

श्रीस्वामिनारायणो विजयतेराम्  
ॐ नमो भगवते वासुदेवाय

**श्रीमद् भागवतमहापुराण  
श्रीव्यासभुनि विरचित गुर्जरानुवाद सहित  
दशम स्कन्ध**

**श्रीमद्भागवतमहापुराणम् दशमस्कन्धः**  
( उत्तरार्थः )

अथ पञ्चाशत्तमोऽध्यायः (५०)

श्रीशुक उवाच

अस्ति प्रामिश्च कंसस्य महिष्यो भरतर्षभ ! । मृते भर्तरि दुःखार्ते ईयतुःस्म पितुर्गृहान् ॥१  
पित्रे मगधराजाय जरासन्धाय दुःखिते । वेदयाञ्चक्रतुः सर्वमात्मवैधव्यकारणम् ॥२  
स तदप्रियमाकर्ण्य शोकामर्षयुतो नृप ! । अयादवीं महीं कर्तुं चक्रे परममुद्यमम् ॥३

- : अथ दशमस्कन्ध उत्तरार्थं प्रारंभ :-

अध्याय ५०

श्रीइष्टो जरासंघथी उरीने पोताना संबंधीओने द्वारका  
मोक्ष्यां.

शुकदेवज्ञ कहे छे हे राजा ! कंसनी अस्ति अने प्राप्ति नामनी बे राणीओ हती, तेओ पोतानो स्वामीभरण पामतां दुःखथी पीडाईने पोताना बापने घेर गई.<sup>१</sup> दुःख पामेली ए बे स्त्रीओअे भगध देशना राजा अने पोताना पिता जरासंघनी पासे, पोताने विधवा थवानुं सर्वे वृतांत कह्युं.<sup>२</sup> हे राजा ! ए अप्रिय वात सांभणी शोक अने कोधथी भराएला जरासंघे पृथ्वीने यादव वगरनी करवा

अक्षौहिणीभिर्विशत्या तिसृभिश्चापि संवृतः । यदुराजधार्नीं मथुरां न्यरुणत् सर्वतोदिशम् ४  
निरीक्ष्य तद्वलं कृष्ण उद्गेलिमिव सागरम् । स्वपुरं तेन संरुद्धं स्वजनं च भयाकुलम् ॥५  
हनिष्यामि बलं होतद् भुवि भारं समाहितम् । मागधेन समानीतं वश्यानां सर्वभूभुजाम् ॥६  
अक्षौहिणीभिः संख्यातं भटाश्वरथकुञ्जरैः । मागधस्तु न हनत्व्यो भूयः कर्ता बलोद्यमम् ८  
एतदर्थोऽवतारोयं भूभारहरणाय मे । संरक्षणाय साधूनां कृतोऽन्येषां वधाय च ॥९  
अन्योऽपि धर्मरक्षायै देहः संभिष्यते मया । विरामायाप्यधर्मस्य काले प्रभवतः क्वचित् ॥१०  
एवं ध्यायति गोविन्द आकाशात् सूर्यवर्धसौ । रथावुपस्थितौ सद्यः समूतौ सपरिच्छदौ ॥११  
आयुधानि च दिव्यानि पुराणानि यदृच्छया । दृष्ट्वा तानि हृषीकेशः सङ्करणमथाब्रवीत् ॥१२

सारु भोटो उद्यम कर्यो<sup>३</sup> त्रेवीश अक्षौहिणी सैन्य साथे लक्ष्मने तेषो यादवोनी राजधानी मथुराने सधणी दिशाओमां घेरी लीधी.<sup>४</sup> आणे मर्यादा मूर्कीने समुद्र आवेलो होय एवा ए सैन्य द्वारा घेराएली पोतानी नगरीने अने भयथी व्यकुण थयेला पोताना संबंधीओने ज्ञेई, कोई पाण प्रयोजनने माटे मनुष्यनी समान जणाता भगवान, ते देशकाणने अनुकूण आवे एवी रीते पोताना अवतारनुं प्रयोजन विचारवा लाभ्या के जरासंधने मूर्की दृष्टि तेनुं सैन्य ज मारवुं के सैन्यने मूर्की दृष्टि एकला जरासंधने ज मारवो अथवा भग्नेने मारवा ? पछी निश्चय कर्यो के पायदण, घोडा, रथ अने हाथीओथी युक्त त्रेवीश अक्षौहिणी ज्ञेटलुं अने पृथ्वीना भारत्प जे सैन्य, पोताना ताबामां रहेनारा सर्वे राजाओ पासेथी जरासंधे आणेलुं छे, ते सैन्यने हुं मारी नाखीश. जरासंधने हमणां मारवो नहीं. कारण के ज्ञवतो हशो तो फरीवार पाण सैन्य लाववानो उद्यम करशे अने एम थशे तो ज पृथ्वीनो भार उतारवो सरल थशे.<sup>५-६</sup> पृथ्वीनो भार उतारवा सारु, साधुओनुं रक्षण करवा सारु अने दुष्ट लोकोने मारवा सारु ज में अवतार धर्यो छे. हुं बीजो अवतार पाण धर्मनी रक्षा करवा सारु अने कोई समये उत्पन्न थता अधर्मनो नाश करवा सारु धरीश.<sup>७</sup> आ प्रभाणे श्रीकृष्ण भगवान विचार करता उता त्यां आकाशमांथी तरत ज सूर्य सरभा तेजवाणा सारथी रहित तथा सरसामान सहित बे रथ उत्तर्या अने पोतानां जूनां दिव्य आयुधो पाण दैव ईश्वाथी उत्तर्या. तेने ज्ञेई भगवाने भलरामने कह्युं के हे मोटाभाई ! जेओना रक्षक तमे छो एवा यादवोने कष्ट आवी पडऱ्युं छे ते जुओ. तमारे माटे आ रथ अने प्यारां आयुधो पाण आव्यां छे, माटे रथमां बेसीने आ सैन्यने मारो अने संबंधीओने कष्टमांथी

પશ્યાર્ય! વ્યસનં પ્રાસં યદૂનાં ત્વાવતાં પ્રભો! એષ તે રથ આયાતો દયિતાન્યાયુધાનિ ચ ॥૧૩  
યાનમાસ્થાય જહેતદ્વયસનાત્સ્વાન્સમુદ્ધર । એતદર્થે હિનૌ જન્મ સાધૂનામીશ! શર્મકૃત ૧૪  
ત્રયોવિશસ્તયનીકાખ્યં ભૂમેર્ભરમપાકુરુ । એવં સમ્મન્ય દાશાહ્યૌ દંશિતૌ રથિનૌ પુરાત ॥૧૫  
નિર્જગમતુઃ સ્વાયુધાઢ્યૌ બલેનાલ્પીયસાડ્વત્તૌ । શદ્ધું દધ્મૌ વિનિર્ગત્ય હરિર્દારુકસારથિ: ૧૬  
તતોડભૂત પરસૈન્યાનાં હંડિ વિત્રાસવેપથુ: । તાવાહ માગધો વીક્ષ્ય હે કૃષ્ણ! પુરુષાધમ! ॥૧૭  
ન ત્વયા યોદ્ધુમિચ્છામિ બાલેનૈકેન લજ્જયા । ગુસેન હિત્વયા મન્દ! ન યોત્વ્યે યાહિ બન્ધુહન ॥૧૮  
તવ રામ! યદિ શ્રદ્ધા યુધ્યસ્વ ધૈર્યમુદ્રહ । હિત્વા વા મચ્છરૈશ્છન્નં દેહં સ્વર્યાહિ માં જહિ ॥૧૯

શ્રીભગવાનુવાચ

ન વै શૂરા વિકત્થને દર્શયન્યેવ પૌરુષમ् । ન ગૃહીમો વચો રાજન્નાતુરસ્ય મુમૂર્ષતઃ ॥૨૦

શ્રીશુક ઉવાચ

જરાસુતસ્તાવભિસૃત્ય માધવૌ મહાબલૌદેન બલીયસાડ્વત્તોત્ ।  
સસૈન્યયાનધ્વજવાજિસારથી સૂર્યાનલૌ વાયુરિવાભરેણુભિઃ ॥૨૧॥

ઉગારો. હે પ્રભુ ! ભાર ઉતારવા સારુ અને સાધુઓને સુખ આપવા સારુ જ આપણું અવતરણ છે. ૧૧-૧૪ માટે પૃથ્વીના આ ત્રૈવીશ અક્ષૌહિણીરૂપ ભારને ઉતારો. આ પ્રમાણે વિચાર કરી શ્રીકૃષ્ણ તથા બળદેવજી કવચ પહેરી, પોતાના આયુધો લઈ, રથમાં બેસી થોડાક સૈન્યની સાથે મથુરામાંથી બહાર નીકળ્યા. દારુક નામના સારથિ સાથે ભગવાને બહાર નીકળી શંખનાદ કર્યો. ૧૫-૧૬ એ શંખના નાદથી શત્રુના સૈન્યોના હદ્યમાં ત્રાસ અને કંપ ઉત્પન્ન થયો. એ બે ભાઈઓને જોઈને જરાસંધે કહ્યું કે હે કૃષ્ણ! હે પુરુષોમાં અધમ! તું બાળક અને એકલો છે, માટે તારી સાથે લાજને લીધે હું યુદ્ધ કરવાને ઈચ્છા નથી. હે મંદબુદ્ધિવાળા! હે બંધુઓને મારનાર ! તું છાનો રહ્યો હતો તેથી તારી સાથે હું યુદ્ધ નહીં કરું, જતો રહે. ૧૭-૧૮ હે બલરામ ! તારી જો ઈચ્છા હોય તો તું યુદ્ધ કર. ધીરજ રાખજો. મારાં બાણોથી કપાઅલા દેહને છોડી સ્વર્ગમાં જી અથવા મને મારી નાખ. ૧૯

ભગવાન કહે છે હે રાજી ! શૂરપુરુષો બકવાદ ન કરે પણ પરાક્રમ જ દેખાડે. જે તું મરવાની અણી ઉપર છે તેથી આતુર બન્યો છે. માટે તારાં વચનનો અમે સ્વીકાર કરતા નથી. ૨૦

શુકદેવજી કહે છે વાયુ જેમ વાદળાંથી સૂર્યને અને ધૂળથી અઞ્જિને ઢાંકી દેતેમ, જરાસંધે સૈન્ય, વાહન, ધ્વજ અને સારથી સહિત એ બે ભાઈઓની પાસે

સુપર્ણતાલધ્વજચિહ્નિતૌ સ્થાવલક્ષ્યન્યો હરિરામયોર્મુદે ।

સ્ત્રિય: પુરાઙ્ગાલકહર્ષયોપુરં સમાશ્રિતા: સંમુહુ: શુચાર્દિતા: ॥૨૨॥

હરિ: પરાનીકપયોમુચાં મુહુ: શિલીમુખાત્યુલ્બણવર્ષપીડિતમ् ।

સ્વસૈન્યમાલોક્ય સુરાસુરાર્ચિતં વ્યસ્ફૂર્જયચ્છાર્દ્ઘશરાસનોત્તમમ् ॥૨૩॥

ગૃહન નિષઙ્ગાદથ સન્દધ્યાત્રાન્ વિકૃષ્ણ મુઞ્ચાંછિતબાણપૂર્ગાન ।

નિઘન રથાન્ કુઝજરવાજિપત્તીન્ નિરન્તર યદ્વદ્લાતચક્રમ્ ॥૨૪॥

નિર્ભિન્નકુમ્ભા: કરિણો નિપેતુરનેકશોડશા શરવૃકણકન્ધરા: ।

રથા હતાશ્રધ્વજસૂતનાયકા: પદાતયાશ્છન્નભુજોરુકન્ધરા: ॥૨૫॥

સંછ્યામાનદ્વિપદેભવાજિનામઙ્ગ્રાસૂતા: શતશોડસૃગાપગા: ।

ભુજાહય: પૂરુષશીર્ષકચ્છપા હતદ્વિપદ્ધીપહયગ્રહાકુલા: ॥૨૬॥

આવીને ભારે બળવાળા પોતાના સૈન્યના સમૂહથી ધેરી લીધા. ૨૧ મથુરાની અગાસીઓ, હવેલીઓ અને દરવાજા ઉપર જોવા ચઢેલી સ્ત્રીઓ ભગવાનના ગરૂડાનિયિન્વાળા રથને અને બળભદ્રના તાલના ચિહ્નવાળા રથને યુદ્ધમાં નહીં દેખતાં શોકથી પીડાઈને મુંજાવા લાગી. ૨૨ પોતાના સૈન્યનું જે મેધો તેના બાણરૂપી મહાભયંકર વૃષ્ટિથી પીડાએલું જોઈ ભગવાને દેવ અને દૈત્યોએ માન આપેલા પોતાના સારંગ નામના ઉત્તમ ધનુષનો મોટો ટંકાર કરી ચમત્કાર દેખાડ્યો. ૨૩ ભગવાન નિરંતર ભાથામાંથી બાણ લેતા હતા, દોરીમાં સાંધતા હતા, દોરી ખેંચી તે સજાવેલા અનેક બાણોને છોડતા હતા અને રથ, હાથી, ઘોડા તથા પાયદળોને મારતા હતા, એ સમયે ઉંબાડિયાના ચકની પેઠે તે ધનુષ લાગતું હતું. ૨૪ જેઓનાં કુંભસ્થળ જેદાઈ ગયાં છે એવા હાથીઓ, બાણોથી જેનાં ગળાં કપાઈ ગયાં છે એવા ઘોડાઓ, જેઓના ઘોડા અને સાથી નાશ પામ્યા છે એવા રથો. અને હાથ, પગ, મસ્તક કપાયા છે એવા અનેક પાયદળો આ યુદ્ધમાં નાશ પામ્યા. ૨૫ અપાર તેજવાળા અને મુશળથી શત્રુઓને મારતા બલરામે માણસ, હાથી, અને ઘોડાનાં શરીર કાપીને લોહીની સેંકડો નદીઓ વહેવડાવી દીધી. એ નદીઓમાં હાથરૂપી સર્પો હતા, માણસોના માથારૂપી કાચબા હતા, હાથીઓરૂપી બેટ હતા, ઘોડારૂપી અનેક જૂડ હતાં, સાથળોરૂપી માછલાં હતાં, માણસના કેશરૂપી સેવાળ હતી, ધનુષરૂપી તરંગ હતા, આયુદ્ધરૂપી ગુચ્છ હતા, ઘાલરૂપી ચકરીઓથી ભયંકર લાગતી હતી, વળી ભારે આભરણ અને મણીઓરૂપી કંકરીઓથી ઉત્તમ લાગતી હતી, એ નદીઓ બીકણ લોકોને ભયંકર

करोरुमीना नरकेशशैवला धनुस्तरङ्गायुधगुल्मसङ्कलाः ।  
अच्छूरिकावर्तभयानका महामणिप्रवेकाभरणाश्मशर्कराः ॥२७॥

प्रवर्तिता भीरुभयावहा मृधे मनस्विनां हर्षकरीः परस्परम् ।  
विनिघ्नतारीन् मुसलेन दुर्मदान् सङ्कर्षणेनापरिमेयतेजसा ॥२८॥

बलं तदङ्गार्णवदुर्गभैरवं दुरन्तपारं मगधेन्द्रपालितम् ।  
क्षयं प्रणीतं वसुदेवपुत्रयोर्विक्रीडितं तज्जगदीशयोः परम् ॥२९॥

स्थित्युद्गवान्तं भुवनत्रयस्य यः समीहतेऽनन्तगुणः स्वलीलया ।  
न तस्य चित्रं परपक्षनिग्रहस्तथापि मर्त्यानुविधास्य वर्णयते ॥३०॥

जग्राह विरथं रामो जरासन्धं महाबलम् । हतानीकावशिष्टासुं सिंहः सिंहमिवौजसा ॥३१  
बध्यमानं हतारातिं पाशैर्वारुणमानुषैः । वारयामास गोविन्दस्तेन कार्यचिकीर्षया ॥३२  
स मुक्तो लोकनाथाभ्यां ब्रीडितो वीरसंमतः । तपसे कृतसङ्कल्पो वारितः पथि राजभिः ॥३३  
वाक्यैः पवित्रार्थपदैर्नयनैः प्राकृतैरपि । स्वकर्मबन्धप्राप्तोऽयं यदुभिस्ते पराभवः ॥३४  
हतेषु सर्वानीकेषु नृपो बाहूद्रथस्तदा । उपेक्षितो भगवता मगधान् दुर्मना यथो ॥३५

अने वीरलोकोने हर्ष आपनारी हती.<sup>२६-२८</sup> हे राजा ! समुद्रनी पेठे हुर्गम अने भयंकर तथा अंत अने पार वगरनुं जरासंधे पाणेलुं सैन्य श्रीकृष्ण तथा भणदेवज्ञाए हुणी नाख्युं. ए केवण जगतना ईश्वरनी कीडामात्र ज छे, ते कांઈ पराक्रम समजवुं नहीं.<sup>२९</sup> अनंत शुश्रवाणा ए ईश्वर पोतानी लीलाथी ज त्रैलोक्यनी उत्पत्ति, स्थिति अने प्रलय करे छे. तेमणे शत्रुना पक्षने शिक्षा करी ए कांઈ आश्वर्यरूप नथी, तोपश मनुष्यनुं अनुकरण करता भगवाननां कर्मोऽज अहीं वर्षवेलां छे नहि के पराक्रम.<sup>३०</sup> जेनो रथ भाँगी पड्यो छे, एवो जरासंध सैन्य मरी जतां केवण प्राण ज अवशेष रह्या हता. बलरामे सिंह जेम चिताने पकडे तेम भणथी जरासंधने पकडी लीधो.<sup>३१</sup> जेशे धणा शत्रुने मार्या हता एवा जरासंधने बलरामे वरुणना तथा माणसोना पाशोथी बांधवा मांडयो, त्यारे तेनी पासे वधारे कार्य करवानी ईश्वराथी भगवाने भाईने वार्या.<sup>३२</sup> जगतना नाथ श्रीकृष्ण तथा बलरामे मूँझी दीधेलो, लज्जा पामेलो अने वीरलोकोमां मान पामेलो जरासंध तप करवानो संकल्प करीने वनमां जतो हतो. पश मार्गमां तेने राजाओ ए धर्मोपदेशनां तथा लोकरीतिनां नीति भरेलां वाक्योथी वार्यो के तमे मोटा छतां तुच्छ यादवोना हाथथी हारी गया ए केवण तमारा पूर्व कर्मोनुं फण छे पश बीजुं कांઈ नथी. माटे तमारे लज्जाईने तप करवा जवुं ए योग्य नथी.<sup>३३-३४</sup> आ वात

मुकुन्दोऽप्यक्षतबलो निस्तीर्णारिबलार्णवः । विकीर्यमाणः कुसुमैस्त्रिदौशैरनुमोदितः ॥३६  
माथुरैरुपसङ्गम्य विज्वरैर्मुदितात्मभिः । उपगीयमानविजयः सूतमागधवन्दिभिः ॥३७  
शङ्खदुन्दुभयो नेदुर्भेरीतूर्याप्यनेकशः । वीणावेणुमृदङ्गानि पुरं प्रविशति प्रभौ ॥३८  
सिक्तमार्गा हृष्णजनां पताकाभिरलङ्काताम् । निर्धुष्टां ब्रह्मघोषेण कौतुकाबद्धतोरणाम् ॥३९  
निचीयमानो नारीभिर्माल्यदध्यक्षताङ्गैः । नरीक्ष्यमाणः सन्तेहं प्रीत्युक्तलितलोचनैः ॥४०  
आयोधनगतं वित्तमनन्तं वीरभूषणम् । यदुराजाय तत् सर्वमाहृतं प्रादिशत्प्रभुः ॥४१  
एवं सप्तदशकृत्वस्तावत्यक्षौहिणीबलः । युध्ये मागधो राजा यदुभिः कृष्णापालितैः ॥४२  
अक्षिणवंस्तद्वलं सर्वं वृष्णायः कृष्णातेजसा । हतेषु स्वेष्वनीकेषु त्यक्तोऽयादरिभिर्भृष्टः ॥४३  
अष्टादशमसंग्रामे आगामिनि तदन्तरा । नारदप्रेषितो वीरो यवनः प्रत्यदृश्यत ॥४४  
रुरोध मथुरामेत्य तिसृभिर्मर्लेच्छकोटिभिः । नूलोके चाप्रतिदृद्धो वृष्णीज्ञुत्वाऽऽत्मसम्मितान्

मनमां उत्तरतां जरासंध क्यवातो क्यवातो भगधेशमां गयो.<sup>३५</sup> पोतानुं सैन्य अभ्यंड रहेतां शत्रुना सैन्यरूपी समुद्रने तरी गयेला भगवान त्यांथी पाइा मथुरामां पधार्या. त्यारे देवताओ वाह वाह ! करीने पुष्पवृष्टिथी वधाववा लाग्या.<sup>३६</sup> शत्रुसंबधी ताप मटी जतां प्रसन्न थयेला मथुराना लोकोनी साथे मणीने सूत, मागध तथा बंदीजनो भगवानना विजयनुं गायन करता हता.<sup>३७</sup> भगवाने ज्यारे मथुरानगरीमां प्रवेश कर्यो त्यारे अनेक शंभ, हुंदुभि, भेरी, तुरी, वीणा आदि वाञ्छिंत्रो वाणी रह्यां हतां.<sup>३८</sup> मथुराना मार्गोमां पाणी छांट्यां हतां, उत्सवने लीषे तोरणो बांध्यां हतां, लोको राज्ञ थता हता, वेद मंत्रनो ध्वनि थतो हतो अने पताकाओ शोभी रह्या हता.<sup>३९</sup> स्त्रीओ भगवानने झूल, दहीं, अक्षत अने अंकुरोथी वधावती हती, अने स्नेह सहित जोती हती.<sup>४०</sup> रणभूमिमां वीरलोकोना आभरणरूपी जे अपार धन पड्युं हतुं ते सर्वे लावीने भगवाने उत्सेनने आप्युं.<sup>४१</sup> पराजय थतां पश आवी रीते अक्षौहिणी सैन्यो लैठने जरासंधे, जेना रक्षक भगवान हता एवा यादवोनी साथे सत्तरवार युद्ध कर्यु.<sup>४२</sup> वारंवार भगवानना प्रभावथी यादवो जरासंधना सर्वे सैन्यने मारी नाखता हता अने मरी गया पैषी छोटी देवाथी जरासंध पाइो जतो हतो.<sup>४३</sup> ए जरासंध संग्राम करवा सारु अढारभी वधत युद्ध करवा आव्यो तेटलामां नारदज्ञाए मोक्लेल काण्यवने यादवोने पोतानो देखाव आप्यो.<sup>४४</sup> मनुष्योमां तेनी सामे कोई पश टक्कर लैठ शक्तो न हतो, एवा काण्यवने यादवोने पोताना जेवा वणवान सांभणीने, त्राण करोड भ्लेष्टोना सैन्यनी साथे आवी मथुराने घेरो धाव्यो.<sup>४५</sup>

तं दृष्ट्वा चिन्तयत् कृष्णः सङ्कर्षणसहायवान् । अहो यदूनां वृजिनं प्राप्तं ह्युभयतो महत् ॥४६  
 यवनोऽयं निरुच्येऽस्मानद्य तावन्महाबलः । मागधोऽप्यद्य वा श्वो वा परश्वो वाऽगमिष्यति ॥  
 आवयोर्युध्यतोरस्य यद्यागन्ता जरासुतः । बन्धून् वधिष्यत्यथवा नेष्ठते स्वपुरं बली ॥४८  
 तस्मादद्य विधास्यामो दुर्गं द्विपददुर्गमम् । तत्र ज्ञातीन् समाधाय यवनं धातयामहे ॥४९  
 इति सम्मन्य भगवान् दुर्गं द्वादशयोजनम् । अन्तःसमुद्रे नगरं कृत्स्नाद्वृतमचीकरत् ॥५०  
 दृश्यते यत्र हि त्वाष्ट्रं विज्ञानं शिल्पनैपुणम् । रथ्याचत्वरवीथीभिर्यथावास्तु विनिर्मितम् ॥  
 सुरद्रुमलतोद्यानविचित्रोपवनान्वितम् । हेमशूद्धैर्दिविस्पृशिभिः स्फाटिकाद्वालगोपुरैः ॥५२  
 राजतारकुटैः कोष्ठैर्मकुम्भैरलड्कैः । रत्नकूटैर्गृहैर्मैर्महामरकतस्थलैः ॥५३  
 वास्तोष्टीनां च गृहैर्वलभीभिश्च निर्मितम् । चातुर्वर्ण्यजनाकीर्णं यदुदेवगृहोल्लस्त् ॥५४  
 सुधर्मा पारिजातं च महेन्द्रः प्राहिणोद्धरेः । यत्र चावस्थितो मर्त्यो मर्त्यधर्मैर्न युज्यते ॥५५  
 श्यामैकरणान् वरुणो हयाज्ञुक्त्वान् मनोजवान् । अष्टौ निधिपतिः कोशान् लोकपालो निजोदयान्  
 यवनने ज्ञोर्ध श्रीकृष्ण बण्डेवज्ञनी साथे विचार कर्यो के अहो ! ! यादवोने बन्धे  
 बाजुथी भोटुं हुः ख प्राप्त थयुं छे ॥५६ आज तो आ भोटा बणवाणा यवने आपशने  
 धेरो धात्यो छे, त्यां जरासंध पण बे त्रण दिवसनी अंदर आवशे ॥५७ आपशे  
 बन्धेभाईओ यवननी साथे युद्ध करता ज्ञोर्धशुं अने त्यां ज्ञे जरासंध आवशे तो  
 आपणा संबंधीओने मारी नाखशे अथवा पोताना पुरमां लई जशे ॥५८ माटे  
 अत्यारे भनुध्योथी ज्ञई शकाय नहीं ऐवो किल्वो बनावीशुं. ऐ किल्वामां आपणा  
 संबंधीओने राखी पधी यवनने मारीशुं ॥५९ आ प्रभाणे विचार करी भगवाने  
 समुद्रनी अंदर बार योजननुं अने सर्वे सगवडवाणुं अद्भुत नगर बनाव्युं ॥६०  
 ऐ द्वारका नगरीमां विश्वकर्मनी यातुरी अने कणा देखाती हती, धरनी रयनाने  
 अनुकूण आवे ऐवी रीते राजमार्ग, उपमार्ग अने आंगणां कर्या हतां ॥६१ देवताई  
 वृक्ष अने वेलीओवाणी वाडीओ अने विचित्र बगीचाओ शोभी रखा हता, अत्यंत  
 ऊंची स्फटिकमणिनी अगासीओ अने द्वारो उपर सोनानां ईडां हतां ॥६२ घोणशाण  
 रुपानी अने पितणनी करी सोनाना कुंभोथी शाष्णगारी हती. भोटा मरकतमणिनां  
 स्थणवाणां सोनानां धरोनां शिखर माणेक आहिं रत्नोथी कर्या हतां ॥६३ देवताओनां  
 मंदिर अने अगासीओनी भारे रयना करी हती, ऐ द्वारकामां चारे वार्णना लोको  
 रहेता हता अने राजाना अनेक धरोथी शोभी रही हती ॥६४ ईंद्रे भगवानने माटे  
 सुधर्मासभा अने पारिजातकनुं झाड मोकल्युं हतुं के ज्यां रहेनारा माणसोने  
 भुभ अने तरस आहिं देहना धर्मो प्राप्त थता न हता ॥६५ वरुणादेवे धोणा, मन

यद् यद् भगवता दत्तमाधिपत्यं स्वसिद्धये । सर्वं प्रत्यर्पयामासुर्हरौ भूमिगते नृप ! ॥५७  
 तत्र योगप्रभावेण नीत्वा सर्वजनं हरिः । प्रजापालेन रामेण कृष्णः समनुमंत्रितः ।

निर्जगम पुरद्वारात् पद्ममाली निरायुधः ॥५८

इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे उत्तरार्थं  
 दुर्गनिवेशनं नाम पञ्चाशतमोऽध्यायः ॥५९॥

### अथैकपञ्चाशतमोऽध्यायः (५९)

॥ श्रीशुकउवाच ॥

तं विलोक्य विनिष्ठांतमुज्जिहानमिवोङ्गुपम् । दर्शनीयतमं श्यामं पीतकौशेयवाससम् ॥१  
 श्रीवत्सवक्षसं भ्राजत्कौस्तुभामुक्तकन्धरम् । पृथुदीर्घचतुर्बाहुं नवकज्जारुणेक्षणम् ॥२  
 नित्यप्रमुदितं श्रीमत्सुकपोलं शुचिस्मितम् । मुखारविन्दं बिभ्राणं स्फुरन्मकरकुण्डलम् ॥३

सरभा वेगवाणा अने एक कान जेनो काणो हतो ऐवा घोडा भोकल्या. कुबेरज्ञ अे  
 पोतानी विभूतिरूप आठ भंडार मोकल्या ॥५६ हे राजा ! भगवाने ऐ देवताओना  
 पोताना अधिकारनी सिद्धिने माटे तेओने ज्ञे ज्ञे कांड अश्वर्य आप्युं हतुं ते भगवान  
 पृथ्वी उपर पधारतां भगवानने पाढुं आप्युं ॥५७ भगवान पोताना योगना  
 प्रभावथी अे नगरमां सर्वे संबंधीओने लई गया. पृष्ठी प्रजानुं पालन करवा  
 बण्डेवज्ञने राखी, भगवान हथियार विना मात्र कमणनी माणा पहेरीने  
 नगरीना द्वारमांथी भहार नीकल्या ॥५८

इति श्रीमद् महापुराणा भागवतना दशम स्कंधनो पद्माशमो अद्याय संपूर्णः

### अद्याय ५१

मुयुकुंद राजनी दृष्टे द्वारा काणयवननो नाश करावता तथा  
 स्तुति करता मुयुकुंदराजा उपर झूपा करता श्रीकृष्ण भगवान.

शुकदेवज्ञ कुहे छे हे राजा ! अत्यंत सुंदर श्याम, पीणां वस्त्रवाणा,  
 वक्षःस्थणमां लक्ष्मीनां चिर्णवाणा, कंठमां जग्नहणता क्षौस्तुभ मणिथी शोभता,  
 पुष्ट अने लांबा चारे हाथवाणा, कमणनी पांखडी समान नेत्रवाणा अने जेनुं  
 मुखारविन्द निरंतर आनंदवाणुं, शोभायुक्त, सारा गालवाणुं, सुंदर हास्य तथा  
 चणकतां भकाराकृति कुंडलवाणुं हतुं ऐवा भगवान ऊगता चंद्रमानी पेठे

वासुदेवो ह्ययमिति पुमाज्ञीवत्सलाज्ञनः । चतुर्भुजोऽरविन्दाक्षो वनमाल्यतिसुन्दरः ॥४  
लक्षणैर्नारदप्रौक्तैर्नार्यो भवितुमर्हति । निरायुधश्शलन् पद्मयां योत्स्येऽनेन निरायुधः ॥५  
इति निश्चित्य यवनः प्राद्रवनं पराङ्मुखम् । अन्वधावज्जियक्षुस्तं दुरापमपि योगिनाम् ॥६  
हस्तप्रासमिवात्मानं हरिणा स पदे पदे । नीतो दर्शयता दूरं यवनेशोऽद्रिकन्दरम् ॥७  
पलायनं यदुकुले जातस्य तव नोचितम् । इति क्षिपन्ननुगतो नैनं प्रापाहताशुभः ॥८  
एवं क्षिसोऽपि भगवान् प्राविशद् गिरिकन्दरम् । सोऽपि प्रविष्टस्तत्रान्यं शयानं दृशे नरम् ॥९  
नन्वसौ दूरमानीय शेते मामिह साधुवत् । इति मत्वाच्युतं मूढस्तं पदा समताडयत् ॥१०  
स उत्थाय चिरं सुमः शनैरुन्मील्य लोचने । दिशो विलोकयन् पाशर्वं तमद्राक्षीदवास्थितम् ॥११  
स तावत्स्य रुष्टस्य दृष्टिपातेन भारत! । देहजेनाग्निना दग्धो भस्मसादभवत् क्षणात् ॥१२

## राजोवाच

को नाम स पुमान् ब्रह्मन्! कस्य किंवीर्य एव च । कस्माद् गुहां गतः शिश्ये किन्तेजो यवनार्दनः

नगरमांथी भडार आव्या, तेने ज्ञेई काण्यवने विचार्यु के नारदज्ञाए कुहेलां  
लक्षणं प्रमाणे श्रीवत्सना चिर्कवाणो, कमण सरभा नेत्रवाणो, वनमाणाने धरनार  
अने अत्यंत सुंदर आ पुरुष ज वसुदेवनो पुत्र कृष्ण छोवो ज्ञेई, बीजो न  
होवो ज्ञेई। आ कृष्णनी पासे आयुध नथी अने पगपाणो चाले छे, माटे हुं  
पश आयुध विना अने पगपाणो चालीने आनी साथे युद्ध करीश.<sup>१४</sup> आवो निश्चय  
करी ए यवन, पाढुं मुख राखीने भागता अने योगीओ पश जेने पहोंची शक्ता  
नथी ऐवा भगवानने पकडवा सारु पछवाडे दोड्यो。<sup>५</sup> पगले पगले पोतानो  
हाथ पहोंची जाय तेटला ज दूर देखाता भगवान ए काण्यवनने घणे छेटे पर्वतनी  
गुझामां लई गया。<sup>६</sup> तुं यद्युकुणमां जन्मेलो छे माटे तारे भागवुं योग्य नथी, अमे  
तिरस्कार करतो अने जेनां अशुभ कर्म क्षीण थयां न हतां ऐवो ए काण्यवन  
भगवाननी पछवाडे दोडतो गयो, तोपश भगवानने पहोंची शक्यो नहीं।<sup>७</sup>  
भगवान तिरस्कार कराया छतां पश पर्वतनी गुझामां पेसी गया, एटले  
काण्यवन पश पछवाडे पेठो. त्यां तेषो बीजा नरने सूतेलो दीठो。<sup>८</sup> काण्यवने  
भूलथी विचार्यु के आ कृष्ण भने दूर लावीने अहीं साधुनी पेठे सूर्ई गयो छे. आ  
प्रमाणे सूतेला नरने भगवान मानीने काण्यवने लात मारी。<sup>९</sup> घणा काण पहेलां  
सूर्ई रहेलो ते पुरुष लात वागवाथी उठीने धीरे धीरे आंखो उघाडी चारेकोर  
जोवा लाग्यो, त्यां तेषो पडभामां उभेला काण्यवनने दीठो。<sup>१०</sup> कोध पामेला  
मुयुकुण्ड राजनी दृष्टि पडतां ज उत्पन्न थयेला अग्निथी बणी गयेलो काण्यवन

## श्रीशुक उवाच

स इक्ष्वाकुकुले जातो मान्धातृतनयो महान् । मुचुकुन्द इति ख्यातो ब्रह्मण्यः सत्यसङ्गः ॥४  
स याचितः सुरगणैरिन्द्रायैरात्मरक्षणे । असुरेभ्यः परित्सैस्तद्रक्षां सोऽकरोच्चरम् ॥५  
लब्ध्वा गुहं ते स्वःपालं मुचुकुन्दमथाब्रुवन् । राजन्! विरमतां कृच्छ्रद् भवान् नः परिपालनात् ॥६  
नरलोके परित्यज्य राज्यं निहतकण्टकम् । अस्मान् पालयतो वीर! कामास्ते सर्वं उज्ज्ञताः ॥७  
सुता महिष्यो भवतो ज्ञातयोऽमात्यमन्त्रिणः । प्रजाश्च तुल्यकालीया नाधुना सन्ति कालिताः ॥८  
कालो बलीयान् बलिनां भगवानीश्वरोऽव्ययः । प्रजाः कालयते ऋडन् पशुपालो यथा पश्नून्  
वरं वृणीष्व भद्रं ते ऋते कैवल्यमद्य नः । एक एवेश्वरस्तस्य भगवान् विष्णुरव्ययः ॥१०  
एवमुक्तः स वै देवानभिवन्द्य महायशा: । अशयिष्ट गुहाविष्टे निद्रया देवदत्तया ॥११  
स्वापं यातं यस्तु मध्ये बोधयेत्त्वामचेतनः । स त्वया दृष्टमात्रस्तु भस्मीभवतु तत्क्षणात् ॥१२

भस्म थई गयो.<sup>१२</sup>

परीक्षित राजा पूछे छे हे महाराज ! ए यवनने बाणी देनोरो पुरुष कोण  
हतो ? कोना वंशनो हतो ? केवा प्रभाववाणो हतो ? कोनो पुत्र हतो ? अने  
गुझामां जईने शा माटे सूतो हतो ?<sup>१३</sup>

शुक्देवज्ञ कुहे छे ईक्ष्वाकुना कुण्डमां जन्मेलो, मांधाता राजानो दीक्करो,  
ध्रामणोने देवनी पेठे माननार अने साची प्रतिज्ञावाणो ए मुयुकुण्ड नामनो राजा  
हतो。<sup>१४</sup> हेत्योथी त्रास पामेला ईद्राइक देवताओ पोताना रक्षण माटे प्रार्थना  
करतां तेषो देवताओनी घणा दिवस सुधी रक्षा करी हती。<sup>१५</sup> पछी देवताओने  
'कार्तिकेय स्वामी' सेनापति भणतां, तेओओ मुयुकुण्डने कहुं के हे राजा ! हवे तमे  
अमारुं पालन करवानो परिश्रम छोडी दो。<sup>१६</sup> हे वीर ! तमे मनुष्यलोकमां पोतानुं  
निष्कंटक राज्य छोडी दृष्टि अमारुं पालन करतां तमारां सर्वे सुख गयां छे。<sup>१७</sup>  
तमारा पुत्रो, राणीओ, अने ज्ञातिज्ञो तथा मंत्रीओ अने ते समयनी प्रजाओ  
काणथी नाश पामतां हमणां एके अवशेष नथी。<sup>१८</sup> गोवाण जेम पशुओने आमतेम  
फेरवे तेम बणवानोमां श्रेष्ठ अने अविनाशी ईश्वररूप काण पश पोतानी कीडाथी  
प्रजाओने आमतेम फेरवे छे。<sup>१९</sup> तमारुं कल्याण थाओ अने आज अमारी पासेथी  
मोक्ष विना बीजो वर माणी ल्यो, मोक्षना स्वामी तो एक अविनाशी भगवान  
विष्णु ज छे。<sup>२०</sup> आ प्रमाणे देवताओ कुहेतां मोटी क्रीतिवाणा ते मुयुकुण्डे देवताओने  
पगे लागीने श्रमथी थाकी जवाने लीधे निन्द्रा माणी, अने वयन लीधुं के "हे देवताओ !  
जे कोई वयमां मारी निन्द्रानो भंग करे, ते तरत बणीने भस्म थाय." देवताओये

યવને ભસ્મસાંત્રીતે ભગવાન् સાત્વતર્ષભઃ । આત્માનં દર્શયામાસ મુચુકુન્દાય ધીમતે ॥૨૩  
તમાલોક્ય ઘનશ્યામં પીતકૌશેયવાસસમ् । શ્રીવત્સવક્ષસં ભ્રાજત્કૌસ્તુભેન વિરાજિતમ् ॥૨૪  
ચતુર્ભુજં રોચમાનં વૈજયન્યા ચ માલયા । ચારુપ્રસન્નવદનં સ્ફુરન્મકરકુણ્ડલમ् ॥૨૫  
પ્રેક્ષણીયં નૂલોકસ્ય સાનુરાગસ્મિતેક્ષણમ् । અપીચ્યવયસં મત્તમૃગેન્દ્રોદારવિક્રમમ् ॥૨૬  
પર્યપૃછ્છન્મહાબુદ્ધિસ્તેજસા તસ્ય ધર્ષિતઃ । શઙ્કિતઃ શનકૈ રાજા દુર્ધર્ષમિવ તેજસા ॥૨૭

## મુચુકુન્દ ઉવાચ

કો ભવાનિહ સમ્પ્રાસો વિપિને ગિરિગ્રહે । પદ્ભ્યાં પદ્મપલાશાભ્યાં વિચરસ્યુરુકણ્ટકે ॥૨૮  
કિંસ્વિતેજસ્વિનાં તેજો ભગવાન् વા વિભાવસુ: । સૂર્ય: સોમો મહેન્દ્રો વા લોકપાલોઽપરોઽપિ વા  
મન્યે ત્વાં દેવદેવાનાં ત્રયાણાં પુરુષર્થભમ् । યદ્ બાધસે ગુહાધ્વાનં પ્રદીપ: પ્રભયા યથા ॥૩૦  
શુશ્રૂષતામવ્યલીકમસ્માકં નરપુઙ્ગવ! । સ્વજનમ કર્મ ગોત્રં વા કથ્યતાં યદિ રોચતે ॥૩૧  
વયં તુ પુરુષવ્યાધ ઐક્ષવાકા: ક્ષત્રબન્ધવઃ । મુચુકુન્દ ઇતિ પ્રોક્તો યોવનાશ્વાત્મજઃ પ્રભો! ૩૨  
ચિરપ્રજાગરશ્રાન્તો નિદ્રયોપહતેન્દ્રિયઃ । શયેઽસ્મિન् વિજને કામં કેનાષ્ટુથાપિતો�ધુના ॥૩૩  
સોઽપિ ભર્મસીકૃતો નૂનમાત્મીયેનૈવ પાપ્મના । અનન્તરં ભવાજ્ઞીમાન્ લક્ષ્મિતોઽમિત્રશાતન: ૩૪

તે સ્વીકાર્યું. તેથી તે રાજા દેવોએ આપેલી નિદ્રાથી ગુફામાં જઈને સૂર્ય રહ્યા હતા. ૩૧-  
૩૨ દેવતાઓએ તેને કહ્યું હતું કે તું સૂરો હોઈશ ત્યારે વચ્યમાં જે કોઈ તને જગાડશે  
તે પ્રાણી તારી દષ્ટિ પડતાં જ તરત પ્રાણ રહિત થઈને ભસ્મ થઈ જશે. ૩૩ આ  
પ્રમાણે શ્રીકૃષ્ણ ભગવાને કાળયવનને ભસ્મ કરાવી નાખ્યો પછી મુચુકુંદને પોતાનું  
દર્શન આપ્યું. ૩૪ ઘનશ્યામ, પીળાં રેશમી વસ્ત્રવાળા, ચારભુજવાળા, વૈજયંતી  
માળાથી શોભતા, સુંદર તથા પ્રસન્ન મુખવાળા, સ્નેહ ભરેલા મંદહાસ્યથી જોતા  
અને સિંહની પેઠે ઉદાર પરાક્રમવાળા, તે ભગવાનને જોઈ તેમના તેજથી અંજાઈ  
ગયેલા અને શંકા પામેલા તે બુદ્ધિમાન રાજાએ આ પ્રમાણે પૂછ્યું. ૩૫-૩૬ મુચુકુંદ  
પૂછે છે અહીં આવેલા તમે કોણ છો? વનમાં અને તેમાં પણ ઘણા કાંઠવાળા  
પર્વતના વિષમ પ્રદેશમાં કમળની પાંખડીઓ સરખા ચરણથી ફરો છો. ૩૭ તમે  
તેજસ્વી લોકોનું તેજ છો? અભિનદેવ છો? સૂર્ય, ચંદ્ર કે બીજા કોઈ લોકપાળ  
છો? ૩૮ હે દેવ! તમે પોતાની કાંતિથી દીવાની પેઠે ગુફાના અંધકારને મટાડો છો,  
માટે હું ધારું છું કે, ત્રણ મોટા દેવમાના વિષણુ છો. ૩૯ હે મનુષ્યોમાં ઉત્તમ! જો  
તમારી રૂચિ હોય તો પોતાના જન્મ, કર્મ અને વંશની વાત કહો. કારણ કે અમે  
સાંભળવા ઈચ્છાએ છીએ, ૩૧ હે પુરુષોમાં સિંહ! અમો ઈક્ષવાકુવંશના ક્ષત્રિયો  
છીએ, હું માન્ધાતાનો દીકરો મુચુકુંદ નામથી ઓળખાઉં છું. ૩૩ ઘણા કાળના

તેજસા તેજવિષ્ણેણ ભૂરિ દ્રષ્ટું ન શક્નુમઃ । હતૌજસો મહાભાગ માનનીયોઽસિ દેહિનામ् ॥૩૫  
એવં સમ્ભાષિતો રાજા ભગવાન્ ભૂતભાવનઃ । પ્રત્યાહ પ્રહસન્ વાણ્યા મેઘનાદગભીરયા ॥૩૬  
શ્રીભગવાનુવાચ

જન્મકર્મભિધાનાનિ સન્તિ મેઽઙ્ગ! સહસ્રશા: । ન શક્યન્તેઽનુસંખ્યાતુમનત્તવાન્મયાપિ હિ ૩૭  
ક્રચિદ્ ર્જાંસિ વિમને પાર્થિવાન્યુરુજમભિ: । ગુણકર્માભિધાનાનિ ન મે જન્માનિ કર્હિચિત ૩૮  
કાલત્રયોપપત્રાનિ જન્મકર્માણ મે નૃપ! । અનુક્રમન્તો નૈવાનં ગચ્છન્તિ પરમર્થયઃ ॥૩૯  
તથાપ્યદ્વાતનાન્યઙ્ગ ! શૃણુષ્વ ગદતો મમ । વિજ્ઞાપિતો વિરિઝ્ઞેન પુરાં ધર્મગુસ્યે ।

ભૂમેભરાયમાણામસુરાણાં ક્ષયાય ચ ॥૪૦  
અવતીર્ણો યદુકુલે ગૃહ આનકદુનુભે: । વદન્તિ વાસુદેવેતિ વસુદેવસુતં હિ મામ् ॥૪૧  
કાલનેમિહિત: કંસ: પ્રલમ્બાદ્યાશ્ સદ્દ્વિષ: । અયં ચ યવનો દગ્ધો રાજસ્તે તિગમચક્ષુષા ૪૨  
સોઽહં તવાનુગ્રહાર્થ ગુહમેતામુપાગતઃ । પ્રાર્થિત: પ્રચુરં પૂર્વ ત્વયાં ભક્તવત્તસલ: ॥૪૩  
વરાન્ વૃણીષ્વ રાજર્ણે સર્વાન્ કામાન્ દવામિતે । માં પ્રપત્રો જન: કશ્ચિત્ત્ર ભૂયોર્હિતિ શોચિતુમ્ ૪૪

ઉજાગરથી થાકીને નિદ્રાથી ઈંદ્રિયો પરવશ થતાં આ એકાંત સ્થળમાં સુખેથી સૂર્ય  
રહ્યો હતો, ત્યાં હમણાં કોઈએ મને જગાડ્યો. ૩૪ એ જગાડનાર પણ પોતાના  
પાપથી જ ભર્મ થઈ ગયો. તે પછી શત્રુઓને મારનાર શોભાયમાન આપ જોવામાં  
આવ્યા છો. ૩૫ હે ભાગ્યશાળી! તમારા અસહ્ય તેજથી અંજાઈ જવાને લીધે હું  
તમને સારી રીતે જોઈ શકતો નથી, તમે પ્રાણીઓને માન દેવા યોગ્ય છો. ૩૬

શુક્રદેવજી કહે છે આ પ્રમાણે રાજાએ કહ્યું, એટલે જગતને પાળનાર  
ભગવાન હસીને મેઘના નાદ સરખી ગંભીર વાણીથી આ પ્રમાણે બોલ્યા. ૩૭

શ્રી ભગવાન કહે છે હે રાજા! મારા જન્મ, કર્મ અને નામ હજારો છે.  
અનંત હોવાને લીધે તેઓની સંખ્યા મારાથી પણ કહી શકતી નથી. ૩૮ કોઈ પુરુષ  
ઘણા જન્મોથી પૃથ્વીના ૨૯ક્ષણને પણ ગણી શકે, પરંતુ મારા ગુણા, કર્મ, નામ  
અને જન્મને કદી ગણી શકે નહીં. ૩૯ હે રાજા! ત્રણકાળમાં થતા મારા જન્મ અને  
કર્માને મોટા મોટા ઋષિઓ ગણ્યા કરે છે, તોપણ તેઓ પાર પામતા નથી. ૪૦ તો  
હમણાંના જન્મો અને કર્મો કહું છું તે સાંભળો. પ્રથમ ધર્મના રક્ષણને માટે અને  
પૃથ્વીને ભારતુપ થયેલા અસુરોનો ક્ષય કરવાને માટે બ્રહ્માની પ્રાર્થનાથી હું  
યદુકુણમાં વસુદેવના ઘરમાં અવતરેલો છું. હું વસુદેવનો પુત્ર છું તેથી મને  
“વાસુદેવ” કહે છે. ૪૧-૪૨ જે કંસ પૂર્વ જન્મમાં કાલનેમિ દેત્ય હતો તેને અને  
પ્રલભાસુર આદિ બીજા શત્રુઓને મે માર્યા અને હે રાજા! આ યવનને તમારાં

श्रीशुक उवाच

इत्युक्तसं प्रणम्याह मुचुकुन्दो मुदाचितः । ज्ञात्वा नारायणं देवं गर्गवाक्यमनुस्मरन् ॥४५

मुचुकुन्द उवाच

विमोहितोऽयं जन ईश ! मायया त्वदीयया त्वां न भजत्यनर्थदृक् ।  
सुखाय दुःखप्रभवेषु सज्जते गृहेषु योषित् पुरुषश्च वञ्चितः ॥४६॥

लब्ध्वा जनो दुर्लभमत्र मानुषं कथञ्चिदव्यङ्गमयतोऽनघ ! ।  
पादारविन्दं न भजत्यसन्मतिर्गृहास्थकूपे पतितो यथा पशुः ॥४७॥

ममैष कालोऽजित ! निष्कलो गतो राज्यश्रियोन्नद्यमदस्य भूपतेः ।  
मर्त्यांत्मबुद्धेः सुतदारकोशभूष्णासज्जमानस्य दुरन्तचिन्तया ॥४८॥

कलेवरेऽस्मिन् घटकुड्यसन्निभे निस्तुष्टमानो नरदेव इत्यहम् ।  
वृतो रथेभाश्वपदात्यनीकपैर्गां पर्यटस्त्वागणयन् सुदुर्मदः ॥४९॥

प्रमत्तमुच्चैरितिकृत्यचिन्तया प्रवृद्धलोभं विषयेषु लालसम् ।  
त्वमप्रमत्तः सहसाभिपद्यसे क्षुलेलिहानोऽहिरिवाखुमन्तकः ॥५०॥

तीक्ष्ण यक्षुथी बाणी नभाव्यो ॥४३ हुं भक्तो उपर प्रेम राखनार छुं, तमे पूर्वे धणी भक्ति करी राजा, तेथी तमारा उपर अनुग्रह करवाने माटे आ गुफामां आव्यो छुं ॥४४ हे राजा ! वर मागो, तमारी सर्वे ईरच्छा पूर्ण करुं, मने शरण थयेलो कोई पाण पुरुष फरीवार संताप पामवाने योग्य ज रहेतो नथी ॥४५

शुकदेवज्ञ कहे छे आ प्रमाणे भगवाननां वयन सांभणी, आनंद पामेला मुचुकुंदे पोताने वृद्ध गर्गमुनिनां वयननुं स्मरण आवतां, तमने नारायणदेव जाणीने आ प्रमाणे स्तुति करी ॥४६

मुचुकुंद स्तुति करे छे हे ईश्वर ! तमारी मायाथी मोह पामवाने लीधे तमारा वास्तविक स्वरूपने नहीं जाणनारा आ स्त्रीओ अने पुरुषोरुपी सर्वलोको तमने भजता नथी, अने एकभीजाथी ठगाईने जे धर दुःखनुं ज स्थानक छे, तेमां सुखनी ईरच्छाथी बंधाई रहे छे ॥४७ हे निर्दोष ! आ कर्मभूमिमां करोडे उद्यमथी पाण न मणे एवो अने तेमां वणी सर्वे परिपूर्ण अवयववाणो मनुष्यदेह प्रयत्न वगर प्राम थया छां, पशुनी पेठे विषयसुखमां ज प्रीति राखनारा अने धरउपी ऊंडी खाडमां पडेला लोको तमारा चरणारविंदने भजता नथी ॥४८ हे प्रभु ! हुं राज्य लक्ष्मीथी मदोन्मत्त थयेलो अने देहेने आत्मा करी माननार अने अपार चिंताथी पुत्र, स्त्रीओ, भंडार अने पृथ्वीमांज आसक्त थई रहेलो राजा छुं.

पुरा रथैर्हेमपरिकृतैश्चरन् मतद्वजैर्वा नरदेवसंज्ञितः ।  
स एव कालेन दुरत्ययेन ते कलेवरो विट्कूमिभस्मसंज्ञितः ॥५१॥

निर्जित्य दिक्षक्रमभूतविग्रहो वरासनस्थः समराजवन्दितः ।  
गृहेषु मैथुन्यसुखेषु योषितां ऋद्वामृगः पूरुष ईश ! नीयते ॥५२॥

करोति कर्माणि तपस्मुनिष्ठिते निवृत्तभोगस्तदपेक्षया ददत् ।  
पुनश्च भूयेयमहं स्वराडिति प्रवृद्धतर्षो न सुखाय कल्पते ॥५३॥

भवापवर्गो भ्रमतो यदा भवेज्जनस्य तर्ह्यच्युत ! सत्समागमः ।  
सत्सङ्गमो यर्हि तदैव सद्गतौ परावरेण त्वयि जायते मतिः ॥५४॥

मन्ये ममानुग्रह ईश ! ते कृतो राज्यानुबन्धापगमो यदृच्छ्या ।  
यः प्रार्थते साधुभिरेकवर्यया वनं विविक्षद्विरखण्डभूमिपैः ॥५५॥

मारो आटलो काण व्यर्थ गयो छे ॥५६ धाडा अने भींत सरभा क्षणाभंगुर आ जड देहमां, हुं राजा छुं, ऐवुं दृढ अभिमान धरावनार अने रथ, हाथी, धोडा, तथा पायदणोना सेनापितिओथी वीटाईने, तमने नहीं गाणकारतां, पृथ्वी पर फरनार हुं आटला समय सुधी मदोन्मत्त थई रह्यो हतो ॥५७ आ कार्य करवुं छे, हजु आ कार्य करवुं छे. एवी चिंताथी गाँल रहेनार, मनोरथो भांगी जवा छां पण विषयोमां उत्कंठावाणो अने मनोरथो प्राम थाय तो वणी जेने तृष्णा वधती जाय छे, एवा मनुष्यने जेम भूखथी गलोझां चाटतो सर्प उंदरने झडपमां ले छे, तेम अप्रमत्त काणउपी तमे झडपमां लई ल्यो छो ॥५८ प्रथम राजा ऐवुं नाम धारी, जे देह सोनाथी शशगारेला रथोथी अने हाथीओथी फरतो होय, ते ज देह टाण्यो टणे नहीं एवा काणउप आप प्राम थतां, अंते कोई खाई जाय तो 'विष्टा' ऐवुं नाम धारण करे छे, पड्यो रहे तो 'कीडा' ऐवुं नाम धारण करे छे अने बाणी नाखवामां आवे तो 'भस्म' ऐवुं नाम धारण करे छे ॥५९ हे ईश्वर ! सर्वे दिशाओने ज्ञती लेवाथी जेने कोई संग्राम करवो रह्यो न होय एवो, उत्तम सिंहासन पर बेठेलो अने सर्वे राजाओ जेने प्रश्नाम करता होय एवो पुरुष पण, मात्र मैथुनां ज सुखवाणां धरोमां स्त्रीओनो कीडामृग थईने, मदारीना वांदरानी पेठे चारेकोर रङ्गे छे ॥६० प्रथम राज्य मेणववानी ईरच्छाथी तप करवामां निष्ठा राखी भोग भोगववानुं छोडी दे छे अने जे पोता पासे होय ते आपी दे छे. पछी राज्य मणतां वणी बीजा जन्ममां हुं चकवर्ती थाउं, एवी तृष्णा वधवाथी सुख भोगववानो अवसर ज मणतो नथी ॥६१ हे भगवन् ! संसारमां भटक्या करता

न कामयेऽन्यं तव पादसेवनादकिञ्चनप्रार्थ्यतमाद् वरं विभो !  
आराध्य कस्त्वा ह्यपर्वगदं हरे ! वृणीत आर्यो वरमात्मबध्नम् ॥५६॥  
तस्माद् विसृज्याशिष ईश ! सर्वतो रजस्तमः सत्त्वगुणानुबन्धनाः ।  
निरञ्जनं निर्गुणमद्वयं परं त्वां ज्ञसिमात्रं पुरुषं व्रजाम्यहम् ॥५७॥  
चिरमिह वृजिनार्तस्तप्यमानोऽनुतापैरवितृष्णुषडमित्रोऽलब्धशान्तिः कथञ्चित् ।  
शरणद ! समुपेतस्त्वत्पदाब्जं परात्मन्नभयमृतमशोकं पाहि माऽपन्नमीश ! ॥५८॥

## श्रीभगवानुवाच

सार्वभौम ! महाराज ! मतिस्ते विमलोर्जिता । वरैः प्रलोभितस्यापि न कामैर्विहता यतः ॥५९  
प्रलोभितो वरैर्यत्त्वमप्रमादाय विद्धिं तत् । न धीर्मय्येकभक्तानामाशीर्भिर्भिद्यते ऋचित् ६०  
युञ्जनानामभक्तानां प्राणायामादिभिर्भिनः । अक्षीणवासनं राजन् ! दृश्यते पुनरुत्थितम् ६१

माणसने तमारा अनुग्रहथी ज्यारे बंधननो अंत आव्यो होय, त्यारे तेने  
साधुलोकोनो समागम मणे छे, अने त्यारे ज सत्पुरुषोनी गतिरूप अने कार्य  
तथा कारणाना नियंता ऐवा तमारे विषे भक्ति प्राप्त थाय छे.<sup>५५</sup> हे ईश्वर ! भने  
तो आपोआप यद्यस्याथी ज राज्यादिकनो संबंध छूटी गयो छे, ऐ तमारो मारा  
उपर मोटो अनुग्रह थयो छे. ऐम मानु छुं; केमके सर्वथी अलग थर्ठने वनमां  
ज्वानी ईस्या करता उत्तम यक्षवर्ती राजाओ पश पोताथी ऐ संबंधने नहीं  
छोडी शकातां ते छोडवानी प्रार्थना ज करे छे.<sup>५६</sup> हे प्रभु ! तमारा यरणानु सेवन,  
के जेने देहाभिमान रहित पुरुषो बहु ज माझ्या करे छे, ते विना कोईपश वरने  
ईस्यतो नथी. हे विष्णु ! मोक्ष आपनारा आपने प्रसंस करी, क्यो समजु पुरुष,  
जेथी पोताने बंधन थाय ऐवुं वरदान मागे ?<sup>५७</sup> माटे हे ईश्वर ! रजेगुणा, तमोगुणा  
अने सत्त्वगुणथी बंधाएली सर्व सुखनी ईस्याओने छोडी देतां जे तमो निरंजन,  
निर्गुणा, अद्वैत अने ज्ञानस्वरूप परम पुरुष छो, ऐवा तमारुं हुं शरण लउं  
छुं.<sup>५८</sup> रक्षण आपनार हे परमात्मा ! हे परमेश्वर ! जे हुं धृष्णा काणथी आ  
संसारमां कर्मोना फणथी पीडाएलो छुं, कर्मोनी वासनाओथी तपेलो छुं, अने  
जेना छ ईद्रियोरुपी शत्रुओ तृष्णा रहित थया ज नथी, ऐवो हुं ते मांड मांड  
शांति मणतां निर्भय, सत्य अने शोक रहित तमारा यरणारविंदना शरणे आवेलो  
छुं, माटे जे हुं दुःखी छुं, तेनुं रक्षण करो.<sup>५९</sup>

भगवान कहे छे हे यक्षवर्ती राजा ! तमारी बुद्धि निर्भण अने निवृत्ति धर्ममां  
निष्ठावाणी थयेली छे. केमके वरदाननी लालय आपी तोपश ललयाई नहीं.<sup>६०</sup>

विचररस्व महीं कामं मव्यावेशितमानसः । अस्त्वेव नित्यदा तुभ्यं भक्तिर्मव्यनपायिनी ॥६२  
क्षात्रधर्मस्थितो जन्मून् न्यवधीर्मृगयादिभिः । समाहितस्तपसा जह्यां मदुपाश्रितः ॥६३  
जन्मन्यनन्तरे राजन् ! सर्वभूतसुहृत्तमः । भूत्वा द्विजवरस्त्वं वै मामुपैष्यसि केवलम् ॥६४  
इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्दे उत्तरार्थं  
मुचुकुन्दस्तुतिर्नमैकपञ्चाशत्तमोऽध्यायः ॥५९॥

## अथ द्विपञ्चाशत्तमोऽध्यायः (५२)

॥ श्रीशुक्तउवाच ॥

इत्थं सोऽनुग्रहीतोऽग ! कृष्णेनेक्ष्वाकुनन्दनः । तं परिक्रम्य सत्राम्य निश्चक्राम गुहामुखात् ॥१  
स वीक्ष्य क्षुल्कान् मर्त्यान् पशून् वीरुद्धनस्पतीन् । मत्वा कलियुगं प्राप्तं जगाम दिशमुत्तराम् २

में तमने वरदाननी लालय आपी, ऐ पश तमोने सावधान बनाववा माटे ज छे.  
ऐम तमो ज्ञाषो. अने ते प्रभाषे तमे कदाय वर मागो तोपश तमने प्रभाद थाय  
ज नहीं ऐम समज्वंवुं; केमके मारा साचा भक्तोनी बुद्धि कटी पश संसारना  
सुखोमां आसक्त थाय नहीं.<sup>६१</sup> हे राजा ! जे ओ मारा अभक्त होय तेओ  
प्राणायामादिक साधनोथी भनने वश करे, तोपश जेनी वासना क्षीणा थती नथी,  
ऐवुं तेओनुं भन फरी पश विषयोथी ललयाय छे.<sup>६२</sup> तमे मारामां भन राखी  
ईस्या प्रभाषे पृथ्वीमां फरो, तमने मारे विषे अविनाशी भक्ति सर्वदा रहेशे.<sup>६३</sup>  
तमे क्षत्रिय धर्ममां रही, भूगया आदिके करीने धृष्णा ज्वव मार्या छे, ते पाप, मारो  
आश्रय राखी ऐकाश्रपणाथी तप करीने टाणो. हे राजा ! तमे हवे पछीना जन्ममां  
सर्वप्राणीओना भित्र उत्तम ध्राव्याश थर्ठने मारा दिव्य स्वरूपने पामशो.<sup>६४-६५</sup>  
द्यति श्रीमद्भागवता भागवतना दशम स्कन्दनो ऐकावनभो अद्याय संपूर्ण.

## अद्याय ५२

श्रीकृष्ण भयुराथी द्वारिका जहने रह्या अने लक्ष्मीज्ञनो संदेशो  
स्वीकार्यो.

शुक्देवज्ञ कहे छे हे राजा ! आवी रीते श्रीकृष्णो अनुग्रह कर्यो ऐटले ते  
मुयुकुंद राजा भगवानने प्रदक्षिणा करी तथा प्रशाम करी, गुफाना द्वारमांथी भहार  
नीकण्या.<sup>१</sup> मनुष्य, पशु, लता अने वनस्पतिओ प्रमाणमां टूंकां थर्ठ गयां हतां,

तपःश्रद्धायुतो धीरो निसङ्गे मुक्तसंशयः । समाधाय मनः कृष्णे प्राविशद् गन्धमादनम् ॥३  
बदर्याश्रममासाद्य नरनारायणालयम् । सर्वद्वन्द्वसहः शान्तस्तपसा॒॑राध्यद्विरिम् ॥४  
भगवान् पुनरावज्य पुरी यवनवेष्टिताम् । हत्वा म्लेच्छबलं निन्ये तदीयं द्वाराकां धनम् ॥५  
नीयमाने धने गोभिनृभिश्चाच्युतचोदितैः । आजगाम जरासन्धस्त्रयोर्विंशत्यनीकपः ॥६  
विलोक्य वेगरभसं रिपुसैन्यस्य माधवौ । मनुष्यचेष्टामापन्नौ राजन् ! दुदुवतद्वुत्तम् ॥७  
विहाय वित्तं प्रचुरमधीतौ भीरुभीतवत् । पद्म्यां पद्मपलाशाभ्यां चेरतुर्बहुयोजनम् ॥८  
पलायमानौ तो दृष्ट्वा मागधः प्रहसन् बली । अन्वधावद् रथानीकैरीशयोरप्रमाणवित् ॥९  
प्रद्रुत्य दूरं संश्रान्तौ तुङ्गमारुहतां गिरिम् । प्रवर्षणाख्यं भगवान् नित्यदा यत्र वर्षति ॥१०  
गिरौ निलीनावाज्ञाय नाधिगम्य पदं नृप ! । ददाह गिरिमेधोभिः समन्नादग्निमुत्सृजन् ॥११  
तत उत्पत्य तरसा दह्यमानतटादुभौ । दशैकयोजनोत्तुङ्गान्तिपेततुरधो भुवि ॥१२  
अलक्ष्यमाणौ रिपुणा सानुगेन यदूत्तमौ । स्वपुरं पुनरायातौ समुद्रपरिखां नृप ! ॥१३

ते ज्ञेई कणियुग आव्यो मानीने ते भुयुकुंद उत्तर दिशामां गया.<sup>२</sup> धीरजशाणी  
आसक्तिओथी रहित अने जेमना संशय दूर थया छै, ऐवा भुयुकुंद राजा तपने  
विषे श्रद्धावाणा थई, भगवानमां मन राखीने गंधमादन पर्वतमां गया.<sup>३</sup> त्यां  
नरनारायणाना स्थानकृप बदरिकाश्रममां जई, सर्व सुभदुःखादिक दंदो सहन  
करी तथा शांत रही, तपथी भगवाननी आराधना करवा लाय्या.<sup>४</sup> श्रीकृष्ण  
भगवान यवनो ए घेरेली भथुरामां पाइ आवी, भ्लेच्छोनुं सैन्य मारीने तेनुं  
धन द्वारकामां मोकलवा लाय्या.<sup>५</sup> भगवाननी प्रेरणाथी बणदो तथा माणसो  
द्वारकामां धन लई जता हता. त्यां त्रेवीश अक्षौहिणी सैन्य लहिने जरासंध यडी  
आव्यो.<sup>६</sup> हे राजा ! शत्रुना सैन्यना वेगनो वधारो ज्ञेई श्रीकृष्ण अने बणराम  
मनुष्यनी येष्टानो स्वीकार करी तरत भाय्या.<sup>७</sup> नहीं भय पामवा छतां भय  
पामेलानी पेठे धघुंक धन पडतुं भूकीने धण्डा योजन सुधी दोडता गया.<sup>८</sup> ऐ भन्ने  
भाईओने भागता ज्ञेई, खडभाट छास्य करतो अने ईश्वरना प्रमाणने नहीं  
जाणतो बणवान जरासंध रथनां सैन्योथी तेओनी पछिवाडे दोडयो.<sup>९</sup> धण्डा दूर  
सुधी दोडीने थाकी रहेला भन्ने भाईओ प्रवर्षण नामना ऊंचा पर्वत उपर यडी  
गया. जे पर्वतमां ईन्द्र दररोज दिवसे वृष्टि करे छे.<sup>१०</sup> हे राजा ! ऐ भे भाईओने  
पर्वतमां धुपायेला जाणी, शोध करतां पाण्डा पतो नहीं भणतां, जरासंधे चारेकोर  
लाकडां भूकी अग्नि सणगावीने ते पर्वतने बाय्यो.<sup>११</sup> शिखरो बणवा लागतां  
अगियार योजन ऊंचा ते पर्वत उपरथी ठेकीने ऐ भन्ने जाणा शत्रुओ न देखे

सोऽपि दग्धाविति मृषा मन्वानो बलकेशवौ । बलमाकृष्ण सुमहम्मगधान् मागधो ययौ १४  
आनन्दाधिपतिः श्रीमान् रैवतो रेवतीं सुताम् । ब्रह्मणा चोदितः प्रादाद् बलायेति पुरोदितम् १५  
भगवानपि गोविन्द उपयेमे कुरुद्वह । वैदर्भी भीष्मकसुतां श्रियो मात्रां स्वयंवरे ॥१६  
प्रमथ्य तरसा राज्ञः शाल्वादीं शैद्यपक्षगान् । पश्यतां सर्वलोकानां ताक्ष्यपुत्रः सुधामिव ॥१७  
राजोवाच

भगवान् भीष्मकसुतां रुक्मिणीं रुचिराननाम् । राक्षसेन विधानेन उपयेम इति श्रुतम् ॥१८  
भगवज्ञानेतुमिच्छामि कृष्णस्यामिततेजसः । यथा मागधशाल्वादीन् जित्वा कन्यामुपाहरत् १९  
ब्रह्मन्! कृष्णकथा: पुण्या माध्वीलोकमलापहाः । को नु तृप्येत शृणवानः श्रुतज्ञो नित्यनूतनाः ।  
श्रीशुक उवाच

राजाऽऽसीद् भीष्मको नाम विदर्भाधिपतिर्महान् । तस्य पञ्चाभवन् पुत्राः कन्यैका च वरानना ॥  
रुक्म्यग्रजो रुक्मरथो रुक्मबाहुरनन्तरः । रुक्मकेशो रुक्ममाली रुक्मण्येषां स्वसा सती २२

ऐवा प्रदेशमां नीये धरती उपर पड्या.<sup>१२</sup> हे राजा ! शत्रु अने शत्रुना अनुयरोना  
ज्ञेवामां नहीं आवेला ऐ भे भाईओ समुद्रउपी खाईवाणी पोतानी द्वारकापुरीमां  
आव्या.<sup>१३</sup> जरासंध पाण्डा श्रीकृष्ण अने बणहेवज्ज बणी गया ऐवी खोटी  
समज्ञाथी, पोतानुं मोटुं सैन्य पाढ्युं वाणीने भगध देशमां गयो.<sup>१४</sup> आनार्त देशना  
राजा रैवते ब्रह्मानी प्रेरणाथी पोतानी दीक्षिरी रेवती बणभद्रने आपी हती.<sup>१५</sup> हे  
राजा ! श्रीकृष्ण भगवान पाण्डा भीष्मक राजानी कुंवरी अने लक्ष्मीज्ञना अंशरूप  
रुक्मिणीने स्वयंवरमां परण्या हता.<sup>१६</sup> गरुडे जेम देवताओने हरावीने अमृतनुं  
हरण कर्यु हतुं, तेम श्रीकृष्ण भगवाने, सर्व लोकोना देखतां शिशुपाणना पक्षना  
शाल्व आदि राजाओने हरावी कीरी रुक्मिणीनुं हरण कर्यु.<sup>१७</sup>

परीक्षित राजा पूछे छे भगवान श्रीकृष्ण, सुंदर मुखवाणी भीष्मक राजानी  
कुंवरी रुक्मिणीने राक्षस विवाहनी रीतिथी ऐटले युद्धमां हरण करीने परण्या,  
ऐम तमे कही गया. तो हे महाराज ! अपार तेजवाणा भगवान, जरासंध अने  
शाल्व आदि राजाओने ज्ञी लई, जेवी रीते कन्याने हरी लाव्या ते सर्वे वात  
विस्तारथी सांभणवाने ईर्ष्णीये छीओ.<sup>१८-१९</sup> हे महाराज ! पवित्र, जगतना  
पापने दूर करनार अने सर्वदा नवीन लागे ऐवी भगवाननी कथाओ सांभणतां  
सारने जाणनार क्यो पुरुष तृप्ति पामे ?<sup>२०</sup>

शुकदेवज्ज कहे छे विदर्भ देशनो अधिपति भीष्मक नामे मोटो राजा हतो,  
तेने पांच दीक्षिरा हता अने ऐक दीक्षिरी हती.<sup>२१</sup> सौथी मोटो रुक्मि नामे हतो

સોપશ્રુત્ય મુકુન્દસ્ય રૂપવીર્યગુણશ્રિયઃ । ગૃહાગતૈર્ગર્યમાનાસં મેને સદૃશં પતિમ् ॥૨૩  
તાં બુદ્ધિલક્ષણૌ દાર્યસ્તપશીલગુણાશ્રયામ् । કૃષ્ણાશ્ર સદૃશીં ભાર્યાં સમુદ્રોદું મનો દધે ॥૨૪  
બન્ધૂનામિચ્છતાં દાતું કૃષ્ણાય ભગિનીં નૃપું ! તતો નિવાર્ય કૃષ્ણાદ્વિદ્રુષ્ટું રૂક્મીં ચૈદ્યમમન્યત ॥૨૫  
તદવેત્યાસિતાપાઙ્ગી વૈદર્ભી દુર્મના ભૃષામ् । વિચિન્ત્યાસં દ્વિજં કઞ્ચિત્કૃષ્ણાય પ્રાહિણોદ્ભુતમ् ॥૨૬  
દ્વારકાં સ સમભેત્ય પ્રતીહારૈઃ પ્રવેશિતઃ । અપશ્યદાદ્યં પુરુષમાસીનં કાઞ્ચનાસને ॥૨૭  
દૃષ્ટા બ્રહ્મણ્યદેવસ્તમવરુહા નિજાસનાત् । ઉપવેશ્યાર્હયાઞ્ચક્રે યથાડત્માનં દિવૌકસ: ॥૨૮  
તં ભુક્તવન્તં વિશ્રાન્તમુપગમ્ય સતાં ગતિઃ । પાણિનાભિમૃષાન્ પાદાવવ્યગ્રસ્તમપૃછ્છત ॥૨૯  
કચ્ચિદ્વિજવરશ્રેષ્ઠ ! ધર્મસ્તે વૃદ્ધસમતઃ । વત્તે નાતિકૃચ્છેણ સંતુષ્ટમનસ: સદા ॥૩૦  
સંતુષ્ટે યર્હ વર્તેત બ્રાહ્મણો યેન કેનચિત् । અહીયમાનઃ સ્વાદ્ધર્મત્ સ હ્યસ્યાખિલકામધુક् ॥

અને તેથી નાના રૂક્મરથ, રૂક્મભાષુ, રૂક્મકેશ અને રૂક્મમાલી નામના પુત્રો હતા. તેની બહેનનું નામ “રૂક્મિષી” હતું. <sup>૨૨</sup> ઘેર આવેલા જનોએ ગાવા માંડેલ ભગવાનનું રૂપ, પરાક્રમ, ગુણ અને સંપત્તિ તેને સાંભળીને રૂક્મિષીએ ભગવાનને જ પોતાના યોગ્ય પતિ માન્યા. <sup>૨૩</sup> તેમજ ભગવાને પણ બુદ્ધિ, લક્ષણ, ઉદારતા, શીલ અને ગુણોના આશ્રયરૂપ તે રૂક્મિષીને પોતાને યોગ્ય સ્ત્રી માની, તેને પરણવાનું મન કર્યું. <sup>૨૪</sup> હે રાજા ! સર્વે સંબંધીઓ કન્યા ભગવાનને જ આપવા ઈચ્છતાં હતાં છતાં ભગવાનો દેષ કરનારા રૂક્મીએ તે વાત બંધ રાખી, તે કન્યાનું શિશુપાળની સાથે સગપણ કરાવ્યું. <sup>૨૫</sup> તે વાત જાણી બહુજ કચવાએલાં તે શ્યામ કટાક્ષવાળાં રૂક્મિષીએ વિચાર કરી, તરત પોતાના વિશ્વાસપાત્ર અને સત્યવક્તા એક બ્રાહ્મણને ભગવાનની પાસે મોકલ્યો. <sup>૨૬</sup> દ્વારિકામાં આવેલા તે બ્રાહ્મણો સોનાના આસન ઉપર બેઠેલા શ્રીકૃષ્ણ ભગવાનને દીઠા. <sup>૨૭</sup> બ્રાહ્મણોને માન આપનાર ભગવાન એ બ્રાહ્મણને જોઈ આસન ઉપરથી ઊઠી, તે આસન ઉપર તેને બેસાડ્યો, અને પોતાની જેમ દેવતાઓ પૂજા કરે છે તેમ પોતે એ બ્રાહ્મણની પૂજા કરી. <sup>૨૮</sup> તે બ્રાહ્મણો જમીને વિશ્રાંમ લીધો, પછી ભગવાને તેની પાસે જઈ પોતાના હાથથી ધીરે ધીરે તેના પગ ચાંપતાં ધીરજથી આ પ્રમાણે તેને પૂછ્યું. <sup>૨૯</sup>

ભગવાન પૂછે છે હે બ્રાહ્મણોમાં સર્વોત્તમ ! વૃદ્ધલોકોએ સ્વીકારેલો તમારો ધર્મ મનમાં સર્વદા સંતોષ રહેતાં ઘણું કષ્ટ ભોગવ્યા વગર બરાબર ચાલે છે, કારણ કે સંતોષ એ જ બ્રાહ્મણનો પરમ ધર્મ છે. <sup>૩૦</sup> પોતાના ધર્મથી ભાષ્ટ નહીં થતો બ્રાહ્મણ જો જે કંઈ મળે તેથી સંતોષ રાખીને વર્તે, તો તે ધર્મ તેના સર્વે મનોરથ

અસન્તુષ્ટોઽસ્કલોકાનાજોત્વપિ સુરેશ્વર: । અકિઞ્ચનોઽપિ સંતુષ્ટ શેતે સર્વાઙ્ગવિજ્વર: ॥૩૨  
વિપ્રાન્ સ્વલાભસંતુષ્ટન્ સાધૂન્ ભૂતસુહૃત્તમાન્ । નિરહ્લારિણ: શાન્તાન્ નમસ્યે શિરસાસ્કૃત ॥  
કચ્ચિદ્વિજવરશ્રેષ્ઠ ! ધર્મસ્તે વૃદ્ધસમતઃ । વત્તે નાતિકૃચ્છેણ સંતુષ્ટમનસ: સદા ॥૩૦  
સંતુષ્ટે યર્હ વર્તેત બ્રાહ્મણો યેન કેનચિત् । અહીયમાનઃ સ્વાદ્ધર્મત્ સ હ્યસ્યાખિલકામધુક् ॥

## સુક્મપણુવાચ

શ્રુત્વા ગુણાન્ ભુવનસુન્દર ! શૃંપતાં તે નિર્વિશ્ય કર્ણવિવરૈહરતોઽઙ્ગતાપમ् ।  
રૂપં દૃશાં દૃશિમતામખિલાર્થલાભં ત્વચ્યચ્યુતાવિશતિ ચિત્તમપત્રં મે ॥૩૭॥  
કા ત્વા મુકુન્ ! મહતી કુલશીલરૂપવિદ્યાવ્યોગ્રવિણધામભિરાત્મતુલ્યમ् ।  
ધીરા પતિં કુલવતી ન વૃણીત કન્યા કાલે નૃસિંહનરલોકમનોઽભિરામમ् ॥૩૮॥  
તમ્મે ભવાન્ ખલુ વૃત: પતિરઙ્ગ ! જાયામાતાર્પિતશ્ચ ભવતોઽત્ર વિભો ! વિધેહિ ।  
મા વીરભાગમભિરંશ્તુ ચૈદ્ય આરાદ ગોમાયુવન્મૃગપતેર્બલિમબુજાક્ષ ! ॥૩૯॥

પૂર્ણ કરે છે. <sup>૩૧</sup> જે અસંતોષ હોય તો ઈદ્રની પદવી મળતાં પણ કોઈ લોકોમાં સુખેથી એક ટેકાણે બેસી શકાતું નથી, અને સંતોષ હોય તો નિષ્કંચન છતાં પણ સર્વ અંગમાં તાપ રહિત થઈને સુખે રહે છે. <sup>૩૨</sup> જે બ્રાહ્મણો પોતાની મેળે મળતા લાભથી સંતોષ રાખનાર, સ્વધર્મમાં નિષ્ઠાવાળા, સર્વ પ્રાણીઓના પરમ મિત્ર, અહૂકાર રહિત અને શાંત હોય, તેઓને હું વારંવાર મસ્તકથી પ્રણામ કરું છું. <sup>૩૩</sup>  
હે બ્રાહ્મણ ! રાજદ્વારથી તો તમારું કુશળ છે ને ? જે રાજાના દેશમાં પાલન પામતી પ્રજા સુખેથી રહે છે, તે રાજા મને પ્રારો થાય છે. <sup>૩૪</sup> તમે આ મહાસાગરને ઉિતરી જ્યાંથી અને જે કામની ઈચ્છાથી અહીં આવ્યા છો તે સર્વે વાત જો ગુહ્ય ન હોય તો અમારી પાસે કહો. અમે તમારું શું કામ કરીએ ? <sup>૩૫</sup>

શુકુદેવજી કહે છે ભગવાને આ પ્રમાણે પ્રશ્ન પૂછતાં, તે બ્રાહ્મણો સર્વે વાત કહી દેખાડી. <sup>૩૬</sup> (રૂક્મિષીએ એકાંતમાં જે પત્ર લખ્યો છે તે બ્રાહ્મણ ભગવાનની આજાથી વાંચી સંભળાવે છે.)

રૂક્મિષીએ લખ્યું છે કે હે ત્રૈલોક્ય સુંદર ! હે પ્રભુ ! સાંભળનારાઓના કાનાના છિદ્રોથી મારા હદ્યમાં પેસી, મારા તાપને હરનાર તમારા ગુણો અને સર્વે મનોરથોના લાભરૂપ તમારું રૂપ સાંભળીને, લાજ વગરનું મારું ચિત્ત તમારામાં લાગી રહ્યું છે. <sup>૩૭</sup> હે મનુષ્યોમાં સિંહરૂપ ! આપ કુણ, શીલ, વિદ્યા, રૂપ, અવસ્થા, ધન અને પ્રમાણથી પોતા તુલ્ય જ છો અને મનુષ્યોને પ્રારો લાગો એવા

पूर्णेष्टदत्तनियमब्रतदेविप्रगुर्वर्चनादिभिरलं भगवान् परेशः ।  
आराधितो यदि गदाग्रज एत्य पाणिं गृह्णातु मे न दमघोषसुतादयोऽन्ये ॥४०॥  
श्वेभाविनि त्वमजितोद्भवने विदर्भान् गुप्तः समेत्य पृतनापतिभिः परीतः ।  
निर्मथ्य चैद्यमगधेन्द्रबलं प्रसहा मां राक्षसेन विधिनोद्भव वीर्यशुल्काम् ॥४१॥  
अन्तःपुरान्तरचरीमनिहत्य बन्धुस्त्वामुद्भवे कथमिति प्रवदाम्युपायम् ।  
पूर्वेद्युरस्ति महती कुलदेवियात्रा यस्यां बहिर्नववधूर्गिरजामुपेयात् ॥४२॥  
यस्याङ्गिपङ्कजरजःस्तपनं महान्तो वाञ्छन्त्युमापतिरिवात्मतमोऽपहत्यै ।  
यर्हम्बुजाक्ष ! न लभेय भवतप्रसादं जह्यामसून् ब्रतकृशाज्ञतजन्मभिः स्यात् ॥४३॥

छो, आवा आपने सारा कुणनी उंचा गुणवाणी अने बुद्धिवाणी कई कन्या विवाहना अवसरमां न वरे ?<sup>३८</sup> अेटला माटे हे प्रभु ! हुं तमने पति करीने वरी चूकी हुं अने मारो देह आपने अर्पण करेलो छे, माटे अहीं पधारीने पत्नी तरीके मारो स्वीकार करो. सिंहना भागने शिथाण जेम अडकी शके नहि, तेम हुं आपना भागउप हुं तेने शिशुपाण आवीने स्पर्श न करे ए मारी प्रार्थना छे.<sup>३९</sup> जणाशयाइकनुं निर्माण, अग्निहोत्राइ यज्ञ, दान, नियम, ब्रत अने देव, प्राक्षण तथा गुरुना पूजनाइकथी परमेश्वर भगवाननी में पूर्व जन्मोमां पाण ज्ञे आराधना करी होय तो तमे आवीने मारुं पाणिग्रहण करो.<sup>४०</sup> (कदाच तमे कहो के तारा संबंधीओअे तने शिशुपालने आपी छे, तो हवे तेमां माराथी शुं बनी शके तेना उत्तरमां कहे छे.) हे अजित ! विवाहने आगले दिवसे ज तमे प्रथम गुम रीते विदर्भ देशमां आवी, पछी सेनापतिओथी वीटाईने शिशुपाण तथा जरासंधना सैन्यनुं भथन करी नाखीने बणात्कारथी हुं के जेनुं मुख्य पराक्रम ज छे, तेने राक्षस विवाहनी रीतिथी परण्हो.<sup>४१</sup> “तुं अंतःपुरनी अंदर रहेनारी छे, आवी तने तारा बंधुओने मार्या विना शी रीते परण्ही शकुं ?” ऐवी तमने शंका होय तो तेनो उपाय तमने कहुं हुं. विवाहथी पहेले दिवसे अमारा कुणमां कुणदेवीनी यात्रा करवानी रीति छे, के जे यात्रामां कन्याने गाम बहार पार्वतीनां दर्शन करवा जवुं पडे छे. (त्यांथी मारुं हरण करवुं सहेलुं रहेशे.)<sup>४२</sup> हे कुमण सरभां नेत्रवाणा ! सदाशिवनी पेठे बीजा महात्मा लोको पाण पोतानुं अज्ञान टाणवा माटे जेना चरणारविंदनी २४मां नहावाने ईच्छे छे, अवा आपनी कृपा मने नहीं भणे तो मारा प्राणोने ब्रतथी दुबणा करी नाखी, तेओनो त्याग करी दृश. अेम वारंवार करतां सेंकडो जन्मथी पाण आपनी कृपा ज मेणववी छे.<sup>४३</sup>

ब्राह्मण उवाच  
इत्येते गुह्यसंदेशा यदुदेव ! मयाहृताः । विमृश्य कर्तुं यच्चात्र क्रियतां तदनंतरम् ॥४४  
इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्दे उत्तरार्थं  
रुक्मिण्युद्भाहप्रस्तावे द्विपञ्चाशतमोऽध्यायः ॥५२॥

## अथ त्रिपञ्चाशतमोऽध्यायः (५३)

॥ श्रीशुकउवाच ॥

वैदर्भ्याः स तु संदेशं निशम्य यदुनंदनः । प्रगृह्य पाणिना पाणिं प्रहसन्निदमद्वीत् ॥१  
श्रीभगवानुवाच  
तथाहमपि तच्चित्तो निद्रां च न लभे निशि । वेदाहं रुक्मिणा द्वेषान्ममोद्भाहो निवारितः ॥२  
तामानयिष्य उन्मथ्य राजन्यापसदान् मृथे । मत्परामनवद्याङ्गीमेधसोऽग्निशिखामिव ॥३  
श्रीशुक उवाच  
उद्भाहक्षं च विज्ञाय रुक्मिण्या मधुसूदनः । रथः संयुज्यतामाशु दारुकेत्याह सारथिम् ॥४

आत्माण कहे छे, हे यादवोमां उत्तम ! आ प्रमाणे आ छानो संदेशो में आपनी पासे वांची संभणाव्यो, हवे आ विषयमां जे करवानुं होय तेनो विचार करीने तरत करो.<sup>४४</sup>

इति श्रीमद् महापुराण भागवतना दशम स्कन्दनो बावनमो अद्याय संपूर्णं

## अद्याय ५३

श्रीकृष्ण भगवाने भणाळ्कारे रुक्मिणीनुं हराणा कर्युं.  
शुकदेवज्ञ कहे छे हे राजा ! भगवाने रुक्मिणीनो संदेशो सांभणी, ते श्रावणानो हाथ पोताना हाथे पकडी, हसतां हसतां आ प्रमाणे कहुं.<sup>१</sup> भगवान कहे छे मारुं चित रुक्मिणीमां ज लाग्युं छे, अने तेनी चिताने लीधे रातनी निद्रा पाण आवती नथी. रुक्मीअे द्वेषने लीधे मारा विवाहने अटकाव्यो छे ते हुं जाणुं हुं.<sup>२</sup> मनुष्य लाकडानुं भथन करी जेम अग्निनी शिखाने बहार लावे, तेम युद्धमां नीय राजाओनुं भथन करी मारा परायण अने निर्दोष अंगवाणी ते रुक्मिणीने हुं बहार लावीश.<sup>३</sup>

शुकदेवज्ञ कहे छे हे राजा ! परम दिवसे रात्रीमां रुक्मिणीना विवाहनुं नक्षत्र छे, अेम जाणी भगवाने पोताना सारथिने कहुं के हे दारुक ! मारा रथने

स चाश्वैः शैव्यसुग्रीवमेघपुष्पबलाहकैः । युक्तं रथमुपानीय तस्थौ प्राज्जलिरग्रतः ॥५  
आरुह्य स्यन्दनं शौरिर्द्विजमारोप्य तूर्णगैः । आनर्तादेकरात्रेण विदर्भानगमद्धयैः ॥६  
राजा स कुण्डिनपतिः पुत्रस्नेहवशं गतः । शिशुपालाय स्वां कन्यां दास्यन् कर्माण्यकारयत् ॥७  
पुरं सम्मृष्टसंसिक्तमार्गरथ्याचतुष्पथम् । चित्रध्वजपताकाभिस्तोरणैः समलङ्घतम् ॥८  
स्वगन्धमाल्याभरणैर्विरजोऽम्बरभूषितैः । जुष्टं स्त्रीपुरुषैः श्रीमद्गृहैरगुरुधूषितैः ॥९  
पितृन् देवान् समभ्यर्च्य विप्रांश्च विधिवन्नप ! । भोजयित्वा यथान्यायं वाचयामास मङ्गलम् ॥१०  
सुन्नातां सुदर्तीं कन्यां कृतकौतुकमङ्गलाम् । अहतांशुकयुग्मेन भूषितां भूषणोत्तमैः ॥११  
चक्रुः सामर्यजुर्मन्त्रैर्बृद्धा रक्षां द्विजोत्तमाः । पुरोहितोऽथर्वविद् वै जुहाव ग्रहणान्तये ॥१२  
हिरण्यरूप्यवासांसि तिलांश्च गुडमिश्रितान् । प्रावाद् धेनूश्च विप्रेभ्यो राजा विधिविदं वरः ॥१३  
एवं चेदिपती राजा दमघोषः सुताय वै । कारयामास मन्त्रज्ञैः सर्वमभ्युदयोचितम् ॥१४  
मदच्छुद्धिर्गजानीकैः स्यन्दनैर्हेममालिभिः । पत्त्यश्वसङ्कुलैः सैन्यैः परीतः कुण्डिनं ययोः ॥१५

तेयार कर. ४ शैव्य, सुग्रीव, मेघपुष्प अने बलाहक नामना यार घोडाथी ज्ञेतेलो  
रथ पासे लावीने ते सारथी हाथ ज्ञेतीने आगण उभो रह्यो. ५ भगवान पोते  
रथमां भेसी तथा ब्राह्मणने साथे भेसाई, घोडाओने उतावणा चलाव्या अने  
ओआ देशमांथी एक रात्रीमां विदर्भ देशमां गया. ६ स्नेहने लीधे पुत्र रुक्मीनी  
ईच्छा प्रमाणे यालेलो कुण्डिनपुरनो पति भीष्मक राजा, पोतानी कन्या शिशुपाणने  
परशाववा सारु सर्व तेयारी करवा लाग्यो. ७ गामना मार्ग, राजमार्ग, यौटाओने  
स्वर्य करावी रस्तामां पाणी छंटाव्यां. स्त्रीओ अने पुरुषोंसे माणा, सुंगंधी  
पुष्प, आभरण अने स्वर्य वस्त्रोथी शाणगार कर्या. घेरघेर अगरुना धूपनी  
सुंगंधी प्रसरावी रही. विचित्र ध्वज, पताका, अने तोरणोथी नगर शाणगार्यु. ८  
पितृ अने देवताओनी विधि सहित पूजा करी, तथा ब्राह्मणोने योग्य रीते जमाई  
स्वस्तिवाचन कराववा लाग्यो. ९ कन्याने सारी पेठे नवरावी, कौतुकथी विवाहसूत्र  
पहेराववानुं मंगण करी, नवां वस्त्र तथा उत्तम आभूषणो पहेरावी स्वस्ति वाचन  
कराव्यु. १० उत्तम ब्राह्मणो ऐ झग्वेद, यजुर्वेद तथा सामवेदना मंत्रोथी कन्यानी  
रक्षा करी. अथर्ववेदना मंत्रोने जाणनार पुरोहिते ग्रहशांति माटे होम कर्या. ११  
विधि जाणनाराओमां उत्तम भीष्मक राजा ए ब्राह्मणोने सोनां, रुपां, वस्त्र, तल,  
गोण अने गायोनां दान आप्या. १२ ए ज रीते येदीना पति दमघोष राजा ए पश  
पोताना पुत्र शिशुपाणने माटे मंत्र जाणनारा ब्राह्मणोनी पासे विवाहने योग्य  
सर्व कर्म कराव्यु. १३ पछी मह झरनार हाथी, सोनानी माणा ओवाणा रथ, पायदण

तं वै विदर्भाधिपतिः समभ्येत्याभिपूज्य च । निवेशायामास मुदा कल्पितान्यनिवेशने ॥१६  
तत्र शाल्वो जरासथो दन्तवक्त्रो विदूरथः । आजगमुश्चैद्यपक्षीयाः पौण्ड्रकाद्याः सहस्राशः ॥  
कृष्णरामद्विषो यत्ता: कन्यां चैद्याय साधितम् । यद्यागत्य हरेत् कृष्णो रामाद्यैर्युद्भिर्वृतः ॥  
योत्स्यामः संहतास्तेन इति निश्चितमानसाः । आजगमुर्भूभुजः सर्वे समग्रबलवाहनाः ॥१९  
श्रुत्वैतद् भगवान् रामो विपक्षीयनुपोद्यमम् । कृष्णं चैकं गतं हर्तुं कन्यां कलहशङ्कितः ॥  
बलेन महता सार्धं भ्रातृस्नेहपरिप्लुतः । त्वरितः कुण्डिनं प्रागाद् गजाश्वरथपतिभिः ॥२१  
भीष्मकन्या वरारोहा काङ्क्षन्यागमनं हरे: । प्रत्यापत्तिमपश्यन्ती द्विजस्याचिन्तयत्तदा ॥२२  
अहो त्रियामान्तरित उद्धाहे मेऽल्पराधसः । नागच्छत्यरविन्दाक्षो नाहं वेदम्यत्र कारणम् ।

सोऽपि नावर्ततेऽद्यापि मत्सन्देशहरो द्विजः ॥२३

अपि मत्यनवद्यात्मा दृष्ट्वा किञ्चिज्जुगुप्सितम् । मत्याणिग्रहणे नूनं नायाति हि कृतोद्यमः ॥२४  
दुर्भगाया न मे धाता नानुकूलो महेश्वरः । देवी वा विमुखा गौरी रुद्राणी गिरिजा सती ॥२५

अने घोडानी भारे भीउवाणा सैन्योथी वींटाईने कुण्डिनपुरमां गयो. १५ विदर्भ  
देशना पति भीष्मक राजा ए ते दमघोषनुं सामैयुं करी तथा सत्कार करी प्रीतिथी  
भीजा धरमां उतारो आप्यो. १६ शाल्व, जरासंध, दंतवक्त्र, विदूरथ अने पौँड्रुक  
आदि शिशुपाणना पक्षना हजरो राजाओ के जेओ श्रीकृष्ण तथा बणदेवना शत्रु  
हता, तेओ सज्ज थैने जानमां आव्या हता. बणदेवादिक यादवोथी वींटाएला  
श्रीकृष्ण ज्ञे अहीं आवीने कन्यानुं हरण करशे तो कन्या शिशुपाणने अपाववा  
सारु सर्व एक थैने कृष्णनी साथे युद्ध करीशुं. अेवो दृढ निश्चय करी पोतानां  
सर्व सैन्य अने वहानोने साथे लै ए सर्व राजा ओ आव्या हता. १७-१८ आवी  
रीतनो शत्रुना पक्षना राजाओ ओ उद्यम सांभणी, कन्यानुं हरण करवा श्रीकृष्णने  
एकला गयेला जाणी, युद्धनी शंकाथी बणदेवज्ञ पश हाथी, घोडा, रथ अने  
पायदणनुं भोटुं सैन्य लै भाईना स्नेहथी व्याम थवाने लीधे तरत कुण्डिनपुर  
आव्या. २०-२१ सुंदर रुपवाणी भीष्मक राजा नी कन्या रुक्मिणी के जे भगवानना  
आववानी राह ज्ञेतां हतां. ते पोते भोक्लेला ब्राह्मणने पाणो आव्यो नहीं. तेने  
ज्ञेईने ते समयमां चिंता करवा लाग्यां के अहो !!! हुं मंदभाग्यवाणी छुं. मारा  
विवाहने एकज रात आडी रही छे. अने हजु सुधी भगवान आवता नथी, ते  
विषयनुं कारण मारा जाणवामां आवतुं नथी. २२-२३ मारो संदेशो लै जनार ते  
ब्राह्मण पश हजु सुधी पाणो आवतो नथी. मारुं पाणीग्रहण करवामां सज्ज  
थैने रभेने पछी कांठ मारामां दोष जाणवामां आवतां निर्दोष भगवान रोकाई

એવं ચિન્તયતી બાલા ગોવિન્દહૃતમાનસા । ન્યમીલયત કાલજા નેત્રે ચાશ્રુકલાકુલે ॥૨૬  
એવં વધ્વા: પ્રતીક્ષાન્ત્યા ગોવિન્દાગમનં નૃપ! । વામ ઉરુભુજો નેત્રમસ્ફુરન્ પ્રિયભાષિણ: ॥૨૭  
અથ કૃષ્ણવિર્નિર્દિષ્ટ: સ એવ દ્વિજસત્તમ: । અન્ત:પુરચર્ચી દેવી રાજપુત્રી દર્દર્શ હ ॥૨૮  
સા તં પ્રહૃષ્ટવદનમવ્યગ્રાત્મગતિં સત્તી । આલક્ષ્ય લક્ષ્ણાભિજા સમપૃચ્છચ્છુચિસ્મિતા ॥૨૯  
તસ્યા આવેદ્યત્ પ્રાસં શશંસ યદુન્દનમ્ । ઉં ચ સત્ત્વવચનમાત્મોપનયનં પ્રતિ ॥૩૦  
તમાગતં સમાજાય વૈદર્ભી હૃષ્માનસા । ન પશ્યન્તી બ્રાહ્મણાય પ્રિયમન્યન્ત્રનામ સા ॥૩૧  
પ્રાસૌ શ્રુત્વા સ્વદુહિતુર્દ્વાહપ્રેક્ષણોત્સુકૌ । અભ્યાન્તૂર્યઘોષેણ રામકૃષ્ણૌ સર્મહણૈ: ॥૩૨  
મધ્યપુર્કમુપાનીય વાસાંસિ વિરજાંસિ સ: । ઉપાયનાન્યભીષ્ણાનિ વિધિવત સમપૂજયત ॥૩૩

ગયા હોય ! ॥૨૪ ભાગ્ય રહિત એવી મને બ્રહ્મા અનુકૂળ નહિ હોય, અથવા શિવ  
અનુકૂળ નહિ હોય, અથવા તો પાર્વતી દેવી અનુકૂળ નહિ હોય, જેથી શ્રીકૃષ્ણ ન  
પધાર્યા. ૨૫ આ પ્રમાણે વિચાર કરતાં અને જેનું મન ભગવાનમાં જ લાગી રહ્યું  
હતું, એવાં તે રૂક્મિણી શ્રીકૃષ્ણને આવવાનો સમય હજુ થયો નથી, એમ માની  
કાંઈક ધારણા મળતાં આંસુનાં ટીપાંઓથી વ્યાકુળ થયેલી પોતાની આંખોને મીંચી  
ગયાં. ૨૬ હે રાજી ! આવી રીતે તે રૂક્મિણી ભગવાનના આવવાની રાહ જોતાં  
હતાં ત્યાં તેમના અંગોમાં પ્રિય સૂચન થયું. ડાબો હાથ, ડાબો સાથળ અને ડાબી  
આંખ ફરકી. ૨૭ તેટલી વારમાં જ ભગવાને મોકલેલો તે જ બ્રાહ્મણ આવ્યો અને  
એ બ્રાહ્મણ અંત:પુરમાં રહેનારાં તે રાજ કુંવરીને મળ્યો. ૨૮ સ્વસ્થ રીતે ચાલ્યા  
આવતા અને જેનું મુખારવિંદ પ્રહૃદિલિત મુદ્રામાં હતું એવા તે બ્રાહ્મણને જોઈ દૂત  
કામ કરી આવ્યો છે કે નહીં, એ વાતને તેનાં લક્ષ્ણ ઉપરથી જ જાણી જનારાં  
રૂક્મિણીએ મનોહર રીતે હસીને તે બ્રાહ્મણને પૂછ્યું. ૨૯ અને બ્રાહ્મણે ભગવાન  
આવી પહોંચ્યાની તથા ભગવાને પાણિગ્રહણ કરવાનું જે સત્ત્વ વચન આપ્યું હતું  
તે સર્વ વાત રૂક્મિણીને કહી સંભળાવી. ૩૦ ભગવાનને આવ્યા જાણી રાજ થયેલાં  
રૂક્મિણીએ, સર્વોત્તમ વધામણીમાં દેવા જેવી બીજી કોઈ પ્રિય વસ્તુ નહીં દેખતાં  
એ બ્રાહ્મણને નમસ્કાર કરી વિચાર કર્યો કે (હું કે જે લક્ષ્મીનો અવતાર છું તેને  
જેઓ નમે તેને સર્વ સંપત્તિઓ પ્રાપ્ત થાય તો હું જ જેને નમું તેને શી મણા રહે ?)  
એવા વિચારથી કેવળ પ્રણામ જ કર્યા. ૩૧ શ્રીકૃષ્ણ તથા બળભદ્રને પોતાની  
દીકરીનો વિવાહ જોવાના ઉત્સાહથી આવેલા સાંભળી, ભીષ્મક રાજાએ પૂજનના  
પદાર્થો લઈ ગાજે વાજે તેઓનું સામેયું કર્યું. ૩૨ મધુપર્ક, સ્વચ્છ વસ્ત્રો તથા  
ઘારી ભેટો લાવીને વિધિ સહિત તેઓનો સત્કાર કર્યો. ૩૩ મોટી બુદ્ધિવાળા ભીષ્મક

તર્યોનિવેશનં શ્રીમદુપકલ્પ્ય મહામતિ: । સસૈન્યયો: સાનુગ્યોરાતિશ્ય વિદધે યથા ॥૩૪  
એવં રાજ્ઞાં સમેતાનાં યથાવીર્ય યથાવય: । યથાબલાં યથાવિત્તં સર્વૈ: કામૈ: સર્મહૃયત ॥૩૫  
કૃષ્ણમાગતમાકર્ણ્ય વિદર્ભપુરવાસિનઃ: । આગત્ય નેત્રાજજલિભિ: પપુસ્તમ્નુખપઙ્કજમ્ ॥૩૬  
અસ્યૈવ ભાર્યા ભવિતું રુક્મિણ્યર્હતિ નાપરા । અસાવપ્યનવદ્યાત્મા ભૈષ્યા: સમુચ્ચિત: પતિ: ૩૭  
કિન્ધિત્સુચરિતં યત્રસ્તે તુષ્ણસ્તોકકૃત । અનુગૃહાતુ ગૃહાતુ વैદર્ભ્યા: પાણિમચ્યુત: ॥૩૮  
એવં પ્રેમકલાબદ્ધા વદન્નિ સ્મ પુરૌકસ: । કન્યા ચાનત:પુરાત પ્રાગાદ ભર્તૈરુમાસ્બિકાલયમ્ ૩૯  
પદ્ગ્રાં વિનિર્યાં દ્રષ્ટું ભવાન્યા: પાદપલ્કવમ્ । સા ચાનુધ્યાયતી સમ્યડમુકુન્દચરણામ્બુજમ્ ૪૦  
યતવાડ્માતૃભિ: સાર્ધ સખિભિ: પરિવારિતા । ગુસા રાજભટૈ: શૂરૈ: સન્નદ્ધૈરુદ્યતાયુધૈ: ।

મૃદઙ્શઝૃપણવાસ્તૂર્યભેવશ્ચ જાણિરે ॥૪૧

નાનોપહારબલિભર્મસુખ્યા: સહસ્રશ: । સ્વગાધ્યવસ્ત્રાભરપ્રીજપત્ય: સ્વલંકૃતાઃ ॥૪૨  
ગાયત્નશ્શ સ્તુવત્નશ્શ ગાયકા વાદ્યવાદકા: । પરિવાર્ય વધ્ય જાગુઃ સૂતમાગધવન્દિન: ॥૪૩

રાજાએ સારો ઉતારો આપી તેઓની તથા તેના અનુયરો સહિત સૈન્યની  
મહેમાનગતિ કરી. ૩૪ એ જ પ્રમાણે બીજા રાજાઓ આવ્યા હતા તેઓની પણ  
તેઓના બણ અને ઐશ્વર્યના પ્રમાણમાં યોગ્ય પદાર્થોથી મહેમનગતિ કરી. ૩૫  
કુંદિનપુરના રહેવાસીઓ ભગવાનને આવ્યા સાંભળી, ત્યાં આવીને પોતાનાં  
નેત્રદુપ અંજલિથી તેઓના મુખારવિંદને પીવા લાગ્યાં, અને કહેવા લાગ્યાં કે  
“રૂક્મિણી આની સ્ત્રી થવાને યોગ્ય છે. ૩૬-૩૭ આપણું કાંઈ પુણ્ય હોય અને તેથી  
પરમેશ્વર પ્રસન્ન થઈને અનુગ્રહ કરવાના હોય, તો આ શ્રીકૃષ્ણ રૂક્મિણીનું  
પાણિગ્રહણ કરે એજ અનુગ્રહ કરજો. ૩૮ આ પ્રમાણે પ્રેમથી બંધાએલા લોકો  
વાતો કરતા હતા, તેટલી વારમાં ઘણા યોગ્દ્વાઓના રક્ષણ તળે કન્યા પણ અંબાજીના  
મંદિરમાં જવા સારુ અંત:પુરમાંથી બહાર નીકળ્યાં. ૩૯ અંબાજીના ચરણારવિંદનું  
દર્શન કરવા સારુ પગે જ ચાલ્યાં જતાં તે રૂક્મિણીના મનમાં ભગવાનના  
ચરણારવિંદનું ધ્યાન સારી રીતે લાગ્યું હતું. ૪૦ માતાઓ સાથે હતી, મૌનવત રાખ્યું  
હતું અને સખીઓ ચારેકોર વીંટાઈને ચાલતી હતી. શૂર, સજજ અને જેઓએ  
આયુધ ઉપાડ્યાં હતાં એવા યોગ્દ્વાઓ રક્ષણ કરતા આવતા હતા. મૃદુંગ, શંખ,  
પણવ, તૂરી અને ભેરીઓ વાગતાં હતાં. ૪૧ હજારો ઉત્તમ વેશ્યાઓ અનેક પ્રકારના  
ઉપહાર અને બલિયો લઈને સાથે આવતી હતી, તેમજ માળા, સુગંધ, વસ્ત્રો  
અને આભરણોથી શાશગારેલી બ્રાહ્મણાંની સ્ત્રીઓ પણ સાથે હતી. ૪૨ ગાતા તથા  
સ્તુતિ કરતા ગવૈયાઓ, વાજાં વગાડનારા, સૂત, માગધ અને બંદિજનો કન્યાને

आसाद्य देवीसदनं धौतपादकराम्बुजा । उपस्थृश्य शुचिः शान्ता प्रविवेशाम्बिकान्तिकम् ४४  
तां वै प्रवयसो बालां विधिज्ञा विप्रयोषितः । भवानी वन्दयाञ्चक्रुर्भवपतीं भवान्विताम् ४५  
नमस्ये त्वाम्बिकेऽभीक्षणं स्वसन्तानयुतां शिवाम् । भूयात् पतिर्में भगवान् कृष्णसदनुमोदताम्  
अद्विर्गन्धाक्षतैर्धूपैर्वासः स्त्रिमाल्यभूषणैः । नानोपहारबलिभिः प्रदीपावलिभिः पृथक् ॥४७॥  
विप्रलिङ्गिः पतिमतीस्तथा तैः समपूजयत् । लवणापूपताम्बूलकण्ठसूत्रफलेक्षुभिः ॥४८॥  
तस्यै सन्त्रियस्ताः प्रददुः शेषां युयुजुराशिषः । ताभ्यो देव्यै नमस्वक्रे शेषां च जगृहे वधूः ४९  
मुनिव्रतमथ त्यक्त्वा निश्चक्रामाम्बिकागृहात् । प्रगृह्य पाणिना भृत्यां रत्नमुद्रोपशोभिना ५०  
तां देवमायमिव वीरमोहिनीं सुमध्यमां कुण्डलमण्डिताननाम् ।

श्यामां नितम्बार्पितरलमेखलां व्यञ्जत्सनीं कुन्तलशङ्कितेक्षणाम् ॥५१॥  
शुचिस्मितां बिम्बफलाधरद्युतिशोणायमानद्विजकुन्दकुदमलाम् ।  
पदा चलनीं कलहंसगमिनीं शिज्जत्कलानूपरथामशोभिना ।  
विलोक्य वीरा मुमुहुः समागता यशस्विनस्तल्कृतहृच्छयार्दिताः ॥५२॥  
यां वीक्ष्य ते नृपतयस्तदुदारहासब्रीडावलोकहृतचेतस उज्जितास्त्राः ।  
पेतुः क्षितौ गजरथाश्वगता विमूढा यात्राच्छ्लेन हरयेऽर्पयतीं स्वशोभाम् ॥५३॥

वीटाईने जता हता.<sup>४३</sup> देवीना भंडिरनी पासे आवी, हाथ पग धोई, आयमन  
लઈ, पवित्रताथी तथा धीरजथी कन्याए देवीना भंडिरमां प्रवेश कर्यो.<sup>४४</sup> विधि  
जाणनारी ब्राह्मणोनी वृद्ध स्त्रीओए ते कन्याने सदाशिव सहित पार्वतीना  
यरणामां प्रणाम कराव्या.<sup>४५</sup> हे अंभिका ! गणेशादि पोताना संतानो सहित अने  
परम भंगणरूप आपने हुं वारंवार प्रणाम करुं छुं. श्रीकृष्ण भगवान मारा पति  
थाय एवी मारा उपर आप कृपा करजो.<sup>४६</sup> आ मंत्र बोलीने जण, गंध, अक्षत,  
धूप, वस्त्र, माणा, फूल, आभरण, अनेक प्रकारना उपहार, बलि अने  
दीपमाणाथी कन्याए नोभनोभी पूजा करी.<sup>४७</sup> सौभाग्यवती ब्राह्मणोनी स्त्रीओए  
पण ते पदार्थोथी तथा भीहुं, मालपुवा, तांबुल, कंठसूत्र, फण अने शेलीथी  
देवीनी पूजा करी.<sup>४८</sup> ते स्त्रीओए रुक्मिणीने आशीर्वाद आप्या. रुक्मिणीए  
पण ब्राह्मणीओने अने देवीने प्रणाम कर्या तथा प्रसाद लीधो.<sup>४९</sup> पछी भौनव्रत  
छोडी दृष्ट रत्ननी वीटीओथी शोभी रहेला हाथथी दासीनो हाथ पकडी ते कन्या  
देवीना भंडिरमांथी बहार नीकल्यां.<sup>५०</sup> देवताओनी मायानी पेठे वीरलोकोने मोह  
पमाडनारां, सारी कटीवाणां, कुंडलथी शोभित मुखवाणां अने सर्वांगे  
आभरणोथी सुशोभित अने सुंदर चालवाणां रुक्मिणीने जोहीने उत्पन्न थयेला

सैवं शनैश्चलयती चलपद्मकोशौ प्रासिं तदा भगवतः प्रसमीक्षमाणा ।  
उत्सार्य वामकरजैरलकानपाङ्गैः प्रासान् द्विघैक्षत नृपान् ददृशेऽच्युतं सा ॥५४॥  
तां राजकन्यां रथमासुरक्षतीं जहार कृष्णो द्विषतां समीक्षताम् ।  
रथं समारोप्य सुपर्णलक्षणं राजन्यचक्रं परिभूय माधवः ॥५५॥  
ततो यथौ रामपुरोगमैः शनैः सृगालमध्यादिव भागहृदरिः ॥५६॥  
तं मानिनः स्वाभिभवं यशःक्षयं परे जरासन्धवशा न सहिरे ।  
अहो धिगस्मान् यश आत्तन्धन्वनां गोपैर्हतं केसरिणां मृगैरिव ॥५७॥  
इति श्रीमद्भागवते महापुराणे परमहंस्यां संहितायां दशमस्कन्धे उत्तरार्धं  
रुक्मिणीहरणं नाम त्रिपञ्चाशत्तमोऽद्यायः ॥५३॥

कामदेवथी पीडाएला यशस्वी वीर लोको के जेओ त्यां भेणा थया हता, तेओ सर्वे  
मोह पामी गया. चालवाना भिषथी पोतानी शोभा भगवानने देखाइतां ते  
रुक्मिणीने जोहीने सर्वे राजाओ तेना उदार हसवा अने लाज सहित जोवाथी  
चित उराई जतां हथियार छोडी दृष्ट मूढ थईने, हाथी तथा घोडाओ उपरथी  
पडवा लाग्या.<sup>५१-५४</sup> पोताना चरणकमणे धीरे धीरे चलावतां अने ते समये  
भगवान आवी पहोचयवानी वाट जोतां ते रुक्मिणीऐ डाबा हाथना नभवडे  
पोताना केश उंचा करीने, नेत्रनी अणीओथी त्यां आवेला राजाओने लाजथी  
जोया, त्यां तरत भगवान जोवामां आव्या.<sup>५५</sup> ऐ राजकन्या रथ उपर चडवा  
जतां हतां तेटली वारमां श्रीकृष्णे सर्वे शत्रुना देखतां ज तेमनुं हरण कर्यु, श्रीकृष्ण  
भगवान राजाओनो पराभव करी ते कन्याने पोताना गरुडना चिन्हवाणा रथमां  
बेसाडी, जेम शियाणियांना टोणामांथी पोतानो भाग लईने सिंह जाय, तेम  
त्यांथी बणदेवादि यादवोनी साथे धीरे धीरे चाल्या.<sup>५६</sup> जरासंधना वशमां रहेनारा  
बीजा अभिमानी राजाओ कीर्तिनो क्षय करनारा, ऐ पोताना पराभवने सहन  
करी शक्या नहीं, तेथी कुहेवा लाग्या के अहो !! आपणा हाथमां हथियारो छतां  
जेम केसरीना यशने मृग लई जाय तेम आपणा यशने गोवाणो लई गया,  
आपणने धिक्कार छे.<sup>५७</sup>  
इति श्रीमद् महापुराणा भागवतना दशम स्कन्धनो त्रेपनमो अद्याय संपूर्णः.

अथ चतुःपञ्चाशत्तमोऽध्यायः (५४)

श्रीशुक उवाच

इति सर्वे सुसंरब्धा वाहानारुह्य दंशिताः । स्वैःस्वैर्बलैः परिक्रान्ता अन्वीयुर्धृतकार्मुकाः ॥१  
तानापतत आलोक्य यादवानीकयूथापाः । तस्थुस्तसंमुखा राजचिस्फूर्ज्य स्वधनूषिते ॥२  
अश्वपृष्ठे गजस्कन्धे रथोपस्थे च कोविदाः । मुमुचुः शरवर्षाणि मेघा अद्रिष्वपो यथा ॥३  
पत्युर्बलं शरासारैश्छन्नं वीक्ष्य सुमध्यमा । सवीडमैक्षतद्वक्त्रं भयविह्ललोचना ॥४  
प्रहस्य भगवानाह मा स्म भैरवामलोचने ! । विनङ्ग्यत्यधुनैवतत्तावकैः शात्रवं बलम् ॥५  
तेषां तद्विक्रमं वीरा गदसङ्कर्षणादयः । अमृष्यमाणा नाराचैर्जन्मुर्हयगजान् रथान् ॥६  
पेतुः शिरांसि रथिनामश्चिनां गजिनां भुवि । सकुण्डलकिरीटानि सोष्णीषाणि च कोटिशः ७  
हस्ताः सासिगदेष्वासाः करभा उरवोऽङ्गस्याः । अश्वाश्वतरनागोष्ट्रखरमर्त्यशिरांसि च ॥८  
हन्यमानबलानीका वृष्णिभिर्जयकाङ्गिभिः । राजानो विमुखा जगमुर्जरासन्धपुरःसराः ९

अध्याय ५४

श्रीकृष्ण भगवाने रुक्मिणीनुं पाण्डिग्रहणं कर्युं।

शुकदेवज्ञ कुहे छे हे राजा ! आ प्रमाणे कोधना आवेशथी वाहनो उपर बेसी, कवयो पहेरी, धनुषो हाथमां लई पोतपोताना सैन्योनी साथे सर्वे राजाओ भगवाननी पछवाडे दोऽया।<sup>१</sup> हे राजा ! ऐ लोकोने आवता ज्ञेई यादवोना सैन्यना यूथपतियो पोतानां धनुषोनो टंकार करी तेओनी सामा उभा रह्या।<sup>२</sup> घोडा, हाथी अने रथो उपर बेसवामां बहु ज निपुण एवा राजाओ, जेम वादणां पर्वतो उपर पाण्डीनी वृष्टि करे तेम यादवो उपर बाणोनी वृष्टि करवा लाग्या।<sup>३</sup> रुक्मिणी पोताना पतिना सैन्यने बाणी वृष्टिथी ढंकाएलुं ज्ञेई, भयथी विहृण अने लाज भरेली दृष्टिथी भगवानना भुखने ज्ञेवा लाग्यां।<sup>४</sup> भगवाने हसीने कहुं के हे सुंदर नेत्रवाणां ! तमारा संबंधीओना (यादवोना) हाथथी हमणां ज आ शत्रुओनुं सैन्य नाश पामशे।<sup>५</sup> ऐ राजाओना पराक्रमने नहीं सहन करता गद अने बणदेवज्ञ आहि यादवो बाणोथी ते शत्रुओना हाथी, घोडा अने रथने नाश करवा लाग्या।<sup>६</sup> रथ घोडा अने हाथीओ उपर बेठेला योद्धाओनां कुंडण, किरीट तथा पाधीओ सहित करोडो माथां धरती उपर पडवा लाग्यां।<sup>७</sup> तलवार, गदा अने धनुष सहित हाथ, लांबा हाथवाणां कंडां, साथण, पग अने घोडा, खच्चर, हाथी, उंट, गधेडां तथा मनुष्योनां माथां पडवा लाग्यां।<sup>८</sup> ज्यने ईरच्छनारा यादवोंसे ज्ञेओना सैन्यने मारवा मांडया छे, एवा जरासंधाहिक राजाओ पीठ

शिशुपालं समभ्येत्य हृतदारमिवातुरम् । नष्टित्वं गतोत्साहं शुष्पद्वदनमबूबूवन् ॥१०  
भो भोः पुरुषशार्दूल ! दौर्मनस्यमिदं त्यज । न प्रियाप्रिययो राजन् ! निष्ठा देहिषु दृश्यते ॥११  
यथा दासमयी योषिन्नत्यते कुहकेच्छया । एवमीश्वरतन्त्रोऽयमीहते सुखदुःखयोः ॥१२  
शौरेः सप्तदशाहं वै संयुगानि पराजितः । त्रयोर्विशतिभिः सैन्यर्जिण्य एकमहं परम् ॥१३  
तथाप्यहं न शोचामि न प्रहस्यामि कर्हिचित् । कालेन दैवयुक्तेन जानन् विद्रावितं जगत् ॥१४  
अधुनापि वयं सर्वे वीरयूथपयूथपाः । पराजिताः फल्नुतन्त्रैर्युभिः कृष्णपालितैः ॥१५  
रिपवो जिग्युरधुना काल आत्मानुसारिण । तदा वयं विजेष्यामो यदा कालः प्रदक्षिणः ॥१६  
एवं प्रबोधितो मित्रैश्चैद्योऽगात् सानुगः पुरम् । हतशेषाः पुनस्तेऽपि ययुः स्वं स्वं पुरं नृपाः ॥७  
रुक्मी तु राक्षसोद्धाहं कृष्णाद्विडसहन् स्वसुः । पृष्ठोन्वगमत् कृष्णमक्षौहिण्या वृतो बली ॥८  
रुक्म्यमर्षी सुसंरब्धः शृणवतां सर्वभूभुजाम् । प्रतिज्ञे महाबाहुर्दशितः सशरासनः ॥१९

बतावीने भागी गया।<sup>९</sup> जे शिशुपालनी कांति नाश पामी हती, उत्साह ज्तो रह्यो हतो, मोहुं सूकातुं हतुं अने जाणो पोतानी परशेली स्त्री हराई गई होय तेम आतुर थयो हतो. तेने मणीने ते राजाओंसे कहुं के हे पुरुषोमां सिंह ! आ विषयनो खेद छोडी दे. हे राजा ! प्राणीओमां सुखदुःखनी स्थिरता देखाती ज नथी।<sup>१०-११</sup> जेम लाकडांनी पूतणी, नयावनारा मदारीनी ईरच्छा प्रमाणे नाये छे, ते सर्वे प्राणीओ ईरच्छरने आधीन रहीने सुखदुःख पाम्या करे छे।<sup>१२</sup> हुं कृष्णना हाथथी सतरवार त्रेवीश अक्षौहिणीओनी साथे हारी गयो हतो अने केवण एकवार ज ज्ञत्यो छुं, तोपण जगतने ईरच्छरे प्रेरेला काणथी जेंचातुं जाणी कटी पण शोक करतो नथी अने राज्ञ पण थतो नथी।<sup>१३-१४</sup> हमणां पण आपाणे सर्वे वीरलोकोना यूथपतियोना पण यूथपति छीअे ते आपाणे कृष्णे पाणेला अने थोडां सैन्यवाणा यादवोना हाथथी हारी गया।<sup>१५</sup> हमणां शत्रुओ पोताने काण अनुकूण होवाने लीथे ज्ञती गया, अने ज्ञारे आपाणने काण अनुकूण थशे त्यारे आपाणे ज्ञतीशुं।<sup>१६</sup> आ प्रमाणे भित्रोंसे समजाव्युं अटले शिशुपाल पोताना अनुयरो सहित पोताना पुरमां गयो अने भरतां बाकी रहेला ते राजाओं पण पोत पोताना नगरोमां गया।<sup>१७</sup> बहेननो जे राक्षस विवाह थयो तेने नहीं सहन करी शक्तो बणवान रुक्मी तो एक अक्षौहिणी सेना साथे लईने भगवाननी पाइण गयो।<sup>१८</sup> मोटा हाथवाणा अने कोध पामता रुक्मीसे कवय पहेरी तथा धनुष हाथमां लई, सर्वे राजाओना सांभणतां प्रतिज्ञा करी के युद्धमां कृष्णने मार्या विना अने रुक्मिणीने पाणी लाव्या विना, हुं कुंडिनपुरमां प्रवेश नहीं करुं.

अहत्वा समरे कृष्णमप्रत्यूह्य च रुक्मिणीम् । कुण्डिनं न प्रवेश्यामि सत्यमेतद् ब्रवीमि वः २०  
इत्युक्त्वा रथमारुह्य सारथिं प्राह सत्वरः । चोदयाश्वान् यतः कृष्णस्तस्य मे संयुगं भवेत् २१  
अद्याहं निश्चैर्बाणीर्गोपालस्य सुदुर्मतेः । नेष्ये वीर्यमदं येन स्वसा मे प्रसभं हृता ॥२२  
विकल्पमानः कुमतिरीश्वरस्याप्रमाणवित् । रथेनैकेन गोविन्दं तिष्ठ तिष्ठेत्यथाह्यत् ॥२३  
धनुर्विकृष्टं सुदृढं जघे कृष्णं त्रिभिः शरैः । आह चात्र क्षणं तिष्ठ यदूनां कुलपांसन ! ॥२४  
कुत्र यासि स्वसारं मे मुषित्वा ध्वाङ्गवद्विः । हरिष्येऽद्य मदं मन्द ! मायिनः कूटयोधिनः २५  
यावन्न मे हतो बाणैः शयीथा मुञ्च दारिकाम् । स्मयन् कृष्णो धनुश्छित्त्वा षड्भिर्विव्याध स्वक्मिणम्  
अष्टुभिश्चतुरो वाहान् द्वाभ्यां सूतं ध्वजं त्रिभिः । स चायद् धनुरादाय कृष्णं विव्याध पञ्चभिः ॥२७  
तैस्ताडितः शरौघैस्तु चिच्छेद धनुरच्युतः । पुनरन्यदुपादत्त तदप्यच्छिनदव्ययः ॥२८  
परिघं पद्मिशं शूलं चर्मासी शक्तिमोरमै । यद्यदायुधमादत्त तत् सर्वं सोऽच्छिनद्वरिः ॥२९  
ततो रथादवप्लुत्य खड्गपाणिर्जिधांसया । कृष्णमध्यद्रवत् क्रुद्धः पतङ्ग इव पावकम् ॥३०

तमारी पासे हुं आ साची प्रतिशा करुं छुं. १८-२० आ प्रमाणे बोली रथमां बेसी  
उतावणथी सारथीने कहुं के ज्यां कृष्ण छे त्यां घोडा हाँकी चाल के जेथी श्रीकृष्णनी  
साथे भारे युद्ध थाय. २१ आज हुं ऐ भारे हुबुद्धिवाणा गोवाणना पराकर्मना  
अभिमानने सजावेला बाणथी उतारी नाखीश, के जे बणात्कारथी भारी बहेनने  
हरी गयो छे. २२ आ प्रमाणे बकता अने ईश्वरना प्रभावने नहीं जाणता ऐ  
हुबुद्धि रुक्मीअे एक रथथी भगवाननी पासे पहोंची जई, उभो रहे ! उभो  
रहे ! ऐवी हाकल करी. २३ धनुषने बहुज खेंयीने श्रीकृष्णने त्रषा बाण मार्या अने  
कहुं के हे यादवोना कुणने वटलावनार ! अहीं क्षणमात्र उभो रहे. २४ कागडो  
जेम यज्ञना हविने लई जाय तेम भारी बेनने लईने तुं क्यां जाय छे ? हे  
मंदबुद्धिवाणा ! जे तुं मायावी अने कपटथी युद्ध करनार छे ते तारो मद आज हुं  
उतारीश. २५ हुं तने हजु येतवणी आपुं छुं के मारां बाणथी मरण पामीने तुं सूर्ई  
गयो नथी ते पहेलां भारी बहेनने भूकी हे. ऐ वयन सांभणी भगवाने हसतां  
हसतां ते रुक्मीनुं धनुष कापी नाखी, छ बाणथी तेने वींध्यो, आठ बाणथी चार  
घोडाने वींध्या, बे बाणथी सारथीने वींध्यो अने त्रषा बाणथी तेनी धज्जने वींधी  
नाखी. रुक्मीअे बीजुं धनुष लई भगवानने पांच बाण मार्या. २६-२७ धणां बाणथी  
प्रहार पामेला भगवाने तेनुं धनुष कापी नाख्युं, रुक्मीअे बीजुं धनुष लीधुं तो ते  
पण भगवाने कापी नाख्युं. २८ आ प्रमाणे परिघ, पद्मिश, शूल, ढाल, तलवार,  
सांग अने तोमर आहि जे आयुधो रुक्मीअे लीधां ते सर्वे आयुध भगवाने

तस्य चापततः खड्गं तिलशश्वर्म चेषुभिः । छित्त्वासिमाददे तिगमं रुक्मिणं हन्तुमुद्यतः ३१  
दृष्ट्वा भ्रातृवधोद्योगं रुक्मिणी भयविह्ला । पतित्वा पादयोर्भर्तुरुवाच करुणं सती ॥३२  
योगेश्वराप्रमेयात्मन् ! देवदेव ! जगत्पते ! हन्तु नार्हसि कल्याण ! भ्रातरं मे महाभुज ! ॥३३

## श्रीशुक उवाच

तया परित्रासविकम्पिताङ्ग्या शुचावशष्यमुखरुद्धकण्ठया ।  
कातर्यविस्त्रंसितहेममालया गृहीतपादः करुणो न्यवर्तत ॥३४॥  
चैलेन बद्ध्वा तपसाधुकारिणं सश्मश्रुकेशं प्रवपन् व्यरूपयत् ।  
तावन्मदुः परसैन्यमद्दुतं यदुप्रवीरा नलिनी यथा गजाः ॥३५॥  
कृष्णान्तिकमुपव्रज्य ददृशुस्तत्र रुक्मिणम् । तथा भूतं हतप्रायं दृष्ट्वा सङ्कर्षणो विभुः ।  
विमुच्य बद्धं करुणो भगवान् कृष्णमब्रवीत् ॥३६॥

असाधिकं त्वया कृष्ण ! कृतमस्मज्जुगुप्सितम् । वपनं श्मश्रुकेशानां वैरूप्यं सुहृदो वधः ३७

कापी नाख्यां. २८ पछी रुक्मी रथमांथी उतरी पडी हाथमां खडग लईने पतंगियो  
जेम अग्नि सामे दोडे तेम, भारी नाखवानी ईश्वरथी भगवाननी सामे दोडयो. ३०  
ऐ रुक्मी आवतो हतो त्यां मार्गमां ज भगवाने तेनी तरवारने तथा ढालने  
पोताना बाणोवडे तिल तिल जेटला कटका करी कापी नाख्युं अने पडी तेने भारी  
नाखवा सारु तीक्ष्णा तलवार हाथमां लीधी. ३१ भाईना वधनो उद्योग जोई भयथी  
विह्वण थयेलां सती रुक्मिणी स्वामीना पगमां पडीने दीन वयन बोल्यां के हे  
योगेश्वर ! हे देवना देव ! हे जगतना पति ! हे कल्याणरुप महाभाषु ! तमारे  
भारा भाईने भारी नाखवो न जोईअे. ३२

शुकदेवज्ञ कहे छे हे राजा ! रुक्मिणीनां अंग त्रासथी ध्रूजतां हतां, शोकथी  
मोहुं सुकातुं हतुं, कंठ रोकाई गयो हतो, विह्वणपणाने लीधे सुवर्णानी भाणाखसी  
गई हती. आवां रुक्मिणीअे श्रीकृष्णनां चरण पकडतां दयाणु भगवान रुक्मीने  
मारवाथी अटक्या. ३३-३४ आम छतां पण रुक्मी पोताना अनिष्ट प्रयत्नथी  
अटक्यो नहि, तेथी रुक्मीने वस्त्रथी बांधी लई भगवाने ठेकाणे ठेकाणे थोडी  
थोडी दाढी, मूळ अने माथाना वाण रही जाय, ऐवी रीते मूळी नाखीने विरुप  
करी नाख्यो. तेलीवारमां हाथीओ जेम कमणनुं मर्दन करे तेम यादवोना वीर  
योद्धाओभे रुक्मीना सैन्यनुं मर्दन करी नाख्युं. ३५ यादवो भगवाननी पासे आव्या  
त्यारे बंधाएला अने हतप्राय थयेला रुक्मीने जोई दयाणु बलरामे तेमने छोडी  
भूकी भगवानने कहुं के कृष्ण ! तमे आ आपणी निंदा थाय ऐवुं भूंडुं काम कर्यु,

મૈવાસમાન્ સાધ્યસૂયેથા ભાતુર્વૈસ્ત્રચિન્તયા । સુખદુઃખદો ન ચાન્યોરસ્તિ યતઃ સ્વકૃતભુક્પુમાન્  
બન્ધુર્વધાર્હદેષોરૂપિ ન બન્ધોર્વધમહર્તિ । ત્યાજ્ય: સ્વેનૈવ દોષેણ હત: કિ હન્યતે પુનઃ ॥૩૯  
ક્ષત્રિયાણામયં ધર્મ: પ્રજાપતિવિનિર્મિતઃ । ભાતાપિ ભાતરં હન્યાદ્ યેન ઘોરતરસ્તત: ॥૪૦  
રાજ્યસ્ય ભૂર્મેર્વિતસ્ય લ્લિયો માનસ્ય તેજસ: । માનિનોર્નયસ્ય વા હેતો: શ્રીમદાસ્થા: ક્ષિપન્તિ હિ ॥  
તવેયં વિષમા બુદ્ધિ: સર્વભૂતેષુ દુર્દુદામ્ । યન્મન્યસે સદાભર્દ્રં સુહૃદાં ભદ્રમજ્ઞવત् ॥૪૨  
આત્મમોહો નૃણામેષ કલ્પ્યતે દેવમાયયા । સુહૃદ દુર્દુદાસીન ઇતિ દેહાત્મમાનિનામ् ॥૪૩  
એક એવ પરો હ્યાત્મા સર્વેશામપિ દેહિનામ્ । નાનેવ ગૃહાતે મૂર્ખૈયથા જ્યોતિર્યથા નભ: ॥૪૪  
દેહ આદ્યન્તવાનેષ દ્રવ્યપ્રાણગુણાત્મકઃ । આત્મન્યવિદ્યયા ક્લાસ: સંસારયતિ દેહિનમ् ॥૪૫

દાઢી મૂછ અને માથાના વાળ મૂંડી નાખી, રૂપ બગાડી નાખવું એ સંબંધીનો વધ  
કર્યો જ કહેવાય છે.<sup>૩૬-૩૭</sup> પછી બલરામ રૂક્મિણીને કહેવા લાગ્યા, હે સારા  
સ્વભાવવાળાં! ભાઈને વિરૂપ કરી નાખ્યો તેની ચિંતાથી અમારા ઉપર દેષ લાવશો  
નહીં. સુખદુઃખ આપનાર બીજો કોઈ છે જ નહીં, કારણ કે પુરુષને પોતાનું કરેલું  
જ ભોગવંસું પડે છે.<sup>૩૮</sup> ફરીવાર ભગવાનને કહે છે સંબંધીએ દેહાંત શિક્ષાને  
લાયક અપરાધ કર્યો હોય તોપણ તેને સંબંધીએ નહીં મારવો જોઈએ, પણ છોડી  
દેવો જોઈએ, કેમકે પોતાના દોષથી જ જે મરી ગયો હોય તેને ફરીવાર શા માટે  
મારવો જોઈએ, કારણ કે મરેલાને મારવો એ વીરપુરુષ માટે નિંદનીય છે.<sup>૩૯</sup>  
ફરીવાર રૂક્મિણીને કહે છે વધ કરવો એ ક્ષત્રિયોનો ધર્મ છે, અને એ ધર્મપ્રજાપતિ  
બ્રહ્માએ જ નિર્માણ કરેલો છે કે જે ધર્મથી ભાઈ ભાઈને પણ મારી નાખે છે. આ  
ધર્મ તો અતિ ભયંકર છે, માટે આમાં અમારો કોઈ દોષ નથી.<sup>૪૦</sup> ભગવાનને કહે  
છે જેઓ લક્ષ્મીના મદથી આંધળા થયેલા અભિમાની લોકો છે તેઓ રાજ્યના,  
પૃથ્વીના, ધનના, સ્ત્રીના, માનના કે તેજના કારણથી અથવા બીજા કોઈ કારણથી  
સંબંધીઓનું અપમાન કરે છે, પણ આપણા હાથથી તેવું કામ કરવું યોગ્ય નથી.<sup>૪૧</sup>  
રૂક્મિણીને કહે છે તમારા ભાઈઓ કે જેઓ સર્વપ્રાણીઓના શત્રુરૂપ છે, તેઓનું  
અજ્ઞાનીની પેઠે તમે સર્વદા સારું ઈચ્છાઓ છો એ તમારી જ બુદ્ધિની ભૂલ છે, અપરાધી  
સંબંધીઓનું આ રીતે કલ્યાણ ઈચ્છાવું તે ખરી રીતે તેઓનું અકલ્યાણ ઈચ્છાવા  
જેવું છે.<sup>૪૨</sup> દેહને આત્મા કરી માનનારા મનુષ્યોને આ મિત્ર, આ શત્રુ અને આ  
ઉદાસીન, આવી રીતનો અંત: કરણનો મોહ ઈશ્વરની માયાથી જ થયો છે.<sup>૪૩</sup> સર્વે  
જીવોનો અંતરાત્મા એક જ છે. ગુમપણે સર્વે જીવોને વિષે રહેલો છે. જેમ કાણમાં  
અજ્ઞિ ગૂઢપણે રહેલો છે, તેમ પરમાત્મા સર્વે જીવોને વિષે ગૂઢપણે રહેલા છે.

નાત્મનોર્નયેન સંયોગો વિયોગશ્વાસત: સતિ । તદ્દેતુત્વાત્તત્ત્વસિદ્ધેર્વૃગૂપાભ્યાં યથા રવે: ॥૪૬  
જન્માદયસ્તુ દેહસ્ય વિક્રિયાનાત્મન: ક્રચિત । કલાનામિવ નૈવેન્દોર્મૃતિર્દ્યસ્ય કુદ્રારિવ ॥૪૭  
યથા શયાન આત્માનં વિષયાન્ ફલમેવ ચ । અનુભુક્તેપ્યસત્યર્થે તથાર્જનોત્યબુધો ભવમ् ૪૮  
તસ્માદજ્ઞાનજં શોકમાત્મશોષવિમોહનમ् । તત્વજ્ઞાનેન નિર્હૃત્ય સ્વસ્થા ભવ શુચિસ્મતે! ૪૯

## શ્રીશુક ઉત્તા

એવં ભગવતા તન્વી રામેણ પ્રતિબોધિતા । વૈમનસ્યં પરિત્યજ્ય મનો બુદ્ધ્યા સમાદધે ॥૫૦  
પ્રાણાવશેષ ઉત્સ્થો દ્વિદ્બિર્હત્તબલપ્રભઃ । સ્મરન્ વિરૂપકરણં વિતથાત્મમનોરથઃ ॥૫૧  
ઇતાં આકાશની પેઠે નિર્લેંપ છે.<sup>૪૪</sup> આદિ અંતવાળો અને પંચભૂત, ઈદ્રિય તથા  
શબ્દાદિ ગુણોના સમુદ્દાયરૂપ આ દેહ કે જે અજ્ઞાનને લીધે આત્માને ઠેકાડો  
કલ્પાયેલ છે, તે દેહ જીવને જન્મ મરણ આપ્યા કરે છે.<sup>૪૫</sup> દેહ જો પોતાના સંબંધ  
માત્રથી જીવાત્માને જન્મ મરણ આપતો હોય તો જીવ દ્વારા જીવોમાં અંતર્યામીપણે  
રહેલા પરમાત્માને પણ જન્મ મરણ આપનાર થાય? તો કહે છે કે, પરમાત્માને  
દેહની સાથે સંયોગ અને વિયોગ નથી. દેહની સાથે સંયોગ અને વિયોગ કેવળ  
જીવનો જ છે. દેહનો કેવળ પરમાત્માને આધીન હોવાને કારણે એ દેહ પરમાત્માને  
બંધન આપનાર થાય નહિ. જેમ દ્વિષ્ટે તથા દ્વિષ્ટી પ્રકાશય એવું જે રૂપ આ બસે  
સૂર્યને આધીન છે, ઇતાં તેનાથી સૂર્યને કોઈ સંબંધ નથી. તેમ દેહ પરમાત્માને  
આધીન હોવા ઇતાં તે દેહની સાથે પરમાત્માને કોઈ સંબંધ નથી.<sup>૪૬</sup> જેમ વધવું  
અને ઘટવું તે ચંદ્રમાની કળાઓનું જ છે પણ ચંદ્રમાનું નથી, તેમ જન્મ મરણાદિક  
સર્વે વિક્રિયાઓ દેહની જ છે. પણ આત્માની કયારેય નથી. અમાવાસ્યાએ કળાનો  
ક્ષય થતાં જેમ ચંદ્રમાનો ક્ષય થયો કહેવાય છે, તેમ દેહનો નાશ થતાં આત્માનો  
નાશ થયો કહેવાય છે.<sup>૪૭</sup> જેમ સૂર્યને માણસ સ્વપ્ર સંબંધી સર્વે દૃશ્ય પદાર્થો  
અસ્થિર હોવા ઇતાં પણ ભોક્તા, ભોગયવિષયો અને ફળનો સ્થિર બુદ્ધિથી  
અનુભવ કરે છે. તેમ અજ્ઞાની માણસ સર્વે દૃશ્ય પદાર્થો અસ્થિર હોવા ઇતાં પણ  
સ્થિર બુદ્ધિથી સંસારનો અનુભવ કરે છે.<sup>૪૮</sup> એટલા માટે હે સુંદર મંદહારયવાળાં  
રૂક્મિણી! અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો શોક, મનને શોષ તથા મોહ ઉત્પન્ન કરનાર  
છે. તેને તત્વજ્ઞાનથી દૂર કરી તમે સ્વસ્થ થાઓ.<sup>૪૯</sup>

શુકદેવજી કહે છે આ પ્રમાણો મહાત્મા બળદેવજીએ સમજાવતાં રૂક્મિણીએ  
ખેદ છોડી દઈને બુદ્ધિથી પોતાના મનને સ્થિર કર્યું.<sup>૫૦</sup> જેના પ્રાણ જ અવશેષ રહ્યા  
હતા એવો અને શત્રુઓએ છોડી દીધેલો, પોતાના વિરૂપને સંભારતો, વર્થ

चक्रे भोजकटं नाम निवासाय महत् पुरम् । अहत्वा दुर्मतिं कृष्णमप्रत्यूह्या यवीयसीम् ।  
कुण्डनं न प्रवेक्ष्यामीत्युक्त्वा तत्रावसद् रुषा ॥५२  
भगवान् भीष्मकसुतामेवं निर्जित्य भूमिपान् । पुरमानीय विधिवदुपयेमे कुरुद्वह ॥५३  
तदा महोत्सवो नृणां यदुपुर्या गृहे गृहे । अभूदनन्यभावानां कृष्णे यदुपतौ नृप ! ॥५४  
नरा नार्यश्च मुदिताः प्रमुष्मणिकुण्डलाः । पारिबर्हमुपाजहुर्वरयोश्चित्रवाससोः ॥५५  
सा वृष्णिपुर्युत्तिभितेन्नकेतुभिर्विचित्रमाल्याम्बररत्नतोरणैः ।  
बभौ प्रतिद्वार्युपकलृममङ्गलैरापूर्णकुभागुरुधूपदीपकैः ॥५६॥  
सिक्तमार्गं मदच्युद्धिराहूतप्रेष्टभूभुजाम् । गजैर्द्वास्मु परामृष्टरम्भापूर्णोपशोभिता ॥५७  
कुरुसृज्यकैक्यविदर्थयदुक्तन्यः । मिथो मुमुदिरे तस्मिन् सम्भ्रमात् परिधावताम् ॥५८  
रुक्मिण्या हरणं श्रुत्वा गीयमानं ततस्ततः । राजानो राजकन्याश्च बभूवृष्टशविस्मिताः ॥५९  
द्वारकायामभूद् राजन् महामोदः पुरोक्षाम् । रुक्मिण्या रमयोपेतं दृष्ट्वा कृष्णं श्रियः पतिम् ॥६०  
इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे उत्तरार्थं  
रुक्मिण्युद्धाहे चतुःपञ्चाशतमोऽध्यायः ॥५४॥

मनोरथवाणो अने जेनां बण तथा कांति हुणाई गयां छे; ऐवो रुक्मी प्रथम बोध्यो उतो के हुष्टभुद्धिवाणा कुष्णने मार्या विना अने रुक्मिणीने पाणी लीधा विना हुं आ कुंडिनपुरमां प्रवेश करीश नहीं, तेथी ज्यां पोते विरुप थयो त्यां ज भोजकट नामनुं नवुं पुर वसावीने रह्यो.<sup>५१-५२</sup> हे राजा ! आ प्रमाणे श्रीकुष्ण भगवान् सर्वे राजाओने ज्यती लई भीष्मक राजानी कुंवरीने द्वारकामां लावी तेने शास्त्रोक्त विधि प्रमाणे परएया हता.<sup>५३</sup> ए समये द्वारकानां माणसोने श्रीकुष्णमां अनन्य भक्ति थयेली हती, तेओने घेर घेर मोटो उत्सव थई रह्यो हतो.<sup>५४</sup> जेओ स्वच्छ मणिओनां कुंडणो पहेयां हतां ऐवां अने प्रसन्न थयेलां स्त्री पुरुषो, विचित्र वस्त्रोवाणां ए पति पत्नीने वधाववा माटे आपवा माटेना पदार्थो लाव्यां हतां.<sup>५५</sup> ए द्वारका उंचा करेला ईरध्वजो, विचित्र पुष्पो, वस्त्रो, रत्नो, तोरणो, प्रत्येक द्वारमां करेलां मंगणो, पूर्ण कुंभो, अगरुना धूपो अने दीवाओथी शोभी रही हती.<sup>५६</sup> बोलावेला राजाना मद झरनारा हाथीओ द्वारा मार्गो पर पाणी छांट्यां हतां. अने द्वारमां उंची करेली केणो अने सोपारीनां वृक्षोथी द्वारिका शोभी रही हती.<sup>५७</sup> उत्साहथी चारेकोर दोडाढोड करता बंधुओमां कुल, सूर्ज्य, केकेय, विदर्भ, यदु, कुंति अने देशना राजाओ परस्पर मणी आनंद पाभ्या.<sup>५८</sup> राजाओ अने राजकन्याओ चारेकोर गवातुं रुक्मिणीनुं हरण

अथ पञ्चपञ्चाशतमोऽध्यायः (५५)

॥ श्रीशुक्तउवाच ॥

कामस्तु वासुदेवांशो दग्धः प्राग् रुद्रमन्युना । देहोपपत्तये भूयस्तमेव प्रत्यपद्यत ॥१  
स एव जातो वैदर्थ्यं कृष्णावीर्यसमुद्भवः । प्रद्युम्न इति विख्यातः सर्वतोऽनवमः पितुः ॥२  
तं शास्त्रः कामरूपी हृत्वा तोकमनिर्दर्शम् । स विदिवाऽऽत्मनः शत्रुं प्रास्योदत्यत्यगाद् गृहम् ॥३  
तं निर्जित बलवान् मीनः सोऽप्यपैः सह । वृतो जालेन महता गृहीतो मत्यजीविभिः ॥४  
तं शम्बराय कैवर्ता उपाजहुरुपायनम् । सूदा महानसं नीत्वावद्यन् स्वधितिनाद्भुतम् ॥५  
दृष्ट्वा तदुदरे बालं मायावत्यै न्यवेदयन् । नारदोऽकथयत् सर्व तस्याः शङ्कितचेतसः ।  
बालस्य तत्त्वमुत्पत्तिं मत्स्योदरनिवेशनम् ॥६  
सा च कामस्य वै पत्नी रतिर्नाम यशस्विनी । पत्युर्निर्दद्धदेहस्य देहोत्पत्तिं प्रतीक्षती ॥७  
सांभणीने बहु ज विस्मय पाभ्या.<sup>५९</sup> हे राजा ! लक्ष्मीना अवताररूप रुक्मिणीनी साथे भगवान् श्रीकुष्णने जोई द्वारकाना रहेवासीओने मोटो आनंद थयो.<sup>६०</sup>  
इति श्रीमद् महापुराणा भागवतना दशम ऋक्ष्यानो योपनमो अद्याय संपूर्णः.

अद्याय ५५  
शंखरासुरे करेलुं प्रद्युम्ननुं हराणा अने शंखरासुरनो वध करी,  
रतिनी साथे द्वारिका आवता प्रद्युम्न.

शुक्देवज्ञ कुहे छे हे राजा ! वासुदेव भगवाननी विभूतिरूप ऐवो काम पूर्वे महादेवना कोधथी बणी गयो हतो. ते पाणी फरीवार पोताना देहना संयोगने माटे भगवानने ज प्राम थयो.<sup>१</sup> ए कामदेव रुक्मिणीमां भगवानना वीर्यथी उत्पत्त थया, अने प्रद्युम्न ऐवा नामे प्राप्यात थया हता. ए प्रद्युम्न कोई रीते पोताना पिताथी न्यून न हता.<sup>२</sup> कामदेवनो शत्रु शंखरासुर, ए प्रद्युम्नने पोतानो शत्रु जाणी, तेमना जन्मने हजु दश दिवस पूरा थया न हता, त्यां ज ते बाणकने वथेष्ट रूप धरीने हरी गयो. अने तेमने समुद्रमां नाभी दृष्टि पोताने घेर गयो. प्रद्युम्नने समुद्रमां कोई मोटुं माछलुं गणी गयुं. ए माछलाने माछीमारो ऐ मोटी जाणथी वींटी लईने, बींज माछलांओनी साथे पकडी लीधुं.<sup>३-४</sup> माछीमारो पाण मोटां माछलांने शंखरासुरनी पासे भेट लाव्या.<sup>५</sup> माछलांना पेटमांथी पुत्र नीकण्यो, तेने जोई ते पुत्रने रसोयाओ ऐ मायावतीने आप्यो. मायावतीने शंका आवतां नारदज्ञाए आवीने तेने कह्युं के आ तारो पति कामदेव छे, ते श्रीकुष्णथी

નિસ્તપ્તિ શાંખરેણ સા સૂપौદનસાધને । કામદેવં શિશું બુદ્ધા ચક્રે સ્લેહં તદાર્થકે ॥૮  
નાતિદીર્ઘેણ કાલેન સ કાણ્ણો રૂઢયૌવન: । જનયામાસ નારીણાં વીક્ષન્તીનાં ચ વિભ્રમમ् ॥૯  
સા તં પર્તિ પદ્મદલાયાથેક્ષણં પ્રલમ્બબાહું નરલોકસુન્દરમ् ।

સારીડહાસોત્તભિત્તભુવેક્ષતી પ્રીત્યોપતસ્થે રતિરઙ્ગ ! સૌરતૈ: ॥૧૦॥

તામાહ ભગવાન્ કાર્ષિર્માતસે મતિરન્થા । માતૃભાવમતિક્રમ્ય વર્તસે કામિની યથા ॥૧૧

રતિરુવાચ

ભવાન્ નારાયણસુત: શાંખરેણાહૃતો ગૃહત્ । અહંતેઽધિકૃતા પલી રતિ: કામો ભવાન્ પ્રભો ! ॥૧૨  
એ ત્વાનિર્દાંસિધ્યાવક્ષિપચ્છબ્રરોજસુર: । મત્સ્યોઽગ્રસીનદુદરદિહ્ પ્રાસો ભવાન્ પ્રભો ! ॥૧૩  
તમિમં જહિ દુર્ધ્ર્થ દુર્જયં શત્રુમાત્મન: । માયાશતવિદં ત્વં ચ માયાભિર્મોહનાદિભિ: ॥૧૪  
પરિશોચનિ તે માતા કુરીવ ગતપ્રજા । પુત્રસ્વેહાકુલા દીના વિવત્સા ગૌરિવાતુરા ॥૧૫  
પ્રભાષ્યેવં દવી વિદ્યાં પ્રદ્યુમાય મહાત્મને । માયાવતી મહામાયાં સર્વમાયાવિનાશિનીમ् ॥૧૬

રક્ષિમણીમાં ઉત્પત્ત થયેલ છે અને શંખરાસુરના હરી જવાથી માછલાંના પેટમાં  
આવેલ છે. એ માયાવતી કામદેવની રતિ નામની સ્ત્રી હતી તે બળી ગયેલા પોતાના  
પતિને દેહની પ્રાભિ થવાની વાટ જોતી હતી. ૧૭ એ રતિ, રૂપ અને નામ બદલાવીને  
આવેલી હોવાને લીધે શંખરાસુરે તેને દાળ-ભાત કરવાના કામમાં રાખી હતી. એ  
રતિએ તે બાળકને કામદેવ જાણી તેના ઉપર સ્નેહ કર્યો. ૧૮ થોડા કાળમાં જ જેને  
યુવાની આવી છે, એવા તે પ્રદ્યુમ્ન પોતાને જોનારી સ્ત્રીઓને મોહ ઉત્પત્ત કરવા  
લાગ્યા. ૧૯ હે રાજા ! કમળની પાંખડીઓની સમાન નેત્રવાળા, લાંબા હાથવાળા  
અને મનુષ્યલોકમાં સર્વોત્તમ રૂપાળા, એ પતિ સામું લાજ સહિત હાસ્યથી ઊંચી  
કરેલી ભૂકુટીથી જોતી રતિ, પ્રીતિથી તેને કામનાની ભાવથી સેવવા લાગી. ૨૦ એ  
રતિને પ્રદ્યુમ્ને કહું કે હે મા ! તમારી બુદ્ધિ વિપરીત કેમ થઈ છે ? કે જેથી આબરૂ  
મૂકીને પત્નીની પેઠે વર્તો છો. ૨૧ રતિએ કહું કે હે પ્રભુ ! તમે નારાયણના પુત્ર છો  
અને શંખરાસુર નારાયણના ઘરમાંથી લાવ્યો છે, હું રતિ નામે તમારી સ્ત્રી છું અને  
તમે કામદેવરૂપ મારા પતિ છો. ૨૨ તમને દશ દિવસ થયા ન હતા ત્યાં જ આ  
શંખરાસુરે સમુદ્રમાં નાખ્યા હતા અને સમુદ્રમાં માછલું ગળી ગયું હતું. હે પ્રભુ !  
માછલાંના ઉદરમાંથી અહીં આવ્યા છો. ૨૩ સેંકડો માયાને જાણનાર અને ઘણી  
મહેનતથી જીતાય એવા પોતાના શત્રુ શંખરાસુરને મોહનાદિ માયાથી મારો. ૨૪  
જેનો પુત્ર જતો રહ્યો છે એવાં, અને પુત્રના સ્નેહથી વ્યાકુળ અને વાછરડાં વિનાની  
ગાયની પેઠે દુઃખ ભોગવતાં તમારી મા ટીટોડીની પેઠે રૂદ્ધન કરે છે. ૨૫

સ ચ શાંખરમભેત્ય સંયુગાય સમાહૃત । અવિષહૃસ્તમાક્ષેપૈ: ક્ષિપન્ સજ્જનયન્ કલિમ્ ॥  
સોઽધિક્ષિસો દુર્વચોભિ: પાદાહત ઇવોરગ: । નિશ્ચક્રામ ગદાપાણિરમર્બત્તાપ્રલોચન: ॥૧૮  
ગદામાવિધ્ય તરસા પ્રદ્યુમાય મહાત્મને । પ્રક્ષિપ્ય વ્યનદ્રાદં વજ્ઞનિષેષનિષ્ઠ્રમ્ ॥૧૯  
તામાપતન્તી ભગવાન્ પ્રદ્યુમ્નો ગદયા ગદામ્ । અપાસ્ય શત્રવે ક્રુદ્ધ: પ્રાહિણોત્ સ્વગદાં નૃપ! ।  
સ ચ માયાં સમાશ્રિત્ય દૈત્યો મયર્દિશતામ્ । મુચેઽસ્ત્રમય વર્ષ કાણ્ણો વૈહયસોઽસુર: ॥૨૧  
બાધ્યમાનોઽસ્ત્રવર્ષેણ રૌક્રિમણોયો મહારથ: । સન્ત્વાત્મિકાં મહાવિદ્યાં સર્વમાયોપમર્દીનીમ્ ॥૨૨  
તતો ગૌહ્યકગાન્ધ્યવર્ષૈશાચોરગરાક્ષસીઃ । પ્રાયુઙ્ક ! શતશો દૈત્ય: કાર્ષિણ્વર્ધમયત્ સ તા: ॥૨૩  
નિશાતમસિમુદ્યાય સક્રિટિં સકુણડલમ્ । શાંખરસ્ય શિર: કાયાત્ તાપ્રશ્મશ્વોજસાહરત્ ॥૨૪  
આકીર્યમાણો દિવિજૈ: સ્તુવદ્ધિ: કુસુપોત્કરૈ: । ભાર્યાયાંબરચારિણ્યા પુરં નીતો વિહયસા ॥૨૫  
અન્ત:પુરવરં રાજન્ ! લલનાશતસઙ્કુલમ્ । વિવેશ પત્યા ગગનાદ્ વિદ્યુતેવ બલાહકઃ ॥૨૬  
તં દૂષ્ટા જલદશ્યામં પીતકૌશેયવાસસમ્ । પ્રલમ્બબાહું તાપ્રાક્ષં સુસ્મિતં સુચિરાનનમ્ ॥૨૭

શુક્ટેવજુ કહે છે આ પ્રમાણે કહી તે માયાવતીએ મહાત્મા પ્રદ્યુમ્નને સર્વે  
માયાઓનો વિનાશ કરનારી મહામાયા નામની વિદ્યાનો ઉપદેશ કર્યો. ૨૮ પછી  
પ્રદ્યુમ્ને શંખરાસુરની પાસે આવી અસહ્ય ગાળો દઈ તિરસ્કાર કરી કજિયો ઉત્પત્ત  
કરતાં તેને યુદ્ધ કરવા માટે હાકલ કરી. ૨૯ દુર્વચનોથી તિરસ્કાર પાપેલો તે  
શંખરાસુર પગના પ્રહારથી છંછડાયેલા સર્પની પેઠે કોધથી આંખો રાતી કરી ગદા  
હાથમાં લઈને યુદ્ધ કરવા બહાર નીકળ્યો. ૩૦ વેગથી ગદાને ફેરવી મહાત્મા  
પ્રદ્યુમ્નની ઉપર નાખી અને વજના કડાકા જેવી કંદણ ગર્જના કરી. ૩૧ હે રાજા !  
કોધ પામેલા પ્રદ્યુમ્ને તે આવતી ગદાને પોતાની ગદાથી દૂર કરીને શંખરાસુર  
ઉપર પોતાની ગદા ફેંક્રી. ૩૨ પછી મયદાનવે ઉત્પત્ત કરેલી દેત્યોની માયાઓનો આશ્રય  
કરી, આકાશમાં ઊભેલો શંખરાસુર પ્રદ્યુમ્ન ઉપર અસ્ત્રોની વૃષ્ટિ કરવા લાગ્યો. ૩૩  
અસ્ત્રોની વૃષ્ટિથી પીડા પામેલા પ્રદ્યુમ્ને સર્વે માયાઓનો નાશ કરનારી પોતાની  
સત્તવગુણમય મહા વિદ્યાનો પ્રયોગ કર્યો. ૩૪ પછી શંખરાસુરે યક્ષ, ગંધર્વ, પિશાચ,  
સર્પ અને રાક્ષસોની સેંકડો માયાના પ્રયોગો કર્યા, તે સર્વે પ્રયોગોને પ્રદ્યુમ્ને ટાળી  
નાખ્યા. ૩૫ પછી પ્રદ્યુમ્ને સજાવેલી તલવાર કાઢીને મુગટ તથા કુંડળ સહિત અને  
રાતી દાઢીમૂછોવાળું શંખરાસુરનું માથું તેના ધડ ઉપરથી કાપી નાખ્યું. ૩૬ સ્તુતિ  
કરતા દેવતાઓ પુષ્પના સમૂહથી પ્રદ્યુમ્નને વધાવ્યા પછી આકાશમાં ચાલનારી  
તેમની સ્ત્રી રતિ આકાશ માર્ગથી પ્રદ્યુમ્નને દ્વારકામાં તેડી ગઈ. ૩૭ હે રાજા ! સેંકડો  
સ્ત્રીઓથી ભરેલા ભગવાનના ઉત્તમ અંત:પુરમાં પ્રદ્યુમ્ને જેમ વીજળીની સાથે

स्वलंकृतमुखाभ्यों नीलवक्रालकालिभिः । कृष्णं मत्वा स्त्रियो ह्रीता निलिल्युस्तत्र तत्र ह ॥  
अवधार्य शनैरीषद्वैलक्षण्येन योषितः । उपजग्मुः प्रमुदिताः सस्त्रीरत्नं सुविस्मिताः ॥२९  
अथ त्रासितापाङ्गी वैदर्भी वलुभाषणी । अस्मरत् स्वसुतं नष्टं स्तेहस्तुतपयोधरा ॥३०  
को न्वयं नरवैदूर्यः कस्य वा कमलेक्षणः । धृतः कथा वा जठरे केयं लब्धा त्वनेन वा ॥३१  
मम चाप्यात्मजो नष्टे नीतो यः सूतिकागृहात् । एतत्तुल्यवयोरूपो यदि जीवति कुत्रचित् ॥३२  
कथं त्वनेन संप्रासं सास्त्रप्यं शार्ङ्गधन्वनः । आकृत्यावयवैर्गत्या स्वरहासावलोकनैः ॥३३  
स एव वा भवेत्वूनं यो मे गर्भे धृतोऽर्थकः । अमुष्मिन् प्रीतिराधिका वामः स्फुरति मे भुजः ॥३४  
एवं मीमांसमानायां वैदर्भ्यं देवकीसुतः । देवक्यानकदुन्दुभ्यामुत्तमश्लोक आगमत् ॥३५  
विज्ञातार्थोऽपि भगवांस्तूष्णीमास जनार्दनः । नारदोऽकथयत् सर्वं शम्बराहरणादिकम् ॥३६  
तच्छ्रुत्वा महदाश्र्वर्य कृष्णान्तःपुरयोषितः । अभ्यनन्दन् बहूनब्दान् नष्टं मृतमिवागतम् ॥३७

मेघ प्रवेश करे तेम रतिनी साथे प्रवेश कर्यो ॥२६ मेघ जेवा श्याम, पीणां रेशभी  
वश्ववाणा, लांबा हाथवाणा, राती आंभोवाणा, सुंदर मंदहास्य करता, रुडा  
मुखवाणा अने श्याम तथा वांका केशउपी भ्रमरोथी जेनुं मुखारविंश शोभी रह्युं  
हतुं अेवा ए प्रद्युम्ने जोई, तेमने श्रीकृष्ण मानीने लज्जाअेली कृष्णी स्त्रीओ  
चारेकोर धुपावा लागी ॥२७-२८ पछी श्रीवास आहि चित्तोना अभावउप थोडा  
विलक्षणपणाथी “आ श्रीकृष्ण नथी” आवो निश्चय करी राज्ञ थयेली अने बहुज  
विस्मय पामेली स्त्रीओ ए प्रद्युम्न अने तेमनी रतिनामनी स्त्रीनी पासे आवी ॥२९  
पछी प्रद्युम्ने श्याम कटाक्षवाणां अने भधुर बोलनारां रुक्मिणीने पोताना  
स्तनमांथी स्नेहने लीधे धूध ऊरवा लाग्युं, अने पोतानो जतो रहेलो पुत्र सांभर्यो ॥३०  
आ कमण सरभा नेत्रवाणो रत जेवो पुरुष कोष छे ? कोनो हशे ? कोना पेटमां  
रह्यो हशे ? अने आ कोष स्त्री आने भणी छे ? ॥३१ मारो पुत्र पण सुवावडना  
धरमांथी हराई जवाने लीधे जतो रह्यो छे, ते जो कोई ठेकाणो ज्वतो होय तो  
तेनी अवस्था अने उप आना जेवां ज होय !!! ॥३२ आकृति, अवयवो, गति,  
स्वर, हास्य अने जोवानी ढंभमां आने श्रीकृष्णानुं समानपणुं शी रीते भण्युं  
हशे ? ॥३३ जे बाणक मारा गर्भमां रह्यो हतो ते ज आ होवो जोईअे, आना उपर  
मने बहु प्रीति उत्पन्न थई छे अने मारो डाबो हाथ पण फरके छे ! ! ॥३४ आ  
प्रमाणे रुक्मिणी विचार करतां हतां तेटलीवारमां देवकी अने वसुठेवनी साथे  
श्रीकृष्ण त्यां आव्या ॥३५ श्रीकृष्ण भगवान सर्वं जाणता हता तोपण चूप रह्या.  
अने नारदज्ञ जे शंभरासुर हरी गयो हतो ते सर्वे वात कही टेखाई ॥३६ आ

देवकी वसिदेवश्च कृष्णामौ तथा स्त्रियः । दम्पती तौ परिष्वज्य रुक्मिणी च ययुमुदम् ॥३८  
नष्टं प्रद्युम्नमायातमाकर्ण्य द्वारकौकसः । अहो मृत इवायातो बालो दिष्ट्येति हाब्रुवन् ॥३९  
यं वै मुहुः पितृसरूपनिजेशभावास्तन्मातरो यदभजन् रहस्यदभावाः ।  
चित्रं न तत्खलु रमास्पदबिम्बबिन्बे कामे स्मरेऽक्षिविषये किमुतान्यनार्यः ॥४०  
इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्दे उत्तरार्थं  
प्रद्युम्नोत्पत्तिनिरु पणं नाम पञ्चपञ्चाशत्तमोऽद्यायः ॥१५५॥

### अथ पट्पञ्चाशत्तमोऽध्यायः (५६) ॥ श्रीशुकउवाच ॥

सत्राजितः स्वतनयां कृष्णाय कृतकिल्बिषः । स्यमंतकेन मणिना स्वयमुद्वाप्य दत्तवान् ॥१  
मोटा आश्वर्यनी वात सांभणी जाणो भरणा पामीने पाइ आवेल होय, तेम धणां  
वर्ष सुधी खोवाईने पाइ आवेला प्रद्युम्ननो भगवानना अंतःपुरनी स्त्रीओअे  
सत्कार कर्यो ॥३७ देवकी, वसुठेव, श्रीकृष्ण, भलराम, रुक्मिणी तथा भीज्ञ सर्वे  
स्त्रीओअे स्त्री पुरुषना जोडलानुं आलिंगन करी आनंद पाय्यां ॥३८ खोवाई गयेला  
प्रद्युम्नने पाइ आवेला सांभणी द्वारकानां माणसो अहो !! जाणो मरी गया पछी  
पाइ आवेल होय तेम आ बाणक पाइ आव्यो; धणुं ज सारुं थयुं अेम बोलवा  
लाग्यां ॥३९ प्रद्युम्ननुं श्रीकृष्ण समान उप जोई तेमां वारंवार स्वामीनी भावना  
थतां तेमनी माताओ पण प्रथम अेकांतमां धणो प्रेम करी भ्रांतिथी भूली गई,  
ऐ कांઈ आश्वर्य समजवुं नहीं केमके जे क्रामठेव स्मरण मात्रथी ज चित्तने क्षोभ  
उपजावनार छे, ते ज पोते वणी श्रीकृष्णना पुत्र थईने प्रत्यक्ष जोवामां आवे  
त्यारे अेम थयुं संभवित ज छे, ज्यारे माताओनी पण प्रथम आ प्रमाणे भूल  
थई, त्यारे भीज्ञ स्त्रीओनी तो भूल थाय तेमां शुं कुहेवुं ? ॥४०  
इति श्रीमद्भागवतना भागवतना दशम स्कन्दनो पंचावनमो अद्याय संपूर्णः

### अद्याय ५६

क्लंकउप भक्तिने लावी आपता तथा अंभवती अने  
सत्यलाभाने पराणता श्रीकृष्ण भगवान.  
शुकउवाच्छ कुहे छे हे राजा ! सत्राजित यादवे पोते श्रीकृष्णना अपराधमां  
आवतां, ते अपराधने शांत करवा सारु पोते ज उद्यम करीने पोतानी कन्या

राजोवाच

सत्राजितः किमकरोद् ब्रह्मन् ! कृष्णस्य किल्बिषम् । स्यमन्तकः कुतस्तस्य कस्माद् दत्ता सुता हरेः ॥

श्रीशुक उवाच

आसीत् सत्राजितः सूर्यो भक्तस्य परमः सखा । प्रीतस्तस्मै मणिं प्रादात् सूर्यस्तुष्टः स्यमन्तकम् । स तं बिभ्रन् मणिं कण्ठे भ्राजमानो यथा रविः । प्रविष्टे द्वारकां राजंस्तेजसा नोपलक्षितः ४ तं विलोक्य जना दूरात्तेजसा मुष्टृष्टृयः । दिव्यतेऽक्षैर्भगवते शशंसुः सूर्यशङ्किताः ॥५ नारायण ! नमस्तेऽस्तु शङ्खचक्रगदाधर ! । दामोदराविन्दाक्ष ! गोविन्द ! यदुनन्दन ! ॥६ एष आयाति सविता त्वं दिव्यक्षुर्जगत्यते ! । मुष्णान् गभस्तिचक्रेण नृणां चक्षुषिं तिगमगुः ॥७ नन्वन्विच्छन्ति ते मार्गं त्रिलोक्यां विबुर्धर्षभाः । ज्ञात्वाद्य गूढं यदुषु द्रष्टुं त्वां यात्यजः प्रभो ! ॥८

श्रीशुक उवाच

निशम्य बालवचनं प्रहस्याम्बुजलोचनः । प्राह नासौ रविर्देवः सत्राजिन्मणिना ज्वलन् ॥९ सत्राजित् स्वगृहं श्रीमत् कृतकोतुकमङ्गलम् । प्रविश्य देवसदने मणिं विप्रैर्न्यवेशयत् ॥१०

सत्यभामा, स्यमंतक नामना मणिनी साथे भगवानने आपी हती।<sup>१</sup>

परीक्षित राजा पूछे हे हे महाराज ! सत्राजिते भगवाननो शो अपराध कर्यो हतो ? अने भगवानने पोतानी दीकरी शा कारणाथी आपी ?<sup>२</sup>

शुक्लेवज्जु कहे हे सत्राजित यादव सूर्यनो भक्त हतो अने सूर्यदेव तेना स्वामी छतां पश्च परम भित्र थईने रह्या हता. सूर्ये प्रसन्न थईने तेने स्यमंतक नामनो मणि आप्यो हतो.<sup>३</sup> हे राजा ! एक वधुत ए मणिने गणामां बांधी सूर्यनी पेठे प्रकाशतो ते सत्राजित द्वारकामां आव्यो, त्यां तेजने लीघे ते ओणभायो नहीं.<sup>४</sup> तेना तेजथी ज्ञेओनां नेत्रो अंजाई गयां, ऐवा लोकोंसे दूरथी तेने ज्ञेई, सूर्यनी शंकाथी योपाट रमता भगवानने तेमनी सामे जहुने कहुं के हे नारायण ! हे शंभ, यक तथा गदाने धरनार ! हे दामोदर ! हे कमण सरभा नेत्रवाणा ! पोताना किरणोना समूहथी मनुष्योनी आंभोनुं हरण करता, आ तीव्र किरणोवाणा सूर्यदेव तमारुं दर्शन करवाने माटे आवे हे !!<sup>५-७</sup> त्रिलोकीमां भोटा भोटा देवताओं पश्च आपना मार्गने शोधे हे. हे प्रभु ! हमणां आपने यादवोमां गूढ रीते रहेला जाइ, सूर्यदेव तमारुं दर्शन करवा आवे हे.<sup>८</sup> आ प्रमाणे अजाइया माणसोनुं बोलवुं सांभणी भगवाने हसीने कहुं के आ सूर्यदेव नर्थी, पश्च मणिथी प्रकाशी रहेलो सत्राजित हे.<sup>९</sup> पछी सत्राजित यादवे उत्सवने लीघे जेमां मंगल कार्य कर्यां हतां ऐवां पोतानां धरमां प्रवेश करी पोताना धरमां रहेल, देव मंदिरमां

दिने दिने स्वर्णभारानष्टौ स सृजति प्रभो ! । दुर्भिक्षमार्यरिष्टानि सर्पाधिव्याधयोऽशुभाः ।

न सन्ति मायिनस्तत्र यत्रास्तेऽभ्यर्चितो मणिः ॥११

स याचितो मणिं क्वापि यदुराजाय शौरिणा । नैवार्थकामुकः प्रादाद् याच्चाभङ्गमतर्कयन् ॥१२ तमेकदा मणिं कण्ठे प्रतिमुच्य महाप्रभम् । प्रसेनो हयमारुह्य मृगयां व्यचरद् वने ॥१३ प्रसेनं सहयं हत्वा मणिमाच्छ्वया केसरी । गिरि विशञ्जाम्बवता निहतो मणिमिच्छता ॥१४ सोऽपि चक्रे कुमारस्य मणिं ऋद्धनकं बिले । अपश्यन् भ्रातरं भ्राता सत्राजित् पर्यतप्यत ॥१५ प्रायः कृष्णन निहतो मणिग्रीवो वनं गतः । भ्राता ममेति तच्छुत्वा कर्णे कर्णेऽजपञ्जनाः ॥१६ भगवांस्तदुपश्रुत्य दुर्यशो लिप्समात्मनि । मार्ष्य प्रसेनपदवीमन्वयद्यत नागरैः ॥१७ हतं प्रसेनमश्च च वीक्ष्य केसरिणा वने । तं चाद्रिपृष्ठे निहतमृक्षेण ददृशुर्जनाः ॥१८ ऋक्षराजबिलं भीममन्धेन तमसाऽऽवृतम् । एको विवेश भगवानवस्थाप्य बहिः प्रजाः ॥१९

प्रात्मणोनी पासे ते मणिनुं प्रतिष्ठा विधिथी स्थापन कराव्युः ॥२० हे राजा ! ए मणि दिवसे दिवसे आठभार सोनुं आपतो हतो. ए मणिनुं ज्यां पूजन थतुं होय त्यां दुर्भिक्ष, अकाण मृत्यु, अकल्याण, सर्प, आधि, व्याधि के बीजां कोई अशुभना कारण होतां नथी.<sup>२१</sup> ज्यां ए मणिनी पूजा थती होय त्यां मायावी लोको पश्च रहेता नथी. एक वधुत भगवाने यादवोना राजा उत्तरसेनने माटे सत्राजितनी पासे ए मणिनी मांगाणी करी हती, पश्च धनना लालयु सत्राजिते भगवाननी मांगाणी भंगना परिष्णामनो विचार नहीं करतां ते मणि आप्यो न हतो.<sup>२२</sup> सत्राजितनो भाई प्रसेन एक दिवसे ए मोटी कांतिवाणा मणिने गणे बांधी, घोडा उपर बेसीने वनमां मृगया करतो हतो, त्यां तेने एक केसरी सिंह तेना घोडा सहित मारी नाभी मणि खेंची लहिने पर्वतमां गयो, त्यां ते सिंहने पश्च जंभवाने मणि लहि लेवानी ईच्छाथी मारी नाप्यो.<sup>२३-२४</sup> जंभवाने ए मणि लहिने पोतानी गुङ्फामां तेने बाणकना रमकडांरुपे राप्यो. पोताना भाई प्रसेनने नहीं देखतां तेनो भाई सत्राजित परिताप पामवा लाग्यो अने कहुं के कंठमां मणि पहेरीने मारो भाई वनमां गयो हतो, तेने धाणुं करीने कृष्णे मारी नाप्यो हशे. आ सांभणी लोको कानोकान एक बीजाने कहेवा लाग्या.<sup>२५-२६</sup> श्रीकृष्ण भगवान आ वात सांभणीने पोताने प्राप्त थयेली ते अपकीर्ति टाणवा सारु गामना लोकोनी साथे प्रसेननी शोध करवा लाग्या.<sup>२७</sup> वनमां प्रसेनने अने तेना घोडाने केसरीए मारी नाखेला ज्ञेई आगण चालेला लोको एते केसरीने पश्च पर्वत उपर जंभवान रीछे मारी नाखेलो ज्ञेयो.<sup>२८</sup> पछी घाटा अंधारावाणी रीछना राजानी भयंकर

तत्र दृष्टा मणिश्रेष्ठं बालक्रीडनकं कृतम् । हर्तु कृतमतिस्तस्मिन्नवतस्थेऽर्भकान्तिके ॥२०  
तमपूर्वं नरं दृष्टा धात्री चुक्रोश भीतवत् । तच्छुल्वाभ्यद्रवत् क्रुद्धो जाम्बवान् बलिनां वरः २१  
स वै भगवता तेन युधे स्वामिनाऽऽत्मनः । पुरुषं प्राकृतं मत्वा कुपितो नानुभाववित् ॥२२  
द्वन्द्वयुद्धं सुतुमुलमुभयोर्विजिगीषतोः । आयुधाशमद्रुमैर्दीभिः क्रव्यार्थे श्येनयोरिव ॥२३  
आसीनदष्टार्विशाहमितरेतरमुष्टिभिः । वज्रनिष्पेषपूर्वैरविश्रममहर्निशम् ॥२४  
कृष्णमुष्टिविनिष्पातनिष्पिष्टोरुबन्धनः । क्षीणसत्त्वः स्विन्नगात्रस्तमाहातीव विस्मितः ॥२५  
जाने त्वां सर्वभूतानां प्राण ओजः सहो बलम् । विष्णुं पुराणपुरुषं प्रभविष्णुमधीश्वरम् ॥२६  
त्वं हिविश्वसृजां स्त्रष्टा स्वज्यानामपि यच्च सत् । कालः कलयतामीशः पर आत्मा तथाऽऽत्मनाम् ॥२७  
यस्येषदुल्कलितरोषकटाक्षमोक्षैर्वर्त्मादिशत् क्षुभितनक्रतिमिङ्ग्लोऽव्यिः ।

सेतुः कृतः स्वयश उज्ज्वलिता च लङ्घा रक्षः शिरांसि भुवि पेतुरिषुक्षतानि ॥२८

गुफा ज्ञेवामां आवतां भीजा लोकोने भहार बेसाडीने तेमां भगवान ऐकला ४  
गया. १८ ए गुफामां स्यमंतक मणिने बाणकनुं रमकुं उक्तेलो ज्ञेई, तेने लै  
लेवाना विचारथी भगवान बाणकनी पासे उभा रह्या. २० कोई द्विवस नहीं  
ज्ञेअला ए पुरुषने ज्ञेई बाणकनी उपमाताए बीकथी यीस नाखी, ए सांभणी  
कोध पामेला महाबणवान जांबवान दोडी आव्या. २१ कोधी अने श्रीकृष्णना  
प्रभावने नहीं जाणता जांबवान ते पोताना स्वामीने कोई प्राकृत पुरुष मानी,  
तेमनी साथे युद्ध करवा लाग्या. (पोताना स्वामी कहेवानो ए अभिप्राय छे के  
रामावतारमां भगवान रामयंक जांबवनना स्वामी हता अने ए ज राम श्रीकृष्ण  
छे.) २२ परस्पर ज्ञती लेवाने ईच्छता ए बत्रे जाणानुं जेम मांसने माटे बे बाज  
पक्षीओनुं युद्ध थाय तेम भयंकर दंद्व युद्ध थयुं. आयुध, पथरा, झाड, हाथ अने  
वज्र पडवा जेवी कठण मूठीओथी रात द्विवस विसामो लीधा विना युद्ध करतां  
अहावीश द्विवस थया. २३-२४ भगवाननी मूठीओना प्रहारथी जांबवानना अंगोना  
सांधाओ शिथिल थई गया, बण क्षीण थयुं अने शरीरमां पसीनो वणी गयो,  
तेथी बहुज विस्मय पामीने जांबवान आ प्रमाणे बोल्यो. २५

जांबवान कहे छे सर्वप्राणीओना प्राणरूप, ईंद्रिय, हृदय तथा देहना  
बणरूप, पुराण पुरुष, सर्वना प्रभु अने सर्वने वश करनारा आपने हुं विष्णु  
जाणुं छुं. २६ जगतने सर्वज्ञारां सर्वे तत्त्वो तेना पण सर्वक छो, अने जगतने वश  
करनाराओने पण वश करनारा काणरूप आप छो, सर्वज्ञवोना शुद्ध अंतर्यामी  
आत्मा पण आप ज छो. २७ पूर्वे रामावतारमां आपना सहेज प्रदीप कोधना

इति विज्ञातविज्ञानमृक्षराजानमच्युतः । व्याजहार महाराज ! भगवान् देवकीसुतः ॥२९  
अभिमृश्यारविन्दाक्षः पाणिना शङ्करेण तम् । कृपया परया भक्तं प्रेमगम्भीरया गिरा ॥३०  
मणिहेतोरिह प्रासा वयमृक्षपते ! बिलम् । मिथ्याभिशापं प्रमृजन्नात्मनो मणिनामुना ॥३१  
इत्युक्तः स्वां दुहितरं कन्यां जाम्बवतीं मुदा । अर्हणार्थं स मणिना कृष्णायोपजहार ह ॥३२  
अदृष्टा निर्गमं शौरे : प्रविष्टस्य बिलं जनाः । प्रतीक्ष्य द्वादशाहानि दुःखिताः स्वपुं ययुः ॥३३  
निशम्य देवकी देवी रुक्मिण्यानकदुन्दुभिः । सुहृदो ज्ञातयोऽशोचन् बिलात् कृष्णमनिर्गतम् ॥३४  
सत्राजितं शपन्तसे दुःखिता द्वारकौक्षसः । उपतस्थुर्महामायां दुर्गा कृष्णोपलब्धये ॥३५  
तेषां तु देव्युपस्थानात् प्रत्यादिष्टाशिषा स च । प्रादुर्बभूव सिद्धार्थः सदारो हर्षयन् हरिः ॥३६  
उपलभ्य हृषीकेशं मृतं पुनरिवागतम् । सह पत्न्या मणिग्रीवं सर्वे जातमहोत्सवाः ॥३७  
सत्राजितं समाहूय सभायां राजसन्निधौ । प्रासि चाख्याय भगवान् मणिं तस्मै न्यवेदयत् ॥३८

कटाक्षो धूटतां जे समुद्रमां मोटां मगरो अने माइलांओ खण्भणी उठायां हतां,  
अेवा महासागरे तरत ज मार्ग आपी दीधो हतो, छतां पण पोतानी कीर्तिने  
माटे सेतु बांध्यो, लंका बाणी अने रावणानां माथां बाणथी कापीने धरती पर  
पाइयां, ते ज आप छो. २८

शुकदेवजु कहे छे हे राजा ! आ प्रमाणे रींछना राजने शान थतां श्रीकृष्ण  
भगवाने परम कृपाथी पोतानो सुभकारी हाथ ते भक्तना शरीर पर फेरवीने  
प्रेमपूर्वक गंभीर वाणीथी तेमने कहुं के हे रींछना राजा ! अमे मणिने शोधता  
शोधता आ गुफाना द्वार आगण आव्या हता अने आ मणिथी मारा उपरनो  
झोटो अभिशाप टाणवा सारु हुं अंदर आवेलो छुं. २८-३१ आ प्रमाणे भगवाननां  
वयन सांभणी जांबवाने भगवानना सत्कार सारु प्रीतिथी पोतानी दीकरी  
जांबवतीनुं स्यमंतक मणिनी साथे भगवानने दान दीधुं. ३२ गुफामां भगवानना  
पाणा नीकणवानी बार द्विवस सुधी वाट ज्ञेई तो पण भहार नहीं नीकणतां  
दुःख पामेला द्वारकाना लोको पाणा द्वारकामां गया हता. ३३ देवकी, रुक्मिणी,  
वसुदेव, संबंधीओ अने शातिओ भगवानने गुफामांथी भहार नहीं नीकणेला  
सांभणी शोक करतां हतां. ३४ दुःख पामेलां अने सत्राजितने गाणो देतां द्वारकानां  
माणसो श्रीकृष्णनी प्राप्ति थवा सारु महामाया दुर्गादेवीनी आराधना करवा  
लाग्यां. ३५ आराधनाने लीधे दुर्गादेवीते तेओने आशीर्वाद आप्यो के तमे  
श्रीकृष्णने ज्ञेशो, त्यां ज तुरत स्त्री सहित अने जेमनुं काम सिद्ध थयुं हतुं, एवा  
भगवान सर्वने राजु करता प्रगट थया. ३६ पाणा आवेला भगवानने स्त्री सहित

स चातिव्रीडितो रत्नं गृहीत्वा वाइमुखस्तः । अनुत्प्यमानो भवनमगमत् स्वेन पापमा ३९  
सोऽनुध्यायं स्तदेवाधं बलवद्विग्रहाकुलः । कथं मृजाम्यात्मरजः प्रसीदेद् वाच्युतः कथम् ४०  
किं कृत्वा साधु मह्यं स्यान्न शपेद् वा जनो यथा । अदीर्घदर्शनं क्षुद्रं मूढं द्रविणलोलुपम् ४१  
दास्ये दुहितं तस्मै स्त्रीरत्नं रत्नमेव च । उपायोऽयं समीचीनस्तस्य शान्तिर्न चान्यथा ॥४२  
एवं व्यवसितो बुद्ध्या सत्राजित् स्वसुतां शुभाम् । मणिं च स्वयमुद्यम्य कृष्णायोपजहार ह ४३  
तां सत्यभामां भगवानुपयेमे यथाविधि । बहुभिर्याचितां शीलस्त्रोदार्थगुणान्विताम् ॥४४  
भगवानाह न मणिं प्रतीच्छामो वयं नृप ! । तवास्तां देवभक्तस्य वयं च फलभागिनः ॥४५

इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे उत्तरार्थं  
स्यमन्तकोपाख्याने षट्पञ्चाशतमोऽध्यायः ॥५६॥

तथा गणामां भणि सहित ज्ञेयने सर्वने भोटो आनंद थयो. ३७ पछी भगवाने  
उत्सेन राजानी समक्ष सभामां सत्राजितने बोलावी भणि भणवानी सर्वे वात  
कहीने तेने भणि आपी दीधो. ३८ भणि लईने बहु ज लजाएलो अने पोताना  
पापथी पस्तातो ते सत्राजित नीयुं भोकुं करीने त्यांथी पोताने धेर गयो. ३९ अणिया  
साथे विरोध थवाने लीधे व्याकुण थयेलो ते सत्राजित पोताना भनमां ते ज वातनुं  
ध्यान लागी रहेतां विचार करवा लाग्यो के हवे हुं मारो अपराध शी रीते टाणुं ?  
भगवान शी रीते प्रसन्न थाय ? हुं लांबी दृष्टिथी नहीं ज्ञेनारो, क्षुद्र, मूढ अने  
धननो लालयु हुं तेथी भने माणसो शी रीते गाणो न आपे ? ४०-४१ हुं स्त्रीओमां  
रत्नरूप मारी दीकरी सत्यभामा तथा भणि ऐ बस्ते भगवानने आपीश, आ  
उपाय सारो छे, ते विना भीज्ञ रीते अपराधनी शांति थशे नहीं. ४२ सत्राजिते आ  
प्रमाणे मनमां निश्चय करी, सामेथी ज्ञेयने पोतानी कन्या भगवानने आपी अने  
भणि पश आप्यो. ४३ शील, रूप, उदारता अने गुणवाणां ते सत्यभामाने  
भगवान परण्या. ४४ परण्यीने भगवाने सत्राजितने कहुं के तमारो भणि अमे  
राखीशुं नहीं. तमे सूर्यना भक्त छो तेथी तमारी पासे ज भले रह्यो, अमे तो  
अमांथी थतुं झण लेवाना छीअे. (तमे अपुत्र होवाने लीधे तमारुं धन अंते अमारुं  
ज थवानुं छे, ऐ गूढ अभिग्राय राखीने भगवाने आ वयन कहुं.) ४५  
इति श्रीमद् महापुराणा भागवतना दशम स्कन्धनो छ्यनमो अद्याय संपूर्णः.

अथ सप्तशतमोऽध्यायः (५७)

॥ श्रीशुकुत्वाच ॥

विज्ञातार्थोऽपि गोविंदो दग्धानाकर्ण्य पांडवान् । कुंतीं च कुल्यकरणे महरामो ययौ कुरुन् १  
भीष्मं कृपं सविदुरं गाम्थारीं द्रोणमेव च । तुल्यदुःखौ च सङ्गम्य हा कष्टमिति होचतुः ॥२  
लब्धवैतदन्तरं राजन् ! शतधन्वानमूचतुः । अक्रूरकृतवर्मणौ मणिः कस्मात्र गृहते ॥३  
योऽस्मध्यं संप्रतिश्रुत्य कन्यारत्नं विगर्ह्य नः । कृष्णायादान्न सत्राजित् कस्माद् भ्रातरमन्वियात्  
एवं भिन्नमतिस्ताभ्यां सत्राजितमसत्तमः । शयानमवधीलोभात् स पापः क्षीणजीवितः ॥५  
स्त्रीणां विक्रोशमानानां ऋन्दनीनामनाथवत् । हत्वा पश्नून् सौनिकवर्मणिमादाय जर्मिवान् ६  
सत्यभामा च पितरं हतं वीक्ष्य शुचार्पिता । व्यलपत्तात ! तातेति हा हतास्मीति मुहूर्ति ॥७  
तैलद्रोण्यां मृतं प्राप्य जगाम गजसाहृयम् । कृष्णाय विदितार्थ्य तसाऽचर्चाख्यौ पितुर्वधम् ८

#### अद्याय ५७

शतधन्वाने भारवाथी इरी भणिं योरवानो आरोप आवतां  
भगवाने अक्षर पासेथी भणिं भंगावीने आरोप दूर कर्यो.

शुकदेवज्ञ कहे छे हे राजा ! पांडवो भोंयरामां थईने लाखागृहमांथी नीकणी  
गया छे, ऐ वात भगवान ज्ञाणता हता, तोपाण पांडवोने अने कुंतीने बणी  
गयेला सांभणी, बलरामने साथे लईने श्रीकृष्ण भगवान लौकिक व्यवहार  
साचववा सारु हस्तिनापुरमां गया. १ समान जेमने हुः ख छे अवा भीष्मपितामह,  
कृपाचार्य, विदुर, गांधारी अने द्रोषाचार्य आटलाने भणी, ऐ ऐ भाईओ हाय !!  
भुंकु थयुं, ऐ भरभरो करवा लाग्या. २ हे राजा ! आ ताकडो भणतां द्वारकामां  
अक्षरज्ञ तथा कृतवर्माए शतधन्वाने शीभव्युं के तुं सत्राजित पासेथी भणिने शा  
माटे लई लेतो नथी ? ३ जेषो रत्न जेवी कन्या आपवानी आपणाने हा कहीने पछी  
कृष्णने आपी दीधी. ते सत्राजित तेना भाई प्रसेननी पासे शा भाटे नहीं ज्वो  
ज्ञेयाए ? ४ (अर्थात् तेने मारी नाख्वो ज्ञेयाए) आ प्रमाणे ते बस्ते ज्वाअे बुद्धि  
झेवतां जेनुं मोत नश्चक आव्युं हतुं, अवा ऐ पापी अने अत्यंत झर शतधन्वाए  
सत्राजितने सूतो भार्यो. ५ कसाई जेभ पशुने मारे तेम सत्राजितने मारीने अनाथनी  
पेठे रुद्धन करती अने विलाप करती ऐवी सत्राजितनी स्त्रीओनो अनादर करी  
शतधन्वा भणि लईने भागी गयो. ६ पोताना बापने मारी नाखेलो ज्ञेय शोकथी  
व्याप थयेलां अने मुंजाएलां सत्यभामा हे बाप ! हे बाप ! हाय !! हुं मरी गई.  
ऐ विलाप करवा लाग्या. ७ पछी मरी गयेला बापने तेलनी कोठीमां नाखी,

तदाकरण्ये श्वरौ राजन्ननुसृत्य नूलोकताम् । अहो नः परमं कष्टमित्यस्त्राक्षौ विलेपतुः ॥१  
आगत्य भगवांस्तस्मात् सभार्यः साग्रजः पुरम् । शतधन्वानमारेभे हन्तुं हर्तुं मर्णि ततः ॥१०  
सोऽपि कृष्णोद्यमं ज्ञात्वा भीतः प्राणपरीप्सया । साहाय्ये कृतवर्मणामयाचत स चाब्रवीत् ॥१  
नाहमीश्वरयोः कुर्या हेलनं रामकृष्णयोः । को नु क्षेमाय कल्पेत तयोर्वृजिनमाचरन् ॥१२  
कंसः सहानुगोऽपीतो यद्द्वेषात्याजितः श्रिया । जरासन्धः समदश संयुगान् विरथो गतः ॥१३  
प्रत्याख्यातः स चाकूरं पार्षिण्याहमयाचत । सोऽप्याह को विरुद्धेत विद्वानीश्वरयोर्बलम् ॥१४  
य इदं लीलया विश्वं सृजत्यवति हन्ति च । चेष्टां विश्वसृजो यस्य न विदुर्मोहिताजया ॥१५  
यः समहयनः शैलमुत्पाद्यैकेन पाणिना । दधार लीलया बाल उच्छ्वलीन्धमिवार्भकः ॥१६  
नमस्तस्मै भगवते कृष्णायाद्भूतकर्मणे । अनन्तायादिभूताय कूटस्थायात्मने नमः ॥१७

संताप पामेलां सत्यभामा हस्तिनापुर गयां, अने जे श्रीकृष्ण भगवान आ बधी वातने ज्ञाता जे हता, तेमनी पासे पोताना बापानो वध थवानी वात करी.<sup>१</sup> हे राजा ! आ वात सांभणी श्रीकृष्ण तथा बलराम के जेओ ईश्वर हता तेओ पोताना मनुष्यावतारने अनुसरी आंभोमां आंसु लावीने अहो !!! आपणने भोटी विपत्ति आवी छे. ऐम विलाप करवा लाग्या.<sup>२</sup> पछी सत्यभामा अने बलरामनी साथे भगवान हस्तिनापुरमांथी द्वारकामां आवीने, शतधन्वाने मारवानी अने तेनी पासेथी भणि लई लेवानी गोठवणा करवा लाग्या.<sup>३</sup> भगवानने एवी गोठवणेमां लागेला ज्ञेई, भय पामेला ते शतधन्वाए पोताने सहायता आपवा माटे कृतवर्मनी प्रार्थना करी, त्यारे कृतवर्माए कहुं के श्रीकृष्ण अने बलराम भोटा समर्थ छे. तेओनो अपराध हुं नहीं करुं, तेनो अपराध करवाथी कोण सुखी थाय ?<sup>४-५</sup> तेओनो देख करवाथी पोताना अनुयरो सहित कंस, राज्य लक्ष्मीथी भ्रष्ट थईने भरी गयो अने जरासंध पण सतरवार संग्राममां हार खाईने जतो रह्यो हतो.<sup>६</sup> आ प्रमाणे कृतवर्माए ना पाडतां ते शतधन्वाए पोताने पउधे रहेवाने माटे अकूरज्जनी प्रार्थना करी, त्यां अकूरज्जले पण कहुं के श्रीकृष्ण अने बणदेवज्ज तो ईश्वर छे तेओना बणने ज्ञानारो क्यो पुरुष तेनी साथे विरोध करे.<sup>७</sup> जे भगवान आ जगतने पोतानी लीलाथी झजे छे, पाणे छे अने नाश करे छे, तेनी गतिने मायाथी भोइ पामेला ब्रत्माणिक पण ज्ञाता नथी अने जेषो सात वर्षनी बाल्यावस्थामां बाणक जेम बिलाडीना टोपने उभेडी नाखे तेम लीलामात्रमां पर्वतने उभेडीने ऐक हाथथी धर्यो हतो. आवुं अहुत कर्म करनार, अनंत, सर्वना कारण, अविनाशी आवा परमात्मा श्रीकृष्ण

प्रत्याख्यातः स तेनापि शतधन्वा महामणिम् । तस्मिन् न्यस्याश्वमारुह्य शतयोजनगं ययौ १८  
गरुडध्वजमारुह्य रथं रामजनार्दनौ । अन्वयातां महावेरैश्वरै राजन् ! गुरुद्वृहम् ॥१९  
मिथिलायामुपवने विसृज्य पतितं हयम् । पद्भ्यामधावत् सन्त्रसः कृष्णोऽप्यन्वद्रवद् रुषा २०  
पदतेर्भगवांस्तस्य पदातिस्तिग्मनेमिना । चक्रेण शिर उत्कृत्य वाससो व्यचिनोमणिम् ॥२१  
अलब्धमणिरागत्य कृष्ण आहाग्रजान्तिकम् । वृथा हतः शतधनुर्मणिसतत्र न विद्यते ॥२२  
तत आह बलो नूनं स मणिः शतधन्वना । कर्सिंमश्चित् पुरुषे न्यस्तस्तमन्वेषं पुरं व्रज ॥२३  
अहं विदेहिमिच्छामि द्रष्टुं प्रियतमं मम । इत्युक्त्वा मिथिलां राजन् ! विवेश यदुनन्दनः ॥२४  
तं दृष्ट्वा सहसोथाय मैथिलः प्रीतमानसः । अर्हियामास विधिवद्वर्णीयं समर्हणैः ॥२५  
उवास तस्यां कतिचिन्मिथिलायां समा विभुः । मानितः प्रीतियुक्तेन जनकेन महात्मना ।

ततोऽशिक्षद् गदां काले धार्तराष्ट्रः सुयोधनः ॥२६॥

भगवानने हुं प्रशाम करुं धुं.<sup>१५-१७</sup> आ प्रमाणे अकूरज्जले पण ना पाडतां ते शतधन्वा पोताना भोटा भणिने अकूरज्जनी पासे थापण राखी, ऐक सो योजन चालवानी शक्तिवाणा घोडा पर बेसीने भागी गयो.<sup>१८</sup> हे राजा ! श्रीकृष्ण अने बणदेवज्ज गरुडनी ध्वजवाणा रथमां बेसीने भोटा वेगवाणा घोडाओथी, ऐ पोताना ससराने मारनारा शतधन्वानी पछवाडे गया.<sup>१९</sup> मिथिला नगरीना उपवनमां घोडो पडी जतां तेने छोटी दृष्ट त्रास पामेलो शतधन्वा पगथी दोऽयो, त्यारे भगवान पण कोधथी तेनी पछवाडे पगथी जे दोऽया.<sup>२०</sup> भगवाने ऐ शतधन्वानुं माथुं तीक्ष्ण धारवाणां यक्थी कापी नाखीने तेना कपडांमां भणिने शोध्यो.<sup>२१</sup> भणि नहीं मणतां भगवाने भोटा भाई बलरामनी पासे आवीने कहुं के शतधन्वाने वृथा भायो. तेनी पासे भणि नथी.<sup>२२</sup> आथी बणदेवज्जने शंका थई के भगवान पोतानी स्त्रीने आपवा सारु पोतानी पासे भणि राखीने मने ठगे छे.<sup>२३</sup> तोपण ते वात मनमां राखी, अरुयिथी भगवानने कहुं के ऐ भणि शतधन्वाए कोईने त्यां थापण राखेलो छेसे, माटे तेनी शोध करो अने द्वारकामां जायो.<sup>२४</sup> जे मने बहु ज प्यारा छे तेवा विदेह राजाने मणवानी ईच्छा राखुं धुं.<sup>२५</sup> ऐक ही बलराम मिथिला नगरीमां गया.<sup>२६</sup> पूजन करवा योऽय ऐ बणदेवज्जने आव्या ज्ञेई, राज्ञ थयेला मिथिला नगरीना पति विदेह राजाए तरत उठीने पूजना पदार्थोथी विधि प्रमाणे तेमनी पूजा करी. बणदेवज्ज केटलांक वर्ष सुधी मिथिलामां जे रह्या. त्यां योऽय समयमां धृतराष्ट्रनो दीकरो दुर्योधन के जेने प्रीतिवाणा महात्मा जनके मान दृष्टने राख्यो हतो, ते दुर्योधन बलरामनी पासेथी

કેશવો દ્વારકામેત્ય નિધનં શતધન્વનઃ । અપ્રાસિં ચ મણે: પ્રાહ પ્રિયાયા: પ્રિયકૃદ્વ વિભુ: ૨૭ તત: સ કારયામાસ ક્રિયા બન્ધોહતસ્ય વૈ । સાકં સુહૃદ્ભર્ભગવાન્યા યા: સ્યુ: સામ્પરાયિકા: ૨૮ અક્રૂર: કૃતવર્મા ચ શ્રુત્વા શતધનોર્વધમ् । વ્યૂષતુર્ભયવિત્રસૌ દ્વારકાયા: પ્રયોજકૌ ॥૨૯ અક્રૂરે પ્રોષ્ઠિતેરિણ્ણાસન્ન વૈ દ્વારકૌકસામ् । શારીરા માનસાસ્તાપા મુહુર્વિકભૌતિકા: ૩૦ ઇત્યઝોપદિશન્યેકે વિસ્મત્ય પ્રાગુદ્બાહ્તમ્ । મુનિવાસનિવાસે કિં ઘટેતારિષ્ટદર્શનમ् ॥૩૧ દેવેઽવર્ષતિ કાશીશ: શ્રફલકાયાગતાય વૈ । સ્વસુંં ગાન્દિન્ની પ્રાદાત્ત તતો�વર્ષત્ સ્મ કાશિષુ ૩૨ તત્સુસ્તસ્તપ્રભાવોઽસાવકૂરો યત્ર યત્ર હ । દેવો�ભિવર્ષતે તત્ત્વ નોપતાપા ન મારિકા: ૩૩ ઇતિ વૃદ્ધવચ: શ્રુત્વા નૈતાવદિહ કારણમ् । ઇતિ મત્ત્વા સમાનાય્ પ્રાહાકૂરં જનાર્દનઃ ॥૩૪ પૂજયિત્વાભિભાષ્યૈન કથયિત્વા પ્રિયાય: કથા: । વિજ્ઞાતાખિલચિત્તજ્ઞઃ સ્મયમાન ઉવાચ હ ૩૫

ગાદાયુદ્ધ શીખ્યો. ૨૬ આ બાજુ સત્યભામાને રાજુ કરનારા ભગવાને દ્વારકામાં આવીને શતધન્વનાને મારી નાખવાની અને મણિ નહીં મળવાની વાત કરી દેખાડી. (સત્યભામાને પણ શંકા થઈ કે મણિ પોતાના મોટા ભાઈને આપી, તેમને ભિથિલામાં રાખી આવ્યા છે અને ખોટું બોલીને મને ઠગે છે.) ૨૭ પછી ભગવાને મરણ પામેલા સસરાની જે જે પરલોક સંબંધી ક્રિયાઓ કરવી જોઈએ તે સર્વે સંબંધીઓને સાથે રાખીને કરાવી. ૨૮ શતધન્વનાને શીખવનારા અકૂરજુ અને કૃતવર્મા શતધન્વનાને મારી નાખવાની વાત સાંભળી બીકના માર્યા દ્વારકામાંથી ભાગી ગયા. ૨૯ અકૂરજુ દ્વારકામાંથી જતા રહેતાં દ્વારકાના રહેવાસીઓને શરીરમાં અને મનમાં દેવ તથા ભૂત સંબંધી કેટલાક તાપ અને અનિષ્ટ થવા લાગ્યાં, આમ કેટલાક મુનિઓ પોતે જ કહેલા શ્રીકૃષ્ણના માહાત્મ્યને ભૂલી જઈને કહે છે, કેમકે મુનિઓના નિવાસરૂપ શ્રીકૃષ્ણ જ્યાં રહેતા હોય ત્યાં ઉત્પાત દેખાવા ઘટે જ કેમ? ૩૦-૩૧ કેટલાક મુનિઓ કહે છે અકૂરજુ જતા રહેતાં દ્વારકાના વૃદ્ધલોકો કહેવા લાગ્યા કે જે સમયે ઈંડ વૃષ્ટિ કરતો ન હતો તે સમયે કાશીના રાજાએ પોતા પાસે આવેલા શ્વિદ્ધ યાદવને પોતાની ગાંધિની નામની કુંવરી આપી હતી, તેથી કાશી દેશમાં વૃષ્ટિ થઈ હતી. તો એ શ્વિદ્ધના પુત્ર અકૂરજુ પણ પોતાના બાપ જેવા પ્રભાવવાળા છે, માટે તે જ્યાં હોય ત્યાં ઈંડ વૃષ્ટિ કરે અને ઉત્પાત કે અકાળ મૃત્યુ પણ ન થાય. ૩૨-૩૩ આવું વૃદ્ધલોકોનું બોલવું સાંભળી તથા આમ થવામાં આટલું જ કારણ નથી પણ મણિ ગયો છે એ પણ કારણ છે, એમ માની ભગવાને કાશીમાંથી અકૂરજુને તેડાવ્યા. ત્યાર પછી તેમનો સત્કાર કરી બોલાવી તથા પ્રિય લાગે તેવી વાતો કરી સર્વને તથા સર્વના ચિત્તને જાણનારા ભગવાને હસતાં

નનુ દાનપતે ! ન્યસ્તસ્વચ્છાસ્તે શતધન્વના । સ્યમન્તકો મણિ: શ્રીમાન્ વિદિત: પૂર્વમેવ ન: ૩૬ સત્ત્રાજિતોઽનપત્રત્વાદ્ ગૃહીયુર્દુહિતુ: સુતા: । દાયં નિનીયાપ: પિણ્ડાન્ વિમુચ્યર્ણ ચ શેષિતમ્ ૩૭ તથાપિ દુર્ધરસ્વચ્છાસ્તાં સુત્રતે ! મણિ: । કિન્તુ મામગ્રજઃ સમ્યઙ્ન પ્રત્યેતિ મણિ પ્રતિ ૩૮ દર્શયસ્વ મહાભાગ બન્ધુનાં શાન્તિમાવહ । અવ્યુચ્છિત્ત્રા મખાસે ઽદ્ય વર્તને રૂક્મવેદયઃ ॥૩૯ એવં સામભિરાલબ્ધઃ શ્રફલકતનયો મણિમ् । આદાય વાસસાચ્છ્વાન્ દવૈ સૂર્યસમપ્રભમ् ॥૪૦ સ્યમન્તકં દર્શયિત્વા જ્ઞાતિભ્યો રજ આત્મનઃ । વિમૃજ્ય મણિના ભૂયસ્તસ્મૈ પ્રત્યર્પયત્ પ્રભુ: ૪૧ યસ્ત્વેતદ્વાગવત ઈશ્વરસ્ય વિષ્ણોર્વીર્યાદ્યં વૃજિનહરં સુમદ્ધલં ચ ।

આખ્યાનં પઠતિ શૃણોચ્યનુસ્મરેદ્વા દુષ્કીર્તિ દુરિતમયોહ્ય યાતિ શાન્તિમ् ॥૪૨॥

ઇતિ શ્રીમદ્બાગવતે મહાપુરાણે પારમહંસાં સંહિતાયાં દશમસ્કંદ્રે ઉત્તરાર્થ સ્યમન્તકોપાખ્યાને સપ્તપ્રાશત્તમોઽદ્યાય: ॥૫૭॥

હસતાં કહું કે હે દાનપતિ ! શતધન્વાએ સ્યમંતક નામનો ઉત્તમ મણિ તમારી પાસે થાપણ મૂકેલો છે. એ વાત પ્રથમથી જ અમારા જાણવામાં છે. ૩૪-૩૬ જોકે સત્ત્રાજિત અપુત્ર હોવાને લીધે તેને જણદાન તથા પીંડદાન દઈ તથા તેમનું અવશેષ રહેલું કરજ ચૂકવી તેની સર્વે મિલકત લેવાને ધર્મશાસ્ત્ર પ્રમાણે તેની દીકરીના દીકરાઓ અધિકારી છે, તોપણ એ મણિ તમ વિના બીજાઓથી રાખી શકાય તેમ નથી, તમે સારા નિયમો પાળનારા છો તેથી તમારી પાસે જ રહેવા દઈશું, પરંતુ મણિના વિષયમાં મોટાભાઈ મારો સંપૂર્ણ વિશ્વાસ કરતા નથી, માટે એ મણિ દેખાડો અને બંધુઓમાં પરસ્પર મન દુઃખ થયું છે તેની શાંતિ કરો. તમે એમ તો નહિં જ કહી શકો કે મણિ મારી પાસે નથી; કારણ કે હમણાં સુધી સોનાની વેદીવાળા તમારા યજો ચાલ્યા કરે છે. ૩૭-૩૮ આ પ્રમાણે ભગવાનનાં સત્ય વચન અકૂરજુના હૃદયમાં લાગી ગયાં, તેથી અકૂરજુએ સૂર્ય સરખી કાંતિવાળો મણિ હાથમાં લઈ વલ્લથી ઢાંકીને ભગવાનને આપ્યો. ૩૯ જ્ઞાતિઓને એ સ્યમંતકમાણિ દેખાડી અને તેથી પોતા ઉપરનો અભિશાપ ટાળીને ભગવાને તે મણિ પાછો અકૂરજુને જ આપ્યો. ૪૦ આ આખ્યાન કે જે જગતના ઈશ્વર વિષ્ણુ ભગવાનના પરાક્રમવાળું, દુઃખને હરનાર અને મહા મંગળરૂપ છે, તેનો જે કોઈ માણસ પાઠ કરે, સાંભળે અથવા સ્મરણ કરે તે પોતાની અપકીર્તિને અને અપકીર્તિ કરાવનારા પાપને દૂર કરી શાંતિ પામે છે. ૪૨ ઇતિ શ્રીમદ્બાગવતના ભાગવતના દશમ રક્ષણનો સત્તાવનમો અદ્યાય સંપૂર્ણ.

अथाष्टपञ्चाशत्तमोऽध्यायः (५८)

॥ श्रीशुक्लवाच ॥

एकदा पांडवान् दृष्टं प्रतीतान् पुरुषोत्तमः । इन्द्रप्रस्थं गतः श्रीमान् युयुधानादिभिर्वृतः ॥१  
दृष्टा तमागतं पार्था मुकुन्दमखिलेश्वरम् । उत्तस्थुर्युगपद् वीरा: प्राणा मुख्यमिवागतम् ॥२  
परिष्वज्याच्युतं वीरा अङ्गमङ्गहतैनसः । सानुरागास्मितं वक्रं वीक्ष्य तस्य मुदं ययुः ॥३  
युधिष्ठिरस्य भीमस्य कृत्वा पादभिवन्दनम् । फाल्गुनं परिरभ्याथ यमाभ्यां चाभिवन्दितः ४  
परमासन आसीनं कृष्णा कृष्णमनिन्दिता । नवोदा ब्रीडिता किञ्चिच्छन्नरेत्याभ्यवन्दत ॥५  
तथैव सात्यकिः पार्थैः पूजितश्चाभिवन्दितः । निषसादासनेऽन्ये च पूजिताः पर्युपासत ॥६  
पृथां समागत्य कृताभिवादनस्तयातिहार्द्रदृशाभिरम्भतः ।

आपृष्ठवांस्तां कुशलं सहस्रुषां पितृष्वसारं परिपृष्ठबान्धवः ॥७॥

तमाह प्रेमवैकल्यवरुद्धकण्ठाश्रुलोचना । स्मरन्ती तान् बहून् क्लेशान् क्लेशापायात्मदर्शनम् ८

#### अध्याय ५८

श्रीकृष्ण भगवान् पांच स्त्रीओ साथे परामुखः ।

शुक्लेवज्जु कुहे छे हे राजा ! पांडवो प्रथम लाक्षण्युहमां बणी गयेला जग्याया  
हता अने पछी दुपट राजाने घेर सर्वलोकोना ज्ञेवामां आव्या हता, ते पांडवोने  
ज्ञेवा माटे एक दिवसे श्रीकृष्ण भगवान् सात्यकि आदि यादवोनी साथे ईद्रप्रस्थमां  
पधार्या ।<sup>१</sup> सर्वलोकोना ईश्वर ते श्रीकृष्णने आवेला ज्ञेई वीर पांडवो ज्ञेम ग्राण  
आवतां ईद्रियो उठे तेम एक सामटा उभा थया ।<sup>२</sup> भगवान्नुं आलिंगन करी  
तेमना अंगना समागमथी ज्ञेओनां पाप बणी गयां एवा पांडवो स्नेह भरेलुं  
मंदहास्यवाणुं तेमनुं मुख ज्ञेईने आनंद पाभ्या ।<sup>३</sup> युधिष्ठिर अने भीमसेन के  
ज्ञेओ पोताथी मोटा हता तेओने भगवान् पगे लाग्या, अर्जुननुं आलिंगन कर्युं  
अने नकुल, सहेदेव भगवान्ने पगे लाग्या ।<sup>४</sup> नवां परशीने आवेलां पतित्रिता  
द्रोपदी उत्तम आसन पर बेठेला भगवान्नी पासे कंठिक लज्जातां धीरे धीरे आवीने  
तेमने पगे लाग्यां ।<sup>५</sup> आ प्रभाणे पांडवो द्वारा पूज्येल अने प्राणाम करायेल,  
सात्यकि अने बीजाओ पाण योग्य पूजा अने सन्मान पाभीने आसनो पर बेठा ।<sup>६</sup>  
भगवान् पोतानां ईरुं कुंतीनी पासे आवीने तेमने पगे लाग्या. घणा स्नेहथी  
ज्ञेमनी आंभोमां पाणी भराई आव्यां हतां, एवां ए कँडुअे भगवान्नुं आलिंगन  
कर्युं. पछी कुंतीअे बांधवोनुं कुशण पूछतां भगवाने पण तेमने अने द्रोपदीने  
कुशण पूछयुं ।<sup>७</sup> प्रेमनी परवशताथी ज्ञेनो कंठ रुधाई गयो हतो, अने नेत्रमां

तदैव कुशलं नोऽभूत् सनाथास्ते कृता वयम् । ज्ञातीन् नः स्मरता कृष्ण भ्राता मे प्रेषितस्त्वया ९  
न तेऽस्ति स्वपरभ्रान्तिर्विश्वस्य सुहृदात्मनः । तथापि स्मरतां शश्वत् क्लेशान् हंसि हृदि स्थितः १०  
युधिष्ठिर उवाच

किं न आचरितं श्रेयो न वेदाहमधीश्वर ! । योगेश्वराणां दुर्दर्शो यन्नो दृष्टः कुमेधसाम् ॥११  
इति वै वार्षिकान् मासान् राजा सोऽभ्यर्थितः सुखम् । जनयन् न यनानन्दमिन्द्रप्रस्थौकसां विभुः ॥१२  
एकदा रथमारुहा विजयो वानरध्वजम् । गाण्डीवं धनुरादाय तूणौ चाक्षयसायकौ ॥१३  
साकं कृष्णोन सत्रद्वद्वो विहर्तु विपिनं वनम् । बहुव्यालमृगाकीर्ण प्राविशत् परवीरहा ॥१४  
तत्राविद्यच्छ्लैर्व्याघ्रान् सूकरान् महिषान् रुस्तन् । शारभान् गवयान् खड्गान् हरिणान्द्वशल्कान्  
तान् निन्युः किङ्गरा राज्ञे मेद्यान् पर्वयुपागते । तृट्परीतः परिश्रान्तो बीभत्सुर्यमुनामगात् ॥१६  
तत्रोपस्पृश्य विशदं पीत्वा वारि महारथौ । कृष्णौ ददृशतुः कन्यां चरन्तीं चारुदर्शनाम् ॥१७  
तामासाद्य वरारोहां सुद्धिजां सुचिराननाम् । पप्रच्छ प्रेषितः सख्या फाल्गुनः प्रमदोत्तमाम् ॥१८

आंसु आव्यां हतां, एवां कुंतीअे पोता उपर पडेलां घणां क्षेत्रोने संभारी श्रीकृष्ण  
भगवान्ने कह्युं के “हे कृष्ण ! हे हुः भहरण ! ज्यारे अमो बंधुओने संभारीने  
तमे मारा भाई अझूरने मोकल्या हता, त्यारथी ज अमारुं कुशण थई चूक्युं छे  
अने तमे अमने धाणियातां कर्या छे ॥८॥ ७गतना मित्र अने आत्मारूप आपने  
आ पोतानो अने आ पारको एवो भेट नथी, तोपण स्मरण करनाराओना  
हृदयमां रहीने निरंतर तेओना क्लेशोने दूर करो छो ॥”<sup>९</sup> युधिष्ठिरे भगवान्ने  
कह्युं के “हे प्रभु ! अमे कह्युं पुष्य कर्युं छे के जेना प्रभावथी योगेश्वरोने पण  
दुर्लभ एवां तमारां दर्शन, विषय लंपट एवा अमोने थयां ते हुं जाणतो नथी ॥”<sup>१०</sup>  
युधिष्ठिर राजानी प्रार्थना उपरथी भगवान् वर्षांत्रतुना चार महिना सुधी  
आनंदथी ईद्रप्रस्थमां रह्या अने त्याना रहेवासीओनां नेत्रोने आनंद आप्यो ॥<sup>११</sup>  
एक दिवसे शत्रुओने मारनार अर्जुन भगवान्नी साथे सज्ज थई, वानरनी  
धज्जावाणा रथमां बेसीने गांडीव धनुष तथा अक्षय बाणवाणा भाथा लई, घणा  
सर्प अने मृगोथी भरेला घाटा वनमां मृगया करवा सारु गया ॥<sup>१२-१४</sup> ए वनमां  
वाघ, सुवर, पाडा, रुरु, सरभ, रोज, गेंडा, हरण, ससलां अने शाहुडीने  
(शेढाईने) बाणथी वींधी नाप्यां ॥<sup>१५</sup> पर्वषीनो दिवस हतो तेथी ए पवित्र पशुओने  
किंकर लोको राजानी पासे लई गया. तरसथी व्याम अने थाकेला अर्जुन  
यमुनाज्ञनी पासे आव्या ॥<sup>१६</sup> महारथी श्रीकृष्ण अने अर्जुने स्वयं पाणीनुं  
आयमन अने पान कर्या पृष्ठी त्यां फरती एक रुपाणी कन्याने दीठी ॥<sup>१७</sup> भगवान्ने

કાત્વં કસ્યાસિ સુશ્રોણિ ! કૃતોર્ગસિ કિ ચિકીર્ષસિ । મન્યે ત્વાં પતિમિચ્છતી સર્વ કથય શોભને !  
કાલિન્દ્યુવાચ

અહં દેવસ્ય સવિતર્દુહિતા પતિમિચ્છતી । વિષણું વેરેણ વરદં તપ: પરમાસ્થિતા ॥૨૦  
નાન્ય પતિ વૃણ વીર ! તમૃતે શ્રીનિકેતનમ् । તુષ્ટ્યાં મે સ ભગવાન् મુકુન્દોઽનાથસંશ્રય: ॥૨૧  
કાલિન્દીતિ સમાખ્યાતા વસામિ યમુનાજલે । નિર્મિતે ભવને પત્રા યાવદચ્યુતદર્શનમ् ॥૨૨  
તથાવદદ્ગુડાકેશો વાસુદેવાય સોર્ગિ તામ् । રથમારોપ્ય તદ્વિદ્વાન् ધર્મરાજમુપાગમત् ॥૨૩  
યદૈવ કૃષ્ણ: સન્દિષ્ટ: પાર્થાનાં પરમાદૃતમ् । કારયામાસ નગરં વિચિત્રં વિશ્વકર્મણ ॥૨૪  
ભગવાંસ્તત્ર નિવસન્ સ્વાનાં પ્રિયચિકીર્ષયા । અનન્યે ખાણદવં દાતુમર્જુનસ્યાસ સારથિ: ૨૫  
સોર્ગિનસ્તુષ્ટો ધનુરદાદ્વાયાજ્ઞવેતાનષ્ટ રથં નૃપ ! અર્જુનાયાખ્યાં તૂણો વર્મ ચાભેદ્યમસ્ત્રિભિ: ૨૬  
મયશ્ર મોચિતો વહે: સભાં સખ્ય ઉપાહરત્ । યસ્મિન્ દુર્યોધનસ્યાસીજ્જલસ્થલદૃશિ ભ્રમ: ૨૭

મોકલેલા અર્જુને સુંદર નિતંબવાળી, સારા દાંતવાળી અને રૂચિર મોઢાંવાળી એ  
ઉત્તમ સ્ત્રીની પાસે જઈને પૂછ્યું કેર હે રૂડા નિતંબવાળી ! તું કોણ છે ? કોની છે ?  
ક્યાંથી આવી છે ? અને શું કરવા ઈચ્છે છે ? હું ધારું છું કે તને પતિની ઈચ્છા છે.  
માટે હે સુંદરી ! તું સર્વે કહે. ૧૮-૧૯ કાલિંદી કહે છે હું સૂર્યની દીકરી છું, અને  
વરદાન દેનારા મહાપ્રભુ વિષણુ મારા પતિ થાય એવી ઈચ્છાથી કઠોર તપ કરું  
છું. ૨૦ હે વીર ! લક્ષ્મીના નિવાસરૂપ એ વિષણુ વિના બીજા પતિને હું ઈચ્છતી  
નથી. અનાથ લોકોના આશ્રયરૂપ એ મુકુંદ ભગવાન મારા ઉપર પ્રસન્ન થજો. ૨૧  
મારું નામ કાલિંદી છે અને યમુનાના ધરામાં મારા પિતાએ રથી આપેલા ધરમાં હું  
ભગવાનનું દર્શન થવા સુધી રહેવાની છું. ૨૨

શુક્રદેવજી કહે છે હે રાજા ! અર્જુને ભગવાનની પાસે આ વાત કહી એટલે  
ભગવાન પોતે પહેલાંથી જ જાણતા હતા, તેથી ભગવાન એ કાલિંદી નામની  
કન્યાને રથમાં બેસાડી અર્જુનની સાથે યુધિષ્ઠિર રાજાની પાસે આવ્યા. ૨૩ પાંડવોની  
પ્રાર્થનાથી ભગવાન ઈદ્રપ્રસ્થમાં રહ્યા હતા, તે સમયમાં તેમણે વિશ્વકર્માની પાસે  
પાંડવોને માટે ભારે અલ્લુત નગર કરાવી દીધું હતું. ૨૪ સંબંધીઓનું પ્રિય કરવાની  
ઈચ્છાથી ત્યાં રહેલા શ્રીકૃષ્ણો અજિનને ખાંડવવન બાળવા આપ્યું તે પ્રસંગમાં  
અર્જુનને ધનુષ આદિનો લાભ કરી દેવાને માટે તેના સાધિથ થયા હતા. ૨૫ અજિનએ  
પ્રસન્ન થઈને અર્જુનને ધનુષ, ધોળા, ધોડા, રથ, અખૂટ બાણવાળાં ભાથાં અને  
કવચ આપ્યું હતું. ૨૬ વળી ખાંડવવન બાળતી વખતે મયદાનવને અજિનથી છોડાવ્યો  
હોવાથી અજિનમાંથી મુકાવેલા મયદાનવે પોતાના મિત્ર અર્જુનને એવી સભા કરી

સ તેન સમનુજ્ઞાત: સુહૃદિશાનુમોદિતઃ । આયયૌ દ્વારકાં ભૂય: સાત્યકિપ્રમુખૈર્વત: ॥૨૮  
અથોપયેમે કાલિન્દી સુપુણ્યત્વક્ષ ઊર્જિતે । વિતન્વન્ પરમાનન્ સ્વાનાં પરમઙ્ગ્લલમ્ ॥૨૯  
વિન્દાનુવિન્દાવાવન્યૌ દુર્યોધનવશાનુગૌ । સ્વયંવે સ્વભગિની કૃષ્ણો સક્તાં ન્યષેધથામ્ ॥૩૦  
રાજાધિદેવ્યાસ્તનયાં મિત્રવિન્દાં પિતૃષ્વસુ: । પ્રસાહ્ હૃતવાન્ કૃષ્ણો રાજન્ ! રાજાં પ્રપશ્યતામ્ ૩૧  
નગનજિત્રામ કૌસલ્ય આસીદ રાજાતિર્થાર્મિક: । તસ્ય સત્યાભવત કન્યા દેવી નાગનજિતી નૃપ !  
ન તાં શેકુર્ણીપા વોદુમજિત્વા સમ ગોવૃષાન્ । તીક્ષ્ણશૃઙ્ગાન્ સુદુર્ધર્ષાન્ વીરગન્ધાસહાન્ ખલાન્ ૩૩  
તાં શ્રુત્વા વૃષજિલભ્યાં ભગવાન્ સાત્વતાં પતિ: । જગામ કૌસલ્યપુરં સૈન્યેન મહતા વૃત: ૩૪  
સ કોસલપતિ: ગ્રીત: પ્રયુથાનાસનાદિભિ: । અર્હણેનાપિ ગુરુણા પૂજયન્ પ્રતિનન્દિત: ॥૩૫  
વરં વિલોક્યાભિમતં સમાગતં નરેન્દ્રકન્યા ચકમે રમાપતિમ્ ।

ભૂયાદ્યં મે પતિરાશિષોઽમલા: કરોતુ સત્યા યદિ મે ધૃતો વ્રતૈ: ॥૩૬॥

આપી હતી કે જે સભામાં જળનું સ્થળ અને સ્થળનું જળ સમજાયાની દુર્યોધનને  
ભાંતિ થઈ હતી. ૨૭ પદી યુધિષ્ઠિર રાજાની આજા લઈને સંબંધીઓની સંમતિ  
લઈ, ભગવાન સાત્યકિ આદિ પોતાના અનુચરોની સાથે પાછા દ્વારકામાં પથાર્યા. ૨૮  
ત્યાં આવીને સંબંધીઓને પરમ આનંદ મંગળ આપતા ભગવાન સારી ઋતુ અને  
ઉત્તમ નક્ષત્રવાળા માંગલિક સમયમાં કાલિંદીને પરણ્યા. ૨૯ અવંતીના રાજા વિંદ  
અને અનુવિંદ જેઓ દુર્યોધનની ઈચ્છા પ્રમાણે ચાલનારા હતા, તેઓએ પોતાની  
બેન મિત્રવિંદા સ્વયંવરમાં શ્રીકૃષ્ણમાં આસક્ત થયાં છતાં પણ તેને રોકી હતી. ૩૦  
શ્રીકૃષ્ણ ભગવાન એ મિત્રવિંદા કે જે પોતાની ફોઈ રાજાધિદેવીની દીકરી હતી,  
તેને સર્વ રાજાઓના દેખતાં જ બળાત્કારથી હરી ગયા. ૩૧ હે રાજા ! કોસલ દેશનો  
નગનજિત નામે એક મોટો ધાર્મિક રાજા હતો, તેની “સત્યા” નામની રૂપાળી  
કન્યા હતી તે “નાગનજિતી” એવા નામથી ઓળખાતી હતી. ૩૨ તીક્ષ્ણ  
શીંગલાંવાળા, પરાભવ કરી શકાય નહીં એવા, ખળ અને શૂર પુરુષોના ગંધને  
પણ સહન કરતા ન હતા, એવા સાત આખલાઓને જીત્યા વિના રાજાઓ તેને  
પરણી શક્યા ન હતા. ૩૩ આખલાને જે જીતે તેને જ કન્યા મળે. એ વાત સાંભળી,  
શ્રીકૃષ્ણ ભગવાન મોટું સૈન્ય લઈ, એ રાજાના પુરમાં ગયા. ૩૪ પ્રસન્ન થયેલા તે  
કોસલ દેશના રાજાએ આસનાદિક અને પૂજાના પદાર્થોથી ભગવાનની પૂજા કરી,  
અને ભગવાને પણ તેને માન આપ્યું. ૩૫ રાજાની કન્યાએ પોતાને જોઈએ તેવા વર  
થવા આવેલા ભગવાનને જોઈને તેને વરવાની ઈચ્છા કરી, અને મનમાં કહેવા  
લાગી કે જો અનેક વ્રત કરીને મે ભગવાનને મનમાં ધર્યા હોય તો આ ભગવાન

यत्पादपङ्कजरजः शिरसा बिभर्ति श्रीरब्जजः सगिरिशः सह लोकपालैः ।  
लीलातनूः स्वकृतसेतुपरीप्सयेशः काले दधत् स भगवान् मम केन तुष्येत् ॥३७  
अर्चितं पुनरित्याह नारायण ! जगत्यते ! आत्मानन्देन पूर्णस्य करवाणि किमल्पकः ॥३८  
श्रीशुक उवाच  
तमाह भगवान् हृष्टः कृतासनपरिग्रहः । मेघगम्भीरया वाचा सस्मितं कुरुनन्दन ! ॥३९  
श्रीभगवानुवाच  
नरेन्द्र ! याच्चा कविभिर्विर्गर्हिता राजन्यबन्धोर्निजधर्मवर्तिनः ।  
तथापि याचे तव सौहृदेच्छ्या कन्यां त्वदीयां न हि शुल्कदा वयम् ॥४०॥  
राजोवाच

कोऽन्यस्तेऽभ्यधिको नाथ ! कन्यावर इहेष्पितः । गुणैकधाम्नो यस्याङ्गे श्रीर्वसत्यनपायिनी ४१  
किं त्वम्मामिः कृतः पूर्व समयः सात्वतर्षभ ! । पुसां वीर्यपरीक्षार्थं कन्यावरपरीप्सया ॥४२  
समैते गोवृषा वीर ! दुर्दन्ता दुरवग्रहाः । एतैर्भर्गनाः सुबहवो भिन्नगात्रा नृपात्मजाः ॥४३

मारा पति थजो अने मारा शुभ मनोरथने सङ्खण करजो. ४४ लक्ष्मी, ब्रह्मा,  
सदाशिव अने लोकपाण देवताओ पाण जेना यरणानी २४ने पोतानां मस्तक  
उपर धरे छे अने पोते करेली धर्म मर्यादाओनुं रक्षण करवाने माटे जे ईश्वर  
समये समये लीलावतार धरे छे, ते भगवान मारा उपर शा उपायथी प्रसन्न  
थाय ? पछी राजाए भगवाननी पूजा करीने कहुं के हे नारायण ! हे जगतना  
पति ! तमे आत्मानंदथी ज परिपूर्ण छो ते तमारुं हुं क्षुद्र राजा शुं काम करुं ? ४७-४८  
हे राजा ! राज थयेला भगवाने आसननो स्वीकार करी मेघनाद सरभी गंभीर  
वाणीथी मंदहास्यपूर्वक ते राजाने आ प्रभाणे कहुं. ४९

भगवान कहे छे हे राजा ! पोताना धर्ममां वर्तनार क्षत्रिय कोईनी पासे  
माराणी करे ए काम विद्वानोअे धिक्कारेलुं छे, तो पाण तमारी साथे स्नेह संबंध  
करवानी ईच्छाथी तमारी कन्याने मारुं छुं. पाण अमो कन्याना भूत्य तरीके धन  
वगेरे आपता नथी. ५०

राजा कहे छे हे नाथ ! गुणोना मुख्य स्थानत्रुप अने जेना अंगमां लक्ष्मीज्ञ  
सदाय रहे छे, तेमनाथी अधिक भीजो कन्यानो क्यो वर धारीये ? परंतु हे कृष्ण !  
पुरुषोना पराक्मनी परीक्षाने माटे अने कन्यानो वर शोधवाने माटे प्रथम ठराव  
कर्यो छे. ५१-५२ हे वीर ! वगर नाथेला अने पक्की शकाय नहीं ऐवा आ सात  
भण्डो छे, तेमणे धणा राजकुमारोनां गात्रो भांगी नाखीने तेझोने हराव्या छे. ५३

यदि मे निग्हृताः स्युस्त्वयैव यदुनन्दन ! । वरो भवानभिमतो दुहितुर्मै श्रियः पते ! ॥४४  
एवं समयमाकर्ण्य बद्ध्वा परिकरं प्रभुः । आत्मानं समधा कृत्वान्यगृह्णालीलयैव तान् ॥४५  
बद्ध्वा तान् दामभिः शौरिर्भग्नदर्पन् हृतौजसः । व्यर्कर्षलीलया बद्धान् बालो दारुमयान् यथा  
ततः प्रीतः सुतां राजा दौ कृष्णाय विस्मितः । तां प्रत्यगृहाद् भगवान् विधिवत् सदृशीं प्रभुः ॥  
राजपत्यश्च दुहितुः कृष्णं लब्ध्वा प्रियं पतिम् । लेभिरे परमानन्दं जातश्च परमोत्सवः ॥४८  
शङ्खभेर्यानका नेदुर्गातिवाद्यद्विजाशिषः । नरा नार्यः प्रमुदिताः सुवासः स्वगलङ्काताः ॥४९  
दशधेनुसहस्राणि पारिबहूमदाद् विभुः । युवतीनां त्रिसाहस्रं निष्क्रीवसुवाससाम् ॥५०  
नवनागसहस्राणि नागाच्छतगुणान् रथान् । रथाच्छतगुणानश्चाच्छतगुणान् नरान् ॥५१  
दम्पती रथमारोप्य महत्या सेनया वृतौ । स्तेहप्रक्लिन्नहृदयो यापयामास कोसलः ॥५२  
श्रुत्वैतद् रुरुधुर्भूपा नयन्तं पथि कन्यकाम् । भग्नवीर्याः सुदुर्मर्षा यदुभिर्गोवृषैः पुरा ॥५३  
तानस्यतः शरव्रातान् बन्धुप्रियकृदर्जुनः । गाण्डीवी कालयामास सिंहः क्षुद्रमृगानिव ॥५४  
हे यदुनंदन ! हे लक्ष्मीनापति ! जो आआभलाने आप पक्को तो हुं मारी दीकरीना  
पति तरीके स्वीकारुः. ५५

शुकदेवज्ञ कहे छे आवी रीतनो ठराव सांभणी भगवाने भेट बांधीने  
पोतानां सात स्वरूप धरी, रमत मात्रमां ज ते आभलाने पक्की लीधा. ५५ जेओनो  
गर्व अने शक्ति नाश पाम्यां छे, ऐवा ऐ आभलाने लगामथी बांधीने बाणक  
जेम लाकडाना आभलाने खेंये तेम लीलामात्रमां खेंय्या. ५६ पछी प्रसन्न थयेला  
अने विसमय पामेला नृनजित राजाए पोतानी दीकरी भगवानने आपी.  
भगवाने पाण पोताने योग्य ऐ स्त्रीनो विधि प्रमाणे प्रतिग्रह कर्यो. ५७ दीकरीने  
प्यारा पति भगवान मणवाथी राजानी राणीओने मोटो आनंद मण्यो अने भारे  
उत्सव थयो. ५८ शंभ, भेरी, आहि अनेक वाजां वागवा लाग्यां. श्वाह्याशो आशीर्वाद  
आपवा लाग्या. पुरुषो अने स्त्रीओअे राज थई सारां वस्त्रो अने माणाओना  
शणगार धर्या. ५९ समर्थ नृनजित राजाए दीकरी अने जमाईना सत्कारमां  
गणामां सुवर्णना हारोथी शणगारेली दशहजार गायो, त्रशहजार सारां वत्तवाणी  
दासीओ, नवहजार हाथीओ, हाथीओथी सो गणा रथ, अने रथथी सो गणा  
घोडा, अने घोडाथी सो गणा सेवको आप्या. ५०-५१ जेनुं हृदय स्नेहथी भींजाई  
गयुं छे, ऐवा ए राजाए दीकरी तथा जमाईने रथमां बेसाडी, साथे मोटी सेना  
आपीने वणाव्या. ५२ पूर्वे यादवो अने भणवान आभलाओअे प्रथम जेनां भण  
भांगी नांभ्यां हतां ऐवा राजाओअे, आ कृष्ण कन्या पराणीने लई जाय छे ऐ

पारिबह्मुपागृह्य द्वारकामेत्य सत्यया । रेमे यदूनामृषभो भगवान् देवकीसुतः ॥५५  
श्रुतकीर्तेः सुतां भद्रामुपयेमे पितृष्वसुः । कैकेयीं भ्रातृभिर्दत्तां कृष्णः सन्तर्दनादिभिः ॥५६  
सुतां च मद्राधिपतेर्लक्षणां लक्षणैर्युताम् । स्वयंवरे जहारैकः सुपर्णः सुधामिव ॥५७  
अन्याशैवंविधा भार्याः कृष्णस्यासन् सहस्रशः । भौमं हत्वा तन्निरोधादाहृताश्चारुदर्शनाः ५८

इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्दे उत्तरार्थे  
अष्टमहिष्युद्वाहो नाम अष्टपञ्चाशत्तमोऽध्यायः ॥५८॥

### अथ एकोनषष्ठितमोऽध्यायः (५९)

राजोवाच

यथा हतो भगवता भौमो येन च ताः स्त्रियः । निरुद्धा एतदाचक्षत्व विक्रमं शाङ्खधन्वनः ॥१  
इन्द्रेण हृतच्छत्रेण हृतकुण्डलबन्धुना । हृतमराद्रिस्थानेन ज्ञापितो भौमचेष्टितम् ।

सभायों गरुडारूढः प्राग्ज्योतिषपुरं ययौ ॥२

वात सांभणी सहन न थतां, तेमणे मार्गमां रोक्या.<sup>५३</sup> बंधुनुं प्रिय करनारा अर्जुने  
अनेक बाण नाभी ए राजा ओने सिंह जेम भूगोने भारे तेम मारी नाख्या.<sup>५४</sup>  
यादवोमां उत्तम भगवाने ससराए आपेली सर्वे वस्तुओ लई द्वारकामां आवीने  
नानजितीनी (सत्यानी) साथे रमवा लाग्या.<sup>५५</sup> केक्य देशमां उत्पन्न थयेली अने  
शृतकीर्ति नामनी पोतानी फैर्हनी दीकरी भद्राने तेमना भाईओए भगवानने  
आपी, तेथी श्रीकृष्ण तेमने पश पराण्या.<sup>५६</sup> मद्रदेशना राजानी दीकरी सारां  
लक्षणवाणी लक्ष्मणाने, गरुड जेम अमृतने हरी लाव्या हता तेम भगवान पश  
स्वयंवरमांथी ऐकला ज हरी लाव्या.<sup>५७</sup> आवी रीते बीज पश भगवाननी हजारो  
रुपाणी स्त्रीओ हती के जेओने नरकासुरना बंधनमांथी नरकासुरने मारीने  
छोडावी लाव्या हता.<sup>५८</sup>

इति श्रीमद्भागवता भागवतना दशम ऋक्यनो अष्टवनमो अध्याय संपूर्णः।

### अध्याय ५९

कृष्ण भगवाने करेलो नरकासुरनो वध अने पारिज्ञातनुं हुराता.

परीक्षित राजा कहे छे हे शुकटेवज्ञ ! नरकासुरे ते स्त्रीओने केवी रीते रोकी  
राखी भूकी हती अने तेने श्रीकृष्णो केवी रीते मार्यो ते प्रकारनुं भगवाननुं पराक्रम  
मने कहो. १ शुकटेवज्ञ कहे छे नरकासुरे वरुणादेवनुं छत्र हरी लीधुं हतुं, देवतानी

गिरिदुर्गः शस्त्रदुर्गेऽर्जलाग्न्यनिलदुर्गमम् । मुरपाशायुतैर्घोर्दृढैः सर्वत आवृतम् ॥३  
गदया निर्बिभेदाद्वैन् शस्त्रदुर्गाणि सायकैः । चक्रेणार्णिं जलं वायुं मुरपाशांस्तथासिना ॥४  
शङ्खानादेन यन्त्राणि हृदयानि मनस्विनाम् । प्राकारं गदया गुर्वा निर्बिभेद गदाधरः ॥५  
पाञ्चजन्यध्वनिं श्रुत्वा युगान्ताशनिभीषणम् । मुरः शयान उत्स्थै दैत्यः पञ्चशिरा जलात् ६  
त्रिशूलमुद्याम्य सुर्दिनीक्षणो युगान्तसूर्यानलरोचिरुल्बणः ।  
ग्रसंस्त्रिलोकीमिव पञ्चभिर्मुखैरभ्यद्रवताक्ष्यसुतं यथोरगा: ॥७॥  
आविध्य शूलं तरसा गरुत्मते निरस्य वक्रैव्यनदत् स पञ्चभिः ।  
स रोदसी सर्वदिशोऽन्तरं महानापूरयन्निष्ठकटाहमावृणोत् ॥८॥  
तदापतद् वै त्रिशिखं गरुत्मते हरिः शराभ्यामभिनत्रिधौजसा ।  
मुखेषु तं चापि शरैरताडयत्तस्मै गदां सोऽपि रुषा व्यमुञ्चत ॥९॥

मा अदितिनां कुंडण हरी लीधां हतां अने मेत्रपर्वतमां भणिपर्वत नामनुं ईद्रनुं  
स्थानक पश उरी लीधुं हतुं, तेथी ईद्रे सत्यभामाना धरमां आवीने ते सर्वे  
नरकासुरना अपराधनुं निवेदन करतां श्रीकृष्ण भगवान गरुड़ज्ञ उपर बेसीने,  
सत्यभामानी साथे नरकासुरना प्राग्योतिष नामना पुरमां गया. ए पुरनी  
आजु बाजु पहाडो तथा शखना किल्ला हता. ४७, अग्नि अने वायु चारेकोर  
राखेला होवाने लीधे त्यां जवुं धशुं कठाण पडे अवुं हतुं. मुर नामना हैत्ये नाभी  
मूँडेला भयंकर अने दृढ ऐवा हजारो पाशोथी चारेकोर वींटाअेलुं हतुं.<sup>२३</sup> भगवाने  
त्यां जैने गदाथी पर्वतना गढने अने बाणोथी शखना गढने तोडी नाख्यो,  
अग्नि, ४७ तथा वायुने चक्षी, मुरहैत्यना पाशोने तलवारथी, यंत्रोने तथा वीर  
पुरुषोना हृदयोने शंखनादथी अने गढने मोटी गदाथी तोडी नाख्या.<sup>४४</sup> पांचजन्य  
शंखना प्रलयकाणना कडाकानी पेठे भयंकर शब्दने सांभणी पांच माथांवाणो  
मुरहैत्य के जे खाईना जणमां सूतो हतो ते उठचो.<sup>६</sup> जेनी सामुं जोई शकाय नहीं  
ऐवो भयंकर हैत्य, प्रलयकाणना सूर्य अने अग्निना सरभुं तेजवाणुं त्रिशूल  
उगामीने पांच मोढांथी जाणे त्रिलोकीने गणी जतो होय ऐवी रीते, सर्प जेम  
गरुडनी सामे दोडे तेम भगवाननी सामे दोडचो.<sup>०</sup> वेगथी त्रिशूल फेरवीने गरुड  
उपर नाभतां तेषो पांच मोढांथी गर्जना करी. ए गर्जनाना मोटा शब्दथी सर्वे  
दिशाओ, आकाश अने आधुं ब्रह्मांड व्याम थयुं.<sup>८</sup> गरुड उपर आवी पडतां ए  
त्रिशूलना भगवाने पोतानी शक्तिथी बाणवडे त्रण कटका करी नाख्या, अने ए  
हैत्यना मोढांओमां पश केटलांक बाण मार्या. हैत्ये पश कोधथी भगवान उपर

तामापतन्तीं गदया गदां मृधे गदाग्रजो निर्बिभिदे सहस्रधा ।  
 उद्यम्य बाहूनभिधावतोऽजितः शिरांसि चक्रेण जहार लीलया ॥१०॥

व्यसुः पपाताभ्यसि कृतशीर्षो निकृतशृङ्गोऽद्विरिवेऽन्तेजसा ।  
 तस्यात्मजाः सम पितुर्वधातुराः प्रतिक्रियामर्घजुषः समुद्यताः ॥११॥

ताम्रोऽन्तरिक्षः श्रवणो विभावसुर्वसुर्भस्वानरुणश्च सप्तमः ।  
 पीठं पुरस्कृत्य चमूपर्ति मृधे भौमप्रयुक्ता निरग्न् धृतायुधाः ॥१२॥

प्रायुज्जतासाद्य शरानसीन् गदाः शक्त्यृष्टिशूलान्यजिते रुषोल्बणाः ।  
 तच्छस्त्रकूटं भगवान् स्वमार्गणैरमोघवीर्यसितलशश्कर्त ह ॥१३॥

तान् पीठमुख्याननयद् यमक्षयं निकृतशीर्षोर्भुजाऽद्विवर्मणः ।  
 स्वानीकपानच्युतचक्रसायकैस्तथा निरस्तान् नरको धरासुतः ॥१४॥

निरीक्ष्य दुर्बर्षण आस्ववन्मदैर्गजैः पयोधिप्रभवैर्निराक्रमत् ।  
 दृष्ट्वा सभार्यं गरुडोपरि स्थितं सूर्योपरिष्ठात् सतडिद्धनं यथा ।

कृष्णं स तस्मै व्यसृजच्छतर्णीं योधाश्च सर्वे युगपत् स्म विव्यथुः ॥१५॥

गदा नाभी.<sup>९</sup> ए गदा आवती हती तेटलामां भगवाने युद्धमां पोतानी गदाथी ते गदाना हजार कटका करी नाभ्या. पैछी पोताना अनेक हाथने उंचा करी, ते हैत्य युद्धमां सामो दोऽयो आवतो हतो तेनां पांचे माथां भगवाने चक्रवते कापी नाभ्यां.<sup>१०</sup> माथां कपातां प्राण रहित थयेलो ते हैत्य पाणीमां पडयो. पैछी बापना वधथी आतुर थयेला तेना सात दीकराओ वेर वाणवाने माटे कोध करीने लडवा सज्ज थया.<sup>११</sup> ताम्र, अंतरिक्ष, श्रवण, विभावसु, वसु, नभस्वान् अने अरुणा ए सात हैत्यो हथियारो लई तथा पीठ नामना सेनापतिने आगण करी बहार नीकछ्या.<sup>१२</sup> युद्धमां आवी कोधने लीधे बहु ज भयंकर लागता ए हैत्यो, भगवान उपर बाण, तलवार, गदा, सांग, ऋषि अने त्रिशूलोना धा करवा लाय्या. अमोघ पराक्रमवाणा भगवाने पोतानां बाणोथी ए शस्त्रोना समूहना तिलतिल जेवडा टुकडा करी नाभ्या.<sup>१३</sup> ए पीठादिक योद्धाओनां माथां, साथण, हाथ, पग अने कवयो कापी नाभीने तेओने यमपुरीमां मोक्षया. आ प्रमाणे भगवाननां चक अने बाणोथी पोताना सेनापतिओने मरण पामेला सांभणी, असहनतावाणो पृथ्वीनो दीकरो नरकासुर समुद्रमांथी उत्पन्न थयेला अने मद झरता हाथीओनुं सैन्य लईने बहार नीकछ्यो. जेम सूर्यनी उपर वीजणी सहित मेघ बेठेलो होय, तेम गरुड उपर सत्यभामानी साथे बेठेला भगवानने जोई तेमना उपर शतघ्नि नामनुं हथियार नाभ्युं. अने सर्वे योद्धाओ पष्ठ भगवानने एक सामटा वीधवा

तद् भौमसैन्यं भगवान् गदाग्रजो विचित्रवाजैनिशितैः शिलीमुखैः ।  
 निकृतबाहूरुशिरोध्विग्रहं चकार तर्हेव हताश्वकुञ्जरम् ॥१६॥

यानि योधैः प्रयुक्तानि शस्त्रास्त्राणि कुरुद्वृह । हरिस्ताच्यच्छिनन्तीक्षणैः शरैरैकैकशस्त्रिभिः १७  
 उद्यमानः सुपर्णेन पक्षाभ्यां निघता गजान् । गरुत्मता हन्यमानास्तुण्डपक्षनखैर्गजाः ॥१८  
 पुरमेवाविशन्नार्ता नरको युध्ययुध्यत । दृष्ट्वा विद्रावितं सैन्यं गरुडेनार्दितं स्वकम् ॥१९  
 तं भौमः प्राहरच्छक्त्या वज्रः प्रतिहतो यतः । नाकम्पत तया विद्वां मालाहत इव द्विपः ॥२०  
 शूलं भौमोऽच्युतं हन्तुमाददे वितथोद्यमः । तद्विसर्गात् पूर्वमेव नरकस्य शिरो हरिः ।  
 अपाहरद् गजस्थस्य चक्रेण क्षुरनेमिना ॥२१  
 सकुण्डलं चारुकिरीटभूषणं बभौ पृथिव्यां पतितं समुज्ज्वलत् ।  
 हाहेति साधिवत्यृष्यः सुरेश्वरा माल्यैर्मुकुन्दं विकिरन्त ईडिरे ॥२२॥

ततश्च भूः कृष्णमुपेत्य कुण्डले प्रतसजाम्बूनदरत्रभास्वरे ।  
 सवैजयन्त्या वनमालयार्पयत् प्राचेतसं छत्रमथो महामणिम् ॥२३॥

अस्तौषीदथ विश्वेशं देवी देववरार्चितम् । प्राज्जलिः प्रणता राजन्! भक्तिप्रवणया धिया २४

लाय्या. १४-१५ भगवाने विचित्र पुंखवाणां सज्जावेलां बाणोथी ते नरकासुरना सैन्यना हाथ, साथण, कंठ अने शरीर कापी नाभ्यां तथा धोडा अने हाथीओने पष्ठ मारी नाभ्या.<sup>१५</sup> हे राजा! योद्धाओं जे जे शस्त्रो अने अस्त्रो नाभ्यां, ते प्रत्येकने भगवान के जे पांखोथी हाथीओने मारनारा गरुडनी उपर बेठा हता, तेमणे त्रष्ण त्रष्ण बाणोथी कापी नाभ्यां. गरुडे चांच, पांखो अने नखोथी मारवा मांडेला हाथीओ पीडा पामीने गाममां पेसी गया. पैछी नरकासुर युद्ध करवा लाय्यो, पोताना सैन्यने गरुडे भगुडेलुं अने पीडेलुं जोई नरकासुरे पोतानी सांगथी वज्जने पष्ठ रोक्युं हतुं ते सांगथी गरुडने प्रहार कर्यो. भालांना प्रहारथी जेम हाथी कंपे नहीं, तेम गरुड सांगना प्रहारथी कंप्या नहीं.<sup>१७-२०</sup> पोतानो उद्यम व्यर्थ जतां नरकासुरे भगवानने मारवा सारु त्रिशूल उपाद्युं. ए त्रिशूलने नाभ्या पहेलां ज भगवाने सज्जायानी समान धारवाणा चकथी ए हाथी उपर बेठेला नरकासुरनुं माथुं कापी नाभ्युं.<sup>२१</sup> कुंडण सहित अने सुंदर मुकुट अने आभूषणो वाणुं तेनुं माथुं पृथ्वी पर पड्या इतां पष्ठ शोभवा अने चण्डकवा लाय्युं, हैत्यो हाहाकार करवा लाय्या. ऋषिओ सारुं थयुं एम कहेला लाय्या, मोटा देवताओ पुण्योथी भगवानने वधावतां स्तुति करवा लाय्या.<sup>२२</sup> पैछी पृथ्वीए भगवाननी पासे आवीने तेमने अति उज्जवण सुवर्णमां जडेलां रत्नोथी चण्डकतुं कुंडण,

## ભૂમિરુવાચ

નમસ્તે દેવદેવેશ ! શંહુચક્રગદાધર ! ભક્તેચ્છોપાત્તસ્પાય પરમાત્મન ! નમોઽસ્તુ તે ॥૨૫  
 નમ : પઙ્ક્ષજનાભાય નમ : પઙ્ક્ષજમાલિને । નમ : પઙ્ક્ષજનેત્રાય નમસ્તે પઙ્ક્ષજાદ્ધયે ॥૨૬  
 નમો ભગવતે તુભ્યં વાસુદેવાય વિષ્ણાવે । પુરુષાયાદિબીજાય પૂર્ણબોધાય તે નમ : ॥૨૭  
 અજાય જનયિતેઽસ્ય બ્રહ્મણેઽનન્તશક્તયે । પરાવરાત્મન્ ભૂત્તાત્મન્ પરમાત્મન્ નમોસ્તુ તે ॥૨૮  
 ત્વં વૈ સિસૃક્ષુ રજ ઉત્કટં પ્રભો ! તમો નિરોધાય બિભર્ષસંવૃતઃ ।  
 સ્થાનાય સત્ત્વં જગતો જગત્પતે ! કાલ : પ્રધાનં પુરુષો ભવાન્ પર : ॥૨૯॥  
 અહં પદ્યો જ્યોતિરથાનિલો નભો માત્રાણિ દેવા મન ઇન્દ્રિયાણિ ।  
 કર્તા મહાનિત્યખિલં ચરાચરં ત્વય્યદ્વિતીયે ભગવત્ત્રયં ભ્રમ : ॥૩૦॥

વેજયંતીમાળા, વરુણદેવનું ઇત્ર અને મોટો ભણિ આપ્યો. ૨૩ હે રાજા ! તે પદ્ધિ  
 નમેલાં પૃથ્વીદેવી હાથ જોડીને ભક્તિથી નમ્ બુદ્ધિવડે, ઉત્તમ દેવતાઓએ પૂજેલા  
 ભગવાનની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યાં. ૨૪

પૃથ્વી સ્તુતિ કરે છે હે દેવના દેવ ! હે ઈશ્વર ! હે શંખ, ચક્ર, ગદાને ધરનાર !  
 આપને હું નમસ્કાર કરું છું. હે પરમાત્મા ! જે આપ ભક્તો ઉપર અનુગ્રહ કરવાની  
 ઈચ્છાથી અવતાર ધર્યો છે, તેમને પ્રણામ કરું છું. ૨૫ જે આપની નામિ ક્રમણ થકી  
 બ્રહ્મા ઉત્પન્ન થયા છે એવા આપને પ્રણામ કરું છું. ક્રમણ સરખાં નેત્રવાળા આપને  
 પ્રણામ કરું છું. ક્રમણની માળા ધારણ કરનારા આપને હું પ્રણામ કરું છું. ૨૬  
 વસુદેવના પુત્રપણે પ્રગટ થયેલા છતાં પણ વ્યાપક અને સર્વોત્તમ ઐશ્વર્યવાળા  
 આપને પ્રણામ કરું છું. પૂર્ણ જ્ઞાનવાળા તથા સર્વથી પહેલા રહેનાર અને કારણના  
 કારણરૂપ આપને પ્રણામ કરું છું. ૨૭ અજન્મા, જગતને ઉત્પન્ન કરનાર, મોટા  
 અને અનંત શક્તિવાળા આપને પ્રણામ કરું છું. હે કાર્ય કારણોના આત્મા ! હે  
 યેતન અને અયેતનના પ્રવર્તક ! હે પરમાત્મા ! આપને મારા નમસ્કાર હો. ૨૮ હે  
 પ્રભુ ! હે જગતના પતિ ! જ્યારે આપ જગતને ઝજવાની ઈચ્છા કરો છો, ત્યારે  
 વૃદ્ધિ પામેલા રજોગુણને ઝજો છો, પ્રલય કરવાને માટે ભારે તમોગુણને ઝજો છો,  
 અને પાલન કરવાને માટે તે પ્રકારના સત્ત્વગુણને ઝજો છો. એ કરવા છતાં પણ તે  
 ગુણોનું આપને આવરણ થતું નથી. કાળ, પ્રધાન અને પુરુષ આપના શરીરભૂત  
 છે, છતાં પણ આપ તેનાથી જુદા છો. ૨૯ હે પ્રભુ ! જળ, તેજ, વાયુ, આકાશ,  
 વિષયો, દેવતાઓ, મન, ઈંદ્રિયો, અહંકાર અને મહત્તત્વ, તેનાથી થયેલું આ સ્થાવર  
 જંગમ સર્વ જગત આપના અદ્વિતીય સ્વરૂપમાં વર્તે છે. (અર્થાત્ આ જગત આપને

તસ્યાત્મજોઽયં તવ પાદપઙ્કજં ભીતઃ પ્રપત્રાર્તિહરોપસાદિતઃ ।

તત્ પાલયૈનં કુરુ હસ્તપઙ્કજં શિરસ્યમુદ્ઘાખિલકલમ્ભાપહમ् ॥૩૧॥

## શ્રીશુક ઉવાચ

ઇતિ ભૂમ્યાર્થિતો વાગ્નિભર્ભગવાન् ભક્તિનગ્રયા । દત્ત્વાભયં ભૌમગૃહં પ્રાવિશત્ સકલાર્દ્ધમત્ ૩૨  
 તત્ર રાજન્યકન્યાનાં ષટ્સહસ્તાધિકાયુતમ્ । ભૌમાહૃતાનાં વિક્રમ્ય રાજભ્યો દદૂશે હરિઃ ॥૩૩  
 તં પ્રવિષ્ટં સ્ત્રિયો વીક્ષ્ય નરવીરં વિમેહિતાઃ । મનસા વન્નિરેઽભીષ્ટું પતિં દૈવોપસાદિતમ् ॥૩૪  
 ભૂયાત् પતિરયં મહ્યં ધાતા તદનુમોદતામ્ । ઇતિ સર્વાઃ પૃથ્વક્ કૃષ્ણો ભાવેન હૃદયં દધુઃ ॥૩૫  
 તાઃ પ્રાહિણોઽદ્વારવતી સુમૃદ્ધિવરજોઽમ્બરાઃ । નરયાનૈર્મહાકોણાન્ રથાશાન્ દ્રવિણં મહત્ ॥૩૬  
 એરાવતકુલેભાંશ્ ચતુર્દન્તાંસ્તરસ્વિનઃ । પાણુરાંશ્ ચતુર્ષષ્ઠિ પ્રેષયામાસ કેશવઃ ॥૩૭  
 ગત્વા સુરેન્દ્રભવનં દત્ત્વાદિત્યૈ ચ કુણઢલે । પૂર્જિતસ્ત્રિદશેન્દ્રેણ સહેન્દ્રાણ્યા ચ સપ્ત્રિયઃ ॥૩૮  
 ચોદિતો ભાર્યાયોત્પાટ્ય પારિજાતાં ગરૂત્મતિ । આરોપ્ય સેન્દ્રાન્ વિબુધાન્ નિર્જિત્યોપાનયત્ પુરમ् ।

જ આધીન છે.) આ જગત આપને આધીન નથી, એમ કહેનારાનો એ માત્ર ભ્રમ  
 જ છે. ૩૦ હે શરણાગતોની પીડાને હરનાર ! નરકાસુરનો પુત્ર આ ભગદત્ત  
 આપનાથી ભય પામેલો હતો, તેથી હું તેને આપના ચરણારવિંદની પાસે લાવી છું.  
 માટે આનું પાલન કરો અને સર્વપાપને નાશ કરનારું હસ્તક્રમણ આના માથા  
 ઉપર ધરો. ૩૧

શુકદેવજી કહે છે આ પ્રમાણે ભક્તિથી નમેલાં પૃથ્વીદેવીએ પોતાની વાણીથી  
 જેમની પ્રાર્થના કરી છે, એવા ભગવાન અભયદાન આપીને નરકાસુરના સર્વ  
 સંપત્તિવાળા ધરમાં પદ્ધાર્યા. ૩૨ ત્યાં રાજાઓની સોળહજાર અને એકસો કન્યાઓ  
 કે જેઓને પરાક્રમથી નરકાસુરે રાજાઓની પાસેથી હરી લાવેલી હતી, તેઓને  
 ભગવાને જોઈ. ૩૩ ભગવાનને આવેલા જોઈ મોહ પામેલી તે કન્યાઓ દૈવે મેળવી  
 આપેલ તે જ પ્યારા શ્રીકૃષ્ણને પતિ તરીકે મનથી વરી ચૂકી. ૩૪ “આ ભગવાન  
 મારા પતિ થજો અને એજ વિષયમાં દૈવસંમતિ આપજો” આવી રીતે સર્વ  
 કન્યાઓએ પૃથક્ પૃથક્ પ્રેમથી ભગવાનમાં મન ધર્યું. ૩૫ સુંદર અને સ્વચ્છ  
 વલ્લવાળી તે સ્ત્રીઓને પાલભીઓ આદિમાં બેસાડીને ભગવાને દ્વારકામાં મોકલી  
 દીધી, અને તે ઉપરાંત મોટા ભંડાર, હાથી, ઘોડા અને ધણુંક ધન પણ મોકલી  
 દીધું. વેગવાળા ઘોડા અને એરાવતના કુળમાં ઉત્પન્ન થયેલા ચોસઠ હાથીઓ પણ  
 મોકલી દીધા. ૩૬-૩૭ પછી સ્વર્ગમાં જઈને અદિતિને કુંડળ આપ્યાં અને ઈંગ્રે તથા  
 ઈંડ્રાણીએ ભગવાન તથા સત્યભામાની પૂજા કરી. ૩૮ સત્યભામાની પ્રેરણાથી

स्थापितः सत्यभामाया गृहोद्यानोपशोभनः । अन्वगुर्भमराः स्वर्गात्तद्द्वासवलम्पटाः ॥४०  
 ययाच आनन्द्य किरीटकोटिभिः पादौ स्पृशन्नच्युतमर्थसाधनम् ।  
 सिद्धार्थ एतेन विगृह्यते महानहो सुराणां च तमो धिगाद्यताम् ॥४१॥  
 अथो मुहूर्त एकस्मिन् नानागारेषु ताः स्त्रियः । यथोपयेमे भगवांस्तावद्वूपधरोऽव्ययः ॥४२  
 गृहेषु तासामनपाय्यत्कर्यकृत्तिरस्ताम्यातिशयेष्ववस्थितः ।  
 रेमे रमाभिर्निजकामसंप्लुतो यथेतरो गार्हकमेधिकांश्वरन् ॥४३॥  
 इत्थं रमापतिमवाप्य पर्ति स्त्रियस्ता ब्रह्मादयोऽपि न विदुः पदवीं यदीयाम् ।  
 भेजुर्मुदाविरतमेधितयानुरागहासावलोकनवसङ्गमजल्पलज्जाः ॥४४॥  
 प्रत्युद्ग्रामासनवराहणपादशौचतांबूलविश्रमणवीजनगंधमाल्यैः ।  
 केशप्रसारशयनस्नपनोपहार्येदर्दीसीशता अपि विभोविदधुः स्म दास्यम् ॥४५॥  
 इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां सहितायां दशमस्कन्धे उत्तरार्द्धे  
 पारिजातहरणनरकवद्यो नाम एकोनषष्ठिमोऽध्यायः ॥५९॥

पारिजातकना जाडने उिखेडी, गरुड उपर भूकीने ईंद्रादिक देवताओनो पराजय करी, ते जाडने द्वारकामां लाव्या.<sup>३८</sup> ऐ जाडने सत्यभामाना धरना भगीयानी शोभा करवा सारु त्यां रोध्युं. ए जाडना सुगंधरुप आसवमां लक्ष्याएला भ्रमरो स्वर्गमांथी ते जाडनी पछिवाडे आव्या हता.<sup>३९</sup> जे ईंद्रे भुगटना अग्रभागथी श्रीकृष्णना यरणानो स्पर्श करतां प्रशाम करी, प्रथम तेनी पासे पोतानां कार्य सिद्ध करवा भागडी करी हती, ते जे ईंद्र पोतानुं कार्य सिद्ध थया पछी भगवान साथे युद्ध करे छे. आश्वर्य छे, देवोने पश्च आटलो भधो अहंकार !!! विकार छे देवोनी धनिकताने.<sup>४०</sup> पछी जेटली स्त्रीओ हती तेटलां रुपो धरीने श्रीकृष्ण भगवान नोभानोभा धरोमां एक जे मुहूर्तमां ते सर्वे स्त्रीओने विधि सहित पराण्या.<sup>४१</sup> जे ओना समान अथवा अधिक कोई पश्च धर नथी, एवां ते स्त्रीओनां धरमां सर्वदा रहेता अने पोताना स्वरूपानंदथी पूर्ण छतां पश्च बीजानी पेटे गृहस्थाश्रमना धर्माने पाणता भगवान लक्ष्मीना अंशरुप ते स्त्रीओनी साथे रमता हता.<sup>४२</sup> ईश्वादिक पश्च जेमनी पदवीने जाणता नथी, एवा लक्ष्मीना पति भगवानने पोताना पतिरुपे पाभीने ते स्त्रीओ निरंतर वृद्धि पाभती प्रीतिथी स्नेह भरेला हास्यपूर्वक जोती हती, नवीन संगम करती हती, भाषण करती हती अने लाज देखाउती हती.<sup>४३</sup> जोके प्रत्येकनी पासे सेंकडो दासीओ हती तोपश्च

अथ षष्ठिमोऽध्यायः (६०)

॥ श्रीशुक उवाच ॥

कर्हिचित्सुखमासीनं स्वतल्पस्थं जगदुरुम् । पतिं पर्यचरद्वैष्मी व्यजनेन सखीजनैः ॥१  
 यस्त्वेतल्लिलया विश्वं सृजत्यत्यवतीश्वरः । स हि जातः स्वसेतूनां गोपीथाय यदुष्वजः ॥२  
 तस्मिन्नतर्गृहे भ्राजन्मुक्तादामविलम्बिना । विराजिते वितानेन दीपैर्मणिमयैरपि ॥३  
 मल्लिकादामभिः पुष्टिद्विरेफकुलनादितैः । जालरन्ध्रप्रविष्टैश्च गोभिश्वन्द्रमसोऽमलैः ॥४  
 पारिजातवनामोदवायुनोद्यानशालिना । धूपैरगुरुजै राजन् ! जालरन्ध्रविनिर्गतैः ॥५  
 पयःफेननिभे शुभ्रे पर्यङ्के कशिपूत्तमे । उपतस्थे सुखासीनं जगतामीश्वरं पतिम् ॥६  
 वालव्यजनमादाय रत्नदण्डं सखीकरात् । तेन वीजयती देवी उपासाञ्चक्र ईश्वरम् ॥७

सामे जवुं, आसन देवुं, सुंदर पूजन करवुं, पग धोवा, पानबींदुं देवुं, पग चांपवा, पंखा नाखवा, यंदन पुष्प देवां, केश स्वरूप करवा, सुवडाववा, नवराववा अने भोजन कराववुं ईत्यादिक उपचारोथी ते स्त्रीओ भगवाननी पासे दासीपशुं करती हती.<sup>४४</sup>

द्यति श्रीमद्भागवता भागवतना दशम ऋक्यनो ओगाणसाठमो अद्याय संपूर्णः

अद्याय ६०

श्रीकृष्ण भगवाने रुक्मिणीनुं करेलुं हास्य तथा सान्त्वन.

शुकदेवज्ञ कहे छे एक दिवसे पोतानी सभीओनी साथे रुक्मिणी पोताना पलंग उपर सुभेथी बेटेला जगद्गुरु श्रीकृष्ण भगवाननी चमर ढोणीने सेवा करतां हतां.<sup>१</sup> जे ईश्वर पोतानी लीलाथी आ जगतनी उत्पत्ति, स्थिति, अने पोषण करे छे तेजे अजन्मा ईश्वर पोतानी करेली मर्यादाओना रक्षण माटे यादवकुणमां जन्म्या छे.<sup>२</sup> ए रुक्मिणीनुं शयनगृह भोतीनी माणाओनां लटकणियांथी शोभतुं हतुं अने मणिना दीवा प्रकाशी रह्या हता.<sup>३</sup> मल्लिकानी माणाओ अने पुष्पोनी सुगंधी लेवा आवेला अनेक भ्रमराओ गुंजारव करी रह्या हता, यंद्रमाना निर्मण किरणो बारीओना छिद्रमांथी पेसी रह्या हता.<sup>४</sup> भगीयामां शोभनार पारिजातकना वननो सुगंधी वायु फेलाई रहेलो हतो. हे राज ! अगरुना धूपना धुमाडा जाणिआनां छिद्रमांथी नीकणता हता.<sup>५</sup> ए धरमां रुक्मिणी पलंग पर बीछावेली दूधना फीण समान अति कोमण तथा थेत

सोपाच्युं क्रणयती मणिनूपुराभ्यां रेजेऽङ्गलीयवलयव्यजनाग्रहस्ता ।  
वस्त्रान्तगूढकुचकुङ्कमशोणहारभासा नितम्बधृतया च पराध्यकाञ्च्या ॥८॥  
तां रूपिणीं श्रियमन्यगतिं निरीक्ष्य या लीलया धृतनोरनुरूपरूपा ।  
प्रीतः स्मयन्नलक्कुण्डलनिष्ककण्ठवक्त्रोल्लसत्सुधां हरिरावभाषे ॥९॥

श्रीभगवानुवाच

राजपुत्रीप्सिता भूपैर्लोकपालविभूतिभिः । महानुभावैः श्रीमद्दीरुपौदार्यबलोर्जितैः ॥१०  
तान् प्रापानार्थिनो हित्वा चैद्यादीन् स्मरदुर्मदान् । दत्ता भ्रात्रा स्वपित्रा च कस्मात्रो वृषेऽसमान् ॥११  
राजभ्यो बिभ्यतः सुभूः समुद्रं शरणं गतान् । बलवद्धिः कृतद्वेषान् प्रायस्त्यक्तनृपासनान् ॥१२  
अस्पृष्टवर्त्मनां पुंसामलोकपथमीयुषाम् । आस्थिताः पदवीं सुभूः प्रायः सीदन्ति योषितः ॥१३  
निष्कञ्चना वयं शशनिष्कञ्चनजनप्रियाः । तस्मात् प्रायेण न ह्याद्या मां भजन्ति सुमध्यमे ! ॥१४

वर्णवाणी उत्तम रजाई उपर सुभेथी बेठेला पोताना पति जगत्त्राथ भगवाननी सेवा करतां हतां ॥१५ रत्ननी दांडीवाणा यमर हाथमां लईने पवन ढोणतां रुक्मिणी प्रभुनी पासे बेठां हतां ॥१६ भगवाननी पासे भणिनां जांङ्गरना जमकारा करता अने वीटीओ, कंकणा तथा यमर जेना हस्तमां शोभी रहेलुं हतुं, ऐवां रुक्मिणी वस्त्रना छेडाथी ढांडेलां स्तन उपर केसरथी रंगाएला हारथी अने नितं अ उपर धरेली अमूल्य कटिमेखणाथी शोभतां हतां ॥१७ भगवाने लीलाथी धरेला अवतारने योग्य रुपवाणां अने पोता विना बीजो कोई जेनो आश्रय नथी, ऐवां ए साक्षात् लक्ष्मीरूप रुक्मिणी के जेना केश, बे कुँडण अने सोनानी कंठीथी चारे दिशामां शोभी रहेला मुखमां भंडहास्यरुपी अमृत दीपी रह्युं हतुं, तेमने जोईने प्रसन्न थयेला श्रीकृष्ण भगवान हसतां हसतां आ प्रमाणे कहेवा लाग्या ॥१८

भगवान कहे छे हे राजपुत्री ! लोकपाण सरभा ऐश्वर्यवाणा, मोटा प्रभाववाणा, धनवान, रुप, उदारता अने बणथी वृद्धि पामेला राजाओ प्रथम तमने ईरुता हता अने पधी तमारा भाई ए तथा पिताए तेओना संबंधमां तमारुं सगपण कर्युं हतुं ते छतां, ए कामातुर शिशुपाण आहि राजाओ के जेओ तमने परणवा सारु आव्या हता, तेओने छोडी दृष्टने अमो के जेओ तमारा समान नथी, तेने तमो शा माटे वर्या ? ॥१९-२० अमो तो धशुं करीने राजाओथी भय पामीने समुद्रने शरणे आवेला, बणवानोनी साथे देष करनारा अने राज्यासननो त्याग करनारा छीअे, आवा अमोने शा माटे वर्या ? ॥२१ हे सुंदरी ! अजाणी रीतभातवाणा अने लोकथी न्यारा मार्गवाणा पुरुषोना पनारामां

ययोरात्मसमं वित्तं जन्मैश्वर्याकृतिर्भवः । तर्योर्विवाहो मैत्री च नोत्तमाधमयोः क्वचित् ॥१५  
वैदर्भ्येतदविज्ञाय त्वयादीर्घसमीक्षया । वृता वयं गुणैर्हीना भिक्षुभिः इलाघिता मुधा ॥१६  
अथात्मनोऽनुरूपं वै भजस्व क्षत्रियर्थभम् । येन त्वमाशिषः सत्या इहामुत्र च लप्प्यसे ॥१७  
चैद्यशाल्वजरासन्धदन्तवक्त्रादयो नृपाः । मम द्विषन्ति वामोरु! रुक्मी चापि तवाग्रजः ॥१८  
तेषां वीर्यमदास्थानां दूमानां स्मयनुत्तये । आनीतासि मया भद्रे ! तेजोऽपहरतासताम् ॥१९  
उदासीना वयं नूनं न स्वयपत्यार्थकामुकाः । आत्मलब्ध्याऽस्महे पूर्णा गेहयोज्येतिरक्रियाः २०

श्रीशुक उवाच

एतावदुक्तवा भगवानात्मानं वल्लभामिव । मन्यमानामविश्लेषात् तद्वर्षण उपारमत् ॥२१  
इति त्रिलोकेशपतेस्तदाऽत्मनः प्रियस्य देव्यश्रूतपूर्वमप्रियम् ।  
आश्रुत्य भीता हृदि जातवेपथुश्चिन्तां दुरन्तां रुदती जगाम ह ॥२२॥

पदेली स्त्रीओ धशुं करीने पीडाय छे ॥१३ अमो तो निरंतर निष्कियन छीअे, अने निष्कियन लोकोने घ्यारा तथा तेओ उपर प्रीति राखनारा छीअे, एटला माटे धशुं करीने समृद्धिवाणा लोको मने भजता नथी ॥१४ जेओनां धन, जन्म, ऐश्वर्य अने आवता समयनी स्थिति परस्पर समान होय तेओ वच्ये ज विवाह अने मैत्री थवी योग्य छे । पाण उत्तम अने अधमनी वच्ये कटी योग्य नथी ॥१५ हे रुक्मिणि ! तमे टूंकी दृष्टिथी आ सर्वे वात नहीं जाणतां, गुण रहित, ऐवा अमो भिखारीओने वभाषावा लायक छीअे तेओने तमो वृथा वर्या छो ॥१६ माटे हज्ज पाण तमे पोताने योग्य होय, ऐवा कोई उत्तम क्षत्रियने वरो के जेथी आलोकमां अने परलोकमां तमे साचां सुखने पामो ॥१७ शिशुपाण, शाल्व, जरासंध अने दंतवक्त्र आहि राजाओ तथा तमारो भोटोभाई रुक्मी पाण मारो देष करता हता ॥१८ पराक्रमना भद्रथी आंधणा ए अभिमानी लोकोनो गर्व उतारवा सारु हे रुक्मिणि ! दुष्ट लोकोना तेजनो नाश करनार हुं तमने हरी लाव्यो छु ॥१९ अमो स्वस्वरुपना अभंड प्रकाशना कारणे प्राकृत येष्टाथी रहित छीअे. अमोने स्त्री, संतान के धननी लालय नथी. कारणे के अमो स्वस्वरुपना लाभथी ज पूर्णा छीअे. एटला ज माटे देह तथा धरने विषे अमो अत्यंत उदासीन वर्तीअे छीअे ॥२०

शुकदेवज्ञ कहे छे पोताथी भगवान अणगा नहीं पडवाने लीधे जे रुक्मिणी पोताने बहुज प्यारी मानतां हतां, ते रुक्मिणीनो गर्व उतारवा सारु आटलां वच्यन बोलीने बंध रह्या ॥२१ त्रिलोकना स्वामीओना पाण स्वामी अने पोताना घ्यारा भगवाननुं आ प्रमाणे कटी नहीं सांभणेलुं अप्रिय वच्यन सांभणी हृदयमां

पदा सुजातेन नखारुणश्चिया भुवं लिखन्त्यशुभिरञ्जनासितैः ।  
आसिञ्चती कुड्डमस्तुषितौ स्तनौ तस्थावधोमुख्यतिदुःखरुद्धवाक् ॥२३॥

तस्याः सुदुःखभयशोकविनष्टबुद्धेर्हस्ताच्छ्लथद्वलयतो व्यजनं पपात ।  
देहश्च विक्लवधियः सहसैव मुहूर्न् रम्भेव वायुविहता प्रविकीर्य केशान् ॥२४॥  
तद् दृष्टा भगवान् कृष्णः प्रियायाः प्रेमबन्धनम् । हास्यप्रौढिमजानन्त्याः करुणः सोऽन्वकम्पया २५  
पर्यङ्कादवरुह्याशु तामुत्थाप्य चतुर्भुजः । केशान् समुह्य तद्वक्त्रं प्रामृजत् पद्मपाणिना ॥२६  
प्रमृज्याश्रुकले नेत्रे स्तनौ चोपहतौ शुचा । आश्लिष्य बाहुना राजनन्यविषयां सतीम् ॥२७  
सान्त्वयामास सान्त्वज्ञः कृपया कृपणां प्रभुः । हास्यप्रौढिभ्रमच्चित्तामतदर्हा सतां गतिः २८

श्रीभगवानुवाच

मा मा वैदर्भ्यसूयेथा जाने त्वां मत्परायणाम् । तद्वचः श्रोतुकामेन क्षेत्र्याऽचरितमङ्गने! २९

भयथी रोतां एवां रुक्मिणी अपार चिंतामां पडयां.<sup>२२</sup> न भने लीघे राती कंतिवाणा  
क्रमण यरणथी धरतीने खोतरतां, केसरना लेपनवाणां पोतानां स्तनने आंजणने  
लीघे कणां थयेलां आंसुवडे नवरावतां अने घण्टा दुःखने लीघे जेनी वाणी रोकाई  
गई हती. एवां रुक्मिणी नीचुं मोहुं करी बेसी रह्यां.<sup>२३</sup> अप्रिय सांभणवाथी  
अत्यंत दुःखी अने भगवान् मारो त्याग करी देशे एवी शंकाथी भय, तथा  
पश्चातापथी जेनी बुद्धि व्याकुण थई गई, एवां ते रुक्मिणीना हाथमांथी चामर  
पडी गयो अने कुंकण पाश पडवा लाग्यां, तेमै भूर्धा पामतां वायुये पारी नाखेली  
केणनी पेठे छुटां थयेलां केशवाणां रुक्मिणी धरती पर पडी गयां.<sup>२४</sup> हास्यनी  
गंभीरताने नहीं जाणनारां घ्यारीनुं ऐ प्रेमबन्धन ज्ञोईने ते दयाणु श्रीकृष्ण  
भगवानने दया आवी.<sup>२५</sup> उठाइवुं, आलिंगन करवुं अने मोहुं लुछवुं ईत्यादिक  
कार्योने माटे जेणो चारभुजा प्रगट करी छे, एवा भगवाने पलंग परथी नीचा  
उतरी ते रुक्मिणीने उठाई तेमना केश सरभां करी क्रमण सरभा हाथथी तेमनुं  
मोहुं लुछवुं.<sup>२६</sup> हे राजा ! आंसुथी शोभतां तेमनां नेत्र अने आंसुथी भरडायेला  
तेमना स्तनने लुहीने भगवाने जेनी पोता सिवाय बीजु कोई गति नथी, एवां  
ऐ सती रुक्मिणीनुं हाथथी आलिंगन कुर्या.<sup>२७</sup> पधी सांत्वना करवामां चतुर  
अने सज्जनोना शरणरूप भगवाने हास्यनी गंभीरताथी जेनुं चित्त भमतुं हतुं  
एवां अने तेवी हांसी करवाने योग्य नहीं, एवां रुक्मिणीनी आ प्रमाणे सांत्वना  
करी.<sup>२८</sup>

भगवान् कहे छे हे रुक्मिणी ! मारा उपर तमारे दोष दृष्टि करवी नहीं. हुं

मुखं च प्रेमसंरम्भस्कुरिताधरमीक्षितम् । कटाक्षेपारुणापाङ्गं सुन्दरभुक्टीतटम् ॥३०  
अयं हि परमो लाभो गृहेषु गृहमेधिनाम् । यन्मर्मनीयते यामः प्रियया भीरु भामिनि ! ॥३१

श्रीशुक उवाच

सैवं भगवता राजन् ! वैदर्भी परिसान्विता । ज्ञात्वा तत्परिहासोक्ति प्रियत्यागभयं जहौ ॥३२  
बभाष ऋषभं पुंसां वीक्षन्ती भगवन्मुखम् । सन्नीडहासरुचिरस्निग्धापङ्गेन भारत ! ॥३३

स्तुविमण्युवाच

नन्वेवमेतदरविन्दविलोचनाह यद् वै भवान् भगवतोऽसदृशी विभूमः ।  
क्रस्वे महिम्यभिरतो भगवांस्यधीशः व्वाहं गुणप्रकृतिरज्ञगृहीतपादा ॥३४॥  
सत्यं भयादिव गुणेभ्य ऊक्रमान्तः शेते समुद्र उपलभ्नमात्र आत्मा ।  
नित्यं कदिन्द्रियगणैः कृतविग्रहस्त्वं त्वत्सेवकैर्नृपपदं विधुतं तमोऽन्धम् ॥३५॥  
तत्पादपद्मकरन्दजुषां मुनीनां वर्त्मास्फुटं नृपशुभिर्ननु दुर्विभाव्यम् ।  
यस्मादलौकिकमिवेहितमीश्वरस्य भूमंस्तवेहितमथो अनु ये भवन्तम् ॥३६॥

ज्ञाणुं छुं के तमे भने ज आश्रयरूप गणो छो. हे सुंदरी ! तमारो प्रत्युत्तर  
सांभणवानी ईच्छाथी में हस्तां हस्तां कहुं छे, कांઈ वास्तविक रीते कहुं नथी.<sup>२८</sup>  
तमारा मुखने प्रेमना कोपथी ईरक्ता होठवाणुं, राती थयेली नेत्रनी आशीओवाणुं  
अने तेथी ज वांकी थयेली भ्रमरोवाणुं जोवा सारु में आ तमारी हांसी करी छे.<sup>२९</sup>  
हे भामिनी ! घ्यारीनी साथे हास्यनां वयनोथी समय काढवामां आवे ऐज  
गृहस्थाश्रमां मोटो लाभ छे.<sup>३०</sup>

शुकदेवज्ञ कहे छे हे राजा ! आ प्रमाणे भगवाने सांत्वना आपतां  
रुक्मिणीऐ ए वयनोने हास्यरूप जाणी, भगवान् मारो त्याग करशे एवी बीक्ने  
छोडी दीधी.<sup>३१</sup> पधी लाज सहित हास्यथी सुंदर अने स्नेह भरेलां नेत्रोथी  
भगवानना मुखने जेनां रुक्मिणीऐ भगवानने आ प्रमाणे कहुं.<sup>३२</sup>

रुक्मिणी कहे छे हे क्रमण सरभां नेत्रवाणा ! आपे कहुं के अमो तारा  
समान नथी ए वात साची ज कही छे; केमके पोताना स्वरूपना आनंदमां भग्न  
रहेनारा अने ब्रह्मादिकना स्वामी आप क्यां ? अने पामर तथा अज्ञानी लोको  
जेना यरणनुं सेवन करे छे एवी लक्ष्मी हुं क्यां ?<sup>३३</sup> हे मोटा पराक्रमवाणा ! आपे  
कहुं के “अमो राजाओथी भय पामीने समुद्रना शरणे आवेला धीये” ते पाण  
साचुं ज कहुं छे, कारण के शष्ठ स्पर्शादिक विषयोरुपी राजाओनी बीक्थी जाणे  
भय पामेला होयने शुं ? तेनी पेठे आप समुद्रनी पेठे अगाध अर्थात् विषयोथी

નિષ્કષ્ટનો નનુ ભવાનું ન યતોऽસ્તિ કિઞ્ચિત્ યસ્મૈ બર્લિ બલિભુજોऽપિ હરન્ત્યજાદ્યાઃ ।  
ન ત્વા વિદન્તસુતૃપોऽન્તકમાદ્યતાથાઃ પ્રેષ્ટે ભવાનું બલિભુજામપિ તેઽપિ તુભ્યમ् ॥૩૭॥

ત્વં વૈ સમસ્તપુરુષાર્�મયઃ ફલાત્મા યદ્વાજ્જ્યા સુમતયો વિસૂજનિત કૃત્સ્નમ् ।  
તેણાં વિભો સમુચ્ચિતો ભવતઃ સમાજઃ પુંસઃ સ્ત્ર્યાશ્ર રતયોઃ સુખદુઃખિનોર્ન ॥૩૮॥  
ત્વં ન્યસ્તદણ્ડમનિભર્ગદિતાનુભાવ આત્માઽત્મદશ્ચ જગતામિતિ મે વૃતોઽસિ ।  
હિત્વા ભવદ્ભુવ ઉદીરિતકાલવેગધવસ્તાશિષોઽબ્જભવનાકપતીનું કુતોઽસે ॥૩૯

ક્ષોભ નહીં પામેલા હદ્યમાં ચૈતન્યધન આત્માના અંતરાત્મારૂપે નિશ્ચળપણાથી  
રહેલા છો. આપે કહ્યું કે “બળવાનોની સાથે દ્વેષ કરનારા છીએ” તે પણ સાચું જ  
કહ્યું છે; કેમકે વિષયોમાં લાગનારી ઈંદ્રિયો કે જેઓ બળવાન છે, તેઓની સાથે  
આપ નિરંતર દ્વેષ જ રાખો છો. અર્થાત્ તેવી ઈંદ્રિયોથી આપ ઓળખાતા નથી.  
આપે કહ્યું કે “અમો રાજ્યાસનનો ત્યાગ કરનારા છીએ” તે પણ સાચું જ કહેલું  
છે. કેમકે રાજ્યાસન ઘાટા અજ્ઞાનરૂપ જ છે, તેને આપના સેવકોએ પણ છોડી  
દીધેલું છે, ત્યારે આપ પોતે છોડી દો તેમાં તો શું કહેવું ? આપે કહ્યું કે “અમો  
અજ્ઞાણી રીતભાતવાળા છીએ” તે પણ સાચું જ કહ્યું છે. કેમકે હે પ્રભુ ! આપના  
ચરણકમળના રસને સેવનારા મુનિઓની રીતભાત પણ પણ જેવા માણસોના  
જાણવામાં આવતી નથી, ત્યારે આપની પોતાની રીતભાત તો અજ્ઞાણી જ હોય  
તેમાં શું કહેવું ? આપે કહ્યું કે “અમો લોકથી ન્યારા માર્ગવાળા છીએ” તે પણ  
સાચું જ કહ્યું છે. આપને સેવનારા મુનિઓનો માર્ગ પણ લોકોથી ન્યારો હોય છે.  
ત્યારે આપ કે જે ઈશ્વર જ છો, તેમનો પોતાનો માર્ગ લોકથી ન્યારો હોય તેમાં તો  
શું જ કહેવું ? આપે કહ્યું કે “અમો નિષ્કિંચન છીએ” તે પણ સાચું જ કહ્યું છે.  
કેમકે આપની પાસે કંઈ નથી, માટે આપ નિષ્કિંચન છો, એવું નથી, પણ આપને  
કંઈ પણ પ્રામ કરવા યોગ્ય નથી, આપ પૂર્ણકામ છો, માટે આપ નિષ્કિંચન છો.  
બીજાઓની પાસેથી પૂજા લેનારા બ્રહ્માદિક પણ આપને પૂજા અર્પણ કરે છે. આપે  
કહ્યું કે “અમો નિષ્કિંચન લોકોને પ્યારા અને તેઓની ઉપર પ્રીતિ રાખનારા છીએ”  
તે પણ સાચું જ કહ્યું છે, કેમકે નિષ્કિંચન એટલે જેઓને કંઈ પણ દેહાભિમાન  
નથી, એવા નારદાદિક બ્રહ્મવેતાઓને આપ પ્યારા છો અને તેઓ આપને પ્યારા  
છે. આપે કહ્યું કે “સમૃદ્ધિવાળા લોકો મને ભજતા નથી” તે પણ સાચું જ કહ્યું છે.  
કેમકે ધનવાનપણાના અભિમાનની આંધળા થયેલા લોકો કાળસ્વરૂપ એવા આપને

જાડ્યં વચ્ચસ્તવ ગદાગ્રજ ! યસ્તુ ભૂપાનું વિદ્રોહ્ય શાર્ઙ્ખનિનદેન જહર્થ માં ત્વમ् ।  
સિંહો યથા સ્વબલિમીશ ! પશૂનું સ્વભાગં તેભ્યો ભયાદ યદુર્ધિ શરારણ પ્રપન્ન : ॥૪૦॥

યદ્વાજ્જ્યા નૃપશિખામણ્યોઽઙ્ગવૈન્યજાયન્તનાહૃષગયાદય એકપત્યમ् ।  
રાજ્યં વિસૂજ્ય વિવિશુર્વનમભુજાક્ષ ! સીદન્તિ તેજું પદવીં ત ઇહાસ્થિતાઃ કિમ् ॥૪૧॥  
કાન્યં શ્રયેત તવ પાદસરોજગન્થમાદ્યા સન્મુખરિતં જનતાપરવર્ગમ् ।  
લક્ષ્મ્યાલયં ત્વવિગણાય ગુણાલયસ્ય મર્ત્યા સદોરુભયમર્થવિવિક્તદૃષ્ટઃ ॥૪૨॥

જાણતા નથી, તેથી તેઓ ઈંદ્રિયોને જ તૃમ કરે છે પણ આપને ભજતા નથી. આપે  
કહ્યું કે “ઉત્તમ અને અધમની વચ્ચે વિવાહ કે મૈત્રી યોગ્ય નથી” એ પણ સાચું જ  
કહ્યું છે, કેમકે આપ સર્વે પુરુષાર્થમય અને પરમાનંદ છો, એમ જાણી પરમાનંદની  
પ્રાપ્તિની ઈચ્છાથી જે બુદ્ધિમાન લોકો બીજા સર્વને છોડી દે છે, તેઓને જ આપનો  
સંબંધ યોગ્ય છે, પણ સુખદુઃખથી વ્યાકુળ અને પરસ્પર પ્રીતિની ગાંઠ બાંધી  
રહેલાં પામર સ્ત્રીપુરુષોને આપનો સંબંધ યોગ્ય નથી. ૩૫-૩૮ આપે કહ્યું કે “અમોને  
ભીખારીઓએ વખાણ્યા છે” તે પણ સાચું જ કહ્યું છે. કેમકે ભિખારીઓ એટલે  
સર્વને અભ્યદાન દઈને લિક્ષુક થયેલા મુનિલોકો આપના વખાણ કરે છે. અને  
વળી આપે કહ્યું કે “દૂંકા વિચારની તું આ બધું જાણ્યા વિના અમને વૃથા વરી છો”  
આ તમારું કહેવું ઠીક નથી. કેમ કે તમો જગતના અંતર્યામી છો. અને તમોને  
વરનારા પુરુષોને આપ પોતાની મૂર્તિ પર્યન્તનું ફણ આપનારા છો, આ બધું જાણીને  
હું આપને વરી છું. અને વળી તમારી ભૂકુટીથી પ્રેરાયેલા કાળના વેગે કરીને નાશ  
પામેલા છે લોકો અને ભોગો જેમના, એવા બ્રહ્માદિકોનો ત્યાગ કરીને હું તમોને  
વરી છું. તો બીજા શિશુપાલાદિકની વાત જ શું કરું ? (અર્થાત્ દીર્ઘ દાઢિથી વિચાર  
કરીને જ હું તમોને વરી છું, પણ વિચાર કર્યા વિના હું તમોને વરી નથી.) ૩૯ હે  
શ્રીકૃષ્ણ ! હે પ્રભુ ! સિંહ જેમ પશુઓને ભગાડીને પોતાનું ભક્ષ્ય લઈ જાય, તેમ  
તમે શારંગ ધનુષના નાદથી જરાસંધાદિક રાજાઓને ભગાડીને પોતાના ભાગરૂપ  
મને હરી લાવ્યા છો, માટે તેઓના ભયથી સમુક્રનું શરણ લેવાનું આપ જે કહો  
છો, તે આપનું વચ્ચન સાંભળનારા જનોને મોહ ઉત્પન્ન કરનારું છે. ૪૦ આપે કહ્યું  
કે “અમારે પનારે જેઓ પડેલા હોય તેઓ પીડાય છે, પણ તે વાત ખોટી છે; કેમકે  
બીજા રાજાઓના શિરોમણિ સરખા અંગ, પૃથુ, ભરત, યયાતિ અને ગય આદિ  
રાજાઓ પણ આપનું ભજન કરવાની ઈચ્છાથી પોતાના ચક્કવર્તી રાજ્યને છોડી

तं त्वानुस्तप्मभजं जगतामधीशमात्मानमत्र च परत्र च कामपूरम् ।  
स्यान्मे तवाद्विग्रहरणं सृतिभिर्भ्रमन्त्या यो वै भजन्तमुपयात्यनृतापवर्गः ॥४३॥  
तस्याः स्युरच्युत ! नृपा भवतोपदिष्टः स्त्रीणां गृहेषु खरगोश्विडालभृत्याः ।  
यत्कर्णमूलमरिकर्षण ! नोपयायाद् युष्मत्कथा मृडविरिञ्छसभासु गीता ॥४४॥  
त्वक्षमश्रुरोमनखकेशपिनद्वमन्तर्मासास्थिरकृमिविद्कफित्तिवातम् ।  
जीवच्छ्वं भजति कान्तमतिर्विमूढा या ते पदाब्जमकरन्दमजिघ्रती स्त्री ॥४५॥  
अस्त्वम्बुजाक्ष ! मम ते चरणानुराग आत्मन् रतस्य मयि चानतिरिक्तदृष्टेः ।  
यर्हस्य वृद्धय उपान्तरजोऽतिमात्रो मार्मीक्षसे तदु हनः परमानुकम्पा ॥४६॥

इह वनमां गया हता. माटे हे कमणी समान नेत्रवाणा ! आपने पनारे पडेला होय तेओ पीडाता नथी पण तमारा स्वरूपने पामे छे.<sup>४१</sup> कत्याशक्तारी गुणोना आश्रयरूप अने लोकोने मोक्षरूप तथा सत्पुरुषोचे वर्षाविल तमारा यरण कमणना सुंगंधने सूंधीने पट्ठी तेनो अनादर करीने कठ स्त्री धणा भयथी इबायेला अने मरणाशील बीजा पतिने वरे ? जेने माथे मोत होय अने जे पोताना साच्या स्वार्थमां यथार्थ समजती होय, ऐवी कोई पण स्त्री आपने छोडीने बीजा पतिने न वरे.<sup>४२</sup> अेटला माटे सर्वप्रकारे योग्य, जगतना स्वामी, आलोक तथा परलोकना सर्व मनोरथोने पूरनार अने पोताना आत्मारूप आपने ज हुं वरी छुं. (आम कहीने प्रार्थना करे छे.) अनेक अवतारोमां भटकती हुं मागुं छुं के आपनुं आ खोटा संसारनो नाश करनार यरणारविंद के जे भजनारा माणसने पोतानो करी ले छे, ते ज यरणारविंद सर्वे अवतारोमां मारुं शरण थजो.<sup>४३</sup> हे अच्युत ! हे शत्रुओनो नाश करनार ! तमोचे कहेला जे बीजा राजाओ, स्त्री जेमां प्रधान छे ऐवा धरोमां गधेडानी पेठे केवण भार उपाऊचा करे छे, बणदनी पेठे सर्वदा रङ्ग्या करे छे, कूतरानी पेठे हमेशां अपमान पाभ्या करे छे, मींदांनी पेठे गरीबडा थईने हिंसाओ कर्या करे छे, अने नोकरोनी पेठे ताबे दारी उठाव्या करे छे. आवा ए राजाओ, जेमना कानमां क्यारेय पण तमारी कथा आवेली नथी, ऐवी दुर्भागणी स्त्रीओना पति थाओ, पण मारा नहीं.<sup>४४</sup> तमारा यरणकमणना मकरंदने नहीं सूंधनारी जे स्त्री भूढ होय, ते स्त्री छवते मरेला माणसने आ पति छे ऐम मानीने भजे छे के जे माणस बहार चांभडी, दाढी, भूष्ण, रुवांडां, नभ अने वाणथी मढाएलो अने अंदर मांस, हाडकां, लोही, कीडा, विष्टा, कई,

नैवालीकमहं मन्ये वचसे मधुसूदन । अम्बाया इव हि प्रायः कन्यायाः स्याद् रतिः क्रचित् ४७ व्यूढायाश्वापि पुंश्चल्या मनोऽभ्येति नवं नवम् । बुधोऽसतीं न बिभृयात्तां बिभ्रदुभयच्युतः ४८  
श्रीभगवानुवाच

साध्येतच्छ्रेतुकामैस्त्वं राजपुत्रि! प्रलभ्मिता । मयोदितं यदन्वात्थ सर्वं तत् सत्यमेव हि ।४९  
यान् यान् कामयसे कामान् मन्यकामाय भामिनि! । सन्ति ह्येकान्तभक्तायासतव कल्याणि नित्यदा ।  
उपलब्धं पतिप्रेम पातिव्रतं च तेऽनघे ! । यद्वायैश्वाल्यमानाया न धीर्मव्यपकर्षिता ॥५१  
ये मां भजन्ति दाम्पत्ये तापसा व्रतवर्यया । कामात्मानोऽपवर्गेण भोहिता मम मायया ॥५२

पित अने वायुथी ज भरेलो होय छे.<sup>४५</sup> आपना कह्या प्रभाषे जो के आप कोईनी अपेक्षा वगरना अने मने पण उत्कृष्ट नहीं समजनारा छो, तोपण मने आपना यरणारविंदमां ज प्रेम रहेजो. केमके ए प्रेम ज मारा माटे खोटो लाभ छे. आ जगतनी वृद्धि करवा सारु रजोगुणनी भारे मात्रा लઈने कोई समये, हुं के जे मायारूप छुं तेनी सामुं जुओछो, ऐज मारा उपर खोटो अनुग्रह छे !<sup>४६</sup> हे मधुहृद्यत्यने मारनारा ! आपे हवे मने बीजा उपर प्रेम करवानुं कह्युं ते वातने हुं खोटी मानती नथी; केमके काशीराजानी अंबा, अंबालिका तथा अंबिका ए त्रायमांथी अंबा नामनी कुंवरीने कन्यावस्थामां ज जेम शाल्वराजा उपर प्रीति थई हती. तेम मने पण कन्यावस्थामां ज आपना उपर प्रीति थई हती, जेथी हुं मारा योग्य पति एवा आपने वरी छुं. अने कोई समये परण्या पट्ठी पण छिनाणवी स्त्रीनुं मन नवा नवा पुरुषमां लागी ज्य छे एवां धणां उदाहरण छे, परंतु मारी तो तमारामां ज प्रीति छे. (अर्थात् मारुं मन तमारा सिवाय क्यांय लाग्युं नथी.) विद्वान् पुरुषे व्यतिरिक्ती स्त्रीने धरमां राखवी न ज जोईअे; केमके ऐवी स्त्रीने राखनार पुरुष आलोक तथा परलोकमांथी पण भष्ट थाय छे.<sup>४७-४८</sup>

भगवान कहे छे हे पतिव्रता ! हे राजपुत्री ! तमारा भुव्यथी आवां वयन सांभणवानी ईश्वराथी में तमारी हांसी करी हती, मारां वयनोना तमे जे प्रत्युतर कह्या ते सर्वे साच्या ज छे.<sup>४९</sup> हे भामिनि ! जे जे मनोरथोने तमे ईश्वरो छो ते सर्वे मनोरथो तमने मारामां साची भक्ति होवाथी सर्वदा प्राम ज छे, अेटलुं ज नहीं पण हे कत्याशि ! ते कामो परिणामे कामनिवृत्तिने माटे ज होय छे. (अर्थात् कामनिवृत्तिपूर्वक भोक्षने ज आपनारा होय छे.)<sup>५०</sup> हे निर्दोष पति ! तमारो पति उपर प्रेम अने पतिव्रतापणुं पण सारी रीते जाणवामां आव्युं; केमके वयनो बोलीने तमने यलायमान करवा मांडयां, तोपण मारामां लागेली तमारी बुद्धि

मां प्राप्य मानिन्यपवर्गसम्पदं वाज्ञन्ति ये सम्पद एव तत्पतिम् ।  
ते मन्दभाग्या निरयेऽपि ये नृणां मात्रात्मकत्वान्निरयः सुसङ्गमः ॥५३॥

दिष्ट्या गृहेश्वर्यसकृन्मयि त्वया कृतानुवृत्तिर्भवमोचनी खलैः ।  
सुदुष्करासौ सुतरां दुराशिषो ह्यसुम्भराया निकृतिज्जुषः स्त्रियाः ॥५४॥

न त्वादूर्धीं प्रणयिनीं गृहिणीं गृहेषु पश्यामि मानिनि ! यथा स्वविवाहकाले ।  
प्रापान् नृपानवगणन्य रहोहरो मे प्रस्थापितो द्विज उपश्रुतसत्कथस्य ॥५५॥

भ्रातुर्विरुपकरणं युधि निर्जितस्य प्रोद्धाहपर्वणि च तद्वधमक्षगोच्छाम् ।  
दुःखं समुत्थमसहोऽस्मदयोगभीत्या नैवाब्रवीः किमपि तेन वर्णं जितास्ते ॥५६॥

दूतस्त्वयाऽऽत्मलभने सुविविक्तमन्तः प्रस्थापितो मयि चिरायति शून्यमेतत् ।  
मत्वा जिहास इदमङ्गमनन्ययोग्यं तिष्ठेत तत्त्वयि वर्णं प्रतिनन्दयामः ॥५७॥

बीजा विषयमां गृहं ज नहीं.<sup>५१</sup> मोक्षना स्वामी ऐवा भने जे विषयी लोको तप अने प्रतो पाणीने दंपती संबंधी सुखभोगने माटे ज भजे छे, तेओने मारी मायाथी मोह पामेला समज्वा.<sup>५२</sup> हे मानिनि ! मोक्षनी साथे संपत्तिनो स्वामी ऐवो जे हुं, ते भने प्रसन्न करी जे लोको संपत्तिरूप केवण विषय सुखने ज ईर्थे छे, पशा हुं के जे संपत्तिओनो स्वामी हुं तेने ईर्थता नथी, ते लोकोने मंदभाग्यवाणा ज ज्ञाशवा; केमें केविषयनां सुख तो माणसोने अति अधमयोनिमां पशा भणे छे अने विषय सुखमां चित रहेवाथी नरकनी ज प्राप्ति थाय छे.<sup>५३</sup> हे धरधाणीआणी ! संसारमांथी छोडावे ऐवी मारी निष्काम सेवा जे खण लोकोथी थई शके नहीं, ते तमे धाणीवार करी तेषो करीने भने महान आनंद थयो छे. दुष्ट स्वभाववाणी, दंत्रियोने ज तृम करनारी अने ठगाई करनारी स्त्रीथी आवी सेवा कटी पशा भनी शके नहीं.<sup>५४</sup> हे मानिनि ! निष्काम रहीने प्रेमथी ज मारी सेवा करनारी मारा धरमां धाणी स्त्रीओ छे, तोपशा तमारा जेवी प्रेमवाणी हुं कोईने देखतो नथी; तमे पोताना विवाह समयमां आवेला राजाओने तुच्छ गणीने केवण मारी क्रीति सांभणवा उपरथी ज थयेला प्रेमने लीधे, ब्राह्मणने गुम समाचार आपीने मारी पासे मोक्ष्यो हतो.<sup>५५</sup> तमारा भाईने युद्धमां ज्ञती लर्हने अमे विरुप कर्यो तथा अनिरुद्धना विवाहना उत्सवमां जुगारनी सभामां ए भाईने मारी नाख्यो, ते वातने समये समये मनमां याद आवतां, उत्पन्न थयेल दुःखने तमे अमारी साथे वियोग थवानी बीकथी सहन करी रह्यां छो अने कांઈ पशा बोल्यां नथी. तेथी तमोओ अमोने वश करी लीधा छे.<sup>५६</sup> मारी प्राप्ति माटे

श्रीशुक उवाच  
एवं सौरतसंलापैर्भगवाज्जगदीश्वरः । स्वरतो रमया रेमे नरलोकं विडम्बयन् ॥५८  
तथान्यासामपि विभुगृहेषु गृहवानिव । आस्थितो गृहमेधीयान् धर्माल्लोकगुरुर्हरिः ॥५९  
इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्दे उत्तरार्थं  
कृष्णरुक्मिणीसंवादो नाम षष्ठितमोऽध्यायः ॥६०॥

## अथ एकषष्ठितमोऽध्यायः

॥ श्रीशुक उवाच ॥

एकैकशस्ताः कृष्णस्य पुत्रान् दश दशाबलाः । अजीजननवमान्यितुः सर्वात्मसंपदा ॥१  
गृहादनपगं वीक्ष्य राजपत्रोऽच्युतं स्थितम् । प्रेष्टं न्यमंसत स्वं स्वं न तत्तत्त्वविदः स्त्रियः ॥२

तमे गुम विचारो आपीने दूत मोक्ष्यो हतो, तथा मारा आवी पहेंचवानो विलंब थतां आ जगतने शून्य मानी, बीजने योग्य नहीं अेवुं आ शरीर छोडी देवानी ईर्या करी हती, तेनो बदलो अमाराथी वाणी शकाय तेम नथी. अमो तो केवण वभाषा करी तमने अभिनन्दन आपीऐ छीऐ.<sup>५७</sup>

शुकदेवज्ञ कहे छे जगतना ईश्वर भगवान पोते आत्माराम छतां पशा मनुष्य लोकनी लीला करवा सारु, आवी रीतनी शृंगाररस संबंधी हांसीनी वातोथी लक्ष्मीज्ञना अवताररूप रुक्मिणीनी साथे रमता हता.<sup>५८</sup> लोकोना गुरु श्रीकृष्ण भगवान बीज स्त्रीओना धरमां पशा ऐवी ज रीते गृहस्थाश्रम संबंधी धर्माने अनुसरता हता.<sup>५९</sup>

इति श्रीमद् महापुराणा भागवतना दशम रक्षणो साठमो अद्याय संपूर्णः.

## अद्याय ६१

श्रीकृष्ण भगवानना पुत्रं पौत्रादिकनी कथा तथा धणभद्रे  
करेलो रुक्मिनो नाश.

शुकदेवज्ञ कहे छे भगवाननी ए सोणहजार एकसो आठ स्त्रीओए दरेके दश दश पुत्रोने जन्म आप्या. ते सर्वे पुत्रो पिताथी न्यून न हता.<sup>१</sup> भगवानना आत्मारामपशाने नहीं ज्ञानती ए भगवाननी पत्नी राजपुत्रीओ, भगवानने पोतपोताना धरमां रेहला अने धर छोडीने नहीं जता ज्ञेईने तेमने पोतपोताना

चार्वब्जकोशवदनायतबाहुनेत्रसप्रेमहासरसवीक्षितवल्लुजल्पैः।  
सम्मोहिता भगवतो न मनो विजेतुं स्वैर्विभ्रमैः समशक्न् वनिता विभूम्नः ॥३॥

स्मायावलोकलवदर्शितभावहारि भूमण्डलप्रहितसौरतमन्त्रशौण्डैः।  
पत्न्यस्तु षोडशसहस्रमनङ्गबाणैर्यस्येन्द्रियं विमथितुं करणैर्न शेकुः ॥४॥

इत्थं रमापतिमवाप्य पतिं स्त्रियस्ता ब्रह्मादयोऽपि न विदुः पदवीं यदीयाम् ।  
भेर्जुर्मुदाविरतमेधितयानुरागहासावलोकनवसङ्गमलालसाद्यम् ॥५॥

प्रत्युद्गमासनवराहणपादशौचताम्बूलविश्रमणवीजनगाध्माल्यैः।  
केशप्रसारशयनस्वपनोपहैर्दीसीशता अपि विभोर्विवद्धुः स्म दास्यम् ॥६॥

तासां या दशपुत्राणां कृष्णस्त्रीणां पुरोदिताः। अष्टौ महिष्यस्तत्पुत्रान् प्रद्युम्नादीन् गृणामि ते ७  
चारुदेष्णः सुदेष्णश्च चारुदेहश्च वीर्यवान् । सुचारुश्चारुगुमश्च भद्रचारुस्तथापरः ॥८  
चारुचन्द्रो विचारुश्च चारुश्च दशमो हरे:। प्रद्युम्नप्रमुखा जाता रुक्मिण्यां नावमाः पितुः ९

४ प्यारा मानती हती.<sup>२</sup> भगवाननुं सुंदर कमण्ना कोश जेवुं मुख, लांबा हाथ  
तथा नेत्र द्वारा प्रेम सहित हास्यरसस्थी युक्त, भधुर दृष्टि अने मनोहर भाषणोंथी  
मोह पामेली ए स्त्रीओ पोताना अनेक विलासोथी भगवानना मननुं हरण  
करवाने समर्थ थती न हती.<sup>३</sup> गूढ हास्ययुक्त कटाक्षथी सूचवेला अभिप्रायने  
लीधे, मननुं हरण करनार भूकुटीना मंडणथी योजेला रतिकीडाना मंत्रो तेने विषे  
प्रवीण एवां कामदेवनां बाणोथी अने बीजा पशा कामशाखमां प्रसिद्ध उपायोथी  
भगवानना मनने वश करवामां ए स्त्रीओ सोणहजार एक्सो अने आठ हती  
छतां पशा समर्थ थती न हती.<sup>४</sup> ब्रह्मादिक पशा जेमनी पदवीने जाणता नथी,  
एवा ए लक्ष्मीना पति भगवानने पति तरीके पामीने ए स्त्रीओ निरंतर वृद्धि  
पामती प्रीतिथी, आ प्रमाणे स्नेह सहित हास्य कटाक्ष अने नवीन संगममां  
उत्सुक्पशुं, ईत्यादिक विहारो करती हती.<sup>५</sup> जो के प्रत्येकनी पासे सेंकडो दासीओ  
हती तोपशा सामे जवुं, आसन देवुं, सुंदर पूजन करवुं, पग धोवा, पानबीडी  
देवी, पग चांपवा, पंखा नाखवा, चंदन पुष्प देवां, केश स्वर्ण<sup>६</sup> कराववा,  
सुवडाववा, नवराववा अने भोजन देवुं एवा एवा एवा उपयारोथी ते स्त्रीओ  
भगवाननी पासे दासीपशुं करती हती.<sup>६</sup> दश दश दीकरावाणी ए भगवाननी  
स्त्रीओमां जे आठ पटराणीओ कहेली छे, तेओना पुत्र प्रद्युम्नादिकनां नाम हुं  
तमारी पासे कहुं छुं.<sup>७</sup> भगवानने रुक्मिणीमां प्रद्युम्न, यारुदेष्ण, सुदेष्ण,  
यारुदेह, सुचारु, यारुगुम, भद्रयारु, यारुचंद्र, विचारु अने चारु, ए दश पुत्रो

भानुः सुभानुः स्वर्भानुः प्रभानुर्भानुमांस्तथा । चन्द्रभानुर्बृहद्बानुरतिभानुस्तथाष्टमः ॥१०  
श्रीभानुः प्रतिभानुश्च सत्यभामात्मजा दश । साम्बः सुमित्रः पुरुजिच्छतजिच्छ सहस्रजित् ॥१  
विजयश्चित्रकेतुश्च वसुमान् द्रविडः क्रतुः । जाम्बवत्या: सुता ह्येते साम्बाद्या: पितृसमता: १२  
वीरश्चन्द्रोऽश्वेनश्च चित्रगुर्वेगवान् वृषः । आमः शङ्कुर्वसुः श्रीमान् कुन्तिनार्गनजितेः सुता: १३  
श्रुतः कविवृषो वीरः सुबाहुर्भद्र एकलः । शान्तिर्दर्शः पूर्णमासः कालिन्द्याः सोमकोऽवरः १४  
प्रधोषो गात्रवान् सिंहो बलः प्रबल उर्ध्वगः । माद्रायाः पुत्रा महाशक्तिः सह ओजोऽपराजितः १५  
वृको हर्षोऽनिलोगृथो वर्धनोऽन्नाद एव च । महाशः पावनो वर्ह्मित्रविन्दात्मजाः क्षुधिः १६  
सङ्ग्रामजिद् बृहत्सेनः शूरः प्रहरणोऽरिजित् । जयः सुभद्रो भद्राया वाम आयुश्च सत्यकः १७  
दीसिमांस्ताप्तसाद्या रोहिण्यास्तनया हरे: । प्रद्युम्नाच्चानिरुद्धोऽभूद् रुक्मवत्यां महाबलः १८  
पुत्रां तु रुक्मिणो राजन्! नामा भोजकटे पुरे । एतेषां पुत्रपौत्राश्च बभूवुः कोटिशो नृप ! ।  
मातरः कृष्णजातानां सहस्राणि च षोडश ॥१९  
राजोवाच

कथं रुक्म्यरिपुत्राय प्रादाद् दुहितरं युधि । कृष्णेन परिभूतस्तं हन्तुं रन्धं प्रतीक्षते ।  
एतदाख्याहि मे विद्वन् ! द्विषोर्वैवाहिकं मिथः ॥२०

थया हता के जेओ पिताथी न्यून न हता.<sup>८</sup> हवे सत्यभामाना पुत्रोनां नाम कहुं  
छुं. भानु, सुभानु, स्वर्भानु, प्रभानु, भानुमान, यंद्रभानु, बृहद्बानु, रतिभानु,  
श्रीभानु, अने प्रतिभानु, हवे जंबवतीना पुत्रोनां नाम कहुं छुं. सांब, सुमित्र,  
पुरुजित, शतजित, सहज्ञजित, विजय, चित्रकेतु, वसुमान, द्रविड, अने क्रतु.<sup>९</sup>  
१२ वीर, यंद्र, अश्वेन, चित्रगु, वेगवान, वृष, आम, शंकु, वसु, अने कुन्ति, ए  
दश नानजितीना पुत्रो हता.<sup>१३</sup> हवे कालिंदीना पुत्रोनां नाम कहुं छुं. श्रुत, कवि,  
वृष, वीर, सुबाहु, भद्र, शांत, दर्श, पूर्णमास अने सोमक.<sup>१४</sup> प्रधोष, गात्रवान,  
सिंह, बल, प्रबल, उर्ध्वग, महाशक्ति, सह, ओज अने अपराजित आ दश  
लक्ष्मणाना पुत्रो हता.<sup>१५</sup> वृक, हर्ष, अनिल, गृध्र, वर्धन, अश्राद, महाश, पावन,  
वक्षि अने क्षुधि ए दश भित्रविंदाना पुत्रो हता.<sup>१६</sup> संग्रामजित, बृहत्सेन, शूर,  
प्रहरण, अरिजित, जय, सुभद्र, वाम, आयु अने सत्यक ए दश भद्राना पुत्रो  
हता.<sup>१७</sup> भगवानने सोणहजार अने एक्सो स्त्रीओने मध्ये गुणो करीने मोटी  
रोहिणीमां, दिमान अने ताम्रतम आहि पुत्रो थया हता. हे राजा ! भोजकट  
नामना पुरमां रहेला रुक्मीनी कुंवरी रुक्मवतीने प्रद्युम्न परण्या हता, ते  
रुक्मवतीमां प्रद्युम्नने महा बणवान अनिरुद्ध नामे पुत्र थयो हतो. श्रीकृष्णाना  
बीजा पुत्रो अने पौत्रो करोडो थया हता. श्रीकृष्णानी सोणहजार एक्सो अने

અનાગતમતીતં ચ વર્તમાનમતીન્દ્રિયમ् । વિપ્રકૃષ્ટ વ્યવહિતં સમ્યક् પશ્યન્તિ યોગિનઃ ॥૨૧

શ્રીશુક ઉવાચ

વૃત્તઃ સ્વયંવરે સાક્ષાદનઙ્ગોઽજ્ઞયુતસ્યા । રાજ્ઞઃ સમેતાન् નિર્જિત્ય જહારૈકરથો યુધિ ॥૨૨  
યદ્યાય્યનુસ્મરન् વૈરં રૂક્મી કૃષ્ણાવમાનિતઃ । વ્યતરદ્ ભાગિનેયાય સુતાં કુર્વન્ સ્વસુઃ પ્રિયમ् ॥  
રૂક્મિણ્યાસ્તનયાં રાજન् ! કૃતવર્મસુતો બલી । ઉપયેમે વિશાળાક્ષી કન્યાં ચારુમતી કિલ ૨૪  
દૌહિત્રાયાનિરુદ્ધાય પૌત્રી રૂક્મયદદાદ્રરે: । રોચનાં બદ્ધવૈરોઽપિ સ્વસુઃ પ્રિયચિકીર્ષયા ।

જાનન્ત્રધર્મ તદ્ યૌનં સ્વેહપાશાનુબન્ધનઃ ॥૨૫

તસ્મિન્નભ્યુદ્યે રાજન् ! રૂક્મિણી રામકેશવૌ । પુરું ભોજકટં જગમુઃ સામ્બપ્રદ્યુમ્નકાદય: ૨૬  
તસ્મિન્ નિવૃત્ત ઉદ્ધારે કાલિઙ્ગપ્રમુખા નૃપા: । દૂસાસે રૂક્મિણં પ્રોચુર્બલમક્ષેવિન્રિય ॥૨૭  
અનક્ષણો હૃદયં રાજન્નયિ તદ્વ્યસનં મહત્ । ઇત્યુક્તો બલમાહૂય તેનાક્ષી રૂક્મયદીવ્યત ॥૨૮

આઠ પત્નીઓ હતી તેથી સંતતિ પણ ધણી જ થઈ. ૧૮-૧૯ પરીક્ષિત રાજા પૂછે છે  
જે રૂક્મી શ્રીકૃષ્ણના હાથથી યુદ્ધમાં પરાભવ પામવાને લીધે શ્રીકૃષ્ણને મારવાનો  
જ લાગ જોતો હતો, તેણે પોતાના શત્રુ શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નને પોતાની દીકરી  
કેમ આપી ? હે સર્વજ્ઞ ! શત્રુઓને પરસ્પર વેવાઈનો સંબંધ થયો તેનું કારણ  
કહો. ૨૦ રૂક્મીનો અભિપ્રાય તમારાથી અજ્ઞાયો ન હોવો જોઈએ; કેમકે જે વસ્તુ  
ભૂત, ભવિષ્ય, વર્તમાન, ઈદ્રિયોથી ન જાણી શકાય. એવી દૂર કે વ્યવધાનવાળી  
હોય તેને પણ યોગીઓ સારી રીતે જાણી શકે છે. ૨૧

શુક્ટેવજી કહે છે પ્રદ્યુમ્ન સાક્ષાત્ કામદેવના અવતારરૂપ હતા, તેમને  
સ્વયંવરમાં રૂક્મવતી વરતાં તેમણે પોતાના એક રથથી, ત્યાં ભેણા થયેલા  
રાજાઓને યુદ્ધમાં જીતી લઈને રૂક્મવતીનું હરણ કર્યું હતું. ૨૨ ભગવાને અપમાન  
કરેલા રૂક્મીને વેર સાંભરતું હતું, તોપણ તેણે પોતાની બહેન રૂક્મિણીને રાજી  
રાખવા સારુ પોતાના ભાણેજને કન્યા આપવામાં વાંધો લીધો ન હતો. ૨૩ હે રાજા !  
રૂક્મિણીની કુંવરી મોટાં નેત્રવાળી ચારુમતી નામની કન્યાને બળવાન કૃતવર્માનો  
દીકરો પરણ્યો હતો. ૨૪ રૂક્મીએ ભગવાનની સાથે વૈર બાંધ્યું હતું, તોપણ  
ભગવાનના પૌત્ર અનિરુદ્ધને પોતાની પૌત્રી રોચના આપી હતી. જો કે શત્રુની  
સાથે સંબંધ કરવો અયોગ્ય છે, એમ પોતે જાણતો હતો તોપણ સ્નેહરૂપી પાશથી  
બંધાઈને પોતાની બેનને સારુ લગાડવા માટે એ કામ પણ રૂક્મીએ કર્યું. ૨૫ હે  
રાજા ! એ અનિરુદ્ધના વિવાહના ઉત્સવમાં રૂક્મિણી, બળભદ્ર, ભગવાન, શાંબ  
અને પ્રદ્યુમ્ન આદિ યાદવો ભોજકટપુરમાં ગયા હતા. ૨૬ એ વિવાહની કિયા સંપૂર્ણ

શતં સહસ્રમયુતં રામસ્તત્રાદ્વા પણમ् । તં તુ રૂક્મયજયત્ તત્ કાલિઙ્ગ: પ્રાહસદ્ બલમ् ।

દન્તાન્ સન્દર્શયન્નચૈર્નામૃષ્યત્ તદ્ભ્લાયુધઃ ॥૨૯

તતો લક્ષ્યં રૂક્મયગૃહાદ્ ગલહં તત્ત્રાયદ્ બલઃ । જિત્વાનહમિત્યાહ રૂક્મી કૈતવમાશ્રિતઃ ॥૩૦

મન્યુના ક્ષુભિતઃ શ્રીમાન્ સમુદ્ર ઇવ પર્વણિ । જાત્યારુણાક્ષોરતિરૂપા ન્યબું ગલહમાદ્વા ॥૩૧

તં ચાપિ જિતવાન્ રામો ધર્મણચ્છલમાશ્રિતઃ । રૂક્મી જિત મયાત્રેમે વદનું પ્રાશિન્કા ઇત્તિ ૩૨

તદાબ્રવીન્નભોવાણી બલેનૈવ જિતો ગલહઃ । ધર્મતો વચનેનૈવ રૂક્મી વદતિ વૈ મૃષા ॥૩૩

તામાન્દૃત્ય વૈદર્ભો દુષ્ટાયન્યચોદિતઃ । સઙ્ક્રાંતં પરિહસન્ બભાષે કાલચોદિતઃ ॥૩૪

નૈવાક્ષકોવિવા યૂયં ગોપાલા વનગોચરા: । અંક્રેર્દીવ્યત્તિ રાજાનો બાળૈશ ન ભવાદૂશા: ૩૫

રૂક્મિણેવમધિક્ષિસો રાજભિશ્શોપહાસિતઃ । ક્રુદ્ધ: પરિઘમુદ્યાય જાણે તં ન્યમાસંસદિ ॥૩૬

કાલિઙ્ગરાજં તરસા ગૃહીત્વા દશમે પદે । દન્તાનપાતયત્ ક્રુદ્ધો યોજહસદ્ વિવૃતૈર્દ્વિજૈ: ॥૩૭

અન્યે નિર્ભિન્નબાહૂરુશિરસો રૂધિરોક્ષિતા: । રાજાનો દુદ્વુર્ભીતા બલેન પરિધાર્દિતા: ॥૩૮

થયા પણી અભિમાની કાલિંગ આદિ રાજાઓ રૂક્મીને કહું કે જુગારમાં બળભદ્રને

જીતીલે. ૨૭ બલરામને પાસા નાખવાનું જ્ઞાન નથી, તોપણ તે વાતનું ભારે વ્યસન

છે, આ પ્રમાણે રાજાઓના કહેવાથી બળદેવજીને બોલાવી તેમની સાથે રૂક્મી

જુગાર રમવા લાગ્યો. ૨૮ એ પ્રસંગમાં બળભદ્ર સો, હજાર અને દશહજારનો

દાવ મુક્યો, તેમાં રૂક્મી જીત્યો. એટલે કાલિંગ રાજાએ દાંત દેખાડીને બળદેવની

જિંયા સાદથી હાંસી કરી, તે બળદેવજીથી સહન ન થયું. ૨૯ પણી રૂક્મીએ

એકલાખનો દાવ માંડયો. તેમાં બળભદ્ર જીત્યા તોપણ કપટથી રૂક્મીએ કહું કે

હું જીત્યો. ૩૦ સમુદ્ર જેમ પુનમમાં ક્ષોભ પામે તેમ કોધથી ક્ષોભ પામેલા અને

જેમના જન્મથી રાતાં નેત્ર કોધથી અત્યંત રાતાં થઈ ગયાં એવા બળદેવજી

દશકરોડનો દાવ માંડયો.. ૩૧ એ રમતમાં પણ ધર્મની રીતે બળદેવજી જીત્યા,

તોપણ છળ ધરાવનારો રૂક્મી બોલ્યો કે હું જીત્યો છું. આ વિષયમાં આ સમાસદો

કહેશે. ૩૨ એ સમયમાં આકાશવાણી બોલી કે “આ દાવમાં બળદેવજી જ ધર્મની

રીતે જીત્યા છે. અને રૂક્મી તો કેવળ વચનથી ખોટું બોલે છે” . ૩૩ દુષ્ટ રાજાઓએ

પ્રેરેલો અને જેનું મોત સમીપે આવ્યું હતું, એવો રૂક્મી આકાશવાણીનો અનાદર

કરી બળદેવજીની હાંસી કરતાં બોલ્યો કે તમો વનમાં ફરનારા ગોવાળો પાસાની

રમતમાં જાણો જ નહીં. રાજાઓ જ પાસાઓથી અને બાણોથી રમી જાણો પણ

તમ જેવા ન જાણો. ૩૪-૩૫ આ પ્રમાણે રૂક્મીએ તિરસ્કાર કરતાં અને રાજાઓએ

ઉપહાસ કરતાં કોધ પામેલા બળદેવજીએ, માંગલિક સભામાં ભોગળ ઉપાડીને

निहते रुक्मिणि श्याले नाब्रवीत् साध्वसाधु वा । रुक्मिणीबलयो राजन् स्वेभङ्गभयाद्वरिः ३९  
ततोऽनिरुद्धं सह सूर्यया वरं रथं समारोप्य ययुः कुशस्थलीम् ।

रामादयो भोजकटाद्वार्हा: सिद्धाखिलार्थं मधुसूदनाश्रयाः ॥४०॥

इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे उत्तरार्थं  
अनिरुद्धविवाहे रुक्मिवधो नामैकषष्टिमोऽध्यायः ॥६९॥

### अथ द्विषष्टिमोऽध्यायः (६२)

॥ राजोवाच ॥

बाणस्य तनयामूषामुपयेमे यदूत्तमः । तत्र युद्धमभूद्धोरं हरिशंकरयोर्महत् ।  
एतत् सर्वं महायोगिन् ! सपाख्यातुं त्वमर्हसि ॥१

श्रीशुक उवाच

बाणः पुत्रशतज्येष्ठे बलेरासीन्महात्मनः । येन वामनस्तपाय हरयेऽदायि मेदिनी ॥२  
रुक्मीने मारी नाष्यो ॥३६ क्लिंगं देशनो राजा भागवा लागतां तेने दशमे पगले  
पकडी लઈने, कोधथी तेना दांतं पाडी नाष्या कारणे के ते राजा दांतं उघाडा करीने  
हस्यो हतो ॥३७ बलरामे भोगणथी ताडन करेला, लोहीथी भरडाअेला अने  
जेओनां सर्वे अंगो भांगी पड़यां हतां, ऐवा बीजा राजाओ बीकथी भागी गया ॥३८  
हे राजा ! श्रीकृष्ण भगवान् पोतानो साणो रुक्मी भरणे पामतां रुक्मिणी अने  
भण्डेवज्ञनी साथे स्नेह तूटी जवानी बीकथी सारुं के नरसुं कंठ पशं बोत्या  
नहीं ॥३९ पछी भगवानना आश्रयने लीधे जेओना सर्वे मनोरथो पूर्ण थया छे.  
ऐवा बण्डम आदि यादवो अनिरुद्धने ए नवी परणेली वहुनी साथे रथमां  
बेसाडीने भोजकटपुरथी द्वारकामां गया ॥४०

इति श्रीमद्भापुराणा भागवतना दशम स्कन्धना अक्षराय संपूर्ण ॥

अध्याय ६२

उषा साथे रभात्रा करवाथी अनिरुद्धने यात्रासुरे केउ कर्यो ॥

परीक्षित राजा पूछे हे हे मोटा योगी ! बाणासुरनी दीकरी उषाने अनिरुद्ध  
परण्या हता, ते प्रसंगमां श्रीकृष्ण अने सदाशिवने मोटुं अने भयंकर युद्ध थयुं  
हतुं ॥ ए सर्वे वात आप कहेवाने योग्य छो ॥

शुक्देवज्ञ कहे हे हे राजा ! बणिराजना सो पुत्रोमां बाणासुर मोटो पुत्र

तस्यौरसः सुतो बाणः शिवभक्तिरतः सदा । मान्यो वदान्यो धीमांश्च सत्यसम्भो दृढव्रतः ॥३  
शोणिताख्ये पुरे रम्ये स राज्यमकरोत् पुरा । तस्य शम्भोः प्रसादेन किङ्करा इव तेऽमराः ।

सहस्रबाहुवर्द्येन ताण्डवेऽतोषयन्मृडम् ॥४

भगवान् सर्वभूतेशः शारण्यो भक्तवत्सलः । वरेणच्छन्दयामास स तं वके पुराधिपम् ॥५  
स एकदाऽऽह गिरिं पार्श्वस्थं वीर्यदुर्मदः । किरीटेनार्कवर्णेन संस्पृशंसंत्यदाम्बुजम् ॥६  
नमस्ये त्वां महादेव ! लोकानां गुरुमीश्वरम् । पुंसामपूर्णकामानां कामपूरामाराङ्गपम् ॥७  
दोः सहस्रं त्वया दत्तं परं भाराय मेऽभवत् । त्रिलोक्यां प्रतियोद्धारं न लभे त्वदृते समम् ॥८  
कण्डूत्या निभृतैर्दर्भिर्युर्युत्सुर्दिग्जगजानहम् । आद्यायां चूर्णयन्नद्रीन् भीतास्तेऽपि प्रदुद्रुवुः ॥९  
तच्छुत्वा भगवान् क्रुद्धः केतुसे भज्यते यदा । त्वहर्पञ्चं भवेन्मूढ ! संयुगं मत्समेन ते ॥१०  
इत्युक्तः कुमतिर्हष्टः स्वगृहं प्राविशन्नृप ! । प्रतीक्षन् गिरिशादेशं स्ववीर्यनशनं कुर्धीः ॥११

हतो ॥ के जे बणिराजाए वामनरूप धरी आवेला विष्णुने पृथ्वीनुं दान दीधुं हतुं ॥२

अे बणिराजानो औरस पुत्र बाणासुर निरंतर सदाशिवनी भक्तिमां लागेलो,  
मान देवा योग्य, उदार, बुद्धिमान, साची प्रतिज्ञावाणो अने दृढ नियमवाणो  
हतो ॥३ अे बाणासुर पूर्वं शोणितपुरमां राज्य करतो हतो ॥ सदाशिवनी दृपाथी  
देवताओ तेनी पासे किंकर जेवा थई रव्या हता ॥ हजार हाथवाणा ए बाणासुरे  
तांडव करीने महादेवने प्रसन्न कर्या हता ॥४ सर्वप्राणीओना स्वामी, शरणे जवा  
योग्य अने भक्तवत्सल शंकरे बाणासुरने ईर्जित वर मागवानुं कहेतां “तमारे  
मारा पुरनुं पालन करवामां रहेवुं” ऐवुं मार्युं हतुं ॥५ पराक्षमी छकेला बाणासुरे  
एक दिवस पोतानी पासे रहेला शिवने पोताना सूर्य सरभा तेजस्वी मुकुटथी  
तेमना यरणारविंदनो स्पर्श करीने कह्युं के हे महादेव ! जे आप लोकोना गुरु,  
ईश्वर अने जेनी कामना पूरी थई नथी ऐवा पुरुषोनी कामनाने पूर्ण करवामां  
कल्पवृक्ष समान छो, ते आपने हुं प्रणाम करुं छुं ॥६७ आपे मने हजार हाथ  
आपेला छे, परंतु तेओ मने भारतरूप थई पक्ष्या छे; कारणे के त्रिलोकीमां एक  
तमारा विना बीजो कोई मारी समान अने मारी सामे लडनार मने मणतो नथी ॥८  
हे आदिपुरुष ! हस्तोमां खंजवाण आवतां हुं युद्ध करवानी ईर्याथी पर्वतोने  
यूर्ण करी नाखता दिशाओना हाथीओनी पासे गयो, त्यारे तेओ मारी बीकथी  
भागी गया ॥९ आवां वयन सांभणी कोध पामेला शिवे कह्युं के हे मूढ ! ज्यारे  
तारी धज्ञा भांगशे त्यारे तने तारो गर्व उतारी नाखे ऐवुं युद्ध मणशे ॥१० हे राजा !  
आ प्रमाणे शिवनुं वयन सांभणी राज थयेलो दुर्भाग्य भाणासुर पोताने धेर

तस्योषा नाम दुहिता स्वने प्राद्युम्निना रतिम् । कन्यालभत कान्तेन प्रागदृष्टश्रुतेन सा ॥१२  
सा तत्र तमपश्यन्ती क्रासि कान्तेति वादिनी । सखीनां मध्य उत्तस्थौ विह्वला ब्रीडिता भृशम् ॥१३  
बाणस्य मन्त्री कुम्भाण्डश्चित्रलेखा च तत्सुता । सख्यपृच्छत् सखीमूषां कौतूहलसमन्विता ॥१४  
कं त्वं मृगयसे सुधूः कीदृशस्ते मनोरथः । हस्तग्राहं न तेऽद्यापि राजपुत्रुपलक्षये ॥१५

अषोवाच

दृष्टः कश्चिन्नरः स्वने इयामः कमललोचनः । पीतवासा बृहद्वाहुर्योषितां हृदयङ्गमः ॥१६  
तमहं मृगये कान्तं पाययित्वाधरं मधु । क्रापि यातः स्पृहयतीं क्षिप्त्वा मां वृजिनार्णवे ॥१७

चित्रलेखोवाच

व्यसनं तेऽपकर्षामि त्रिलोक्यां यदि भाव्यते । तमानेष्ये नरं यस्ते मनोहर्ता तमादिश ॥१८  
इत्युक्त्वा देवगन्धर्वसिद्धचारणपन्नगान् । दैत्यविद्याधरान् यक्षान् मनुजांश्च यथालिखत् ॥१९  
मनुजेषु च सा वृष्णीन् शूरमानकदुन्दुभिम् । व्यलिखद् रामकृष्णो च प्रद्युम्नं वीक्ष्य लज्जिता २०

गयो, अने कुबुद्धिपञ्चाथी पोताना पराक्रमनो नाश करनार शिवज्ञनुं वयन सझण  
थवानी वाट ज्ञेवा लाय्यो.<sup>११</sup> ए बाणासुरनी उषा नामनी कुंवारी दीकरी हती,  
तेने रूपाणा अनिरुद्ध के जेने पूर्वे दीठा के सांभण्या पश्च न हता, तेमनी साथे  
स्वप्रमां समागम थयो.<sup>१२</sup> पछी स्वप्रमांज तेमने नहीं देखतां ते उषा “हे पति !  
क्यां छो” ऐम बोलती उठी अने सभीओना मध्यमां विहृण थईने बहु ज  
लज्जाई गई.<sup>१३</sup> कुभांड नामे बाणासुरनो मंत्री हतो तेमनी दीकरी चित्रलेखा के जे  
उषानी सभी थती हती, तेषो कौतुकने लीधे पोतानी सभी उषाने पूछ्युं के हे  
सुंदरी ! हे राजकुमारी ! तुं कोने शोधे छे ? तारो केवो मनोरथ छे ? हजु सुधी  
तारं पाणिगहण करनार कोई भारा ज्ञाणवामां नथी.<sup>१४-१५</sup>

उषाए कहुं के श्याम कमण सरभां नेत्रवाणो, पीणां वस्त्रवाणो, मोटा  
हाथवाणो अने स्त्रीओना मनने गमे एवो कोई नर भारा स्वप्रमां ज्ञेवामां  
आय्यो.<sup>१६</sup> ए नर मने प्रथम पोतानुं अधरामृत पाईने पछी मने हुः भना समुद्रमां  
नाभी दृष्टे क्यांय जतो रह्यो छे, ते प्याराने हुं शोधुं छुं.<sup>१७</sup>

चित्रलेखाए कहुं के तारं हुः भ हुं भटाडी दउं छुं. जेषो तारा मननुं हरण  
कर्युं छे ते ज्ञेत्रिलोकीमां हशे तो तेने हुं लावी आपीश, माटे मने ओणभाव.<sup>१८</sup>

शुकदेवज्ञ कहे छे आ प्रभाणे भोलीने ते चित्रलेखाए वस्त्रमां देव, गंधव,  
सिद्ध, चारण, नाग, दैत्य, विद्याधर, यक्षो अने मनुष्योने यथार्थ रीते आलेख्या.<sup>१९</sup>  
मनुष्योमां तेषो शूर, वसुदेव, भणदेवज्ञ, श्रीकृष्ण अने पद्युम्नने आलेख्या,

अनिरुद्धं विलिखितं विक्ष्योषावाङ्मुखी ह्रिया । सोऽसावसाविति प्राह स्मयमाना महीपते!<sup>२१</sup>  
चित्रलेखा तमाज्ञाय पौत्रं कृष्णस्य योगिनी । ययौ विहायसा राजन् ! द्वारकां कृष्णपालिताम् ॥२२  
तत्र सुम् सुपर्यङ्के प्राद्युम्न योगमास्थिता । गृहीत्वा शोणितपुरं सख्यै प्रियमदर्शयत् ॥२३  
सा च तं सुन्दरवरं विलोक्य मुदितानना । दुष्प्रेक्ष्ये स्वगृहे पुम्भी रेमे प्राद्युम्निना समम् ॥२४  
परार्घवासः स्वगन्धधूपदीपासनादिभिः । पानभोजनभक्ष्यै वाक्यैः शुश्रूषार्याचितः ॥२५  
गूढः कन्यापुरे शश्वत्प्रवृद्धस्नेहया तया । नार्हगणान् स बुबुधे ऊघयापहतेन्द्रियः ॥२६  
तां तथा यदुवीरेण भुज्यमानां हतवताम् । हेतुभिर्लक्ष्याङ्गक्रुत्राप्रीतां दुरवच्छैः ॥२७  
भटा आवेदयाङ्गक्रुत्राप्रीतां दुहितुर्वयम् । विवेष्टितं लक्ष्यामः कन्यायाः कुलदूषणम् ॥२८  
अनपायिभिरस्माभिर्गुम्याश्च गृहे प्रभो ! कन्याया दूषणं पुम्भिर्दुष्प्रेक्षाया न विचाहे ॥२९  
ततः प्रव्यथितो बाणो दुहितः श्रुतदूषणः । त्वरितः कन्यकागारं प्रासोऽद्राक्षीद् यदूद्धरम् ॥३०  
कामात्मजं तं भुवनैकसुन्दरं श्यामं पिशङ्गाम्बरमध्युजेक्षणम् ॥३१॥

पद्युम्नने ज्ञेईने ते उषा लज्जाई गई.<sup>२०</sup> हे राजा ! पछी अनिरुद्धने आलेखेला  
ज्ञेई हसती उषाए लाजथी नीचुं मुख करीने “ते आ, ते आ” ऐम कहुं.<sup>२१</sup>  
पोगवाणी चित्रलेखा तेमने श्रीकृष्णना पौत्र ज्ञाणीने आकाश मार्गथी श्रीकृष्णो  
पाणेली द्वारकामां गई.<sup>२२</sup> चित्रलेखाए द्वारकामां सारा पलंगपर सूतेला पोतानी  
सभीना प्रिय अनिरुद्धने, योगना प्रभावथी उपाडी, शोणितपुरमां जईने पोतानी  
सभीने देखाइया.<sup>२३</sup> ते सुन्दर अनिरुद्धने ज्ञेई जेनुं मुख प्रकुलित थयुं छे. एवी  
ए उषा पुरुषोथी ज्ञेई शकाय नहीं एवा पोताना धरमां तेमनी साथे २माण  
करवा लागी.<sup>२४</sup> अभूत्य वस्त्र, माणा, सुगंध, धूप, दीप, पान, भोजन, भक्ष्य  
अने आसनादिक आपीने सारा वयन पूर्वक सेवाथी पूजेला, कन्याना अंतः पुरमां  
गुप्त रहेला अने जेने स्नेह वध्यो छे, एवी उषाए भोउ पमाडी दीधेला अनिरुद्धने  
धणा दिवसो नीकी गया तेनी खबर पडी नहीं.<sup>२५-२६</sup> आ प्रभाणे अनिरुद्ध  
द्वारा भोगवाती अने राजु थयेली उषाने योकीवाणाओ छानां राखी शकाय  
नहीं, एवां चित्तोथी व्रतभंग थयेली (अर्थात् गर्भ रह्यो) ज्ञाणी लीधी.<sup>२७</sup> पछी  
ते योकीदारो बाणासुरनी पासे वात करी के हे राजा ! तमारी कुंवारी कन्या कुणने  
कलंक लगाए एवी अभारा ज्ञेवामां आवी छे.<sup>२८</sup> हे स्वामी ! अमो सावधानपणाथी  
धरनी योकी करीए छीए अने पुरुषो ते कन्याने ज्ञेई पश्च शके तेम नथी; छतां  
ए कन्याने दूषण क्यांथी आव्युं ? ए अमो ज्ञाता नथी.<sup>२९</sup> पछी दीकरीना दूषणनी

दीव्यन्तमक्षेः प्रिययाभिनृष्णाया तदङ्गसङ्गस्तनकुङ्गमस्वजम् ।  
बाह्वेर्दधानं मधुमल्लिकाश्रितां तस्याग्र आसीनमवेक्ष्य विस्मितः ॥३२॥

सं तं प्रविष्टं वृत्तमाततायिभिर्भैरवलोक्य माधवः ।  
उद्यम्य मौर्व परिघं व्यवस्थितो यथान्तको दण्डधरो जिधांसया ॥३३॥

जिघृक्षया तान् परितः प्रसर्पतः शुनो यथा सूकरयूथपोऽहनत् ।  
ते हन्यमाना भवनाद् विनिर्गता निर्भिन्नमूर्धोरुभुजाः प्रदुद्रुकुः ॥३४॥

तं नागपाशैर्बलिनंदनो बली जन्तं स्वसैन्यं कृपितो बबंध ह ।  
ऊषा भृशं शोकविषादविह्ला बद्धं निशम्याश्रुकलाक्ष्यरौदिवीत् ॥३५॥

इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्दे उत्तरार्थं  
अनिरुद्धबन्धो नाम द्विषष्टिमोऽध्यायः ॥६२॥

वात सांभणी अहु ज व्यथा पामेलो बाणासुर तरत कन्याना धरमां गयो, त्यां  
अनिरुद्ध तेना जोवामां आव्या.<sup>३०</sup> त्रिलोकीमां सर्वोत्तम, रूपाणा, श्याम, पीणां  
वस्त्रोवाणा, कमण सरभां नेत्रवाणा, मोटी भुज्वाणा, सर्व मंगणरूप, प्यारीनी  
साथे पासाथी रमता, प्यारीना अंगसंगने लीधे जेमां स्तननुं केसर लागी गयुं  
हतुं ऐवा अने वसंतऋतु संबंधी भल्लिकाना पुष्पोनी माणाने वक्षःस्थणमां धारण  
करनार अने कुंडण तथा केशनी कांतिथी तथा हास्यपूर्वक कटाक्षथी जेमनुं मुख  
शोभी रह्युं हतुं, ऐवा पद्युमना पुत्र अनिरुद्धने ते कन्यानी आगण बेठेला जोईने  
बाणासुर विस्मय पाम्यो.<sup>३१-३२</sup> शत्रु धरनारा अनेक योद्धाओथी वींटाएला  
बाणासुरने धरमां आवेलो जोई अनिरुद्ध, ते बाणासुरने मारी नाखवानी  
ईच्छाथी लोढानी भोगण उपाडीने दंड धरनारा काणनी पेठे उिभा रह्या.<sup>३३</sup> मोटो  
भूंड जेम कूतराओने मारे तेम, पकडी लेवानी ईच्छाथी चारेकोरथी आवता ए  
योद्धाओने अनिरुद्धे मारवा मांडया. मार खाता अने जेओनां माथां, साथण  
तथा हाथ भांगी पड्या छे, ऐवा ते योद्धाओ धरमांथी नीकणी गया.<sup>३४</sup> पोताना  
सैन्यने मारता ए अनिरुद्धने बणवान बाणासुरे कोपथी नागपाशवडे बांधी  
लीधा. अनिरुद्धने बंधाएला जोई शोक तथा झेदथी विह्वण थयेली अने आंसु  
जेना नेत्रमांथी पडतां हतां ऐवा उिषा अहु ज रोवा लागी.<sup>३५</sup>  
इति श्रीमद् महापुराण भागवतना दशम ऋक्यनो बासठमो अद्याय संपूर्णं.

अथ त्रिषष्टिमोऽध्यायः (६३)  
॥ श्रीशुकुञ्जवाच ॥

अपश्यतां चानिरुद्धं तद्धूनां च भारत ! चत्वारो वार्षिका मासा व्यतीयुरनुशोचताम् ॥१  
नारदात्तदुपाकर्ण्य वार्ता बद्धस्य कर्म च । प्रययुः शोणितपुरं वृष्णयः कृष्णदेवताः ॥२  
प्रद्युम्नो युयुधानश्च गदः साम्बोऽथ सारणः । नन्दोपनन्दभद्राद्या रामकृष्णानुर्वितनः ॥३  
अक्षौहिणीभिर्द्वादशभिः समेताः सर्वतोदिशम् । रुसुर्बुर्णानगरं समन्तात् सात्वतर्षभा ॥४  
भज्यमानपुरोद्यानप्राकाराद्वालगोपुरम् । प्रेक्षमाणो रुषाविष्टस्तुल्यसैन्योऽभिनिर्ययौ ॥५  
बाणार्थं भगवान् रुद्रः ससुतैः प्रमर्थैर्वृतः । आरुह्य नन्दिवृषभं युयुधे रामकृष्णयोः ॥६  
आसीत् सुतुमुलं युद्धमद्धुतं रोमर्हणम् । कृष्णशङ्करयो राजन्! प्रद्युम्नगुहयोरपि ॥७  
कुम्भाण्डकूपकर्णाभ्यां बलेन सह संयुगः । साम्बस्य बाणपुत्रेण बाणेन सह सात्यकेः ॥८  
ब्रह्मादयः सुराधीशा मुनयः सिद्धचारणाः । गन्धर्वाप्सरसो यक्षा विमानैर्द्रष्टुमागमन् ॥९  
शङ्करानुचराज्ञौरिर्भूतप्रमथगुह्यकान् । डाकिनीर्यातुधानांश्च वेतालान् सविनायकान् ॥१०

## अद्याय ६३

श्रीकृष्ण भगवाने बाणासुरना हाथ कापी नाप्या.

शुकुदेवज्ञ कुहे छे हे राजा ! अनिरुद्धने नहीं देखतां अने तेमनो शोक करतां  
तेमनां संबंधीओने वर्षांतुना चार भणिना वीती गया.<sup>१</sup> पछी नारदज्ञना  
कहेवाथी अनिरुद्ध बंधायानी वात तथा तेमणे करेलुं काम जाशवामां आवतां,  
श्रीकृष्णने अनुसरनारा यादवो शोणितपुरमां गया.<sup>२</sup> श्रीकृष्ण तथा बणदेवज्ञनी  
साथे प्रद्युम्न, सात्यकि, गद, सांब, सारण, नंद, उपनंद तथा भद्र आदि उत्तम  
यादवो ए बार अक्षौहिणी सैन्यथी चारेकोर बाणासुरना नगरने घेरी लीधुं.<sup>३-४</sup>  
सर्व दिशाओमां पुर, बगीचा, गढ, कोठा अने दरवाजा भांगतां जोई कोधथी  
भराएलो बाणासुर बार अक्षौहिणी सैन्य लईने युद्ध करवा नीकण्यो.<sup>५</sup>  
बाणासुरने माटे पोताना पुत्रो अने पार्षदोथी वींटाएला शिवज्ञ नंदिकेश्वर उपर  
बेसीने बलराम तथा भगवानी साथे युद्ध करवा लाग्या.<sup>६</sup> हे राजा ! श्रीकृष्ण  
तथा शंकरने अने प्रद्युम्न तथा कार्तिकेय स्वामीने पश भारे तुमुल अल्लुत अने  
रुवांडं उिभां करे ऐवुं युद्ध थयुं.<sup>७</sup> बणदेवज्ञनी साथे कुमांड अने कूपकर्ण नामना  
बाणासुरना मंत्रीओ युद्ध करवा लाग्या, सांभनी साथे बाणासुरनो पुत्र अने  
सात्यकिनी साथे बाणासुर पोते युद्ध करवा लाग्यो.<sup>८</sup> ब्रह्मादिक मोटा देवताओ,  
मुनिओ, सिद्ध, चारण, गंधर्व, अप्सरा अने यक्षो विमानोमां बेसीने जोवा आव्या

प्रेतमातृपिशाचांश्च कूष्माण्डान् ब्रह्मराक्षसान् । द्रावयामास तीक्ष्णाग्रैः शरैः शार्ङ्ग्नुश्चयुतैः ११ पृथग्विधानि प्रायुङ्गं पिनाक्यस्त्राणि शार्ङ्ग्णे । प्रत्यस्त्रैः शमयामास शार्ङ्ग्पाणिरविस्मितः १२ ब्रह्मास्त्रस्य च ब्रह्मास्त्रं वायव्यस्य च पार्वतम् । आग्नेयस्य च पार्जन्यं नैजं पाशुपतस्य च १३ मोहयित्वा तु गिरिशं जृम्भणास्त्रेण जृम्भितम् । बाणस्य पृतनां शौरिर्जघानासिगदेषुभिः १४ स्कन्दः प्रद्युम्नबाणौधर्द्यमानः समन्ततः । असृग् विमुच्छन् गात्रेभ्यः शिखिनाप्रकमद् रणात् । कुम्भाण्डः कूपकर्णश्च पेततुर्मुसलार्दितौ । दुद्रुवुस्तदनीकानि हतनाथानि सर्वतः ॥१६ विशीर्यमाणं स्वबलं दृष्ट्वा बाणोऽत्यमर्घणः । कृष्णमध्यद्रवत् संख्ये रथी हित्वैव सात्यकिम् १७ धनूंध्याकृष्णं युगपद् बाणः पञ्चशतानि वै । एकैकस्मिंश्चौ द्वौ द्वौ सन्दधे रणदुर्मदः ॥१८ तानि चिच्छेद भगवान् धनूंध्यं युगपद्धरिः । सारर्थं रथमश्चांश्च हत्वा शङ्खमपूरयत् ॥१९ तन्माता कोटरा नाम नग्ना मुक्तशिरोरुहा । पुरोऽवतस्थे कृष्णस्य पुत्रप्राणरिक्षया ॥२० ततस्तिर्थद्मुखो नग्नामनिरीक्षन् गदाग्रजः । बाणश्च तावद् विरथश्छन्नधन्वाविशत् पुरम् ॥२१

हता.१० भूत, प्रभृत, डाक्षा, राक्षसो, यक्षो, वैताल, विनायक, प्रेत, मातृगण, पिशाच, कुष्मांड अने ब्रह्मराक्षस आहि शंकरना अनुयरोने श्रीकृष्णे शारंग-धनुषमांथी मूडेलां तीक्ष्णबाणोथी नसाडी मूक्या. १०-११ विस्मय नहीं पामेला श्रीकृष्ण भगवाने, महादेवे पोतानी सामे मूडेला अनेक प्रकारनां अस्त्रोने सामा अस्त्रोथी समावी दीधां. १२ ब्रह्मास्त्रनी सामे ब्रह्मास्त्र, वायुना अस्त्रनी सामे पर्वतनुं अस्त्र, अग्निना अस्त्रनी सामे मेघनुं अस्त्र अने पाशुपतास्त्रनी सामे नारायणास्त्र मूक्युं. १३ जृंभणास्त्रना प्रयोगथी महादेवने मोह उपजतां ते भगासा खावा लागी गया, तेटलामां भगवान तलवार, गदा अने बाणोथी बाणासुरनी सेनानो संहार करवा लाग्या. १४ यारेकोर प्रद्युम्नना बाणशी पीडा पामता अने जेमना शरीरमांथी लोही नीकण्ठुं हतुं, ऐवा कार्तिकेय स्वामी मोर उपर बेसीने युद्धमांथी भागी गया. १५ बलरामना मुशागथी पीडा पामेला कुमांड अने कूपकर्णं पडी गया. जेओना मुख्य योद्धा मरण पाम्या छे. ऐवा बाणासुरना सैन्यो यारेकोर भागवा लाग्यां. १६ पोताना सैन्यने नासेलुं जोई, बहु ज कोध पामेलो बाणासुर सात्यकिने छोडी दृढ रथमां बेसीने भगवाननी सामे दोड्यो. १७ मदोन्मत्त बाणासुर एक सामटा पांचसो धनुष खेंचीने ते प्रत्येकमां बज्बे बाण सांघतो हतो. १८ भगवाने ए धनुषोने एक सामटा ज कापी नाख्यां अने बाणासुरना सारथि तथा घोडाओने पशा कापीनाखीने शंखनाद कर्यो. १९ बाणासुरनी मा कोटरा पोताना पुत्रना प्राण भयाववा सारु, वाण धूटा मूडी नागी थईने भगवाननी सामे आवीने ऊभी

विद्राविते भूतगणे ज्वरस्तु त्रिशिरास्त्रिपात् । अभ्यधावत दाशाहं दहन्त्रिव दिशो दश ॥२२ अथ नारायणो देवस्तं दृष्ट्वा व्यसृजज्वरम् । माहेश्वरो वैष्णवश्च युयुधाते ज्वरावुभौ ॥२३ माहेश्वरः समाक्रन्दन् वैष्णवेन बलार्दितः । अलब्ध्वा भयमन्यत्र भीतो माहेश्वरो ज्वरः ।

शरणार्थी हृषीकेशं तुष्टव प्रयताज्जलिः ॥२४

ज्वर उत्वाच

नमामि त्वानन्तशक्तिं परेशं सर्वात्मानं केवलं ज्ञसिमात्रम् ।

विश्वोत्पत्तिस्थानसंरोधहेतुं यन्तद् ब्रह्म ब्रह्मलिङ्गं प्रशान्तम् ॥२५॥

कालो दैवं कर्म जीवः स्वभावो द्रव्यं क्षेत्रं प्राण आत्मा विकारः ।

तत्सङ्गातो बीजरोहप्रवाहस्त्वन्मायैषा तत्त्वेषं प्रपद्ये ॥२६॥

नानाभावैर्लीलयैवोपपत्तैर्देवान् साधूलोकसेतून् बिर्भविष ।

हंस्युन्मार्गान् हिंसया वर्तमानान् जन्मैतते भारहाराय भूमेः ॥२७॥

२८.२० पछी नागीने नहीं जोता भगवान आँुं मोहुं करी गया, तेटलीवारमां रथ वगरनो अने जेनुं धनुष कपाई गयुं हतुं ऐवो बाणासुर गाममां पेसी गयो. २१ भगवाने भूतप्रेतोने भगाडी मूकतां त्रश माथां अने त्रश पगवाणो ताव जाणे दशे दिशाओने बाणतो होय तेम भगवान सामो युद्ध करवा आग्यो. २२ भगवाने ते तावने जोईने तेनी सामे पोतानो शीतज्वर मूक्यो. शिवनो गरम ताव तथा विष्णुनो टाढीओ ताव बेय युद्ध करवा लाग्या. २३ विष्णुना तावे पोताना बणथी पीडेलो, चीसो पाडतो, भय पामेलो अने शरणाने ईश्वरो शिवनो ताव बीजा कोईथी अभय नहीं मणतां हाथ जोडीने भगवाननी सामे स्तुति करवा लाग्यो. २४

शिवनो ताव स्तुति करेछे हे अपार शक्तिवाणा परमेश्वर ! सर्वना आत्मा ! शानस्वरूप ! शांत ! वेदथी ज्ञानावामां आवो ऐवा ! अने जगतीनी उत्पत्ति, स्थिति तथा प्रलयना कारणस्वरूप ! जे आप परब्रह्म छो ते आपने हुं प्रशाम करुं हुं. २५ काण, कर्म, कर्मनो संस्कार, श्व, पांच विषयो, शरीर, प्राण, अहंकार, अग्नियार ईद्रियो, पंचमहाभूत, लिंगशरीर अने देहथी कर्म तथा कर्मथी देह अेम चालतो प्रवाह, ए सर्व तमारा संकल्परूप शानने आधीन छे. माटे ए काणादिको जेमां निषेध रह्यो छे. ऐवा आपने शरणे हुं आवेलो हुं. २६ आप सर्व उपाधिओथी मुक्त होवा छतां ज लीलाथी स्वीकार करेला अनेक अवतारोथी देव, साधु अने वर्णाश्रमनी भर्यादाओने पाणो छो अने जगतने पीडा करनारा

तसोऽहं ते तेजसा दुःसहेन शान्तोग्रेणात्युल्बणेन ज्वरेण ।  
तावत्तापो देहिनां तेऽद्विघ्मूलं नो सेवेन् यावदाशानुबद्धाः ॥२८॥

## श्रीभगवानुवाच

त्रिशिरस्ते प्रसन्नोऽस्मि व्येतु ते मज्ज्वराद् भयम् । यो नौ स्मरति संवादं तस्य त्वन् भवेद् भयम् ॥  
इत्युक्तोऽच्युतमानम्य गतो माहेश्वरो ज्वरः । बाणस्तु रथमारुढः प्रागाद्योत्यज्जनार्दनम् ॥३०  
ततो बाहुसहस्रेण नानायुधधरोऽसुरः । मुमोच परमकुद्धो बाणांश्क्रायुधे नृपः ॥३१  
तस्यास्यतोऽस्त्राण्यसकृच्छक्रेण क्षुरनेमिना । चिञ्छेद भगवान् बाहून् शाखा इव वनस्पतेः ३२  
बाहुषुच्छिद्यमानेषु बाणस्य भगवान् भवः । भक्तानुकम्प्युपव्रज्य चक्रायुधमभाषत ॥३३

## श्रीरुद्र उवाच

त्वं हि ब्रह्म परं ज्योतिर्गूढं ब्रह्मणि वाइमये । यं पश्यन्त्यमलात्मान आकाशमिव केवलम् ३४  
नाभिर्भोऽग्निर्मुखमम्बु रेतो द्यौः शीर्षमाशा श्रुतिरद्विरुर्वर्णी ।  
चन्द्रो मनो यस्य दृग्कर्त आत्मा अहं समुद्रो जठरं भुजेन्द्रः ॥३५॥

कुमारीं लोकोने हृषो छो. अेवा आ आपनो जन्म पृथ्वीनो भार उतारवा सारु  
छो. २७ आपे उत्पत्ति करेला असह्य अने महाभयंकर आ शीतज्वरथी हुं पीडायो  
छुं. प्राणीओ आशामां बंधाईने ज्यां सुधी आपना चरणने सेवे नहीं त्यां सुधी  
ज तेओने ताप रहे छो. २८

भगवान कहे छे हे न्रेषमाथांवाणा. हुं तारी उपर प्रसन्न थयो छुं. तने मारा  
तावनी भीक ट्यो. आपणा आ संवादनुं स्मरण करे तेने तारे भय आपवो नहीं. २९

शुकदेवज्ञ कहे छे आ प्रमाणे भगवाने कहेतां तेमनी आशाने माथे यढावी  
प्रणाम करीने शिवनो ताव त्यांथी गयो, तेटलामां बाणासुर युद्ध करवा सारु  
रथमां बेसीने भगवाननी सामे आव्यो. ३० हे राजा ! पही अनेक आयुधोने  
धरनार अने बहु ज कोध पामेलो बाणासुर, पोताना हजार हाथथी भगवान  
उपर बाण वरसाववा लाग्यो. ३१ वारंवार अस्त्रोने नाखता ते बाणासुरना  
हस्तोने भगवाने सज्जया सरभी धारवाणा यक्थी वृक्षनी शाखाओनी जेम कापी  
नाख्या. ३२ बाणासुरना हाथ कपावा लागतां भक्तवत्सल भगवान श्रीकृष्णनी  
पासे आवीने शंकरे आ प्रमाणे कहुं. ३३

सदाशिव कहे छे वेदमां पाण छाना रहेला अने परम प्रकाशरूप परब्रह्म  
आप छो के जेमने निर्भय बुद्धिवाणाओ आकाशनी पेठे निर्दोष रूपे जुवे छे.  
माटे आपने जाण्या विना आ बाणासुर युद्ध करे छे ते कांઈ आश्वर्य नथी. ३४

रोमाणि यस्यौषधयोऽम्बुवाहाः केशा विरिङ्गो धिषणा विसर्गः ।  
प्रजापतिर्हृदयं यस्य धर्मः स वै भवान् पुरुषो लोककल्पः ॥३६॥  
तवावतारोऽयमकुण्ठधामन् धर्मस्य गुप्त्यै जगतो भवाय ।  
वयं च सर्वे भवतानुभाविता विभावयामो भुवनानि सप्त ॥३७॥  
त्वमेक आद्यः पुरुषोऽद्वितीयस्तुर्यः स्वदृग्घेतरहेतुरीशः ।  
प्रतीयसेऽथापि यथाविकारं स्वमायया सर्वगुणप्रसिद्ध्यै ॥३८॥  
यथैव सूर्यः पिहितच्छायया स्वया छायां च रूपाणि च सञ्चकास्ति ।  
एवं गुणेनापिहिते गुणास्त्वमात्मप्रदीपो गुणिनश्च भूमन् ॥३९॥

निरंजननी वात तो एक कोर पाण जेम उद्दंभराना फणनी अंदर रहेतां जंतुओ  
फणने जाणी शक्तां नथी, तेम आपे लीलाथी धरेला आपना विराट स्वरूपने पाण  
कोई जाणता नथी. के जे स्वरूपमां आकाश नाभिरूप छे, अग्नि मुखरूप छे,  
जण वीर्यरूप छे, स्वर्ग मस्तकरूप छे, दिशाओ कानरूप छे, पृथ्वी पगरूप छे,  
चंद्रमा मनरूप छे, सूर्य दृष्टिरूप छे, हुं अहंकाररूप छुं, समुद्र पेटरूप छे, ईंद्र  
भुजरूप छे, औषधिओ रुवांडारूप छे, भेघ केशरूप छे, ब्रह्मा बुद्धिरूप छे,  
प्रजापति शिश्नरूप छे अने धर्म हृदयरूप छे. आ प्रभाणे जगतरूपे कल्पायेला  
आप परमपुरुष छो. ३५-३६ हे अभं त्वरूपवाणा ! धर्मना रक्षणने माटे अने  
जगतना कल्पाणने माटे आ तमारो अवतार छे. अमे सर्वे लोकपाणो आपनाथी  
ज रक्षण पामीने साते लोकनुं पालन करीये छीये. ३० हे प्रभु ! नामरूपना  
विभागथी रहित सूक्ष्म दशाने पामेलां येतन तथा अयेतनथी विशिष्ट होवाने  
कारणे आप एकत्व व्यपदेशने योग्य आटिपुरुष छो. अर्थात् आप एक ज  
जगतना उपादान कारणभूत छो. अने वणी आप केवण जगतना उपादान  
कारणभूतज नथी, परंतु निमित्तकारण पाण आप ज छो. अने वणी हे प्रभु !  
आप स्वयंप्रकाश, शानस्वरूप, होवाने कारणे प्रकृति थकी विलक्षण छो. अने  
जाग्रत, स्वप्न अने सुषुप्ति आ त्रिष्ण अवस्थाना संबन्धिती रहित होवाने कारणे  
ज्ञव थकी पाण विलक्षण छो, आप सर्वेना नियन्ता छो, आप सर्वेना कारण छो,  
पाण आपनुं कोई कारण नथी. जो के आप उपादान कारणभूत छो, इतां प्रकृतिना  
परिणामरूप विकारथी रहित छो. अने सर्वे ज्ञवोने कर्मक्षण आपवाने माटे  
पोतानी अंतर्यामि शक्तिती देव मनुष्यादिक्ने विषे न्यूनाधिकभावथी जाण्या ओ  
छो. ३८ हे ईश्वर ! जेम सूर्य पोताथी ज प्रकाशवा योग्य वाढणांओथी नहि ढंकाईने

यन्मायामोहितधियः पुत्रदारगृहादिषु । उम्मज्जन्ति निमज्जन्ति प्रसक्ता वृजिनार्णवे ॥४०  
देवदत्तमिमं लब्ध्वा नूलोकमजितेन्द्रियः । यो नाद्रियेत त्वत्यादौ स शोच्यो ह्यात्मवञ्चकः ४१  
यस्त्वां विसृजते मर्त्य आत्मानं प्रियमीश्वरम् । विपर्ययेन्द्रियार्थार्थं विषमत्यमृतं त्यजन् ॥४२  
अहं ब्रह्माथ विबुधा मुनयश्चामलाशयाः । सर्वात्मना प्रपत्नास्त्वामात्मानं प्रेष्टमीश्वरम् ॥४३  
तं त्वा जगत्स्थित्युदयान्हेतुं समं प्रशान्तं सुहृदात्मदैवम् ।

अनन्यमेकं जगदात्मकेतं भवापवर्गाय भजाम देवम् ॥४४॥

अयं ममेषो दयितोऽनुवर्तीं मयाभयं दत्तममुष्य देव ! ।

सम्पाद्यतां तद् भवतः प्रसादो यथा हि ते दैत्यपतौ प्रसादः ॥४५॥

श्रीभगवानुवाच

यदात्थ भगवंस्त्वन्नः करवाम प्रियं तव । भवतो यद् व्यवसितं तम्ये साध्वनुमोदितम् ॥४६

वादणांओने अने वादणांओथी आच्छादित घटादिकने पाण प्रकाशे छे. तेम हे भूमन् ! आप गुणमय प्रकृति वडे नहि ठंकाईने गुणमय प्रकृतिने अने प्रकृतिथी आच्छादित छ्वाने प्रकाश करो छो. माटे आप स्वयंप्रकाश छो. ४६ आपनी मायाथी मोह पाभीने पुन्र, स्त्रीओ अने घर आदिमां आसक्त थयेला लोको हुःभना समुद्ररूप संसारमां ऊंची नीची योनिओ पाभ्या करे छे. ४० आपे आपेला आ मनुष्य देहने पाभी, जे अजितेन्द्रिय पुरुष आपना चरणानुं भजन न करे, ते पुरुष शोक करवा योग्य अने आत्माने ज ठगनारो समज्वो. ४१ जे पुरुष जड अप्रिय अने अनीश्वर पुत्रादिकने माटे चैतन्य, प्रिय अने ईश्वर स्वरूप एवा आपने छोडी हे छे, ते पुरुष अमृतने मूँझीने झेर खाय छे. ४२ हुं, ब्रह्मा, देवताओ अने निर्भी मनवाणा ऋषिओ पाण, प्रिय, ईश्वर अने अंतर्यामी एवा आपने ज सर्वप्रकारे भज्याए छीओ. ४३ अने हे प्रभु ! आप जगतनी उत्पत्ति, स्थिति अने प्रलयना कारणरूप छो, विषयभावथी रहित छो, भूम तरस आदि ४ प्रकारनी उर्भिओथी रहित छो, सर्वना भित्र छो, सर्वना अंतर्यामी आत्मा छो, सर्वना ईश्वर छो, तमे ज एक स्वामी छो, तमारा सिवाय बीजो कोई पाण स्वामी नथी. माटे तमो अनन्य एक छो, प्रकृति तथा आत्माओना आधाररूप छो. आवा तमने अभ्युदय माटे अने मोक्षने माटे अमो भज्याए छीओ. ४४ हे देव ! आ बाणासुर मारो आशाकारी अने घारो भक्त छे. अने तेने में अभय आपेल छे. माटे आपे जेवी प्रह्लाद उपर कृपा करी तेवी आना उपर कृपा करो. ४५

भगवान कहे छे हे भक्त शिवज ! आप जेवुं कहो छो ते प्रमाणे हुं आपने

अवध्योऽयं ममाप्येष वैरोचनिसुतोऽसुरः । प्रह्लादाय वरो दत्तो न वध्यो मे तवान्वयः ॥४७  
दर्पोपशमनायास्य प्रवृक्षणा बाहवो मया । सूदितं च बलं भूरि यच्च भारयितं भुवः ॥४८  
चत्वारोऽस्य भुजाः शिष्ठ भविष्यन्त्यजरामरा : । पार्षदमुख्यो भवतो न कुतश्चिद्दद्योऽसुरः ४९  
इति लब्ध्वाभयं कृष्णं प्रणम्य शिरसासुरः । प्राद्युम्निं रथमारोप्य सवधा समुपानयत् ॥५०  
अक्षौहिण्या परिवृतं सुवासः समलङ्कृतम् । सपत्नीकं पुरस्कृत्य ययौ रुद्रानुमोदितः ॥५१  
स्वराजधारीं समलङ्कृतां ध्वजैः सतोरणैरुक्षितमार्गचत्वराम् ।

विवेश शङ्खानकदुन्दुभिस्वनैरभ्युद्यतः पौरसुहृद्द्विजातिभिः ॥५२॥

य एवं कृष्णविजयं शंकरेण च संयुगम् । संस्मरेत् प्रातरुत्थाय न तस्य स्यात् पराजयः ५३

इति श्रीमद्भागवते महापुराणे परमहंस्यां संहितायां दशमस्कन्धे उत्तरार्थं

अनिरुद्धानयनं नाम त्रिषष्ठितमोऽध्यायः ॥६.३॥

राज्ञ करुं छुं. आप जे धारो छो तेमां हुं सारी रीते संभति आपुं छुं. ४६ बणिराजना दीकरा आ बाणासुरने मारे पाण मारवो नथी कारण के “तमारा वंशने हुं मारीश नहीं” ऐवुं में प्रह्लादज्ञने वयन आपुं छे. ४७ गर्व उतारवा सारु आना में हाथ काप्या छे अने पृथ्वीने भारतुप लागतुं मोहुं सैन्य में मार्युं छे. ४८ आना चार हाथ अवशेष रह्या छे ते अजरअमर थशे. तमारा पार्षदोमां मुख्य आ असुरने हवे कोई पाण स्थग्नी भय थशे नहीं. ४९

शुक्टेवज्ञ कहे छे हे राजा ! आ प्रमाणे बाणासुर अभय पाभी, श्रीकृष्णने प्रशाम करी, अनिरुद्धने पोतानी दीकरी उषानी साथे रथमां बेसाईने लाव्यो. ५० बाणासुरे आपेली एक अक्षौहिणी सेनाथी वींटाएला अने सारां वस्त्र अलंकारोथी शाशगारेली स्त्रीओ सहित अनिरुद्धने आगण करी श्रीकृष्ण भगवान शिवज्ञनी संभति लह्ने त्यांथी चाल्या. ५१ नगरना लोको, संबंधीओ अने द्विजलोकोओ जेमनुं सामैयुं कर्युं हतुं. एवा भगवान शंभ, आनक अने हुंदुभिओना ध्वनिओनी साथे तोरण अने ध्वजाओथी शाशगारेली तथा जेना मार्ग अने यौटाओमां पाणी छांट्यां हतां, ऐवी पोतानी राजधानी द्वारकामां पवार्या. ५२ आ प्रमाणे सदाशिवनी साथे युद्ध थयानी अने भगवाननो विजय थयानी कथाने, जे माणस प्रातः काणमां उठीने संभारशे तेनो क्यारेय पाण पराजय थशे नहीं. ५३

इति श्रीमद् महापुराण भगवतना दशम स्कन्धनो ग्रेसठमो अद्याय संपूर्णः.

अथ चतुःषष्ठितमोऽध्यायः (६४)

॥ श्रीशुक उवाच ॥

एकदोपवनं राजन् ! जगमुर्यदुकुमारकाः । विहृतु साम्बप्रद्युम्नचारुभानुगदादयः ॥१  
क्रीडित्वा सुचिरं तत्र विचिन्वन्तः प्रिपासिताः । जलं निरुदके कूपे ददृशः सत्त्वमद्भूतम् ॥२  
कृकलासं गिरिनिभं वीक्ष्य विस्मितमानसाः । तस्य चोद्धरणे यत्रं चक्रुस्ते कृपयाच्चिताः ३  
चर्मजैस्तान्तवैः पाशैबद्धवा पतितमर्भकाः । नाशकनुवन् समुद्धर्तु कृष्णायाच्छ्वरुत्सुकाः ४  
तत्रागत्यारिवन्दाक्षो भगवान् विश्वभावनः । वीक्ष्योज्जहार वामेन तं करेण स लीलया ॥५  
स उत्तमश्लोककराभिमृष्टे विहाय सद्यः कृकलासरूपम् ।  
सन्तमचामीकरचारुवर्णः स्वर्गद्भूतालङ्करणाम्बरस्वक् ॥६॥  
पप्रच्छ विद्वानपि तत्रिदानं जनेषु विख्यापयितुं मुकुन्दः ।  
कस्त्वं महाभाग वरेण्यस्तपे देवोत्तमं त्वां गणयामि नूनम् ॥७॥  
दशामिमां वा कतमेन कर्मणा सम्प्रापितोऽस्यतदर्हः सुभद्र ।  
आत्मानमाख्याहि विवित्यतां नो यन्मयसे नः क्षममत्र वक्तुम् ॥८॥

#### अद्याय ६४

श्रीकृष्ण भगवाने नृगरामने शापथी भुक्ताव्यो.

शुकदेवज्ञ कहे छे हे राजा ! एक दिवसे सांभ, प्रद्युम्न, चारु, भानु अने  
गद आहि यादव कुमारो वाडीमां रमवा माटे गया.<sup>१</sup> घण्टीवार सुधी रभीने तरस  
लागतां पाणी शोधता हता, त्यां एक पाणी वगरना कूवामां अद्भुत प्राणी तेओना  
जोवामां आव्युं.<sup>२</sup> ए पर्वत जेवडा शरीरने धरी रहेला कायंडाने जोई, विस्मय  
पामतां दयाने लीघे तेओअे तेने भहार काढवानो प्रयत्न कर्यो.<sup>३</sup> ते कायंडाने  
चामडाना अने सूतरना दोरडांथी बांधीने काढवा मांडया, तोपश नहीं काढी शकतां  
तेओअे आश्चर्य युक्त थर्हने भगवाननी पासे वात करी.<sup>४</sup> जगतना रक्षक अने  
कमण सरभां नेत्रवाणा भगवाने त्यां आवी कायंडाने जोई लीलामात्रमां डाबा  
हाथथी काढी लीधो.<sup>५</sup> भगवानना हस्तनो स्पर्श थतांनी साथे तरत कायंडानुं रुप  
छोटी दीधुं. अने तपावेला सुवर्ण सरभा सुंदर वर्णवाणो तथा अद्भुत अलंकार,  
वस्त्र अने माणवाणो देव थर्ह भगवाननी आगण उभो रह्यो.<sup>६</sup> भगवान पोते  
तेना कारणाने जाणता हता तोपश तेमाझे प्रभ्यात रकवा सारु ते देवने पूछ्युं के हे  
आग्यशाणी ! उत्तम रूपवाणो तुं कोणा छे ? हुं धारुं छुं के तुं कोई उत्तम देव छे.<sup>७</sup>  
हे सौभ्य ! आ दशाने योग्य नहीं ऐवातें क्या कर्म वडे आ दशाने प्राप्त करी हती ?

श्रीशुक उवाच

इति स्म राजा सम्पृष्टः कृष्णोनानन्तमूर्तिना । माधवं प्रणिपत्याह किरीटेनार्कवर्चसा ॥९  
नृग उवाच

नृगो नाम नरेन्द्रोऽहमिक्ष्वाकुतनयः प्रभो ! । दानिष्वाख्यायमानेषु यदि ते कर्णमस्पृशम् १०  
किं नु तेऽविदितं नाथ ! सर्वभूतात्मसाक्षिणः । कालेनाव्याहतदृशो वक्ष्येऽथापि तवाज्ञया<sup>१</sup>  
यावत्यः सिकता भूमेर्यावत्यो दिवि तारकाः । यावत्यो वर्षधाराश्च तावतीरददां स्म गाः १२

पर्यस्विनीस्तरुणीः शीलस्तपगुणोपपन्नाः कपिला हेमशृङ्गीः ।

न्यायार्जिता रूप्यखुराः सवत्सा दुकूलमालाभरणा ददावहम् ॥१३॥

स्वलङ्घतेभ्यो गुणशीलवद्भ्यः सीदत्कुटुम्बेभ्य ऋतव्रतेभ्यः ।

तपःश्रुतब्रह्मवदान्यसद्भ्यः प्रादां युवभ्यो द्विजपुङ्गवेभ्यः ॥१४॥

गोभूहिरण्यायतनाश्वहस्तिनः कन्याः सदासीस्तिलरूप्यशश्याः ।

वासांसि रत्नानि परिच्छदान् रथानिष्टं च यज्ञैश्चरितं च पूर्तम् ॥१५॥

जो तने अभारी पासे वात करवाने योग्य लागे तो जाणवानी ईश्वराणा अभोने  
तुं तारी वात कहे.<sup>८</sup>

शुकदेवज्ञ कहे छे अनंत भूर्तिवाणा भगवाने आ प्रमाणो पूछतां, सूर्य सरभा  
तेजवाणा मुकुटथी भगवानने प्रणाम करीने बोल्यो.<sup>९</sup>

नृगराजा कहे छे हे प्रभु ! ईक्षवाकुनो दीकरो हुं नृग नामनो राजा छुं.  
दानेश्वरीओना नाममां मारुं नाम पश तमारा कान उपर आव्युं हशे.<sup>१०</sup> सर्व  
प्राणीओनी बुद्धिना साक्षी अने काणथी जेना ज्ञाननो लोप थतो नथी ऐवा आपथी  
शुं अजाइयुं होय ? तोपश हे ईश्वर ! आपनी आज्ञाथी कहुं छुं.<sup>११</sup> जेटला पृथ्वीमां  
२४कण छे, आकाशमां जेटला तारा छे, अने वरसादानं जेटलां बुंद छे. तेटली  
गायो में दानमां आपी हती.<sup>१२</sup> दूधाणी, युवान, शीलरूप तथा गुणोथी संपत्त,  
कपिल वर्णवाणी, सोनानां शीगडावाणी, न्यायमार्गथी भेणवेली रुपानी  
भरीओवाणी, वाइरडां सहित अने वस्त्र तथा माणाओथी शशगारेली गायो में  
आपी हती.<sup>१३</sup> सारी रीते शशगारेला, सारा गुण तथा स्वभाववाणा, निष्कपट  
आचरणवाणा, तपथी प्रभ्यात, वेद भजनारा, युवान अने जेओनां कुटुंब  
दरिद्रताने लीघे पीडातां हतां, ऐवा सुपात्र उत्तम ब्राह्मणोने में गायोनुं दान कर्युं  
हतुं.<sup>१४</sup> गायो, पृथ्वी, सुवर्ण, घोडा, हाथी, दासी सहित कन्याओ, तिल, रुपुं,  
शथ्याओ, वस्त्रो, रत्नो अने सरसमान सहित रथोनां पश में दान कर्या हतां,

कस्यचिद् द्विजमुखस्य भ्रष्टा गौर्मम गोधने । सम्पूर्का विदुषा सा च मया दत्ता द्विजातये ॥६  
तां नीयमानां तत्स्वामी दृष्टेवाच ममेति तम् । ममेति प्रतिग्राह्याह नृगो मे दत्तवानिति ॥१७  
विप्रौ विवदमानौ मामूचतुः स्वार्थसाधकौ । भवान् दातापहर्तीति तच्छुल्वा मेऽभवद् भ्रमः १८  
अनुनीतावुभौ विप्रौ धर्मकृच्छ्रगतेन वै । गवां लक्षं प्रकृष्टानां दास्याम्येषा प्रदीयताम् ॥१९  
भवन्तावनुगृहीतां किङ्करस्याविजानतः । समुद्ग्रहत मां कृच्छ्रात् पतनं निरयेऽशुचौ ॥२०  
नाहं प्रतीच्छेवै राजन्नित्युक्त्वा स्वाम्यपाक्रमत् । नान्यद् गवामप्ययुतमिच्छामीत्यपरो ययौ २१  
एतस्मिन्नत्रे याम्यैर्दूर्तैर्नीतो यमक्षयम् । यमेन पृष्ठस्त्राहं देवदेव ! जगत्पते ! ॥२२  
पूर्वं त्वमशुभं भुज्ञे उताहो नृपते ! शुभम् । नान्तं दानस्य धर्मस्य पश्ये लोकस्य भास्वतः २३  
पूर्वं देवाशुभं भुज्ज इति प्राह पतेति सः । तावदद्राक्षमात्मानं कृकलासं पतन् प्रभो ! ॥२४  
ब्रह्मण्यस्य वदान्यस्य तव दासस्य केशव ! । स्मृतिर्नाद्यापि विध्वस्ता भवत्सन्दर्शनार्थिनः २५

तेमज्यशो अने जग्नाशय करवा आहिं कामो पशा में कर्या हतां ॥१५ कोई उत्तम भ्रात्माना धरनी गाय भूती पडतां मारी गायोना धशमां भणी गई हती, ते गाय में अजाणतां बीज्ञ भ्रात्मणो आपी दीधी ॥१६ ते गायने लई भ्रात्मण जतो हतो त्यां तेनो प्रथमनो स्वामी ज्ञेईने बोल्यो के “आ गाय मारी छे.” प्रतिग्रह करनार बोल्यो के “आ गाय मारी छे अने मने नृगराजाए आपी छे.” ॥१७ विवाद करता अने स्वार्थ साधवा मागता ए बसे भ्रात्मणो ए मने आ प्रमाणे कह्युं तेमां पहेला भ्रात्मणे कह्युं के “तें मने आ गाय आपी छे. अने बीज्ञ बोल्यो के तें मारी गाय हरी लीधी छे.” आ वात सांभणी हुं व्याकुण थई गयो ॥१८ धर्म संकट आवी पडतां में बसे भ्रात्मणो समजाववा मांड्युं के “आ गायने जे भूकी देशे तेने हुं बीज्ञ एक लाख गायो आपीश ॥१९ किंकर एवो जे हुं कांઈ पश जाणातो नथी, माटे मारा उपर तमे अनुग्रह करो. अने अपवित्र नरकमां पडवाना कष्टमांथी मने काढो ॥२० तेनो पहेलो धणी “हे राजा ! हुं दान लेतो नथी” माटे आ गायना बदलामां हुं आपनी बीज्ञ गायो लईश नहि. ऐम कहीने याल्यो गयो. अने प्रतिग्रह करनार पश “ऐक लाख ने माथे दशहजार आपो तोपश आ गाय विना बीज्ञ लेवाने हुं ईच्छतो नथी” ऐम दुराग्रहथी बोलीने जतो रव्यो ॥२१ हे देवना देव ! हे जगतना पति ! आ समयमां यमदूतो मने यमपुरीमां लई गया. त्यां यमे मने पूछ्युं के हे राजा ! तुं प्रथम पाप भोगवीश के पुण्य भोगवीश ? तारा दाननो, धर्मनो अने तेथी मणवाना उत्तम लोकोनो पशा हुं अंत देखतो नथी ॥२२-२३ हे देव ! हुं प्रथम पाप भोगववा ईच्छु हुं, यमराजाए कह्युं के त्यारे

स तं कथं मम विभोऽक्षिपथः परात्मा योगेश्वरैः श्रुतिदृशामलहृद्भाव्यः ।  
साक्षादधोक्षज उरव्यसनान्धबुद्धेः स्याम्नेऽनुदृश्य इह यस्य भवापर्वां ॥२६॥  
देवदेव ! जगन्नाथ ! गोविन्द ! पुरुषोत्तम ! नारायण ! हृषीकेश ! पुण्यश्लोकाच्युताव्यय ॥२७  
अनुजानीहि मां कृष्ण ! यान्तं देवगर्ति प्रभो ! यत्र क्वापि सतश्चेतो भूयाम्ने त्वत्पदास्पदम् ॥२८  
नमस्ते सर्वभावाय ब्रह्मणेऽनन्तशक्तये । कृष्णाय ! वासुदेवाय ! योगानां पतये नमः ॥२९  
इत्युक्त्वा तं परिक्रम्य पादौ स्पृष्टा स्वमौलिना । अनुजातो विमानाग्रयमारुहत् पश्यतां नृणाम् ॥३०  
कृष्णः परिजनं प्राह भगवान् देवकीसुतः । ब्रह्मण्यदेवो धर्मात्मा राजन्याननुशिक्षयन् ॥३१  
दुर्जं बत ब्रह्मस्वं भुक्तमग्नेमनागपि । तेजीयसोऽपि किमुत राजामीश्वरमानिनाम् ॥३२  
नाहं हलाहलं मन्ये विषं यस्य प्रतिक्रिया । ब्रह्मस्वं हि विषं प्रोक्तं नास्य प्रतिविधिर्भुवि ॥३३  
हिनस्ति विषमत्तारं वह्निरद्धिः प्रशाम्यति । कुलं समूलं दहति ब्रह्मस्वारणिपावकः ॥३४

नीय योनीमां पड. तेटली वारमां हे प्रभु ! त्यांथी भ्रष्ट थईने में मारा देहने कायंडारूप ज्ञेयो ॥३५ हे श्रीकृष्ण ! जे हुं भ्रात्मणोने माननार, उदार, तमारो दास अने तमारा दर्शनने ईच्छनार हतो. ते मने ए वातनुं स्मरण अद्यापि सुधी टण्युं नथी ॥३६ हे प्रभु ! जे आप योगेश्वरो ए पश उपनिषद्रूप यक्षुथी निर्मण हृदयमां ज चिंतवा योग्य अने ठंडियो जेमने साक्षात् पहेंची शक्ती नथी एवा परमात्मा छो. ते आज मारां नेत्रे प्रत्यक्ष केम थया ? ॥३७ जेने संसारनो अंत आववानो होय तेने आपनां दर्शन थाय, पश हुं कायंडाना अवतार संबंधी धशां कष्टोथी आंधणी बुद्धिवाणो हुं, तेने आपनां दर्शन थयां ए आश्वर्यरूप छे. हे पुरुषोत्तम ! हे नारायण ! हे पवित्र कीर्तिवाणा ! मने देवलोकमां जवानी आशा आपो. अने हुं ज्यां रहुं त्यां मारुं चित तमारां यरणमां ज रहे ॥३८-३९ सर्वने उत्पत्त करनार, परब्रह्म, अनंत शक्तिवाणा, सर्व प्राणीओना आश्रयरूप, कर्मानां फण आपनारा अने परमानंदरूप आपने हुं प्रशाम करुं हुं ॥४०

शुकदेवज्ञ कहे छे आ प्रमाणे कही, प्रदक्षिणा करी पोताना माथाथी भगवानना यरणानो स्पर्श करी ते नृगराजा, लोकोना देखतां आशा लईने उत्तम विमानमां बेसी गया ॥४१ पछी भ्रात्मणोने माननार अने धर्मात्मा श्रीकृष्ण भगवाने राजाओने शिखामण देवा सारु पोताना पुत्र आहिने आ प्रमाणे कह्युं ॥४२

श्रीकृष्ण भगवान कहे छे हे पुत्रो ! भ्रात्मणानुं धन थोहुं पश खवायुं होय तो ते अग्नि जेवा तेजस्वीने पशा पचयुं कठीन छे, त्यारे समर्थपशानुं भिथ्या अभिमान धरावनारा राजाओने तो केम ज पये ? ॥४३ हुं हणाहणने विष समजतो

ब्रह्मस्वं दुरनुजातं भुक्तं हन्ति त्रिपूरुषम् । प्रसहा तु बलाद् भुक्तं दश पूर्वान् दशापरान् ॥३५  
राजानो राजलक्ष्म्यान्था नाम्पातं विचक्षते । निरयं येऽभिमन्यन्ते ब्रह्मस्वं साधु बालिशः ३६  
गृह्णन्ति यावतः पांसून् क्रन्दतामश्रुविन्दवः । विप्राणां हृतवृत्तीनां वदान्यानां कुटुम्बिनाम् ३७  
राजानो राजकुल्याश्च तावतोऽब्दान्निरङ्गुशाः । कुम्भीपाकेषु पच्यन्ते ब्रह्मदायापहारिणः ३८  
स्वदत्तां परदत्तां वा ब्रह्मवृत्तिं हरेच्च यः । षष्ठिवर्षसहस्राणि विश्रायां जायते कृमिः ३९  
न मे ब्रह्मधनं भूयाद् यद् गृदध्वाल्पायुषो नराः । पराजिताश्च्युता राज्याद् भवन्त्युद्गेजिनोऽहयः  
विप्रं कृतागसमपि नैव द्वृहत्त मामकाः । घन्तं बहु शपन्तं वा नमस्कुरुत नित्यशः ४१  
यथाहं प्रणमे विप्राननुकालं समाहितः । तथा नमत यूयं च योऽन्यथा मे स दण्डभाक् ॥४२  
नथी, कारणे के तेनो उपाय थई शके छे. परंतु जेनो उपाय ज नथी, ऐवा ब्राह्मणाना  
द्रव्यने विष मानुं छुं. ३३ झेर केवण खानाराने ज मारे छे अने अग्नि संसर्गथी ज  
बाणी नाखनार छे तोपणे जग्थी शांत थाय छे, पणे ब्राह्मणाना धनरूपी  
अरणीमांथी उत्पत्त थयेलो पापरूप अग्नि तो तेना कुणनो भूण सहित नाश करे  
छे. ३४ ब्राह्मणोनी संभति लीधा विना ब्राह्मणानुं धन खवायुं होय तो ते त्राश पेढीने  
नरकमां नाखे छे, अने हठथी अथवा राजाहिकना आश्रयना भणथी खवायुं होय  
तो दश पहेली अने दश पछीनी पेढीओने पणे नरकमां नाखे छे. ३५ राजलक्ष्मीथी  
अंध थयेला जे राजाओ ब्राह्मणाना धननी ईच्छा करे छे तेओ नरकनी ज ईच्छा  
करे छे अने मूर्खपणाथी पोताना नाशने देखता नथी. ३६ उदार अने कुटुंबवाणा  
ब्राह्मणे पोतानी आज्ञविकानुं हरण थतां रोता होय तो आंसुना एक बुंदथी  
जेटला रज्जकण भींज्य तेटलां वर्ष सुधी राजाओ अने राजाना आश्रितो कुंभीपाक  
नरकमां रंधाय छे के जेओअे निरंकुश थईने ब्राह्मणाना धननुं हरण कर्यु होय. ३७-३८  
पोते आपेली अथवा बीजा कोइहे आपेली ब्राह्मणनी आज्ञविकानुं जे हरण करे  
ते माणस साठज्जार वर्ष सुधी विषामां क्रीडो थाय छे. ३९ आथी हुंतो एज ईच्छुं  
छुं, के ब्राह्मणोनुं धन कटी भूलथी पणे मारा खजानामां न आवो. केम के ब्राह्मणाना  
धननी लालच राखनारा राजाओ अल्प आयुष्यवाणा, पराज्य पामेला अने  
राज्य थकी भ्रष्ट थाय छे. अने देह त्याग कर्यो पछी सर्वजनोने उद्देग पमाडनार  
सर्पना जन्मने पामे छे. ४० हे मारा संबंधीओ! ब्राह्मणे अपराध कर्यो होय तोपणे  
तेनो द्रोह करशो नहीं, ब्राह्मण मारतो होय अथवा गाणो देतो होय तोपणे तमो  
तेने निरंतर प्रणाम करजो. ४१ हुं जेम सावधान रहीने प्रत्येक समयमां ब्राह्मणोने  
प्रणाम करुं छुं, तेम तमो पणे प्रणाम करजो. आथी जे उलटो चालशे तेने हुं

ब्राह्मणार्थे ह्यपह्तो हर्तरं पातयत्यधः । अजानन्तमपि ह्येनं नृगं ब्राह्मणगौरिव ॥४३  
एवं विश्राव्य भगवान् मुकुंदो द्वारकौकसः । पावनः सर्वलोकानां विवेश निजं मंदिरम् ४४  
इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्दे उत्तरार्थं  
नृगोपाख्यानं नाम चतुःषष्ठितमोऽध्यायः ॥६४॥

## अथ पञ्चषष्ठितमोऽध्यायः (६५)

॥ श्रीशुकउवाच ॥

बलभद्रः कुरुश्रेष्ठ ! भगवान् रथमास्थितः । सुदृद्दिदृक्षुरुत्कण्ठः प्रययौ नंदगोकुलम् ॥१  
परिश्वक्तश्चिरोत्कण्ठौपैर्गोपीपीभिरेव च । रामोऽभिवाद्य पितरावाशीर्भरभिनन्दितः ॥२  
चिरं नः पाहि दाशार्ह सानुजो जगदीश्वरः । इत्यारोप्याङ्गमालिङ्गं नैतैः सिधिचतुर्जलैः ॥३  
गोपवृद्धांश्च विधिवद् यविष्टैरभिवन्दितः । यथावयो यथासम्बन्धमात्मनः ॥४  
समुपेत्याथ गोपालान् हास्यहस्तग्रहादिभिः । विश्रान्तं सुखमासीनं पप्रच्छुः पर्युपागताः ॥५

शिक्षा करीश. ४२ नहि जाणता ऐवा पणे आ नृगराजाने ब्राह्मणनी गाये जेम  
नीय अवतारमां नाख्यो. ऐज प्रमाणे बीजा हरणाना करनाराने पणे हराअेलुं  
ब्राह्मणानुं धन नीय अवतारमां नाखे छे. ४३

शुकृदेवज्ञ कहे छे हे राजा ! सर्वलोकोने पवित्र करनार मुकुंद भगवान  
आवी रीते द्वारकावासीओने संभणावी पोताना धरमां पधार्या. ४४

इति श्रीमद् महापुराणा भागवतना दशम स्कंदनो योसठमो अद्याय संपूर्ण.

## अद्याय ६५

ब्रह्मदेवज्ञाये व्रजमां जर्जने यमुनाशुने खेंस्यां.

शुकृदेवज्ञ कहे छे हे राजा ! संबंधीओने मणवानी उत्कंठाथी महा समर्थ  
बणदेवज्ञ रथमां बेसीने नंदरायना गोकुणमां गया. १ धणा काणनी उत्कंठावाणा  
गोवाणो अने गोपीओ जेमनुं आलिंगन कर्यु छे ऐवा बणभद्र माबापने पगे  
लाग्या. अने तेओ आशीर्वादथी तेमनो सत्कार कर्यो. हे यादव ! जगतना ईश्वर  
तमे अने तमारा नानाभाई धणा काण सुधी अमारुं पालन करजो. ऐम बोली  
बणभद्रने खोणामां बेसाई तथा आलिंगन करी तेमने नंद अने पशोदाए आंसुथी  
भींजवी दीधा. २-३ बणदेवज्ञ वृद्ध गोवाणोने पगे लाग्या अने पोतानी अवस्था,  
मित्रता अने संबंध प्रमाणे नानी अवस्थाना गोवाणो, ते बणदेवज्ञने पगे

पृष्ठश्चानामयं स्वेषु प्रेमगद्वया गिरा । कृष्णे कमलपत्राक्षे संन्यस्ताखिलराधसः ॥६  
कच्चिं त्रो बाथ्वा राम! सर्वे कुशलमासते । कच्चित् स्मरथ नो राम! यूं दारसुतान्विताः ७  
दिष्ट्या कंसो हतः पापो दिष्ट्या मुक्ताः सुहृजनाः । निहत्य निर्जित्य रिपून् दिष्ट्या दुर्ग समाश्रिताः ॥८  
गोप्यो हसन्त्यः पप्रच्छू रामसन्दर्शनादृताः । कच्चिदास्ते सुखं कृष्णः पुरस्त्रीजनवल्लभः ॥९  
कच्चित् स्मरति वा बन्धून् पितरं मातरं च सः । अप्यसौ मातरं द्रष्टुं सुकृदद्व्यागमिष्यति ।

अपि वा स्मरते इस्माकमनुसेवां महाभुजः ॥१०  
मातरं पितरं भ्रातृन् पतीन् पुत्रान् स्वसूरपि । यदर्थे जहिम दाशार्ह दुस्त्यजान् स्वजनान् प्रभो! ११  
ता नः सद्यः परित्यज्य गतः संछिन्नसौहृदः । कथं नु तादृशं स्त्रीभिर्न श्रद्धोयेत भाषितम् १२  
कथं नु गृहन्त्यनवस्थितात्मनो वचः कृतञ्च्य बुधाः पुरस्त्रियः ।  
गृहन्ति वै चित्रकथस्य सुन्दरस्मितावलोको च्छुसितस्मरातुरा: ॥१३॥

लाङ्गा.४ पठी आवेला गोवाणो ए हास्य अने हाथ जालवा आदिथी बण्डेवज्ञनुं सन्मान करी बेसाऽच्या, पठी विश्रांति लैहने सुभपूर्वक बेठेला बण्डेवज्ञने प्रेमथी गद्गद्वयनोवडे तेमना संबंधीओ नुं कुशण पूछ्युं, अने बलरामे पाण कमणपत्र सरभां नेत्रवाणा श्रीकृष्णने पामवा सारु, जेओ ए सर्वे विषयो छोटी दीधा हता अवा ते गोवाणो ने कुशण पूछ्युं.५६ गोवाणो ए पूछ्युं, हे बलराम! आपणा सर्वे सगा संबंधीओ कुशण छे? स्त्रीओ अने पुत्रोवाणा थयेला तमो अमने संभारो छो?७ पापी कंस भरणा पाभ्यो, संबंधीओ छूट्या अने तमो शत्रुओ ने मारी तथा शतीने द्वारकाना गढमां रह्या ए सर्वे सारुं थयुं.८ रामना दर्शनथी आदर पामेली गोपीओ ए हसतां हसतां पूछ्युं कु जेने नगरनी स्त्रीओ वडाली छे अवा श्रीकृष्ण सुधी छ?९ बंधुओ ने अने माबापने ते कोई समये संभारे छे? मोटी भुजावाणा ए भगवान पोतानी मा यशोदाने जोवा सारु एकवार पाण अहीं आवशे? अमे करेली सेवाने ते संभारे छे?१० हे यादव! हे प्रभु! मा, बाप, भाईओ, पति, पुत्रो, बहेनो अने छोटी शकाय नहीं ऐवां बीजां संबंधीओ ने पाण अमे जेने माटे छोटी दीधां हतां, ते भगवान अमारो त्याग करी गया अने तरत स्नेह तोडी नाघ्यो. अमे ईरच्छत तो तेने जतां रोकी लेत, परंतु तेमणे कहुं के, हुं तमारो ऋणी छुं, तमारा उपकारनो बदलो कटी पाण यूक्ती शर्कुं तेम नथी. त्यारे ऐवी कृष्ण स्त्री होय, के जे तेमनी भीठी भीठी वातो उपर विश्वास न मुके?११-१२ अमने आश्वर्य लागे छे के, कृतधन अने जेनुं चिता स्थिर नथी, ऐवा भगवाननां वयनोने द्वारकानी यतुर स्त्रीओ शी रीते स्वीकारती

किं नस्तत्कथया गोप्यः कथाः कथयतापराः । यात्यस्माभिर्विना कालो यदि तस्य तथैव नः इति प्रहसितं शौरेर्जल्पितं चारु वीक्षितम् । गर्ति प्रेमपरिष्वङ्गं स्मरन्त्यो रुरुदुः स्त्रियः ॥१५  
सङ्कर्षणस्ता: कृष्णस्य सदेशैर्हृदयझौमैः । सान्त्वयामास भगवान् नानानुनयकोविदः ॥१६  
द्वौ मासौ तत्र चावात्सीमधुं माधवमेव च । रामः क्षपासु भगवान् गोपीनां रतिमावहन् ॥१७  
पूर्णचन्द्रकलामृष्टे कौमुदीगन्धवायुना । यमुनोपवने रेमे सेविते स्त्रीगणैर्वृतः ॥१८  
वरुणप्रेषिता देवी वारुणी वृक्षकोटरात् । पतन्ती तद् वनं सर्वं स्वगन्धेनाध्यवासयत् ॥१९  
तं गच्छं मधुधाराया वायुनोपहतं बलः । आग्नायोपगतस्तत्र ललनाभिः समं पर्यौ ॥२०  
उपरीयमानवरितो वनिताभिर्हलायुधः । वनेषु व्यचरत् क्षीबो मदविह्वललोचनः ॥२१  
स्वग्वेककुण्डलो मत्तो वैजयन्त्या च मालया । बिभ्रत् स्मितमुखाभ्योजं स्वेदप्रालेयभूषितम् ॥२२

हशे? पाण अमो धारी ए छी ए के विचित्र वातो करनारा ए श्रीकृष्णना सुंदर हास्य पूर्वक कटाक्षो पडवाने लीघे वृद्धि पामेला कामदेवथी आतुर थईने स्वीकारती हशे.१३ (भीजु गोपीओ कहे छे.) हे गोपीओ! तेमनी वातो करवाथी आपणुं शुं वणशे? भीजु वातो करो. तेमनो समय आपणा विना जाय छे, तो आपणो समय पाण तेमना विना जाय छे. (पाण फूर्क एटलो जु छे के तेमनो काण सुभथी जाय छे अने आपणो हुः खथी जाय छे.)१४ हे राजा! आ प्रभाणे भगवानना हास्य, भाषण, सुंदर कटाक्ष, गति, प्रेम अने आलिंगनने संभारती गोपीओ रोई पडी.१५ अनेक प्रकारे समजाववामां यतुर बण्डेवज्ञ भनने भीठा लागे अवा भगवानना संदेशा आपीने तेओनी सांतवना करी.१६ बण्डेवज्ञ यैत्र अने वैशाख ए बे महिना सुधी त्यां जु रह्या. श्रीकृष्णे रास कीडा करी हती ते समयमां जे गोपीओ अत्यंत बाणक हती अने जेओ जन्मी जु न हती तेओनी साथे रात्रीओ मां रमण करता हता.१७ पूर्ण चंद्रमानां किरणोथी उज्ज्वल अने कुमुदोनी सुगंधीवाणा पवने सेवेला यमुनाज्ञना उपवनमां स्त्रीओना टोणां ओथी वीटाईने विहार करता हता.१८ ते समयमां वरुणादेवे मोकलेली वारुणी नामनी भद्रिरा देवी, वृक्षना कोतरामांथी नीये वडीने पोताना सुंगधथी ते आभा वनने सुवासित करती हती.१९ वायु ए आशेला ते भद्रिराना गंधने सुंधी बणभद्रे त्यां जैने स्त्रीओनी साथे ते भद्रिरा पीधी.२० मता, भद्री विकण नेत्रवाणा अने स्त्रीओ जेमनां चरित्रने गाती हती. ऐवा बण्डेवज्ञ वनमां फरवा लाङ्गा.२१ वैजयंती माणाने धरनार, एक कुंडणवाणा, मत अने जेमना मंदहास्यवाणा मुखारविंद उपर पसीनारूपी हिम शोभी रह्युं हतुं. ऐवा ते ईश्वर बणभद्रे जगमां कीडा

स आजुहाव यमुनां जलक्रीडार्थमीश्वरः । निजं वाक्यमनादृत्य मत्त इत्यापगां बलः ।  
अनागतां हलाग्रेण कुपितो विचकर्ष ह ॥२३  
पापे! त्वं मामवज्ञाय यन्नायासि मयाऽहुता । नेष्ये त्वां लाङ्गलाग्रेण शतधा कामचारिणीम्।  
एवं निर्भर्त्सिता भीता यमुना यदुनन्दनम् । उवाच चकिता वाचं पतिता पादयोर्नैप ! ॥२५  
राम! राम! महाबाहो! न जाने तव विक्रमम् । यस्यैकांशेन विधृता जगती जगतः पते! ॥२६  
परं भावं भगवतो भगवन्! मामजानतीम् । मोक्षुर्महसि विश्वात्मन्! प्रपन्नां भक्तवत्सल! ॥२७  
ततो व्यमुञ्चद् यमुनां याचितो भगवान् बलः । विजगाह जलं स्त्रीभिः करेणुभिरिवेभराद् ॥२८  
कामं विहृत्य सलिलादुत्तीर्णायासिताब्बरे । भूषणानि महार्हणि ददौ कान्तिः शुभां स्वजम् ॥२९  
वसित्वा वाससी नीले मालामामुच्य काञ्छनीम् । रेजे स्वलङ्घतो लिसो माहेद्र इव वारणः ॥३०  
अद्यापि दृश्यते राजन्! यमुनाऽऽकृष्टवत्सला । बलस्यानन्तवीर्यस्य वीर्यं सूचयतीव हि ॥३१  
एवं सर्वा निशा याता एकेव रमतो ब्रजे । रामस्याक्षिसचित्तस्य माधुर्यैर्वैजयोषिताम् ॥३२

इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे उत्तरार्थं  
बलदेवविजये यमुनाकर्षणं नाम पञ्चषष्ठितमोऽध्यायः ॥६५॥

करवाने माटे यमुनाज्ञने बोलाव्यां. मत्त समज्ञने पोताना वाक्यनो अनादृ  
करतां, नहीं आवेलां यमुनाज्ञने कोप पामेला बलरामे हणना अग्रथी खेंच्यां,  
अने कहुं के हे हुष्ट! में बोलाव्यां छतां मारुं अपमान करीने तुं के जे स्वर्यछंद रीते  
यालनारी छे, तेने हणना अग्रथी सैकडो विभागमां वहेंची नाभीश. २२-२४ आ  
प्रमाणे तिरस्कार थतां भयभीत थयेलां यमुनाज्ञ ध्रुज्ञने तेमना यरणमां पडीने  
बोल्यां के “हे राम! हे जगतना पति! हे महाबाहु! जे तमोअे तमारा एक अंशे  
पृथ्वीने धरी राखी छे ते तमारा पराक्रमने हुं जाणती नथी. २५-२६ हे जगदात्मा !  
हे भक्तवत्सल ! जे हुं तमारा परम स्वरूपने जाणती नथी अने शरणागत हुं,  
ते आवी भने आप छोटी देवाने योऽय छो. २७ आ प्रमाणे यमुनाज्ञ ए प्रार्थना  
करतां समर्थ बण्भद्रे तेमने छोटी दीधां, अने पछी स्त्रीओनी साथे नदीना जणमां  
पेढा. २८ पोतानी ईर्ष्ण प्रमाणे विडार करी, बण्देवज्ञ जणमांथी बहार नीक्षतां,  
लक्ष्मीज्ञ ए तेमने श्याम वख, भूत्यवान आभूषण अने सुंदर माणा आपी. २९  
श्याम वख तथा सोनानी माणा पहेरी सारी रीते अलंकृत थयेला अने जे मणे  
यंदनादिकनुं लेपन कर्युं हतुं, एवा बलराम ईंद्रना ऐरावत हाथीनी पेढे शोभवा  
लाया. ३० हे राजा ! बण्देवज्ञ ए खेंचवाने लीघे ते स्थणमां यमुनाज्ञ अद्यापि  
सुधी, अनंत पराक्रमवाणा ते बण्देवना पराक्रमने जाणे सूचवतां होय एवां

अथ पठ्पष्ठितमोऽध्यायः (६६)

॥ श्रीशुकउवाच ॥

नंदव्रजं गते रामे करुषाधिपतिर्नैप ! । वासुदेवोऽहमित्यज्ञो दूतं कृष्णाय प्राहिणोत् ॥१  
त्वं वासुदेवो भगवानवतीर्णो जगत्पतिः । इति प्रस्तोभितो बालैर्मेन आत्मानमच्युतम् ॥२  
दूतं च प्राहिणोन्मन्दः कृष्णायाव्यक्तवत्मने । द्वारकायां यथा बालो नृपो बालकृतोऽबुधः ॥३  
दूतस्तु द्वारकामेत्य सभायामास्थितं प्रभुम् । कृष्णं कमलपत्राक्षं राजसन्देशमब्रवीत् ॥४  
वासुदेवोऽवतीर्णोऽहमेक एव न चापरः । भूतानामनुकम्पार्थं त्वं तु मिथ्याभिधां त्यज ॥५  
यानि त्वमस्मच्यह्वानि मौढ्याद् बिर्भविष्य सात्वत! । त्यक्त्वैहि मां त्वं शरणं नो चेद् देहि ममाहवम्

श्रीशुक उवाच

कथनं तदुपाकर्ण्य पौण्ड्रकस्याल्पमेधसः । उग्रसेनादयः सभ्या उच्चकैर्जहसुस्तदा ॥७

सरकतां ज्ञेवामां आवे छे. ३१ आ प्रमाणे प्रजमां विष्णार करता अने गोपीओना  
विलासोथी जेमनुं चित खेंचाई गयुं हतुं, एवा बण्भद्रने सर्वे रात्रीओ एक  
रात्रीनी समान थयेली हती. ३२

इति श्रीमद् महापुराणा भागवतना दशम ऋक्यनो पांसठमो अद्याय संपूर्ण.

#### अद्याय ६६

श्रीकृष्ण भगवाने पौँड्रक सहित तेना भित्रनो डरेलो नाश.

शुक्देवज्ञ कहे छे हे राजा ! बण्भद्र नंदरायना प्रजमां गया हता. त्यां  
पछवाडे करुष देशनो राजा पौँड्रक पोताने वासुदेव समजतो हतो. तेणे भूर्भूपणाथी  
भगवाननी पासे एक दूत मोकल्यो. १ “तमेज जगतना पति भगवान वासुदेव  
अवतरेला छो” आ प्रमाणे भूर्भू लोकोअे स्तुतिथी बहेकावेलो ते पौँड्रक राजा  
पोताने विष्णु मानतो हतो. २ छोकराओ जेम रमतमां एकने राजा ठरावे छे, तेम  
भूर्भू लोकोअे विष्णु ठेरावेला ते भंद राजाए द्वारकामां अचिन्त्य मार्गवाणा  
श्रीकृष्णनी पासे दूत मोकल्यो. ३ दूते द्वारकामां आवीने, सभामां बेठेला अने  
कमणपत्र सरभां नेत्रवाणा श्रीकृष्ण भगवानने आ प्रमाणे ते राजानो संदेशो  
कह्यो. ४

दूत कहे छे प्राणीओ पर दया करवाने माटे पृथ्वी पर अवतरेलो वासुदेव  
हुं एक ज छुं, बीजो कोई वासुदेव नथी, माटे तुं खोटुं नाम छोटी हे. ५ हे यादव !  
तुं भूर्भूपणाथी जे अमारां चिन्हो धारण करे छे ते सर्वे छोटी दृष्टने मारा शरणमां

उवाच दूतं भगवान् परिहासकथामनु । उत्सवक्ष्ये मूढ ! चिह्नानि यैस्त्वमेवं विकल्पसे ॥८  
मुखं तदपिधायाज्ञ कङ्गाधृवटैर्वृतः । शयिष्यसे हतस्तत्र भविता शरणं शुनाम् ॥९  
इति दूतस्तदाक्षेपं स्वामिने सर्वमाहरत् । कृष्णोऽपि रथमास्थाय काशीमुपजगाम ह ॥१०  
पौण्ड्रकोऽपि तदुद्योगमुपलम्य महारथः । अक्षौहिणीभ्यां संयुक्तो निश्चक्राम पुराद् द्रुतम् ॥११  
तस्य काशिपतिर्मित्रं पार्षिण्याग्रेऽन्वयान्वृप् । अक्षौहिणीभिस्तिसूभिरपश्यत् पौण्ड्रकं हरिः ॥१२  
शङ्खार्थसिगदाशार्ङ्गश्रीवत्साद्युपलक्षितम् । बिभ्राणं कौस्तुभमर्णि वनमालाविभूषितम् ॥१३  
कौशेयवाससी पीते वसानं गरुडध्वजम् । अमूल्यमौल्याभरणं स्फुरन्मकरकुण्डलम् ॥१४  
दृष्टा तमामनस्तुल्यवेषं कृत्रिममास्थितम् । यथा नन्तं रङ्गातं विजहास भृशं हरिः ॥१५  
शूलरैर्गदभिः परिधैः शक्त्यृष्टिप्रासतोमरैः । असिभिः पद्मिश्रबाणैः प्राहरन्नरयो हरिम् ॥१६

आव अने अेम न करवुं होय तो मारी साथे युद्ध करे ॥६

शुकदेवज्ञ कहे छे हे राजा ! अत्यबुद्धिवाणा ते पौण्ड्रकनो बकवाए सांभणीने  
ते समयमां उत्रसेन आहि सभासदो उंचे सादे हसवा लाग्या ॥७ हसवानी वात  
पूरी थया पछी भगवाने दूतने कहुं के “हे मूढ ! तुं तारा राजाने कहेजे के जे  
यित्तोथी तुं आ प्रमाणे बके छे, ते यित्तोने हुं छोडावी दृष्टश ॥८ हे मूर्ख ! ते समयमां  
मरण पामेलो तुं जे मुखथी बडाई करे छे, ते तारा मुखने ढांकी तथा कागडा,  
गृधो अने वट नामना पक्षीओथी वीटाईने रणसंग्राममां सूर्य जैश । अने  
झूतराओनुं शरण लैश” अेम तुं तारा राजाने कहेजे ॥९

शुकदेवज्ञ कहे छे आ प्रमाणे भगवाने जे तिरस्कारनां वयनो कह्यां, ते  
पेला दूते पोताना स्वामी पौण्ड्रकनी पासे सघणां कह्यां । ते समयमां पौण्ड्रकराजा  
तेना भित्रनी नगरी काशीमां हतो । तेथी भगवान पण रथमां बेसीने काशीअे  
गया ॥१० भगवाननो उद्योग जाणीने महारथी पौण्ड्रकराजा पण बे अक्षौहिणी  
सैन्य लैने तरत काशीमांथी भहार नीकछ्यो ॥११ अनो भित्र काशीनो राजा तेनो  
पक्ष लैने त्रण अक्षौहिणी सैन्य लै तेनी पछिवाडे आव्यो । भगवाने पौण्ड्रकराजाने  
दीठो ॥१२ ऐ राजाअे शंख, यक्ष, गदा, शारंग, अने श्रीवत्स इत्यादिक धार्यां  
हतां, कौस्तुभमणि गणामां पहेयो हतो, वनमाणाथी शोभी रह्यो हतो, पीणां  
रेशभी वस्त्र पहेयां हतां, ध्वजामां गरुडनुं यित्त हतुं, मुकुट अने आभरणो अमूल्य  
हतां अने मकराकृति कुँडणो यणकतां हतां ॥१३-१४ नाटकशाणामां आवेला नटनी  
पेठे, पोताना जेवो कृत्रिम वेष धरीने आवेला ते पौण्ड्रकने जोईने भगवान खड्हु जे  
हस्या ॥१५ त्रिशूण, गदा, परिध, सांग्य, बे धारी तलवारो, भाला, तोभर, तलवार,

कृष्णस्तु तत्पैण्ड्रककाशिराजयोर्बलं गजस्यन्दनवाजिपत्तिमत् ।  
गदासिचक्रेषुभिराद्यद् भृशं यथा युगाने हुतभुक् पृथक् प्रजा: ॥१७॥  
आयोधनं तद्रथवाजिकुञ्जरद्विपत्त्वरोष्ट्ररिणावखण्डितैः ।  
बभौ चितं मोदवहं मनस्विनामाक्रीडनं भूतपतेरिवोल्बणम् ॥१८॥  
अथाह पौण्ड्रकं शौरिर्भो भो: पौण्ड्रक! यद् भवान् । दूतवाक्येन मामाह तान्यस्त्रापयुत्सृजामि ते ॥  
त्याजयिष्येऽभिधानं मे यत् त्वयाज्ञ ! मृषा धृतम् । व्रजामि शरणं तेऽद्य यदि नेच्छामि संयुगम् ॥२०  
इति क्षिप्त्वा शितैर्बाणैर्विरथीकृत्य पौण्ड्रकम् । शिरोऽवश्वद् रथाङ्गेन वज्रेणोन्नो यथा गिरे: ॥२१  
तथा काशिपते: कायच्छ्र उत्कृत्य पत्रिभिः । न्यपातयत् काशिपुर्या पद्मकोशमिवानिलः ॥२२  
एवं मत्सरिणं हत्वा पौण्ड्रकं समस्यं हरिः । द्वारकामाविशत् सिद्धैर्गार्यमानकथामृतः: ॥२३  
स नित्यं भगवद्व्यानप्रधवस्ताखिलबन्धनः । बिभ्राणश्च हरे राजन्! स्वरूपं तम्योऽभवत् ॥२४  
शिरः पतितमालोक्य राजद्वारे सकुण्डलम् । किंमिदं कस्य वा वक्त्रमिति संशिष्ये जना: ॥२५  
राजः काशिपतेज्ञात्वा महिष्यः पुत्रबान्धवाः । पौराश्च हा हता राजन्! नाथ! नाथेति प्रारुदन् ॥२६

पद्मिश्र अने बाणोथी शत्रुओ भगवान पर प्रहार करवा लाग्या ॥१७ पौण्ड्रक अने  
काशीना राजाना हाथी, घोडा, रथ अने पायदणवाणा ते सैन्यनो श्रीकृष्ण भगवाने  
जे भ प्रलयकाणमां अजिनि नो खीनो खी प्रजाओनो नाश करे ते भ गदा, तलवार,  
यक्ष अने बाणोथी खड्हु जे नाश करी नाख्यो ॥१८ यक्षी कपाअेला रथ, घोडा,  
हाथी, माणस, खर्यर अने उंटोथी व्याम थयेदुं अने वीरलोकोने आनंद आपे  
ऐवुं ते युद्धनुं स्थण रुद्रने कीडा करवाना स्थणनी पेठे भयंकर जृषातुं हतुं ॥१९  
पछी भगवाने पौण्ड्रकने कहुं के “हे पौण्ड्रक ! दूतना भोदाथी तें भने कहेवराव्युं हतुं,  
ते प्रमाणे ते शस्त्रो तारा उपर जे मूर्ख ! तें जे भारुं खोटुं नाम धर्युं  
छे ते हुं आज छोडावी दृष्टश” ॥२० आ प्रमाणे तिरस्कार करी तथा सजावेलां बाणोथी  
तेने रथ वगरनो करी, भगवाने ईंद्र जे भ वज्री पर्वतनुं शिखर कापे ते भ यक्षी  
ते पौण्ड्रकनुं माथुं कापी नाख्युं ॥२१ ऐ प्रमाणे जे काशीना राजानुं माथुं पण बाणोथी  
कापी नाखीने भगवाने ते माथाने, वायु जे भ कमणना डोडाने उडावीने पाडे ते भ  
उडावीने काशीनगरीमां पाड्युं ॥२२ आ रीते भत्सरवाणा पौण्ड्रक राजाने तथा तेना  
भित्रने मारी नाखी, सिद्धलोको जेना कथारुपी अमृतनुं गायन करता हता, ऐवा  
भगवान द्वारकामां पधार्या ॥२३ निरंतर भगवाननुं ध्यान रहेवाथी सर्वे कर्मधंधन  
धूटी गयां हतां अने भगवाननुं जे रुप धरतो हतो, तेथी ते पौण्ड्रकराजा भगवाननी  
साथे साधर्यपणाने पाभी गयो ॥२४ राजद्वारमां कुँडण सहित माथुं पडेदुं जोईने

सुदक्षिणस्तस्य सुतः कृत्वा संस्थाविधि पितुः । निहत्य पितृहन्तारं यास्याम्यपचितिं पितुः २७  
इत्यात्मनाभिसन्धाय सोपाध्यायो महेश्वरम् । सुदक्षिणोऽर्चयामास परमेण समाधिना ॥२८  
प्रीतोऽविमुक्ते भगवांस्तस्मै वरमदाद् भवः । पितृहन्तवधोपायं स वन्वे वरमीप्सितम् ॥२९  
दक्षिणाग्निं परिचर ब्राह्मणैः सममृत्विजम् । अभिचारविधानेन स चाग्निः प्रमथैर्वृतः ॥३०  
साधिष्यति सङ्कल्पमब्रह्मण्ये प्रयोजितः । इत्यादिष्टस्था चक्रे कृष्णायाभिचरन् व्रती ॥३१  
ततोऽग्निरुत्थितः कुण्डान्मूर्तिमानतिभीषणः । तमताम्रशिखाश्मशुरङ्गारोद्गारिलोचनः ॥३२  
दण्डग्रभुकुटीदण्डकठोरास्यः स्वजिह्वा । आलिहन् सृक्षिणी नग्नो विद्युन्वस्त्रिशिखं ज्वलन् ।  
पद्भ्यां तालप्रमाणाभ्यां कम्पयन्नवनीतलम् । सोऽभ्यधावद् वृतो भूतैर्द्वारकां प्रदहन् दिशः ३४  
तमाभिचारदहनमायान्तं द्वारकौकसः । विलोक्य तत्रमुः सर्वे वनदाहे मृगा यथा ॥३५

आ शुं ? अने आ भोदुं कोनुं ? ऐम लोको संशयमां पड़या. २५ पृष्ठी काशीना राजा नुं छे ऐम जाणवामां आवतां तेनी राणीओ, पुत्रो, बांधवो अने प्रजाजनो “हे राजा ! हे नाथ ! हाय, तमो मरण पामतां अभो मरी गयां” ऐम विलाप करवा लाग्यां. २६ ऐ काशी राजाना पुत्र सुदक्षिणे पितानी उत्तरकिया करीने निश्चय कर्यो के “पिताना मारनारने मारीने हुं पितानुं वेर वाणीश” २७ बुद्धिमां आवो निश्चय करीने पोताना उपध्यायोनी साथे सुदक्षिणे भोटी अेकाग्रताथी सदाशिवनुं पूजन कर्यु. २८ प्रसन्न थयेला काशीविश्वनाथे तेने वरदान मागवानुं कहेतां तेषो पोताना पिताने मारनारने मारवानो उपाय के जे पोताने जोईतो हतो ते माग्यो. २९ सदाशिवे कहुं के दक्षिणाग्नि के जे, ऋत्विजनी पेठे कहेलुं काम करनार छे. तेनुं ख्रात्मणोनी साथे अभियार (मारण प्रयोगना) विधानथी तुं पूजन कर, अने ऐम करीश तो ते भूत प्रेतादिकथी वींटाईने तारी हृच्छा पूरी करशे, पाण तेनो प्रयोग ख्रात्मणे भक्त सिवाय भीजा उपर करीश तो ज तारो संकल्प सिद्ध थशे, नहि तो विपरीत थशे. आ प्रमाणे सदाशिवे आशा करतां श्रीकृष्ण उपर अभियार करवाना नियमो तेषो लीधा. ३०-३१ ऐ नियमो लेवाथी कुंडमांथी देहधारी, महाभयंकर, तपावेला त्रांबा जेवी शिखा अने दाढी मूळवाणो तथा नेत्रमांथी अंगारा काढनारो अग्नि नीकछ्यो. ३२ ऐनुं भोदुं भारे विकरण हतुं, ज्ञभथी गलोकां चाटतो हतो, त्राण शिखावाणा बणता त्रिशूणने हलावतो हतो, ताड जेवडा बे पगथी धरतीने ध्रुज्जावतो अने नग्न हतो. भूतथी वींटाएलो अने दिशाओने बाणतो ते अग्नि द्वारका उपर दोऽयो. ३३-३४ ऐ अभियारना अग्निने आवतो जोई, जेम वन बणतां मृगो त्रास पामे, तेम सर्वे द्वारकूवासीओ त्रास पाम्यां. ३५

अक्षैः सभायां क्रीडन्तं भगवन्तं भयातुरा : त्राहि त्राहि त्रिलोकेश ! वह्नेः प्रदहतः पुरम् ॥३६  
श्रुत्वा तज्जनवैकलव्यं दृष्टा स्वानां च साध्वसम् । शरण्यः सम्प्रहस्याह मा भैष्ट्यवितास्यहम् ।  
सर्वस्यान्तर्बहिः साक्षी कृत्यां माहेश्वरी विभुः । विज्ञाय तद्विद्यातार्थं पार्श्वस्थं चक्रमादिशत् ३८  
तत् सूर्यकोटिप्रतिमं सुदर्शनं जाज्वल्यमानं प्रलयानलप्रभम् ।  
स्वतेजसा खं ककुभोऽथ रोदसी चक्रं मुकुन्दास्त्रमथाग्निमार्दयत् ॥३९॥  
कृत्यानलः प्रतिहतः स रथाङ्गपाणेरस्त्रौजसा स नृप ! भग्नमुखो निवृत्तः ।  
वाराणसीं परिसमेत्य सुदक्षिणं तं सर्त्तिगजं समदहत् स्वकृतोऽभिचारः ॥४०॥  
चक्रं च विष्णोस्तदनुप्रविष्टं वाराणसीं सादृसभालयापणाम् ।  
सगोपुराङ्गालककोष्ठसङ्कुलां सकोशहस्त्यश्वथान्नशालाम् ॥४१॥  
दग्धवा वाराणसीं सर्वा विष्णोशक्रं सुदर्शनम् । भूयः पार्श्वमुपातिष्ठृत् कृष्णस्याक्लिष्टकर्मणः ४२  
य एतच्छ्रावयेन्मर्त्यं उत्तमश्लोकविक्रमम् । समाहितो वा शृणुयात् सर्वपापैः प्रमुच्यते ॥४३  
इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे उत्तरार्थं  
पौङ्कडादिविधो नाम षट्षष्ठितमोऽध्यायः ॥६६॥

भयथी आतुर थयेला लोको ए सभामां पासाओथी रमता श्रीकृष्णने कहुं के हे त्रिलोकना नाथ ! नगरने बाणीनाखता अग्निथी रक्षण करो. ३६ लोकोनो ते गभराट सांभणीने भगवाने हसतां हसतां कहुं के भीशो नहीं, हुं रक्षा करीश. ३७ भहार अने अंदर सर्वना साक्षी भगवाने ए शिवज्ञाए भोक्लेली कृत्या छे, ऐम जाणी, नाश करवाने माटे पोताना पडभामां रहेला यक्ने आशा करी. ३८ करोऽ सूर्य जेवा प्रलयना अग्नि सरभी कंतिवाणा अने पोताना तेजथी आकाश, दशे दिशाओ, स्वर्ग तथा पृथ्वीने बहु ज प्रकाश आपता ए भगवानना अस्त्र सुदर्शन, अग्निने पीडवा लाग्यु. ३९ हे राजा ! भगवानना यक्ना तेजथी हुणाएला अने जेनुं भोदुं भांगी गयुं छे, ऐवा ए अभियारना अग्निए पाणवणी काशीमां आवीने पोताने उत्पन्न करनार सुदक्षिणने, ऋत्विज ख्रात्मणोने अने लोकोने बाणी नाख्या. ४० तेनी पृथ्वाडे सुदर्शन यक गयुं, तेषो वणी भंय, सभा, घाट, हाट, दरवाजा, अगाशीओ, भंडार, हाथीनी शाणा, अने अन्ननी शाणाओ सहित काशीने बाणी नाखीने, पाण्डुं भगवान श्रीकृष्ण पासे आव्यु. ४१-४२ जे माणस सावधान रहीने आ भगवाननुं पराक्रम संभणावे अथवा सांभणे छे. ते माणस सर्वपापोथी धूटी ज्य छे. ४३  
इति श्रीमद् महापुराणा भागवतना दशम स्कन्धनो छासठमो अद्याय संपूर्ण.

## अथ सप्तष्ठितमोऽध्यायः (६७)

॥ राजोवाच ॥

भूयोऽहं श्रोतुमिच्छामि रामस्याद्वृतकर्मणः । अनंतस्याप्रमेयस्य यदन्यत् कृतवान् प्रभुः १  
श्रीशुक उवाच

नरकस्य सखा कश्चिद् द्विविदो नाम वानरः । सुग्रीवसचिवः सोऽथ भ्राता मैन्दस्य वीर्यवान् २  
सख्युः सोऽपचितिं कुर्वन् वानरे राष्ट्रविलक्षम् । पुरग्रामाकरान् घोषानहद् वह्निमुत्सृजन् ३  
क्रचित् स शैलानुत्पाट्य तैर्देशान् समचूर्णयत् । आनर्तान् सुतरामेव यत्रास्ते मित्रहा हरिः ४  
क्रचित् समुद्रमध्यस्थो दोर्भार्यामुक्तिक्षय तज्जलम् । देशान् नागायुतप्राणो वेलाकूलानमज्जयत्  
आश्रमानृषिमुख्यानां कृत्वा भग्नवनस्पतीन् । अदूषयच्छक्खमूत्रैरग्नीन् वैतानिकान्खलः ६  
पुरुषान् योषितो दृशः क्षमाभृदद्वेणीगुहासु सः । निक्षिप्य चाप्यदाच्छैलैः पेशस्कारीव कीटकम् ७  
एवं देशान् विप्रकुर्वन् दूषयन्श्च कुलस्त्रियः । श्रुत्वा सुललितं गीतं गिरि रैवतकं यथौ ८  
तत्रापश्यद् यदुपतिं रामं पुष्करमालिनम् । सुदर्शनीयसर्वाङ्गं ललनायूथमध्यगम् ॥९

अद्याय ६७

अणदेवज्ञाए रैवतायण पर्वत उपर द्विविद नामना वानरने  
मार्यो.

परीक्षित राजा पूछे छे अद्भुत कर्म करनार, अनंत अने प्रमाणमां न आवे  
अवा बलरामे जे काँઈ बीजुं पाणे यरित्र कर्युं होय, ते पाणे हुं सांभगवा ईच्छुं छुं.<sup>१</sup>

शुकदेवज्ञ कहे छे सुश्रीवनो मंत्री, मैन्द नामना वानरनो भाई अने पराकमी  
द्विविद नामनो कोई वानर नरकासुरनो सभा हतो.<sup>२</sup> ते वानर पोताना भित्रनुं  
वैर वाणवानी ईच्छाथी देशनो नाश थई जाय ऐवी रीते पुर, गाम, खाणो अने  
प्रज्ञेमां अग्नि भूकीने तेओने बाणतो हतो.<sup>३</sup> कोई समये पर्वतोने उपाडीने गामोने  
यूर्ण करतो हतो. तेओमां आनर्त देश के जेमां तेना भित्रने मारनार भगवान  
रह्या हता, तेने तो बहु ज सतावतो हतो.<sup>४</sup> दशहजार हाथीओना भणवाणो ए  
वानर कोई समये समुद्रनी वयमां ऊभो रहीने हाथवते तेनुं जण उछाणी कांठाना  
देशने बोणी देतो हतो.<sup>५</sup> मोटा ऋषिओना आश्रमोना जाड भांगीने ए दुष्ट वानर  
यज्ञना अग्निने विष्टा अने भूत्रथी अभडावतो हतो.<sup>६</sup> जेम भमरी कीडाने दरमां  
नाखी रोकी राखे, तेम ए गर्ववाणो वानर स्त्री-पुरुषोने पर्वतोना क्रौतर अने  
गुफाओमां नाखीने ते स्थानकोने भोटी शिलाओथी ढांकी देतो हतो.<sup>७</sup> आ प्रमाणे  
देशोने दुःख हेतो अने सारा कुणनी स्त्रीओने दूषित करतो ए वानर, सुंदर

गायनं वारुणं पीत्वा मदविह्वललोचनम् । विभ्राजमानं वपुषा प्रभिन्नमिव वारणम् ॥१०  
दुष्टः शाखामृगः शाखामारुढः कम्पयन् द्रुमान् । चक्रे किलकिलाशब्दमात्मानं सम्प्रदर्शयन् ११  
तस्य धार्ष्यर्थं कपेर्वीक्ष्यं तरुणयो जातिचापलाः । हास्यप्रिया विजहसुर्बलदेवपरिग्रहः ॥१२  
ता हेलयामास कपिर्भूक्षेपैः सम्मुखादिभिः । दर्शयन् स्वगुदं तासां रामस्य च निरीक्षतः १३  
तं ग्राव्या प्राहरत् क्रुद्धो बलः प्रहरतां वरः । स वञ्चित्यित्वा ग्रावाणं मदिराकलशं कपि: १४  
गृहीत्वा हेलयामास धूर्तसं कोपयन् हसन् । निर्भिद्य कलशं दुष्टे वासांस्यास्फालयद् बलम् १५  
कदर्थीकृत्य बलवान् विप्रचक्रे मदोद्धतः । तं तस्याविनयं दृष्ट्वा देशांश्च तदुपद्रुतान् ॥१६  
क्रुद्धो मुसलमादत्त हलां चारिजिधांसया । द्विविदोऽपि महावीर्यः शालमुद्याम्य पाणिना ॥१७  
अभ्येत्य तरसा तेन बलं मूर्धन्यताडयत् । तं तु संकर्षणो मूर्धन्य पतन्तमचलो यथा ॥१८  
प्रतिजग्राह बलवान् सुनदेनाहनच्च तम् । मुसलाहतमस्तिष्को विरेजे रक्तधारया ॥१९

गायन सांभणीने रैवतक नामना पर्वतमां गयो.<sup>१</sup> ए पर्वतमां कमणीनी  
माणावाणा, सर्वे सुंदर अंगोवाणा, स्त्रीओना टोणाना भध्यमां बेठेला, वारुणी  
भदिरा पीने गायन करता, मदथी विहृण नेत्रवाणा, मद झरनारा हाथीनी पेठे  
शरीरथी शोभता बलराम तेना जोवामां आव्या.<sup>२-३</sup> ए दुष्ट वानर शाखा उपर  
चढी वृक्षोने कंपावतां पोतानुं शरीर देखाइने किंडियारी करवा लाय्यो.<sup>४</sup> युवान,  
जातिथी यपण अने जेओने हास्य वहालुं हतुं ऐवी भणदेवज्ञनी स्त्रीओ ते  
वानरनुं दुष्टपशुं जोईने हसवा लागी.<sup>५</sup> बलरामना देखतां ज ते स्त्रीओने  
पोतानी गुह्य ईंद्रियो देखाइतो ते वानर भुक्टीना ईशाराओथी अने सामे आववुं  
ए आदिथी तेओनी ठेकी करवा लाय्यो.<sup>६</sup> प्रहार करनाराओमां उत्तम बलरामे  
कोध कीरीने तेना उपर पथरो ईंक्यो. पथरो पोताने वागवा नहीं देतां धूर्त,  
बलरामने कोध यदावतो अने हसतो ए वानर भदिराना कणशने उपाडीने ठेकी  
करवा लाय्यो, मदोन्मत, धृष्ट अने भणवान ए वानरे कणशने झोडी नाखी,  
भणभद्रने नहीं गणकारतां स्त्रीओनां वस्त्रो खेंची खेंचीने फाडी नाखवा  
लाय्यो.<sup>७-८</sup> ते वानरनी ए अनीति जोईने अने तेषो उपद्रव पमाडेला देशोने  
जोईने, कोध पामेला भणदेवज्ञ ए ते शत्रुने मारी नाखवानी ईच्छाथी हण अने  
मुशण लीधां.<sup>९</sup> मोटा भणवाणा द्विविदे पाणे हाथथी शालनुं जाड उपाडी वेगथी  
भणदेवज्ञनी सामे आवी, ते जाड भणदेवज्ञना माथामां मार्यु.<sup>१०</sup> पर्वत जेवा  
भणभद्रे पोताना माथां पर पडता ते जाडने पकडी लीधुं, अने ते वानराने सुनंद  
नामना मुशणनो मार मार्यो.<sup>११</sup> मुशणथी माथुं भांगी जतां पाणे ते प्रहारने नहीं

गिरियथा गैरिकया प्रहारं नानुचिन्तयन् । पुनरन्यं समुत्क्षिप्य कृत्वा निष्पत्रमोजसा ॥२०  
तेनाहन्त् सुसंकुद्धस्तं बलः शतधाच्छिन्त । ततोऽनेन रुषा जघे तं चापि शतधाच्छिन्त ॥२१  
एवं युध्यन् भगवता भग्ने पुनः पुनः । आकृष्टं सर्वतो वृक्षान् निर्वक्षमकरोज् वनम् ॥२२  
ततोऽमुञ्चच्छिलावर्षं बलस्योपर्यमर्षितः । तत् सर्वं चूर्णयामास लीलया मुसलायुधः ॥२३  
स बाहू तालसङ्खाशौ मुष्टीकृत्य कपीश्वरः । आसाद्य रोहिणीपुत्रं ताभ्यां वक्षस्यरुजत् ॥२४  
यादवेन्नेऽपि तं दोभ्यां त्यक्त्वा मुसललाङ्गले । जत्रावभ्यर्दयत् क्रुद्धः सोऽपतद् रुधिरं वमन् ॥२५  
चकम्ये तेन पतता सटङ्गः सवनस्पतिः । पर्वतः कुरुशार्दूल ! वायुना नौरिवाभ्यसि ॥२६  
जयशब्दो नमःशब्दः साधु साधित्वं चाम्बरे । सुरसिद्धमुनीन्द्रणामासीत् कुसुमवर्षिणाम् ॥२७  
एवं निहत्य द्विविदं जगद्व्यतिकरावहम् । संस्तूयमानो भगवाञ्जनैः स्वपुरमाविशत् ॥२८

इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां सहितायां दशमस्कन्धे उत्तरार्द्धे द्विविदवधो

नाम सप्तषष्ठिमोऽध्यायः ॥६७॥

गणकारतो वानर, पर्वत जेम गेझथी शोभे तेम लोहीनी धाराथी शोभवा लाग्यो ॥१  
कोध पामेला ते वानरे फरी भीजुं जाइ उभेडी पांडडां वगरनुं करी, ते जाइथी  
बलरामने प्रहार कर्यो, ते जाइना रामे सो टूकडा कर्या ॥२० पछी कोधथी भीजुं जाइ  
बणभद्रने मार्यु, तो ते जाइना पश तेमाणे सो टूकडा कर्या । आ प्रमाणे बणभद्रनी  
साथे युद्ध करता ते वानरे वारंवार वृक्षो भांगी जतां चारे कोरथी वृक्षो घेंयी  
लઈने ते वनने वृक्ष वगरनुं करी मूळयुं । पछी कोध पामेलो ते वानर बणटेवज्जनी  
उपर पथरानी वृष्टि करवा लाग्यो । मुशणना आयुधवाणा बणटेवे ते सर्वे  
पथराओनो लीला मात्रमां भूझो करी नाघ्यो ॥२१-२२ मोटा वानर द्विविदं ताइ जेवडा  
बे हाथनी मूठीओ बणभद्रनी छातीमां मारी ॥२३ बणटेवे पश कोध करीने हण  
तथा मुशण छोडी देतां ते वानरनी हांसीमां पोताना बे हाथथी प्रहार कर्यो । ए  
प्रहारथी लोही ओकतो ते वानर पडी गयो ॥२४ हे राजा ! पाणीमां वहाण जेम  
वायुथी कुंपे तेम जगनां छिद्रो अने वनस्पतिओ सहित ए पर्वत द्विविद वानरना  
पडवाथी कुंपवा लाग्यो ॥२५ आकाशमां पुष्पनी वृष्टि करता देवो, सिद्धो अने मोटा  
मुनिओ ज्य ज्य नमः अने सारुं थयुं, सारुं थयुं अम बोलवा लाग्या ॥२६  
आ प्रमाणे जगतने दुःख देनारा द्विविद वानरने मारी, लोको द्वारा स्तुति कराता  
बणटेवज्ज द्वारकामां पधार्या ॥२७

इति श्रीमद् महापुराण भागवतना दशम स्कन्धनो सदसाठमो अद्याय संपूर्णं

अथाष्टषष्ठिमोऽध्यायः (६८)

॥ श्रीशुक उवाच ॥

दुर्योधनसुतां राजन् ! लक्ष्मणां समितिंजयः । स्वयंवरस्थामहरत् सांबो जांबवतीसुतः ॥१  
कौरवाः कुपिता ऊर्दुर्विनीतोऽयमर्भकः । कदर्थीकृत्य नः कन्यामकामामहरद् बलात् ॥२  
बध्नीतेम दुर्विनीतं किं करिष्यान्ति वृष्णायः । येऽस्मत्प्रासादोपचित्तां दत्तां नो भुज्जते महीम् ॥३  
निगृहीतं सुतं श्रुत्वा यद्येष्यन्तीह वृष्णायः । भग्नदर्पाः शमं यान्ति प्राणा इव सुसंयताः ॥४  
इति कर्णः शलो भूरियज्ञकेतुः सुयोधनः । साम्बमारेभिरे बद्धुं कुरुवद्धानुमोदिताः ॥५  
दृष्ट्वानुधावतः साम्बो धार्तराष्ट्रान् महारथः । प्रगृह्य रुचिरं चापं तस्थौ सिंह इवैकलः ॥६  
तं ते जिधृक्षवः क्रुद्धस्तिष्ठतिष्ठेति भाषिणः । आसाद्य धन्विनो बाणैः कर्णाग्रण्यः समाकिर्न् ॥७  
सोऽपविद्धः कुरुश्रेष्ठ ! कुरुभिर्युदनन्दनः । नामृष्यतदचिन्त्यार्थः सिंहः क्षुद्रमूर्गैरिव ॥८  
विस्फूर्ज्य रुचिरं चापं सर्वान् विव्याध सायकैः । कर्णादीन् षड्वरथान् वीरांस्तावद्विर्युगपत् पृथक् ॥  
चतुर्भिंश्चतुरो वाहनेकैकेन च सारथीन् । रथिनश्च महेष्वासांस्तस्य तत्तेऽभ्यपूजयन् ॥९०

अद्याय ६८

अथाष्टषष्ठिमोऽध्यायः

शुक्टेवज्ज कुहे छे हे राजा ! जांबवतीना पुत्र, युद्धमां ज्य भेणवनार सांबे  
स्वयंवरमां रहेली दुर्योधननी कुवरी लक्ष्मणानुं हरण कर्यु ॥१ कौरवो क्रोप करीने  
बोलवा लाग्या के आ विनय वगरनो छोकरो आपशेन नहीं गणकारीने जे आपशी  
कन्या ए सांबने ईश्छती न हती छितां, ते कन्याने बणत्कारथी हरी गयो छे ॥२  
माटे ए उद्धत छोकराने बांधी लो । यादवो आपशो कृपा करी आपेली पृथ्वीने  
भोगवे छे तेओ शुं करशे ? ॥३ पुत्रने पकडेलो सांबणी यादवो जो अहीं आवशो तो  
भांगेला गर्ववाणा थईने तेओ दमन करेली ईद्रियोनी पेठे शांत थई जशे ॥४ आ  
प्रमाणे बोली भिभितामहनी संभन्तिथी कर्ण, शल, भूरि, पक्षकेतु अने दुर्योधन,  
तेओ सांबने बांधवानी गोठवण करी ॥५ महारथी सांब पोतानी पाइण दोडता  
कौरवोने जोई सुंदर धनुष हाथमां लઈने सिंहनी पेठे एकलो तेओनी सामे उभो ॥६  
कोध पामेला, पकडी लेवाने ईश्छता, ‘उभो रहे, उभो रहे’ एम बोलता, ए  
कर्णादिक धनुषधारीओ सांबनी पासे पहोंचीने तेना उपर बाण वरसाववा  
लाग्या ॥७ हे राजा ! तुष्य मृगो द्वारा ताडन करायेलुं सिंहनुं बच्युं जेम सहन करी  
शके नहि, तेम कौरवो ए वींधेलो, अने यादवोने राजा करनार श्रीकृष्णनो पुत्र ते  
सहन करी शक्यो नहीं ॥८ वीर सांबे पोताना सुंदर धनुषनो टंकार करी

तं तु ते विरथं चक्रुश्वत्वारश्वतुरो ह्यान् । एकस्तु सारथिं जघे चिच्छेदान्यः शरासनम् ॥१  
तं बद्ध्वा विरथीकृत्य कृच्छ्रेण कुरवो युधिः । कुमारं स्वस्य कन्यां च स्वपुरं जयिनोऽविशन् ॥२  
तच्छुत्वा नारदोक्तेन राजन् ! सज्जातमन्यवः । कुरुन् प्रत्युद्यमं चक्रुग्रसेनप्रचोदिताः ॥३  
सान्त्वयित्वा तु तान् रामः सन्नद्धान् वृष्णिपुङ्कवान् । नैच्छत्कुरुणां वृष्णीनां कर्लिकलिमलापहः  
जगाम हस्तिनपुरं रथेनादित्यवर्चसा । ब्राह्मणैः कुलवृद्धैश्च वृतश्चन्द्र इव ग्रहैः ॥५  
गत्वा गजाह्वयं रामो ब्राह्मोपवनमास्थितः । उद्धवं प्रेषयामास धृतराष्ट्रं बुभुत्सया ॥६  
सोऽभिवन्द्याम्बिकापुत्रं भीष्मं द्रोणं च ब्राह्मिकम् । दुर्योधनं च विधिवद् रामामागतमब्रवीत् ॥७  
तेऽतिप्रीतास्तमाकण्ठं प्राप्तं रामं सुहत्तमम् । तमर्चियित्वाभियुः सर्वे मङ्गलपाणयः ॥८  
तं सङ्घम्य यथान्यायं गमर्थ्यं च न्यवेदयन् । तेषां ये तत्प्रावक्त्वाः प्रणेमुः शिरसा बलम् ॥९  
बन्धून् कुशलिनः श्रुत्वा पृष्ठा शिवमनामयम् । परस्परमथो रामो बभाषेऽविक्लवं वचः ॥१०

भीष्मपितामहं सहित, ए छ महारथीओने एक सामटा प्रत्येकने छ छ भाषथी  
प्रहार कर्योऽयार भाषथी तेओना यार घोडाओने, एक भाषथी एक सारथीने  
अने एक भाषथी रथमां बेसनाराओने वींधी नाख्या. ए सांभना कर्मने छ ए  
महारथीओ अभिनंदन आपवा लाख्या. १० पछी ए छ व्यक्तिओ ए सांभने रथ  
विनानो कर्यो. यार जणाए यार घोडा मारी नाख्या, एके सारथिने मारी नाख्यो  
अने एके धनुष कापी नाख्युं. ११ कौरवो युद्धमां धणा परिश्रमथी ते सांभने रथ  
वगरनो करी, बांधी लेतां जय मेणवीने तेने तथा पोतानी कन्याने लઈने पोताना  
पुरमां गया. १२ हे राजा ! नारदज्ञना कहेवाथी आ वात सांभणवामां आवतां  
कोध पामेला अने उग्सेन राजाए प्रेरेला यादवो कौरवो उपर लडाई करवा  
तत्पर थया. १३ पश कणियुगना भेलने टाणनार बणदेवज्ञ कौरवो अने यादवो  
वय्ये कजियो वधवामां राज्ञ न हता, तेथी सज्ज थयेला मोटा मोटा यादवोनी  
सांत्वना करी, सूर्य सरभा तेजस्वी रथमां बेसी हस्तिनापुर गया. ग्रहोवडे जेम  
यंद्रभा वींटाएलो रहे तेम ब्राह्मणोथी अने कुणना वृद्ध पुरुषोथी वींटाएला ते  
बणदेवज्ञ हस्तिनापुरमां जईने बहारनी वारीमां ऊतर्या, त्यां रहीने अभिप्राय  
जाणवा सारु तेमणे उद्धवज्ञने धृतराष्ट्रनी पासे मोकल्या. १४-१५ धृतराष्ट्र, भीष्म,  
द्रोषा, बाल्हिक अने दुर्योधनने रीति प्रभाषो प्रशाम करी, उद्धवज्ञ ए बणदेवज्ञ  
आव्याना समाचार आप्या. १६ पोताना परम स्नेही रामने आव्या सांभणी बहु  
ज राज्ञ थयेला ते कौरवो उद्धवज्ञनो सत्कार करी हाथमां भेट देवानी उतम  
वस्तुओ लईने बणभद्रनी पासे गया. १८ तेने यथा योग्य रीते मणीने गाय तथा

उग्सेनः क्षितीशेशो यद् व आज्ञापयत् प्रभुः । तदव्यग्रधियः श्रुत्वा कुरुध्वं माविलम्बितम् ॥१  
यद् यूयं बहवस्त्वेकं जित्वाधर्मेण धार्मिकम् । अबधीनीताथ तम्भृष्ये बन्धूनामैक्यकाम्यया ॥२  
वीर्यशौर्यबलोन्नद्धमातशक्तिसमं वचः । कुरवो बलदेवस्य निशम्योचुः प्रकोपिताः ॥२३  
अहो महच्चित्रमिदं कालगत्या दुरत्यया । आरुक्षत्युपानद् वै शिरो मुकुटसेवितम् ॥२४  
एते यौनेन सम्बद्धाः सहस्र्यासनाशनाः । वृष्णयस्तुल्यतां नीता अस्मद्वत्तनृपासनाः ॥२५  
चामरव्यजने शङ्खमातपत्रं च पाण्डुरम् । किरीटमासनं शश्यां भुज्जन्यस्मदुपेक्षया ॥२६  
अलं यद्वानां नरदेवलाज्ञैर्दीर्तुः प्रतीपैः फणिनामिवामृतम् ।

येऽस्मत्प्रसादोपचिता हि यादवा आज्ञापयन्त्यद्य गतत्रया बत ॥२७॥

कथमिन्द्रोऽपि कुरुभिर्भिर्द्रोणार्जुनादिभिः । अदत्तमवरुच्यीत सिंहग्रस्तमिवोरणः ॥२८

अर्धनुं निवेदन कर्युं. तेमां जेओ बणभद्रना प्रभावने जाणता हता तेओ ए  
मस्तकवडे बणभद्रने प्रशाम कर्या. १८ परस्पर कल्याण तथा आरोग्य पूछी  
संबंधीओनुं कुशण सांभणी, पछी बणदेवज्ञ ए आ प्रभाषे तेज भरेलुं वयन  
कह्युं. २०

बणदेवज्ञ कहे छे महाराजाधिराज उग्सेने तमोने जे आज्ञा करीछे ते  
सावधान पशाथी सांभणीने ते प्रभाषे करो, विलंब करशो नहीं. २१ उग्सेने कह्युं  
छे के तमो ए धणा जणा भेगा थई अधर्म करीने धर्मवाणा अमारा बाणकने  
ज्ञती लई बांधी लीधो छे, तोपश संबंधीओमां संप राखवानी ईच्छाथी ते वात  
हुं सहन करुं छुं, तो हवे ए बाणकने छोटी आपो. २२

शुकदेवज्ञ कहे छे हे राजा ! प्रभाव, उत्साह अने बणने लीधे उच्छ्रुंभल  
तथा पोतानी शक्तिने योग्य बणदेवज्ञनुं वयन सांभणी कोप पामेला कौरवो  
बोल्या के २३ “अहो ! काणनी दुरंत गतिथी आ मोटुं आश्र्य थयुं छे के मुकुटे  
सेवेला मस्तक उपर जोडा यडवा ईच्छे छे. २४ आ यादवो कुंतीना विवाहने लीधे  
आपणी साथे संबन्धवाणा थया छे, ए यादवोने राज्यासन आपी तथा शश्या,  
आसन अने भोजन आपणी साथे करवा आपीने तेओ आपणे आपणा जेवा  
कर्या छे. २५ आपणे आग्रह राखता नथी, तेथी ज आ यादवो चामर, वींजणा,  
शंभ, धोणुं छत्र, किरीट, आसन अने शश्याने भोगवे छे. २६ खेदनी वात छे के  
आपणी कृपाथी वधेला यादवो आज निर्लज्ज थईने आपणा उपर आज्ञा करे  
छे. सर्पोने पायेलुं दूध जेम पानारनुं ज भूंदुं करे, तेम यादवोने आपणे आपेलां  
राज्यित्व के जेओथी आपणुं ज अवणुं थाय छे. माटे ते हवे हरी लेवां जोईअ. २७

## श्रीशुक उवाच

जन्मबन्धुश्रियोन्रद्वमदास्ते भरतर्षभ !। आश्राव्य रामं दुर्वच्यमसभ्या: पुरमाविशन् ॥२९  
 दृष्ट्वा कुरुणां दौःशील्यं श्रुत्वावाच्यानि चाच्युतः । अवोचत् कोपसंब्द्यो दुष्प्रेक्ष्यः प्रहसन् मुहुः  
 नूनं नानामदोन्रद्वा: शान्तिं नेच्छन्त्यसाधवः । तेषां हि प्रशमो दण्डः पशूनां लगुडो यथा ३१  
 अहो यदून् सुंसरब्धान् कृष्णं च कुपितं शनैः । सान्त्वयित्वा हमेतेषां शममिच्छन्निहागतः ३२  
 त इमे मन्दमतयः कलहाभिरताः खलाः । तं मामवज्ञाय मुहुर्द्भाषान् मानिनोऽब्रुवन् ॥३३  
 नोग्रसेनः किल विभुर्भेजवृष्ययन्तकेश्वरः । शक्रादयो लोकपाला यस्यादेशानुवर्तिनः ॥३४  
 सुधर्माऽऽक्रम्यते येन पारिजातोऽमराङ्गिष्यः । आनीय भुज्यते सोऽसौ न किलाध्यासनार्हणः ३५  
 यस्य पादयुगं साक्षात् श्रीरूपास्तेऽखिलेश्वरी । स नार्हति किल श्रीशो नरदेवपरिच्छदान् ३६  
 भीष्म, द्रोषु अने अर्जुनादिकं क्षैरवोऽस्ते जे न आपेलुं होय तेने ईन् पशु केम लृष्ट  
 शके ? जे भ सिंहनो क्रोणियो बक्कुं छीनवी शके नहि, तेम आपशा आप्या विना  
 यादवो राज्यिनो छीनवी शके नहि.<sup>२८</sup>

शुकदेवज्ञ कुहे छे हे राजा ! जन्म बंधु अने लक्ष्मीथी भद्रोन्मत थयेला ए  
 असभ्य लोको बण्ठेवज्ञने आवां दुर्वयनो संभणावी हस्तिनापुरमां गया.<sup>२९</sup>  
 क्षैरवोनो दुष्टस्वभाव ज्ञेईने अने तेओनां दुर्वयन सांभणीने कोपना वेगमां  
 आवेला अने तेने लीधे सामुं ज्ञेई शकाय नहीं एवा बलराम वारंवार हसीने  
 आप्रमाणे बोल्या.<sup>३०</sup>

बण्ठेवज्ञ बोले छे अनेक प्रकारना भद्रोथी छकेला नीय पुरुषो शांतिने  
 ईर्ष्ये ज नहीं. पशुओ जे भ लाकडीथी ज शांत थाय तेम एवा लोको दंडथी ज  
 पांशरा थाय.<sup>३१</sup> अहो ! बहु ज वेगमां आवेला यादवोने अने कोप पामेला  
 श्रीकृष्णने धीरेधीरे समजावी, भन्ने वय्ये समाधान करवानी ईर्ष्याथी हुं अहीं  
 आव्यो, पशु मंदबुद्धिवाणा, कजियामां प्रीति राखनारा, अभिमानी अने  
 खण्ठा भरेला आ लोको मार्ण अपमान करीने वारंवार न बोलवानां वयनो  
 बोली गया ! !<sup>३२-३३</sup> भोज, वृष्णि अने अंधकुण्णना स्वाभी उग्रसेन के जेनी  
 आशामां ईद्रादिकं लोकपाणो पशु वर्ते छे, तेमने आ लोको तो राजा ज गणता  
 नथी !<sup>३४</sup> जे कृष्णो देवताओनी सुधर्मा सभा पोताने आधीन करी छे अने  
 देवताओना वृक्ष पारिज्ञातकने पशु स्वर्गमांथी लावीने जे भोगवे छे, ते तो आ  
 लोकोना मनमां सिंहासनने योग्य ज नथी.<sup>३५</sup> सर्व जगतनी ईश्वरी साक्षात् लक्ष्मी  
 पशु जेनां यरणाने सेवे छे, एवा लक्ष्मीना पति श्रीकृष्ण आ लोकोना मनमां

यस्याङ्गिष्ठपङ्कजरजोऽखिललोकपालैर्मौल्युत्तमैर्धृतमुपासितीर्थतीर्थम् ।

ब्रह्मा भवोऽहमपि यस्य कलाः कलायाः श्रीशोद्वेषम चिरमस्य नृपासनं क्र ॥३७  
 भुजते कुरुभिर्दत्तं भूखण्डं वृष्णायः किल । उपानहः किल वयं स्वयं तु कुरवः शिरः ३८  
 अहो ऐश्वर्यमत्तानां मत्तानामिव मानिनाम् । असम्बद्धा गिरो रूक्षाः कः सहेतानुशासिता ३९  
 अद्य निष्कौरवीं पृथ्वीं करिष्यामीत्यर्थितः । गृहीत्वा हलमुत्तस्थौ दहन्निव जगत्त्रयम् ॥४०  
 लाङ्गलाग्रेण नगरमुद्विदार्य गजाह्वयम् । विचकर्ष स गङ्गायां प्रहरिष्यन्नर्मर्षितः ॥४१  
 जलयानमिवाधूर्ण गङ्गायां नगरं पतत् । आकृष्यमानमालोक्य कौरवा जातसम्भ्रमाः ४२  
 तमेव शरणं जग्मुः सकुट्म्बा जिजीविषवः । सलक्षणं पुरस्कृत्य साम्बं प्राज्जलयः प्रभुम् ४३  
 राम! रामाखिलाधार प्रभावं न विदाम ते । मूढानां नः कुबुद्धीनां क्षन्तुमर्हस्यतिक्रमम् ॥४४  
 स्थित्युत्पत्त्यप्ययानां त्वमेको हेतुर्निराश्रयः । लोकान् ऋडनकानीश! ऋद्वित्से वदन्ति हि ४५  
 त्वमेव मूर्धनीदमनन्त लीलया भूमण्डलं बिर्भविं सहस्रमूर्धन् ।

अन्ते च यः स्वात्मनि रुद्धविश्वः शेषेऽद्वितीयः परिशिष्यमाणः ॥४६॥

राज्यिनोने धारण करवाने योग्य ज नथी.<sup>३६</sup> गंगाङ्गाज्ञने पशु तीर्थपाणुं आपनार  
 एवां जे भना यरणारविंदनी २४ने सर्वे लोकपाणो पोताना उत्तम मुकुटो उपर  
 धरे छे, अने ब्रह्मा, शिव, लक्ष्मी तथा हुं पशु जे भना अंशना अंशरूप अने  
 यरणरज्ञने अनादिकाणी धारण करनारा छीअे, ते भगवानने राज्यासन  
 क्यांथी ज होय.<sup>३७</sup> क्षैरवोऽस्ते आपेला पृथ्वीना कटकाने यादवो भोगवे छे ! अमो  
 पगरभां छीअे!<sup>३८</sup> अहो ! मदिरा पीनारनी पेठे ऐश्वर्यथी भत थयेला अभिमानी  
 लोकोनी असंबद्ध अने कठोर वाणीने शिक्षा करवानुं सामर्थ्य धरावनार क्यो  
 पुरुष सहन करे ? आज हुं पृथ्वीने क्षैरवो वगरनी करी नाखीश.<sup>३९</sup>

शुकदेवज्ञ कुहे छे आ प्रमाणे जाषे जगतने बाणवा धारता होय तेम कोध  
 पामेला बण्ठेवज्ञ हाथमां हण लाईने उठाया.<sup>४०</sup> बण्ठेवज्ञ हणना अग्रभागथी  
 हस्तिनापुरने उभेषी गंगाङ्गाज्ञमां झेंकी देवा सारु खेंच्युं.<sup>४१</sup> हस्तिनापुरने खेंचातुं  
 गंगाङ्गाज्ञमां पडतुं अने वहाणनी पेठे हालतुं ज्ञेईने क्षैरवो गभराया.<sup>४२</sup> २ कुटुंब  
 सहित ज्ञववाने ईर्ष्यता क्षैरवो, लक्ष्मणा सहित सांभने आगण करी, हाथ  
 जोडीने बण्ठेवज्ञना शरणे गया.<sup>४३</sup>

क्षैरवो कुहे छे हे बलराम ! तमारा प्रभावने अमो जाणता नथी. जे अमो  
 मूढ अने कुबुद्धिमान छीअे. ते अमारा अपराधनी क्षमा करवी ज्ञेईअे.<sup>४४</sup>  
 जगतनी उत्पत्ति, स्थिति अने प्रलयना कारणरूप तमे ज छो. हे ईश्वर ! आ सर्व

कोपस्तेऽखिलशिक्षार्थं न द्वेषान्नं च मत्सरात् । बिभ्रतो भगवन्! सत्त्वं स्थितिपालनतत्परः ४७  
नमस्ते सर्वभूतात्मन्! सर्वशक्तिधराव्यय! । विश्वकर्मन्! नमस्तेऽस्तु त्वां वयं शरणं गताः ४८

## श्रीशुक उवाच

एवं प्रपत्नैः संविग्नैर्वेपमानायनैर्बलः । प्रसादितः सुप्रसन्नो मा भैष्टेयभयं ददौ ॥४९  
दुर्योधनः पारिबर्ह कुञ्जरान् षष्ठिरायनान् । ददौ च द्वादशशतान्ययुतानि तुरङ्गमान् ॥५०  
रथानां षट्सहस्राणि रौक्माणां सूर्यवर्चसाम् । दासीनां निष्ककण्ठीनां सहस्रं दुहितृवत्सलः ५१  
प्रतिगृह्य तु तत् सर्व भगवान् सात्वतर्षभः । समुत्तः सस्तुषः प्रागात् सुहृद्दिरभिनन्दितः ॥५२

ततः प्रविष्टः स्वपुरं हलायुधः समेत्य बन्धूननुरक्तघेतसः ।

शशंस सर्व यदुपुङ्गवानां मध्ये सभायां कुरुषु स्वचेष्टितम् ॥५३॥

अद्यापि च पुरं हेतत् सूचयद् रामविक्रमम् । समुन्नतं दक्षिणातो गङ्गायामनुदृश्यते ॥५४॥

इति श्रीमद्भागवते महापुराणे पारमहस्यां सहितायां दशमस्कन्धे उत्तरार्थं  
हास्तिनपुरकर्षणरूपसङ्कर्षणविजये नामाष्ट षष्ठितमोऽध्यायः ॥६८॥

लोको कीडा करनार आपना रमकडांउप छे, एम तमोने यथार्थ ज्ञानारा पुरुषो  
कुहे छे.<sup>४५</sup> हे अनंत! हे हजार भस्तकवाणा! तमे ज आ भूमंडणे एक भस्तक  
उपर धरी रह्या छो अने प्रलयकाणमां पोताना स्वरुपमां जगतनो लय करी,  
अद्वितीय अने अवशेष रहेनारा तमे ज शेषनाग पर पोढो छो.<sup>४६</sup> हे महाराज!  
आप तो सत्वगुणने धरनारा छो ते आपनो कोप देखथी के मत्सरथी होतो नथी,  
पश शर्वने शिखामणा देवाने माटे होय छे अने तेनुं तात्पर्य जगतना रक्षणा माटे  
होय छे.<sup>४७</sup> हे सर्वपदार्थोना आत्मा! हे सर्व शक्तिओने धरनार! हे अविनाशी!  
अमे तमारे शरणे आवेला छीये अने तमोने प्रणाम करीये छीये.<sup>४८</sup>

शुकदेवज्ञ कुहे छे आ प्रमाणे शरणागत, उद्देग पामेला अने जेओनुं नगर  
धूजतुं हतुं ऐवा कौरवोअे प्रसन्न करला बणदेवज्ञाए “‘भीशो मा” एम कहीने  
अभयदान आप्युं.<sup>४९</sup> दुर्योधने प्रेमने लीधे साठ साठ वर्धना बारसो हाथी,  
दशहजार घोडा, सोनाना सूर्य सरभा तेजस्वी छहजार रथो अने जेओना कंठमां  
सोनानी कंठीओ पहेरावी हती. ऐवी एकहजार दासीओ पोतानी दीकरीने  
आपी.<sup>५०-५१</sup> यादवोमां उत्तम अने संबंधीओअे मान आपेला बलराम ए सर्वे  
लई दीकरा अने वहुनी साथे त्यांथी चाल्या.<sup>५२</sup> पछी बलरामे द्वारकामां आवी  
स्नेह भरेला संबंधीओने भणी, मुख्य यादवोनी सभामां कौरवो साथेनी सर्वे

अथ एकोनसप्तिमोऽध्यायः (६९)

॥ श्रीशुक उवाच ॥

नरकं निहतं श्रुत्वा तथोद्वाहं च योषिताम् । कृष्णोनैकेन बहीनां तत् दिवृक्षुः स्म नारदः ॥१  
चित्रं बतैतदेकेन वपुषा युगपत् पृथक् । गृहेषु द्व्यष्टसाहस्रं स्त्रिय एक उदावहत् ॥२  
इत्युत्सुको द्वारवर्तीं देवर्षिद्रष्टुमागमत् । पुष्पितोपवनारामद्विजालिकुलनादिताम् ॥३  
उत्फुल्लेन्दीवराभ्योजकहारकुमुदोत्पलैः । छुरितेषु सरस्सूच्यैः कूजितां हंससारसैः ॥४  
प्रासादलक्ष्मैर्नवभिर्जुष्टां स्फाटिकराजतैः । महामरकतप्रख्यैः स्वर्णरत्नपरिच्छदैः ॥५

विभक्तरथ्यापथचत्वरापणः शालासभाभी रुचिरां सुरालयैः ।

संसिक्तमार्गाङ्गणवीथिदेहलीं पतत्पताकाध्वजवारितातपाम् ॥६॥

तस्यामन्तःपुरं श्रीमद्वर्चितं सर्वधिष्यपैः । हरे: स्वकौशलं यत्र त्वष्टा कात्पूर्येन दर्शितम् ७

पोतानी वर्तशुकनी वात कही देखाइ.<sup>५३</sup> बणदेवज्ञाना पराकर्मने सूचवतुं ए  
हस्तिनापुर हजु सुधी पश दक्षिणा दिशानी कोर उंचुं अने गंगाज्ञनी कोर ढणतुं  
देखाय छे.<sup>५४</sup>

इति श्रीमद्भापुराण भागवतना दशम स्कन्धनो अक्षसठमो अद्याय संपूर्णः ।

## अद्याय ६८

दरेक रातुनिना धरभां भगवानने जोઈने नारदशु चाश्वर्यं पाम्या.

शुकदेवज्ञ कुहे छे हे राजा! नरकासुरने भार्यो सांभणी तथा श्रीकृष्णो करेलो  
धशी स्त्रीओ साथेनो विवाह सांभणी, नारदज्ञने ते जोवानी ईरच्छा थई.<sup>१</sup> आश्वर्य  
छे! के एक शरीरथी एक समयमां ज नोभानोभां धरोमां एक श्रीकृष्ण सोणहजार  
स्त्रीओने पराया.<sup>२</sup> आ जोवानी उत्कंठाथी नारदज्ञ द्वारकामां आव्या. त्यां फूलवाडी  
बगीचा अने वाडीओमां पक्षीओ अने भ्रमराओनां टोणां नाद करी रह्यां हतां.<sup>३</sup>  
भीली रहेलां ईदीवर, अंभोज, कल्हार, कुमुद अने उत्पलोथी घेराई रहेलां  
तणावोमां हंस अने सारसो उंच्या स्वर करी रह्यां हतां.<sup>४</sup> स्फटिकना, रुपाना,  
मोटा मरकत मणिथी शोभी रहेला अने सुवर्ण तथा रत्नजित रासरथीलावाणा  
नव लाख महेलो दीपी रह्या हता.<sup>५</sup> जुदा जुदा राजमार्ग, योवाटा, भजार, शाणा,  
सभा अने देवभंटिरो शोभी रह्यां हतां. मार्ग, आंगणां, गलीओ अने डेलीओमां  
पाणी छांट्यां हतां. उडती धज्ञ अने पताकाओथी तडकानुं निवारण थतुं हतुं.<sup>६</sup>  
ऐ द्वारकामां सुशोभित, सर्व लोकपाणोअे पूजेल सोणहजार धरोथी दीपी रहेल

तत्र षोडशभिः सद्वसहस्रैः समलंकृतम् । विवेशैकतमं शौरे: पतीनां भवनं महत् ॥८  
विष्टब्धं विद्वमस्तम्भैर्वेदूर्धफलकोत्तमैः । इन्द्रनीलमयैः कुड्यैर्जगत्या चाहतत्विषा ॥९  
वितानैर्निर्मितैस्त्वष्ट्रा मुक्तादामविलम्बिभिः । दान्तैरासनपर्यङ्कैर्मण्युत्तमपरिष्कृतैः ॥१०  
दासीभिर्निष्ककण्ठीभिः सुवासेभिरलंकृतम् । पुम्भिः सकञ्चुकोष्णीषसुवस्त्रमणिकुण्डलैः  
रत्नप्रदीपनिकरद्युतिभिर्निरस्तथान्तं विचित्रवलभीषु शिखणिडनोऽङ्गः ।  
नृत्यन्ति यत्र विहितागुरुधूपमक्षर्निर्यान्तमीक्ष्य घनबुद्धय उन्नदन्तः ॥१२॥  
तस्मिन् समानगुणस्तपवयस्मुवेषदासीसहस्रयुतयानुसवं गृहिण्या ।  
विग्रो ददर्श चमरव्यजनेन रुक्मदण्डेन सात्वतपर्ति परिवीजयन्त्या ॥१३॥  
तं सन्निरीक्ष्य भगवान् सहसोत्थितः श्रीपर्यङ्कृतः सकलधर्मभृतां वरिष्ठः ।  
आनन्द्य पादयुगलं शिरसा किरीटजुष्टेन साञ्जलिरवीविशदासने स्वे ॥१४॥  
तस्यावनिज्य चरणो तदपः स्वमूर्धार्बिभ्रज्जगद्गुरुतरोऽपि सतां पतिर्हि ।  
ब्रह्मण्यदेव इति यद्गुणनाम युक्तं तस्यैव यच्चरणशौचमशेषतीर्थम् ॥१५॥

अने जेमां विश्वकर्माए पोतानुं सर्व उदापणा देखाइयुं हतुं, ऐवा भगवाननी स्त्रीना कोई अेक भोटा अंतःपुरमां नारदज्ञ गया.<sup>७८</sup> ए घरमां वेदूर्धभिणिनां उत्तम पाटियांवाणा थांभला लागी रह्या हता. ईनीलभिणी भीतो अने अंधं उत्तिवाणी नीलभिणी पृथ्वी, विश्वकर्माए निर्माण करेलां भोतीनी माणाना लटकणियांवाणा यंदरवा, उत्तम भिणीथी जडेलां दांतनां आसन अने पलंग, सारां वस्त्रवाणी अने गणामां सोनानी कंठीओ पहेरनारी दासीओ अने जूलडी, पाधीओ, सारां वस्त्र तथा भिणिनां कुंडणवाणा पुरुषोथी ए घर शोभी रह्युं हतुं.<sup>७९</sup> रत्नना अनेक दीवाओनी कंतिथी अंधकार देखातो ज न हतो. ए घरमां जाणियामांथी नीकणता अगरुना धूपने ज्ञेई, तेने भेघ जाणी उंचो नाद करता भयूरो विचित्र छाजलीओ पर नाचता हता.<sup>८०</sup> ए घरमां सर्व कणामां पोताना सरभा ज गुण, दृप अने अवस्थावाणी तथा सारा वेषवाणी हजारो दासीओ सहित रुक्मिणीज्ञ सोनानी ढांडीवाणुं यमर लઈने जेने पवन ढोणतां हतां, ऐवा श्रीकृष्ण भगवानने नारदज्ञाए दीठा.<sup>८१</sup> नारदज्ञने ज्ञेई सर्व धर्मधारीओमां उत्तम श्रीकृष्ण भगवाने तरत रुक्मिणीना पलंग परथी उठी, किरीटवाणा भस्तकथी नारदज्ञना यरणमां प्रणाम करी, हाथज्ञेईने पोताना आसन पर बेसाइया.<sup>८२</sup> सत्पुरुषोना पति अने जेमना यरण धोवानुं जण सर्व तीर्थदृप छे, ऐवा भगवाने पोते जगतमां सर्वोत्तम होवा छतां पश नारदज्ञनां

सम्पूज्य देवत्रष्टविर्यमृषिः पुराणो नारायणो नरसखो विधिनोदितेन ।  
वाण्याभिभाष्य मितयामृतमिष्टया तं प्राह प्रभो ! भगवते करवामहे किम् ॥१६॥  
नारद उवाच  
नैवाद्गुतं त्वयि विभोऽखिललोकनाथे मैत्री जनेषु सकलेषु दमः खलानाम् ।  
निःश्रेयसाय हि जगत्तिथितरक्षणाभ्यां स्वैरावतार ऊरुगाय विदाम सुष्टु ॥१७॥  
दृष्टं तवाद्विद्ययुगलं जनतापवर्ग ब्रह्मादिभिर्हिंदि विचिन्त्यमगाधबोधैः ।

संसारकूपपतितोत्तरणावलम्बं ध्यायंश्शराम्यनुगृहाण यथा स्मृतिः स्यात् ॥१८॥  
ततोऽन्यदाविशद् गेहं कृष्णपत्न्याः स नारदः । योगेश्वरेश्वरस्याङ्ग! योगमायाविवित्सया ॥१९  
दीव्यन्तमक्षेस्तत्रापि प्रियया चोद्वेन च । पूजितः परया भक्त्या प्रत्युथानासनादिभिः २०  
पृष्ठश्शाविदुषेवासौ कदाऽऽयातो भवानिति । क्रियते किं नु पूर्णानामपूर्णैरस्मदादिभिः ॥२१  
यरण धोईने तेनुं जण पोताना माथा पर यद्गाव्युं, पोतानुं गुण उपरथी थयेलुं  
'ब्रह्माण्यटेव' ए नाम सार्थक कर्यु.<sup>८३</sup> नरना सभा अने जुना ऋषि नारायण  
भगवाने नारदनुं पूजन करी तथा थोडा अक्षरवाणी अने अमृतनी पेठे भीठी  
वाणीथी भोलावीने कह्युं के हे महाराज ! पूज्य ऐवा तमारा माटे अमो शुं ईष्ट  
करीये.<sup>८४</sup>

नारदज्ञ कहे छे हे विभु ! हे सर्वलोकना नाथ ! हे वेदथी गवाएला ! आप सर्व सज्जनो उपर स्नेह राखो छो, अने खण्पुरुषोने शिक्षा करो छो ए कांઈ आश्र्य नथी; केमके जगतनुं धारणा, पालन अने कल्याण करवाने माटे ज आ आपनो ईर्ष्यावतार छे, ए अमे सारी रीते जाणीये छीये.<sup>८५</sup> आपनां यरण के जे लोकोने मोक्षरूप, अगाध ज्ञानवाणां, ब्रह्मादिकोये पश वृद्धमां ध्यान करवा योग्य अने संसाररूपी झूवामां पडेलाओने बहार नीकणवाना आश्रयरूप छे, ते यरणानां मने दर्शन थयां तो हवे मने आपनुं स्मरण रहे ऐवो अनुग्रह करो के जेथी यरणानुं ज ध्यान करीने फर्या करु.<sup>८६</sup>

शुक्टेवज्ञ कहे छे हे राजा ! पछी ते नारदज्ञ भगवाननी योगमायाने जाणवा सारु भगवाननी भीज्ञ स्त्रीना घरमां गया.<sup>८७</sup> त्यां पश घारी अने उद्भवनी साथे पासानी कीडा करता भगवानने दीठा. भगवाने परम भक्तिथी उभा थई तथा आसनादिक आपीने नारदज्ञनी पूजा करी अने जाणे अजाण्या होय तेम पूछ्युं के "आप क्यारे पधार्या छो ? मारा जेवा अपूर्ण लोकोथी आप जेवा पूर्ण लोकोनुं शुं काम थई शके ? तोपश हे महाराज ! जे काम होय ते कहो,

अथापि ब्रूहि नो ब्रह्मन् जन्मैतच्छेभनं कुरु । स तु विस्मित उत्थाय तृष्णीमन्यदगाद् गृहम् २२ तत्राप्यचतुर्ष गोविन्दं लालयन्तं सुताज्ज्ञानून् । ततोऽन्यस्मिन् गृहेऽपश्यन्मज्जनाय कृतोद्यमम् २३ जुह्वन्तं च वितानानीन् यजन्तं पञ्चभिर्भ्यैः । भोजयन्तं द्विजान् क्रापि भुज्जानमवशेषितम् २४ क्रापि सम्भ्यामुपासीनं जपन्तं ब्रह्म वाग्यतम् । एकत्र चासिचर्मभ्यां चरन्तमसिवर्तम्भिः २५ अश्वैर्गजैः रथैः क्रापि विचरन्तं गदाग्रजम् । क्रचिच्छ्यानं पर्यङ्गे सूत्यमानं च बन्दिभिः २६ मन्त्रयन्तं च कस्मिंश्चिन्मन्त्रिभिश्चोद्धवादिभिः । जलक्रीडारतं क्रापि वारमुख्याबलावृतम् २७ कुत्रिचिद् द्विजमुख्येभ्यो ददतं गा: स्वलंकृता: । इतिहासपुराणानि शृण्वन्तं मङ्गलानि च २८ हसन्तं हास्यकथ्या कदाचित् प्रियथा गृहे । क्रापि धर्मे सेवमानमर्थकामौ च कुत्रिचित् ॥२९ ध्यायन्तमेकमासीनं पुरुषं प्रकृतेः परम् । शुश्रूषन्तं गुरुन् क्रापि कामैर्भैर्गेः सपर्यया ॥३० कुर्वन्तं विग्रहं कैश्चित् सर्विं चान्यत्र केशवम् । कुत्रिपि सह रामेण चिन्तयन्तं सतां शिवम् ३१ पुत्राणां दुहितॄणां च काले विध्युपयापनम् । दारैर्वैस्तत्सदृशोः कल्पयन्तं विभूतिभिः ॥३२

अने आ अमारा जन्मने पवित्र करो.” विस्मय पामेला नारदश्च त्यांथी युपयाप उठीने बीजा धरमां गया. २०-२२ त्यां पश्च पोताना बाणक ऐवा पुत्रोने रमाडता भगवान् जोवामां आव्या, पछी बीजा धरमां भगवान् स्नान करवानी तेयारी करता जोवामां आव्या. २३ कोई धरमां अग्निहोत्रनो होम करता अने वैश्वदेव आहि पंचमहायश करता जोवामां आव्या. कोई धरमां ब्राह्मणोने जमाडता अने अवशेष रहेलुं अस जमता जोवामां आव्या. २४ कोई धरमां संध्यानी उपासना करता अने भौन रहीने गायत्रीनो जप करता जोवामां आव्या, कोई धरमां ढाल तलवारथी पटो खेलता जोवामां आव्या. २५ कोई धरमां हाथी, घोडा अने रथ उपर बेसीने झरता. कोई धरमां पलंग पर पोढेला अने बंहिजनोरे स्तुति करता जोवामां आव्या. २६ कोईमां उद्धवादिक मंत्रीओनी साथे विचार करता. कोई धरमां उत्तम वेश्याओथी वीटाईने जग्नीडा करता जोवामां आव्या. २७ कोई धरमां उत्तम ब्राह्मणोने शशगारेली गायो देता. अने कोईमां मंगणरूप ईतिहास अने पुराणोने सांभणता जोवामां आव्या. २८ कोईमां स्त्रीनी साथे हसवानी वातथी हसता जोवामां आव्या. कोई धरमां धर्मने, कोईमां अर्थने अने कोईमां कामने सेवता जोवामां आव्या. २९ कोई धरमां एकला बेसीने प्रकृतिथी पर स्वस्वरूपनु चिंतन करता जोवामां आव्या. कोईमां कामभोग अने पूजनना बीजा पदार्थोथी गुरुओनी सेवा करता जोवामां आव्या. ३० कोईमां बीजाओनी साथे संधी करता अने कोई धरमां बीजाओनी साथे विग्रह करता. तेमज कोईमां मोटामाईनी

प्रस्थापनोपानयनैरपत्यानां महोत्सवान् । वीक्ष्य योगेश्वरेशस्य येषां लोका विसिस्मिरे ॥३३ यजन्तं सकलान् देवान् क्रापि क्रतुभिर्सूर्जितैः । पूर्तयन्तं क्रचिद् धर्मं कूपाराममठादिभिः ३४ चरन्तं मृगयां क्रापि हयमारुह्यं सैन्धवम् । घन्तं ततः पशून् मेध्यान् परीतं यदुपुङ्गवैः ॥३५ अव्यक्तलिङ्गं प्रकृतिष्वन्तः पुरगृहादिषु । क्रचिच्चरन्तं योगेशं तत्तद्वावबुभुत्सया ॥३६ अथोवाच हृषीकेशं नारदः प्रहसन्निव । योगमायोदयं वीक्ष्य मानुषीमीयुषो गतिम् ॥३७ विदाम योगमायास्ते दुर्दर्शा अपि मायिनाम् । योगेश्वरात्मन् निर्भाता भवत्पादनिषेवया ३८ अनुजानीहि मां देव लोकांस्ते यशसाऽप्लुतान् । पर्यटामि तवोद्धायन् लीलां भुवनपावनीम् ३९

## श्रीभगवानुवाच

ब्रह्मन् ! धर्मस्य वक्ताहं कर्ता तदनुमोदिता । तच्छक्षयँलोकमिममास्थितः पुत्र ! मा खिदः ४०

साथे सत्पुरुषोना कल्याणो विचार करता जोवामां आव्या. ३१ कोई धरमां मोटी धामधूमथी पुत्रोने योग्य स्त्रीओनी साथे अने दीकरीओने योग्य वरोनी साथे परशावता जोवामां आव्या. ३२ कोईमां पोतानां संतानोने मोक्लवाना अने पाइं तेडी आववाना भणोत्सव के जेने जोईने लोको विस्मय पामता हता, तेओनी गोठवाण करता जोवामां आव्या. ३३ कोई धरमां भारे भारे यज्ञोशी सर्वदेवताओनुं पूजन करता, कोईमां फूवा, वाडीओ अने मठ आहि रचावीने, धर्म संबंधी पूर्त कर्म करता जोवामां आव्या. ३४ कोईमां सिंधुदेशना घोडा उपर यदीने मृगयामां पवित्र पशुओने मारता अने मोटा मोटा यादवोथी वीटाएला जोवामां आव्या. ३५ कोईमां मंत्रीओ अने अंतःपुर आहिना ते मनोभाव जाणवा सारु वेष भदलावीने झरता जोवामां आव्या. ३६ पछी मनुष्यावतारनी लीला करता भगवाननी योगमायानो ए सर्वे उद्य जोईने जाणे हसता होय, ऐवा नारदश्च अभगवानने आ प्रमाणे कह्युं. ३७

नारदश्च कुहे छे हे योगेश्वर ! योगी पुरुषोथी पश्च जाणी शकाय नहीं ऐवी तमारी योगमाया जे तमारा यरणनी सेवाना प्रभावथी मनमां जणाय छे, ते योगमायाने ज अमो जाणीऐ छीऐ पश्च तमारा परमार्थ स्वरूपने जाणता नथी. ३८ हे देव ! मने आज्ञा आपो के त्रिलोकेने पवित्र करनारी तमारी लीलानुं गायन करतां, तमारा यशथी व्याप थयेला लोकोमां झरु. ३९

भगवान् कुहे छे हे पुत्र नारद ! धर्मनो कुहेनार, करनार अने संभति आपनार, हुं लोकेने धर्म शीभववा सारु आ धर्म पाणुं छुं. माटे तमे मुंजाशो नहीं. ४०

श्रीशुक उवाच

इत्याचरन्तं सद्वर्मान् पावनान् गृहमेधिनाम् । तमेव सर्वगेहेषु सन्तमेकं ददर्श ह ॥४१  
कृष्णस्यानन्तवीर्यस्य योगमायामहोदयम् । मुहुर्द्विष्टा ऋषिरभूद् विस्मितो जातकौतुकः ॥४२  
इत्यर्थकामधर्मेषु कृष्णोन श्रन्दितात्मना । सम्यक् सभाजितः प्रीतस्तमेवानुस्मरन् ययौ ॥४३  
एवं मनुष्यपदवीमनुवर्तमानो नारायणोऽखिलभवाय गृहीतशक्तिः ।  
रेमेऽङ्गः ! षोडशसम्बन्धवराङ्गनानां सब्रीडसौहृदनिरीक्षणहासजुषः ॥४४॥  
यानीह विश्वविलयोद्भववृत्तिहेतुः कर्मण्यनन्यविषयाणि हरिश्चकार ।  
यस्त्वंग गायति शृणोत्यनुमोदते वा भक्तिर्भवेद्भगवति ह्यपवर्गमार्गे ॥४५॥  
इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्दे उत्तरार्द्धे  
कृष्णगार्हस्थ्यदर्शनं नामैकोनसप्तितमोऽध्यायः ॥६९॥

शुकदेवज्ञ कहे छे आ प्रमाणे गृहस्थाश्रमवाणाओना पवित्र धर्मनुं पालन  
करता एक ज भगवानने नारदज्ञभे सर्वे धरोमां रहेला दीठा.<sup>४१</sup> अनंत  
शक्तिवाणा भगवाननी योगमायानो भोटो उदय वारंवार ज्ञेने कौतुक  
उत्पन्न थयुं हतुं, ऐवा नारदज्ञ विस्मय पाम्या.<sup>४२</sup> अर्थ, काम अने धर्मभां आ  
प्रमाणे श्रद्धा राखनारा श्रीकृष्ण भगवाने सारी रीते सत्कार करतां प्रसन्न थयेला  
नारदज्ञ तेमनुं ज स्मरण करता करता त्यांथी गया.<sup>४३</sup> हे राजा ! आ प्रमाणे  
मनुष्यलीलाने अनुसरता, सर्वना कल्याणाने भाटे अनेक अवतारो धरनार अने  
सोणहज्जर उत्तम स्त्रीओनी लाज सहित स्नेह भरेली दृष्टिथी तथा हसवाथी  
प्रीति पामेला नारायण भगवान रभता हता.<sup>४४</sup> हे राजा ! जगतनी उत्पत्ति,  
स्थिति अने प्रलयना कारणरूप भगवाने जे जे असाधारण कर्मो कर्यांछे, तेओने  
जे माणस गाय, सांभणे अथवा वभाणे ते माणसने मोक्षना मार्गरूप भगवानने  
विषे भक्ति प्राम थाय छे.<sup>४५</sup>

इति श्रीमद्भागवतना भागवतना दशम स्कन्दानो ओगाणोत्तेमो अद्याय संपूर्णः।

अथ सप्तितमोऽध्यायः (७०)

॥ श्रीशुक उवाच ॥

अथोषस्युपवृत्तायां कुक्षटान् कुजतोऽशपन् । गृहीतकण्ठयः पतिभिर्माधव्यो विरहातुराः १  
वयांस्यस्त्रुवन् कृष्णं बोधयन्तीव बन्दिनः । गायत्स्वलिष्वनिद्राणि मन्दारवनवायुभिः ॥२  
मुहूर्तं तं तु वैदर्भी नामृष्यदतिशोभनम् । परिरम्भणविश्लेषात् प्रियबाह्नतरं गता ॥३  
ब्राह्मे मुहूर्तं उथाय वार्युपस्पृश्य माधवः । दध्यो प्रसन्नकरण आत्मानं तमसः परम् ॥४  
एकं स्वयंज्योतिरनन्यमव्ययं स्वसंस्थया नित्यनिरस्तकल्पषम् ।

ब्रह्माख्यमस्योद्भवनाशहेतुभिः स्वशक्तिभिर्लक्षितभावनिर्वृतिम् ॥५॥

अथाप्लुतोऽभ्यस्यमले यथाविधि क्रियाकलापं परिधाय वाससी ।

चकार सम्योपगमादि सत्तमो हुतानलो ब्रह्म जजाप वाग्यतः ॥६॥

उपस्थायार्कमुद्यन्तं तर्पयित्वाऽऽत्मनः कलाः । देवानृषीन् पितृन् वृद्धान् विप्रानभ्यर्च्य चात्मवान्  
धेनूनां रुक्मशृङ्गीणां साध्वीनां मौक्किकस्त्रजाम् । पर्यस्विनीनां गृष्णीनां स्ववत्सानां सुवाससाम्

अद्याय ७०

भगवाननुं आहिक अने दूतनो संदेशो.

शुकदेवज्ञ कहे छे हे राजा ! रात्रीओमां श्रीकृष्णो कंठमां आलिंगन करेली  
स्त्रीओ प्रातःकाण थवा आवे त्यारे कुकडां बोलतां, तेओना शष्टो सांभणी  
भगवान उठी जशे ऐम जाणी, विरहथी आतुरताने लीधे कुकडांओने ते गाणो  
देती हती.<sup>१</sup> पारिज्ञातना वनना सुगंधी वायुने लीधे भमराओ गायन कर्या करतां  
जेओनी निद्रा जती हती ऐवां पक्षीओ, बंटीजनोनी पेठेजाणे श्रीकृष्णने जगाडतां  
होय तेम शष्ट करतां हतां.<sup>२</sup> ऐ प्रभातनो समय ज्ञेके अत्यंत सुंदर हतो तो पश  
पोताना पतिनी बाथमां रहेली श्रीकृष्णनी सर्वे स्त्रीओने पतिनुं आलिंगन धूटी  
जवाथी ते प्रातःसमय जरा पशा सारो लागतो न हतो.<sup>३</sup> भगवान ध्राव्यमुहूर्तमां  
उठी, जगवडे कोगणा करी, ईद्रियोने स्वरूप कर्या पधी मायाथी पर, एक  
स्वयंप्रकाश, उपाधी रहित, अविनाशी, स्वस्वरूपने विषे रहेवाथी अविद्याने  
निरंतर दूर राखनार तथा आ जगतनी उत्पत्ति, स्थिति अने नाशना कारणरूप  
पोतानी शक्तिओथी जशाएलुं छे अस्तित्व जेमनुं, अने आनंदात्मक ऐवा  
स्वस्वरूपनुं ध्यान करता हता.<sup>४५</sup> पधी निर्भूत जगमां स्नान करी, बे वस्त्र पहेरीने  
विधि प्रमाणे संध्योपासन आठि क्रियाओ करता हता. पोते यजुर्वेदनी  
कर्णशाखावाणा होवाथी, सूर्योदयथी पहेलां ज अग्निमां होम करीने मौन व्रतथी

ददौ स्त्यखुराग्राणं क्षौमाजिनतिलैः सह । अलंकृतेभ्यो विप्रेभ्यो बद्वं बद्वं दिने दिने ॥१९  
गोविप्रदेवतावृद्धगुरुन् भूतानि सर्वशः । नमस्कृत्यात्मसंभूतीर्मङ्गलानि समस्पृशत् ॥२०  
आत्मानं भूष्यामास नरलोकविभूषणम् । वासोभिर्भूषणैः स्वीर्यैदिव्यस्वगुलुपेनैः ॥२१  
अवेक्ष्याज्यं तथाऽऽर्दर्शं गोवृष्टिजदेवताः । कामांश्च सर्ववर्णानां पौरान्तःपुरचारिणाम् ।

प्रदाप्य प्रकृतीः कामैः प्रतोष्य प्रत्यनन्दतः ॥२२

संविभज्याग्रतो विप्रान् स्वकाम्बूलानुलेपनैः । सुहृदः प्रकृतीर्दारानुपायुद्धक्त ततः स्वयम् ॥३  
तावत् सूत उपानीय स्यन्दनं परमाद्गुतम् । सुग्रीवाद्यैहर्यैर्युक्तं प्रणम्यावस्थितोऽग्रतः ॥२४  
गृहीत्वा परिणना पाणी सारथेस्तमथासहत् । सात्यक्युद्धवसंयुक्तः पूर्वाद्रिमिव भास्करः ॥५  
ईक्षितोऽन्तःपुरस्त्रीणां सवीडप्रेमवीक्षितैः । कृच्छ्राद् विसृष्टे निरगज्जातहासो हरन् मनः ॥६  
सुधर्माख्यां सभां सर्वैर्वृष्णिभिः परिवारितः । प्राविशद् यन्निविष्णानं न सन्त्यङ्गः घट्मयः ॥७

गायत्रीनो जप करता हता. अने पछी सर्वथी उत्तम अने धीर श्रीकृष्ण भगवान उगता सूर्यनुं उपस्थान करी, पोताना अंशरूप देव, ऋषि अने पितृओनुं तर्पण करी तथा ब्राह्मण अने वृद्धलोकोनी पूजा करी, दूरोज दरेक घरमां सुवर्णथी मढेला शींगणांवाणी, इपानी खरीओवाणी, भली, मोतीनी माणावाणी, हुधाण, पहेलवेतरी, वाइरडांवाणी अने सारां वस्त्रवाणी तेरहजार अने चोराशी गायो शशगारेला ब्राह्मणोने आपता हता. अने तेओनी साथे रेशभी वस्त्र, मृगयर्म अने तिलनां दान पशु करता हता.<sup>१८</sup> पोतानी विभूतिरूप सर्व गाय, ब्राह्मण, देवता, वृद्ध, गुरु अने सर्वप्राणीओने प्रशाम करी, भंगण पदार्थोंनो स्पर्श करता हता.<sup>१९</sup> जो के भगवानना शरीरनुं स्वाभाविक सौंदर्य ४ मनुष्यलोकना आभूषणरूप छे, तो पशु तेओ पोताना शरीरने वस्त्र, भूषण, दिव्यमाणा अने दिव्य चंदनोथी शशगारता हता.<sup>२०</sup> धीमां मोहुं जोई तथा अरीसो जोई, गाय, भण्ड, ब्राह्मण तथा देवताओनां दर्शन करी, नगरभां तथा अंतःपुरमां रहेनारा सर्ववर्णोने जोईता पदार्थों अपावी करी भंत्रीओने ते ते पदार्थोथी राज्ञ करी मान आपता हता.<sup>२१</sup> प्रथम ब्राह्मणोने अने पछी भित्र, कारभारीओ तथा स्त्रीओने माणा, तांबूल अने चंदनना भाग आप्या पछी ते वस्तुओने पोते उपयोगमां लेता हता.<sup>२२</sup> एटलीवारमां सारथि, सुग्रीव आदि घोडाओथी जोडेला परम अद्भुत रथने लावी प्रशाम करी आगण उभो रहेतो.<sup>२३</sup> पोताना हाथथी सारथिनो हाथ पकडी, सात्यकि तथा उद्धवज्ञ सहित भगवान, सूर्य जेम उद्याचण उपर यहे तेम रथ उपर यढता हता.<sup>२४</sup> अंतःपुरमांथी विद्याय थवाना समयमां

तत्रोपविष्टः परमासने विभुर्बधौ स्वभासा ककुभोऽवभासयन् ।

वृतो नृसिंहर्यदुभिर्यदूतो यथोदुराजो दिवि तारकागणैः ॥२८॥

तत्रोपमन्त्रिणो राजन्! नानाहास्यरसैर्विभुम् । उपतस्थुर्नटाचार्या नर्तक्यस्ताण्डवैः पृथक् ॥१९  
मृदङ्गवीणामुरजवेणुतालदरस्वनैः । ननृतुर्जगुस्तुष्टुवश्च सूतमागधवन्दिनः ॥२०

तत्राहुर्बाह्यणाः केचिदासीना ब्रह्मवादिनः । पूर्वेषां पुण्ययसासां राजां चाकथयन् कथा: २१  
तत्रैकः पुरुषो राजनागतोऽपूर्वदर्शनः । विज्ञापितो भगवते प्रतीहारैः प्रवेशितः ॥२२

स नमस्कृत्य कृष्णाय परेशाय कृताज्जलिः । राजामावेदयद् दुःखं जरासन्धनिरोधजम् ॥२३

ये च दिग्विजये तस्य सन्नतिं न यथुर्नृपाः । प्रसह्य रुद्धास्तेनासन्नयुते द्वे गिरिव्रजे ॥२४

अंतःपुरनी स्त्रीओ लाज सहित प्रेम भरेली दृष्टिथी जोई रहेती हती अने तेमनां

दर्शनने मांडमांड छोडी शक्ती हती. सर्वना मननुं हरश करता अने हसता

भगवान अंतःपुरमांथी बहार नीकणी, सर्वे यादवोथी वींटाईने सुधर्मा नामनी

सभामां पधारता हता, के जे सभामां प्रवेशेलाओने भूष तरस आदि ७ ऊर्मिओ

बाध करती न हती.<sup>१६-१७</sup> ते सभामां उत्तम आसन पर बिराजेला, पोतानी

कांतिथी दिशाओमां प्रकाश करता अने मनुष्योमां सिंह सरभा उत्तम यादवोथी

वींटाईला श्रीकृष्ण भगवान, आकाशमां ताराओना समूहोथी जेम चंद्रमा शोभे

तेम शोभता हता.<sup>१८</sup> हे राजा ! ऐ सभामां हास्य करावनारा विद्युषको अनेक

प्रकारना हास्यरसोथी भगवानने प्रसन्न करता हता अने नटलोकोना आचार्यों

तथा नायनारी स्त्रीओ पशु पोतपोताना समुदायनी साथे आवी, नृत्यादिकथी

भगवानने प्रसन्न करती हती.<sup>१९</sup> सूत, मागध अने बंदिजनो मृदंग, वीणा,

मुरज, वेणु, ताल अने शंखना शंखोथी नायता, गाता अने सुन्तुति करता हता.<sup>२०</sup>

ऐ सभामां बेठेला केटलाक वादमां चतुर ब्राह्मणो वेदमंत्रोनुं व्याख्यान करता

हता अने पवित्र कीर्तिवाणा प्राचीन राजाओनी कथा कहेता हता.<sup>२१</sup> आ प्रमाणे

दूरोज भगवान करता हता. त्यां ऐक दिवसे कोई समये नहीं देखेलो ऐक

पुरुष त्यां आव्यो. भगवानने पूष्यावीने द्वारपाण लोको अनेक ज्वालीधो.<sup>२२</sup>

ऐ दूते परमेश्वर श्रीकृष्णने प्रशाम करी, हाथ जोडीने तेमनी पासे राजाओने

जरासंघे रोकी मूकवाथी थयेला हुःभनुं निवेदन कर्यु.<sup>२३</sup> जे राजाओ जरासंघना

दिग्विजय करवाना समयमां जरासंघने नभ्या न हता, ते वीशहजार राजाओने

बणात्कारथी गिरिव्रज नामना किल्लामां केद कर्या हता, ते राजाओवती दूते

श्रीकृष्ण भगवानने आ प्रमाणे कहुं.<sup>२४</sup>

कृष्ण! कृष्णाप्रमेयात्मन् ! प्रपन्नभयभञ्जन ! । वयं त्वां शरणं यामो भवभीताः पृथिव्यः  
लोको विकर्मनिरतः कुशले प्रमत्तः कर्मण्ययं त्वदुदिते भवदर्चने स्वे ।  
यस्तावदस्य बलवानिह जीविताशां सद्यश्छिनत्यनिमिषाय नमोऽस्तु तस्मै ॥२६॥  
लोके भवाञ्जगदिनः कलयावतीर्णः सद्रक्षणाय खलनिग्रहणाय चान्यः ।  
कक्षित् त्वदीयमतियाति निदेशमीश किं वा जनः स्वकृतमृच्छति तत्र विद्वः ॥२७॥  
स्वज्ञायितं नृपसुखं परतन्नमीश ! शश्वद्धयेन मृतकेन धुरं वहामः ।  
हित्वा तदात्मनि सुखं त्वदनीहलभ्यं किलश्यामहेऽतिकृपणास्तव माययेह ॥२८॥  
तत्रो भवान् प्रणतशोकहराङ्गयुग्मो बद्धान् वियुद्धक्षव मगाधाह्वयकर्मपाशात् ।  
यो भूभुजोऽयुतमतङ्गजवीर्यमेको बिघ्रद् रुरोध भवने मृगराङ्गवावीः ॥२९॥

राजाओऽक्षेवरावे छे हे कृष्ण ! हे शरणागतोना भयने भाँगनार ! जे  
अमो भेदभुद्धिवाणा छीअे, ते अमो संसारथी भय पामीने तमारा शरणागत  
थया छीअे.<sup>२५</sup> निषिद्ध अने सकाम कर्ममां बहु ज लागेलो लोक हज्ज आपे क्षेवला  
अने पोताना पवित्र धर्मरूप आपना पूजनमां प्रमाद धरावतो होय तेटलामां ज  
बणवान ऐवा जे आप, ते लोकोनी ज्ञवानी आशाने कापी नाखो छो, ते काणरूप  
आपने प्रणाम करीअे छीअे.<sup>२६</sup> हे ईश्वर ! जगतना स्वामी आप सज्जनोना  
रक्षणने माटे अने बण लोकोने शिक्षा करवाने माटे बणहेवज्जनी साथे अवतर्या  
छो, तो पछी रक्षण करनारो हुं रहेलो होवा छतां केटलाक जनो शा कारणथी  
हुःभ पामे छे ? आना उत्तरमां राजाओऽक्षेवे छे के- जरासंधाइ केटलाक लोको  
प्रज्ञपालनरूप तमारी आशानुं उल्लंघन करे छे, अने अमारा जेवा केटलाक  
लोको पूर्वे करेलां पापनां फ्लो भोगवे छे, आ सिवाय बीजुं कोई हुःभनुं कारण  
अमे ज्ञानाता नथी.<sup>२७</sup> हे ईश्वर ! राज्य संबंधी सुख कर्माधीन होवाथी परतंत्र  
छे, अने स्वप्रना सुखनी समान अति तुरुच्छ छे. अने आ शरीर पण निरंतर  
भय पामेलुं अने मुडाजेवुं छे, तोपण आ शरीरथी अमे केवण स्त्री पुत्रादिक्नी  
यिंताने उपारीअे छीअे, अने निष्काम लोकोने आपनी पासेथी भेणववा योग्य  
स्वतःसिद्ध सुख तेने छोडी दृष्टने, आपनी मायाथी अत्यंत कुंगाण बनीने अहीं  
क्लेश भोगव्या करीअे छीअे.<sup>२८</sup> एटला माटे प्रणाम करनाराओना शोकने  
हरनारां यरणारविंदवाणा आप, अमो बंधाएला लोकोने जरासंध नामना  
कर्मबंधनमांथी छोडावो. एकलो छतां दशहजार हाथीनुं बण धरावनार ए  
जरासंधे, सिंह जेम घेटांओने रोकी राखे, तेम पोताना धरमां अमोने राजाओ

यो वै त्वया द्विनवकृत्व उदात्तचक्र भग्नो मृथे खलु भवन्तमनन्तवीर्यम् ।  
जित्वा नृलोकनिरतं सकृदूढदर्पो युष्मत्प्रजा रुजति नोऽजित तद् विधेहि ॥३०॥  
दूत उवाच  
इति माग्धसंरुद्धा भवदर्शनकाङ्क्षणः । प्रपन्नाः पादमूलं ते दीनानां शं विधीयताम् ॥३१  
श्रीशुक उवाच  
राजदूते ब्रुवत्येवं देवर्षिः परमद्युतिः । बिभ्रत् पिङ्गजटाभारं प्रादुरासीद् यथा रविः ॥३२  
तं दृष्ट्वा भगवान् कृष्णः सर्वलोकेश्वरेश्वरः । ववन्द उत्थितः शीर्षाणि ससभ्यः सानुगो मुदा ३३  
सभाजयित्वा विधिवत् कृतासनपरिग्रहम् । बभाषे सूनृतैर्वाक्यैः श्रद्धया तर्पयन् मुनिम् ३४  
अपि स्विद्य लोकानां त्रयाणामकुतोभयम् । ननु भूयान् भगवतो लोकान् पर्यटतो गुणः ३५  
न हितेऽविदितं किञ्चिल्लोकेष्वीश्वरकर्तृषु । अथ पृच्छामहे युष्मान् पाण्डवानां चिकीर्षितम् ३६  
श्रीनारद उवाच

दृष्ट्वा मया ते बहुशो दुरत्यया माया विभो ! विश्वसृजश्च मायिनः ।  
भूतेषु भूमंश्चरतः स्वशक्तिभिर्वैरिवच्छ्रव्नरुचो न मेऽद्भुतम् ॥३७॥

रोकी राष्या छे.<sup>२९</sup> हे यक्षधारी ! हे अजित ! आपनी साथे अठारवार थयेला  
संग्राममां आप ए जरासंधने सतारवार तो हराव्यो हतो, पण अठारभीवारना  
संग्राममां आप अनंत पराक्रमवाणा छतां मनुष्यदेहनी लीला करवा लागतां  
ऐकवार आपने ज्ञती लैने ते जरासंध भारे गर्व धरावे छे अने अमे के जेओ  
आपनी प्रजा छीअे तेओने पीडे छे. माटे आ विषयमां जे योग्य लागे ते करो.<sup>३०</sup>

दृत क्षेवे छे जरासंधे रोकेला, आपना दर्शनने ईश्चता अने आपना यरणे  
शरण थयेला राजाओ ए आ प्रमाणे आपने प्रार्थना करी छे, माटे ए दीन लोकोनुं  
कल्याण करो.<sup>३१</sup> शुकदेवज्ज क्षेवे छे राजाओनो दृत आ प्रमाणे बोलतो हतो, त्यां  
मोटी कांतिवाणा अने पींगली जटाने धरनारा नारदज्ज सूर्यनी पेठे प्रगट थया.<sup>३२</sup>  
नारदज्जने जोई श्रीकृष्ण भगवान्, सभासदो अने अनुयरो सहित आनंदथी  
उभा थईने तेमने मस्तकवडे पगे लाग्या.<sup>३३</sup> आसननो स्वीकार करी बेठेला  
नारदज्जनो विषिपूर्वक श्रद्धाथी सत्कार करी, भगवाने मधुर वयनथी नारदने  
आ प्रमाणे कहुं.<sup>३४</sup>

भगवान् क्षेवे छे, हमणां त्रष्णेलोक सारी रीते निर्भय छे ? कोई तरफथी  
भय तो नथी ने ? आप सर्वे लोकोमां फ्लोछो तेथी अमोने लोकोनुं वृत्तांत ज्ञानवानो  
मोटो लाभ थाय छे.<sup>३५</sup> ईश्वरे सर्जला न्रां लोकोमां आपथी अज्ञाइयुं कांઈ नथी,

તવેહિતં કોર્જહતિ સાધુ વેદિતું સ્વમાયેદં સૃજતો નિયચ્છત: ।  
યદ્વિદ્યમાનાત્મતયાવભાસતે તસ્મૈ નમસ્તે સ્વવિલક્ષણાત્મને ॥૩૮॥

જીવસ્ય ય: સંસરતો વિમોક્ષણં ન જાનતોઽનર્થવહાચ્છીરત: ।  
લીલાવતારૈ: સ્વયશ:પ્રદીપકં પ્રાજ્વાલયત્ત્વા તમહં પ્રપદ્યે ॥૩૯॥

અથાપ્યાશ્રાવયે બ્રહ્મ નરલોકવિડ્ઘનમ् । રાજ્ઞ: પैતૃષ્વસેયસ્ય ભક્તસ્ય ચ ચિકીર્ષિતમ् ૪૦  
યક્ષ્યતિ ત્વાં મહેન્દ્રેણ રાજસૂયેન પાણ્ડવ: । પારમેષ્ઠ્યકામો નૃપતિસ્તદ્ભ્રવાનનુમોદતામ्  
તસ્મિન્ દેવ ! ક્રતુવરે ભવનં વૈ સુરાદય: । દિવ્દક્ષ્વઃ સમેષ્ઠનિ રાજાનશ્ચ યશસ્વિન: ॥૪૨  
શ્રવણાત્કીર્તનાદ્ધ્યાનાત્પૂર્યનેઽનેવસાયન: । તવ બ્રહ્મમયસ્યેશ ! કિમુતેક્ષાભિમર્ણિન: ૪૩  
માટે હમણાં પાંડવો શું કરવા ધારે છે ? એ આપને પૂછું છું. ૩૬

નારદજી કહે છે હે પ્રભુ ! હે વ્યાપક ! જે આપ બ્રહ્માને પણ મોહ ઉપજાવનાર  
અને પોતાની શક્તિઓથી પ્રાણીઓમાં અંતર્યામીરૂપે રહેલા છો. છતાં પણ કાણમાં  
રહેલા અગ્નિની પેઠે ગુસ્પ પ્રકાશવાળા છો તે તમારી માયા મેં ઘણીવાર જોયેલી  
છે, માટે આ આપે કરેલા પ્રશ્નાદિક મને આશ્ર્ય પમાડનારા થતા નથી. ૩૭ પોતાના  
સંકલ્પથી આ જગતને ઝજનારા, અને અંતરાત્માપણે પાલન કરનારા એવા  
આપના અભિપ્રાયને કયો પુરુષ જાણી શકે ? કોઈપણ ન જાણી શકે. અને કદાચ  
કોઈ જાણી શકે છે, એ પણ તમારી મૂર્તિમાં પોતાનો આત્મા જોડી દઈને એ દ્વારા  
મહાપ્રાયસે જાણી શકે છે. માટે કયો પુરુષ સારી રીતે જાણી શકે ? કોઈ પણ ન  
જાણી શકે, માટે જે આપ સ્વરૂપથી અચિંત્ય જ છો તે આપને પ્રણામ કરું છું. ૩૮  
જન્મ મરણ પાભ્યા કરતા અને અનર્થ આપનારા શરીરથી ધૂટકારો થવાનો ઉપાય  
નહીં જાણતા જીવને માટે તેના અજ્ઞાનરૂપી અંધારાને દૂર કરનાર પોતાના પણરૂપી  
દીવાને જે આપે લીલા અવતારો દ્વારા પ્રજ્વલિન કર્યો છે તે આપને હું શરણે  
આવ્યો છું. ૩૯ હે મહારાજ ! આમ છે તોપણ મનુષ્ય લોકનું અનુકરણ કરનારા  
આપને, આપના ભક્ત અને ફોઈના દીકરા યુધિષ્ઠિર રાજાઓ જે કરવા ધારેલું  
છે, તે કહી સંભળાવું છું. ૪૦ હે દેવ ! યુધિષ્ઠિર રાજા ચક્રવર્તીપણું મેળવવાની  
ઈચ્છાથી રાજસૂય નામનો મોટો યજ્ઞ કરીને આપનું પૂજન કરવા ધારે છે, તો એ  
કામમાં આપે સંમતિ આપવી, એટલું જ નહીં પણ ત્યાં અવશ્ય આવવું, કેમકે એ  
મોટા યજ્ઞમાં દેવતા આદિ અને મોટી કીર્તિવાળા રાજાઓ પણ આપનાં દર્શન  
કરવાની ઉત્કર્ષાથી ભેણા થશે. ૪૧-૪૨ હે પ્રભુ ! જે આપ પરબ્રહ્મ છો તે આપના  
શ્રવણથી, કીર્તનથી અને ધ્યાનથી ચંડાળો પણ પવિત્ર થાય છે. ત્યારે આપનાં

યસ્યામલં દિવિ યશ: પ્રથિતં રસાયાં ભૂમૌ ચ તે ભુવનમઙ્ગલ ! દિગ્વિતાનમ્ ।  
મન્દાકિનીતિ દિવિ ભોગવતીતિ ચાથો ગંગેતિ ચેહ ચરણામ્બુ પુનાતિ વિશ્વમ્ ॥૪૪॥  
શ્રીશુક ઉવાચ  
તત્ત્વ તેષ્વાત્મપક્ષેષ્વગૃહસુ વિજિગીષયા । વાચ:પેશૈ: સ્મયન્ ભૃત્યમુદ્ધવં પ્રાહ કેશવઃ ॥૪૫  
શ્રીભગવાનુવાચ  
ત્વં હિ ન: પરમં ચક્ષુ: સુહુન્મન્ત્રાર્થતત્ત્વવિત્ । તથાત્ર બ્રહ્મનુષ્ટ્યેં શ્રદ્ધધમઃ કરવામ તત્ ॥૪૬  
ઇત્યુપામંત્રિતો ભર્ત્રા સર્વજ્ઞેનાપિ મુગ્ધવત્ । નિદેશં શિરસાઽધાય ઉદ્ધવઃ પ્રત્યાભષત ॥૪૭  
ઇતિ શ્રીમહાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં દશમસ્કંધે ઉત્તરાર્થ  
ભગવદ્યાનવિચારે સપ્તતિતમોઽધાયાઃ ॥૭૦॥

દર્શન અને સ્પર્શ કરનારા લોકો પવિત્ર થાય તેમાં શું કહેવું ? ૪૩ હે સર્વલોકોને  
મંગળરૂપ ! સ્વર્ગને વિષે, રસાતળને વિષે, અને પૃથ્વીને વિષે પ્રસિદ્ધ થઈને  
વ્યાપેલો નિર્મણ એવો તમારો યશ દિશાઓને શાણગારરૂપ થઈને વિશ્બને પવિત્ર કરે  
છે. તેવી જ રીતે સ્વર્ગમાં મંદાકિની એવા નામથી, પાતાળમાં ભોગવતી એવા  
નામથી તથા પૃથ્વીમાં ગંગા એવા નામથી પ્રખ્યાતિ પામેલું જે આપનું ચરણારવિંદ  
ધોયાનું જળ જગતને પવિત્ર કરે છે, તે આપના ત્યાં પધારવાથી સર્વે મંગળ અને  
પવિત્ર થશો. ૪૪

શુકદેવજી કહે છે આ પ્રમાણે નારદજી બોલ્યા પછી પોતાના પક્ષના યાદવો  
જરાસંધને જીતવાની ઈચ્છાથી યુદ્ધિષ્ઠિરના યજ્ઞમાં જવાની વાત જ્યારે માન્યા  
નહિં ત્યારે હસતા શ્રીકૃષ્ણ ભગવાને મધુર વાણીથી પોતાના ભૃત્ય ઉદ્ધવજીને આ  
પ્રમાણે કહ્યું. ૪૫

ભગવાન કહે છે તમે અમારા સંબંધી અને વણી વિચારથી સિદ્ધ કરવાની  
વસ્તુઓના પરિણામ જાણનાર હોવાને લીધે અમારી ઉત્તમ આંખરૂપ છો, માટે  
આ વિષયમાં શું કરવું યોગ્ય છે, તે કહો; અને જે કહેશો તે અમો સ્વીકારીને એ  
પ્રમાણે કરીશું. ૪૬

શુકદેવજી કહે છે આ પ્રમાણે ભગવાને સર્વજ્ઞ છતાં પણ નહિં સમજનારની  
પેઠે પૂછતાં તેમની આજ્ઞાને માથે ચડાવી ઉદ્ધવજી બોલ્યા. ૪૭

ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ રક્ષણનો સિતેરમો અદ્યાય સંપૂર્ણ.

अथ एकसमतितमोऽध्यायः (७७)

॥ श्रीशुक उवाच ॥

इत्युदीरितमाकर्ण्य देवर्षेऽद्वद्वोऽब्रवीत् । सभ्यानां मतमाज्ञाय कृष्णस्य च महामतिः ॥१  
उद्वद्व उवाच

यदुक्तमृषिणा देव साचिव्यं यक्ष्यतस्त्वया । कार्यं पैतृष्वसेयस्य रक्षा च शरणैषिणाम् ॥२  
यष्टव्यं राजसूयेन दिक्चक्रजयिना विभो ! । अतो जरासुतजय उभयार्थो मतो मम ॥३  
अस्माकं च महानर्थो होतेनैव भविष्यति । यशश्च तव गोविन्द ! राजो बद्धान् विमुच्छतः ॥४  
स वै दुर्विषहो राजा नागायुतसमो बले । बलिनामपि चान्येषां भीमं समबलं विना ॥५  
द्वैरथे स तु जेतव्यो मा शताक्षौहिणीयुतः । ब्रह्मण्योऽभ्यर्थितो विप्रैन् प्रत्याख्याति कर्हिचित् ६  
ब्रह्मवेषधरो गत्वा तं भिक्षेत वृकोदरः । हनिष्यति न सन्देहो द्वेरथे तव सन्निधौ ॥७

अद्याय ७७

उद्वद्वशुनी सलाहृथी श्रीकृष्णानुं ईंद्रप्रस्थमां पद्धारवुं.

शुक्टेवज्ञ कुहे छे हे राजा ! आ प्रमाणे भगवाननुं वयन सांभणी  
राजसूयमां ज्वानो नारदशुनो मत, राजाओनी रक्षा करवानो सभासदोनो मत  
अने ते बत्रे करवानो भगवाननो मत ज्ञाणीने मोटी बुद्धिवाणा उद्वद्वज्ञ आ  
प्रमाणे बोल्या.<sup>१</sup>

उद्वद्वज्ञ कुहे छे हे देव ! नारदशुना कुहेवा प्रमाणे यज्ञ करवाने ईच्छता  
आपनी झोईना दीकरा युविष्ठिर राजाने आपे सहायता आपवी ज्ञोईअे, अने  
शरण ईच्छनारा राजाओनी रक्षा पश करवी ज्ञोईअे.<sup>२</sup> हे प्रभु ! राजसूय यज्ञ  
करवानो छे तेमां दिग्विज्य करवो ज पडशे अने ते प्रसंगे जरासंध पश जिताशे,  
माटे तेम करवामां शरणागतनी रक्षा अने राजसूय ए बत्रे सिद्ध थशे, एम हुं  
मानुं छुं.<sup>३</sup> हे गोविंद ! आम करवाथी ज आपाणुं भोटुं प्रयोजन सिद्ध थशे अने  
बंधाएला राजाओने छोडावाथी तमारी क्रीति पश थशे.<sup>४</sup> बणमां दशहजार हाथी  
सरखा ते जरासंध राजा तेथी वधारे बणवाणा भीजाओने तो भारे पडी जाय  
तेवो छे. केवण समान बणवाणो भीम ज तेने भारी शके एम छे, कारण के  
भीमना हाथथी ज जरासंधनो वध सर्जयेलो छे.<sup>५</sup> ते जरासंधने दंद्युद्धमां ज्ञतवो,  
पश सो अक्षोलिषी सैन्य भेगुं करवा माटेनो तेने लाग आववा देवो नहीं. आम  
करवानो उपाय आ छे के भीमे ब्राह्मणानो वेष धरी तेनी पासे ज्ञैने दंद्युद्ध  
माणी लेवुं. जरासंध ब्राह्मणोने माननार छे, तेथी ब्राह्मणो तेनी पासे कांઈ माणे

निमित्तं परमीशस्य विश्वसर्गनिरोधयोः । हिरण्यगर्भः शर्वश्च कालस्यास्तपिणस्त्व ॥८  
गायन्ति ते विशदकर्म गृहेषु देव्यो राजां स्वशत्रुवधमात्मविमोक्षणं च ।

गोप्यश्च कुञ्जरपतेर्जनकात्मजायाः पित्रोश्च लब्धशरणा मुनयो वयं च ॥९॥  
जरासन्धवधः कृष्ण ! भूर्यथायोपकल्पते । प्रायः पाकविपाकेन तव चाभिमतः क्रतुः ॥१०  
श्रीशुक उवाच

इत्युद्वद्ववचो राजन् ! सर्वतोभद्रमच्युतम् । देवर्षिर्यदुवृद्धाश्च कृष्णश्च प्रत्यपूजयन् ॥११  
अथादिशत् प्रयाणाय भगवान् देवकीसुतः । भृत्यान् दारुकजैत्रादीननुज्ञाप्य गुरुन् विभुः ॥१२

छे तो ना कुहेतो नथी. माटे भीमे ब्राह्मणानो वेष धारण करी, जरासंध पासे  
ज्ञैने भिक्षा मागवी अने ते समये तमारा सानिध्यमां दंद्युद्धने विषे तो भीम  
तेने मारशो ज, एमां कशो संदेह नथी.<sup>६-७</sup> विश्वनी सृष्टि अने प्रलयने विषे परम  
निमित्त कारण आप ज छो. जो हुं परम निमित्त कारण होउं तो अवान्तर निमित्त  
कारण कोणा छे ? प्राङ्कृतउपथी रहित अने काणना पश नियामक एवा आपना  
अंशभूत ब्रह्मा अने शंकर अवान्तर निमित्त कारण छे. माटे भीमद्वारा तमो ज  
जरासंधने मारशो, भीम अवान्तर निमित्तउप ज थशे, आप परम निमित्तर  
कारण थशो. आवो भाव छे.<sup>८</sup> जेम गोपीओ शंभयूडने मारवारूप अने तेथी  
पोताने छोडाववारूप आपना पवित्र कर्मने गाय छे, जेम शरणागत लोको झूडने  
मारवारूप अने तेथी गजेन्द्रने छोडाववारूप आपना पवित्र कर्मने गाय छे, जेम  
मुनिओ रावणने मारवारूप अने तेथी सीताशुने छोडाववारूप आपना पवित्र  
कर्मने गाय छे. अने जेम अमो कंसने मारवारूप अने तेथी मातापिताने  
छोडाववारूप आपना पवित्र कर्मने गाईअे छीअे, तेम जरासंधे पक्की राखेला  
राजाओनी स्त्रीओ पश पोताना धरोमां बाणकने रमाडवा आटि काम करतां “हे  
पुत्र ! रुद्न कर मा, करुणाना सागर श्रीकृष्ण जरासंधने मारशो अने तारा  
बापने छोडावशे” ऐवी रीते आपना पवित्र कर्मने गाय छे.<sup>९</sup> हे कृष्ण ! जरासंधने  
मारवाथी भीजां पश धणां प्रयोजन सिद्ध थशे, केमके तेने मारवाथी शिशुपाण  
आटि शत्रुओ नबणा पडी जशे. हुं धारुं छुं के धणुं करीने केदी राजाओना पुण्यनो  
पाक काण आववाथी अने जरासंधाटिक्ना पापोनो पाककाण आववाथी राजसूय  
कराववा तमने रुचि थई छे.<sup>१०</sup>

शुक्टेवज्ञ कुहे छे आ प्रमाणे सर्वे रीते सुखकारक अने उत्तम युक्तिथी

निर्गमव्यावरोधान् स्वान् ससुतान् सपरिच्छदान् । सङ्कर्षणमनुज्ञाप्य यदुराजं च शत्रुहन् ।  
 सूतोपनीतं स्वरथमारुहद् गरुडध्वजम् ॥१३॥

ततो रथद्विपभटसादिनायकैः करालया परिवृत आत्मसेनया ।  
 मृदग्नभेर्यानकशङ्खागोमुखैः प्रघोषघोषितकुभो निराक्रमत् ॥१४॥

नृवाजिकाञ्जनशिविकाभिरच्युतं सहात्मजाः पतिमनु सुव्रता ययुः ।  
 वराम्बराभरणविलेपनस्वजः सुसंवृता नृभिरसिचर्मपाणिभिः ॥१५॥

नरोष्ट्रगोमहिषखराश्वतर्यनः करेणुभिः परिजनवारयोषितः ।  
 स्वलङ्घताः कटकुटिकम्बलाम्बराद्युपस्करा ययुरधियुज्य सर्वतः ॥१६॥

बलं बृहदध्वजपटछत्रचामरैर्वायुधाभरणकिरीटवर्मिभिः ।  
 दिवांशुभिस्तुमुलरवं बभौ रवेर्यथार्णवः क्षुभिततिमिङ्ग्लोर्मिभिः ॥१७॥

अथो मुनिर्यदुपतिना सभाजितः प्रणम्य तं हृदि विदधद् विहायसा ।  
 निशम्य तद्व्यवसितमाहतार्हणो मुकुन्दसन्दर्शननिवृतेन्द्रियः ॥१८॥

भरेलां उद्धवश्चनां वयनने नारदश्च, वृद्ध यादवो अने श्रीकृष्ण भगवाने मान आपीने स्वीकारी लीधुं.<sup>११</sup> पछी श्रीकृष्ण भगवाने वसुहेवाहि गुरुजनोनी संमति लईने प्रयाश करवा माटे दारुक अने जैत्र आदि भूत्य लोकोने आशा करी.<sup>१२</sup> हे शत्रुने मारनार परीक्षित ! पुत्रो सहित अने दासी-दास तथा सरसामान सहित पोतानी स्त्रीओने द्वारकामांथी प्रयाश करावी अने बलराम तथा उत्तरेननी आशा लई श्रीकृष्ण भगवान सारथिये आणेला अने जेनी ध्वजामां गरुडनु चिक्क हतुं एवा रथमां बेठा.<sup>१३</sup> पछी रथ, हाथी, पाणा, घोडेसवारो अने नायकोथी भयंकर लागे एवी पोतानी सेनाथी वींटाअेला भगवान मृदुंग, भेरी, आनक, शंख अने गोमुख नामानां वाज्ञाओना शब्दोथी शब्दायमान थयेली दिशामांथी नीकण्या.<sup>१४</sup> उत्तम आभूषण, वस्त्र, लेपन अने माणावाणी तथा ढाल तलवारवाणा मनुष्योथी वींटाअेली पतिप्रता स्त्रीओ पुत्रोनी साथे भेना आदि मनुष्योनां वहान, घोडा जेडेला रथ अने पालभीओमां बेसीने पोताना पति भगवाननी पछवाडे यालवा लाणी.<sup>१५</sup> सारी रीते शाशगारेली सेवकोनी स्त्रीओ अने वेश्याओ पशा सादरीओ, तंबुओ, धाबणा अने वस्त्रादिक सामानो लई तथा ते समानोने गाडाओमां सारी रीते बांधीने माणस, उंट, बण्ड, पाडा, खच्चर, गाडां अने हाथशीओ उपर बेसी यारेकोरथी यालती थई.<sup>१६</sup> भारे शब्दवाणुं ते मोटुं सैन्य, ध्वजा, छत्र, चामर, उत्तम आयुध, आभरण, किरीट, कवच अने सूर्यनां किरणोथी, समुद्र

राजदूतमुवाचेदं भगवान् प्रीणयन् गिरा । मा भैष्ट दूत ! भद्रं वो घातयिव्यामि मागधम् ॥१९  
 इत्युक्तः प्रस्थितो दूतो यथावदवदन्वपान् । तेऽपि सन्दर्शनं शौरैः प्रत्यैक्षन् यन्मुक्षवः ॥२०  
 आनर्तसौवीरमस्त्वित्वा विनशनं हरिः । गिरीन् नदीरतीयाय पुरग्रामवजाकरान् ॥२१  
 ततो दृषद्वर्तीं तीर्त्वा मुकुन्दोऽथ सरस्वतीम् । पञ्चालानथ मत्स्यांश्च शक्रप्रस्थमथागमत् ॥२२  
 तमुपागतमाकर्ण्य प्रीतो दुर्दर्शनं नृणाम् । अजातशत्रुनिरगात् सोपाध्यायः सुहृद्वतः ॥२३  
 गीतवादित्रघोषेण ब्रह्मघोषेण भूयसा । अभ्ययात् स हृषीकेशं प्राणाः प्राणमिवादृतः ॥२४  
 दृष्ट्वा विक्लिन्नहृदयः कृष्णं स्नेहेन पाण्डवः । चिराद् दृष्ट्वा प्रियतमं सस्वजेऽथ पुनः पुनः ॥२५  
 दोऽर्थां परिष्वज्य रमामलालयं मुकुन्दगांत्रं नृपतिर्हताशुभः ।  
 लेभे परां निर्वृतिमश्रुलोचनो हृष्टत्तर्नुर्विस्मृतलोकविभ्रमः ॥२६॥  
 तं मातुलेयं परिरभ्य निर्वृत्तो भीमः स्मयन् प्रेमजवाकुलेन्द्रियः ।  
 यमौ किरीटीं च सुहृत्तमं मुदा प्रवृद्धबाष्पाः परिरेभिरेऽच्युतम् ॥२७॥

जेम क्षोभ पामेला भत्स्यो अने तरंगोथी शोभे तेम दिवसमां शोभवा लाग्युं.<sup>१९</sup>  
 पछी भगवाने सत्कार करी पूजेला अने भगवाननां दर्शनथी परम आनंद पामेला नारदश्च भगवानने प्राणाम करी तथा तेमनो निश्चय सांभणी हृदयमां तेनुं ज ध्यान करता करता आकाशमार्गथी गया.<sup>२०</sup> पछी वयनथी प्रसन्न करता भगवाने राजाओना दूतने कहुं के हे दूत ! तुं राजाओने कहेजे के भय पामशो नहीं, तमारुं भलुं थशे हुं जरासंधने मरावीश.<sup>२१</sup> आ प्रमाणे भगवाने कहेतां त्यांथी गयेला दूते राजाओनी पासे ते वात यथास्थित कही संभणावी. धूटवाने ईच्छता राजाओ पण भगवानना दर्शननी वाट जोवा लाग्या.<sup>२०</sup> आनर्त, सौवीर अने मरुदेशने ओणंगी कुरुक्षेत्र, पर्वतो, नदीओ, गाम, पुर, व्रज अने खाणोना प्रदेशोने भगवान ओणंगी गया.<sup>२१</sup> पछी सरस्वती नदीने उतरी अने पंचाल तथा भत्स्य देशने ओणंगी ईद्रप्रस्थमां आव्या.<sup>२२</sup> जेनां दर्शन मनुष्योने हुर्लभ छे, एवा भगवानने आव्या सांभणी राज्ञ थयेला युधिष्ठिर राजा पोताना उपाध्यायो अने संबंधीओनी साथे सामा आव्या.<sup>२३</sup> ईद्रियो जेम मुख्य प्राणानी सामे जाय तेम आदरवाणा युधिष्ठिर राजा गाजते वाजते अने वेदना मोटा घोषनी साथे भगवाननी सामे गया.<sup>२४</sup> भगवानने जोई स्नेहथी जेनुं हृदय पलणी गयुं छे, एवा युधिष्ठिर राजाओ धाशे दिवसे देखेला परम खारा भगवाननुं वारंवार आलिंगन कर्यु.<sup>२५</sup> लक्ष्मीना सुंदर धरतुप श्रीकृष्णाना अंगनुं आलिंगन करी जेनां पाप नाश पाम्यां छे एवा युधिष्ठिर राजाना नेत्रमां धणुं सुख मणवाथी हर्षाश्रु आव्यां, रुवांडा

અર્જુનેન પરિષ્વકો યમાભ્યામભિવાદિતઃ । બ્રાહ્મણેભ્યો નમસ્કૃત્ય વૃદ્ધેભ્યશ્વ યથાર્હતઃ ॥૨૮  
માનિતૌ માનયામાસ કુરુસૃજ્યયકૈકયાન् । સૂતમાગધગન્ધર્વા બન્દિનશ્રોપમન્ત્રિણઃ ॥૨૯  
મૃદુઙ્ઘશછુંપટહીણાપણવગોમુખૈ: । બ્રાહ્મણાશ્વારવિન્દાક્ષાં તુષ્ટુવુર્નનૃતુર્જગુ: ॥૩૦  
એવં સુહૃદિઃ પર્યસ્તઃ પુણ્યશ્લોકશિખામણિઃ । સંસ્તૂયમાનો ભગવાન્ વિવેશાલંકૃતં પુરમ् ॥૩૧

સંસિક્તકર્તવ કરણાં મદગન્ધતોયैશ્ક્રિત્રધવ્જાઃ કનકતોરણપૂર્ણકૃષ્ણઃ ।

મૃષ્ણાત્મભર્નવદુકૂલવિભૂષણસ્ત્રગગન્ધૈર્ન્ભિર્યુવતિભિશ્વ વિરાજમાનમ् ॥૩૨॥

ઉદ્દીપદીપબલભિ: પ્રતિસદ્યજાલનિર્યાતધૂપુરચિરં વિલસત્યતાકમ् ।

મૂર્ધન્યહેમકલશૈ રજતોરુશૃંજ્ઞાણુંદર્શ ભવનૈ: કુરુરાજધામ ॥૩૩॥

પ્રાસં નિશાય્ય નરલોચનપાનપાત્રમૌત્સુક્યવિશલથિતકેશદુકૂલબન્ધા: ।

સદ્ગો વિસૃજ્ય ગૃહકર્મ પર્તીંશ તલ્પે દ્રષ્ટું યયુર્વતયઃ સ્મ નરેન્દ્રમાર્ગે ॥૩૪॥

ઓભાં થયાં અને તે બીજું કર્તવ્ય ભૂલી ગયા. ૨૬ હસતા અને પ્રેમના વેગથી આકુણ હંડિયોવાળા ભીમસેને એ પોતાના મામાના પુત્રનું આદિંગન કર્યું, અને તેથી તે ભીમસેનને પરમ સુખ મળ્યું. આનંદથી જેઓનાં આંસુ વધી ગયાં છે એવા અર્જુન, નકુલ અને સહદેવે પણ ભગવાનનું આદિંગન કર્યું. ૨૭ અર્જુન સમાન વયના હોવાને લીધે ભગવાનને કેવળ મળ્યા જ અને નકુલ તથા સહદેવ તો મળવા ઉપરાંત પગે પણ લાગ્યા. બ્રાહ્મણોને અને વૃદ્ધલોકોને યથાયોગ્ય રીતે નમસ્કાર કરી માન પામેલા ભગવાને કુરુ, સંજ્ય, કેક્ય, સૂત, માગધ, ગાંધર્વ, બંદિજનો અને ઉપમંત્રીઓને માન આપ્યું. ૨૮-૨૯ મૃદુંગ, શંખ, ઢોલ, વીજા, પણવ અને ગોમુખ નામનાં વાજ્ઞાં વાગવા લાગ્યાં. બ્રાહ્મણો પણ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યાં અને ગાવવા લાગ્યા. ૩૦ આ પ્રમાણે પવિત્ર ક્રીતિવાળા, પુરુષોના ચૂડામણિરૂપ અને સંબંધીઓથી વીંટાએલા તથા સ્તુતિ કરાતા ભગવાન શાશ્વતારેલા હંડ્રપસ્થપુરમાં પથાર્યા. ૩૧ એ પુરના માર્ગમાં હાથીઓના મદ અને સુગંધી જળોના છંટકાવ થઈ રહ્યા હતા. એ પુર વિચિત્ર ધજા, સોનાના તોરણ અને પૂર્ણ કુંભોથી શોભી રહ્યું હતું. સ્વચ્છ શરીરવાળા અને નવાં વસ્ત્રો, ધરેણાં, માળા તથા સુગંધોને ધારણ કરનારા પુરુષો અને સ્ત્રીઓથી શોભી રહ્યું હતું. ૩૨ ધેરધેર દીવા અને પુષ્પાદિકના સમૂહ શોભી રહ્યા હતા, જાળિયાઓમાંથી નીકળતા ધૂપના ધુમાડાઓથી મનોહર લાગતું હતું, પતાકાઓ શોભી રહી હતી, ઉપર સોનાના કળશવાળા અને કળશોની નીચે રૂપાનાં શિખરોવાળાં ધરોવાળું યુધિષ્ઠિરનું નગર ભગવાને જોયું. ૩૩ પુરુષોના નેત્રો પણ જેમાં લાગી જ રહે એવા ભગવાનને પથાર્યા સાંભળી, ઉત્સાહને લીધે

તસ્મિન્ સુસઙ્કુલ ભાશ્વરથદ્વિપદ્ધિ: કૃષ્ણાં સભાર્યમુપલભ્ય ગૃહાધિરૂઢાઃ ।

નાર્યો વિકીર્ય કુસુમૈર્નસોપગહૃ સુસ્વાગતં વિદ્ધુરુત્સમયવીક્ષિતેન ॥૩૫॥

ઊચુ: સ્ત્ર્યઃ પથિ નિરીક્ષ્ય મુકુન્દપલીસ્તારા યથોઙુપસહા: કિમકાર્યભૂમિ: ।

યચ્ચક્ષુષાં પુરુષમાલિરુદારહાસલીલાવલોકકલયોત્સવમાતનોતિ ॥૩૬॥

તત્ત્રતોપસઙ્ગમ્ય પૌરા મઙ્ગલપાણયઃ । ચત્રુ: સપર્ય કૃષ્ણાય શ્રેણીમુખ્યા હતૈનસ: ॥૩૭

અન્તઃપુરજનૈ: પ્રીત્યા મુકુન્દ: ફુલલોચનૈ: । સસપ્થમૈરભ્યુપેત: પ્રાવિશદ્ રાજમન્દ્રમ ॥૩૮

પૃથા વિલોક્ય ભાત્રેયં કૃષ્ણાં ત્રિભુવનેશ્વરમ । પ્રીતાત્મોથાય પર્યઙ્કાત્ સસ્નુષા પરિષસ્વજે ૩૯

ગોવિન્દ ગૃહમાનીય દેવદેવેશમાદૃતઃ । પૂજાયાં નાવિદત્ કૃત્ય પ્રમોદોપહતો નૃપ: ॥૪૦

પિતૃષ્વસુરુસ્ત્રીણાં કૃષ્ણશ્ક્રેઽભિવાદનમ । સ્વયં ચ કૃષ્ણાય રાજન્ ! ભગિન્યા ચાભિવન્દિઃ

શશ્વા સઞ્ચોદિતા કૃષ્ણા કૃષ્ણપલીશ્ સર્વશ: । આનંદ રુક્મિણી સત્યાં ભદ્રાં જાબ્વવતી તથા

જેઓના કેશ અને વસ્ત્રોનાં બંધનો શિથિલ થઈ ગયાં હતાં, એવી યુવતિ સ્ત્રીઓ

ઘરના કામ કાજને અને પતિને પણ પલંગ ઉપર છોડી દઈ રાજમાર્ગમાં જોવા

આવી. ૩૪ હાથી, ઘોડા, રથ અને માણસોથી બહુ જ ભીડવાળા રાજમાર્ગમાં સ્ત્રીઓ

સહિત ભગવાનને આવેલા જાણી, ઘર ઉપર ચઢેલી કેટલીક સ્ત્રીઓ ફૂલથી વધાવી

તથા મનથી આદિંગન કરીને ઉત્સાહ ભરેલા કટાક્ષોથી જ માન આપવા લાગી. ૩૫

ચંદ્રની સાથે તારાઓની પેટે માર્ગમાં ભગવાનની સાથે તેમની સ્ત્રીઓને જોઈને,

હંડ્રપસ્થની સ્ત્રીઓ વાતો કરવા લાગી કે “આ સ્ત્રીઓ કે જેઓના નેત્રોને પુરુષોત્તમ

ભગવાન પોતાના મંદ હાસ્યથી અને લીલાપૂર્વક જોવાની કળાથી આનંદ આપે

છે, તેઓએ શા પુણ્ય કર્યા હશે ? ૩૬ પાપ રહિત થયેલા પૌર લોકો અને વ્યાપાર

ચલાવનારા મહાજનોના આગોવાનો હાથમાં મંગળ પદાર્થ રાખી, સ્થળે સ્થળે

ભગવાનને મળીને તેમની પૂજા કરવા લાગ્યા. ૩૭ પ્રીતિથી પ્રકુલ્પિત નેત્રવાળી

અને ઘણાં સંભમવાળી અંત:પુરની સ્ત્રીઓએ સામે જઈને જેમને માન આપ્યું છે,

એવા ભગવાન રાજના ઘરમાં પદાર્થા. ૩૮ ત્રિલોકના ઈશ્વર અને પોતાના ભાઈના

પુત્ર ભગવાનને જોઈ રાજ થયેલાં કુંતીએ પોતાની વહુ દ્રૌપદી સહિત ઢોલિયા

પરથી ઊઠીને તેમનું આદિંગન કર્યું. ૩૯ આદરવાળા યુધિષ્ઠિર મોટા દેવતાઓના

પણ સ્વામી એવા, શ્રીકૃષ્ણને પોતાને ઘેર તેદી લાવીને પ્રેમથી વિબ્બળ થઈ જવાને

લીધે પૂજનના કેટલાક પ્રકારોને પણ ભૂલી ગયા. ૪૦ હે રાજ ! શ્રીકૃષ્ણ ભગવાન

પોતાની ઝોઈને અને ગુરુજનની સ્ત્રીઓને પગે લાગ્યા, અને દ્રૌપદી તથા સુભદ્રા

તેમને પગે લાગ્યાં. ૪૧ સાસુએ પ્રેરણા કરવાથી દ્રૌપદીએ રુક્મિણી, સત્યમામા,

कालिन्दी मित्राविन्दां च शैव्यां नागनजितीं सतीम् । अन्याश्चाभ्यागता यास्तु वासः स्वद्यमण्डनादिभिः सुखं निवासयामास धर्मराजो जनार्दनम् । सैन्यं सानुगामात्यं सभार्यं च नवं नवम् ॥४४ तर्पयित्वा खाण्डवेन वर्ह्णं फाल्युनसंयुतः । मोचयित्वा मयं येन राजे दिव्या सभा कृता ४५ उवास कतिचिन्मासान् राजः प्रियचिकीर्षया । विहरन् रथमारुह्यं फाल्युनेन भट्टैवृतः ॥४६

इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्दे उत्तरार्थं  
कृष्णस्येन्द्रप्रस्थगमनं नामैकसप्ततितमोऽध्यायः ॥७१॥

### अथ द्विसप्ततितमोऽध्यायः (७२)

॥ श्रीशुक उवाच ॥

एकदा तु सभामध्ये आस्थितो मुनिभिर्वृतः । ब्राह्मणैः क्षत्रियैर्वैश्यैर्भ्रातृभिश्च युधिष्ठिरः ॥१ आचार्यैः कुलवृद्धैश्च ज्ञातिसम्बन्धिबान्धवैः । शृण्वतामेव चैतेषामाभाष्येदमुवाच ह ॥२ भद्रा, ज्ञांभवती, कालिंदी, भित्रविन्दा, शैव्या, नागनजिती अने बीजुं पश्च भगवाननी जे स्त्रीओ आवी हती, तेओनी वस्त्र, भाणा अने आभरणादिकथी पूजा करी ॥२-४४ भगवानने, तेमना सैन्यने, अनुचरोने, मंत्रीओने अने स्त्रीओने युधिष्ठिर राजाए दृरोज नवां नवां लागे अंवां सुखथीं ईंद्रप्रस्थमां राष्यां, प्रेमथी अर्जुननी साथे निरंतर रहेता भगवाने अर्जुनने सहायता आपी, खांडव वनथी अग्निने तृष्ण कराव्यो अने मयदानव के जेषो पृथीथी युधिष्ठिर राजाने दिव्य सभा करी आपी हती तेने अग्निमांथी छोडाव्यो ॥४५ अर्जुननी साथे रथमां बेसी योद्धाओथी वींटाईने विहार करता भगवान राजानुं प्रिय करवानी ईश्वाथी केटलाक महिना सुधीं ईंद्रप्रस्थमां रह्या ॥४६

इति श्रीमद्भागवताणा भागवतना दशम स्कन्दनो अेकोतेरमा  
अध्यायं संपूर्णं ।

### अध्यायः ७२

राजसूय यज्ञं प्रसंगे भगवाने भीमसेन द्वारा ज्ञासंधनो वथ  
कराव्यो ।

शुकदेवज्ञ कुहे छे हे राजा ! एक दिवसे मुनि, ब्राह्मणो, क्षत्रियो, वैश्यो, भाईओ, आचार्यो, कुणना वृद्ध पुरुषो, शाति, संबंधी अने बांधवोथी वींटाईने सभानी अंदर सिंहासन पर बेठेला युधिष्ठिर राजाए ऐ सर्वे लोकोना सांभणतां

युधिष्ठिर उवाच  
क्रतुराजेन गोविन्द ! राजसूयेन पावनीः । यक्ष्ये विभूतीर्भवतस्तत् सम्पादय नः प्रभो ! ॥३ तत्पादुके अविरतं परि ये चरन्ति ध्यायन्त्यभद्रनशने शुचयो गृणन्ति । विन्दन्ति ते कमलनाभ ! भवापवर्गमाशासते यदि त आशिष इश ! नान्ये ॥४॥ तद् देवदेव ! भवतश्चरणारविन्दसेवानुभावमिह पश्यतु लोक एषः । ये त्वां भजन्ति न भजन्युत वोभयेषां निष्ठां प्रदर्शय विभो ! कुरुसृज्जयानाम् ॥५॥ न ब्रह्मणः स्वपरभेदमतिसत्व स्यात् सर्वात्मनः समदूशः स्वसुखानुभूतेः । संसेवतां सुरतरोरिव ते प्रसादः सेवानुरूपमुदयो न विपर्ययोऽत्र ॥६॥ श्रीभगवानुवाच

सम्प्रग् व्यवसितं राजन् ! भवता शत्रुकर्शन ! । कल्याणी येन ते कीर्तिलोकाननुभविष्यति । भगवानने संबोधन आपीने आ प्रमाणे कहुं ।<sup>१-२</sup>

युधिष्ठिर राजा कुहे छे हे गोविंद ! हे प्रभु ! सर्वयज्ञोना राजा राजसूय नामना यज्ञथीं हुं आपना अंशरूप देवताओनुं पूजन करवा धारुं छुं, तो ते अमारुं काम आप सिद्ध करी आपो ।<sup>३</sup> हे पद्मनाभ ! हे ईश्वर ! जे पवित्र लोको अमंगणो नाश करनारी आपनी पादुकानुं देहथी निरंतर सेवन करे छे, मनथी ध्यान करे छे अने वाणीथी वर्षण करे छे, तेओ मोक्ष पामे छे, अने जो ईश्वरा होय तो संसार संबंधी सुखोने पश्च तेओ ज पामे छे; परंतु भक्ति वगरना यक्षर्ताओ पश्च पामता नथी ।<sup>४</sup> एटला माटे हे देवना देव ! आ लोको आपना यरणारविंदनी सेवाना प्रभावने देखे, ऐम आ विषयमां थवुं जोईओ. हे प्रभु ! आ कुरु अने सूर्य राजाना वंशना केटलाक हुर्योधनादिक पुरुषो के जेओ कमादिकने प्रधान गणीने आपनी भक्तिने उत्तम मानता नथी, अने अमारा जेवा केटलाक तमोने भजे छे, ऐ भजेनी स्थिति देखाओ. (अर्थात् तमोने भजे छे तेने शुं फण प्राम थाय छे ? अने नथी भजता तेने शुं फण प्राम थाय छे ? ऐ भजेनी स्थिति देखाओ) <sup>५</sup> आप के जे उपाधि रहित सर्वना आत्मा, समदृष्टिवाणा अने स्वरूप सुखना अनुभवरूप छो, ते आपने जो के पोताना पारकानी भेदभुद्धि न ज होय, तोपश्च कल्पवृक्षनी पेठे आपने सेवनाराओने ज आपनो प्रसाद मणे छे, पश्च बीजाओने मणतो नथी. अने तेमां पश्च जे फण मणे छे ते सेवाना प्रमाणमां मणे छे, ऐमां ईरक्षार थतो नथी ।<sup>६</sup>

श्रीभगवान कुहे छे हे राजा ! हे शत्रुओनो नाश करनार ! तमे बहु ज सारो

ऋषीणां पितृदेवानां सुहृदामपि नः प्रभो ! । सर्वेषामपि भूतानामीप्सितः क्रतुराडयम् ॥८  
विजित्य नृपतीन् सर्वान् कृत्वा च जगतीं वशे । सम्भृत्य सर्वसम्भारानाहरस्व महाक्रतुम् ॥९  
एते ते भ्रातरो राजन् ! लोकपालांशसम्भवाः । जितोऽस्म्यात्मवता तेऽहं दुर्जयो योऽकृतात्मभिः ॥१०  
न कश्चिन्मत्परं लोके तेजसा यशसा श्रिया । विभूतिभिर्वाभिभवेद् देवोऽपि किमु पार्थिवः ॥११

## श्रीशुक उवाच

निशम्य भगवदीतं प्रीतः फुलमुखाम्बुजः । भ्रातृन् दिग्विजयेऽयुडक्त विष्णुतेजोपबृहितान्  
सहदेवं दक्षिणस्यामादिशत् सह सृज्जयैः । दिशि प्रतीच्यां नकुलमुदीच्यां सव्यसाचिनम् ।

प्राच्यां वृकोदरं मत्ख्येः केकयैः सह मद्रैकैः ॥१३  
ते विजित्य नृपान् वीरा आजहुर्दिग्भ्य ओजसा । अजातशत्रवे भूरि द्रविणं नृप ! यक्ष्यते ॥१४  
श्रुत्वाजितं जरासन्धं नृपतेर्ध्यायतो हरिः । आहोपायं तमेवाद्य उद्धवो यमुवाच ह ॥१५  
भीमसेनोऽर्जुनः कृष्णो ब्रह्मलिङ्गधरास्त्रयः । जग्मुर्गिरिव्रजं तात ! बृहद्रथसुतो यतः ॥१६

निश्चय कर्यो छे, के जेथी तमारी पवित्र कीर्ति लोकोमां फैलाई जशे, ऋषिओ,  
पितृ, देव, अमो संबंधीओ अने सर्वे प्राणीओने पश्च ए मोटो यज्ञ घ्यारो छे.<sup>७८</sup>  
सर्वे राजाओने छती, सर्वे पृथ्वीने वश करी, सर्व सामान भेणो करीने मोटो यज्ञ  
करो.<sup>९</sup> हे राजा ! आ तमारा भाईओ लोकपाणना अंशोथी उत्पन्न थया छे, अने  
जे हुं अजितेन्द्रिय पुरुषोने वश थतो नथी, ते भने पश्च तमे पोताना  
जितेन्द्रियपशाथी वश कर्यो छे.<sup>१०</sup> जे पुरुष मारो भक्त होय तेने देवता पश्च  
तेजथी, पशथी, लक्ष्मीथी अथवा सैन्यादिक सामग्रीओथी पराभव न करी शके,  
त्यारे राजानी तो शी ज वात करवी ?<sup>११</sup>

शुकदेवज्ञ कहे छे भगवाननुं वयन सांभणी आनंदथी प्रकृत्वित मुखवाणा  
युधिष्ठिर राजाओ, विष्णुना तेजथी वृद्धि पामेला भाईओने दिग्विजय करवानी  
आशा करी.<sup>१२</sup> सहदेवने सूंज्यकुणना क्षत्रियोनी साथे दक्षिण दिशामां मोकल्या,  
नकुणने केक्य देशना क्षत्रियोनी साथे पश्चिम देशमां मोकल्या, अर्जुनने मद्रदेशना  
क्षत्रियोनी साथे उत्तर दिशामां मोकल्या अने भीमसेनने मत्स्य देशना क्षत्रियोनी  
साथे पूर्व दिशामां मोकल्या.<sup>१३</sup> हे राजा ! ऐ वीरपुरुषोअे पराक्रमथी राजाओने  
छती लई यज्ञ करवाने ईच्छता युधिष्ठिर राजाने दिशाओमांथी घण्युं धन लावी  
आप्युं.<sup>१४</sup> ऐ दिग्विजयमां जरासंधने नहीं जिताअेलो सांभणी, युधिष्ठिर राजा  
यितामां पडतां, भगवाने ते ज उपाय कह्यो, के जे उद्धवज्ञअे कह्यो हतो.<sup>१५</sup> पछी  
भीमसेन, अर्जुन अने श्रीकृष्ण ऐ त्राण जाणा भ्रात्मणोनो वेश धरीने गिरिव्रजमां

ते गत्वाऽऽतिथ्यवेलायां गृहेषु गृहमोथिनम् । ब्रह्माण्यं समयाचेरन् राजन्या ब्रह्मलिङ्गिनः ॥१७  
राजन् ! विद्युतिथीन् प्राप्तार्थिनो दूरमागतान् । तत्रः प्रयच्छ भद्रं ते यद् वयं कामयामहे<sup>१८</sup>  
किं दुर्मर्ष तितिक्षाणां किमकार्यमसाधुभिः । किं न देयं वदान्यानां कः परः समदर्शिनाम् ॥१९  
योऽनित्येन शरीरेण सतां गेयं यशो ध्रुवम् । नाचिनोति स्वयं कल्पः स वाच्यः शैच्य एव सः  
हरिश्चन्द्रो रन्निदेव उज्ज्वृत्तिः शिबिर्बलिः । व्याधः कपोतो बहवो ह्यध्रुवेण ध्रुवं गताः ॥२१

## श्रीशुक उवाच

स्वरैराकृतिभिस्तांस्तु प्रकोष्ठैर्ज्याहृतैरपि । राजन्यबन्धून् विज्ञाय दृष्टपूर्वान्विन्दितयत् ॥२२  
राजन्यबन्धवो होते ब्रह्मलिङ्गानि विभ्रति । ददामि भिक्षितं तेभ्य आत्मानमपि दुस्त्वजम्<sup>२३</sup>  
बलेर्नु श्रूयते कीर्तिवितता दिक्षवकल्मषा । ऐश्वर्यद् भृंशितस्यापि विप्रव्याजेन विष्णुना ॥२४  
श्रियं जिहीर्षेन्द्रस्य विष्णवे द्विजस्त्वपिणे । जानन्नपि महीं प्रादाद् वार्यमाणोऽपि दैत्यराट् ॥२५

गया, के ज्यां जरासंध रहेतो हतो.<sup>१६</sup> भ्रात्मणो वेश धरनारा ऐ क्षत्रियोअे  
भ्रात्मणने माननारा अने गृहस्थनो धर्म पाणनारा जरासंधने धेर अतिथिना  
पूजनना समयमां जैर्ने माझयुं के हे राजा ! अमोने मागवानी ईच्छाने लीधे  
दूरथी आवेला अतिथि जाणो, अने एटला माटे अमो जे ईच्छीअे छीअे ते  
आपो.<sup>१७-१८</sup> जेम नीच पुरुषोने कांઈ पश्च अकार्य होतुं नथी, तेम सहनशील  
पुरुषोने कांઈ पश्च असह्य होतुं नथी. अत्यंत उदार पुरुषोने कांઈ पश्च नहि  
देवानुं होतुं नथी अने समदृष्टिवाणा पुरुषोने कोई पश्च परायो होतो नथी.<sup>१९</sup> जे  
पुरुष पोते समर्थ छतां आ अनित्य शरीरथी, सत्पुरुषोअे गावा जेवा अविच्यण  
यशने भेणवतो नथी, ते निंदानुं अने खेद करवानुं पात्र थाय छे.<sup>२०</sup> हरिश्चन्द्र,  
रंतिदेव, उंछवृत्ति, शिबि, बणि, पारधि, होलो अने बीजा पश्च धण्णा लोको आ  
अनित्य शरीरथी अविच्यण पट पामी गया छे.<sup>२१</sup>

शुकदेवज्ञ कहे छे स्वर आकृति अने जेओमां धनुषपनी दोरीओ वागवाना  
उध हता, ऐवां कांडां उपरथी तेओने क्षत्रिय जाणीने अने वणी कोई समये  
जेयेला जाणीने जरासंधे विचार कर्यो के “आ लोको जातना क्षत्रिय होवा छतां  
पश्च भ्रात्मणो वेश पहेरी आव्या छे, माटे आ लोकोने मारे अत्यंत प्रिय आत्मा  
आपवो पडशे तोपश्च आपीश.<sup>२२-२३</sup> जे बणिराजाने भ्रात्मणो वेश धरी आवेला  
विष्णुअे ऐश्वर्यथी भए कर्यो हतो, ते बणिराजानी सर्वत्र फैलाअेली पवित्र कीर्ति  
सांभणवामां आवे छे.<sup>२४</sup> बणिराजाने शुकाचार्ये वारवा मांडयो अने वणी पोते  
जाणतो हतो, तोपश्च जे विष्णु ईद्रने राज्य अपाववानी ईच्छाथी भ्रात्मणनुं रुप

जीवता ब्राह्मणार्थाय को न्वर्थः क्षत्रबन्धुना । देहेन पतमानेन नेहता विपुलं यथः ॥२६  
इत्युदारमतिः प्राह कृष्णार्जुनवृकोदरान् । हे विप्रा ! व्रियतां कामो ददाम्यात्मशिरोऽपि वः २७

## श्रीभगवानुवाच

युद्धं नो देहि राजेन्द्र ! द्वन्द्वशो यदि मन्यसे । युद्धार्थिनो वयं प्राप्ता राजन्या नान्नकाङ्क्षणः २८  
असौ वृकोदरः पार्थस्तस्य भ्रातार्जुनो ह्ययम् । अनयोर्मातुलेयं मां कृष्णं जानीहि ते स्तिपुम् २९  
एवमावेदितो राजा जहासोच्चैः स्म मागधः । आह चामर्षितो मन्दा युद्धं तर्हि ददामि वः ३०  
न त्वया भीरुणा योत्स्ये युधि विकलवचेतसा । मथुरां स्वपुरी त्यक्त्वा समुद्रं शरणं गतः ३१  
अयं तु वयसा तुल्यो नातिसन्त्वो न मे समः । अर्जुनो न भवेद् योद्धा भीमसुत्युबलो मम ३२  
इत्युक्त्वा भीमसेनाय प्रादाय महतीं गदाम् । द्वितीयां स्वयमादाय निर्जगाम पुराद् बहिः ३३  
ततः समे खले वीरौ संयुक्तावितरेतरौ । जघ्नतुर्वज्रकल्पाभ्यां गदाभ्यां रणदुर्मदौ ३४  
मण्डलानि विचित्राणि सब्वं दक्षिणमेव च । चरतोः शुशुभे युद्धं नटयोरिव रङ्गिणोः ३५

धरी आव्या हता, ते विष्णुने भणीराज्ञामे पृथ्वीनुं दान दीधुं हतुं.<sup>२५</sup> क्षत्रिय जातनो  
देह छवतां छतां पश ब्राह्मणानो अर्थं संपादन करीने भोटी कीर्ति न मेणवे, तो ते  
देहनुं प्रयोजनं पश शुं छे ?<sup>२६</sup>" आवो विचार करी उदार बुद्धिवाणा जरासंधे  
श्रीकृष्ण, अर्जुन अने भीमसेनने कहुं के हे ब्राह्मणो ! जे ज्ञेठाए ते माणी लो.  
मारुं माथुं मागशो तो ते पश हुं आपीश.<sup>२७</sup>

भगवान कहे छे हे भोटी राजा ! जो तमारे देवानी ईरच्छा होयतो अमने  
दंद्युद्ध आपो. अमे क्षत्रिय छीअे अने युद्धनी ईरच्छाथी आव्या छीअे, अपनी  
ईरच्छाथी आव्या नथी.<sup>२८</sup> आ कुंतीनो पुत्र भीमसेन छे. आ तेनो भाई अर्जुन छे  
अने हुं आ बेना मामानो दीकरो अने तमारो शत्रु कृष्ण छुं अम जाणो.<sup>२९</sup>

शुक्टेवज्ज कहे छे आ प्रमाणे श्रीकृष्ण वात कहेतां जरासंध उंचा स्वरथी  
हस्यो अने कोधथी भोत्यो के हे भूढलोको ! अम होय तो अत्यारे हुं तमोने युद्ध  
आपुं छुं.<sup>३०</sup> भीक्षु अने युद्धमां विकण चितवाणो जे तुं, पोतानी नगरी भथुराने  
छोटीने समुद्रने शरणे गयो छे, माटे तारी साथे हुं युद्ध नहीं करुं.<sup>३१</sup> आ अर्जुन  
अवस्थाथी पश मारा सरभो नथी, बहु बणवान नथी अने शरीरथी पश मारा  
सरभो नथी, माटे ते मारी साथे युद्ध करी शके नहि, जे भीममां मारां सरभुं ज  
बण छे, ते भीमे मारी साथे युद्ध करवुं"<sup>३२</sup> आ प्रमाणे बोली भीमसेनने भोटी  
गदा आपी, एक भोटी गदा पोते लઈने जरासंध गाम बहार नीकण्यो.<sup>३३</sup> पछी  
युद्ध भूमिमां भेणा थयेला अने युद्धमां मदोन्मत ए बे वीरपुरुषो वज्ज जेवी

ततश्चटचटाशब्दो वज्रनिष्पेषसंनिभः । गदयोः क्षिसयो राजन् ! दन्तयोरिव दन्तिनोः ॥३६  
ते वै गदे भुजजवेन निपात्यमाने अन्योन्यतोऽसकटिपादकरोरुजवून् ।

चूर्णीबभूवतुरुपेत्य यथार्कशाखे संयुध्यतोद्विरदयोरिव दीपमन्योः ॥३७॥

इत्थं तयोः प्रहतयोर्गदयोर्नैवीरौ कुद्धौ स्वमुष्टिभिरयः स्पर्शरपिष्टाम् ।

शब्दस्तयोः प्रहरतेरिभयोरिवासीन्निर्वातवज्रप्रूपस्तलताडनोत्थः ॥३८॥

तयोरेवं प्रहरतोः समशिक्षाबलौजसोः । निर्विशेषमभूद् युद्धमक्षीणजवयोर्नैप ॥३९

एवं तयोर्महाराज युध्यतोः सप्तविंशतिः । दिनानि निरगंस्तत्र सुद्धनिशि तिष्ठतोः ॥४०

एकदा मातुलेयं वै प्राह राजन् ! वृकोदरः । न शक्तोऽहं जरासंधं निर्जेतुं युधि माधव ! ॥४१

शत्रोर्जन्ममृती विद्वान् जीवितं च जराकृतम् । पार्थमाप्याययन् स्वेन तेजसाचिन्तयद्वरिः ४२

सञ्चिन्त्यारिवधोपायं भीमस्यामोघदर्शनः । दर्शयामास विटपं पाटयन्निव संजया ॥४३

गदाओथी एकभीजाने प्रहार करवा लाग्या. ४४ अभाडामां पटा खेलता नटोनी

पेठे डाबां जमणां विचित्र मंडणोमां फरता ए बे जाणुनुं युद्ध शोभवा लाग्युं. ४५ हे

राजा ! पछी प्रहार करवामां आवती बे गदाओनो वज्ज पडवा सरभो कडाकानो

शब्द, युद्ध करता बे हाथीओना दांतना शब्द जेवो जाणावा लाग्यो. ४६ युद्ध करता

अने प्रदीपं कोधवाणा बे हाथीओथी आकडानी शाखाओ जेम अंगमां पछाडाईने

भांगी पडे, तेम हाथना वेगथी फेंकवामां आवती ए बे गदाओ एक भीजाना

भज्मा, केड, पग, हाथ, साथण अने हांसटीओमां पछाडाईने चूर्ण थई गई. ४७

आ प्रमाणे गदाओ भांगी पडतां कोध पामेला ए बे वीर पुरुषो लोढा सरभा

स्पर्शवाणी पोतानी मुठीओथी एक भीजानां गात्रने भांगवा लाग्या. हाथीनी पेठे

प्रहार करता ए बे जाणाओनो हथेणीओना मारवाथी उठेलो शब्द वज्जना कडाका

जेवो भयंकर थतो हतो. ४८ हे राजा ! अभ्यास, धैर्य अने प्रभावमां सरभा तथा

जेओनो वेग क्षीण थतो न हतो एवा ए भीम अने जरासंधने सरभुं युद्ध

थवा लाग्युं. ४९ आ प्रमाणे दिवसमां युद्ध करता अने रात्रीमां मित्रनी पेठे रहेता

ए भन्ने जाणाने ते स्थणमां सत्यावीश दिवस नीकणी गया. ५० हे राजा ! एक

दिवसे भीमसेने पोताना मामाना पुत्र भगवानने कहुं के "हे कृष्ण ! हुं युद्धमां

जरासंधने ज्ञतवाने समर्थ नथी." ५१ जरासंध बे फाडियां रुपे जन्म्यो हतो अने

पाछो ए फाडियां थईने भरशे एम जाणता अने तेने जरा नामनी राक्षसीए

जिवाडेलो छे तेने पश जाणता, श्रीकृष्ण भगवाने पोतानी शक्तिथी भीमने

भणवान करी जरासंधना फाडियां करी नाभवानो विचार कर्या. ५२ अमोध

तद् विज्ञाय महासत्त्वो भीमः प्रहरतां वरः । गृहीत्वा पादयोः शत्रुं पातयामास भूतले ॥४४  
एकं पादं पदाऽऽक्रम्य दोभ्यामन्यं प्रगृह्ण सः । गुदतः पाटयामास शाखामिव महागजः ॥४५  
एकपादोरुवृषणकटिपृष्ठस्तनांसके । एकबाह्वक्षिभूकर्णे शकले ददृशुः प्रजाः ॥४६  
हाहाकारो महानासीन्निहते मगधेश्वरे । पूजयामासतुर्भीमं परिरभ्य जयाच्युतौ ॥४७  
सहदेवं तत्तनयं भगवान् भूतभावनः । अभ्यषिष्ठदमेयात्मा मगधानां पर्ति प्रभुः ।

मोचयामास राजन्यान् संरुद्धा मागधेन ये ॥४८

इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे उत्तरार्द्धे जरासन्धवधो  
नाम द्विसप्तितमोऽध्यायः ॥७२॥

### अथ त्रिसप्तितमोऽध्यायः (७३)

॥ श्रीशुक उवाच ॥

अयुते द्वे शतान्यष्टौ लीलया युधि निर्जिताः । ते निर्गता गिरिद्रोण्यां मलिना मलवाससः ॥१  
क्षुत्क्षामाः शुष्कवदनाः संरोधपरिकर्शिताः । ददृशुस्ते घनश्यामं पीतकौशेयवाससम् ॥२  
श्रीवत्साङ्कं चतुर्बहुं पद्मगर्भारुणोक्षणम् । चारुप्रसन्नवदनं स्फुरन्मकरकुण्डलम् ॥३

ज्ञानवाणा भगवाने जरासंधने भारवाना उपायनो विचार करीने हाथमां वृक्षनी  
सणी लઈ “जेम हुं आ सणीने चीरुं तेम तुं शत्रुने चीरी नाख” आ रीते संकेतथी  
ते उपाय भीमने देखाइयो.<sup>४३</sup> भहाबुवान अने युद्ध करनाराओमां उत्तम  
भीमसेने ते संकेत जाणी लઈने, जरासंधने तेना पग पकडीने धरती पर  
पढाइयो.<sup>४४</sup> भीमसेने पोताना पगथी तेनो एक पग दबावी ने बीजो पग बे  
हाथथी पकडीने हाथी जेम शाखाने चीरी नाखे तेम ते जरासंधने गुदाथी चीरी  
नाख्यो.<sup>४५</sup> ते समये जेओमां पग, साथण, वृषषण, केड, वांसानो भाग, स्तन,  
भभो, हाथ, आंध, भभर अने कान एक एक हतां ऐवां ते बे फाडियां लोको ए  
जोयां.<sup>४६</sup> भगध देशनो स्वाभी जरासंध भरणा पामतां मोटो हाहाकार थई रह्यो,  
अर्जुन अने भगवाने भीमसेननुं आलिंगन करी तेनो सत्कार कर्यो.<sup>४७</sup> प्राणीओना  
रक्षक अने जाण्यामां न आवे ऐवा स्वरूपवाणा प्रभु श्रीकृष्णे जरासंधना दीकरा  
सहदेवनो भगधदेशमां राज्याभिषेक कर्यो, अने जे राजा ओने जरासंधे केद कर्या  
हता तेओने छोडाव्या.<sup>४८</sup>

इति श्रीमद् महापुराणा भागवतना दशम स्कन्धनो बोतेरमो अद्याय संपूर्णः

पद्महस्तं गदाशङ्करथाङ्गैरुपलक्षितम् । किरीटहारकटकटिसूत्राङ्गदाचितम् ॥४  
भ्राजद्वरमणिग्रीवं निवीतं वनमालया । पिबन्त इव चक्षुभ्या लिहन्त इव जिह्वया ॥५  
जिघन्त इव नासाभ्यां रम्भन्त इव बाहुभिः । प्रणेमुर्हतपाप्मानो मूर्धभिः पादयोहरीः ॥६  
कृष्णसन्दर्शनाहादध्वस्तसंरोधनकलमाः । प्रशंसंसुर्हषीकेशं गीर्भिः प्राज्जलयो नृपाः ॥७

राजान उचुः

नमस्ते देवदेवेश! प्रपन्नार्तिहराव्यय ! । प्रपन्नान् पाहिनः कृष्ण ! निर्विणान् घोरसंसृतेः ॥८  
नैनं नाथान्वसूयामो मागधं मधुसूदन ! । अनुग्रहो यद् भवतो राज्ञां राज्यच्युतिविभो ॥९  
राज्यैश्वर्यमदोन्नद्धो न श्रेयो विन्दते नृपः । त्वमायामोहितोऽनित्या मन्यते सम्पदोऽचलाः ॥१०

### अद्याय ७३

ज्ञासंधे केद करेला राजाओने, श्रीकृष्ण भगवाने छोडावी,  
तेओने पोतानां राज्य पाणां सोप्यां.

शुकृदेवज्ञ कहे छे हे राजा ! वीशहज्ञार अने आठसो राजाओ, के जेओने  
जरासंधे लीला मात्रथी युद्धमां ज्ञती लઈने पर्वतनी गुफामां केद कर्या हता, तेओ  
गुफामांथी बहार नीकण्या. मेलां वस्त्रवाणा, सूक्कामेलां मोढांवाणा अने केदमां  
रहेवाने लीधे दुबणा थयेला ते राजाओने पीणां रेशमी वस्त्र धरनारा, श्रीवत्सनां  
चिह्नवाणा, चार भुजावाणा, कमणी पांखडी सरभा नेत्रवाणा, सुंदर प्रसन्न  
मुखवाणा, चण्डकतां मकराकृति कुंडणवाणा, शंख, चक्र, गदा अने पद्मथी शोभता,  
किरीट, हार, कडां, कटिमेखला तथा बाजुबंधथी शोभी रहेला, वणी  
कौस्तुभभणिथी शोभता गणावाणा अने वनमाणाथी वींटामेला घनश्याम  
भगवानने दीठा. जाणे नेत्रथी पीता होय. ज्ञभथी चाटता होय, नाकथी सूंधता  
होय अने हाथथी आलिंगन करता होय तेम देखाव आपता ए निष्पाप राजाओ  
ते भगवानना चरणामां भस्तक मूकीने पगे लाया.<sup>१-६</sup> भगवानना दर्शनना  
आनंदथी जेओने केद रहेवानो परिश्रम मटी गयो छे, ऐवा ए राजा ओ हाथ  
जोडीने वयनथी, आ प्रमाणे भगवानने वधाणवा लाया.<sup>७</sup>

राजा ओ कहे छे हे देव ! हे ईश्वर ! हे शरणागतोनी पीडाने हरनारा !  
आपने प्रणाम करीऐ छीऐ. हे कृष्ण ! भयंकर संसारथी खेद पामीने शरणागत  
थयेला अमारुं रक्षणा करो.<sup>८</sup> हे नाथ ! हे मधुसूदन ! आ जरासंध उपर अमे दोष  
मूकता नथी. केमके राजा ओ राज्यथी भ्रष्ट थाय ए तमारो अनुग्रह गणवो  
जोईऐ.<sup>९</sup> राज्यसंबंधी ऐश्वर्यना मदथी छक्री गअेला राजा ओ कल्याणने पामता

मृगतृष्णां यथा बाला मन्यन्त उदकाशयम् । एवं वैकारिकीं मायामयुक्ता वस्तु चक्षते ॥११  
वयं पुरा श्रीमदनष्टदृष्ट्यो जिगीषयास्या इतरेतरस्पृधः ।

छन्तः प्रजाः स्वा अतिनिर्दृष्णाः प्रभो मृत्युं पुरस्त्वाविगणव्य दुर्मदाः ॥१२॥  
त एव कृष्णाद्य गभीररंहसा दुरन्तवीर्येण विचालिताः श्रियः ।  
कालेन तन्वा भवतोऽनुकम्पया विनष्टदर्पणश्चरणौ स्मराम ते ॥१३॥  
अथो न राज्यं मृगतृष्णास्तपितं देहेन शश्त्रं पतता रुजां भुवा ।  
उपासितव्यं मृगतृष्णामहे विभो क्रियाफलं प्रेत्य च कर्णरोचनम् ॥१४॥

तं नः समादिशोपायं येन ते चरणाब्जयोः । स्मृतिर्था न विरमेदपि संसरतमिह ॥१५  
कृष्णाय वासुदेवाय हरये परमात्मने । प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः ॥१६

## श्रीशुक उवाच

संस्तूप्यमानो भगवान् राजभिर्मुक्तबन्धनैः । तानाह करुणस्तात शरण्यः श्लक्षण्या गिरा १७

नथी, कारण के तेऽो तमारी मायाथी मोह पामीने अनित्य संपत्तिओने अविच्छिन्न  
माने छे.<sup>१०</sup> जेम बाणको जांजवानां पाणीने जग्नाशय माने, तेम अविवेकी लोको  
अनेक विकारवाणी अस्थिर मायाने स्थिर माने छे.<sup>११</sup> हे श्रीकृष्ण ! जे अमो पूर्वे  
लक्ष्मीना मदथी आंधणा थयेला हता, अने आ पृथ्वीने ज्ञती लेवानी ईच्छाथी  
एक बीजानो द्वेष करनारा हता, अने माथे मृत्युरुप आपने नहीं गणकारी  
मदोन्मत्त थईने अत्यंत निर्दयपणाथी पोतानी प्रजाओने मारता हता, ते ज  
अमो आज तमारी कृपाथी गंभीर वेगवाणा तमारा शरीररुप अने अपार  
बणवाणा कणने लीघे लक्ष्मीथी भ्रष्ट थतां गर्व रहित थईने तमारां चरणानुं  
स्मरण करवानी आशा राखीए छीअे, माटे राज्यथी भ्रष्ट थवुं ऐ आपनो  
अनुग्रह ज छे.<sup>१२-१३</sup> हवे अमे निरंतर क्षीण थता जता अने रोगोना क्षेत्ररुप आ  
देहथी भोगववा योग्य तथा जांजवानां पाणी जेवा राज्यने तथा मात्र कानने ज  
रुचि उपज्ञवनारा अने परलोकमां भोगववाना कर्मझरुप स्वर्गादिकने पण  
ईच्छता नथी.<sup>१४</sup> एटला माटे अमे अनेक योनिओमां जतां पण जे उपायथी  
अमने तमारा चरणारविंदनुं स्मरण भूलाय नहीं एवा उपायनो उपदेश करो.<sup>१५</sup>  
कृष्ण, वासुदेव, हरि, परमात्मा, गोविंद अने नमेला लोकोना कलेशनो नाश  
करनारा आपने वारंवार प्रणाम करीए छीअे.<sup>१६</sup>

शुकदेवज्ञ कहे छे बंधनथी छूटेला राजाओ आ प्रमाणे स्तुति करतां दयाणु अने  
शरणागतोनुं रक्षण करनार भगवाने मधुर वाणीथी राजाओने आ प्रमाणे कहुं.<sup>१७</sup>

श्रीभगवानुवाच  
अद्यप्रभृति वो भूपा मय्यात्मन्यखिलेश्वरे । सुदृढा जायते भक्तिर्बादमाशंसितं तथा ॥१८  
दिष्ट्या व्यवसितं भूपा भवन्त ऋष्टभाषिणः । श्रियैश्वर्यमदोन्नाहं पश्य उमादंकं नृणाम् १९  
हैहयो नहुषो वेनो रावणो नरकोऽपरे । श्रीमदाद् भ्रंशिताः स्थानाद् देवदैत्यनरेश्वराः ॥२०  
भवन्त एतद् विज्ञाय देहाद्युत्पाद्यमन्तवत् । मां यजन्तोऽध्वरैर्युक्ताः प्रजा धर्मेण रक्षथ ॥२१  
सन्तन्वन्तः प्रजातनून् सुखं दुःखं भवाभवौ । प्रासं प्रासं च सेवन्तो मच्चित्ता विचरिष्यथ २२  
उदासीनाश्च देहादावात्मारामा धृतव्रताः । मय्यावेश्य मनः सम्यङ् मामन्ते ब्रह्म यास्यथ ॥२३

श्रीशुक उवाच  
इत्यादिश्य नृपान् कृष्णो भगवान् भुवनेश्वरः । तेषां न्युङ्ग पुरुषान् स्त्रियो मज्जनकर्मणि ॥२४  
सपर्या कारयामास सहदेवेन भारत ! । नरदेवोचितैर्वस्त्रैर्भूषणैः स्वग्विलेपनैः ॥२५  
भोजयित्वा वरान्नेन सुस्नातान् समलङ्घतान् । भोगैश्च विविधैर्युक्तांस्ताम्बूलाद्यैर्नृपोचितैः २६

भगवान कहे छे हे राजाओ ! तमो जेवुं धारो छो ते प्रमाणे ज आज्ञथी  
मांडी, तमोने जे हुं सर्वनो ईश्वर, आत्मा हुं. ते मारामां अत्यंत दृढ भक्ति  
थशे.<sup>१८</sup> हे राजाओ ! तमोए ढीक धार्यु छे अने साची वात करी छे. कारण के  
लक्ष्मी अने ऐश्वर्यना मदथी जे स्वेच्छाचार प्राप्त थाय छे, ए मनुष्योने गांडा  
बनावी हे छे.<sup>१९</sup> सहस्रार्जुन, नहुष, वेन, रावण, नरकासुर अने बीजा पण हेव,  
हेत्य तथा मनुष्यना राजाओ लक्ष्मीना मदथी स्थानभ्रष्ट थया छे.<sup>२०</sup> एटला ज  
माटे तमो पण उत्पन्न थवा योग्य जे देहादिक पदार्थो छे ए नाशवंत छे अमे  
जाणी, सावधानपणे धर्मथी प्रजानुं रक्षण करजो अने यज्ञोथी मारुं पूजन  
करजो.<sup>२१</sup> तमे पुत्र पौत्रादिक वंशनो विस्तार करतां अने सुख दुःख लाभ के  
अलाभ जे कांઈ आवे तेनुं सेवन करतां मारामां चित्त राखीने फरजो.<sup>२२</sup> मारामां  
सारी रीते मन राखीने देहादिकमां उदासीन, आत्माराम अने नियम सहित  
रहेवाथी अंते परब्रह्म एवो जे हुं ते मने पामशो.<sup>२३</sup>

शुकदेवज्ञ कहे छे लोकोना ईश्वर श्रीकृष्ण भगवाने राजाओने आ प्रमाणे  
आज्ञा करीने तेऽोने स्नानादिक कराववा सारुं केटलाक पुरुषो अने स्त्रीओने  
आज्ञा करी.<sup>२४</sup> हे राजा ! सहदेव पासे राजा ने योग्य वस्त्र, भूषण, माणा अने  
लेपन करवानां चंदनो चर्याने तेऽोनी पूजा करावी, शशगारी, उत्तम अश्रुथी  
जमांडी तथा राजा ने योग्य तांबूल आदि अनेक भोग भोगवावीने भगवाने  
सत्कार करेला अने स्वर्यु कुंडण धरनारा ए राजाओ कलेशथी मुकावाने लीघे,

ते पूजिता मुकुद्देन राजानो मृष्टकुण्डलाः । विरेजुर्मोचिताः क्लेशात् प्रावृडने यथा ग्रहाः २७  
रथान् सदश्चानारोप्य मणिकाञ्चनभूषितान् । प्रीणस्य सूनूतैर्वक्यैः स्वदेशान् प्रत्ययापयत् २८  
एवं मोचिताः कृच्छ्रात् कृष्णोन सुमहात्मना । यथुस्तमेव ध्यायन्तः कृतानि च जगत्पतेः २९  
जगदुः प्रकृतिभ्यस्ते महापुरुषे षष्ठितम् । यथान्वशासद् भगवांस्तथा चक्रुरतन्दिताः ॥३०  
जरासन्धं घातयित्वा भीमसेनेन केशवः । पार्थीभ्यां संयुतः प्रायात् सहवेन पूजितः ॥३१  
गत्वा ते खाण्डवप्रस्थं शङ्खान् दध्मुर्जितारयः । हर्षयन्तः स्वसुहृदो दुर्घटां चासुखावहाः ॥३२  
तच्छ्रुत्वा प्रीतमनस इन्द्रप्रस्थनिवासिनः । मेनिरे मागधं शान्तं राजा चासमनोरथः ॥३३  
अभिवन्द्याथ राजानं भीमार्जुनजनार्दनाः । सर्वमाश्रावयाञ्चक्रुरात्मना यदनुष्ठितम् ॥३४  
निशम्य धर्मराजस्तत् केशवेनानुकंपितम् । आनंदाश्रुकलां मुञ्जन् प्रेमणा नोवाच किंचन ३५

इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे उत्तरार्थं

कृष्णाद्यागमने त्रिसप्तितमोऽध्यायः ॥७३॥

वर्षाञ्तुना अंतमां ग्रहो ज्येष्ठे तेभू शोभ्ये तेभू शोभवा लाग्या ॥२६-२७ सारा धोडावाणा  
अने भण्डि तथा सुवर्णथी शाश्वारेला रथोमां बेसाई तथा भधुर वयनोथी प्रसन्न  
करी भगवाने तेओने पोतपोताना देशमां भोक्त्या ॥२८ आ प्रमाणे महात्मा श्रीकृष्ण  
भगवाने कष्टमांथी छोडावेला राजाओ ते भगवाननुं अने तेमना कर्मोनुं ध्यान  
करता करता पोतपोताना देशोमां गया ॥२९ तेओ स्वदेशमां जईने भगवाने करेलुं  
काम पोताना भंत्रीओ आहिनी पासे कही संभणाव्युं, अने भगवाने आज्ञा करी  
हती ते प्रमाणे आणस मूळीने सर्वे करवा लाग्या ॥३० भगवान भीमसेनना डाथथी  
जरासंधने भराव्या पधी सहटेवे करेली पूजानो स्वीकार करी, अर्जुन तथा  
भीमसेननी साथे ईंद्रप्रस्थमां आव्या ॥३१ शत्रुने ज्ञती आवेला, संबंधीओने राज  
करता अने शत्रुओने पीडा करनारा ए त्रेषो जणाए ईंद्रप्रस्थमां आवीने शंभनाद  
कर्यो ॥३२ ए शंभनाद सांभणी राज थअेला ईंद्रप्रस्थना रहेवासीओए जरासंध  
भरावा पामवानो निश्चय कर्यो अने युधिष्ठिर राजाने सर्वे मनोरथ पूर्ण थया ॥३३  
भीम, अर्जुन अने भगवाने युधिष्ठिर राजाने प्रणाम करी पोते जे करी आव्या  
हता ते सर्वे वात कही संभणावी ॥३४ भगवाने अनुग्रह कर्यानी वात सांभणी.  
आनंदथी अश्रुने वहेवरावता युधिष्ठिर राजा प्रेमना द्वाषाथी कांठ पश बोली  
शक्या नहीं ॥३५

इति श्रीमद् महापुराण भागवतना दशम स्कन्धनो तोंतेरमो अद्याय संपूर्णः

अथ चतुःसप्तितमोऽध्यायः (७४)

॥ श्रीशुकउवाच ॥

एवं युधिष्ठिरो राजा जरासन्धवधं विभोः । कृष्णस्य चानुभावं तं श्रुत्वा प्रीतस्तमब्रवीत् ॥१  
युधिष्ठिर उवाच

ये स्युम्ब्रैलोक्यगुरुवः सर्वे लोकमहेश्वराः । वहन्ति दुर्लभं लब्ध्वा शिरसैवानुशासनम् ॥२

स भवानरविन्दाक्षो दीनानामीशमानिनाम् । धर्तेऽनुशासनं भूमंस्तदत्यन्तविडम्बनम् ॥३

न ह्येकस्याद्वितीयस्य ब्रह्मणः परमात्मनः । कर्मभिर्वर्धते तेजो ह्रसते च यथा रवे ॥४

न वै तेऽजित भक्तानां ममाहमिति माधवः । त्वं तवेति च नानाधीः पश्नूनिव वैकृता ॥५

श्रीशुक उवाच

इत्युक्त्वा यज्ञिये काले वन्ने युक्तान् स ऋत्विजः । कृष्णानुमोदितः पार्थो ब्राह्मणान् ब्रह्मवादिनः ६

अद्याय ७४

युधिष्ठिरना राजसूय यज्ञमां अग्र पूजाना प्रसंगे श्रीकृष्णे  
शिशुपाणनो वद्य कर्यो.

शुकदेवज्ञ कहे छे हे राजा ! आ प्रमाणे जरासंधनो वध अने प्रभु श्रीकृष्णनो  
प्रभाव सांभणीने तथा श्रीकृष्णनुं पोतानी आज्ञाने अनुसरवापशुं जोई प्रसन्न  
थयेला युधिष्ठिर राजाए श्रीकृष्णने आ प्रमाणे कह्युं ।<sup>१</sup>

युधिष्ठिर कहे छे हे ईश्वर ! त्रिलोकना युरु सनकादिक, सर्वे लोको अने  
लोकपाण देवताओ जे आपनी आज्ञाने दुर्लभ मानीने धणा मानथी माथे यढावे  
छे ते आप, जे अमो दीन अने समर्थपणानुं मिथ्या अभिमान धरावनारा छीअे.  
ते अमारी आज्ञाने माथे यढावो छो ए आपने न घटे अेवुं अनुकरण छे ॥२-३  
अथवा जे आप एक अद्वितीय, परमात्मा अने परिपूर्ण छो ते आपने बीजानी  
आज्ञा मानवापशुं वास्तविक रीते तो छे ज नहीं, छतां जेम उदय तथा  
अस्तपणाथी सूर्यनुं तेज वृद्धि पामतुं नथी के घटतुं पश नथी. तेम भक्तो उपर  
अनुग्रह करवा सारु शत्रुनो पराजय करवो ए आहि कर्मोथी आपनुं तेज वृद्धि  
पामतुं नथी अने घटतुं पश नथी. <sup>४</sup> हे अजित ! हे माधव ! अज्ञानी लोकोने जेवी  
शरीरना संबंधमां “हुं मारुं, तुं तारुं” एवी भेद वृद्धि होय छे, एवी तमारा  
भक्तोने पश होती नथी, त्यारे तमने पोताने तो क्यांथी ज होय ?<sup>५</sup>

शुकदेवज्ञ कहे छे आ प्रमाणे कही भगवाननी संभन्तिथी यज्ञने योग्य  
समयमां ते युधिष्ठिर राजाए ब्रह्मवादी योग्य ब्राह्मणोनुं होता आहि ऋत्विजुपे

દ્વैપાયનો ભરદ્વાજઃ સુમન્તુર્ગાત્મોऽસિતઃ । વસિષ્ઠચ્છ્વવનઃ કંપ્વો મૈત્રેય: કવષસ્ત્રિતઃ ॥૭  
વિશ્વામિત્રો વામદેવ: સુમતિર્જેમિનિ: ક્રતુ: । પૈલ: પરાશરો ગર્ગો વैશમ્યાયન એવ ચ ॥૮  
અર્થર્વા કશયપો ધૌમ્યો રામો ભાર્ગવ આસુરિ: । વીતિહોત્રો મધુચ્છ્વદ્વા વીરસેનોઽકૃતવ્રણઃ ॥૯  
ઉપહૂતાસ્તથા ચાન્યે દ્રોણભીષ્મકૃપાદયઃ । ધૃતરાષ્ટ્ર: સહસુતો વિદુરશ્વ મહામતિ: ॥૧૦  
બ્રાહ્મણા: ક્ષત્રિયા વैશ્યા: શ્રૂદ્રા યજ્ઞદિવ્દ્યક્ષવઃ । તત્ત્રેય: સર્વરાજાનો રાજાં પ્રકૃતયો નૃપ ! ॥૧૧  
તત્ત્સે દેવયજનં બ્રાહ્મણા: સ્વર્ણલાઙ્ગ્લલૈ: । કૃષ્ણ તત્ત્ર યથામનાયં દીક્ષયાચ્છક્રિરે નૃપમ् ॥૧૨  
હૈમા: કિલોપકરણા વરુણસ્ય યથા પુરા । ઇન્દ્રાદયો લોકપાલા વિરિચ્છભવસંયુતા: ॥૧૩  
સગણા: સિદ્ધગન્ધર્વા વિદ્યાધરમહોરગા: । મુનયો યક્ષરક્ષાંસિ ખગકિન્નરચારણા: ॥૧૪  
રાજાનશ્ચ સમાહૂતા રાજપત્ન્યશ્વ સર્વશ: । રાજસૂયં સમીયુ: સ્મ રાજઃ પાણ્ડુસુતસ્ય વૈ ॥૧૫  
મેનિરે કૃષ્ણભક્તસ્ય સૂપપત્રમવિસ્તિતા: । અયાજયન્ મહારાજં યાજકા દેવવર્ચસ: ।

રાજસૂયેન વિધિવત્ પ્રાચેતસમિવામરા: ॥૧૬॥

સૌત્યેઽહન્યવનીપાલો યાજકાન્ સદસસ્પતીન્ । અપૂર્જયન્મહાભાગાન્ યથાવત્ સુસમાહિત: ॥૧૭

વરણ કર્યુ. ૬ વેદવ્યાસ, ભરદ્વાજ, સુમંતુ, ગૌતમ, અસિત, વસિષ્ઠ, ચ્છ્વવન, કણ્વ,  
મૈત્રેય, કવષ, ત્રિત, વિશ્વામિત્ર, વામદેવ, સુમતિ, જૈમિનિ, ક્રતુ, પૈલ, પરાશર,  
ગર્ગ, વૈશંપાયન, અર્થર્વા, કશ્યપ, ધૌમ્ય, પરશુરામ, આસુરિ, વીતિહોત્ર,  
મધુચ્છ્વદ્વા, વીરસેન અને અકૃતવરણ એ મુનિઓને યજ્ઞમાં વરાવ્યા. ૭૭ તેમજ  
યુધિષ્ઠિરના નિમંત્રણને લીધે બીજા પણ દ્રોષા, ભીષ્મ, કૃપાચાર્યાદિ પુત્રો સહિત  
ધૃતરાષ્ટ્ર, મોટીબુદ્ધિવાળા વિદુર, બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો, શૂર્દ્રો, સર્વ રાજાઓ  
અને રાજાઓના મંત્રી આદિ પણ યજ્ઞ જોવાની ઈચ્છાથી ત્યાં આવ્યા હતા. ૧૦-૧૧  
પછી બ્રાહ્મણોએ દેવતાઓનું યજ્ઞ કરવાની ભૂમિને સુવર્ણના હળોથી ખેડાવીને  
ત્યાં વેદનાં વચન પ્રમાણે યુધિષ્ઠિર રાજાને દીક્ષા આપી. ૧૨ એ યુધિષ્ઠિર રાજાના  
યજ્ઞમાં, પૂર્વે વરુણાદેવના યજ્ઞની પેઠે, સરસામાન સોનાના કર્યા હતા. ૧૩ દ્વારાદિક  
લોકપાળ, બ્રહ્મા, સદાશિવ, તેઓના પાર્ષદો, સિદ્ધ, ગંધર્વ, વિદ્યાધર, મોટા નાગ,  
મુનિઓ, યક્ષ, રાક્ષસ, પક્ષી, કિશર, ચારણ, રાજાઓ અને સર્વ રાજાઓની સ્ત્રીઓ,  
આ સર્વ યુધિષ્ઠિર રાજાના યજ્ઞમાં તેમના બોલાવવાથી આવ્યા હતા. ૧૩-૧૪ એ  
સર્વ કંઈ પણ વિસ્મય નહીં પામતાં ‘ભગવાનના ભક્તને એ સર્વ ઘટે છે’ એમ  
માનવા લાગ્યાં. દેવસરખા તેજવાળા ઋત્વિજો, જેમ વરણને દેવતાઓએ યજ્ઞ  
કરાવ્યું હતું, તેમ વિધિ સહિત રાજસૂયથી મહારાજ યુધિષ્ઠિરને યજ્ઞ કરાવતા  
હતા. ૧૫ સારી પેઠે સાવધાન યુધિષ્ઠિર રાજાએ સોમરસ કાઢવાના દિવસે

સદસ્યાગ્રયાર્હાંહ વૈ વિમૃશનત: સભાસદ: । નાધ્યગચ્છ્વનૈકાન્ત્યાત્ સહદેવસ્તદાબ્રવીત્ ॥૧૮  
અહંતિ હ્યાચ્યુત: શ્રૈષ્ટં ભગવાન્ સાત્વતાં પતિ: । એષ વૈ દેવતાઃ સર્વ દેશકાલધનાદય: ॥૧૯  
યદાત્મકમિદં વિશ્વ ક્રતવશ્વ યદાત્મકા: । અગ્નિરાહૃતયો મન્ત્રા: સાંખ્ય યોગ્યશ્વ યત્પરઃ ॥૨૦  
એક એવાદ્વિતીયોઽસાવૈતદાત્મ્યમિદં જગત્ । આત્મનાઽત્માશ્રય: સભ્યા: સૃજત્યવતિ હન્ત્યજ: ॥૨૧  
વિવિધાની કર્માણિ જનયન યવેક્ષેયા । ઇંહે યદયં સર્વ: શ્રેયો ધર્માદિલક્ષણમ् ॥૨૨  
તસ્માત્ કૃષ્ણાય મહતે દીયતાં પરમાર્હણમ् । એવં ચેત્ સર્વભૂતાનામાત્મનશ્રાહંણં ભવેત્ ॥૨૩  
સર્વભૂતાત્મભૂતાય કૃષ્ણાયાનન્યર્દર્શિને । દેયં શાન્તાય પૂર્ણાય દત્તસ્યાનન્યમિચ્છતા ॥૨૪  
ઇત્યુક્તવા સહદેવોઽભૂત તૂષ્ણી કૃષ્ણાનુભાવવિત । તચ્છુદ્વા તુષ્ણુ: સર્વે સાધુ સાધ્વિતિ સત્તમાઃ ॥  
શ્રુત્વા દ્વિજેરિતં રાજા જ્ઞાત્વા હાર્દ સભાસદામ । સમર્હયદ્ધર્ષીકેશં પ્રીતઃ પ્રણયવિહ્લાઃ ॥૨૬  
મહાભાગ્યશાળી ઋત્વિજો અને સભા પતિઓની પૂજા કરવા માંડી. ૧૭ સભાસદોમાં  
પહેલી પૂજા કોની કરવી ? એમ સભાસદોએ વિચાર કરતાં તે પૂજાને યોગ્ય ઘણા  
જણ હોવાને લીધે કંઈ નિશ્ચય કરી શક્યા નહીં, ત્યારે સહદેવ આ પ્રમાણે  
બોલ્યા. ૧૮

સહદેવ કહે છે યાદવોના પતિ ભક્તવત્સલ ભગવાન. શ્રીકૃષ્ણ જ મુખ્ય  
પૂજા માટે શ્રેષ્ઠતાને યોગ્ય છે, કેમકે શ્રીકૃષ્ણ જ સર્વ દેવતા, દેશ, કાળ અને  
ધનાદિકરૂપ છે. ૧૯ યજ્ઞો અને આ સર્વજગત શ્રીકૃષ્ણરૂપ જ છે. અર્થાત્ સર્વના  
અંતર્યામી આત્મા શ્રીકૃષ્ણ જ છે. અજિનાઓ, આહુતિઓ, મંત્રો, સાંખ્ય અને  
ઉપાસના એ સર્વ શ્રીકૃષ્ણને માટે છે. ૨૦ આ શ્રીકૃષ્ણ એકજ અદ્વિતીય છે. અર્થાત્  
તેની જોડે બીજો કોઈ આવી શકે તેમ નથી. સર્વ જગતનું મૂળતત્ત્વ એ જ છે. હે  
સભાસદો ! અજન્મા અને સ્વાશ્રય ભગવાન પોતે જ આ જગતને જ્ઞાયે છે, પાણે  
છે અને પ્રલય કરે છે. ૨૧ આ સર્વ લોકો શ્રીકૃષ્ણના અનુગ્રહથી જ અનેક પ્રકારનાં  
સત્કર્મ કરીને ધર્માદિકરૂપ પુરુષાર્થને સિદ્ધ કરે છે. ૨૨ આટલા માટે મહાત્મા  
શ્રીકૃષ્ણને જ ઉત્તમ પૂજા આપો, અને એમ કરશો તો સર્વપ્રાણીઓનું અને પોતાનું  
પણ પૂજન થશે. ૨૩ જે પુરુષ દાનના અનંતફળને ઈચ્છાતો હોય તેણે જે શ્રીકૃષ્ણ  
સર્વપ્રાણીઓના આત્મા, ભેદમતિનો નાશ કરનાર, શાંત અને પૂર્ણ છે તે શ્રીકૃષ્ણને  
જ દેવું જોઈએ. ૨૪

શુક્રદેવજી કહે છે ભગવાનના પ્રભાવને જ્ઞાનનારા સહદેવ આટલું બોલીને  
ચુપ રહ્યા. આ વચન સાંભળીને સર્વ મહાત્મા પુરુષો “સારું સારું” એમ વખાણવા  
લાગ્યા. ૨૫ બ્રાહ્મણોનો શાખ સાંભળી અને સભાસદોનો અભિપ્રાય જાણી રાજુ

તત્પાદાવવન્જ્યાપ: શિરસા લોકપાવની: । સભાર્ય: સાનુજામાત્ય: સકૃટુંમ્બોડવહનુદા ૨૭  
વાસોભિ: પીતકૌશેયૈર્ભૂષણૈશ્રી મહાધનૈ: । અર્હયિત્વાશ્રુપૂર્ણક્ષો નાશકત્ત સમવેક્ષિતુમ् ॥૨૮  
ઇથ્યં સભાજિતં વીક્ષ્ય સર્વે પ્રાજ્ઞલયો જનાઃ । નમો જયેત નેમુસ્ત નિપેતુ: પુષ્પવૃષ્ટ્યઃ ॥૨૯  
ઇથ્યં નિશમ્ય દમધોષસુત: સ્વપીઠાદુદ્ધ્યાય કૃષ્ણાગુણવર્ણનજાતમન્યુ: ।

ઉત્ક્ષિપ્ય બાહુમિદમાહ સદસ્યમર્ણી સંશ્વાવયન્ ભગવતે પરુષાણ્યભીતઃ ॥૩૦॥  
ઇશો દુરત્યય: કાલ ઇતિ સત્યવતી શ્રુતિઃ । વૃદ્ધાનામયિ યદ્ બુદ્ધિબાલવાક્યૈર્વિભિદ્યતે ॥૩૧  
યૂધ્યં પાત્રવિદાં શ્રેષ્ઠ મા મન્ધ્યં બાલભાષિતમ્ । સદસપ્તયઃ સર્વે કૃષ્ણો યત્ સમ્પતોર્હણે ॥૩૨  
તપોવિદ્યાત્રાત્થરાન્ જ્ઞાનવિદ્વસ્તકલમણાન્ । પરમર્ણીન્ બ્રહ્મનિષ્ઠાન્ લોકપાત્લૈશ્રી પૂજિતાન્ ॥૩૩  
સદસ્પતીનિતિક્રમ્ય ગોપાલ: કુલપાંસનઃ । યથા કાક: પુરોડાશં સપર્યા કથમર્હતિ ॥૩૪  
વર્ણાશ્રમકુલાપેત: સર્વધર્મબહિષ્કૃતઃ । સ્વૈરવર્તી ગુણૈર્હીનઃ સપર્યા કથમર્હતિ ॥૩૫

થયેલા અને સ્નેહથી વિદ્ધિથયેલા યુધિષ્ઠિર રાજાએ સર્વપ્રથમ ભગવાનની પૂજા  
કરી.<sup>૨૬</sup> રાજા, તેમની સ્ત્રીઓ, ભાઈઓ અને મંત્રીઓએ તથા તેમના કુટુંબે  
ભગવાનનાં ચરણ ધોઈને જગતને પવિત્ર કરનાર તેનું જળ પ્રીતિથી માથે  
ચઢાવ્યું.<sup>૨૭</sup> પીળાં રેશમી વસ્ત્ર અને ઘણા મૂલ્યનાં આભૂષણોથી ભગવાનનું પૂજન  
કરી, યુધિષ્ઠિર રાજા આંખોમાં આંસુ ભરાઈ આવવાથી તેમની સામું જોઈ શક્યા  
નહીં.<sup>૨૮</sup> આ પ્રમાણે ભગવાનનો સત્કાર થયેલો જોઈ સર્વ લોકો હાથ જોડી “નમો  
નમો જ્ય જ્ય” એવા શબ્દો કરી ભગવાનને નમ્યા અને પુષ્પની વૃષ્ટિ કરી.<sup>૨૯</sup>  
આ શબ્દો સાંભળી ભગવાનના શુણોના વર્ણનથી જેને કોધ ઉત્પત્ત થયો છે, એવો  
શિશુપાળ સભામાં નિર્ભયપણે પોતાના આસન પરથી ઊભો થઈ, હાથ ઊંચો  
કરીને અસહનતાથી ભગવાનને કઠણ વચન સંભળાવવા સારુ આ પ્રમાણે  
બોલ્યો.<sup>૩૦</sup>

શિશુપાળ કહે છે ‘કાળ અલંધ્ય અને સમર્થ છે. એવી લોકોની વાત સાચી  
છે; કેમકે બાળકના વચનથી વૃદ્ધલોકોની બુદ્ધિ પણ ફરી જાય છે.<sup>૩૧</sup> હે સભાસદો!  
તમે પાત્ર જાણનારાઓમાં શ્રેષ્ઠ થઈને, આ બાળક સહદેવના બોલવાથી કૃષ્ણ  
અગ્ર પૂજાને યોગ્ય માનવામાં આવે છે, તેને માનો મા.<sup>૩૨</sup> તપ, વિદ્યા અને વ્રતને  
ધરનારા, જ્ઞાનથી સર્વદોષ રહિત થયેલા, બ્રહ્મમાં નિષ્ઠાવાળા અને લોકપાળોએ  
પણ પૂજેલા એવા જે મોટા ઋષિઓ, આ સભાના સભાપતિઓ છે તે ઋષિઓને  
મૂકી દઈ, ગોવાળ અને કુળને વટલાવવનાર આ કૃષ્ણ પૂજાને યોગ્ય કેમ મનાય છે?  
કાગડો પુરોડાશને યોગ્ય હોય જ નહીં.<sup>૩૩-૩૪</sup> વર્ણ, આશ્રમ તથા કુળથી ભ્રષ્ટ,

યયાતિનૈષાં હિ કુલં શાસ્ત્ર સદ્ગ્રિબ્રહ્મિકૃતમ્ । વૃથાપાનરતં શશ્વત્ સપર્યા કથમર્હતિ ॥૩૬  
બ્રહ્મિષસેવિતાન્ દેશાન્ હિતૈતે બ્રહ્માવર્ચસમ્ । સમુદ્રં દુર્ગમાશ્રિત્ય બાધને દસ્યવઃ પ્રજાઃ ॥૩૭  
એવમાદીન્યભદ્રાણિ બભાષે નષ્ટમઙ્ગલ: । નોવાચ કિશ્ચિદ્ ભગવાન્ યથા સિંહ: શિવારુતમ્ ॥૩૮  
ભગવત્ત્રિન્દનં શ્રુત્વા દુઃસહં તત્સભાસદ: । કર્ણો પિધાય નિર્જગમુ: શાપન્ શ્રેદ્ધિપં રૂષા ॥૩૯  
નિન્દાં ભગવત: શૃંવંસત્પત્રસ્ય જનસ્ય વા । તતો નાપૈતિ ય: સોઽપિ યાત્યથ: સુકૃતાચ્યુત: ૪૦  
તત: પાણદુસુતા: ક્રુદ્ધા મત્સ્યકૈકયસૃબ્જયા: । ઉદાયુધા: સમુત્તસ્થુ: શિશુપાલજિધાંસવ: ૪૧  
તતશ્રીદ્યસ્ત્વસમ્ભાન્તો જગૃહે ખંડ્યાર્મણી । ભર્ત્યન્ કૃષ્ણાપક્ષીયાન્ રાજા: સદસિ ભારત! ૪૨  
તાવદુદ્ધ્યાય ભગવાન્ સ્વાન્ નિર્વાય સ્વયં રૂષા । શિરઃ ક્ષુરાત્તચક્રેણ જહારાપતતો રિપો: ૪૩  
શબ્દ: કોલાહલોડ્યાસીત્ શિશુપાલે હતે મહાન્ । તસ્યાનુયાયિનો ભૂપા દુદ્વુર્જીવિતૈષિણ: ૪૪  
સર્વે ધર્મોથી બહિષ્કૃત થયેલો, સ્વધંદ રીતે વર્તનાર અને ગુણ વગરનો આ કૃષ્ણ  
શી રીતે પૂજાને યોગ્ય ગણાય ?<sup>૩૫</sup> યયાતિ રાજાના શાપને લીધે સત્પુરુષોએ  
બહિષ્કૃત કરેલું અને નિરંતર વૃથા મદિરા પીવામાં લાગેલું આ લોકોનું કુળ શી  
રીતે પૂજાને યોગ્ય થાય ?<sup>૩૬</sup> આ બહારવટિયા લોકો (યાદવો) બ્રહ્મર્થિઓએ સેવેલા  
દેશોને છોડી દઈ સમુદ્રરૂપી જે ગઢમાં વેદ સંબંધી તેજ રહે જ નહીં. તે ગઢમાં  
રહીને પ્રજાઓને દુઃખ દે છે.<sup>૩૭</sup>

શુક્દેવજી કહે છે જેનું પુણ્ય નાશ પામ્યું હતું એવો શિશુપાળ આ પ્રમાણે  
ઘણાં દુર્વચન બોલ્યો, પણ શિયાળના શબ્દને સાંભળીને જેમ સિંહ કાંઈ પણ ન  
બોલે. તેમ એ વચન સાંભળીને ભગવાન કાંઈ પણ ન બોલ્યા.<sup>૩૮</sup> સભાસદો એ  
ભગવાનની અસહ્ય નિંદાને સાંભળી, કોધથી શિશુપાળને ગાળો દેતા પોતાના  
કાન બંધ કરીને ઊઠી ગયા.<sup>૩૯</sup> ભગવાનની અથવા ભગવાનના ભક્તની નિંદા  
સાંભળીને તે સ્થળમાંથી જે માણસ ખસી ન જાય તે માણસ પોતાના પુણ્યમાંથી  
ભ્રષ્ટ થઈને નરકમાં પડે છે.<sup>૪૦</sup> પછી કોધ પામેલા પાંડવો અને મત્સ્ય, કેક્ય તથા  
સૃજ્ય વંશના ક્ષત્રિયો શિશુપાળને મારી નાખવાની ઈચ્છાથી હથિઆર ઊચ્કીને  
ઊભા થાય.<sup>૪૧</sup> હે રાજા ! એ જોઈને સભામાં શ્રીકૃષ્ણના પક્ષના રાજાઓને  
ધિક્કારતા શિશુપાળે પણ નિર્ભય રીતે ઢાલ તલવાર લીધી.<sup>૪૨</sup> તેટલીવારમાં આ  
મારો પાર્ષદ મારા સરખો જ બળવાન છે તેથી આ સર્વેને મારી નાખશે, માટે મારે  
જ તરત મારવો જોઈએ, આવા અભિપ્રાયથી ભગવાને તરત પોતે ઊઠીને પોતાના  
પક્ષવાળાઓને વારતાં કોધથી જે શિશુપાળ સામો આવતો હતો તે શિશુપાળનું  
માથું સજ્જાય સરખી ધારવાળા ચક્કથી કાપી નાખ્યું.<sup>૪૩</sup> શિશુપાળ મરવા પામતાં

चैद्यदेहोत्थिं ज्योतिर्बासुदेवमुपाविशत् । पश्यतां सर्वभूतानामुल्केव भुवि खाच्युता ॥४५  
जन्मत्रयानुगुणितवैरसंब्यया धिया । ध्यायंस्तन्मयतां यातो भावो हि भवकारणम् ॥४६  
ऋत्विग्यः सप्तस्येभ्यो दक्षिणां विपुलामदात् । सर्वान् सम्पूज्य विधिवच्चक्रेऽवभृथमेकराद्  
साधयित्वा ऋतुं राज्ञः कृष्णो योगेश्वरेश्वरः । उवास कतिचिन्मासान् सुहृद्दिरभियाचितः ४८  
ततोऽनुजाप्य राजानमिन्छन्तमपीश्वरः । ययौ सधार्थः सामात्यः स्वपुरं देवकीसुतः ॥४९  
वर्णितं तदुपाख्यानं मया ते बहुविस्तरम् । वैकुण्ठवासिनोर्जन्म विप्रशापात् पुनः पुनः ॥५०  
राजसूयावभृथ्येन स्नातो राजा युधिष्ठिरः । ब्रह्मक्षत्रसभामध्ये शुशुभे सुराडिव ॥५१  
राजा सभाजिताः सर्वे सुरमानवखेचराः । कृष्णं ऋतुं च शंसन्तः स्वधामानि यथुर्मुदा ॥५२  
दुर्योधनमृते पापं कर्लि कुरुकुलामयम् । यो न सेहे श्रियं स्फीतां दृष्ट्वा पाण्डुसुतस्य ताम् ५३  
य इदं कीर्तयेद्विष्णोः कर्म चैद्यवधादिकम् । राजमोक्षं वितानं च सर्वपापैः प्रमुच्यते ॥५४

इति श्रीमद्भागवते महापुराणे पारमहस्यां सहितायां दशमस्कन्धे उत्तरार्थ  
शिशुपालवधो नाम चतुःसप्ततिमोऽध्यायः ॥७४॥

भारे कोलाहल शब्द थई रह्यो, अने शिशुपाणने अनुसरनारा राजाओ छववानी  
ईच्छाथी भागी गया.<sup>४४</sup> आकाशमांथी पडेली उल्का जेम पृथ्वीमां पेशी जाय,  
तेम शिशुपाणना देहमांथी नीकणेलुं तेज, सर्वे प्राणीओ देखतां भगवानमां प्रवेशी  
गयुं. (अर्थात् शिशुपाण भगवानना पार्षद पश्चाने पाभ्यो.) <sup>४५</sup> त्रिश जन्ममां  
वारंवार वेरना आवेशवाणी भुद्धिथी जेना भनमां भगवाननुं ज ध्यान लागी  
रह्युं हतुं ऐवो शिशुपाण फ्रीवार भगवाननो पार्षद थयो; केमके भननी भावना  
ज जन्मनुं कारण छे.<sup>४६</sup> यक्कर्ता युधिष्ठिर राजाए ऋत्विजोने अने सभापतिओने  
मोटी दक्षिणा आपी, अने सर्वलोकोनुं पूजन करीने अवभृथस्नान कर्यु.<sup>४७</sup>  
योगेश्वरोना ईश्वर श्रीकृष्ण भगवान युधिष्ठिर राजानो यज्ञ सिद्ध करावीने पछी  
संबंधीओनी मागाणी ने आधारे केटलाक भलिना सुधी त्यां ईंद्रप्रस्थमां ज रह्या.<sup>४८</sup>  
पछी भगवान, युधिष्ठिर राजानी ईच्छा न हती, तोपश्च तेमनी आशा लઈने  
पोतानी स्त्रीओ अने भंत्रीओनी साथे द्वारकामां पधार्या.<sup>४९</sup> वैकुंठमां रहेनारा जय  
विजयना वारंवार जन्म ब्राह्मणोना शापने लीघे थया, ए आध्यान घणा  
विस्तारथी में तमारी पासे कही संभगाव्युं.<sup>५०</sup> राजसूयना अवभृथस्नानथी  
नाहेला युधिष्ठिर राजा, ब्राह्मणो अने क्षत्रियोनी सभामां ईंद्रनी पेठे शोभता  
हता.<sup>५१</sup> राजाए सत्कार करेला, श्रीकृष्णना तथा यज्ञना वधाश करता देव, माणस

अथ पञ्चसप्ततिमोऽध्यायः (७५)

॥ राजोवाच ॥

अजातशत्रोस्तं दृष्ट्वा राजसूयमहोदयम् । सर्वे मुमुदिरे ब्रह्मन् ! नृदेवा ये समागताः ॥१  
दुर्योधनं वर्जयित्वा राजानः सर्वयः सुराः । इति श्रुतं नो भगवंस्तत्र कारणमुच्यताम् ॥२  
ऋषिरुवाच

पितामहस्य ते यज्ञे राजसूये महात्मनः । बान्धवाः परिचर्यायां तस्यासन् प्रेमबन्धनाः ॥३  
भीमो महानसाध्यक्षो धनाध्यक्षः सुयोधनः । सहदेवस्तु पूजायां नकुलो द्रव्यसाधने ॥४  
गुरुशुश्रूषणे जिष्णुः कृष्णः पादावेजने । परिवेषणे द्रुपदजा कर्णो दाने महामनाः ॥५  
युयुधानो विकर्णश्च हार्दिक्यो विदुरादयः । बाह्लीकपुत्रा भूर्याद्या ये च सन्तर्दनादयः ॥६

अने प्रभथ लोको आनन्दथी पोतपोताना स्थानकोमां गया.<sup>५२</sup> पापी कणियुगना  
अंशरूप अने कुरु राजाना कुणमां रोगरूप एक दुर्योधन के जे युधिष्ठिर राजानी  
वृद्धि पामेली लक्ष्मीने सहन न करी शक्यो, तेविना बीजा सर्वे लोको राज्ञ थया.<sup>५३</sup>  
राजाओने छोडाव्या, यज्ञ कराव्यो अने शिशुपाणने मार्यो. ईत्यादिक श्रीकृष्णनी  
आ लीलानुं जे वर्षन करे ते सर्वे पापोथी धूटे छे.<sup>५४</sup>

इति श्रीमद्भागवताणा भागवतना दशम स्कन्धनो चुमोतेरमो अद्याय संपूर्णः.

अद्याय ७५

दुर्योधननुं थयेलुं भानलंग.

परीक्षित राजा पूछे छे हे महाराज ! युधिष्ठिर राजाना यज्ञमां आवेला  
मनुष्यो, देवताओ, राजाओ अने ऋषिओ राजसूयनो महोत्सव जोईने सर्वे  
राज्ञ थया, पश्च तेओने मध्ये एक दुर्योधन राज्ञ न थयो. एम भें तमारी पासेथी  
सांभण्युं तेमां जे कारण होय ते कहो. <sup>१-२</sup> शुकदेवज्ञ कुहे छे तमारा दादा महात्मा  
युधिष्ठिर राजाना राजसूयमां प्रेमना बंधनने लीघे तेमना बांधवो कामकाजमां  
लाग्या हता.<sup>३</sup> भीमसेन रसोडाना उपरी थया, दुर्योधन धननो उपरी थयो,  
सहदेव पूजानुं काम करता हता, नकुल धन मेणववानुं काम करतो हतो.<sup>४</sup> अर्जुन  
गुरुजननी सेवाना काममां लाग्या हता, श्रीकृष्ण महाभाओना पग धोवाना  
काममां हता, द्रोपदी पीरसवाना काममां हतां, उदार मनवाणो कर्ण दानना काममां  
लाग्यो हतो.<sup>५</sup> हे राजा ! सात्यकि, कृष्ण, कृतवर्मा, विदुरादिक, भूरि आदि बालिक

निस्तुष्टिमहायज्ञेनानाकर्मसु ते तदा । प्रवर्तन्ते स्म राजेन्द्र ! राज्ञः प्रियचिर्कीर्षवः ॥७  
ऋत्विक्सदस्यबहुवित्सु सुहृत्मेषु स्विष्ठेषु सूनृतसमर्हणदक्षिणाभिः ।

चैद्यो च सात्वतपतेश्वरणं प्रविष्टे चक्रुस्तस्त्ववभृथस्तपनं द्युनद्याम् ॥८॥  
मृदङ्गशङ्खपणवधुन्धुर्यानकगोमुखाः । वादित्राणि विचित्राणि नेदुरावभृथोत्सवे ॥९  
नर्तक्यो ननृत्हृष्णा गायका यूथशो जगुः । वीणावेणुतलोन्नादस्तेषां स दिवमस्पृशत् ॥१०  
चित्रध्वजपताकाग्रैरिभेन्द्रस्यन्दनार्वभिः । स्वलङ्घतैःर्भटैर्भूपा निर्ययू रुक्ममालिनः ॥११  
यदुसृज्जयकाम्बोजकुरुकेक्यकोसलाः । कम्प्यन्तो भुवं सैन्यैर्यजमानपुरःसराः ॥१२  
सदस्यात्विंद्रिजश्रेष्ठा ब्रह्मघोषेण भूयसा । देवर्षिपितृगन्धर्वास्तुष्टुवुः पुष्पवर्षिणः ॥१३  
स्वलङ्घता नरा नार्यो गन्धस्त्रग्भूषणाम्बरैः । विलिम्पन्त्योऽभिषिञ्चन्त्यो विजहुर्विधैरसैः ॥१४  
तैलगोरसगन्धोदहरिद्रासान्कुङ्कूमैः । पुम्भर्लिमाः प्रलिम्पन्त्यो विजहुर्वारयोषितः ॥१५  
गुपा नृभिर्निरगमन्तुपलब्धुमेतद् देव्यो यथा दिवि विमानवरैर्नैदव्यः ।  
ता मातुलेयसखिभिः परिषिद्यमानाः सब्रीडहासविकसद्वदना विरेजुः ॥१६॥

राजाना पुत्रो अने संतर्दनादिक के जेओने मोटा यज्ञमां नोभानोभा काममां उपरी  
ठराव्या हता, तेआो सर्वे युधिष्ठिर राजानुं प्रिय करवानी ईर्थ्याथी ते ते कामोमां  
लाग्या हता.<sup>५-७</sup> ऋत्विज, सभासद, धाणुं जाणानारा भीजा पशा विद्वानो अने  
प्यारा संबंधीओनुं मधुर वाणी, अलंकारादिक अने दक्षिणाओथी पूजन थया  
पछी अने शिशुपाण श्रीकृष्णना चरणमां प्रवेश कर्या पछी युधिष्ठिर राजाए पशा  
गंगाज्ञमां अवभृथस्नान कर्युः<sup>८</sup> ए अवभृथना उत्सवमां मृदंग, शंभ, पशव,  
नोबत, नगारा अने गोमुख आहि विचित्र वाज्ञं वागतां हतां.<sup>९</sup> राज्ञ थयेली  
वेश्याओ नायती हती, टोणेटोणां गवेयाओ गाता हता, तेओनो मोटो शब्द  
आकाश सुधी व्याम थई रह्यो हतो.<sup>१०</sup> सोनानी माणा पहेनारा यहु, सूर्यज्य,  
कम्भोज, कुरु, केक्य अने कोसल देशना राजाओ विचित्र ध्यज तथा पताकाओथी  
युक्त अने खूब शाशगारेला मोटा हाथीओ, रथो अने घोडाओ पर बेसीने  
शाशगारेला योद्धाओनी साथे महाराज युद्धिष्ठिरने आगण करी, पृथ्वीने कंपावता  
थका अवभृथ स्नान करवा गाम बहार नीकण्या.<sup>११-१२</sup> सभासदो, ऋत्विज अने  
मोटा मोटा ब्राह्मणो वेदनो भारे शब्द करता नीकण्या. देव, ऋषि, पितृ, अने  
गंधर्वों स्तुति करता हता तथा शूलनी वृष्टि करता हता.<sup>१३</sup> सुगंध, माणा, भूषण  
अने वस्त्रोथी सारी रीते शाशगारेली स्त्रीओ अने पुरुषो अनेक प्रकारना दहीं,  
दूध आहि रसोथी एक भीजाने लेपन करी अने भींजवीने विहार करता हता.<sup>१४</sup>

ता देवरानुत सखीन् सिषिचुर्दतीभिः किलन्नाम्बरा विवृतगात्रकुचोरुमध्याः ।  
औत्सुक्यमुक्तकबराच्यवमानमाल्याः क्षोभं दधुर्मलधियां रुचिरैर्वहारैः ॥१७॥  
स सप्ताङ्ग रथमारुढः सदश्वं रुक्ममालिनम् । व्यरोचत स्वपत्नीभिः क्रियाभिः क्रतुराडिव १८  
पतीसंज्ञाजावमृथ्यैश्चरित्वा ते तमृत्विजः । आचान्तं स्नापयाश्चकुर्गङ्गायां सह कृष्णाया ॥१९  
देवदुन्धुभयो नेदुर्नदुन्धुभिभिः समम् । मुमुचुः पुष्पवर्षाणि देवर्षिपितृमानवाः ॥२०  
सस्वुस्त्रत ततः सर्वे वर्णाश्रमयुता नराः । महापातक्यपि यतः सद्यो मुच्येत किल्बिषात् २१  
अथ राजाहते क्षीभे परिधाय स्वलङ्घतः । ऋत्विक्सदस्यविग्रादीनार्चभरणाम्बरैः ॥२२  
बन्धुज्ञातिनृपान् मित्रसुहोऽन्यांश सर्वशः । अभीक्षणं पूजयामास नारायणपरो नृपः ॥२३  
तेल, गोरस, सुगंधी जृण, हण्डर अने धाटां केसरोथी पुरुषोथे लेपन करेली  
अने पुरुषोने ते पदार्थोथी लेपन करती वेश्याओ विहार करती हती.<sup>१५</sup> ए उत्सव  
ज्ञेवा सारु उत्तम विमानमां बेसीने जेम देवांगनाओ नीकणी हती, तेम  
योद्धाओथे रक्षण करेली ईन्द्रप्रस्थना राजाओनी राजसनीओ पशा सुंदर  
पालभीओ उपर सवार थईने स्नान करवा सारु नीकणी हती. मामाना दीकरा  
श्रीकृष्ण अने भित्रोथे राणीओ उपर रंग आहि इंकी रह्या हता, तेथी राणीओना  
मुखो लाज सहित हसवाथी भीली उठेलां हतां, अने तेथी अतिशे शोभती  
हती.<sup>१६</sup> उत्सुकपणाने लीघे धूटी गयेला योटलाओमांथी झूल खरतां हतां अेवी,  
अने वस्त्रो भींजाई जवाने लीघे जेओनां गात्र, सन, साथण अने मध्यभाग  
स्पष्ट देखवामां आवतां हतां अेवी ते राज्य पत्नीओ, पोताना दियर अने भित्रोने  
यामडाना यंत्रोथी पाणी नाखीने भींजवती हती अने अेवा अेवा सुंदर विहारोथी  
कामी लोकोना मनमां कामज्ञवर उत्पत्त करती हती.<sup>१७</sup> सारा घोडावाणा अने  
सुवर्णनी माणाओ वाणा रथमां बेठेला ते यक्कवर्ती युधिष्ठिर राजा, कियाओथी  
जाणे देहधारी राजसूय शोभतो होय तेम पोतानी स्त्रीओथी शोभता हता.<sup>१८</sup>  
पत्नीसंयाज नामनुं कर्म अने अवभृथ संबंधी कर्म करीने जेषो आयमन लीधुं  
छे. अेवा ते युद्धिष्ठिर राजाने ऋत्विजोने गंगाज्ञमां द्रौपदीनी साथे नवराव्या.<sup>१९</sup>  
ते समये माणसोना दुहुंभीओनी साथे देवताओनां दुहुंभीओ पशा वागतां हतां.  
देव, ऋषि, पितृ अने मनुष्यो झूलनी वृष्टि करता हता.<sup>२०</sup> ए अवभृथस्नानमां  
वर्षा आश्रमवाणा सर्वे माणसोथे स्नान कर्यु, केमके ए स्नान करे तो महापापी  
पशा तरत पापमांथी मुक्त थाय छे.<sup>२१</sup> पछी नवां वस्त्र पहेरी, सारी रीते  
शाशगारेला राजाओ, आभरण अने वस्त्रोथी ऋत्विज, सभासद अने ब्राह्मणो

सर्वे जनाः सुरुचो मणिकुण्डलस्वर्णगुण्योषकञ्चुकदुकूलमहार्घ्यहाराः ।  
नार्यश्च कुण्डलयुगालकवृद्धजुष्टवक्त्रश्रियः कनकमेखलया विरेजुः ॥२४॥  
अर्थात्विजो महाशीलाः सदस्या ब्रह्मवादिनः । ब्रह्मक्षित्रियविट्टशूद्रा राजानो ये समागताः २५  
देवर्षिपितृभूतानि लोकपालाः सहानुगाः । पूजितास्तमनुजाप्य स्वधामानि ययुर्नृप ! ॥२६  
हरिदासस्य राजर्जे ! राजसूयमहोदयम् । नैवातृप्यन् प्रशंसन्तः पिबन् मर्त्येऽमृतं यथा ॥२७  
ततो युधिष्ठिरो राजा सुहृत्सम्बन्धिबान्धवान् । प्रेम्णा निवासयामास कृष्णं च त्यागकातरः २८  
भगवानपि तत्राङ् ! न्यवात्सीत्तत्रियद्वारः । प्रस्थाप्य यदुवीरांश्च साम्बादीश्च कुशस्थलीम् ॥२९  
इत्थं राजा धर्मसुतो मनोरथमहार्णवम् । सुदुस्तरं समुत्तीर्य कृष्णोनासीद् गतज्वरः ॥३०  
एकदान्तःपुरे तस्य वीक्ष्य दुर्योधनः श्रियम् । अतप्यद् राजसूयस्य महित्वं चाच्युतात्मनः ३१  
यस्मिन् नरेन्द्रदितिजेन्द्रसुरेन्द्रलक्ष्मीर्नाना विभान्ति किल विश्वसृजोपकलृताः ।  
ताभिः पतीन् द्वुपदराजसुतोपतस्थे यस्यां विषक्तहृदयः कुरुराडतप्यत् ॥३२॥

आहिनी पूजा करी.<sup>२२</sup> नारायणे आधीन युधिष्ठिर राजाए बंधु, शाती, राजाओ, भित्र, संबंधीओ अने बीजा पाणि सर्वे लोकोनी वारंवार पूजा करी.<sup>२३</sup> ऐ समये देवता सरभी कांतिवाणा तथा मणिना कुंडण, माणा, पाघडी, जूलडी, वस्त्र अने अमूल्य हार धरनारा सर्वे पुरुषो शोभता हता. कुंडणनी ज्ञेऽ अने केशना समूहथी यमकती मुखनी शोभावाणी स्त्रीओ पाणि सोनानी कटिमेखणाथी शोभती हती.<sup>२४</sup> उत्तम स्वभाववाणा ऋत्विजो, भ्रष्टवादी सभासदो, भ्रात्याशो, क्षत्रियो, वैश्यो, शूद्रो, राजाओ, देव, ऋषि, पितृ, भूत अने अनुयर सहित लोकपाणो ते सर्वे यज्ञमां आव्या हता. तेऽयो सत्कार पामी युधिष्ठिर राजानी संमति लઈने पोतपोताना स्थानकोमां गया.<sup>२५-२६</sup> माणस जेम अमृत पीतां तृप्ति न पामे तेम ए सर्वे लोको भगवानना भक्त युधिष्ठिर राजाना राजसूय संबंधी उत्सवनी प्रशंसा करतां तृप्ति पामता न हता.<sup>२७</sup> पधी जे युधिष्ठिर राजा पोताना प्रिय बांधवोना विरहने न खमी शके अेवा, हता तेथी ते राजाए प्रेमने लीघे पोताना भित्रो, संबंधीओ, बंधवो अने श्रीकृष्णने ईंद्रप्रस्थमां ज राख्या.<sup>२८</sup> युधिष्ठिर राजानुप्रिय करनारा भगवान पाणि सांब आहिक वीर यादवोने द्वारकामां भोक्तीने पोते ईंद्रप्रस्थमां ज रह्या.<sup>२९</sup> आ प्रमाणे धर्मना पुत्र युधिष्ठिर राजा श्रीकृष्णनी सहायथी राजसूयना मनोरथरुपी दुस्तर भगवान्गरने तरीने संताप रहित थया.<sup>३०</sup> पधी एक दिवसे भगवानमां ज चित राखनारा युधिष्ठिर राजाना अंतःपुरनी भारे लक्ष्मीने अने राजसूयना भगिमाने ज्ञेईने दुर्योधन मनमां भगवा

यस्मिस्तदा मधुपतेर्महिषीसहस्रं श्रोणीभरेण शनकैः क्रणदद्यग्निशोभम् ।  
मध्ये सुचारु कुचकुङ्कमशोणहारं श्रीमन्मुखं प्रचलकुण्डलकुन्तलाढ्यम् ॥३३॥  
सभायां मयक्लृप्तायां क्रापि धर्मसुतोऽधिराट् । वृत्तोऽनुजैर्बन्धिश्च कृष्णोनापि स्वचक्षुषा ३४  
आसीनः काञ्छने साक्षादासने मधवानिव । पारमेष्ठ्यश्रिया जुषः स्तूयमानश्च वन्दिभिः ३५  
तत्र दुर्योधनो मानी परीतो भ्रातृभिर्नृप ! । किरीटमाली न्यविशदसिहस्तः क्षिपन् रुषा ॥३६  
स्थलेऽध्यगृहाद् वस्त्रान्तं जलं मत्वा स्थलेऽपतत् । जले च स्थलवद् भ्रान्त्या मयमायाविमोहितः ॥  
जहास भीमस्तं दृष्टा स्त्रियो नृपतयोऽपरे । निवार्यमाणा अप्यङ्गं राजा कृष्णानुमोदिताः ॥३८  
स ब्रीडितोऽवागवदनो रुषा ज्वलन् निष्कम्य तृष्णीं प्रययौ गजाह्वयम् ।  
हाहेति शब्दः सुमहानभूत् सतामजातशत्रुविमना इवाभवत् ।  
बभूव तृष्णीं भगवान् भुवो भरं समुज्जिहीर्षुर्भ्रमति स्म यदृशा ॥३९॥

लाभ्यो. ३१ युधिष्ठिर राजाना अंतःपुरमां भयदानवे रथेली संपत्ति, राजाओ, देत्योना अधिपतिओ अने देवताना अधिपतिओनी अनेक प्रकारनी विभूतिओ शोभती हती. ऐ विभूतिओनी साथे द्रौपदी पोताना पतिने सेवतां हतां, जेमां मन लागी रहेवाथी दुर्योधनने परिताप थयो. ३२ जे अंतःपुरमां नितंबना भारने लीघे धीरे धीरे जमकतां जांझरोथी शोभी रहेला पगवाणी, सुंदर कटीवाणी, स्तनना केसरथी राता थयेला हारोवाणी, शोभतां मुखवाणी अने हालतां कुंडण तथा केशवाणी भगवाननी हजारो स्त्रीओ झरती हती, ते अंतःपुरनी शोभा ज्ञेईने दुर्योधनना मनमां असह्य परिताप थयो. ३३ एक दिवसे भयदानवे रथेली सभामां भाईओ, बंधुओ अने पोतानी आंभ सरभा श्रीकृष्णथी वीटाईने यक्षवर्ती युधिष्ठिर राजा, सोनाना सिंहासन उपर साक्षात् ईंद्रनी पेठे शोभता हता, यक्षवर्तीपाणी लक्ष्मी दीपी रही हती अने बंदीजनो स्तुति करता हता. ३४-३५ हे राजा ! ते सभयमां अभिमानी राजाओथी वीटाएलो किरीट तथा माणाने धरनारो अने जेना हाथमां तलवार हती अेवो दुर्योधन, क्रोधथी द्वारपाण आहिने धमकी देतो ते सभामां आव्यो. ३६ सभामां ज्यां स्थण हतुं त्यां जणनी आंतिने लीघे दुर्योधने पोतानां कपडां उंचां लीघां, अने ज्यां ज्यां हतुं त्यां स्थण समज्ञने जणमां पड्यो. आवी रीते भयदानवनी मायाथी मोह पामेला दुर्योधनने ज्ञेईने भीमसेन, स्त्रीओ अने बीजा राजाओ युधिष्ठिरे वारवा मांड्या तोपाण श्रीकृष्णनी संमतिथी हांसी करवा लाभ्या. ३७-३८ लज्जाएलो अने क्रोधथी भणतो दुर्योधन नीयुं घोंकी युपचाप सत्तामांथी नीकणीने हस्तिनापुरमां गयो. आ ज्ञेईने सत्युरुपो

एततेऽभिहितं राजन् ! यत्पुष्टोऽहमिहत्वया । सुयोधनस्य दौरात्म्यं राजसूये महाक्रतौ ॥४०  
इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे उत्तरार्थं  
दुर्योधनमानभूमे नाम पञ्चसप्तितमोऽध्यायः ॥७५॥

### अथ षट्सप्तितमोऽध्यायः (७६)

॥ श्रीशुक उवाच ॥

अथान्यदपि कृष्णस्य शृणु कर्मद्वृत्तं नृप ! । क्रीडानरशरीरस्य यथा सौभपतिर्हतः ॥१  
शिशुपालसखः शाल्वो रुक्मिण्युद्वाह आगतः । यदुभिर्निर्जितः संख्ये जरासन्धादयस्तथा २  
शाल्वः प्रतिज्ञामकरोत् शृण्वतां सर्वभूभुजाम् । अयाददीर्घं करिष्ये पौरुषं मम पश्यत ३  
इति मूढः प्रतिज्ञाय देवं पशुपतिं प्रभुम् । आराधयामास नृप ! पांसुमुष्टि सकृद् ग्रसन् ॥४  
संवत्सरान्ते भगवानाशुतोष उमापतिः । वरेणच्छन्दयामास शाल्वं शरणमागतम् ॥५  
मोटो हाहाकार करवा लाङ्या अने युधिष्ठिर राजा मनमां उदास थई गया.  
पृथीनो भार उतारवाने ईर्ष्यता, अने जेनी दृष्टिथी दुर्योधनने भ्रांति थई हती  
ऐवा श्रीकृष्ण भगवान तो युप ज रह्या.<sup>३८</sup> हे राजा ! मोटा राजसूययशमां  
दुर्योधननी दृष्यता विषे तमे जे मने पूछयुं हतुं ते सर्वे कहीं संभणाव्युं.<sup>३९</sup>  
इति श्रीमद् महापुराण भागवतना दशम स्कन्धनो पंचोत्तरमो अद्याय संपूर्णः.

### अद्याय ७६

यादवोनुं शाल्व साथे युद्ध थतां प्रद्युम्नने धायल करतो शाल्वनो  
ज्ञावान भंत्री धुमान.

शुकदेवज्ञ कहे छे हे राजा ! हवे श्रीकृष्ण भगवाने शाल्वने मारवानुं बीजुं  
पश अद्वृत काम कर्युं हतुं, तेनी कथा सांभणो.<sup>१</sup> शिशुपाणनो भित्र शाल्व राजा  
रुक्मिणीना विवाहमां आव्यो हतो, त्यारे युद्धमां तेने यादवोंसे ज्ञती लीधो हतो  
अने जरासंध आदि बीजा राजाओने पश ज्ञती लीधा हता.<sup>२</sup> सर्वे राजाओना  
सांभणतां ए शाल्वे प्रतिज्ञा करी हती के “हुं पृथ्वीने यादवो वगरनी करीश.  
मारो पुरुषार्थं जुवो”<sup>३</sup> मूढ़ शाल्वराजा आ प्रमाणे प्रतिज्ञा करीने सदाशिवनी  
आराधना करवा लाङ्यो अने आराधना करतां मात्र धूणनी ऐक मूठी फँकीने ज  
रहेतो हतो.<sup>४</sup> सदाशिव तरत प्रसन्न थाय ऐवा छे, तोपश भगवानना देखी  
शाल्वने वरदान देवुं व्यर्थ जाणी ऐक वर्ष पूरुं थया पछी शाल्वने वर भागवानुं

देवासुरमनुष्याणां गन्धर्वोरगरक्षासाम् । अभेद्यं कामगं वब्रे स यानं वृष्णिभीषणम् ॥६  
तथेति गिरिशादिष्ठे मयः परपुरज्जयः । पुरं निर्माय शाल्वाय प्रादात् सौभमयस्मयम् ॥७  
स लब्ध्वा कामगं यानं तमोधाम दुरासदम् । ययौ द्वारवती शाल्वो वैरं वृष्णिकृतं स्मरन् ॥८  
निरुद्ध्य सेनया शाल्वो महत्या भरतर्षभ ! । पुरीं बभज्जोपवनान्युद्यानानि च सर्वशः ॥९  
सगोपुराण द्वाराणि प्रासादाव्वालतोलिकाः । विहारान् स विमानाग्न्यान्निपेतुः शस्त्रवृष्ट्यः ॥१०  
शिला द्रुमाश्राशनयः सर्पा आसारशर्कराः । प्रचण्डश्वकवातोऽभूद् रजसाऽच्छादिता दिशः ॥११  
इत्यर्द्यमाना सौभेन कृष्णस्य नगरी भृशम् । नाभ्यपद्यत शं राजस्त्रिपुरेण यथा मही ॥१२  
प्रद्युम्नो भगवान् वीक्ष्य बाध्यमाना निजाः प्रजाः । मा भैष्णव्यधाद्वीरो रथास्त्रो महायशाः ॥१३  
सात्यकिश्चारुदेष्याश्र साम्बोऽकूरः सहानुजः । हर्दिक्यो भानुविन्दश्च गदश्च शुकसारणौ ॥१४  
अपरे च महेष्वासा रथयूथपयूथपाः । निर्युर्दशिता गुमा रथेभाश्वपदातिभिः ॥१५  
ततः प्रववृते युद्धं शाल्वानां यदुभिः सह । यथासुराणां विबुधैस्तुमुलं लोमहर्षणम् ॥१६

कह्युं.<sup>५</sup> शाल्व राजा ए देव, असुर, मनुष्य, गंधर्व, नाग अने राक्षसोथी भेदी  
शकाय नहीं ऐवुं, ईर्ष्या प्रमाणे पहोचे ऐवुं अने यादवोने त्रास आपनारुं विमान  
माङ्युं.<sup>६</sup> “तथास्तु” ऐम कहीने महादेवे आज्ञा करतां शत्रुओना पुरने ज्ञतनार  
मयदानवे सौभ नामनुं विमान बनावीने शाल्वने आप्युं.<sup>७</sup> ईर्ष्या थाय त्यां  
पहोंयनार अने बीजाथी पमाय नहीं ऐवुं अने अंधकारना स्थानकरुप विमान  
मेणवीने यादवो ए करेला वैरने संभारतो ते शाल्वराजा द्वारका उपर आव्यो.<sup>८</sup>  
हे राजा ! मोटी सेनाथी द्वारकाने घेरी लईने तेना सर्वे बगीचा अने वाडीओने  
भांगवा लाङ्यो.<sup>९</sup> गोपुर, द्वार, प्रासाद, मेडीओ, भीतो अने विहारनां स्थानकोने  
भांगवा लाङ्यो. मोटा सौभ विमानमांथी शक्त्रनी वृष्टि थवा लागी.<sup>१०</sup> पथरा,  
जाइ, उल्कापात, सर्प अने भारे करानी वृष्टि थवा लागी. भयंकर वंटोणीओ  
उत्पत्त थयो अने धूणथी दिशाओ ढंकाई गई.<sup>११</sup> त्रिपुरासुरे पीडा करवा मांडतां  
जेम पृथीने सुख भयुं न हतुं, तेम शाल्वे भडु ज पीडा करवा मांडतां भगवाननी  
नगरी द्वारकाने कोई रीते सुख थयुं नहीं.<sup>१२</sup> महावीर अने मोटी कीर्तिवाणा  
प्रद्युम्ने पोतानी प्रजाने पीडाती ज्ञेई रथमां बेसीने “भीशो नहीं” ऐम कह्युं.<sup>१३</sup>  
सात्यकि, सांभ, अक्षरज्ञ, कृतवर्मा, गृष्म, शुक अने बीजा पश मोटा धनुषवाणा  
महारथीओना अधिपतिओ कवय पहेरी, रथ, हाथी, घोडा अने पाणाओने साथे  
लईने बहार नीकण्या.<sup>१४-१५</sup> पछी जेम देत्य अने देवताओनी साथे युद्ध थयुं  
हतुं, तेम शाल्वनी सेनावाणाओने यादवोनी साथे तुमुल अने रुवाडां उत्तमां करे

ताश्च सौभपतेर्मया दिव्यास्त्रै रुक्मिणीसुतः । क्षणेन नाशयामास नैशं तम इवोष्णागुः ॥१७  
विव्याध पञ्चविंशत्या स्वर्णपुहूर्योमुखैः । शाल्वस्य ध्वजिनीपालं शरैः सन्नतपर्वधिः ॥१८  
शतेनाताडयच्छाल्वमेकैकेनास्य सैनिकान् । दशभिर्दर्शभिर्नेतृन् वाहनानि त्रिभिस्त्रिभिः १९  
तदद्वृतं महत् कर्म प्रद्युम्नस्य महात्मनः । दृष्ट्वा तं पूजयामासुः सर्वे स्वपरसैनिकाः ॥२०  
बहुरूपैकस्तपं तद् दृश्यते न च दृश्यते । मायामयं मयकृतं दुर्विभावं परेरभूत् ॥२१  
क्वचिद् भूमौ क्वचिद् व्योग्नि गिरिमूर्धिन जले क्वचित् । अलातचक्रवद् भ्राम्यत् सौभं तद् दुरवस्थितम्  
यत्र यत्रोपलक्ष्येत ससौभः सहसैनिकः । शाल्वस्तस्ततोऽमुञ्चन् शरान् सात्वत्यूथापाः ॥२३  
शौरैरगन्यकं संस्यर्णैराशीविषदुरासदैः । पीड्यमानपुरानीकः शाल्वोऽमुहृत् परेरितैः ॥२४  
शाल्वानीकपशस्त्रैघैर्वृष्णिवीरा भृशादिताः । न तत्यजू रणं स्वं स्वं लोकद्वयजिगीवपः २५  
शाल्वामात्यो द्युमान् नाम प्रद्युम्नं प्राकप्रपीडितः । आसाद्य गदया मौर्व्या व्याहत्य व्यनदद् बली ॥  
प्रद्युम्नं गदया शीर्णवक्षः स्थलमरिन्दमम् । अपोवाह रणात् सूतो धर्मविद् दारुकात्मजः २७

अेवुं युद्ध थयुः १६ जेम सूर्य रात्रीना अंधारानो नाश करे तेम प्रद्युम्ने क्षण मात्रमां  
दिव्य अस्त्रोथी शाल्वनी मायाओनो नाश करी नाख्यो १० सुवर्णानी पुंखवाणां,  
लोढाना मुखवाणां अने नमेली अशीवाणां पच्यीश बाणोथी प्रद्युम्ने शाल्वना  
सेनापतिने वींधी नांख्यो ११ सो बाण शाल्वने मार्या, एक एक बाण तेना दरेक  
योद्धाओने मार्यु, दश दश बाण सारथीओने मार्या अने त्रष्ण त्रष्ण बाण वहानोने  
मार्या १५ महात्मा प्रद्युम्ननुं अे मोटुं अद्वृत काम ज्ञेठने सर्वे पोतानी तथा शत्रुनी  
सेनाना योद्धाओ तेमनां वधाण करवा लाग्या २० शाल्वनुं ते विमान कोई समये  
एक रूप अने कोई समये बहुरूप थई जतुं हतुं अने कोईक समये देखातुं पशा न  
हतुं आवी रीते मयदानवे मायाथी बनावेलुं ते विमान शत्रुओना धारवामां पशा  
आवतुं न हतुं २१ क्यारेक धरी उपर, क्यारेक आकाशमां, क्यारेक पर्वतना शिखर  
उपर अने क्यारेक जग्मां फरतुं ते सौभ विमान उंभाडीआना यक्कनी पेठे स्थिर  
रहेतुं न हतुं २२ विमान अने योद्धाओ सहित शाल्व ज्यां देखातो त्यां यादवोना  
यूथपतिओ बाणो नाखता हता २३ अग्नि अने सूर्यना सरभा स्पर्शवाणा अने  
सर्पनी पेठे त्रास आपनारा यादवोंसे भूक्तेला बाणोथी पोतानुं विमान अने योद्धाओ  
पीडा पामतां शाल्व मुंजाई गयो २४ आलोक तथा परलोकमां सुख पामवानी  
ईच्छावाणा वीर यादवो शाल्वना सेनापतिनां धणां शस्त्रोथी बहु ज पीडाता  
हता, तोपश पोतपोतानी रणभूमिने छोडता न हता २५ प्रथम प्रद्युम्ने पीडेला  
शाल्वना भणवान मंत्री द्युमाने, प्रद्युम्न सामो आवी तेमने मोटी गदा मारीने

लब्धसंज्ञो मुहूर्तेन कार्षिः सारथिमब्रवीत् । अहो असाधिवदं सूत! यद् रणान्मेऽपसर्णम् २८  
न यदूनां कुले जातः श्रूयते रणविच्युतः । विना मत् क्लीबचित्तेन सूतेन प्राप्तिक्लिप्तात् २९  
किं नु वक्ष्येऽभिसङ्गम्य पितरौ रामकेशवौ । युद्धात् सम्यगपक्रान्तः पृष्ठस्त्रात्मनः क्षमम् ३०  
व्यक्तं मे कथयिष्यन्ति हसन्त्यो भ्रातृजामयः । क्लैब्यं कथं कथं वीर! तवान्यैः कथयतां मृथेऽ१

## सारथिरुवाच

धर्मविजानताऽयुष्मन् कृतमेतम्या विभो । सूतः कृच्छ्रगतं रक्षेद् रथिनं सारथिं रथी ॥३२  
एतद्विदित्वा तु भवान् मयापोवाहितो रणात् । उपसृष्टः परेणेति मूर्च्छितो गदया हतः ॥३३

इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे उत्तरार्धं  
शाल्वयुद्धे षट्सप्ततिमोऽध्यायः ॥७६॥

गर्जना करी २६ शत्रुओने मारनार प्रद्युम्न के जेमनुं वक्षः स्थण गदाथी फाटी गयुं  
तेमने, धर्म जाणनारो दारुकनो पुत्र सारथि, युद्धमांथी दूर लै गयो २७  
थोडीवारमां भान आवतां प्रद्युम्ने सारथिने कहुं के अहो! हे सारथि! तुं युद्धमांथी  
मने दूर लै गयो ए भूंडुं कर्यु २८ जे मने नपुंसक सरभा यितवाणा सारथिये  
दूषित करी दीधो । ते मारा विना बीजो कोई यादवना कुणमां जन्मेलो युद्धमांथी  
भागेलो सांभणवामां आव्यो नथी २९ ते हुं युद्धमांथी खसी गयो, तेथी हवे मारा  
पिता श्रीकृष्ण अने बलभद्र मणीने तेओ पूछिशे त्यारे, मारी योग्यता विषे सारी  
रीते शु बोली शकीश ? ३० मारा भाईओनी स्त्रीओ “हे वीर! बीजाओनी साथे  
युद्ध करतां तमारुं केम थयुं हतुं ते कहो” एम हसतां हसतां बोलीने अवश्य मने  
नपुंसक ठरावशे ३१

सारथि कहे छे हे मोटा आयुष्यवाणा ! हे प्रभु ! में धर्म समज्जने आ काम  
कर्यु छे २८ थमां बेसनारने कष्ट पडे त्यारे सारथिये तेनी रक्षा करवी ज्ञेईये, अने  
सारथिने कष्ट पडे त्यारे रथमां बेसनाराये तेनी रक्षा करवी ज्ञेईये ३२ तमने  
शत्रुनी गदानो प्रहार वागवाथी पीडा पामीने भूर्धित थई गया जाणी, हुं युद्धमांथी  
दूर लै गयो हतो ३३

इति श्रीमद् महापुराणा भागवतना दशम स्कन्धनो छोतेरमो अद्याय संपूर्णः

अथ सप्तसप्ततिमोऽध्यायः (७७)

॥ श्रीशुक उवाच ॥

स तूपस्पृश्य सलिलं दंशितो धृतकार्मुकः । नय मां द्युमतः पाश्वं वीरस्येत्याह सारथिम् ॥१  
विधमन्तं स्वसैन्यानि द्युमन्तं रुक्मिणीसुतः । प्रतिह्त्य प्रत्यविध्यन्नाराचैरष्टिः स्मयन् ॥२  
चतुर्भिर्षतुरो वाहान् सूतमेकेन चाहनत् । द्वाभ्यां धनुशं केतुं च शरेणान्येन वै शिरः ॥३  
गदसात्यकिसाम्बाद्या जघ्नुः सौभपतेर्बलम् । पेतुः समुद्रे सौभेयाः सर्वे संछिन्नकथराः ॥४  
एवं यदूनां शाल्वानां निघ्नतामितरेतरम् । युद्धं त्रिणवारात्रं तदभूत्मुलमुल्बणम् ॥५  
इन्द्रप्रस्थं गतः कृष्ण आहूतो धर्मसूनुना । राजसूयेऽथ निर्वृते शिशुपाले च संस्थिते ॥६  
कुरुवृद्धाननुज्ञाप्य मुनीश्च ससुतां पृथाम् । निमित्तान्यतिधोराणि पश्यन् द्वारवर्ती ययौ ॥७  
आह चाहिमहायात आर्यमिश्राभिसङ्गतः । राजन्याश्चैवापक्षीया नूनं हन्तुः पुरी मम ॥८  
वीक्ष्य तत् कदनं स्वानां निरूप्य पुरक्षणम् । सौभं च शाल्वराजं च दारुकं प्राहकेशवः ॥९

अध्याय ७७

मायावी शाल्वनो तथा तेना विभाननो श्रीकृष्णो नाश कर्यो ।

शुक्टेवज्जु कुहे छे जणनुं आयमन लई धनुष धरीने सज्ज थयेला ते प्रद्युम्ने सारथिने कहुं के “मने वीर द्युमाननी पासे लई जा。”<sup>१</sup> पोताना सैन्यनो नाश करता द्युमानने रोकीने प्रद्युम्ने हसतां हसतां तेने आठ बाणथी वींध्यो<sup>२</sup> तेमां चार बाणथी चार धोडा मार्या, एक बाणथी सारथिने मार्या, बे बाणथी धनुष तथा धज्जा कापी नाखी अने एक बाणथी द्युमाननुं माथुं कापी नाख्युं<sup>३</sup> गट, सात्यकि अने सांब आहि यादवो शाल्वना सैन्यने मारवा लाग्या. माथां कपाई जतां सौभ विमानमां बेठेला सर्वे समुद्रमां पडवा लाग्या.<sup>४</sup> आवी रीते यादवो अने शाल्वना पक्षना लोको एक बीजाने मारतां ते तुमुल अने भयंकर युद्ध सत्यावीश रात्री सुधी चाल्युं.<sup>५</sup> युधिष्ठिर राजाए बोलाववाथी ठंडप्रस्थमां गयेला श्रीकृष्ण भगवान राजसूय पूरो थया पधी अने शिशुपाण भरी गया पधी वृद्ध क्रौरवोनी, मुनिओनी अने पुत्रो सहित कुंतीनी आज्ञा लईने अत्यंत भयंकर शुक्नो जोता जोता द्वारकामां जवा नीकण्या.<sup>६-७</sup> मार्गमां विचार करवा लाग्या के “हुं बलभद्र सहित अहीं आव्यो धुं, तो शिशुपालना पक्षना राजाओ अवश्य मारी नगरीने मारता हो.”<sup>८</sup> विचार करता करता द्वारका पासे आव्या त्यां सौभ विमानने, शाल्व राजाने अने तेथी थता पोताना सैन्यना नाशने जोई, द्वारिकानी रक्षा करवा माटे बणभद्रने मोकल्या. पधी भगवाने दारुकने कहुं के

रथं प्रापय मे सूत ! शाल्वस्यान्तिकमाशु वै । सम्भ्रमस्ते न कर्तव्यो मायावी सौभराडयम् १०  
इत्युक्तश्चोदयामास रथमास्थाय दारुकः । विशन्तं ददृशुः सर्वे स्वे परे चारुणानुजम् ॥११  
शाल्वश्च कृष्णामालोक्य हतप्रायबलेश्वरः । प्राहरत् कृष्णासूताय शर्किं भीमरवां मृधे ॥१२  
तामापतन्ती नभसि महोल्कामिव रंहसा । भासयन्ती दिशः शौरिः सायकैः शतधाच्छिन्तत् ॥१३  
तं च षोडशभिर्विद्वा बाणैः सौभं च खे भ्रमत् । अविध्यच्छसन्दोहैः खं सूर्य इव रशिभिः ॥१४  
शाल्वः शौरेरेस्तु दोःसव्यं सशाङ्गं शाङ्गधन्वनः । बिभेद न्यपतद्वस्तात् शाङ्गमासीतदद्वृतम् ॥१५  
हाहाकारो महानासीद् भूतानां तत्र पश्यताम् । विनद्य सौभराडुच्चैरिदमाह जनार्दनम् ॥१६  
यत्त्वया मूढ ! नः सख्युभ्रातुर्भार्या होक्षताम् । प्रमत्तः स सभामध्ये त्वया व्यापादितः सखा ॥१७  
तं त्वाद्य निशतैर्बाणैरपराजितमानिनम् । न याम्यपुनरावृत्तिं यदि तिष्ठेमाग्रतः ॥१८

श्रीभगवानुवाच

वृथा त्वं कत्थसे मन्द ! न पश्यस्यन्तिकेज्ञतकम् । पौरुषं दर्शयन्ति स्म शूरा न बहुभाषिणः ॥९

“हे सारथि ! मारा रथने शाल्वनी पासे तरत पहोंचाई दे. आमां तारे सभम करवो नहीं, केम्के आ शाल्व राजा मायावी छे.”<sup>१०</sup> आ प्रमाणे भगवाने आज्ञा करतां दारुके रथ उपर सारी रीते बेसीने तेने हांक्यो. पोताना अने पराया सर्वे लोकोये युद्धमां भगवाननी ध्वजामां रहेला गरुडने आवतां जोया. अर्थात् गरुडध्वज २थ उपर विराजमान श्रीकृष्णने रेणसंग्राममां प्रवेशता जोया.<sup>११</sup> जेना धशा भरा सेनापतिओ मरण पाभ्या हता, एवा शाल्वराजाए युद्धमां भगवानने आव्या जोई तेमना सारथि उपर भयंकर शब्दवाणी सांग नाखी.<sup>१२</sup> आकाशमां वीजणीनी पेठे भारे वेगथी आवती अने दिशाओमां प्रकाश करती ते सांगने श्रीकृष्णो पोताना बाणोथी अनेक कटका करी कापी नाखी.<sup>१३</sup> सोण बाणथी शाल्वने पश वींधी नाखतां, सूर्य जेम पोताना किरणोथी आकाशने वींधे, तेम आकाशमां फरता सौभ विमानने बाणना समूहथी वींधी नाख्युं.<sup>१४</sup> शाल्व राजाए श्रीकृष्णनो डाबो हाथ के जेमां शारंग धनुष हतुं तेने भेदी नाख्यो, तेथी भगवानना हाथमांथी शारंगधनुष पडी गयुं, ए भारे आश्वर्य थयुं.<sup>१५</sup> ते समयमां जोनारा प्राणीओये मोटो हाहाकार करी मेल्यो. शाल्व राजाए मोटी गर्जना करीने भगवानने कहुं के हे मूढ ! अमारा देखतां अमारा भित्रनी स्त्रीने तुं हरी गयो छे; वणी राजसूयनी सभानी अंदर अमारा भित्रना प्रमाणनो लाभ लईने तेने मारी नाख्यो छे, एटला माटे जे तुं अपराजित पण्णानुं भिथ्याभिमान धरावे छे, ते तुं मारी आगण उभो रहीश, तो तने आज सजावेलां बाणोथी त्यां मोकली

इत्युक्त्वा भगवाञ्छाल्वं गदया भीमवेगया । तताड जत्रौ संरब्धः स चकम्पे वमन्नसूक् २० गदायां सन्निवृत्तायां शाल्वस्त्वन्तरधीयत । ततो मुहूर्तं आगत्य पुरुषः शिरसाच्युतम् ।

देवक्या प्रहितोऽस्मीति नत्वा प्राह वचो रुदन् ॥२१ कृष्ण कृष्ण महाबाहो पिता ते पितृवत्सल ! । बद्धवापनीतः शाल्वेन सैनिकेन यथा पशुः २२ निशम्य विप्रियं कृष्णो मानुषीं प्रकृतिं गतः । विमनस्को धृणी स्नेहाद् बभाषे प्राकृतो यथा २३ कथं राममसम्भान्तं जित्वाजेयं सुरासुरैः । शाल्वेनाल्पीयसा नीतः पिता मे बलवान् विधिः २४ इति ब्रुवाणे गोविन्दे सौभराद् प्रत्युपस्थितः । वसुदेवमिवानीय कृष्णां चेदमुवाच सः ॥२५ एष ते जनिता तातो यदर्थमिह जीवसि । वधिष्ये वीक्षतस्तेऽमुमीशश्चेत् पाहि बालिश! ॥२६ एवं निर्भर्त्य मायावी खड्गेनानकदुन्धभेः । उत्कृत्य शिर आदय खस्थं सौभं समाविशत् २७ ततो मुहूर्तं प्रकृतावुपल्लुतः स्वबोध आस्ते स्वजनानुषङ्गतः ।

महानुभावस्तद्बुद्ध्यदासुरीं मायां स शाल्वप्रसृतां मयोदिताम् ॥२८॥

आपीश के ज्यांथी पाईं अवातुं नथी ॥<sup>१६-१८</sup>

श्रीकृष्ण कहे छे हे भूर्भु ! तुं वृथा बके छे अने पासे काण आव्यो छे तेने पशु तुं जाणतो नथी । शूर पुरुषो पोतानो पुरुषार्थ देखाडे पश घण्युं बोले नहीं ॥१९

शुक्टेवश्च कहे छे आ प्रमाणे कहीने कोध पामेला भगवाने शाल्वनी हांसदीमां भयंकर वेगवाणी गदा मारी । शाल्वराजा कंपवा अने लोही ओकवा लाभ्यो ॥२० गदा पाई वज्या पछी शाल्व अंतर्धानं थई गयो । पछी थोडी ज वारमां एक पुरुष आवी भगवानने मस्तकथी प्रणाम करी “मने देवकीऐ मोकल्यो छे” एम कही रोतो रोतो बोल्यो के “हे कृष्ण ! हे महाबाहु ! हे पिता उपर प्रीति राखनार ! कसाई जेम पशुने लई जाय तेम शाल्व राजा तमारा पिताने बांधीने लई गयो छे ॥२१-२२ आ अप्रिय वात सांभणी मनुष्यनी प्रकृतिने पामेला दयानु भगवान मनमां उदास थईने ग्राहृत मनुष्यनी पेठे बोल्या के “संभ्रम न पामनार अने देव तथा हैत्यो पशु जेने छती शके नहीं ऐवा बलभद्रने छती लई, नीय अने तुच्छ शाल्व मारा पिताने शी रीते लई गयो हशे ? पश दैव भणवान छे ॥” २३-२४ आ प्रमाणे भगवान बोलता हता तेटली वारमां नकली वासुदेव लईने शाल्व आव्यो, अने तेषो भगवानने कह्युं के “हे भूर्भु ! तने जन्म आपनार आ तारो बाप छे के जेने माटे तुं छवे छे, तारा देखतां आने हुं मारी नाखीश । जो तारी शक्ति होय तो आनी रक्षा कर ॥” २५-२६ मायावी शाल्व आ प्रमाणे भगवाननो तिरस्कार करी, खड्गथी वसुदेवनुं माथुं कापी नाखी, ते माथुं लईने आकाशमां

न तत्र दूतं न पितुः कलेवरं प्रबुद्ध आजौ समपश्यदच्युतः ।

स्वाजं यथा चाम्बरचारिणं रिपुं सौभस्थमालोक्य निहन्तुमुद्युतः ॥२९॥

एवं वदन्ति राजर्णे ! ऋषयः के च नान्विताः । यत् स्ववाचो विरुद्ध्येत नूनं ते न स्मरन्त्युत ॥३०

क्रशोकमोहौ स्नेहो वा भयं वा येऽज्ञसम्भवाः । क्रचाखण्डितविज्ञानज्ञानैश्वर्यस्त्वखण्डितः ॥३१

यत्पादसेर्वोर्जितयाऽमविद्या हिन्वन्त्यनाद्यात्मविपर्ययग्रहम् ।

लभन्त आत्मीयमनन्तमैश्वरं कुतो नु मोहः परमस्य सद्गतेः ॥३२॥

तं शस्त्रपूर्णैः प्रहरन्तमोजसा शाल्वं शरैः शौरिरमोघविक्रमः ।

विद्ध्वाच्छिन्द वर्म धनुः शिरोमणिं सौभं च शत्रोर्गदया रुरोज ह ॥३३॥

तत् कृष्णहस्तेरितया विचूर्णितं पपात तोये गदया सहस्रधा ।

विसृज्य तद् भूतलमास्थितो गदामुद्यम्य शाल्वोऽच्युतमध्यगाद् द्रुतम् ॥३४॥

रहेला सौभ विमानमां गयो ॥२७ भगवान स्वतःसिद्ध ज्ञानवाणा होवा छिं पाषण थोडीवार स्वजन उपर स्नेहने लीधे, मनुष्यना स्वभावमां मृग थई रह्या । पछी मोटा प्रभाववाणा श्रीकृष्ण येत्या के भयदानवे शीभवेली आ आसुरी माया ज शाल्वे यलावी छे । आम येत्या एटले त्यां, जागेलो माणस जेम स्वप्रना पदार्थने टेझे नहीं, तेम भगवाने दूतने के पिताना देहने पश दीठो नहीं । पछी सौभमां बेसी आकाशमां इरता शत्रुने ज्ञेईने तेने मारी नाखवाने सज्ज थया ॥२८-२९ हे राजा ! पूर्वापरनुं अनुसंधान नहीं राखनारा केटलाएक ऋषिओ आ प्रमाणे वात करे छे पश तेओ पोताना ज वयनने जे विरोध आवे छे तेनुं स्मरण करता नथी ॥३० शोक, मोह, स्नेह अने भय के जेओ अशानी माणसोमां ज संभवे छे । तेओ क्यां ? अने अर्खंडित तथा जेमनां ज्ञान, विज्ञान अने ऐश्वर्य अर्खंडित छे ऐवा श्रीकृष्ण क्यां ? आ कारणथी पश भगवानने मोह थवो संभवतो ज नथी ॥३१ जे भगवानना यरणनी सेवा करवाथी वृद्धि पामेली आत्मविद्याना प्रभावथी सत्पुरुषो अनादि काणनी आत्मामां देहभुद्धिनो नाश करी, भगवाननी सेवाथी आत्मामां उत्पत्त थयेला अनंत अपहतपाप्तवादि ऐश्वर्यने पामे छे, ते सर्वोत्कृष्ट अने सत्पुरुषोना शरणरूप भगवानने मोह थवो संभवे ज केम ? अर्थात् भगवानना सेवकोने जो मोह थतो न होय तो साक्षात् भगवानने तो मोह थाय ज क्यांथी ? ॥३२ माटे आ वातमां सत्य तो ए छे के अमोह पराक्रमवाणा श्रीकृष्णे अनेक शस्त्रोथी प्रहार करता शाल्वने पोताना सामर्थ्यथी बाष्णोवते वींधी नाखीने तेनां कवय, धनुष अने माथाना मणिने कापी नाखीने, ते शत्रुना सौभ विमानने

आधावतः सगदं तस्य बाहुं भलेन छित्त्वाथ रथाङ्गमद्धुतम् ।  
वधाय शाल्वस्य लयार्कसन्निभं बिभ्रद् बभौ सार्क इवोदयाचलः ॥३५॥

जहार तेनैव शिरः सकुण्डलं किरीटयुकं पुरुमायिनो हरिः ।  
वज्रेण वृत्रस्य यथा पुरन्दरो बभूव हाहेति वचस्तदा नृणाम् ॥३६॥

तस्मिन् निपतिते पापे सौभे च गदया हते । नेदुर्दुन्धभयो राजन् ! दिवि देवगणेरिताः ।  
सखीनामपचिंति कुर्वन् दंतवक्त्रो रुषाऽभ्यगात् ॥३७॥

इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्दे उत्तरार्थं  
सौभवधो नाम सप्तसप्ततिमोऽध्यायः ॥७७॥

## अथ अष्टसपतितमोऽध्यायः (७८)

॥ श्रीशुक उवाच ॥

शिशुपालस्य शाल्वस्य पाँडकस्यापि दुर्मतिः । परलोकगतानां च कुर्वन् पारोक्ष्यसौहृदम् १  
एकः पदातिः संकुद्धो गदापाणिः प्रकम्पयन् । पदभ्यामिमां महाराज ! महासन्त्वो व्यदूश्यत २  
तं तथाऽऽयान्तमालोक्य गदामादाय सत्वरः । अवप्लुत्य रथात् कृष्णः सिन्धुं वेलेव प्रत्यधात् ३  
गदामुद्यम्य कारुषो मुकुन्दं प्राह दुर्मदः । दिष्ट्या दिष्ट्या भवानद्य मम दृष्टिपथं गतः ॥४  
त्वं मातुलेयो नः कृष्ण मित्रधुड्मां जिघांससि । अतस्त्वां गदया मन्द हनिष्ये वज्रकल्पया ५

पश्च गदाथी भांगी नाभ्युं ॥३३॥ भगवानना हाथथी इँकाएली गदाथी हजारो कटका  
थई गयेलुं ते विमान जणमां पड्युं । विमान छोडी दृष्टि धरती पर उभेलो शाल्व  
गदा उगामीने तुरत भगवाननी सामो दोड्यो ॥३४॥ दोड्या आवता शाल्वना गदा  
सहित हाथने भालाथी कापी नाखीने तेना वधने माटे जेमणे प्रलयकाणना सूर्य  
जेवुं यक धर्यु हतुं ऐवा भगवान सूर्यवाणा उदयाचणी पेठे शोभवा लाग्या ॥३५॥  
हँद्रे जेम वज्रथी वृत्रासुरनुं भाथुं कापी नाभ्युं हतुं, तेम भगवाने धणी भाया  
करनारा शाल्वनुं किरीट अने कुंडण सहित भाथुं ते यकथी कापी नाभ्युं । ते समयमां  
लोको हालाकार करवा लाग्या ॥३६॥ हे राजा ! ऐ पापी शाल्व मरण पामतां अने  
सौभ विमान गदाथी भांगी जतां आकाशमां देवताओनां हुंदुभि वाग्यां । पछी  
पोताना भित्रोनुं वेर वाणवा कोधथी दंतवक्त्र आव्यो ॥३७॥

इति श्रीमद् महापुराणा भागवतना दशम स्कन्दनो  
सीत्योत्तमो अद्याय संपूर्णः ।

तर्हानृण्यमुपैर्यज्ञ मित्राणां मित्रवत्सलः । बन्धुस्तपमरिं हत्वा व्याधिं देहचरं यथा ॥६  
एवं रूक्षस्तुदन् वाक्यैः कृष्णं तोत्रैरिव द्विप्रम् । गदया ताडयन्मूर्धिन सिंहवद् व्यनदच्च सः ७  
गदयाभिहतोऽप्याजौ न चचाल यद्दूद्ध्रहः । कृष्णोऽपि तमहन् गुर्व्या कौमोदक्या स्तनान्तरे ८  
गदानिर्भिन्नहृदय उद्धमन् रुधिरं मुखात् । प्रसार्य केशबाहृद्धीन् धरण्यां न्यपतद् व्यसुः ॥९  
ततः सूक्ष्मतं ज्योतिः कृष्णामाविशद्दृढतम् । पश्यतां सर्वभूतानां यथा चैद्यवधे नृप ! ॥१०  
विदूरथस्तु तद्भ्राता भ्रातृशोकपरिप्लुतः । आगच्छदसिचर्मभ्यामुच्छ्वसंस्तज्जिधांसया ॥११॥

## अद्याय ७८

श्रीकृष्णे दंतवक्त्र तथा विदूरथने भार्या अने भणदेवज्ञुये  
रोमहर्षाङ्काने भार्या ।

शुकदेवज्ञु कहे छे हे राजा ! शिशुपाण, शाल्व अने पौँड्रुक के जेओ मरण  
पाभ्या हता तेओनो परोक्ष स्नेह देखाइतो, अेकलो, मोटा भणवाणो, हाथमां  
गदा धरनारो अने पगथी धरतीने ध्रुजावतो दंतवक्त्र देखवामां आव्यो ॥१-२॥ आ  
प्रमाणे आवता दंतवक्त्रने जेई भगवाने तरत रथमांथी उतरी गदा लैठने  
कांठो जेम समुद्रने रोडे तेम तेने रोक्यो ॥३॥ मदोन्मत दंतवक्त्रे गदा उगामीने  
भगवानने कह्युं के “तुं आज मारी दृष्टिये यढ्यो ऐ धणुं ज सारु थयुं ॥४॥ हे कृष्ण !  
अमारा मामानो दीकरो अने भित्रोनो द्रोह करनार तुं मने मारी नाखवा ईर्च्छे  
छे, माटे हे भूर्भ ! वज्ज जेवी गदाथी हुं तने मारी नाखीश ॥५॥ हे अज ! जेम देहमां  
झरनारा रोगने हणे तेम जे तुं बंधुरुपे शत्रु छे ते तने हुं हाणीश, त्यारे जे हुं  
भित्रो उपर प्रेम राखनार धुं ते भित्रोना ऋणीथी मुक्त थर्षीश ॥६॥ आ प्रमाणे  
अंकुश आदिकथी जेम हाथीने पीडा आपवामां आवे, तेम कठण वयनोथी श्रीकृष्णने  
पीडा आपता दंतवक्त्र श्रीकृष्णना माथामां गदा मारी अने सिंहनी पेठे गर्जना  
करी ॥७॥ युद्धमां गदा वाग्या छतां भगवान कंप्या नहीं, अने तेमणे पश्च क्रौमोदकी  
नामनी भारे गदा दंतवक्त्रनी छातीमां मारी ॥८॥ गदाथी छाती फाटी पडतां मोठांथी  
लोही ओकतो ते दंतवक्त्र केश, हाथ अने पगने धरती पर लांबा करी प्राण  
रहित थर्षने पड्यो ॥९॥ हे राजा ! पछी शिशुपाणनुं तेज जेम भगवानमां प्रवेशी  
गयुं हतुं तेम दंतवक्त्रनुं अत्यंत सूक्ष्म तेज जेम भगवानमां देखतां छतां  
भगवानमां प्रवेशी गयुं ॥१०॥ भाईना शोकथी व्याम थयेलो ते दंतवक्त्रनो भाई  
विदूरथ भगवानने मारी नाखवानी ईर्च्छाथी हांकतो हांकतो ठाल, तलवार लैठने

तस्य चापततः कृष्णश्वक्रेण क्षुरनेमिना । शिरो जहार राजेन्द्र ! सकिरीटं सकुण्डलम् ॥१२  
एवं सौभं च शाल्वं च दन्तवक्रं सहानुजम् । हत्वा दुर्विषहानचैरीडितः सुरमानवैः ॥१३  
मुनिभिः सिद्धग्रथ्वैर्विद्याधरमहोरगैः । अप्सरोभिः पितृगौर्यक्षैः किन्नरचारणैः ॥१४  
उपगीयमानविजयैः कुसुमैरभिर्विर्षितैः । वृतश्च वृष्णिप्रवैर्विवेशालङ्कृतां पुरीम् ॥१५  
एवं योगेश्वरः कृष्णो भगवाज्जगदीश्वरः । इयते पशुदृष्टीनां निर्जितो जयतीति सः ॥१६  
शृत्वा युद्धोद्यमं रामः करुणां सह पाण्डवैः । तीर्थामिषेकव्याजेन मध्यस्थः प्रययौ किल ॥१७  
स्नात्वा प्रभासे संतर्प्य देवर्विषितृमानवान् । सरस्वतीं प्रतिस्तोतं यथौ ब्राह्मणसंवृतः ॥१८  
पृथूदकं बिन्दुसरस्त्रितकूर्यं सुदर्शनम् । विशालं ब्रह्मतीर्थं च चक्रं प्राचीं सरस्वतीम् ॥१९  
यमुनामनु यान्येव गङ्गामनु च भारत ! । जगाम नैमिषं यत्र ऋषयैः सत्रमासते ॥२०  
तमागतमभिप्रेत्य मुनयो दीर्घसत्रिणः । अभिनन्द्य यथान्यायं प्रणाम्योत्थाय चार्चयन् ॥२१  
सोऽर्चितः सपरीवारः कृतासनपरिग्रहः । रोमहर्षणमासीनं महर्षेः शिष्यमैक्षत ॥२२

आव्यो. ११ ए विद्वूरथ आवतो हतो त्यां ज भगवाने सज्जाया सरभी धारवाणा  
यक्षी तेनुं किरीट अने कुंडण सहित माथुं कापी नाख्युं. १२ आ प्रमाणे सौभ,  
शाल्व, दंतवक्र अने तेनो भाई विद्वूरथ के जेओ बीजाओथी ज्ञताय अवा न  
हता, तेओने भगवाने मारतां देव अने मनुष्यो भगवाननी सुति करवा लाग्या. १३  
मुनि, सिद्ध, गंधर्व, विद्याधर, मोटा नाग, अप्सराओ, पितृगण, यक्ष, किन्नर  
अने चारणो भगवाननो विजय गावा अने पुण्योनी वृष्टि करवा लाग्या. पछी  
यादवोथी वींटाअेला भगवान धामधूमथी द्वारकामां पधार्या. ए समयमां द्वारकाने  
शशगारी हती. १४-१५ आ प्रमाणे योगेश्वर श्रीकृष्ण सर्वदा ज्ञते ज छे, तोपश  
कोई समये पशु दृष्टिवाणा भूर्भु पुरुणो जरासंधादिक्थी हारी गयेला जाणाय  
छे. १६ पांडवोनी साथे कौरवोअे युद्धनो उद्यम करेलो सांभणी, बणभद्र के जे  
त्राहित हता ते तीर्थसनान करवाना भिषथी द्वारकामांथी चाली नीक्या. १७  
ब्राह्मणोथी वींटाअेला बणदेवज्ञ प्रभासमां समुद्रने विषे स्नान करी देव, ऋषि,  
पितृ अने मनुष्योनुं तर्पण करी सरस्वती नदीनी सामे चाल्या. १८ पृथूदक, बिंदुसर,  
नितकूप, सुदर्शन, विशाल, ब्रह्मतीर्थ, यक्तीर्थ, प्राची, सरस्वती अने गंगा तथा  
यमुनाने अनुसरतां जे बीजं तीर्थो छे, त्यां जहाने नैभिषारण्यमां गया, के ज्यां  
ऋषिओ सत्रयाग करवा बेठा हता. १९-२० लांबाकाणो सत्र मांडी बेठेला  
ऋषिओअे तेमने ओणभीने सन्मुख ऊठवुं, प्रणाम तथा न्याय प्रमाणे  
अभिवंदन करतां तेमनी पूजा करी. २१ परिवार सहित पूजाअेला बणदेवज्ञ

अप्रत्युत्थायिनं सूतमकृतप्रह्लादज्जलिम् । अध्यासीनं च तान् विप्रांशुकोपोद्वीक्ष्य माधवः २३  
कस्मादसाविमान् विप्रान्द्यास्ते प्रतिलोमजः । धर्मपालांस्तथैवास्मान् वधमर्हति दुर्मतिः २४  
ऋषेभर्गवतो भूत्वा शिष्योऽधीत्य बहूनि च । सेतिहासपुराणानि धर्मशास्त्राणि सर्वशः २५  
अदान्तस्याविनीतस्य वृथा पण्डितमानिनः । न गुणाय भवन्ति स्म नटस्येवाजितात्मनः २६  
एतदर्थो हिलोकेऽस्मिन्नवतारो मया कृतः । वध्या मे धर्मध्वजिनस्ते हि पातकिनोऽधिकाः २७  
एतावदुक्त्वा भगवान् निवृत्तोऽसद्व्यादपि । भावित्वात् तं कुशग्रेण करस्थेनाहनत् प्रभुः २८  
हाहेति वादिनः सर्वे मुनयः खिन्नमानसाः । ऊचुः सङ्कर्षणं देवमधर्मस्ते कृतः प्रभो ॥२९  
अस्य ब्रह्मासनं दत्तमस्माभिर्वदुनन्दन । आयुश्चात्माक्लमं तावद् यावत् सत्रं समाप्यते ॥३०  
अजानतैवा चरितस्त्वया ब्रह्मवधो यथा । योगेश्वरस्य भवतो नामायोऽपि नियामकः ॥३१

आसननो स्वीकार करीने बेठा, त्यां वेदव्यासनो शिष्य रोमहर्षणे ऐक उंचां  
आसन पर बेठेलो तेमना ज्ञेवामां आव्यो. २२ ए सूत ज्ञातिनो रोमहर्षणे के जे  
ब्राह्मणो करतां पशु उंचा आसन पर बेठेलो हतो, अने ज्ञेषो प्रत्युत्थान, नम्रता  
के हाथ ज्ञेडवानो विवेक पशु कर्यो नहि, तेने ज्ञेई बणभद्रने रीस चढी. २३ “आ  
प्रतिलोम ज्ञातिनो छतां ब्राह्मणो अने धर्मनुं पालन करनारा अभोथी उंचा आसन  
पर शा माटे बेठो छे ? आम करवाथी आ हुर्भुद्धि सूत मारी नाखवाने योग्य  
छे. २४ महात्मा वेदव्यास मुनिनो शिष्य थै, तेमनी पासेथी ईतिहास पुराण  
सहित धशा ग्रंथो अने सर्वे धर्मशास्त्रो भाष्या छतां आ सूत अयोग्य वर्तषुक  
चलावे छे. नटनी पेठे वेषधारी, मनने तथा ईद्रियोने नहीं ज्ञतनार, विवेक रहित  
अने पंडितपणानुं भिथ्याभिमान धरावनारा पुरुषने शास्त्रात्म्यासथी पशु कशो  
गुण प्राम थतो नथी. २५-२६ अधर्मनुं निवारण करवाने माटे ज आ लोकमां भें  
अवतार धर्यो छे, धर्मनो ढोंग धरावनारा लोकोने मारी नाखवा ज ज्ञेईअे; केमके  
तेओ मोटा पापी छे” २७ बणभद्र ज्ञेके हुए लोकोने मारवाथी निवृत्ति पाभ्या  
हता, तोपश भावि क्रोईनाथी निवारी शकातुं नथी, आटलुं बोलीने तेमणे पोताना  
हाथमां रहेला दर्भनी अशीथी ते सूतने मारी नाख्यो. २८ हाहाकार करता अने  
भेद पामेला सर्वे मुनिओअे बणदेवज्ञने कह्युं के “हे राम ! तमे अधर्म कर्यो. २९  
हे यहुनंदन ! यश पूरो थतां सुधी अमारी पासे पुराणोनी कथा कहेवा सारु  
अमोअे आ सूतने ब्रह्मासन आप्युं हतुं, अने ज्येमां शरीरने भेद न थाय तेवुं  
आयुष्य पशु आप्युं हतुं, तमे अज्ञातां आ ब्रह्महत्या जेवुं काम कर्युं छे. ३० हे  
जगतने पवित्र करनार ! तमे योगेश्वर होवाथी वेदमां कहेलो ब्रह्महत्यानो निषेध

यद्येतद् ब्रह्महत्यायाः पावनं लोकपावन ! । चरिष्यति भवाँल्लोकसंग्रहोऽनन्यचोदितः ॥३२  
श्रीभगवानुवाच

करिष्ये वधनिर्वेशं लोकानुग्रहकाम्यया । नियमः प्रथमे कल्पे यावान् स तु विधीयताम् ३३  
दीर्घमायुर्बैतैतस्य सत्त्वमिन्द्रियमेव च । आशासितं यतद् ब्रूत साधये योगमायया ॥३४

ऋषय ऊचुः

अस्त्रस्य तव वीर्यस्य मृत्योरस्माकमेव च । यथा भवेद् वचः सत्यं तथा राम ! विधीयताम् ३५  
श्रीभगवानुवाच

आत्मा वै पुत्र उत्पन्न इति वेदानुशासनम् । तस्मादस्य भवेद् वक्ता आयुरिन्द्रियसत्त्ववान् ३६  
किंवः कामो मुनिश्चेष्टा ! ब्रूताहं करवाण्यथ । अजानतस्त्वपचितिं यथा मे चिन्त्यतां बुधाः ३७

ऋषय ऊचुः

इल्लवलस्य सुतो घोरो बल्वलो नाम दानवः । स दूषयति नः सत्रमेत्य पर्वणि पर्वणि ॥३८

तमने लागु पडतो नथी, तोपश आप बीजानी प्रेरणा विना पोते ज आ ब्रह्महत्या  
जेवा पापनुं प्रायश्चित करशो तो ज जगतमां भर्यादा रहेशे” ३९

बणभद्र कहे छे जगतनी भर्यादा राखवा सारु हुं वधनुं प्रायश्चित करीश,  
माटे मुख्य पक्षमां जे कांઈ नियम राखवानो होय तेनो उपदेश करो. ३२ आ  
रोमहर्षणनुं लांबु आयुष्य, बण अने ईद्रियोनुं सामर्थ्य फरी प्राप्त थवा विषे जे  
कांઈ तमारी ईच्छा होय ते कहो, एटले हुं मारी योगमायानी शक्तिथी करी  
आपीश. ३३

ऋषिओ कहे छे हे बणदेवज ! जेवी रीते तमारा अस्त्रनी, तमारा  
पराक्रमनी अने मृत्युनी पश सत्यता थाय तथा अमे आपेलुं वयन पश सत्य  
थाय तेवी रीते करी आपो. ३४

बणभद्र कहे छे पिता ज पुत्ररूपथी उत्पन्न थाय छे अेवुं वेदनुं वयन छे,  
एटला माटे आनो पुत्र उत्पन्नवा तमने पुराण संभणावनार थशे, अने आयुष्य,  
ईद्रियनी शक्ति तथा शरीरना बणथी पश संपत्त थशे. ३५ हे भोटा मुनिओ !  
तमारे बीज पश शी ईच्छा छे ? ते कहो, जे कहेशो ते हुं करी आपीश. हे विद्वानो !  
जे हुं प्रायश्चित जाणतो नथी ते मारा प्रायश्चित विषे पश विचार करो. ३६

ऋषिओ कहे छे ईल्लवलनो दीकरो बल्वल नामे एक भयंकर देत्य छे, ते  
दरेक पर्वमां आवीने अमारा यज्ञने अभडावे छे. ३७ हे दार्शाह ! ऐ पापी देत्य  
परु, लोही, विष्टा, मूत्र, मटिरा अने मांसनी वृष्टि करे छे, तेने तमे मारो, ऐ ज

तं पापं जहि दाशार्ह तन्नः शुश्रूषणं परम् । पूयशोणितविण्मूत्रसुरामांसाभिर्विषणम् ॥३९  
ततश्च भारतं वर्षं परीत्य सुसमाहितः । चरित्वा द्वादश मासांस्तीर्थस्नायी विशुद्धयसे ॥४०  
इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्दे उत्तरार्थं  
बलदेवचरित्रे बल्वलवधोपक्रमो नाम अष्टसप्ततिमोऽध्यायः ॥७८॥

अथैएकोनाशीतितमोऽध्यायः (७९)

॥ श्रीशुक उवाच ॥

ततः पर्वण्युपावृत्ते प्रचंडः पांसुवर्षणः । भीमो वायुरभूद्राजन् ! पूयगंधस्तु सर्वशः ॥१  
ततोऽमेध्यमयं वर्षं बल्वलेन विनिर्मितम् । अभवद् यज्ञशालायां सोऽन्वदृश्यत शूलधृक् २  
तं विलोक्य बृहत्कायं भिन्नाज्जनचयोपमम् । तस्मात्रशिखाशमश्रुं दंष्ट्रोग्रभूकीमुखम् ॥३  
सस्मार मुसलं रामः परस्पन्यविदारणम् । हलं च दैत्यदमनं ते तूर्णमुपतस्थतुः ॥४  
तमाकृष्य हलाग्रेण बल्वलं गगनेचरम् । मुसलेनाहनत् क्रुद्धो मूर्धिन ब्रह्मद्रुहं बलः ॥५  
सोऽपतद् भुवि निर्भिन्नलाटोऽसृक्समुत्सृजन् । मुञ्चन्नार्तस्वरं शैलो यथा वज्रहतोऽरुणः ६  
अमारी भोटी सेवा छे. ३८ पछी सारी रीते सावधानपशाथी बार महिना सुधी  
भरतभंडनी प्रदक्षिणा करी, तीर्थोमां स्नान करवाथी तमे पवित्र थशो. ३९  
इति श्रीमद्भागवतमाहात्म्यम् भागवतना दशम स्कन्दनो अठ्योतेमो अद्याय संपूर्णं.

अद्याय ७९

बणदेवज्ञुअे बल्वलने मारी नाखीने ब्रह्महत्याने दूर करवा  
तीर्थयात्रा करी.

शुकदेवज्ञु कहे छे हे राजा ! पछी पर्वणी आवतां भयंकर अने प्रयंड  
वायु उत्पन्न थयो, धूणनी वृष्टि थवा लागी अने चारेकोर परुनो गंध व्यापी  
गयो. १ पछी यज्ञशालामां बल्वल देत्ये करेली अपवित्र पदार्थोनी वृष्टि थवा  
लागी, अने जेना हाथमां त्रिशूण हतुं अेवो ते देत्ये देखायो. २ भोटी कायावाणो,  
भेटेला आंजणाना ढगला सरभो, तपावेलां त्रांबा जेवी मूर्धो तथा शिखावाणो  
अने दाढो तथा भूकुटिथी भयंकर मुखवाणो ते देत्ये जोवामां आवतां, बलरामे  
शत्रुना सैन्यने चीरी नाखनारा पोताना हणनुं अने देत्योने दमन करनारा मुशणनुं  
स्मरण कर्यु, हणमुशण तरत ज आव्यां. ३-४ कोध पामेला बणदेवज्ञुअे आकाशमां  
करनारा ते ब्रह्मद्रोही बल्वल देत्यने हणनी अणीथी खेंयीने तेना माथामां मुशण

સંસ્તુત્ય મુન્યો રામં પ્રયુજ્યાવિતથાશિષ: । અભ્યષિષ્ઠન્ મહાભાગા વૃત્તાં વિબુધા યથા ॥૭  
વૈજયન્તી દવુર્માલાં શ્રીધામામ્લાનપઙ્ક્જામ્ । રામાય વાસસી દિવ્યે દિવ્યાન્યાભરણાનિ ચ ॥૮  
અથ તૈરભ્યનુજ્ઞાત: કૌશિકીમેત્ય બ્રાહ્મણૈ: । સ્તાત્વા સરોવરમગાદ્ યત: સરયુરાસ્ત્વવત્ ॥૯  
અનુસ્થોતેન સરયું પ્રયાગમુપગમ્ય સ: । સ્તાત્વા સંતર્પ્ય દેવાદીન્ જગામ પુલહાશ્રમમ્ ॥૧૦  
ગોમતી ગણદ્કીં સ્તાત્વા વિપાશાં શોણ આપ્લુત: । ગયાં ગત્વા પિતૃનિષ્ટ્વા ગંગાસાગરસર્જન્મે ૧૧  
ઉપસ્પૃશ્ય મહેન્દ્રાદ્રૌ રામં દૃષ્ટાભિવાદ્ય ચ । સસગોદાવરી વેળાં પમ્પાં ભીમરથી તત: ॥૧૨  
સ્કર્દં દૃષ્ટા યથૌ રામ: શ્રીશૈલં ગરિશાલયમ્ । દ્રવિદેષુ મહાપુણ્યં દૃષ્ટાદ્રિં વેઙ્કટં પ્રભુ: ॥૧૩  
કામકોષ્ણી પુરી કાર્ણી કાવેરી ચ સરિદ્વારામ્ । શ્રીઙ્ગાખં મહાપુણ્યં યત્ર સન્ત્રિહિતો હરિ: ॥૧૪  
ત્રષ્ટભાડ્રિં હરે: ક્ષેત્રં દક્ષિણાં મથુરાં તથા । સામુદ્ર સેતુમગમન્મહાપાતકનાશનમ્ ॥૧૫  
તત્ત્રાયુતમદાદ ધેનૂર્બાદ્યણેભ્યો હલાયુધઃ । કૃતમાલાં તાપ્રપર્ણી મલયં ચ કુલાચલમ્ ॥૧૬  
તત્ત્રાગસ્ત્યં સમાસીનં નમસ્કૃત્યાભિવાદ્ય ચ । યોજિતસ્તેન ચાશીભરનુજ્ઞાતો ગતોર્જન્વમ્ ।  
દક્ષિણં તત્ર કન્યાખ્યાં દુર્ગા દેવીં દર્દર્શ સ: ॥૧૭

માર્યું.<sup>૫</sup> કપાળ ફાટી પડતાં લોહી ઓકતો, લોહીથી રાતો થયેલો અને ચીસો નાખતો,  
તે દેત્ય વજથી હણાએલા અને ધાતુથી રંગાએલા પર્વતની પેઠે ધરતી પર પડ્યો.<sup>૬</sup>  
ભાગ્યશાળી મુનિઓએ બલરામની સુતુતિ કરી તથા સત્ય આશીર્વાદ આપીને  
દેવતાઓ જેમ ઈન્દ્રનો અભિષેક કરે તેમ તેમનો અભિષેક કર્યો.<sup>૭</sup> મુનિઓએ ન  
કરમાય એવી અને લક્ષ્મીના સ્થાનકરૂપ વેજયંતી માળા, બે દિવ્ય વસ્ત્ર અને  
દિવ્ય આભરણો બળભદ્રને આય્યાં.<sup>૮</sup> પછી તે મુનિઓની આજ્ઞા લઈ બ્રાહ્મણોની  
સાથે કૌશિકી નદીમાં આવી, સ્નાન કરીને જેમાંથી સરયુનદી ચાલી છે તે સરોવરમાં  
આવ્યા.<sup>૯</sup> પછી સરયુના કંંઠે કંંઠે થઈને પ્રયાગમાં આવ્યા, અને ત્યાં સ્નાન કરી  
તથા દેવાદિકનું તર્પણ કરીને હરિક્ષેત્રમાં આવ્યા.<sup>૧૦</sup> ગોમતી, ગંડકી તથા વિપાશા  
નદીમાં સ્નાન કરી શોણનદમાં નાહ્યા.<sup>૧૧</sup> પછી ગયામાં જઈ પિતુનું પૂજન કરી  
તથા ગંગાસાગરના સંગમમાં નાહ્યા.<sup>૧૨</sup> પછી મહેન્દ્રાચણમાં પરશુરામનાં દર્શન કરી  
તથા પ્રણામ કરીને સમગોદાવરી, વેણી, પંપા અને ભીમરથીમાં નાહ્યા.<sup>૧૩</sup> કર્તિક્ય  
સ્વામીનાં દર્શન કરી શિવના નિવાસરૂપ શ્રીશૈલ પર્વતમાં ગયા. પછી દ્રવિદ દેશમાં  
મહાપવિત્ર વેંકટાચણનાં દર્શન કરીને કામકોષ્ણી અને કંંચીપુરીમાં ગયા. ઉત્તમ  
નદી કાવેરીમાં સ્નાન કર્યું, મહાપવિત્ર શ્રીરંગ નામનું ક્ષેત્ર કે જ્યાં ભગવાન સન્ત્રિહિત  
રહ્યા છે ત્યાં ગયા.<sup>૧૩-૧૪</sup> ભાગવતના ક્ષેત્રરૂપ ઋષભાડ્રિ અને દક્ષિણ મથુરામાં  
જઈને મહાપાપને મટાડનારા સેતુની પાસે ગયા કે જેને રામચંદ્રજીએ સમુદ્રમાં

તત: ફાલ્યુનમાસાદ્ય પઞ્ચાસ્પરસમુત્તમમ્ । વિષ્ણુ: સન્ત્રિહિતો યત્ર સ્તાત્વાસ્પર્શદ્ ગવાયુતમ્ ॥૧૮  
તતોર્ભિવજ્ય ભગવાન્ કેરલાંસ્તુ ત્રિર્ગતકાન્ । ગોકર્ણાખ્યં શિવક્ષેત્રે સાન્ત્રિધ્યં યત્ર ધૂર્જટે: ૧૯  
આર્યા દ્વૈપાણીં દૃષ્ટા શૂર્પારકમગાદ્ બલઃ । તાપીં પયોષ્ણીં નિર્વિન્ધ્યામુપસ્પૃશ્યાથ દણ્ડકમ્  
પ્રવિશ્ય રેવામગમદ્ યત્ર માહિષતી પુરી મનુતીર્થમુપસ્પૃશ્ય પ્રભાસં પુનરાગમત્ ॥૨૧  
શ્રુત્વા દ્વિજૈ: કથ્યમાનં કુરૂપણડવસંયુગે । સર્વરાજન્યનિધનં ભારં મેને હતં ભુવ: ॥૨૨  
સ ભીમદુર્યોધનયોર્ગદાધ્યાં યુધ્યતોર્મધે વારયિષ્ણન્ વિનશનં જગામ યદુનન્દન: ॥૨૩  
યુધિષ્ઠિરસ્તુ તં દૃષ્ટા યમૌ કૃષ્ણાર્જુનાવપિ । અભિવાદ્યાભવંસ્તૂર્ણી કિં વિવક્ષુરિહાગત: ॥૨૪  
ગદાપણી ઉમૌ દૃષ્ટા સંરબ્ધૌ વિજયૈવિષ્ણો । મણ્ડલાનિ વિચિત્રાણિ ચરન્તાવિદમબ્રવીત્ ॥૨૫  
યુવાં તુલ્યબલો વીરો હે રાજન્! હે વૃકોદર! । એક પ્રાણાધિક્મ મંચે ઉતૈકે શિક્ષયાધિક્મ ૨૬  
બાંધેલ છે.<sup>૧૫</sup> ત્યાં જઈને બળભદ્ર બ્રાહ્મણોને દશહજાર ગાયો આપી. કૃતમાલા  
અને તામ્રપણીં નદીમાં સ્નાન કરી મલય નામના કુલપર્વતમાં ગયા.<sup>૧૬</sup> ત્યાં બેઠેલા  
અગસ્ત્ય મુનિને નમસ્કાર તથા અભિવાદન કરતાં તેમણે આશીર્વાદ આપ્યા.  
પછી તેમની આજ્ઞા લઈને બળભદ્ર દક્ષિણ સમુદ્રની પાસે ગયા. ત્યાં કન્યા નામનાં  
દુગાદિવીનું દર્શન કર્યું.<sup>૧૭</sup> પછી અનન્તપુરમાં આવીને પંચાસ્પરસ નામનું ઉત્તમ  
તળાવ કે જેમાં વિષ્ણુ સંત્રિહિત રહ્યા છે, ત્યાં સ્નાન કરીને દશહજાર ગાયોનું દાન  
દીધું.<sup>૧૮</sup> પછી કેરલ અને ત્રિગર્તક દેશમાં જઈને ગોકર્ણ નામનું સદાશિવનું ક્ષેત્ર કે  
જેમાં શિવનું સાંનિધ્ય છે ત્યાં ગયા.<sup>૧૯</sup> ત્યાંથી આય્દૈપાયનીનું દર્શન કરીને બળભદ્ર  
શૂર્પારક તીર્થમાં ગયા. તાપી, પયોષ્ણી અને નિર્વિન્ધ્યા નદીમાં સ્નાન કરી  
દંડકારણ્યમાં થઈને રેવાનદી કે જ્યાં માહિષતી નગરી છે ત્યાં ગયા. મનુતીર્થમાં  
સ્નાન કરીને પાછા પ્રભાસમાં આવ્યા.<sup>૨૦-૨૧</sup> ત્યાં બ્રાહ્મણોના કહેવાથી ક્રૌરવ  
પાંડવોના યુદ્ધમાં સર્વરાજાઓનો નાશ થયો સાંભળીને બળદેવ પૃથ્વીનો ભાર  
ઉત્તર્યો માન્યો.<sup>૨૨</sup> ભીમ અને દુર્યોધન રાણભૂમિમાં ગદાઓથી યુદ્ધ કરે છે, એમ  
સાંભળી તેઓને વારવા સારુ બળદેવ કુરુક્ષેત્રમાં ગયા.<sup>૨૩</sup> યુધિષ્ઠિર, નકુલ,  
સહદેવ, શ્રીકૃષ્ણ અને અર્જુન બળભદ્રને આવ્યા જોઈ અભિવાદન કરીને ‘બળભદ્ર  
અહીં આવીને શું બોલશે’ એવી બીકથી ચુપ થઈ ગયા.<sup>૨૪</sup> કોધ પામેલા જીતવાને  
ઈચ્છા અને ગદા હાથમાં લઈને વિચિત્ર મંડળોમાં ફરતા એ ભીમ તથા દુર્યોધનને  
બળભદ્ર આ પ્રમાણે કહ્યું.<sup>૨૫</sup>

બળભદ્ર કહે છે હે દુર્યોધન રાજા! હે ભીમસેન! તમે બતે સરખા બળવાળા  
વીરપુરુષ છો, તેઓમાં હું ધારું છું કે એકમાં બળ અધિક છે અને એકમાં શિક્ષા

तस्मादेकतरस्येह युवयोः समवीर्ययोः । न लक्ष्यते जयोऽन्यो वा विरमत्वफलो रणः ॥२७॥  
न तद्वाक्यं जगृहतुर्बद्धवैरौ नृपार्थवत् । अनुस्मरन्तावन्योन्यं दुरुक्तं दुष्कृतानि च ॥२८  
दिष्टं तदनुमन्वानो रामो द्वारवतीं ययौ । उग्रसेनादिभिः प्रतैर्ज्ञातिभिः समुपागतः ॥२९  
तं पुनर्नैषिं प्रासमृषयोऽयाजयन् मुदा । क्रत्वङ्गं क्रतुभिः सर्वैर्निवृत्ताखिलविग्रहम् ॥३०  
तेभ्यो विशुद्धविज्ञानं भगवान् व्यतरद् विभुः । येनैवात्मन्यदो विश्वमातानं विश्वं विदुः ३१  
स्वपत्न्यावभृथस्नातो ज्ञातिबन्धुसुहृदृतः । रेजे स्वज्योत्स्नयेवेन्दुः सुवासाः सुष्ठवलङ्घतः ॥३२  
ईद्विविधान्यसंख्यानि बलस्य बलशालिनः । अनन्तस्याप्रमेयस्य मायामर्त्यस्य सन्ति हि ॥३३  
योऽनुस्मरेत रामस्य कर्मण्यद्वृतकर्मणः । सायं प्रातरनन्तस्य विष्णोः स ददितो भवेत् ३४

इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्दे उत्तरार्थं  
बलदेवतीर्थ्यात्रानिरूपणं नामैकोनाशीतितमोऽध्यायः ॥७९॥

अधिक छे, माटे सरभा बणवाणा तमारा भन्नेमांथी कोईनो ज्य के कोईनो पराज्य  
थाय एम जोवामां आवतुं नथी, तेथी आ निष्फल युद्ध बंध थवुं जोईअे. २६-२७

शुकदेवज्ञ कुहे छे हे राजा ! एक बीजानां दुर्वयन अने दुष्ट कृत्यने संभारता  
अने जेओ वय्ये देढ वेर बंधाई गयुं हतुं, एवा ए भन्ने जाणाअे बणदेवज्ञानुं  
उत्तम वयन मान्युं नहीं. २८ पछी तेनुं जेवुं पारब्ध. एम मानी बणदेवज्ञ द्वारकामां  
आव्या अने त्यां प्रसन्न थयेला उग्रसेनादिक ज्ञातिज्ञानी साथे मण्या. २९ यज्ञमूर्ति  
अने जेमना स्वरूपमांथी सर्वे युद्धादि क्लेश निवृत ज हता एवा ए बलभद्र  
पाइ। नैभिषारण्यमां गया. त्यां ब्राह्मणो ए प्रीतिथी तेमने सर्वयज्ञोथी यज्ञ  
कराव्युं. ३० प्रभु बलभद्रे ते ऋषिओने शुद्ध शान आप्युं, के जे शानथी 'सर्वाधार  
परमात्माने विषे आ जगत रह्युं छे.' एवो निश्चय थाय. ३१ अवभृथ स्नान करीने  
ज्ञाति, बंधु अने भित्रोथी वीटाएला, सारां वस्त्र धरनार अने सारी रीते  
शाशगारेला बलभद्र यंद्रमा जेम पोतानी चांदनीथी शोभे, तेम पोतानी स्त्री  
रेवतीनी साथे शोभवा लाग्या. ३२ महा बणवान, अनंत, अप्रमेय अने मायाथी  
मनुष्यरूप थयेला बणदेवज्ञानां एवां एवां पराक्मो असंभ्यात छे. ३३ अनंत  
अने अहुत पराक्मो करनारा बणभद्रनां पराक्मोने जे पुरुष सांझे अने  
प्रातःकाणे संभारे ते विष्णुने प्रिय थाय छे. ३४

इति श्रीमद्भापुराणा भागवतना दशम स्कन्दनो अोगाणाशीभो अद्याय संपूर्णः.

अथ अशीतितमोऽध्यायः (८०)

॥ राजोवाच ॥

भगवन् यानि चान्यानि मुकुन्दस्य महात्मनः । वीर्याण्यनंतवीर्यस्य श्रोतुमिच्छामहे प्रभो १  
को नु श्रुत्वासकृद् ब्रह्मनुत्तमश्लोकसत्कथा । विरमेत विशेषज्ञो विषण्णः काममार्गणः २  
सा वाग् यथा तस्य गुणान् गृणीते करौ च तत्कर्मकरौ मनश्च ।  
स्मरेद् वसन्तं स्थिरजङ्गमेषु शृणोति तत्पुण्यकथाः स कर्णः ॥३॥  
शिरस्तु तस्योभयलिङ्गमानमेत् तदेव यत् पश्यति तद्विचक्षुः ।  
अङ्गानि विष्णोरथ तज्जनानां पादोदकं यानि भजन्ति नित्यम् ॥४॥

सूत उवाच

विष्णुरातेन सम्पृष्ठे भगवान् बादरायणिः । वासुदेवे भगवति निमग्नहृदयोऽब्रवीत् ॥५  
श्रीशुक उवाच

कृष्णस्यासीत् सखा कश्चिद् ब्राह्मणो ब्रह्मवित्तमः । विरक्त इन्द्रियार्थेषु प्रशान्तात्मा जितेन्द्रियः ६

अद्याय ८०

द्वारका पद्धारेला भाणभित्र सुदामाने हर्षवडे पूर्वनी कथा  
पूछता लगवान् श्रीकृष्णः.

परीक्षित राजा पूछे छे हे महाराज ! हे प्रभु ! अनंत पराक्मवाणा महात्मा  
श्रीकृष्णानां बीजां पराक्मोनुं पाश श्रवणे ईर्ष्याए छीअे. १ हे ब्राह्मण !  
ऐक्वार भगवाननी मनोहर कथा सांभणीने तेना सारने जाणनार, शब्दादिक  
विषयोने शोधवा वडे खेद पामेलो क्यो पुरुष ते कथाओथी विराम पामे ? २ जेथी  
भगवानना गुण गवाय, ते ज वाणी सक्षण छे; जेथी भगवाननी सेवा थाय ते  
ज हाथ सक्षण छे; जेथी स्थावर जंगमां रहेनार भगवाननुं स्मरण थाय ते ज  
मन सक्षण छे; जेथी भगवाननी पवित्र कथा संभणाय ते ज कान सक्षण छे; जेथी  
भगवाननी मूर्तिने प्रशाम थाय ते ज माथुं सक्षण छे; अने जेथी भगवानना अने  
भगवानना भक्तोनां चरणोदक्षुं निरंतर सेवन थाय ते ज अंग सक्षण छे. ३-४

सूत शौनकने कुहे छे आ प्रमाणे परीक्षित राजाए पूछतां जेमनुं हृदय  
भगवानमां मन थै गयुं, एवा शुकदेवज्ञ आ प्रमाणे बोल्या. ५

शुकदेवज्ञ कुहे छे श्रीकृष्णानो सभा कोई सुदामा ब्राह्मण हतो. ए ब्राह्मण  
मोटो ब्रह्मवेता, विषयोमां वैराग्यवाणो, शांत अंतःकरणवाणो, जितेन्द्रिय,  
यदृशाथी जे मणे तेथी निर्वाह यलावनार अने गृहस्थाश्रमी हतो. जूनां कपडां

યદૃચ્છયોપપત્રેન વર્તમાનો ગૃહાશ્રમી । તસ્� ભાર્યા કુચૈલસ્ય ક્ષુટ્ક્ષામા ચ તથાવિધા ॥૭  
પતિવ્રતા પર્તિ પ્રાહ મ્લાયતા વદનેન સા । દરિદ્રા સીદમાના સા વેપમાનાભિગમ્ય ચ ॥૮  
નનુ બ્રહ્મન ! ભગવતઃ સખા સાક્ષાચ્છ્વયઃ પતિઃ । બ્રહ્મણયશ્ચ શરણ્યશ્ચ ભગવાન્ સાત્વતર્ષભઃ ૯  
તમુપૈહિ મહાભાગ ! સાધૂનાં ચ પરાયણમ् । દાસ્તિ દ્રવિણં ભૂરિ સીદતે તે કુટુંબિને ॥૧૦  
આસ્તેઽથુના દ્વારવત્યાં ભોજવૃષ્યન્થકેશ્વરઃ । સ્મરતઃ પાદકમલમાત્માનમપિ યચ્છતિ ।

કિં ન્વર્થકામાન્ ભજતો નાત્યભીષ્ણાભ્જગદ્રૂરઃ ॥૧૧  
સ એવં ભાર્યા વિપ્રો બહુશઃ પ્રાર્થિતો મૃદુ । અયં હિ પરમો લાભ ઉત્તમશ્લોકદર્શનમ् ॥૧૨  
ઇતિ સચ્છિદ્ય મનસા ગમનાય માર્તિ દધે । અયસ્ત્યુપાયનં કિઞ્ચિદ્ ગૃહે કલ્પણિ દીયતામ ॥૧૩  
યાચિત્વા ચતુરો મુષ્ણીન્ વિપ્રાન્ પૃથુકતએદુલાન્ । ચૈલખણેન તાન્ બદ્ધા ભર્તે પ્રાદાદુપાયનમ्  
સ તાનાદાય વિપ્રાગ્રયઃ પ્રયયૌ દ્વારકાં કિલ । કૃષ્ણસંદર્શનં મહાં કથં સ્યાદિતિ ચિત્તયન ॥૧૫  
ત્રીણિ ગુલ્માન્યતીયાય તિસ્રાં કક્ષાશ્ર સ દ્વિજઃ । વિપ્રોઽગમ્યાન્ધકવૃષ્ણીનાં ગૃહેષ્વચ્યુતથર્મિણામ्

પહેરનાર એ સુદામા બ્રાહ્મણની સ્ત્રી પણ જૂનાં કપડાં પહેરનારી, ભૂખથી દુબળી  
અને પતિવ્રતા હતી. દરિદ્ર અને પીડા પામતી એ પતિવ્રતા સ્ત્રી કરમાયેલા મોઢે  
ધ્રૂજતી ધ્રૂજતી આવીને પતિ પાસે બોલી કે “હે મહારાજ ! બ્રાહ્મણોને માનનાર,  
શરણાગતાનું રક્ષણ કરનાર, યાદવોમાં ઉત્તમ અને સાક્ષાત્ લક્ષ્મીના પતિ શ્રીકૃષ્ણ  
ભગવાન તમારા સખા છે. ૧૫ માટે સાધુપુરુષોના મોટા શરણરૂપ એ શ્રીકૃષ્ણની  
પાસે જાઓ અને જશો તો જે તમે પીડાતા અને કુટુંબી ગૃહસ્થ છો તે તમને ધશું  
ધન આપશો. ૧૦ એ ભગવાન હમણાં દ્વારકામાં છે અને જે પોતાના ચરણકમળાનું  
સ્મરણ કરે તેને પોતાનું સ્વરૂપ પણ આપે છે. એ ભગવાન ઝોજ, વૃષ્ણિ અને  
અંધક કુળના અધિપતિ છે, એ તમને ધન આપશો. ૧૧ હમણાં ભગવાન જોકે પોતાને  
અર્થ અને વિષય ભોગ બહુ પ્યારા નથી, તોપણ તેઓને સેવે છે, માટે તમને પણ  
આપશો” આવી રીતે સ્ત્રીએ કોમળ રીતે ઘણી ઘણી વાર પ્રાર્થના કરતાં ભગવાનનું  
દર્શન થશે એજ મોટો લાભ છે, એમ મનમાં વિચારી ભગવાનની પાસે જવાનું  
તેમણે મન કર્યું. પછી એ સુદામા બ્રાહ્મણે સ્ત્રીને કહું કે “હે કુલ્યાણી ! ધરમાં કાંઈ  
ભેટ લઈ જવા જેવું છે ? હોય તો આપ.” ૧૨-૧૩ પછી તે બ્રાહ્મણીએ ચાર મૂઢી  
પૌંચા માગી આવીને તે પૌંચાને કપડાના કટકામાં બાંધી પોતાના સ્વામીને ભેટ  
સારુ આપ્યા. ૧૪ એ પૌંચા લઈ “મને ભગવાનનું દર્શન શી રીતે થાય ?” એમ  
વિચાર કરતો તે સુદામા બ્રાહ્મણ દ્વારકામાં ગયો. ૧૫ સ્વર્ધમ પાળનારા અને  
બીજા કોઈથી પાસે પણ ન જવાય એવા અંધક અને વૃષ્ણિ કુળના યાદવોનાં ધરોની

ગૃહં દ્વયષસહસ્રાણાં મહિષીણાં હોર્દ્વિજઃ । વિવેશૈકતમં શ્રીમદ્ બ્રહ્માનન્દં ગતો યથા ॥૧૭  
તં વિલોક્યાચ્યુતો દૂરાત્ પ્રિયાપર્યઙ્કમાસ્થિતઃ । સહસોત્થાય ચાભ્યેત્વ દોભ્ર્યા પર્યગ્રહીમુદા ॥૧૮  
સખ્યુઃ પ્રિયસ્ય વિપ્રેર્ણઙ્સઙ્ગાતિનિર્વત્તઃ । પ્રીતો વ્યમુદ્ધાદબ્બન્દૂન્ નેત્રાભ્યાં પુષ્કરેક્ષણઃ ॥૧૯  
અથોપવેશ્ય પર્યઙ્કે સ્વયં સખ્યુઃ સમર્હણમ् । ઉપહૃત્યાનિજ્યાસ્ય પાદૌ પાદાવનેજનીઃ ॥૨૦  
અગ્રહીચ્છ્રસા રાજન્ ભગવાંલોકપાવનઃ । વ્યાલિમ્પદ દિવ્યગાન્ધેન ચન્દનાગુરુકુઙ્કુમૈઃ ॥૨૧  
ધૂપૈઃ સુરભિમિર્મિત્રાં પ્રદીપાવલભિર્મુદા । અર્ચિત્વાઽવેદ્ય તામ્બૂલં ગાં ચ સ્વાગતમબ્રવીત ॥૨૨  
કુચૈલં મલિનં ક્ષામં દ્વિજિં ધમનિસંતતમ્ । દેવી પર્યચરત્ સાક્ષાચ્વામરવ્યજનેન વૈ ॥૨૩  
અન્તઃપુરજનો દૃષ્ટા કૃષ્ણોનામલકીર્તિના । વિસ્મિતોઽભૂદતિપ્રીત્યા અવધૂતં સભાજિતમ્ ॥૨૪  
કિમનેન કૃતં પુણ્યમબધૂતેન ભિક્ષુણા । શ્રીયા હીનેન લોકેઽસ્મિન્ ગહિતેનાધમેન ચ ॥૨૫  
યોઽસૌ ત્રિલોકગુરુણા શ્રીનિવાસેન સમ્ભૂતઃ । પર્યઙ્કસ્થાં શ્રીયં હિત્વા પરિષ્વકોઽગ્રજો યથા  
કથયાંક્રતુર્ગર્થાઃ પૂર્વા ગુરુકુલે સતોઃ । આત્મનો લલિતા રાજન્ ! કરો ગૃહ્ય પરસ્પરમ ॥૨૭

વચ્યે તે બ્રાહ્મણ ત્રણ સૈનિકોની ધાવણીઓ અને ત્રણ પેટીઓને ઉદ્દંધીને  
ભગવાનની સોળહજાર સ્ત્રીઓમાંથી એક સ્ત્રીના સુંદર ધરમાં ગયો, અને ત્યાં  
જઈને તેને બ્રહ્માનંદ જેવું સુખ મળ્યું. ૧૬-૧૭ પ્યારીના પલંગ પર બેઠેલા ભગવાને  
દૂરથી તે સુદામા બ્રાહ્મણને જોઈ, તરત ઊઠી સામા આવીને પ્રીતિથી બે હાથવતે  
તેનું આલિંગન કર્યું. ૧૮ પોતાના પ્રિયમિત્ર એ સુદામાના શરીરનો સ્પર્શ મળવાથી  
બહુ જ સુખ પામેલા ભગવાન પ્રીતિને લીધે નેત્રમાંથી આંસુ પાડવા લાગ્યા. ૧૯  
પછી તે મિત્ર બ્રાહ્મણને પલંગ પર બેસાડી, પૂજાનો સામાન પોતાના હાથથી લાવીને  
ભગવાને તેના પગ ધોયા, અને પોતે લોકપાવન છિતાં પણ એ પગ ધોયાનું જળ  
માથે ચઢાવ્યું. ચંદનાદિકથી બનાવેલ દિવ્ય ગંધ, અગર અને કુંકુમનું તેના શરીર  
પર લેપન કર્યું. ૨૦-૨૧ સુગંધી ધૂપ અને દીપમાળાથી પ્રીતિપૂર્વક તેનું પૂજન કરી,  
તાંબુલ તથા ગાયનું નિવેદન કરીને “ભલે આવ્યા” એમ કહ્યું. ૨૨ પછી એ સુદામાને  
ભગવાનની સ્ત્રી રૂક્ષિમણી ચામર લઈને પવન ઢોળવા લાગ્યા. ૨૩ નિર્મળ  
કીર્તિવાળા શ્રીકૃષ્ણો બહુ પ્રીતિથી તે સુદામા બ્રાહ્મણનો સત્કાર કરેલો જોઈ  
અંતઃપુરના લોકો વિસ્મય પામી ગયા. ૨૪ એ લોકોને વિસ્મય થયો કે નિર્ધન,  
અધમ, નિંદિત, લક્ષ્મી રહિત અને મેલા આ ભિખારીએ આ લોકમાં શું પુણ્ય કર્યું  
હશે ? કે જે પુણ્યના પ્રભાવથી, ત્રિલોકીના ગુરુ અને લક્ષ્મીના નિવાસરૂપ ભગવાને  
માન આપ્યું તથા પલંગ પર બેઠેલાં રૂક્ષિમણીને મૂકીને મોટા ભાઈનું જેમ આલિંગન  
કરે તેમ આલિંગન કર્યું. ૨૫-૨૬ હે રાજી ! પછી એ ભગવાન અને સુદામા બ્રાહ્મણ

શ્રીભગવાનુવાચ

अपि ब्रह्मन् ! गुरुकुलाद् भवता लब्धदक्षिणात् । समावृत्तेन धर्मज्ञ भार्योद्गा सदृशी न वा २८  
प्रायो गृहेषु ते चित्तमकामविहतं तथा । नैवातिप्रीयसे विद्वन् ! धनेषु विदितं हि मे ॥२९  
केचित् कुर्वन्ति कर्माणि कामैरहतचेतसः । त्यजन्तः प्रकृतीर्दैवीर्यथाहं लोकसंग्रहम् ॥३०  
कच्चिद् गुरुकुले वासाङ्ग! ब्रह्मन् ! स्मरसि नौ यथः । द्विजो विज्ञाय विज्ञेयं तमसः पारमश्नुते ३१  
स वै सत्कर्मणां साक्षाद् द्विजातेरिह सम्भवः । आद्योऽङ्गयत्राश्रमिणां यथाहं ज्ञानदो गुरुः ॥३२  
नन्वर्थकोविदा ब्रह्मन् वर्णाश्रमवतामिह । ये मया गुरुणा वाचा तरन्त्यज्जो भवार्णवम् ॥३३  
नाहमिज्याप्रजातिभ्यां तपसोपशमेन वा । तुष्येयं सर्वभूतात्मा गुरुशुश्रूषया यथा ॥३४  
अपि नः स्मर्यते ब्रह्मन् ! वृत्तं निवसतां गुरौ । गुरुदारैश्वोदितानामिन्धनानयने क्रचित् ॥३५  
એક भीज्ञाना हाथ पक्कीने आगणमां पोते गुरुने घेर रह्या हता ते संबंधी सुंदर  
वातो करवा लाभ्या ॥३६

भगवान् कહे छे हे महाराज ! हे धर्मने जाणनार ! तमे गुरु दक्षिणा आपी  
गुरुने घेरथी आवीने जोઈअे तेवी स्त्री परश्या छो के नहीं ? २८ हे विद्वन् ! त्यारे  
हुं धारुं छुं के धरमां धारुं करीने तमारुं चित्त विषयोमां लंपट नहीं थतुं होय अने  
तमने वस्त्रादिक धन उपर पाण रुचि नहीं होय ! विद्वानने आ प्रमाणे ज राखवुं  
घटे छे ॥२९ ईश्वरनी मायाथी रथाएल विषय वासनाओनो त्याग करता केटलाएक  
पुरुषो मारी पेठे लोकमर्यादा सारु कामनाओथी चित्त नहीं खेचाया छतां पाण  
कर्म करे छे ॥३० हे महाराज ! आपाणे गुरुने घेर साथे रह्या हता ए वातनुं तमने  
स्मरण छे ? के ज्यां रहेवाथी आत्मानुं तत्त्व जाणीने द्विजलोको संसारनो पार  
पामे छे ॥३१ जेथी जन्म भयो छे ते पिता आलोकमां पहेलो गुरु छे, द्विजलोकोने  
उपनयन संस्कार आपीने जे वेद भषावे छे ते बीजो गुरु छे, अने  
आश्रमवाणाओने जे भ्रष्टविद्या आपे छे ते त्रीजो गुरु छे. आ त्रष्ण गुरुओमां  
पहेलो पूज्य छे, बीजो पूज्यतर छे अने त्रीजो तो साक्षात् मारी पेठे पूज्यतम  
छे ॥३२ हे भ्रातृष्ण ! आ मनुष्य जन्ममां वर्णाश्रमवाणा जे पुरुषो ज्ञान आपनार  
गुरु के जे मारुं रूप छे, तेना उपदेश मात्रथी अनायासे संसाररुपी समुद्रने तरे  
छे तेओने पोतानो अर्थ साधवामां यतुर समज्वा ॥३३ सर्वे पदर्थोनो आत्मा हुं  
गुरु सेवाथी जेवो प्रसन्न थाउं छुं तेवो यश, भ्रष्टवर्य, वानप्रस्थना धर्म के  
संन्यासीना धर्मथी प्रसन्न थतो नथी ॥३४ हे भ्रातृष्ण ! आ प्रमाणे गुरुने घेर रहेता  
ते समयमां गुरुनी स्त्रीअे आपाणे एक दिवस लाकडां लेवा मोक्षतां देवगतिथी

प्रविष्टानां महारण्यमपतौ सुमहद् द्विज ! । वातवर्षमभूत् तीव्रं निष्ठाः स्तनयित्रवः ॥३६  
सूर्यश्वासं गतस्तावत् तमसा चावृता दिशः । निन्मं कूलं जलमयं न प्राज्ञायत किञ्चन ॥३७  
वयं भृशं तत्र महानिलाम्बुधिनिहन्यमाना मुहुरम्बुसम्पलवे ।

दिशोऽविदन्तोऽथ परस्परं वने गृहीतहस्ताः परिबध्निमातुरा: ॥३८॥

एतद् विदित्वा उदिते रवौ सान्दीपनिर्गुः । अन्वेषमाणो नः शिष्यानाचार्योऽपश्यदातुरान् ॥३९  
अहो हे पुत्रका यूयमस्मदर्थेऽतिदुःखिताः । आत्मा वै प्राणिनां प्रेष्टस्तमनादृत्य मत्पराः ॥४०  
एतदेव हि सच्छिष्ठैः कर्तव्यं गुरुनिष्कृतम् । यद् वै विशुद्धभावेन सर्वार्थात्मापर्णं गुरौ ॥४१  
तुष्टेऽहं भो द्विजश्रेष्ठः सत्याः सन्तु मनोरथाः । छन्दांस्ययातयामानि भवन्तिव्व परत्र च ॥४२  
इत्थर्याविधान्यनेकानि वसतां गुरुवेशमसु । गुरोरनुग्रहेणैव पुमान् पूर्णः प्रशान्तये ॥४३

ब्राह्मण उवाच

किमस्माभिरनिर्वृत्तं देवदेव जगद्गुरो । भवता सत्यकामेन येषां वासो गुरावभूत् ॥४४

जे कांઈ थयुं हतुं ते तमने सांभरे छे ? ३५ लाकडां लेवा सारु आपाणे मोटा वनमां  
पेठा हता, त्यां ऋतु विना पश अतितीव्र वायु अने वरसाद थया हता तथा कठोर  
गर्जना थवा लागी हती. ३६ थोडीवारमां सूर्य आथभी गयो, अंधारांथी दिशाओ  
घेराई गई अने सर्व जग्मय थई जवाथी, नीयुं के ऊयुं स्थण कांઈ पाण जाणवामां  
आवतुं न हतुं. ३७ जग्मय थई गयेला ते वनमां भारे पवन अने पाणीथी वारंवार  
पीडा पामता, दिशाओने नहीं जाणता अने आतुर थयेला आपाणे एक भीज्ञाना  
हाथ पक्कीने लाकडांनी भारीओ उपाडी रह्या हता. ३८ आ वात जाणी सूर्योदय  
थया पढी सांदीपनि गुरु आपाणने शोधता शोधता आव्या, तेमाणे आतुर थयेला  
विद्यार्थीऐवा आपाणने दीठा. अने तेमाणे कहुं के “अहो ! हे दीकराओ ! आ देह  
के जे प्राणीओने बहु ज ख्यारो छे. तेनो अनादर करी मारी सेवा करनारा तमे  
मारे माटे बहु ज दुःखी थया. ३९-४० जे देहथी सर्वपुरुषार्थ प्राप्त थाय छे, ते देहने  
सद्भावथी गुरुने अर्पण करवो एटलो ज सारा शिष्यो अे गुरुनो प्रत्युपकार  
करवानो छे. ४१ “हे उत्तम द्विजो ! हुं तमारी उपर प्रसन्न थयो छुं. आलोक अने  
परलोकमां तमारा मनोरथ सझण थजो अने मारी पासेथी शीघ्रेला वेद सार  
भरेला थजो.” ४२ आपाणे गुरुने घेर रहेता हता त्यां आवा प्रकारनां धणां वृतांत  
थयां हतां ते तमने याद छे ? गुरुना अनुग्रहथी ज पुरुष शांतिने परिपूर्ण रीते  
पामे छे. ४३

ब्रातृष्ण कहे छे हे देवना देव ! हे जगतना गुरु ! अमे के जेओने

यस्यच्छंदोमयं ब्रह्म देह आवपनं विभो । श्रेयसां तस्य गुरुषु वासोऽत्यंतविडंबनम् ॥४५  
इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे उत्तरार्थं  
श्रीदामचरितेऽशीतितमोऽध्यायः ॥८०॥

## अथ एकाशीतितमोऽध्यायः (८१)

॥ श्रीशुक उवाच ॥

स इत्थं द्विजमुख्येन सह संकथयन् हरिः । सर्वभूतमनोऽभिज्ञः स्मयमान उवाच तम् ॥१  
ब्रह्मण्यो ब्राह्मणं कृष्णो भगवान् प्रहसन् प्रियम् । प्रेम्णा निरीक्षणेनैव प्रेक्षन् खलु सतां गतिः ॥  
श्रीभगवानुवाच

किमुपायनमानीतं ब्रह्मन् मे भवता गृहत् । अप्णवप्युपाहृतं भक्तैः प्रेम्णा भूर्येव मे भवेत् ।  
भूर्यप्यभक्तोपहृतं न मे तोषय कल्पते ॥३

पत्रं पृष्ठं फलं तोयं यो मे भक्त्या प्रयच्छति । तदहं भक्त्युपहृतमश्नामि प्रयतात्मनः ॥४  
इत्युक्तोऽपि द्विजस्तस्मै ग्रीडितः पतये श्रियः । पृथुकप्रसृतिं राजन् न प्रायच्छदवाङ्मुखः ॥५

सत्यसंकल्पवाणा आपनी साथे गुरुने घेर रहेवानुं थयुं हतुं तेओने शुं अपूर्णं  
होय? ॥६ हे विभु! कल्याणोनी उत्पत्तिनुं स्थानक वेदरूप ब्रह्म जेनी भूर्तिरूप छे,  
ते आप गुरुने घेर रह्या हता एतो अत्यंत मनुष्यलीलाना अनुकरण मात्र छे ॥७  
इति श्रीमद् महापुराणा भागवतना दशम स्कन्धनो रौशीमो अध्याय संपूर्ण ॥

## अध्याय ८१

श्रीकृष्ण भगवाने सुदामाना पौंवा जमीने इन्द्रथी अधिक  
राजसक्षमी आपी ।

शुक्टेवज्ञ कुहे छे आ प्रमाणे ते उत्तम सुदामा ब्राह्मणी साथे वातो करता  
श्रीकृष्ण भगवान के जे सर्वप्राणीओना मनने जाणता हता छतां पश तेमाणे  
उसतां हसतां तेने कहुं.<sup>१</sup> हांसी करता प्रेम भरेली दृष्टिथी जेता, सत्पुरुषोना  
शरणरूप अने ब्राह्मणने माननार भगवाने कहुं. हे ब्राह्मण! तमे मारे माटे  
तमारे घेरथी शी भेट लाव्या छो? भक्तो प्रेमथी थोंदुं लाव्या होय तोपश तेने हुं  
घाशुं मानुं छुं, अने अभक्तो घाशुं लावे तोपश तेथी हुं प्रसन्न थतो नथी.<sup>२-३</sup>  
शांतभुद्धिवाणो पुरुष भक्तिपूर्वक मने पांडाण, झूल, झण के पाणी आपे तो ते  
भक्तिथी लावेलुं होवाने लीधे हुं स्वीकारुं छुं.<sup>४</sup>

सर्वभूतात्मदृक् साक्षात् तस्यागमनकारणम् । विज्ञायाचिन्तयन्नायं श्रीकामो माभजत् पुरा  
पत्न्या: पतिव्रतायास्तु सखा प्रियचिकीर्षया । प्रासो मामस्य दास्यामि सम्पदेऽमर्त्यदुर्लभाः ७  
इत्थं विचिन्त्य वसनाच्चीरबद्धान् द्विजन्मनः । स्वयं जहार किमिदमिति पृथुकतण्डुलान् ॥८  
नन्वेतदुपनीतं मे परमप्रीणनं सखे । तर्पयन्त्यङ्गः ! मां विश्वमेते पृथुकतण्डुलाः ॥९  
इति मुष्टि सकृज्जग्धा द्वितीयां जग्धुमाददे । तावच्छ्रीर्जग्हे हस्तं तत्परा परमेष्ठिः ॥१०  
एतावतालं विश्वात्मन् सर्वसम्पत्सम्बद्धये । अस्मिन्लोकेऽथवामुष्मिन् पुंसस्वत्तोषकारणम् ॥११  
ब्राह्मणस्तां तु रजनीमुषित्वाच्युतमन्दिरे । भुक्त्वा पीत्वा सुखं मेने आत्मानं स्वर्गं यथा ॥१२  
श्वोभूते विश्वभावेन स्वसुखेनाभिवन्दितः । जगाम स्वालयं तात पथ्यनुव्रज्य नन्दितः ॥१३  
स चालब्धा धनं कृष्णान्नं तु याचितवान् स्वयम् । स्वगृहान् ग्रीडितोऽगच्छमहर्षशनिर्वृतः ॥१४  
अहो ब्रह्मण्यदेवस्य दृष्टा ब्रह्मण्यता मया । यद् दरिद्रतमो लक्ष्मीमाशिलष्टे विभ्रतोरसि ॥१५

शुक्टेवज्ञ कुहे छे हे राजा! आ प्रमाणे भगवाने कहुं तोपश लज्जाईने  
नीयुं मोहुं करी बेठेला ते श्रीदामा ब्राह्मणे, लाजने लीधे लक्ष्मीना पति भगवानने  
पौंवा आप्या नहीं.<sup>५</sup> सर्वप्राणीओना अंतःकरणना साक्षी भगवाने तेना आववानुं  
करण जाणीने विचार कर्यो के “आ मारो सभा श्रीदामा ब्राह्मण पूर्वे लक्ष्मीनी  
ईच्छाथी मने भज्यो नथी, पश उमणां पोतानी पतिव्रता स्त्रीने राज्ञ करवा  
सारु मारी पासे आव्यो छे, माटे देवताओने पश न मणे ऐवी संपत्तिओ हुं  
आने आपीश.”<sup>६-७</sup> आ प्रमाणे विचार करी ते श्रीदामा ब्राह्मण पासेथी यींथरामां  
बांधेला पौंवाने “आ शुं छे?” ऐम कहीने भगवाने पोताना हाथथी तेना  
वस्तु लाव्या छो. जे हुं जगतनो आत्मा छुं. ते मने आ पौंवा अति प्रसन्नता  
उत्पत्त करनार छे.<sup>८-९</sup> ऐम बोलीने एक मूढी खाधा, पछी पौंवानी भीज्ञ मूढी  
लीधी तेटलामां लक्ष्मी, के जे भगवाननी पासे ज रहेनार छे तेमाणे भगवाननो  
हाथ पकडीने कहुं के “हे जगतना आत्मा! बस बस मनुष्यने आलोकमां तथा  
परलोकमां समग्र संपत्तिओनी समुद्धि आपवा माटे एक मूढी पौंवा पर्याम छे.  
करण के तमारे माटे एक मूढी पौंवा पश प्रसन्नतानुं करण बनी जाय छे. (हवे  
भीज्ञ मूढी खाधी तेने पश एना स्वाधीनमां नहीं आपवी ज्ञेईऐ.)<sup>१०-११</sup> पछी  
ऐ ब्राह्मण भगवानना घरमां ते रात्री रही, खाई पीने पोते जाणे स्वर्गमां आव्यो  
होय तेवुं सुख मानवा लाग्यो.<sup>१२</sup> सूर्योदय थतां जगतना रक्षक अने स्वरूपानंदथी  
पूर्ण भगवाने प्रश्नाम करी, मार्गमां वणावा जृद्धने, विनयना वयनोथी राज्ञ

ब्रह्मं दरिद्रः पापीयान् क्रकृष्णः श्रीनिकेतनः । ब्रह्मबन्धुरिति स्माहं बाहुभ्यां परिरम्भितः ॥१६  
निवासितः प्रियाजुषे पर्यङ्गे भ्रातरो यथा । महिष्या वीजितः श्रान्तो वालव्यजनहस्तया ॥१७  
शुश्रूषया परमया पादसंवाहनादिभिः । पूजितो देवदेवेन विप्रदेवेन देववत् ॥१८  
स्वर्गापवर्गयोः पुंसां रसायां भुवि सम्पदाम् । सर्वासामपि सिद्धीनां मूलं तच्चरणार्चनम् ॥१९  
अधनोऽयं धनं प्राप्य माद्यनुच्छैर्न मां स्मरेत् । इति कारुणिको नूनं धनं मेऽभूरि नाददात् ॥२०  
इति तच्चिन्तयन्नतः प्राप्तो निजगृहान्तिकम् । सूर्यानलेन्दुसंकाशैर्विमानैः सर्वतो वृतम् ॥२१  
विचित्रोपवनोद्यानैः कूमद्विजकुलाकुलैः । प्रोत्कुल्कुमुदाम्भोजकह्नारोत्पलवारिभिः ॥२२  
जुष्टेस्वलङ्घते पुम्भः स्त्रीभिश्च हरिणाक्षिभिः । किमिदं कस्य वा स्थानं कथं तदिदमित्यभूत् ॥२३  
एवं मीमांसमानं तं नरा नार्योऽमरप्रभाः । प्रत्यगृह्णन् महाभागं गीतवाद्येन भूयसा ॥२४

करेलो श्रीदामा ब्राह्मणं पोताने धेर गयो ।<sup>४</sup> ए ब्राह्मणे श्रीकृष्णं पासेशी द्रव्यं  
मण्युं नहि । तथापि तेषो स्वतः मायुं नहीं अने धेर जतां मार्गमां विचार करवा  
लायो के “अहो ! ब्रह्मण्यदेव भगवाननी ब्राह्मणं भक्ति आज मारा ज्ञोवामां  
आवी !!! वक्षः स्थणमां लक्ष्मीने धरनारा भगवाने, हुं के जे भग्नादरिद्र छुं, तेनुं  
पण आलिंगन कर्यु ॥५-६॥ दरिद्र अने नीच हुं क्यां ? मने केवण ब्राह्मणं जातनो  
जाणीने भगवाने पोताना बे हाथथी मारुं आलिंगन कर्यु, स्त्रीने बेसवाना पलंगं  
पर जेम भाईओने बेसाडे तेम बेसाडयो, थाक उतारवा सारु भगवाननी राणीअे  
हाथमां यमर लઈने पवन नार्यो अने देवना तथा ब्राह्मणोना देव भगवाने  
मोटी सेवाथी तथा पण्यंपी करवा आठिथी देवनी पेठे मारी पूजा करी ॥७-८॥ जो  
के ते भगवानना चरणानुं पूजन पुरुषोने स्वर्गानुं, मोक्षानुं, पाताण तथा पृथ्वीनी  
संपत्तिओनुं अने सर्वे सिद्धिओनुं पण कारण छे, तोपण ‘आ निर्धन ब्राह्मणे  
धन मणशे तो बहुज मदोऽन्मत थई जईने मारुं स्मरण नहीं करे’ ऐवी करुणाथी  
भगवाने मने थोडुं पण धन आप्युं नहीं” ॥९-१०॥ एम मनमां विचार करतो करतो  
पोताना धरनी पासे आयो, त्यां ते धर सूर्य, अग्नि अने चंद्रमा सरभा सात  
सात माणना महेलोथी चारेकोर वींटाअेलुं ज्ञोवामां आव्यु ॥१॥ विचित्रं भगीया  
अने वारीओमां पक्षीओनां टोणां भारे शब्द करी रह्यां हतां । जलाशयोमां कुमुदं,  
अंभोजं, कल्हार अने उत्पलं प्रकृत्वित थई रह्यां हतां ॥२॥ शशगारेला पुरुषो  
अने मृगसरभां नेत्रवाणी स्त्रीओ अहीं तहीं हर फर करी रही हती । “आ शुं ?  
आ स्थानक कोनुं ? आ आवुं केम थई गयुं ?” एम ते सुदामा ब्राह्मणं विचार  
करतो हतो, त्यां देव सरभी कांतिवाणा पुरुषो अने स्त्रीओ भारे गायन अने

पतिमागतमाकर्ण्य पल्युद्धर्षातिसम्भ्रमा । निश्चक्राम गृहात्तूर्ण रूपिणी श्रीरिवालयात् ॥२५  
पतिव्रता पर्ति दृष्ट्वा प्रेमोत्कण्ठाश्रुलोचना । मीलिताक्ष्यनमद् बुद्ध्या मनसा परिषस्वजे ॥२६  
पत्नी वीक्ष्य विस्फुरन्ती देवीं वैमानिकीमिव । दासीनां निष्ककण्ठीनां मध्ये भान्तीं स विस्मितः ॥  
प्रीतः स्वयं तया युक्तः प्रविष्टे निजमन्दिरम् । मणिस्तम्भशतोपेतं महेन्द्रभवनं यथा ॥२८  
पयः फेननिभा: शश्या दान्ता रुक्मपरिच्छदा: । पर्यङ्गा हेमदण्डानि चामरव्यजनानि च ॥२९  
आसनानि च हैमानि मूदूपस्तरणानि च । मुक्तादामविलम्बीनि वितानानि द्युमन्ति च ॥३०  
स्वच्छस्फटिकुड्येषु महामारकेषु च । रत्नदीपा भ्राजमाना ललनारलसंयुताः ॥३१  
विलोक्य ब्राह्मणस्त्र समृद्धीः सर्वसम्पदाम् । तर्क्यामास निर्वगः स्वसमृद्धिमहेतुकीम् ॥३२  
नूनं बतैत्नमम दुर्भगस्य शश्वरिद्रस्य समृद्धिहेतुः ।

महाविभूतेरवलोकतोऽन्यो नैवोपपद्येत यदूत्तमस्य ॥३३॥  
नन्वब्रुवाणो दिशते समक्षं याचिष्णवे भूर्योपि भूरिभोजः ।  
पर्जन्यवत्तत् स्वयमीक्षमाणो दाशार्हकाणामृषभः सखा मे ॥३४॥

वाजांओनी धामधूमथी तेने मान आपवा आव्या ॥३-४॥ पतिने आवेला ज्ञाणी  
बहु ज आनन्द पामेली, भारे आदरवाणी तथा लक्ष्मी जेवी रूपाणी तेनी स्त्री  
धरमांथी तरत भहार आवी ॥५॥ पतिने ज्ञेई प्रेम अने उत्कंठाने लीघे जेनी  
आंभोमां आंसु आवी गयां हतां, ऐवी ते पतिव्रता आंभो भींचीने दृढ भावथी  
तेने पगे लाणी अने मनथी आलिंगन कर्यु ॥६॥ विमानमां बेसनारी देवांगनानी  
पेठे यणकती अने कंठभूषणथी शशगारेली दासीओना भध्यमां दीपी रहेली  
पोतानी स्त्रीने ज्ञेईने ते ब्राह्मणं विस्मय पाम्यो ॥७॥ राणु थई तेनी साथे पोते  
पोताना धरमां गयो । ए धरमां ईंद्रना धरनी पेठे मणिना सेंकडो स्तंभ लाणी  
रह्या हता ॥८॥ दूधना ईशा जेवी शश्याओ हती, पलंग हाथी दांतना अने सोनाना  
सामानवाणा हता, चामर अने वींजणा सोनानी दांडीवाणा हता ॥९॥ आसनो  
सोनानां अने कूणां कूणां पाथरणांवाणां हतां । चंद्रवा मोतीनी माणाना  
लटकणियांवाणा अने भारे दीमिवाणा हता ॥१०॥ स्वर्ण स्फटिकमणिनी भींतोमां  
अने मोटा मरक्तमणिना स्थणोमां रत्नना दीवा शोभी रह्या हता अने रत्न  
जेवी स्त्रीओ आलेखेली हती ॥११॥ ए धरमां कारण वगर प्राप्त थयेली सर्वे  
संपत्तिओनी समृद्धि ज्ञेईने ए ब्राह्मणं स्थिर थई विचार करवा लायो के “आ  
समृद्धि क्यांथी आवी ?” ॥१२॥ अहो ! जे हुं दुर्भाग्य अने दरिद्र हतो ते मने आवी  
समृद्धि मणवानुं कारण, मोटी लक्ष्मीवाणा भगवाननी कृपा दृष्टि विना बीजुं

किञ्चित्करोत्युर्पि यत् स्वदत्तं सुहृक्तं फलन्वपि भूरिकारी ।  
मयोपनीतं पृथुकैकमुष्टि प्रत्यग्हीत् प्रीतियुतो महात्मा ॥३५॥  
तस्यैव मे सौहृदसख्यमैत्री दास्यं पुर्जन्मनि जन्मनि स्यात् ।  
महानुभावेन गुणालयेन विषज्जतस्तत्पुरुषप्रसङ्गः ॥३६॥  
भक्ताय चित्रा भगवान् हि सम्पदो राज्यं विभूतीन् समर्थ्यत्यजः ।  
अदीर्घबोधाय विचक्षणः स्वयं पश्यन् निपातं धनिनां मदोद्भवम् ॥३७॥  
इत्थं व्यवसितो बुद्ध्या भक्तोऽतीव जनादिने । विषयाज्ञायया त्यक्ष्यन् बुभुजे नातिलम्पटः ३८  
तस्य वै देवदेवस्य हरेर्जपते: प्रभोः । ब्राह्मणः प्रभवो दैवं न तेभ्यो विद्यते परम् ॥३९  
एवं संप्रियो भगवत्सुहृत्वा दृष्ट्वा स्वभृत्यैरजितं पराजितम् ।  
तद्व्यानवेगोद्ग्रथितात्मबन्धनस्तद्वाम लेभेऽचिरतः सतां गतिम् ॥४०॥

कांड संभवतुं नथी.<sup>३३</sup> जेम समुद्रने पूरनार महाउद्धार भेद्य कोई समये धणी  
वृष्टिने पश्च थोडी मानीने जाणे लज्जातो होय तेम समक्ष नहीं वरसतां रातनो  
भेडूत सूर्य गयो होय, त्यां तेना खेतरने जणथी भरी आपे छे, तेम मारा सभा  
श्रीकृष्ण पश्च भक्तने देवाना ईंद्रादिक पटने पश्च तुर्थ मानीने अने तेणे करेला  
भजने धणुं मानीने समक्ष नहिं बोलतां ज आपी हे छे ! ! !<sup>३४</sup> भगवान् पोते  
धणुं आप्युं होय तेने पश्च थोडुं माने छे अने भक्ते थोडुं कर्युं होय तेने पश्च धणुं  
माने छे. जुओ तो खरा !!! मारी पासे रहेली पौंवानी एक मूठीने पश्च महात्मा  
भगवाने प्रीतिथी पोते लह लीधी.<sup>३५</sup> मने प्रत्येक जन्ममां तेमना संबंधमां ज  
प्रेम, हितेश्चुपणुं, उपकार करनारपणुं अने सेवकपणुं प्राप्त थजो; अने मोटा  
प्रभाववाणा तथा गुणोना स्थानकरुप ते भगवाननी साथे प्रेम धरावनारा तेमना  
भक्तोनो उत्तम प्रसंग मणजो, पश्च संपत्ति मणशो नहीं.<sup>३६</sup> धनवाणाओने धनना  
मदथी थता नीच अवतारने जोता विचक्षण भगवान् पोताना अविवेकी भक्तने  
पश्च विचित्र संपत्ति, राज्य के विभूतियो आपता नथी, पश्च दृढ भक्ति ज आपे  
छे. मने तो भक्ति नहीं होवाथी आ संपत्तिनुं ज सुख मण्युं, माटे हवे तो तेमनी  
भक्तिने ज मागुं छुं.”<sup>३७</sup> आ प्रमाणे बुद्धिथी निश्चय करी, भगवाननो एकांतिक  
भक्त ऐ सुदामा ब्राह्मण विषयोनो त्याग करवानो धीरे धीरे अभ्यास करतां,  
बहु आसक्तिथी रहित थईने स्त्रीनी साथे विषयोने भोगववा लाग्यो.<sup>३८</sup> देवना  
देव अने यशोना पति ऐ श्रीकृष्णने ब्राह्मणो ज ईर्ष्टदेव छे. ब्राह्मणोथी वधारे  
बीजुं कांड पश्च मान्य नथी.<sup>३९</sup> आ प्रमाणे भगवाननो मित्र ऐ श्रीदामा ब्राह्मण

एतद् ब्रह्मण्यदेवस्य श्रुत्वा ब्रह्मण्यतां नरः । लब्धभावो भगवति कर्मबंधाद्विमुच्यते ॥४१  
इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्दे उत्तरार्थं  
पृथुकोपाख्यानं नामैकाशीतितमोऽध्यायः ॥४१॥

## अथ द्व्यशीतितमोऽध्यायः (४२)

॥ श्रीशुक उवाच ॥

अथैकदा द्वारवत्यां वसतो रामकृष्णायोः । सूर्योपरागः सुमहानासीत् कल्पक्षये यथा ॥१  
तं ज्ञात्वा मनुजा राजन् ! पुरस्तादेव सर्वतः । स्यमन्तपञ्चकं क्षेत्रं ययुः श्रेयोविधितस्या ॥२  
निःक्षत्रियां महीं कुर्वन् रामः शस्त्रभृतां वरः । नृपाणां रुदिराद्येण यत्र चक्रे महाहृदान् ॥३  
ईजे च भगवान् रामो यत्रास्पृष्टेऽपि कर्मणा । लोकस्य ग्राह्यनीशो यथान्योऽध्यापनुत्ये ४  
महत्यां तीर्थयात्रायां तत्रागन् भारतीः प्रजाः । वृष्णयश्च तथाकूरवसुदेवाहुकादयः ॥५  
ते समयमां अजित भगवानने पश्च भक्तोनी पासे पराजय पामता जोई, तेमना  
ध्यानना वेगथी देहाभिमान धूटी जतां थोडाकाणमां सत्पुरुषोनी गतिरुप तेमना  
धामने पामी गयो.<sup>४०</sup> ब्राह्मणने देवनी पेठे माननारा भगवान् श्रीकृष्णनी आ  
ब्रह्माण्यपणानी कथा सांभणवाथी माणस भगवाननी भक्ति पामीने कर्मना  
बंधनमांथी धूटे छे.<sup>४१</sup>

इति श्रीमद् महापुराणा भागवतना दशम स्कन्दनो एकाशीमो अद्याय संपूर्णः.

## अद्याय ४२

सूर्यग्रहणं प्रसंगे कुरुक्षेत्रमां नंद यशोदा अने गोपीओने आपेलुं  
भणवानुं वयन सत्य करता श्रीकृष्ण भगवान्.

शुकदेवज्ञु कहे छे श्रीकृष्ण अने बणभद्र द्वारकामां रहेता हता. त्यां एक  
दिवसे जेवुं प्रलयकाणमां थाय छे, तेवुं मोडुं सूर्यग्रहणं थयुं हतुं.<sup>१</sup> हे राजा !  
जोधीओना कहेवाथी सूर्यग्रहणं थवानुं जाणीने पुण्य करवानी ईच्छाथी सर्वदेशना  
माणसो प्रथमथी ज कुरुक्षेत्रमां गयां हतां, ज्यां उत्तम परशुरामे पृथ्वीने निःक्षत्रिय  
करतां राजाओना लोहीना ओधथी मोटा धरा कर्या हता, अने ज्यां भगवान्  
परशुरामे पोताने पापनो स्पर्श नहीं छतांपश्च लोकोने धर्मनी भर्यादा शीघ्रववा  
सारु बीजा प्राकृत मनुष्यनी पेठे पाप मटाइवा सारु यशो कर्या हता.<sup>२-४</sup> ऐ मोटी  
तीर्थयात्रा करवा सारु भरतभंडनी प्रजा, अकूर, वसुदेव, उग्रसेन, गद, प्रद्युम्न

ययुर्भारत तत् क्षेत्रं स्वामयं क्षपयिष्यावः । गदप्रद्युम्नसाम्बाद्याः सुचन्द्रशुकसाराणैः ॥६  
आस्तेऽनिरुद्धो रक्षायां कृतवर्मा च यूथपः । ते रथैर्देवधिष्ययार्भैर्यैश्च तरलप्लवैः ॥७  
गर्जैर्नदद्विभ्रार्भैर्भिविद्याधरद्युभिः । व्यरोचन्त महातेजाः पथि काञ्छनमालिनः ॥८  
दिव्यस्वगवस्त्रसन्नाहाः कलत्रैः खेचरा इव । तत्र स्नात्वा महाभागा उपोष्य सुसमाहिताः ॥९  
ब्राह्मणेभ्यो ददुर्धेनूवर्साः सवगुक्ममालिनीः । रामहृषे विधिवत् पुनराप्लुत्य वृष्णयः ॥१०  
ददुः स्वन्नं द्विजाग्रयेभ्यः कृष्णो नो भक्तिरस्त्विति । स्वयं च तदनुज्ञाता वृष्णयः कृष्णदेवताः  
भुक्त्वोपविविशः कामं स्त्रिघच्छ्रायाद्विग्रापाद्विग्रुषु । तत्रागतांसे ददृशुः सुहृत्सम्बिधिनो नृपान् ॥१२  
मत्स्योशीनरकौसल्यविदर्भकुरुसृज्जयन् । काम्बोजकैकयान् मद्रान् कुर्तीनान्तकिरलान् ॥१३  
अन्यांश्चैवात्मपक्षीयान् परांश्च शतशो नृप ! । नन्दादीन् सुहृदो गोपान् गोपीश्चोत्कण्ठिताश्चिरम् ॥१४

अन्योन्यसन्दर्शनहर्षरंहसा प्रोत्फुल्लद्वक्त्रसरोरुहश्चियः ।

आशिलष्य गाढं नयनैः स्ववज्जला हृष्टत्वचो रुद्धगिरो ययुर्मुदम् ॥१५॥

तथा सांब आदि यादवो पश पोताना पापनो नाश करवा सारु ते क्षेत्रमां आव्या  
हता । अनिरुद्ध अने सेनापति कृतवर्मा, एवे यादवो सुयंद्र, शुक अने साराणी  
साथे द्वारकानी रक्षा करवा सारु रह्या हता ॥५६ ते यादवो विमान सरभा रथ,  
तरंगनी पेढे चालनारा धोडा, नाद करता वादणां जेवा हाथीओ अने विद्याधर  
सरभी कांतिवाणा भनुष्योनी साथे तेओ कुरुक्षेत्रमां गया हता ॥५७ मोटा तेजवाणा,  
सुवर्णानी माणा पहेरनारा अने माणा, वस्त्र तथा कवचो जेओनां दिव्य हतां,  
एवा ते लोको स्त्रीनी साथे देवताओनी पेढे मार्गमां शोभता हता ॥५८ ए भाग्यशाणी  
लोको ए सावधान अंतः करण्याथी कुरुक्षेत्रमां स्नान करीने ब्राह्मणने वस्त्र, झूलनी  
तथा सुवर्णानी माणावाणी गाययोनां दान दीधां ॥५९ पछी यादवो ए परशुरामना  
धरामां विधि सहित भोक्षस्नान करीने ‘अमने भगवानमां भक्तिं थजो’ एवो  
संकल्प करी, उत्तम ब्राह्मणोने उत्तम प्रकारनां दान दीधां ॥६० श्रीकृष्णने ज ईष्टदेव  
माननारा यादवो पोते पश ब्राह्मणोनी आशा लई, जमीने शीतण छायावाणां  
वृक्षोना भूषणमां ईच्छा प्रमाणे बेठा ॥६१ त्यां आवेला मत्स्य, उशीनर, क्षेसल्य,  
विदर्भ, कुरु अने सृंजय वंशना पोताना भित्र अने संबंधी राजाओने यादवो ए  
दीठा ॥६२ कंबोज, केक्य, मद्र, कुंती, आनंद अने केरल देशना राजाओ. बीजा  
पश पोताना पक्षना तथा पर पक्षना सेंकडो लोको अने ए सिवाय स्नेही नंदादि  
गोवाणो अने घणा काणनी उत्कंठावाणी गोपीओ पश जेवामां आवी ॥६३  
परस्परनां दर्शनथी शयेला हर्षना वेगथी प्रकृत्वित थयेला हृदय तथा मुखकमणी

स्त्रियश्च संवीक्ष्य मिथोऽतिसौहृदस्मितामलापाङ्गदूशोऽभिरेभिरे ।

स्तनैः स्तनान् कुङ्गमपङ्गस्वितान् निहत्य दर्भिः प्रणयाश्रुलोचनाः ॥६६॥

ततोऽभिवाद्य ते वृद्धान् यविष्ट्रभिवादिताः । स्वागतं कुशलं पृष्ठा चक्रः कृष्णकथा मिथः ॥७  
पृथा भ्रातृन् स्वसृवीक्ष्य तत्पुत्रान् पितरावपि । भ्रातृपतीर्मुकुन्दं च जहौ संकथया शुचः ॥८  
कुन्त्युवाच

आर्य भ्रातरहं मन्ये आत्मानमकृताशिषम् । यद् वा आपत्सु मद्रात्मा नानुस्मरथ सत्तमाः ॥९  
सुहृदो ज्ञातयः पुत्रा भ्रातरः पितरावपि । नानुस्मरन्ति स्वजनं यस्य दैवमदक्षिणम् ॥१०

वसुदेव उवाच

अम्ब! मास्मानसूयेथा दैवत्रीडनकान् नरान् । ईशस्य हि वशे लोकः कुरुते कार्यतेऽथवा ॥१  
कंसप्रतापिताः सर्वे वयं याता दिशं दिशम् । एतहैव पुनः स्थानं दैवेनासादिताः स्वसः ॥२२

शोभावाणा, रोमांचित थयेला, प्रेमथी रोकाई गयेली वाणीवाणा अने जेओना  
नेत्रोमांथी आंसु झरतां हतां, एवा ए सर्वे लोको परस्परनुं आलिंगन करीने  
आनंद पाप्या ॥१४ स्नेहेन लीढे आंसुभरेलां नेत्रवाणी अने मंदहास्य वाणी स्त्रीओ  
परस्पर एकभीज्ञने जोईने हाथथी आलिंगन करवा लागी ॥१५ पछी नानी  
अवस्थावाणा लोको ए वृद्धोने पगे लागीने तथा स्वागत अने कुशण पूर्णीने परस्पर  
भगवाननी वातो करवा लाग्या ॥१६ कुंतीओ भाईओ, बहेनो, तेओना दीकरा,  
माबाप, भाईओनी स्त्रीओ अने भगवानने जोईने तेओनी साथे परस्पर प्रेमनी  
वात करवाथी सर्वे शोक छोडी दीधा ॥१७

कुंती वसुदेवने कहे छे हे आर्य! हे भाई! हुं मारा आत्माने अपूर्ण मनोरथ  
वाणो मानुं धू. केमके तमे समर्थ छतां विपत्तिओ पडवाना समयमां पश मारी  
संभाण लेता नथी ॥१८ जेने दैव प्रतिकूण होय ते माणस स्वजन होय तोपश तेने  
संबंधी, शाति, पुत्रो भाईओ के माबाप पश संभारे नहीं ॥१९

वसुदेव कहे छे हे कुल्याणी ! दैवना रमकडां जेवा माणस जातना अमो  
उपर दोष मूको नहीं, केमके जगतमां करवुं अथवा कराववुं ईश्वरनी ईच्छा  
प्रमाणे ज थाय छे ॥२० हे बहेन ! कंसे आपेला हुः खथी अमे बीज दिशाओमां  
भागी गया हता ते अमो दैवनी ईच्छाथी हमणां ज ठेकाणे आव्या छीओ ॥२१

शुकदेवज्ञ कहे छे हे राजा ! अहीं जेटला राजाओ आवेला हता, ए सर्वे  
राजाओनो वसुदेव अने उत्तरेनाहि यद्युवंशीओ ए खूब सत्कार कर्यो अने ए  
सर्वे राजाओ पश भगवाननां दर्शनना परम आनंदथी बहु ज संतोष पाप्या ॥२२

## श्रीशुक उवाच

वसुदेवोग्रसेनाद्यैर्दुभिस्तेर्चिता नृपाः । आसन्नच्युतसंदर्शपरमानन्दनिर्वृताः ॥२३  
 भीष्मो द्वारोऽस्तिकापुत्रो गान्धारी ससुता तथा । सदाराः पाण्डवाः कुन्ती सृजयो विदुरः कृपः ॥  
 कुन्तिभोजो विराटश्च भीष्मको नगनिज्महान् । पुरुजिद्द्वुपदः शल्यो धृष्टकेतुः सकाशिराट् २५  
 दमघोषो विशालाक्षो मैथिलो मद्रकेकयौ । युधामन्युः सुशर्मा च ससुता बाह्मिकादयः ॥२६  
 राजानो ये च राजेन्द्र ! युधिष्ठिरमनुव्रताः । श्रीनिकेतं वपुः शौरैः सस्त्रीकं वीक्ष्य विस्मिताः २७  
 अथ ते रामकृष्णाभ्यां सम्यक्प्राप्तसमर्हणाः । प्रशंसंसुर्मदा युक्ता वृष्णीन् कृष्णपरिग्रहान् २८  
 अहो भोजपते यूयं जन्मभाजो नृणामिह । यत् पश्यथासकृत् कृष्णं दुर्दर्शमपि योगिनाम् २९

यद्विश्रुतिः श्रुतिनुतेदमलं पुनाति पादावनेजनपयश्च वचश्च शास्त्रम् ।

भूः कालभर्जितभगापि यददिग्गपद्यस्पर्शोत्थशक्तिरभिवर्षति नोऽखिलार्थान् ॥३०॥

तदर्शनस्पर्शनानुपथप्रजल्पशय्यासनाशनसयौनसपिण्डबन्धः ।

येषां गृहे निरयवर्त्मनि वर्ततां वः स्वर्गापवर्गविरमः स्वयमास विष्णुः ॥३१॥

भीष्म, द्रोषा, धृतराष्ट्र, गांधारीना पुत्रो, स्त्री सहित पांडवो, कुंती, सृंजय, विदुर, कृपाचार्य, कुंतीभोज, विराट, भीष्मक, नगनज्ञत, द्वुपद, शल्य, धृष्टकेतु, काशीनो राजा, मद्रदेशनो राजा, केक्यदेशनो राजा, युधामन्यु, सुशर्मा, बाल्हिकादिक, तेओना पुत्रो अने युधिष्ठिरने अनुसरता भीजा पश्च राजाओ हता, तेओ लक्ष्मीना निवासरूप भगवानना शरीरने अने तेमनी स्त्रीओने ज्ञेयने विस्मय पाभ्या ॥२३-२४  
 बणभद्र अने श्रीकृष्णो जेओनुं सारी रीते पूजन कर्यु हतुं, ऐवा ते लोको प्रीति पामीने जे यादवोने भगवाने स्वीकृत कर्या हता, ते यादवोने वभाशवा लाङ्या के “अहो ! हे उत्तरेन राजा ! अहो मनुष्योमां तमारो जन्म सङ्खण छे, केम्के जेनां दर्शन योगीओने पश्च दुर्लभ छे ते भगवानने तमे वारंवार देखो छो ॥२५-२६ वेदे वभाषोली जेनी कीर्ति, जेनां चरण धोयानुं जण गंगाज्ञ अने जेना वयनरूप वेद आ जगतने अत्यंत पवित्र करे छे, तथा आ पृथ्वी काणनी गतिथी शक्ति रहित थई गई छे, तोपश्च जेनां चरणारविंदना स्पर्शथी उत्तम शक्ति पामीने अमोने सर्वे वस्तु पूरी पाडे छे, ते भगवाननी साथे दर्शन, स्पर्श, अनुसरण, गोष्ठि, शय्या, आसन, भोजन, विवाह अने संपिंडताना संबंधथी तमे जोडाएला छो, अने तमे नरकना मार्गरूप धरमां रत्या छतां पश्च तमारा धरमां स्वर्ग तथा भोक्तनी तृष्णा ज्यां निवृत्ति पामे छे ऐवा विष्णु प्रगट थया छे, माटे तम लोकोनो जन्म सङ्खण छे ॥२७-२८ कुरुक्षेत्रमां वास करवा सारु सर्वे पदार्थो गाडांओमां भरीने

## श्रीशुक उवाच

नन्दस्तत्र यदून् प्रापान् ज्ञात्वा कृष्णापुरोगमान् । तत्रागमद् वृतो गोपैरनःस्थार्थैर्दृदक्षया ॥३२  
 तं दृष्ट्वा वृष्णयो हृष्णस्तन्वः प्राणमिवोत्थिताः । परिषस्वजिरे गाढं चिरदर्शनकातराः ॥३३  
 वसुदेवः परिष्वज्य सम्प्रीतः प्रेमविहूलः । स्मरन् कंसकृतान् क्लेशान् पुत्रन्यासं च गोकुले ३४  
 कृष्णरामौ परिष्वज्य पितरावभिवाद्य च । न किञ्चनोचतुः प्रेष्णा साश्रुकण्ठौ कुरुद्वह ॥३५  
 तावात्मासनमारोप्य बाहुभ्यां परिरभ्य च । यशोदा च महाभागा सुतौ विजहतुः शुचः ॥३६  
 रोहिणी देवकी चाथ परिष्वज्य व्रजेश्वरीम् । स्मरन्त्यै तत्कृतां मैत्रीं बाष्पकण्ठौ समूचतुः ३७  
 का विस्मरेत वां मैत्रीमनिवृत्तां व्रजेश्वरि । अवाप्याव्यैन्द्रमैश्वर्य यस्या नेह प्रतिक्रिया ॥३८

एतावदृष्टपितरौ युवयोः स्म पित्रोः सम्प्रीणनाभ्युदयपोषणपालनानि ।

प्राप्योषतुर्भवति पक्षम ह यद्वदक्षणोन्यस्तावकुत्र च भयौ न सतां परः स्वः ॥३९॥

त्यां आवेला नंदराय, श्रीकृष्ण आदि यादवोने त्यां आवेला जाणी, गोवाणोनी साथे दर्शन करवानी ईश्वराथी आव्या ॥३१ नंदरायने ज्ञेय राज्ञ थयेला अने घाणे काणे दर्शन थवाथी संभामने पामेला यादवोअे प्राणानी सामे ज्ञेम शरीर उभा थाय, तेम नंदरायनी सामा उभा थईने दृढ आलिंगन कर्यु ॥३२ प्रेमथी विहूल, कंसे आपेलां दुःखोने अने गोकुणमां दीक्कराओरुपी थापशा भूकी हती ते वातने संभारता वसुदेव नंदरायनुं आलिंगन करीने बहु ज राज्ञ थया ॥३३ हे राजा ! श्रीकृष्ण अने बलराम, पोतानां माबाप नंद अने यशोदानुं आलिंगन करी तथा प्राणाम करी प्रेमनां आंसु गणामां आवी जतां कंटी पश्च बोल्या नहीं ॥३४ भाग्यशाली नंद अने यशोदा ए बे पुत्रोने पोताना आसन पर बेसाडीने हाथथी आलिंगन करी आंसु पाडवा लाङ्यां ॥३५ यशोदाए कुरेली मैत्रीनुं स्मरण आवतां आभनां आंसु जेओना कंठ सुधी भराई गयां हतां, ऐवां देवकी अने रोहिणीए यशोदानुं आलिंगन करीने कहुं के “हे प्रजनी ईश्वरी ! तमारी नहीं बंध पडेली मैत्री के जेनो बदलो ईद्रनुं ऐश्वर्य भणतां पश्च वाणी शकाय नहीं, तेने कोष भूले ? ॥३६-३७ जेओ ए माबाप जेयां पश्च न हतां ऐवा आ बे अमारा पुत्रो पांपशना रक्षण तणे ज्ञेम आंखो राखेली छे, तेम तमारा रक्षण तणे राखेला हता, तेओ मात पितारूप तमारा हाथथी लाड, अभ्युदय, पोषण अने पालनने पामी निर्भय रीते रत्या । ‘आ पोतानो आ पारको’ ऐवी विषमता सत्पुरुषोने होती ज नथी ॥३८ जे गोपीओने जेवामां नेत्रानां पांपशो आडी आवतां ते पांपशोने बनावनार विधाताने पोते गाणो देती हती, ते ख्यारा श्रीकृष्ण घरो काणे जेवामां आवतां

श्रीशुक उवाच

गोप्यश्च कृष्णमुपलभ्य चिरादभीष्टं यत्प्रेक्षणे दृशिषु पक्षमकृतं शपन्ति ।

दृग्भर्भदीकृतमलं परिरभ्य सर्वास्तद्वावापुरपि नित्ययुजां दुरापम् ॥४०॥

भगवांस्तास्तथाभूता विविक्त उपसङ्गतः । आश्लिष्यानामयं पृष्ठा प्रहसन्निदमब्रवीत् ॥४१॥

अपि स्मरथ नः सख्यः स्वानामर्थचिरीषया । गतांश्चिरायिताज्ज्ञुपक्षक्षणं चेतसः ॥४२॥

अप्यवध्यायथास्मान् स्विद्वृत्तज्ञाविशङ्क्या । नूनं भूतानि भगवान् युनक्ति वियुनक्ति च ४३

वायुर्यथा घनानीकं तृणं तूलं रजांसि च । संयोज्याक्षिपते भूयस्तथा भूतानि भूतकृत् ॥४४॥

मयि भक्तिर्हि भूतानामृतत्वाय कल्पते । दिष्ट्या यदासीमत्वेहो भवतीनां मदापनः ॥४५॥

अहं हि सर्वभूतानामादिरन्नोऽन्तरं बहिः । भौतिकानां यथा खं वार्भवार्युज्योतिरङ्गनाः ॥४६॥

नेत्रुरुप द्वारथी तेभने हृदयमां पेसाई, आलिंगन करीने सर्वे गोपीओ समाधिमां निष्ठा राखनाराओने पश्च न भणे अेवा तद्रूपपश्चाने पामी गै।<sup>७८</sup> आ प्रमाणे तद्रूप थयेली ते गोपीओने भगवाने एकांतमां मणी आलिंगन करी तथा आरोग्य पूछी हसतां हसतां आ प्रमाणे कह्युं.<sup>७९</sup> भगवान कहे छे हे सभीओ ! जे अमो संबंधीओनुं काम करवानी ईर्थाथी गयेला अने ते प्रसंगमां शत्रुओना पक्षनो नाश करवामां चित लागतां धशा काण सुधी रोकाई गया छीअे ते अमोने संभारो छो.<sup>८०</sup> थोडीक 'कर्या उपकारने जाणता नथी' अेवी शंकाथी अमारा उपर तमने रीस यढी छे ? काण ज प्राणीओने भेणां करे छे अने नोभां पाडी दे छे अे वात सत्य छे.<sup>८१</sup> जेम वायु वादणांना समूहने, धासने, तृष्णने अने रजने भेणां करीने पाइं नोभां पाडी दे छे.<sup>८२</sup> मारी भक्ति प्राणीओने मोक्ष आपवाने समर्थ छे, माटे तमने मारी प्राप्ति करावे अेवो मारामां स्नेह थयो छे, अे धाणुं सारुं थयुं छे.<sup>८३</sup> हे स्त्रीओ ! जेम आकाश, जृण, पृथ्वी, वायु अने तेज अे पंचमहाभूत ज घटादिक पदार्थोना आदि, अंत, अत्यंतर अने बाह्यरुप छे, तेम हुं सर्वपदार्थोना आदि, अंत, अत्यंतर अने बाह्यरुप छुं.<sup>८४</sup> आ प्रमाणे आकाशादि पंच महाभूतो भौतिक देहादिकने विषे परस्पर व्याप्य अने व्यापक भावथी रहेलां छे. अने पंचमहाभूतोथी रयायेला देहोने विषे तथा महाभूतोने विषे येतनवर्गं पोतानी ज्ञानशक्तिथी व्यापीने रहेलो छे. अने ब्रह्मपुर धामने विषे दिव्य मूर्तुरुपे प्रकाशता अने सर्वश्रेष्ठ पुरुषोत्तम अेवा मने येतन वर्गने विषे तथा अयेतन वर्गने विषे अंतर्यामिरुपे व्यापेलो तमे ज्ञाणो. आ प्रमाणे माहात्म्यना अधिकपश्चाथी मारे

एवं ह्येतानि भूतानि भूतेष्वात्माऽऽत्मना ततः । उभयं मध्यथ परे पश्यताभातमक्षरे ॥४७॥

श्रीशुक उवाच

अध्यात्मशिक्षया गोप्य एवं कृष्णेन शिक्षिताः । तदनुस्मरणाध्वस्तजीवकोशास्तमध्यगन् ४८

आहुश्च ते नलिननाभ पदारविदं योगेश्वरैर्हृदि विर्चित्यमगाधबोधैः ।

संसारकूपपतितोत्तरणावलम्बं गेहञ्ज्ञामपि मनस्युदियात् सदा नः ॥४९॥

इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे उत्तरार्थं

वृष्णिगोपसङ्गमो नाम द्वयशीतितमोऽध्यायः ॥८२॥

अथ त्र्यशीतितमोऽध्यायः (८३)

॥ श्रीशुक उवाच ॥

तथाऽनुगृह्ण भगवान् गोपीनां स गुरुर्गतिः । युधिष्ठिरमथाऽपृच्छत्सर्वांश्च सुहृदोऽव्ययम् ॥१॥

त एवं लोकनाथेन परिपृष्ठाः सुसत्कृताः । प्रत्यूचुर्हृष्मनसस्तत्पादेक्षाहतांहसः ॥२॥

विषे स्नेहनुं पश्च अधिकपशुं थाय छे, माटे उपर कहेवा प्रमाणे भने हमेशां तमारी सभीपे ज जाणीने भजो.<sup>८६</sup>

शुकदेवज्ञ कहे छे आ प्रमाणे श्रीकृष्णे स्वस्वरुपना उपदेशथी समजावेली अने श्रीकृष्णना स्मरणाथी जे ओनां लिंग शरीर छूटी गयां, अेवी गोपीओ भगवानने ज पामी, अने बोली के "हे पद्मनाभ ! अगाध बोधवाणा, योगेश्वरो अे हृदयमां चिंतववा योग्य अने संसाररुपी कूवामां पडेलाओने आश्रयरुप तमारुं यरणारविंद, अमे धरने सेवीअे तोपश्च अमारा मनमां सर्वदा प्रकट रहेजो.<sup>८७-८८</sup>

इति श्रीमद्भागवतना दशम स्कन्धनो व्याशीमो अद्याय संपूर्णः.

अद्याय ८३

श्रीकृष्ण भगवान के रीते श्रीओने पराया अे विषे पोतपोताना विवाहनी द्रौपदीनी पासे वातो कहेती अष्ट पटराणीओ.

शुकदेवज्ञ कहे छे हे राजा ! गुरु अने गतिरुप भगवाने आ प्रमाणे गोपीओ पर अनुग्रह करीने युधिष्ठिरने तथा बीजा पश्च सर्वं संबंधीओने कुशण पूछ्युं.<sup>१</sup> आ प्रमाणे श्रीकृष्णे पूछेला, सत्कार करेला अने तेमनां यरणानां दर्शनथी

કુતોડશિવं ત્વच્ચરણાભુજાસવં મહનસ્તો મુખનિઃ સૃતં ક્લચિત् ।  
પિબન્તિ યે કર્ણપુટૈરલં પ્રભો દેહભૂતાં દેહકૃદસ્મृતિચ્છદમ् ॥૩॥  
હિત્વાડત્તમધામવિધુતાત્મકૃતત્રયવસ્થમાનન્દસપ્લવમખણ્ડમકુણબોધમ् ।  
કાલોપસૃષ્ટનિગમાવન આત્મયોગમાયાકૃતિં પરમહંસગતિં નતાઃ સ્મ ॥૪॥

## દ્રોપદ્યુવાચ

ઇત્યુત્તમશલોકશિખામળિં જનેષ્વભિષ્ટુવત્સ્વન્ધકકૌરવસ્ત્રિયઃ ।  
સમેત્ય ગોવિન્દકથા મિથોડ્રગ્ણંસ્ત્રિલોકગીતાઃ શૃણુ વર્ણયામિ તે ॥૫॥

## દ્રોપદ્યુવાચ

હે વૈદર્થ્યચ્યુતો ભદ્રે! હે જાઘ્રવતિ! કૌસલે! । હે સત્યભામે! કાલિન્દિ! શૈલ્વે! રોહિણિ! લક્ષ્મણે!  
હે કૃષ્ણપત્ન્ય એતનો બ્રૂત વો ભગવાન् સ્વયમ् । ઉપયેમે યથા લોકમનુકુર્વન् સ્વમાયયા ॥૭  
રૂક્મિણ્યુવાચ

ચૈદ્યાય માર્પયિસુમુદ્યતકાર્મુકેષુ રાજસ્વજેયભટશેખરિતાઙ્ગ્રેણુઃ ।  
નિન્યે સૃગેન્દ્ર ઇવ ભાગમજાવિયુથાત् તચ્છ્રીનિકેતચરણોડસ્તુ મમાર્ચનાય ॥૮॥

નિષ્પાપ થયેલા તે લોકો આનંદથી નીચે પ્રમાણે બોલ્યા.<sup>૨</sup>

સંબંધીઓ કહે છે હે પ્રભુ! મહાત્માઓના મન થકી મુખ દ્વારા કોઈ સમયે નીકળેલું અને પ્રાણીઓને જન્મ આપનારી અવિદ્યાને કાપનારું, તમારા ચરણારવિંદની કથારૂપ અમૃતને જે લોકો કાન્દુપી પડીઆઓથી બહુ જ પીએ છે, તેઓનું અમંગળ કર્યાંથી હોય? <sup>૩</sup> ભક્તજીવોને વિષે અનાદિ અવિદ્યાથી કરાયેલી ત્રણે અવસ્થાઓને સ્વસ્વરૂપના જ્ઞાનથી નાશ કરનારા, આનંદના તો સમુદ્રરૂપ, અખંડિત જ્ઞાનવાળા, કાળગતિથી નાશ પામેલા વેદોનું રક્ષણ કરવા માટે પોતાના યોગેશ્વર્યથી મતસ્યાદિ અવતારોને ધારણ કરનારા, અને પરમહંસોના પરમ ગતિરૂપ, આવા તમોને અમો વારંવાર નમસ્કાર કરીએ છીએ.<sup>૪</sup>

શુક્ટેવજી કહે છે આ પ્રમાણે લોકો ભગવાનની સ્તુતિ કરી રહ્યા હતા, તે સમયે યાદવો અને કૌરવોની સ્ત્રીઓ મળીને ત્રિલોકીએ ગાયેલી ભગવાનની કથાનું પરસ્પર વર્ણન કરવા લાગી. એ સ્ત્રીઓની વાતોનું હું તમારી પાસે વર્ણન કરું છું, તે સાંભળો.<sup>૫</sup>

દ્રોપદી પૂછે છે હે રૂક્મિણિ! હે ભદ્રા! હે જંબવતિ! હે નાગનજિતિ! હે સત્યભામા! હે કાલિન્દિ! હે શૈલ્વા! હે રોહિણિ! હે લક્ષ્મણા! હે કૃષ્ણની સ્ત્રીઓ! પોતાની માયાથી મનુષ્યલોકનું અનુકરણ કરતા શ્રીકૃષ્ણ ભગવાન જેવી રીતે તમોને પરણ્યા એ વાત અમને કહો.<sup>૬-૭</sup>

સત્યભામોવાચ  
યો મે સનાભિવધતમહૃદા તતેન લિસાભિશાપમપમાર્ઘુમુપાજહાર ।  
જિત્વક્ષરજાજમથ રનમદાત્ સ તેન ભીતઃ પિતાદિશત માં પ્રભવેડપિ દત્તામ् ॥૯॥

જામ્બવત્યુવાચ  
પ્રાજ્ઞાય દેહકૃદમું નિજાથેદેવં સીતાપાતિં ત્રિણવહાન્યમુનાભ્યયુધ્યત ।  
જ્ઞાત્વા પરીક્ષિત ઉપાહરદર્હણ માં પાદૌ પ્રગૃહ્ય મણિનાહમમુદ્ધ દાસી ॥૧૦॥

કાલિન્દ્યુવાચ  
તપશ્રરનીમાજ્ઞાય સ્વપાદસ્પર્શનાશયા । સખ્યોપેત્યાગ્રહીત પણિં યોડહં તદ ગૃહમાર્જની ॥૧૧  
મિત્રવિન્દોવાચ

યો માં સ્વયંવર ઉપેત્ય વિજિત્ય ભૂપાનુનિન્યે શ્વયુથગમિવાત્મબર્લિ દ્વિપારિઃ ।  
ભાતૃંશ્ મેઽપકુરુઃ સ્વપુરં શ્રીયૌકસ્તસ્યાસ્તુ મેઝનુભવમદ્ધ્યવનેજનત્વમ् ॥૧૨॥

રૂક્મિણિ કહે છે મને શિશુપાળની સાથે પરણાવવા સારુ રાજાઓ ધનુષ ધરીને સજજ થયા હતા, ત્યાં અજેય યોદ્ધાઓ પણ જેના ચરણની રજને માથે ચઢાવે છે એવા ભગવાન, જેમ સિંહ બકરાના અને ગાડરના ટોળામાંથી પોતાના ભાગને લઈ જાય તેમ લઈ ગયા, તે ભગવાનના ચરણનું પૂજન મને પ્રાપ્ત થજો.<sup>૮</sup>

સત્યભામા કહે છે ભાઈ પ્રસેનના વધથી પરિતાપ પામેલા મારા પિતાએ મૂકેલા અભિશાપને મટાડવા સારુ, ભગવાને રીંછના રાજાને જીતીને મણિ લાવી મારા પિતાને આપતાં, ભગવાન ઉપર આરોપ મૂકવાના અપરાધથી ભય પામેલા મારા પિતાએ, જો કે મારું વાગદાન બીજાને થઈ ચૂક્યું હતું, તોપણ શ્રીકૃષ્ણને મારું દાન આપ્યું.<sup>૯</sup>

જંબવતી કહે છે મારા પિતાએ આ શ્રીકૃષ્ણને “પોતાના ઈષ્ટદેવ અને સ્વામી રામચંદ્ર છે” એમ નહીં જાણતાં એમની સાથે સત્યાવીશ દિવસ સુધી યુદ્ધ કર્યું. પછી સાક્ષાત્ આ જ રામચંદ્ર છે, એવું પરીક્ષા દ્વારા જ્ઞાન થતાં મારા પિતાએ પગમાં પડીને પૂજનરૂપે મણિની સાથે શ્રીકૃષ્ણને મારું પણ દાન આપ્યું. એ શ્રીકૃષ્ણની હું દાસી છું.<sup>૧૦</sup>

કાલિંદી કહે છે મને પોતાના ચરણના સ્પર્શની ઈષ્ટાથી તપ કરતી જાણીને, પ્રથમ પોતાના મિત્ર અર્જુન દ્વારા મળીને જેણે મારું પાણિગ્રહણ કર્યું તે ભગવાનના ઘરમાં હું વાશીદું વાળનારી છું.<sup>૧૧</sup>

મિત્રવિંદા કહે છે લક્ષ્મીના નિવાસરૂપ જે ભગવાન, સ્વયંવરમાં આવીને

सत्योवाच

सप्तोक्षणोऽतिबलवीर्यसुतीक्ष्णशृङ्खान् पित्रा कृतान् क्षितिपवीर्यपरीक्षणाय ।  
तान् वीरदुर्मदहनस्तरसा निगृह्य क्रीडन् बबन्ध हयथा शिशवोऽजतोकान् ॥१३॥  
य इत्थं वीर्यशुल्कां मां दासीभिश्चतुरङ्गिणीम् । पथि निर्जित्य राजन्यान् निन्ये तदास्यमस्तु मे १४  
भद्रोवाच

पिता मे मातुलेयाय स्वयमाहूय दत्तवान् । कृष्णे कृष्णाय तच्चित्तामक्षौहिण्या सखीजनैः १५  
अस्य मे पादसंस्पर्शो भवेज्जन्मनि जन्मनि । कर्मभिर्भास्यमाणाया येन तच्छ्रेय आत्मनः १६

लक्ष्मणोवाच

ममापि राज्यच्युतजन्मकर्म श्रुत्वा मुहुर्नर्दगीतमास ह ।  
चित्तं मुकुन्दे किल पद्महस्तया वृतः सुपम्मृश्य विहाय लोकपान् ॥१७॥

राजाओने तथा अपकार करता मारा भाईओने पश छती लई, सिंह जेम कूतराओना टोणांमांथी पोताना भागने लई जाय तेम भने द्वारकामां लई गया, ते भगवान्ना चरण धोवानुं काम भने दरेक जन्ममां भणजो ॥१२

नागनिंजिती कहे छे मारा पिताए राजाओना भणनी परीक्षा लेवाने माटे पाणेला, तीक्ष्ण शींगडांवाणा, भारे भणवाणा अने वीरपुरुषोना दुष्ट अभिमानने उतारनारा सात आभलाओने बाणको जेम बकरीनां भय्याने बांधी ले तेम, भगवाने रमतां रमतां बांधी लीधा हता ॥१३ आ प्रमाणे जे मारुं भूत्य पराक्रम ज हतुं ते भने परणी, मार्गना राजाओने छतीने मारा पिताए आपेली दासीओ तथा चार अंगवाणी सेनानी साथे भने भगवान द्वारकामां तेडी गया । ते भगवाननुं दासीपशुं भने प्राम थजो ॥१४

भद्रा कहे छे हे द्रौपदी ! भगवान श्रीकृष्ण मारा मामाना पुत्र छे । मारुं चित अेक भगवानमां ज लागेलुं हतुं । ज्यारे मारा पिताने आ वातनी खबर पडी त्यारे स्वयं मारा पिताए भगवानने बोलावीने अक्षौहिणी सेना अने दासीओनी साथे भने भगवान्ना चरणोमां समर्पित करी दीधी ॥१५ हुं मारुं परम कल्याण अेमां ज समजुं धुं, के कर्मने अनुसारे भने ज्यां ज्यां जन्म लेवो पडे, त्यां सर्वत्र भने श्रीकृष्णाना चरणकमणो स्पर्श प्राम थतो रहे ॥१६

लक्ष्मणा कहे छे हे द्रौपदी ! वारंवार नारदज्ञाना गायनमांथी भगवान्नां जन्म कर्म सांभणवामां आवतां, लक्ष्मीज्ञ पश लोकपाणोने मूकीने भगवानने ज वर्यां छे । ऐवो विचार करी मारुं चित पश भगवानमां ज लाग्युं हतुं ॥१७

ज्ञात्वा मम मतं साधिव पिता दुहितृवत्सलः । बृहत्सेन इति ख्यातस्त्रोपायमचीकरत् ॥१८  
यथा स्वयंवरे राज्ञि मत्स्यः पार्थेप्सया कृतः । अयं तु बहिराच्छन्नो दृश्यते स जले परम् ॥१९  
श्रुत्वैतत् सर्वतो भूपा आयुर्मित्यितुः परम् । सर्वास्त्रशस्त्रतच्चज्ञाः सोपाध्यायाः सहस्रशः ॥२०  
पित्रा सम्पूजिताः सर्वे यथावीर्य यथावयः । आददुः सशरं चापं वेद्धुं पर्षदि मद्धियः ॥२१  
आदाय व्यसृजन् केचित् सज्यं कर्तुमनीश्वरा । आकोटि ज्यां समुत्कृष्य पेतुकेऽमुना हताः ॥२२  
सज्यं कृत्वा परे वीरा मागधाम्बष्ठेदिपाः । भीमो दुर्योधनः कर्णो नाविन्दंस्तदवस्थितिम् ॥२३  
मत्स्याभासं जले वीक्ष्य ज्ञात्वा च तदवस्थितिम् । पार्थो यतोऽसृजद् बाणं नाच्छिन्नत् पस्पृष्टे परम्  
राजन्येषु निवृत्तेषु भग्नमानेषु मानिषु । भगवान् धनुरादाय सज्यं कृत्वाथ लीलया ॥२५  
तस्मिन् सम्भाय विशिखं मत्स्यं वीक्ष्य सकृज्जले । छित्त्वेषुणापातयत्तं सूर्ये चाभिजिति स्थिते  
दीक्षिरी पर प्रीति राखनारा ब्रुहत्सेन नामना मारा पिताए मारो अभिप्राय ज्ञाणी  
श्रीकृष्णानी प्राप्तिने माटे उपाय कर्यो ॥१८ हे द्रौपदी ! जेम तमारा स्वयंवरमां  
अर्जुनने आपवानी ईर्याथी तमारा पिताए मत्स्यवेधनुं आयोजन कर्यु हतुं,  
तेम मारा स्वयंवरमां पश भारा पिताए मत्स्यवेधनुं आयोजन कर्यु हतुं, परंतु  
तमारा स्वयंवरनी अपेक्षाए मारा स्वयंवरमां ए विशेषता हती के, मत्स्य  
बहारथी ढांकेलो हतो पश डेवण जग्मां तेनो पदधायो जोयामां आवतो हतो.  
माटे दृष्टि नीये अने निशान उपर होवाथी ए मत्स्य कृष्ण विना भीजा कोईथी  
भेदाय अेम न हतो ॥१९ आ वात सांभणी सर्व अख्य तथा शख्नना तत्वने ज्ञानारा  
हजारो राजाओ पोतपोताना उपाध्यायोनी साथे भारा पिताना पुरमां आव्या  
हता ॥२० सौ सौनां पराक्रम अने अवस्था प्रमाणे भारा पिताए पूजेला राजाओ अे  
सभामां मत्स्यवेध करवा सारु धनुषबाण लीधां, पश सर्वेना भन भारामां  
लागवाथी वींधी शक्या नहीं ॥२१ केटलाके धनुषबाण लईने मूकी दीधां, केटलाके  
धनुषपर दोरी ज चढावी शक्या नहीं, अने केटलाके कांडा सुधी दोरी भेंयी पश  
धनुषनो जपाटो लागवाथी पडी गया ॥२२ जरासंध, अंबष्ठ, शिशुपाण, भीम,  
दुर्योधन, कर्ण अने भीजा वीरलोकोअे धनुषमां दोरी पूरी रीते चढावी, पश तेओ  
कोई मत्स्यनी स्थितिने ज ज्ञाणी शक्या नहीं ॥२३ पछी अर्जुने जग्मां मत्स्यनो  
आभास जोई तथा तेनी स्थिति पश ज्ञाणी लईने सावधानपशाथी बाण नाघ्युं,  
अने ते बाण मत्स्यने अडयुं पश तेथी ते कपायो नहीं ॥२४ आ प्रमाणे अभिमानी  
क्षत्रियो मानभंग पामीने अटकतां श्रीकृष्णे धनुष लई दोरी चढावी तथा  
लीलामात्रथी तेमां बाण चढावीने भध्याक्ष काणना अभिजित मुहूर्तमां अेकवार

दिवि दुन्दुभयो नेदुर्जयशब्दयुता भुवि । देवाश्च कुसुमासारान् मुमुक्षुर्हर्षविह्वलाः ॥२७  
 तद् रङ्गमाविशमहं कलनूपुराभ्यां पदभ्यां प्रगृह्य कनकोज्ज्वलरत्नमालाम् ।  
 नूते निवीय परिधाय च कौशिकाग्रे सर्वीडहासवदना कबरीधृतस्त्रक् ॥२८॥  
 उन्नीय वक्त्रमुरुकुन्तलकुण्डलत्विङ्गण्डस्थलं शिशिरहासकटाक्षमोक्षैः ।  
 राजो निरीक्ष्य परितः शनकैर्मुरारेरंसेऽनुकृहदया निदधे स्वमालाम् ॥२९॥  
 तावन्मृदङ्गपटहाः शङ्खभेर्यनिकादयः । निनेदुर्नटनर्तक्यो ननृतुर्गायका जगुः ॥३०  
 एवं वृते भगवति मयेशो नृपयूथपाः । न सेहिरे याज्ञसेनि स्पर्धन्तो हृच्छयातुराः ॥३१  
 मां तावद् रथमारोच्य हयरतचतुष्टयम् । शार्ङ्गमुद्याय्य सन्नद्धस्तथावाजौ चतुर्भुजः ॥३२  
 दारुकश्चोदयामास काञ्छनोपस्करं रथम् । मिषतां भूभुजां राज्ञि मृगाणां मृगराडिव ॥३३  
 तेऽन्वसज्जन्त राजन्या निषेद्धुं पथि केचन । संयन्ता उद्धृतेष्वासा ग्रामसिंहा यथा हरिम् ॥३४  
 ते शार्ङ्गच्युतबाणौघैः कृत्तबाह्निकन्धराः । निषेतुः प्रधने केचिदेके सन्त्यज्य दुद्रुवुः ॥३५

जृणमां भत्स्य ज्ञेईने तेने बाणाथी कापीने पाढी दीधो.<sup>२५-२६</sup> आ समयमां पृथ्वी  
 अने स्वर्गमां हुंदुभिं वागवा लाङ्यां अने ज्य ज्य शब्दो थवा लाङ्या । हृष्टी  
 विह्वण थयेला देवताओ पुण्यनी वृष्टि करवा लाङ्या ॥२७ पठी नवां उत्तम रेशभी  
 वस्त्र पहेरी अने योटलामां माणाओ गूंथीने लाज सहित हसता मोढावाणी हुं  
 सुवर्णानी उत्तम रत्नोवाणी माणा हाथमां लईने झंझरना झमकारावाणा पगथी  
 ते सभामंडपमां आवी ॥२८ जे भारा हृदयमां प्रेम हतो, ते में घणा केशवाणुं अने  
 कुंडली शोभी रहेला गालवाणुं मोहुं ऊंचुं करी तथा शीतण हास्य सहित कटाक्षोथी  
 चारेकोर धीरे धीरे राजाओने ज्ञेईने श्रीकृष्णना गणामां पोतानी माणा  
 पहेरावी ॥२९ तेटली वारमां मृदंग, पटह, शंख, भेरी अने आनक आदि वाज्ञ  
 वागवा लाङ्यां, नट अने नर्तकीओ नाचवा लाङी, अने गवैयाओ गावा लाङ्या ॥३०  
 हे द्रोपदी ! आ प्रमाणो हुं प्रत्यु श्रीकृष्णने वरतां, स्पर्धा करनारा अने कामदेवथी  
 परवश थयेला मोटा मोटा राजाओ ते वातने सहन करी शक्या नहीं ॥३१ एटली  
 वारमां चार उत्तम घोडाथी ज्ञेला रथमां भने बेसाई, बे हाथथी मारुं आलिंगन  
 करी अने बे हाथथी धनुषबाण लई श्रीकृष्ण युद्धमां सज्ज थई गया ॥३२ दारुक  
 सारथिए सोनाना सामानवाणो रथ हांक्यो । मृगो ज्ञेई रहेतां जेम सिंह चाल्यो  
 ज्य, तेम राजाओना देखतां भगवान चाल्या गया ॥३३ केटलाक राजाओ धनुष  
 उपाईने जेम फूतरा सिंहनी पछवाडे दोडे, तेम भगवानने रोकवा सारु तेमनी  
 पछवाडे दोड्या, अने केटलाक राजाओ आगणथी ज्ञेईने मार्गमां सज्ज थई

ततः पुरीं यदुपतिरत्यलङ्कृतां रविच्छदध्वजपटचित्रतोरणाम् ।

कुशस्थलीं दिवि भुवि चाभिसंस्तुतां समाविशत्तरणिरिव स्वकेतनम् ॥३६॥

पिता मे पूजयामास सुहृत्सम्बन्धिबास्थवान् । महाहवासोऽलङ्कारैः शव्यासनपरिच्छदैः ॥३७

दासीभिः सर्वसम्पद्दिर्भटेभरथवाजिभिः । आयुधानि महार्हण ददौ पूर्णस्य भक्तिः ॥३८

आत्मारामस्य तस्येमा वयं वै गृहदासिकाः । सर्वसङ्गनिवृत्याद्वा तपसा च बभूविम ॥३९

महिष्य ऊचुः

भौमं निहत्य सगणं युधि तेन रुद्धा ज्ञात्वाथ नः क्षितिजये जितराजकन्याः ।

निर्मुच्य संसृतिविमोक्षमनुस्मरन्तीः पादाम्बुजं परिणिनाय य आसकामः ॥४०॥

न वयं साधिव साप्राज्यं स्वाराज्यं भौज्यमप्युत । वैराज्यं पारमेष्ठं च आनन्दं वा हरेः पदम् ॥

कामयामह एतस्य श्रीमत्यादरजः श्रियः । कुचकुङ्कुमगन्धाद्यं मूर्धा वोहुं गदाभृतः ॥४२

व्रजस्त्रियो यद्वांछन्ति पुलिन्द्यस्तृणवीरुद्धः । गावश्चारयते गोपाः पादस्पर्शं महात्मनः ॥४३

इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे उत्तरार्थं  
 त्र्यशीतितमोऽद्यायः ॥४३॥

गया ॥४ शारंग धनुषमांथी नीकणेला बाणोना समूहोथी ज्ञेओना हाथ, पग अने  
 गणां कुपाई गयां ऐवा ते राजाओ युद्धमां पडी गया अने केटलाक युद्ध मूर्कीने  
 भागी गया ॥५ पठी सूर्य जेम अस्तायणमां ज्य तेम श्रीकृष्ण बहुज शशगारेली,  
 पृथ्वीमां तथा स्वर्गमां वधारामेली, सूर्यने ढांकनार ध्वजावाणी अने विचित्र  
 तोरणोवाणी पोतानी द्वारका नगरीमां पधार्या ॥६ मारा पिताए घणां मूल्यनां  
 वस्त्र, अलंकार, शय्या, आसन अने बीजा सामानोथी, भित्रो, संबंधीओ अने  
 बांधवोनी पूजा करी ॥७ श्रीकृष्ण पूर्ण छे तोपण तेमने भक्तिने लीधे दासीओ,  
 सर्वप्रकारनी संपत्तिओ, योद्धा, हाथी, रथ, घोडा अने सर्वोत्तम आयुधो आप्यां ॥८  
 आ अमे आठजणी सर्वसंगनी निवृत्ति अने तपना प्रभावथी ते आत्माराम  
 साक्षात् श्रीकृष्णना घरनी दासीओ थयेली छीओ ॥९

सोणहज्जर अने एकसो स्त्रीओ कुहे छे नरकासुरे हिजिवज्यमां ज्ञती  
 लीघेला राजाओनी कन्याओ अमोने नरकासुरे पोताना महेलमां केद करेली हती,  
 अमो संसारथी छोडावनारा भगवानना चरणारविंदनुं स्मरण करती हती, आ  
 वातने जाणीने श्रीकृष्ण भगवान पोते पूर्णकाम होवा छितां पण युद्धमां परिवार  
 सहित नरकासुरने मारी नाखीने परण्या छे ॥१० हे द्रोपदी ! अमे चक्कर्तिपणाने,  
 ईद्रपदवीने, ते बन्ने प्रकारना वैभवने, आणिमाइ सिद्धिओने, ब्रह्मानी पदवीने,

अथ चतुरशीतितमोऽध्यायः (८४)

॥ श्रीशुक उवाच ॥

श्रुत्वा पृथा सुबलपुत्र्यथ याज्ञसेनी माधव्यथ क्षितिपपत्य उत स्वगोप्यः ।

कृष्णोऽखिलात्मनि हरौ प्रणयानुबंधं सर्वा विसिस्युरलमश्रुकलाकुलाक्ष्यः ॥१॥

इति सम्भाषमाणासु स्त्रीभिः स्त्रीषु नृभिर्नृषु । आययुर्मुनयस्तत्र कृष्णारामदिवृक्षयः ॥२॥

द्वैपायनो नारदश्च च्यवनो देवलोऽसितः । विश्वामित्रः शतानन्दो भरद्वाजोऽथ गौतमः ॥३॥

रामः सशिष्यो भगवान् वसिष्ठे गालवो भृगुः । पुलस्त्यः कश्यपोऽत्रिश्च मार्कण्डेयो बृहस्पतिः ॥४॥

द्वितिस्त्रितश्चैकतश्च ब्रह्मपुत्रास्तथाङ्गिराः । अगस्त्यो याज्ञवल्क्यश्च वामदेवादयोपरे ॥५॥

तान् दृष्ट्वा सहस्रोत्थाय प्रागासीना नृपादयः । पाण्डवाः कृष्णारामौ च प्रणोर्मुकिश्ववन्दितान् ॥६॥

सालोक्यादिकं भुक्तिओने अथवा डैवत्यभोक्षने पश्च ईर्युती नथी; परंतु

लक्ष्मीछना स्तन उपर लगावेलां केसरनी सुगंधवाणी ए भगवाननी सर्वोत्तम

यरण्डजने ज माथे धरवाने ईर्युतीए छीअे ॥१-४॥

महात्मा छतां पश्च गायो चारता भगवानना चरणानी २४ने गोपीओ, भीलीओ, खड अने लताओ

जेम ईर्युते, अने गोवाणो पश्च जेम तेमना चरणाना स्पर्शने ईर्युते छे, तेम अमे

पश्च ईर्युतीए छीअे ॥५॥

इति श्रीमद् महापुराण भागवतना दशम ऋक्यनो त्याशीमो अद्याय संपूर्णः ।

अद्याय ८४

कुरुक्षेत्रमां वसुष्टेवश्चुये करेलो यज्ञः ।

शुकदेवज्ञ कહे छे हे राजा ! कुंती, गांधारी, द्रौपदी, सुभद्रा, राजाओनी स्त्रीओ अने श्रीकृष्णनी भक्त गोपीओ, आ प्रमाणे भगवाननी स्त्रीओनी सर्वना आत्मा श्रीकृष्ण भगवानमां स्नेह संबंधनी वात सांभणी, सर्वे बहु ज विस्मय पामी गई अने सर्वनां नेत्र प्रेमनां आंसुओथी छलकाई गयां ।<sup>१</sup> आ प्रमाणे स्त्रीओनी साथे स्त्रीओ अने पुरुषोनी साथे पुरुषो वातो करता हता, त्यां श्रीकृष्ण अने बणदेवज्ञानं दर्शन करवानी ईर्याथी वेदव्यास, नारद, च्यवन, देवल, असित, विश्वामित्र, शतानंद, भरद्वाज, गौतम, शिष्यो सहित महात्मा परशुराम, वसिष्ठ, गालव, भृगु, पुलस्त्य, कश्यप, अत्रि, मार्कण्डेय, बृहस्पति, द्वित, त्रित, एकत, सनक, सनन्दनादिकं ब्रह्माना पुत्रो, अंगिरा, अगस्त्य, याज्ञवल्क्य अने बीजा वामदेवादि ऋषिओ पश्च कुरुक्षेत्रमां आव्या ॥२-५॥ प्रथमथी बेठेला पांडवो,

तानानचुर्यथा सर्वे सहरामोऽच्युतोऽच्यत् । स्वागतासनपाद्यार्थमाल्यधूपानुलेपनैः ॥७॥

उवाच सुखमासीनान् भगवान् धर्मगुप्तनुः । सदसस्तस्य महतो यतवाचोऽनुशृणवतः ॥८॥

श्रीभगवानुवाच

अहो वयं जन्मभृतो लब्धं कात्स्येन तत्फलम् । देवानामपि दुष्प्रापं यद् योगे श्वरदर्शनम् ॥९॥

किं स्वल्पतपसां नृणामर्चायां देवचक्षुषाम् । दर्शनस्पर्शनप्रश्नप्रह्वपादार्चनादिकम् ॥१०॥

न ह्यम्यानि तीर्थानि न देवा मृच्छिलामयाः । ते पुनन्त्युरुकालेन दर्शनादेव साधवः ॥११॥

नागिनं सूर्यो न च चन्द्रतारका न भूर्जलं खं श्वसनोऽथ वाङ्मनः ।

उपासिता भेदकृतो हरन्त्यवं विपश्चितो ज्ञन्ति मुहूर्तसेवया ॥१२॥

यस्यात्मबुद्धिः कुणपे प्रिथातुके स्वधीः कलत्रादिषु भौम इज्यधीः ।

यत्तीर्थबुद्धिः सलिले न कर्हिचिज्जनेष्वभिज्ञेषु स एव गोखरः ॥१३॥

बणदेवज्ञ अने बीजा राजाओ आहि लोको पश्च जेओने जगत नमे छे ऐवा ते ऋषिओने ज्ञेई तरत उभा थઈने पगे लाग्या ॥<sup>६</sup> सर्वे लोकोअे तथा भगवाने स्वागत, आसन, पाद, अर्ध, पुष्प, धूप अने चंदनथी तेओनी यथायोग्य पूजा करी ॥<sup>७</sup> धर्मनुं रक्षणा करवा माटे जेष्ठे देह धर्यो हतो, ऐवा भगवाने ते मोटी सज्जामां भौन राखीने सर्वना सांभणतां सुखेथी बेठेला ते मुनिओने आ प्रमाणो किहुं ॥

भगवान कहे छे अहो ! देवताओने पश्च न मणे ऐवुं योगेश्वरोनुं दर्शन थयुं, तेथी अमारो जन्म सङ्खण थयो, अने जन्म धारणा करवानुं पूरेपूरुं फળ आजे अमोने मणी गयुं ॥<sup>८</sup> मात्र तीर्थस्नानादिक्ने तप माननारा अने मूर्तिने देवरूप माननारा मनुष्योने, आप लोकोनां दर्शन, स्पर्श, कुशल प्रश्न, नमस्कार अने चरणपूजन आहिनी प्राप्ति क्यांथी ज होय ?<sup>९</sup> जलमय तीर्थो मनुष्योने पवित्र करवामां समर्थ नथी एम नहि. अने माटी तथा पथरनी प्रतिमारूप देवो पवित्र नथी करता एम नहि, पश्च तेओ घणो काणे पवित्र करे छे, अने साधुलोको तो दर्शनथी ज पवित्र करे छे ॥<sup>१०</sup> अग्नि, सूर्य, चंद्र, अने तारा, तथा पृथ्वी, जग, आकाश, वायु, वाणी अने मन तेओना अभिमानी देवताओ ज्ञे उपासेला होय, तो ए अग्नि सूर्यादिक देवताओ जन्म मरण आपनार अशाननो नाश करी शक्ता नथी, पश्च प्राकृत फળ विशेषने आपे छे. परंतु भगवानना जे एकांतिक भक्तो छे ए तो क्षणमात्राना सेवनथी पाप मात्रने नाश करी नाखनारा छे ॥<sup>११</sup> जे माणस वात, पिता अने कफमय शरीरने विषे जेवी आत्मबुद्धि छे, ऐवी

श्रीशुक उवाच

निशम्येत्थं भगवतः कृष्णस्याकुण्ठमेधसः । वचो दुरन्वयं विप्रास्तूष्णीमासन् भ्रमद्बिद्यः १४  
चिरं विमृश्य मुनय ईश्वरस्येशितव्यताम् । जनसंग्रह इत्यूचुः स्मयन्तस्तं जगद्गुरुम् ॥१५

मुनय ऊचुः

यन्मायया तत्त्वविदुत्तमा वयं विमोहिता विश्वसृजामधीश्वराः ।  
यदीशितव्यायति गूढ ईह्या अहो विचित्रं भगवद्विचेष्टितम् ॥१६॥

अनीह एतद् बहुधैक आत्मना सृजत्यवत्यत्ति न बध्यते यथा ।

भौमैर्हि भूमिर्बहुनामरूपिणी अहो विभूमश्चरितं विडम्बनम् ॥१७॥

आत्मबुद्धि तत्त्ववेता पुरुषोने विषे करतो नथी. अने जे पुरुष स्त्री पुत्रादिकने विषे जेवी आत्मबुद्धि छे, ऐवी आत्मबुद्धि तत्त्ववेता पुरुषोने विषे करतो नथी. तथा जलभयतीर्थने विषे जेवी पूज्यभुद्धि छे ऐवी पूज्यभुद्धि जे पुरुष तत्त्ववेता पुरुषोने विषे करतो नथी. ते पुरुष मनुष्य होवा छतां बण्ड अने गर्दभ जेवो कहेलो छे.<sup>१३</sup>

शुकदेवज्ञ कहे छे अर्कुठित शानवाणा भगवान् श्रीकृष्णानुं आवुं दीनता भरेलुं वयन सांभणी जेओनी बुद्धिमां भ्रम थई गयो, ऐवा मुनिओ युप थई गया.<sup>१४</sup> पछी ऐ मुनिओ ए भगवाने देखाडेली दीनता विषे घण्टीवार सुधी विचार करीने हसतां हसतां भगवानने आ प्रमाणे कह्युं के आ दीनता लोकनी भर्यादा राखवाने माटे ज आप करो छो.<sup>१५</sup> जे माया द्वारा आप मनुष्य लीला करवा सारु गूढ रहीने अनीश्वरनी पेठे येष्टा करो छो, ते मायाथी तत्त्ववेता ओमां उत्तम अमो अने प्रजापतिओना अधिपतिओ पण मोह पामेला छे. आप तो मायाना अधिपति छतां मोह पामेलानी पेठे आचरण करो छो तेथी आपनी लीला अतकर्य जणाय छे.<sup>१६</sup> कर्माधीन येष्टाथी रहित, येतनतत्त्व तथा अयेतनतत्त्वना एक ज नियामक ऐवा आप, येतन तत्त्वथी विशिष्ट ऐवी अंतर्यामी शक्ति वडे ज्ञवोने तेनां तेनां कर्मोनां झणो आपवाने माटे देव मनुष्यादिकथी विशिष्ट बहुरुपे थईने आ जगतने झज्जो छो, पालन करो छो अने प्रलय करो छो, छतां पण ए कर्मनो तमोने लेप लागतो नथी, कारण के तमो ज्ञवोना कर्मोनी अपेक्षा राखीने ज ए कर्म करो छो. जेम कुंभारे बनावेला धटादिक विकारो वडे पृथ्वी एक होवा छतां बहु नाम अने रुपवाणी थाय छे. तेम चित् अचित् थी विशिष्ट ऐवा तमो ए सर्जेला, देव मनुष्यादिक विकारो वडे एक ऐवी

अथापि काले स्वजनाभिगुप्तये विभर्षि सत्त्वं खलनिग्रहाय च ।

स्वलीलया वेदपथं सनातनं वर्णाश्रमात्मा पुरुषः परो भवान् ॥१८॥

ब्रह्म ते हृदयं शुक्लं तपःस्वाध्यायसंयमैः । यत्रोपलब्धं सद् व्यक्तमव्यक्तं च ततः परम् ॥१९  
तस्माद् ब्रह्मकुलं ब्रह्मन् ! शास्रयोनेस्त्वमात्मनः । सभाजयसि सद्ग्राम तद् ब्रह्मण्याग्रणीर्भवान्  
अद्य नो जन्मसाफल्यं विद्यायास्तपसो दूशः । त्वया संगम्य सदृत्या यदन्तः श्रेयसां परः २१  
नमस्तस्मै भगवते कृष्णायाकुण्ठमेधसे । स्वयोगमाययाच्छ्रमहिने परमात्मने ॥२२  
न यं विद्वन्यामी भूपा एकारामाश्च वृथायाः । मायाजवनिकाच्छ्रमात्मानं कालमीश्वरम् २३  
यथा शयानः पुरुष आत्मानं गुणतत्त्वदृक् । नाममात्रेन्द्रियाभातं न वेद रहितं परम् ॥२४  
एवं त्वा नाममात्रेषु विषयेष्विन्द्रियेहया । मायया विभ्रमच्चितो न वेद स्मृत्युपप्लवात् ॥२५

पण प्रकृति जुदा जुदा नाम अने रुपवाणी थाय छे. आवुं जे तमारुं मनुष्यलोकमां जन्म धारणादिक यरित्र मात्र अनुकरणरूप ज छे.<sup>१०</sup> आप आवी रीते निरंजन छो, तोपण समयसर भक्त लोकोनुं रक्षण करवा सारु अने खण पुरुषोने शिक्षा करवा सारु शुद्ध सत्त्वमय अवतार धरो छो अने पोताना आचरणाथी सनातन वेद मार्गानुं पालन करो छो. वर्षा तथा आश्रमोना आश्रयरूप आप परमपुरुष छो.<sup>११</sup> जे वेद तमारुं शुद्ध हृदय छे अने जे वेदमां तप, स्वाध्याय अने संयमद्वारा शरीर अने आत्म तत्त्वथी विलक्षण ऐवुं आपनुं परब्रह्म परमात्म स्वरूप ज्ञात्वामां आवे छे.<sup>१२</sup> हे महाराज ! ऐटला माटे ज वेदने प्रवर्ताविनारा ब्राह्मणोनुं कुण, जे वेदथी जणाता आपने ज्ञात्वाना एक साधनरूप छे, ते ब्राह्मणोने आप पूजो छो, अने तेने लीधे आप ब्राह्मण भक्तोमां अग्रगण्य थईने कर्म करो छो.<sup>१०</sup>  
सत्पुरुषोनी गतिरूप आपनो समागम थवाथी आज अमारा जन्म, विद्या, तप अने शाननी सङ्खणता थई; केमके आप कल्याणोना परम अवधिरूप छो.<sup>११</sup> जे आप अर्कुठित शानवाणा अने पोतानी योगमायाथी गूढ महिमावाणा परमात्मा छो. ते आपने प्रशाम करीऐ छीऐ.<sup>१२</sup> आ आपनी साथे रहेनारा राजाओ अने याद्वा पण मायारूपी पडाथी ढंगयेला, ईश्वर, परमात्मा अने काणरूप आपने ज्ञाता नथी.<sup>१३</sup> जे भ स्वप्र अवस्थामां ते अवस्थाना विषयोने साचा मानतो सूतेलो पुरुष, पोताने नाम मात्र अने मनथी ज जणायेला सिंहादिकरूप माने छे, पण ते सिंहादिक रूपोथी रहित पोताना जगत अवस्थाना रुपने ज्ञातो नथी, तेमज नाम मात्र अने मनथी ज जणायेला जगत अवस्थाना विषयोमां ईद्रियोनी प्रवृत्तिरूप मायाथी भभी गयेला चित्तवाणो पुरुष, विवेकनो नाश थवाने

तस्याद्य ते दृशिमाद्विमघैधर्मर्थीर्थास्पदं हृदि कृतं सुविपक्षयोगैः ।  
उत्सिक्तभक्त्युपहताशयजीवकोशा आपुर्भवद्वितिमथोऽनुगृहाण भक्तान् ॥२६॥

श्रीशुक उवाच

इत्यनुज्ञाप्य दाशार्हं धृतराष्ट्रं युधिष्ठिरम् । राजर्भे ! स्वाश्रमान् गन्तुं मुनयो दधिरे मनः ॥२७  
तद् वीक्ष्य तानुपन्नज्य वसुदेवो महायशा । प्रणम्य चोपसंगृह्य बभाषेदं सुयन्त्रितः ॥२८

वसुदेव उवाच

नमो वः सर्वदेवेभ्य ऋषयः श्रोतुर्महर्थ । कर्मणा कर्मनिर्हारो यथा स्यान्नस्तदुच्यताम् ॥२९  
नारद उवाच

नातिचित्रमिदं विप्रा वसुदेवो बुभुत्सया । कृष्णं मत्वार्थकं यन्नः पृच्छति श्रेय आत्मनः ॥३०  
सन्निकर्षें हि मर्त्यानामनादरणकारणम् । गाङ्गः हित्वा यथान्याभ्मस्तत्रत्यो याति शुद्धये ॥३१  
यस्यानुभूतिः कालेन लयोत्पत्त्यादिनास्य वै । स्वतोऽन्यस्माच्च गुणतो न कुतश्चन रिष्यति ॥३२

लीढे तमारा वास्तविकं स्वरूपे ज्ञाणतो नथी ॥३२-३५ पापना समूहने दूर करनार,  
गंगाज्ञना आश्रयरूप अने परिपक्व योगवाणा पुरुषो ए पश्च मात्र हृदयमां ज  
धारेलां आपनां यरणारविंदने घणां पुण्योना योगथी आज अमे प्रत्यक्ष दीठां  
छे, माटे अमोने भक्त मानीने अमारा उपर अनुग्रह करो. वृद्धि पामेली भक्तिथी  
जे ओनुं लींग शरीर नष्ट थई गयुं हतुं ऐवा लोको ज आपने पाम्या छे, पश्च कोई  
बीजा पाम्या नथी ॥३६

शुकदेवज्ञ कहे छे हे राजा ! आ प्रमाणे स्तुति करी तथा श्रीकृष्ण, धृतराष्ट्र  
अने युधिष्ठिरनी आशा लઈ, मुनिओ ए पोतपोताना आश्रमोमां जवानुं मन  
कर्यु ॥३७ मोटी कीर्तिवाणा वसुदेवे ते ऋषिओ ए आश्रमोमां जता जोई तेओनी  
पासे आवी, प्रशाम करी, पग पकडी सावधानपशाथी आ प्रमाणे कहु ॥३८

वसुदेव कहे हे छे ऋषिओ ! सर्वे देवताओना निवासरूप आप लोकोने  
प्रशाम करे छुं. मारी विश्वसि सांभणवाने योग्य छो. जे जे कर्म जेवी रीते करवाथी  
कर्मोनो नाश थाय ते अमोने कहो ॥३९

नारदज्ञ कहे छे हे भ्रात्राणो ! श्रीकृष्णने पोताना बाणक मानीने वसुदेव  
पोताना कल्याणनुं साधन ज्ञाणवानी ईच्छाथी आपणने पूछे छे, ए मोटुं आश्र्य  
नथी ॥४० आ जगतमां पासे रहेवुं ए अनादरनुं कारण थाय छे. गंगाज्ञने कांठे  
रहेनारो माणस गंगाज्ञनां जणने मूकीने पोतानी शुद्धिने माटे बीज तीर्थमां  
जाय छे ॥४१ जेनुं ज्ञान कोई काणे करीने, आ जगतनी उत्पत्ति लयादिकथी, पोताथी,

तं क्लेशकर्मपरिपाकगुणप्रवाहैव्याहतानुभवमीश्वरमद्वितीयम् ।

प्राणादिभिः स्वविभवैरुपगूढमन्यो मन्येत सूर्यमिव मेघहिमोपरागैः ॥३३॥

अथोचुमुनयो राजन्नाभाष्यानकदुन्दुभिम् । सर्वेषां शृणवतां राज्ञां तथैवाच्युतरामयोः ॥३४  
कर्मणा कर्मनिर्हार एष साधु निस्तप्तिः । यच्छ्रद्धया यजेद् विष्णुं सर्वयज्ञेश्वरं मखैः ॥३५  
चित्तस्योपशमोऽयं वै कविभिः शास्त्रचक्षुषा । दर्शितः सुगमो योगो धर्मश्चात्ममुदावहः ३६  
अयं स्वस्त्ययनः पन्था द्विजातेर्गृहमेधिनः । यच्छ्रद्धयाऽऽसवित्तेन शुक्लेनेज्येत पूरुषः ॥३७  
वित्तैषणां यज्ञदानैर्गैर्दर्शरसुतैषणाम् । आत्मलोकैषणां देव ! कालेन विसृजेद् बुधः ।

ग्रामे त्यक्तैषणाः सर्वे ययुर्धीरास्तपोवनम् ॥३८

ऋणैस्त्रिभिर्द्विजो जातो देवर्षिपृष्ठाणां प्रभो ! यज्ञाध्ययनपुत्रैस्तान्यनिस्तीर्य त्यजन् पतेत् ॥३९  
त्वं त्वद्य मुक्तो द्वाभ्यां वै ऋषिपित्रोर्महामते ! । यज्ञैर्देवर्णमुन्मुच्य निर्दृष्टिं शरणो भव ॥४०

बीजाथी के दृपांतरादिक थवाथी पश्च नाश पामतुं नथी, ते श्रीकृष्ण के जे अद्वितीय,  
ईश्वर अने अबंडित ज्ञानस्वरूप छे तेने बीज लोको, जे म सूर्यने वाइणां, हिम  
अने राहुथी ढंकाएलो माने, तेम क्लेश, कर्म, सुख-दुःख, गुणना प्रवाह अने  
पोतानां कार्यरूप प्राणादिकथी ढंकाएला माने, ए कांઈ आश्र्य नथी ॥३२-३३

शुकदेवज्ञ कहे छे हे राजा ! पछी ए मुनिओ ए सर्वे राजाओ तथा श्रीकृष्ण  
अने बणदेवज्ञना सांभणतां वसुदेवने संबोधन आपीने आ प्रमाणे कहु ॥३४

भ्रात्राणो कहे छे सर्वज्ञानोना ईश्वर विष्णुनुं यज्ञोथी श्रद्धापूर्वक यज्ञन करवुं,  
ए ज सौथी सारो कर्मदूर करवानो उपाय विद्वानो ए कहेलो छे ॥३५ विष्णुनी  
आराधनारूप आ धर्म, चित्तनी शान्तिने आपनारो छे, मोक्ष सुखने आपनारो  
छे. एटला ज माटे आज सुगम उपाय विद्वानो ए शास्त्ररूप दृष्टिथी बतावेलो  
छे ॥३६ न्याय मार्ग भेणवेला धनथी श्रद्धापूर्वक ईश्वरनुं यज्ञन करवुं, एज  
गृहस्थाश्रमवाणा द्विजलोकोने कल्याण आपनारो मार्ग छे ॥३७ हे वसुदेव ! समजु  
पुरुषे धनना फणरूप यज्ञो अने दानो करीने धननी ईच्छा छोडी देवी, धरना  
भोग भोगवीने स्त्री अने पुत्रनी तृष्णा छोडी देवी अने जगतने नाश पामनारुं  
जाणीने पोताने प्रतिष्ठानी तथा स्वर्गादिक लोकनी तृष्णा पश्च छोडी देवी ॥३८ सधणा  
धीर पुरुषो गामनी तथा राज्यनी सर्वे तृष्णा छोडी दृष्टिने तपोवनमां गया छे. हे  
वसुदेव ! देव, ऋषि अने पितृना त्राण ऋषि साथे लईने द्विज लोको जन्मे छे. माटे  
यज्ञथी देवना ऋषाने, वेदाध्ययनथी ऋषिओ ऋषाने अने पुत्र उत्पत्ति करवाथी  
पितृना ऋषाने दूर कर्या विना जे संसारनो त्याग करे ते पतित थाय ॥३९-४०

वसुदेव ! भवान् नूनं भक्त्या परमया हरिम् । जगतामीश्वरं प्रार्चः स यद् वां पुत्रां गतः ॥४१

श्रीशुक उवाच

इति तद्वचनं श्रुत्वा वसुदेवो महामनाः । तानृषीनृत्विजो वदे मूर्धाऽऽनम्य प्रसाद्य च ॥४२  
त एनमृषयो राजन् ! वृता धर्मेण धार्मिकम् । तस्मिन्नियाजयन् क्षेत्रे मखैरुत्तमकल्पकैः ॥४३  
तदीक्षायां प्रवृत्तायां वृष्णयः पुष्ट्रकर्सजः । स्नाताः सुवाससो राजन् ! राजानः सुष्ठुवलंकृताः ॥४४  
तन्महिष्यश्च मुदिता निष्ककण्ठयः सुवाससः । दीक्षाशालामुपाजग्मुरालिमा वस्तुपाणयः ॥४५  
नेदुर्मृदङ्गपटहशुभेर्यनकादयः । ननृत्नर्नतर्तक्यस्तुष्टुवः सूतमागधाः ।

जगुः सुकण्ठगो गच्छर्वः सङ्गीतं सहभर्तृकाः ॥४६॥

तमभ्यषिञ्चन् विधिवदक्तमभ्यक्तमृत्विजः । पत्नीभिरष्टादशभिः सोमराजमिवोदुभिः ॥४७  
ताभिर्दुर्कूलवलयैर्हरन्नूपरकुण्डलैः । स्वलंकृताभिर्विबभौ दीक्षितोऽजिनसंवृतः ॥४८  
तस्यत्विजो महाराज रत्नकौशेयवाससः । ससदस्या विरेजुस्ते यथा वृत्रहणोऽधरे ॥४९

હे मोटी बुद्धिवाणा ! तमे तो हमणां ऋषि अने पितृना बे ऋषाथी मुक्त थया छो  
अने हवे यशो करवाथी देवनुं ऋषा दूर करीने ऋषा मुक्त थई घरमांथी चाली  
नीकणो ॥<sup>१</sup>

शुक्टेवज्ञ कहे हे मोटा मनवाणा वसुदेवे आ प्रमाणो तेओनुं वयन सांभणी,  
ते ऋषिओने मस्तकथी प्रशाम करी तथा राज्ञ करीने ऋत्विजनुं काम करवा सारु  
वराव्या ॥<sup>२</sup> हे राजा ! धर्मनी रीते वरावेला ते ऋषिओअे कुरुक्षेत्रमां धर्मात्मा  
वसुदेवने उत्तम रयनावाणा यशोथी यज्ञन कराववा लाग्या ॥<sup>३</sup> वसुदेवे यशनी  
दीक्षा लेतां यादवो अने राजाओअे स्नान करी, सारां वस्त्र अने कमणी माणाओ  
पहेरीने उत्तम शाशगार धरी लीधा ॥<sup>४</sup> राज्ञ थयेली यंदनादिकना लेपनवाणी,  
कंठमां आभूषणवाणी अने सारां वस्त्र धरनारी वसुदेवनी स्त्रीओ पूजनना पदार्थ  
लईने दीक्षानी शाणामां आवी ॥<sup>५</sup> मृदुंग, पटह, शंभ, भेरी अने आनंक आदि  
वाज्ञ वागवा लाग्यां, नट अने नर्तकीओ नाचवा लागी, सूत अने मागधो स्तुति  
करवा लाग्या, सारा स्वरवाणी गांधर्वनी स्त्रीओ पोताना पतिओनी साथे गायन  
करवा लागी ॥<sup>६</sup> यंद्रमानो जेम रोहिणी आदि स्त्रीओनी साथे अभिषेक कर्यो  
हतो, तेम वसुदेवनो पश तेमना नेत्रमां आंजश अंजावी तथा शरीरमां माखणानुं  
लेपन करावी, तेमनी अढार स्त्रीओ साथे ऋत्विजोअे अभिषेक कर्यो ॥<sup>७</sup> दीक्षा  
पामेला अने मृगयर्म जेषो ओढ्युं हतुं, ऐवा वसुदेव वस्त्र, कंकण, हार, झंझर  
अने कुंडणोथी सारी रीते शाशगारेली स्त्रीओथी शोभता हता ॥<sup>८</sup> हे राजा ! ईद्रना

तदा रामश्च कृष्णश्च स्वैः स्वैर्बन्धुभिरन्वितौ । रेजतुः स्वसुतैर्दैर्जीवेशौ स्वविभूतिभिः ॥५०  
ईजेऽनुयज्ञं विधिना अग्निहोत्रादिलक्षणैः । प्राकृतैर्वैकृतैर्यज्ञैर्द्रव्यज्ञानक्रियेश्वरम् ॥५१  
अर्थात्विग्य्योऽददात् काले यथामातं स दक्षिणाः । स्वलंकृतेभ्योऽलंकृत्य गोभूकन्या महाधनाः ॥  
पत्नीसंयाजावभृथैश्वरित्वा ते महर्षयः । सस्त्रू रामहृदे विप्रा यजमानपुरःसराः ॥५३  
स्नातोऽलङ्घारवासांसि वन्दिभ्योऽदात् तथा स्त्रियः । ततः स्वलंकृतो वर्णनाश्वभ्योऽन्नेन पूजयत् ॥  
बन्धून् सदारान् ससुतान् पारिबर्हेण भूयसा । विदर्भकोसलकुरुन् काशिकेकयसृज्जयान् ॥५५  
सदस्यात्विक्षुरुगणान् नृभूतपितृचारणान् । श्रीनिकेतमनुजाप्य शंसन्तः प्रययुः क्रतुम् ॥५६  
धृतराष्ट्रोऽनुजः पार्थी भीष्मो द्रोणः पृथा यमौ । नारदे भगवान् व्यासः सुहृत्सम्बन्धिबाध्यावाः ॥५७  
बन्धून् परिष्वज्य यदून् सौहृदात् क्लिन्नचेतसः । ययुर्विरहकृच्छ्रेण स्वदेशांश्चापरे जनाः ॥५८  
नन्दस्तु सह गोपालैर्बृहत्या पूजयार्चितः । कृष्णरामोग्रसेनाद्यन्यवात्सीद् बन्धुवत्सलः ॥५९

यशमां जेम ऋत्विजो अने सभासदो शोत्प्या हता, तेम वसुदेवना यशमां पश  
ऋत्विजो अने सभासदो शोभता हता, अने तेओओे रत्न तथा रेशभी वस्त्र धार्या  
हतां ॥<sup>१०</sup> ते समयमां सर्वज्ञवोना स्वाभी श्रीकृष्ण अने बणदेव पश पोतपोताना  
बंधुओनी साथे पुत्रो, स्त्रीओ अने पोतानी विभूतिओथी शोभता हता ॥<sup>११</sup> वसुदेवे  
प्रत्येक यशमां विधि सहित अग्निहोत्रादिक प्रकृति अने विकृतिरूप यशोथी द्रव्य,  
मंत्र अने कर्मोना ईश्वर विष्णुनुं यज्ञन कर्यु ॥<sup>१२</sup> पछी समयसर शास्त्रमां कहेला  
विधि प्रमाणे सारी रीते शाशगारेला ऋत्विज ब्राह्मणोने गाय, पृथ्वी, उत्तम  
कन्या अने धननी दक्षिणाओ आपी ॥<sup>१३</sup> ‘पत्नीसंयाज’ अने अवभृथ्य नामनी  
कियाओ करावीने पछी मोटा ऋषिओ अने ब्राह्मणो यजमानने आगण करी,  
परशुरामना धरामां नाह्या ॥<sup>१४</sup> त्यारपछी सारा शाशगार धरीने वसुदेवे तथा  
तेमनी स्त्रीओअे बंदिजनोने अलंकार तथा वस्त्रो आप्यां अने सर्वे वार्षोने तथा  
कूतरां पर्यंत सर्वे प्राणीओने पश अस्थी प्रसन्न कर्यां ॥<sup>१५</sup> बंधुओ अने तेनी स्त्रीओ,  
तेओोना पुत्रो, सभासदो, ऋत्विजो, देवना गण, मनुष्य, भूत, पितृ, चाराण  
अने विदर्भ, क्षेत्र, कुरु, काशी, केक्य तथा सुंजय वंशना क्षत्रियोनुं धारी धारी  
पहेरामणीथी पूजन कर्यु ॥<sup>१६</sup> पछी ऐ सर्वे लोको भगवाननी आज्ञा लई, यशना  
वभाषा करता करता त्यांथी गया ॥<sup>१७-१८</sup> धृतराष्ट्र, विद्वर, भीष्म, द्रोण, कुंती,  
युधिष्ठिर, भीम, अर्जुन, नकुल, सहदेव, महात्मा नारदज्ञ, व्यास, भित्रो,  
संबंधीओ अने बांधवो के जेओनां चित स्नेहथी पलणी गयां हतां, तेओ पोताना  
संबंधी यादवोनुं आविंगन करी, विरहना कष्टथी मांडमांड स्वदेशमां गया, अने

वसुदेवोऽज्जसोत्तीर्य मनोरथमहार्णवम् । सुहृद्दृतः प्रीतमना नन्दमाह करे स्पृशन् ॥६०  
वसुदेव उवाच

भ्रातरीशकृतः पाशो नृणां यः स्वेहसंज्ञितः । तं दुस्त्यजमहं मन्ये शूराणामपि योगिनाम् ॥६१  
अस्मास्वप्रतिकल्पेयं यत् कृताज्ञेषु सत्तमैः । मैत्र्यपिताफला वापि न निवर्तते कर्हिचित् ॥६२  
प्रागकल्पाच्च कुशलं भ्रातर्वो नाचराम हि । अथुना श्रीमदान्धाक्षा न पश्यामः पुरः सतः ॥६३  
मा राज्यश्रीरभूत् पुंसः श्रेयस्कामस्य मानद! । स्वजनानुत्वस्थून् वा न पश्यति ययान्धदृक्

श्रीशुक उवाच

एवं सौहदशैथिल्यचित्त आनकदुन्दुभिः । रुरोद तकृतां मैत्री स्मरन्नश्रुविलोचनः ॥६५  
नन्दस्तु सख्युः प्रियकृत् प्रेम्णा गोविन्दरामयोः । अद्य श्व इति मासांस्त्रीन् यदुभिर्मानितोऽवसत्  
ततः कामैः पूर्यमाणः सव्रजः सहबान्धवः । परार्थ्याभरणक्षौमनानन्धर्परिच्छदैः ॥६७

बीजा लोको पाश गया ॥५७-५८ श्रीकृष्ण बण्डेवज्ज अने उग्रसेन आहि यादवो ए  
मोटी पूजाथी पूजेला अने बंधुओ पर प्रीति धरावनार नंदराय तो, गोवाणोनी  
साथे केटलाक दिवस सुधी त्यां ज रहा ॥५९ अनायासथी मनोरथरुपी  
महासागरनो पार पामी राज्ञ थयेला अने संबंधीओथी वींटाएला वसुदेवे हाथ  
आलीने नंदरायने आ प्रमाणो कह्युं ॥६०

वसुदेव कहे छे हे भाई ! मनुष्योने स्नेह नामनो जे पाश ईश्वरे नाखेलो  
छे, ते पाश शूरपुरुषोथी अने योगीओथी पाश छोडावो कठश छे एम हुं मानुं  
छुं ॥६१ कर्या उपकारने नहीं जाणारा अमलोकोनी साथे तमो महात्मा लोको ए  
करेली अनुपम मैत्री जो के प्रत्युपकार वगरनी छे, तोपाश कठी मटती ज नथी,  
तेथी ए तमोने ईश्वरे नाखेलो पाश छे एम जाणाय छे ॥६२ हे भाई ! आगण  
अमो अशक्त होवाथी तमाऱुं कांઈ भलुं करी शक्या नथी, अने हमणां लक्ष्मीना  
मदथी आंधणा थई जवाने लीधे आगण उभेला महात्माओने पाश देखता  
नथी ॥६३ हे मान आपनारा ! कल्याणने ईश्छनारा पुरुषने राज्य लक्ष्मी प्राप्त  
थशो मा; केमके अथी आंधणो थअेलो पुरुष पोताना आश्रितो अने बंधुओने  
पाश देखतो नथी ॥६४

शुकदेवज्ज कहे छे आ प्रमाणो स्नेहथी चित्त शिथिल थई जतां, जेनां नेत्रोमां  
अश्वु आवी गयां ऐवा वसुदेव, नंदराये करेला उपकारने संभारीने रोई पड्या ॥६५  
यादवो ए मान आपेला अने पोताना भित्र वसुदेवने राज्ञ करता नंदराय श्रीकृष्ण  
अने बणभद्रना प्रेमथी आज्ञाकाल करतां त्राजा भाजिना सुधी त्यां रह्या ॥६६ पछी

वसुदेवोग्रसेनाभ्यां कृष्णोद्धवबलादिभिः । दत्तमादाय पारिबर्ह यापितो यदुभिर्यौ ॥६८  
नन्दो गोपाश्व गोप्यश्व गोविन्दचरणाम्बुजे । मनः क्षिसं पुनर्हर्तुमनीशा मथुरां ययुः ॥६९  
बन्धुषु प्रतियातेषु वृष्णयः कृष्णदेवताः । वीक्ष्य प्रावृष्मासन्नां ययुद्वारवतीं पुनः ॥७०  
जनेभ्यः कथयाञ्चक्रुर्यदुदेवमहोत्पवम् । यदासीनीर्थयात्रायां सुहृत्संदर्शनादिकम् ॥७१

इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्दे उत्तरार्थ  
तीर्थयात्रानुवर्णनं नाम चतुरशीतितमोऽध्यायः ॥८४॥

### अथ पञ्चाशीतितमोऽध्यायः (८५)

श्रीबादरायणिरुवाच

अथैकदाऽऽन्तजौ ग्रासौ कृतपादाभिवन्दनौ । वसुदेवोऽभिनन्द्याह प्रीत्या सङ्कर्षणाच्युतौ ॥१  
मुनीनां स वचः श्रुत्वा पुत्रयोर्धामसूचकम् । तद्वीर्यजातविश्राम्भः परिभाष्याभ्यभाषत ॥२  
अभूत्य आभरण, रेशभी वस्त्र अने अनेक प्रकारना अभूत्य सामानोथी जेनी  
ईश्छा परिपूर्ण करवामां आवती हती ऐवा नंदराय, वसुदेव, उग्रसेन, श्रीकृष्ण,  
उद्धव अने बण्डेवाहि यादवो ए आपेली पहेरामाणी लष्ठने बांधवोनी साथे त्यांथी  
यात्या. यादवो ए तेमने पहेल्याइवा सारु मोटुं सैन्य साथे मोकल्युं ॥६७-६८  
श्रीकृष्णना चरणारविंदमां परोवाएला मनने पाण्डुं नहि खेंची शक्ता नंदराय,  
गोवाणो अने गोपीओ मथुरामां गया ॥६९ बंधुओ गया पछी श्रीकृष्णने ईष्टदेव  
माननारा यादवो वर्षांत्रितुने पासे आवेली जोई पाइशा द्वारकामां गया ॥७० तेओ ए  
तीर्थयात्रामां वसुदेवना यज्ञनो महोत्सव अने संबंधीओना समागम आहि जे  
कांઈ थयुं हतुं, ते सर्वे वात लोकोनी पासे कही देखाई ॥७१

इति श्रीमद्भागवतना भागवतना दशम स्कन्दनो चोराशीमो अद्याय संपूर्णः

### अद्याय ८५

वसुदेवने घ्रन्थज्ञाननो उपेश आपता तथा देवडीने पोताना  
ए पुत्रो लावी आपता श्रीकृष्ण भगवान्.

शुकदेवज्ज कहे छे हे राजा ! पछी एक दिवसे पासे आवीने पगे लागेला  
पोताना पुत्र श्रीकृष्ण अने बणभद्रने वसुदेवे प्रीतिथी सत्कार करीने कह्युं ॥७१ पुत्रोना  
प्रभावने सूचवनाऱुं मुनिओनुं वयन सांभणी, जे वसुदेवने ते पुत्रोना पराक्रमोथी  
विश्वास आव्यो हतो ते वसुदेवे संबोधन आपीने आ प्रमाणो कह्युं ॥७२

कृष्ण! कृष्ण! महायोगिन्! सङ्खर्षण! सनातन! । जाने वामस्य यत् साक्षात् प्रधानपुरुषो परौ  
यत्र येन यतो यस्य यस्मै यद् यद् यथा यदा । स्यादिदं भगवान् साक्षात् प्रधानपुरुषेश्वरः ॥४  
एतन्नानाविधं विश्वमात्मसृष्टमधोक्षज! । आत्मनानुप्रविश्यथात्मन्! प्राणो जीवो बिभृष्णजः ५  
प्राणादीनां विश्वसृजां शक्तयो याः परस्य ताः । पारतन्न्याद् वै सादृश्यादद्वयोश्चैव चेष्टाम् ६  
कान्तिस्तेजः प्रभा सत्ता चन्द्राग्न्यर्क्षविद्युताम् । यत् स्थैर्यं भूमेर्वृत्तिर्गच्छोऽर्थो भवान्  
तर्पणं प्राणनमपां देवत्वं ताश्च तद्रसः । ओजः सहो बलं चेष्टा गतिर्वायोस्तवेश्वर! ॥८  
दिशां त्वमवकाशोऽसि दिशः खं स्फोट आश्रयः । नादे वर्णस्त्वमोङ्गर आकृतीनां पृथक्षृतिः ९  
इन्द्रियं त्विन्द्रियाणां त्वं देवाश्च तदनुग्रहः । अवबोधो भवान् बुद्धर्जीवस्यानुस्मृतिः सती १०  
भूतानामसि भूतादिरन्दियाणां च तैजसः । वैकारिको विकल्पानां प्रधानमनुशायिनाम् ॥११

वसुदेव कुहे छे हे कृष्ण! हे भोटा योगी! हुं तमो बत्रेने आ जगतना  
कारण प्रधानपुरुष जाणुं छुं. (शुं अमो बत्रेने तमोभे प्रधानपुरुष जाण्या?) तो  
कुहे छे के नहि, तमो बत्रे प्रधानपुरुषथी विलक्षण छो, प्रधानपुरुष तो तमारं  
शरीर छे. अने तमो शरीरी आत्मा छो.<sup>३</sup> जेमां आ जगतनी उत्पत्ति, स्थिति  
अने लय पमाडवामां आवे छे, ते सर्वरूप भोऽय अने भोक्ताना नियंता साक्षात्  
तमे ज छो.<sup>४</sup> हे प्रभु! अजन्मा ऐवा तमो, पोते झज्जेला आ अनेक प्रकारना  
जगतमां पोताना रूपथी प्रवेश करी, कियाशक्ति अने ज्ञानशक्तिरूप थईने तेनुं  
पोषण अने धारण करो छो.<sup>५</sup> जगतना कारणरूप प्राणादिकनी जे शक्तिओ छे ते  
तमारी ज छे; केम्के येष्टा करनारा प्राणादिक पदार्थो परतंत्र छे, ज३ छे छतां  
येष्टावाणां छे, पश शक्तिवाणां नथी. जेम धास आदि पदार्थोमां यलन छे पश ते  
वायुनी शक्तिथी छे अने बाणमां जे वेग देखाय छे ए पुरुषनी शक्ति छे, तेम  
सर्वपदार्थोनी येष्टा तमारी शक्तिथी ज छे.<sup>६</sup> यंद्रनी कांति, अग्निनुं तेज, सूर्यनी  
प्रभा, नक्षत्र तथा विज्ञीनी स्फुरण सत्ता, पर्वतोनी स्थिरता अने पृथ्वीनी  
आधारता तथा गंध ए सर्वे आपनी ज शक्ति छे.<sup>७</sup> जण, तेनी तृप्त करवानी  
शक्ति, ऊवाडवानी शक्ति अने तेनो रस, ए सर्वे तमे ज छो. हे ईश्वर! वायुनुं  
जे प्रवृत्ति सामर्थ्य, वेग धारण सामर्थ्य, येष्टा अने गति छे ते तमारां छे.<sup>८</sup>  
दिशाओनो अवकाश, दिशाओ, आकाश, परा, पश्यंती अने मध्यमा वाणी, अने  
स्पष्ट अक्षरोरूप थईने आकृतिओने भिन्न भिन्न कुहेनारी वैभवीवाणी पश तमे  
ज छो.<sup>९</sup> ईद्रियोमां विषयोनो प्रकाश करवानी शक्ति, ईद्रियोना अनुग्राहक  
देवताओ, बुद्धिनी निश्चय शक्ति अने अंतःकरणानी उतम अनुसंधान शक्ति

नश्वरेष्विह भावेषु तदसि त्वमनश्वरम् । यथा द्रव्यविकारेषु द्रव्यमात्रं निरूपितम् ॥१२  
सत्त्वं रजस्तम इति गुणास्तद्वृत्तयश्च याः । त्वयद्वा ब्रह्मणि परे कल्पिता योगमायया ॥१३  
तस्मान्न सन्त्यमी भावा यहं त्वयि विकल्पिताः । त्वं चामीषु विकारेषु ह्यन्यदाव्यावहारिकः १४  
गुणप्रवाह एतस्मिन्नबुधास्त्वखिलात्मनः । गर्ति सूक्ष्मामबोधेन संसरन्तीह कर्मभिः ॥१५  
यदृच्छ्या नृतां प्राप्य सुकल्पामिह दुर्लभाम् । स्वार्थं प्रमत्स्य वयो गतं त्वम्नायेश्वर! ॥१६  
असावहं ममैवैते देहे चास्यान्वयादिषु । स्नेहपाशैर्निबध्नाति भवान् सर्वमिदं जगत् ॥१७  
युवां न नः सुतौ साक्षात् प्रधानपुरुषेश्वरो । भूभारक्षत्रक्षपण अवतीर्णं तथाऽत्थ ह ॥१८  
तते गतोऽस्म्यरणमद्य पदारविन्दमापन्नसंसृतिभयापहमार्तवन्मो ।

एतावतालमलमिन्द्रियलालसेन मर्त्यात्मदृक् त्वयि परे यदपत्यबुद्धिः ॥१९॥

तमे ज छो.<sup>१०</sup> पांचभूतनुं कारण तामसाहंकार, ईद्रियोनुं कारण राजसाहंकार,  
ईद्रियोना देवतानुं कारण सात्विकाहंकार अने ज्वोने संसारनुं कारण प्रधान  
प्रकृति तमोज छो.<sup>११</sup> जेम नाश पामनारा घट अने कुंडणादिक पदार्थोमां माटी  
अने सुवर्षादिक द्रव्य नाश पामनार नथी, तेम नाश पामनारा उपर कुहेला सर्वे  
पदार्थोमां जे नहि नाश पामनार पदार्थ छे ते तमे छो.<sup>१२</sup> सत्वादि त्रिशुगुण अने  
तेओना परिणामरूप महतत्वादिक पदार्थो साक्षात् तमारे विषे तमारा संकल्पथी  
कल्पयेला छे.<sup>१३</sup> एटलाज माटे आ सूष्णिने विषे सर्जयेला महदादिक भावो  
सर्वेश्वी विलक्षण ऐवा तमारे विषे नथी ज. ज्यारे ए प्रकृतिना विकारो तमारे  
विषे नथी ज, त्यारे तमो ए प्रकृतिना विकारोने विषे अंदर प्रवेशीने रहेला छो,  
आ विषयमां शास्त्रो प्रमाणरूप छे.<sup>१४</sup> आ गुणोना प्रवाहरूप संसारमां सर्वना  
आत्मा आपनी सूक्ष्मगतिने नहि ज्ञानारा लोको, देहाभिमानथी करेलां कर्मोने  
लीघे जन्म मरण पाभ्या करे छे.<sup>१५</sup> हे ईश्वर! समर्थ ईद्रियोवाणो मनुष्यदेह के  
जे अहीं दुर्लभ छे, तेने पाभ्या छतां जे हुं तमारी मायाथी स्वार्थ साधवामां  
प्रमाद धरावनार छुं, ते मारी धाणी अवस्था जती रही.<sup>१६</sup> आ देहमां “हुं छुं”  
ऐवा स्नेहपाशथी अने देहना पुत्रादिकोमां “आ मारा ज छे” ऐवा स्नेह पाशथी,  
तमे आ सर्वे जगतने बांधी लो छो.<sup>१७</sup> तमो अमारा पुत्र नथी पश प्रधान तथा  
पुरुषना ईश्वर छो अने पृथ्वीना भाररूप क्षत्रियोनो नाश करवा सारु अवतर्या  
छो, केम्के तमे ए प्रमाणो ज कुहेलुं छे.<sup>१८</sup> हे दीनबंधु! एटला माटे शरणागतोना  
संसाररूपी भयने दूर करनारां आपनां यरणारविंदने आज हुं शरणे आवेलो  
छुं. विषयोनी तृष्णा आटली राणी तेटलाथी ज धाणुं छे के जे तृष्णाथी मने शरीरमां

સૂતીગૃહે નનુ જગાદ ભવાનજો નૌ સંજ્ઞ ઇત્યનુયં નિજર્થમગુપ્તૈ ।  
નાનાતનૂર્ગનવદ્ વિદધજજહાસિ કો વેદ ભૂમન ઉરગાય વિભૂતિમાયામ् ॥૨૦॥

શ્રીશુક ઉવાચ

આકણ્યેથં પિતૃવાર્કયં ભગવાન् સાત્વતર્ષભઃ । પ્રત્યાહ પ્રશ્રયાનમ્રઃ પ્રહસભ્લક્ષણયા ગિરા ૨૧  
શ્રીભગવાનુવાચ

વચો વઃ સમવેતાર્થ તાતૈતુપમનમહે । યન્ત્રઃ પુત્રાન् સમુદ્દ્રય તત્ત્વગ્રામ ઉદાહૃતઃ ॥૨૨  
અહં યુયમસાવાર્ય ઇમે ચ દ્વારકોકસઃ । સર્વેજવ્યેં યદુશ્રેષ્ઠ ! વિમૃદ્ધયા: સच્ચાચરમ् ॥૨૩  
આત્મ હોકઃ સ્વયંજ્યોતિર્નિત્યોડન્યો નિર્ગુણો ગુણે: । આત્મસૃષ્ટેસ્તકૃતેષુ ભૂતેષુ બહુથેયતે ૨૪  
ખં વાયુજ્યોતિરાપો ભૂસ્તકૃતેષુ યથાશયમ् । આવિસ્તરોડલ્પભૂર્યેકો નાનાત્વ યાત્યસાવપિ ૨૫

આત્મબુદ્ધિ અને આપ ઈશ્વરમાં પુત્રબુદ્ધિ થયેલી છે.<sup>૧૬</sup> આપે સુવાડના ઘરમાં  
જ અમોને કહ્યું હતું કે “તમારું જ્યારે સુતપા અને પૃથ્બિનું જોડલું હતું, અને તે  
પછી કશ્યપ અને અદિતિરૂપ જોડલું હતું, અને હમણાં વસુદેવ અને દેવકીરૂપ  
જોડલું છે, ત્યારે તમારાથી હું અજન્મા છતાં જ જન્મ્યો હતો. અને જન્મ્યો છું.”  
તમે આકાશની પેટે અસંગ રહીને જ અનેક અવતાર ધરો છો અને મૂકો છો. હે  
પ્રભુ ! સર્વત્ર વ્યાપક એવા આપની વિભૂતિરૂપ માયાનો કોણ નિશ્ચય કરી શકે.<sup>૨૦</sup>

શુકદેવજી કહે છે યાદવોમાં ઉત્તમ અને વિનયથી નમ્ર બનેલા ભગવાને,  
આ પ્રમાણે પિતાનું વચન સાંભળી, હસતાં હસતાં મધુર વાણીથી તેમણે આ  
પ્રમાણે કહ્યું.<sup>૨૧</sup>

ભગવાન કહે છે હે હે પિતા ! અમે તમારા પુત્રો છીએ, તેઓના વિષયમાં તમે  
જે તત્ત્વના સમૂહનું સારી રીતે નિરૂપણ કર્યું, તે તમારા વચનને અમો યથાર્થ  
માનીએ છીએ.<sup>૨૨</sup> હે યાદવોમાં ઉત્તમ ! હું, તમે, આ મોટાભાઈ, દ્વારકાના  
રહેવાસીઓ અને સર્વે આ સ્થાવર જંગમોના વિષયમાં પણ તમારે એવો વિચાર  
જ રાખવો.<sup>૨૩</sup> પરમાત્મા એક છે, સ્વયં પ્રકાશ છે, નિત્ય છે, પ્રાકૃતગુણોથી રહિત  
છે, સ્વરૂપે કરીને સર્વથી વિલક્ષણ છે, છતાં પણ પોતે જ સર્જેલા ગુણોના  
પરિણામભૂત મહદાદિક તત્ત્વોદ્ધારા સર્જયેલા દેવ મનુષ્યાદિક ભૂતોને વિષે વ્યાપ  
જણાય છે. જેમ આકાશાદિ પાંચભૂતો વ્યાપ્યને અનુસારે આવિર્ભાવ, તિરોભાવ,  
અભ્યભાવ, બૃહદ્ભાવ, એકભાવ અને અનેકભાવને પામે છે. તેમ આ પરમાત્મા  
પણ ક્યારેક આવિર્ભાવ, ક્યારેક તિરોભાવ, ક્યારેક અભ્યભાવ, ક્યારેક  
બૃહદ્ભાવ અને સ્વત : એક હોવા છતાં વ્યાપીને અનેક ભાવને પામે છે.<sup>૨૪-૨૫</sup>

શ્રીશુક ઉવાચ

એવં ભગવતા રાજન્ ! વસુદેવ ઉદાહૃતમ् । શ્રુત્વા વિનષ્ટનાનાધીસ્તૂપ્ણી પ્રીતમના અભૂત ॥૨૬  
અથ તત્ત્વ કુરુશ્રેષ્ઠ ! દેવકી સર્વદેવતા । શ્રુત્વાડનીતં ગુરો: પુત્રમાત્મજાભ્યાં સુવિસ્મિતા ॥૨૭  
કૃષ્ણરામૌ સમાશ્રાવ્ય પુત્રાન્ કંસવિહિસિતાન્ । સ્મરની કૃપણ પ્રાહ વૈકલ્પ્યાદશ્રુલોચના ૨૮  
દેવક્યુવાચ

રામ ! રામાપ્રમેયાત્મન ! કૃષ્ણ ! યોગેશ્વરેશ્વર ! । વેદાં વાં વિશ્વસ્ત્રજામીશ્વરાવાદિપૂરૂષો ॥૨૯  
કાલવિધ્વસ્તસત્ત્વાનાં રાજામુચ્છાસ્ત્રવર્તિનામ । ભૂમેભરાયમાણાનામવતીર્ણી કિલાદ્ય મે ૩૦  
યસ્યાંશાંશાંશભાગેન વિશ્વોત્પત્તિલયોદ્યા: । ભવન્તિ કિલ વિશ્વાત્મસં ત્વાદ્યાં ગર્તિ ગતા ૩૧  
ચિરાન્મતસુતાદાને ગુરુણ કાલચોદિતૌ । આનિન્યથુ: પિતૃસ્થાનાદ ગુરવે ગુરુદક્ષિણામ્ ॥૩૨  
તથા મે કુરુતં કામં યુવાં યોગેશ્વરેશ્વરૌ । ભોજરાજહતાન્ પુત્રાન્ કામયે દ્રષ્ટુમાહતાન્ ॥૩૩  
ત્રણિષુવાચ

એવં સંજ્ઞોદિતૌ માત્રા રામ: કૃષ્ણ ભારત ! । સુતલં સંવિવિશતુર્યોગમાયામુપાશ્રિતૌ ॥૩૪

શુકદેવજી કહે છે હે રાજા ! આ પ્રમાણે ભગવાનનાં વચન સાંભળી રાજ  
થયેલા અને જેની ભેદબુદ્ધિ મટી ગઈ એવા વસુદેવ ચુપ રહ્યા. <sup>૨૬</sup> પછી પોતાના  
પુત્રોએ ગુરુના પુત્રને લાવી દીધેલો સાંભળી બહુ જ વિસ્મય પામેલાં, કંસે મારી  
નાખેલા પોતાના આગલા પુત્રોને સંભારતાં, સર્વમાં માન પામેલાં અને વિહણતાથી  
જેનાં નેત્રમાં આંસુ હતાં એવાં દેવકીએ, ત્યાં શ્રીકૃષ્ણ અને બળદેવજીને બોલાવીને  
આ પ્રમાણે દીનવચન કહ્યું. <sup>૨૭-૨૮</sup>

દેવકી કહે છે હે હે બળદેવ ! હે કણ્યામાં ન આવે એવા સ્વરૂપવાળા ! હે કૃષ્ણ !  
હે યોગેશ્વરોના ઈશ્વર ! તમો બસે પ્રજાપતિઓના ઈશ્વર અને આદિ પુરુષ છો  
એમ હું જાણું છું. <sup>૨૯</sup> કાળથી સત્ત્વગુણ નાશ પામતાં શાસ્ત્રોનું ઉલ્લંઘન કરી વર્તનારા  
અને પૃથ્વીને ભાર જેવા લાગતા રાજાઓનો નાશ કરવાને માટે, તમો મારા ઉદ્રથી  
અવતર્યા છો. <sup>૩૦</sup> હે વિશ્વના આત્મા ! જેના અંશના અંશરૂપ માયાના ગુણોના  
લેશથી જગતની ઉત્પત્તાદિક થાય છે તે આપને હું શરણે આવેલી છું. <sup>૩૧</sup> હે ઈશ્વર !  
ધણા કાળથી મરી ગયેલા પુત્રને લાવી આપવા ગુરુએ આશા કરતાં, તમોએ  
યમલોકમાંથી તે પુત્રને લાવી, ગુરુને ગુરુદક્ષિણારૂપે આપ્યો હતો, તે પ્રમાણે  
મારી ઈશ્છાને પરિપૂર્ણ કરો. કંસે મારી નાખેલા મારા પુત્રોને તમોએ અહીં લાવી  
આપેલા જોવાને ઈશ્ચનું છું. <sup>૩૨-૩૩</sup>

શુકદેવજી કહે છે હે રાજા ! આ પ્રમાણે જનનીએ પ્રેરેલા બળદેવ અને

तस्मिन् प्रविष्ट्वा वुपलभ्य दैत्यराङ् विश्वात्मदैवं सुतरां तथाऽऽत्मनः ।  
 तद्वर्णनाहादपरिप्लुताशयः सद्यः समुत्थाय ननाम सान्वयः ॥३५॥  
 तयोः समानीय वरासनं मुदा निविष्ट्योस्तत्र महात्मनोस्तयोः ।  
 दधार पादाववनिज्य तज्जलं सवृन्द आब्रहा पुनद् यदम्बु ह ॥३६॥  
 समर्हयामास स तौ विभूतिभिर्महार्हवस्त्राभरणानुलेपनैः ।  
 ताम्बूलदीपामृतभक्षणादिभिः स्वगोत्रवित्तात्मसमर्पणेन च ॥३७॥  
 स इन्द्रसेनो भगवत्यदाम्बुजं बिभ्रम्बुः प्रेमविभिन्नया धिया ।  
 उवाच हानन्दजलाकुलेक्षणः प्रह्ल्योमा नृप गद्गदाक्षरम् ॥३८॥

## बलिरुचाच

नमोऽनन्ताय बृहते नमः कृष्णाय वेधसे । सांख्ययोगवित्तानाय ब्रह्मणे परमात्मने ॥३९  
 दर्शनं वां हि भूतानां दुष्प्रापं चाप्यदुर्लभम् । रजस्तमः स्वभावानां यत्रः प्रासौ यदृच्छ्या ॥४०  
 दैत्यदानवगन्धर्वाः सिद्धविद्याध्वचारणाः । यक्षरक्षः पिशाचाश्च भूतप्रमथनायकाः ॥४१॥

श्रीकृष्ण पोतानी योगमायाना बण्ठी पाताणमां गया.<sup>३४</sup> जगतना आत्मा तथा  
 देवतृप अने पोताना तो अत्यंत ईष्टदेव, ए बे भाईओने पाताणमां आवेला  
 ज्ञेई, तेमां दर्शनना आनन्दथी जेनुं अंतःकरण व्याम थई गयुं एवा बणिराजा,  
 तरत उठीने पोताना परिवार सहित पर्णे लाभ्या, अने प्रीतिथी तेओने उतम  
 आसन लावी आप्युं. तेओ बेठा पट्ठी तेओना चरण धोईने ते जण के, जेषो  
 ब्रह्मापर्यंत जगतने पवित्र कर्यु छे, तेने परिवार सहित बणिराजाए माथे  
 चढायुं.<sup>३५-३६</sup> उतम वस्त्र, आभरण, लेपन, तांबूल, दीप अने अमृतभोजन  
 आहि विभूतिओथी तथा पोताना वंश, धन अने देहना समर्पणथी बणिराजाए  
 तेओनी पूजा करी.<sup>३७</sup> हे राजा ! प्रेमथी आद्र थयेली बुद्धिथी भगवाननां  
 चरणारविंदने वारंवार धारणा करता, आनन्दनां आंसुथी व्याकुण नेत्रवाणा अने  
 जेनां रुवांडां उभां थई गयां छे, एवा बणिराजाए गद्गद वाणीथी तेओने आ  
 प्रमाणे कहुं.<sup>३८</sup>

बणिराजा कहे छे मोटा शेषनागरुपी आपने प्रणाम करुं छुं. जगतना  
 विधाता, सांख्य तथा योगने विस्तारनारा, ब्रह्म अने परमात्मातृप आप  
 श्रीकृष्णने प्रणाम करुं छुं.<sup>३९</sup> जेके आपनुं दर्शन प्राणीओने दुर्लभ छे, तोपण  
 केटलाकने सुलभ छे. केमके रजेगुणी अने तमोगुणी स्वभाववाणा अमोने  
 यदेयथाथी तमे दर्शन दीधुं.<sup>४०</sup> हैत्य, दानव, गंधर्व, सिद्ध, विद्याधर, चारण,

विशुद्धसत्त्वधाम्यद्वा त्वयि शास्त्रशरीरिणि । नित्यं निबद्धवैरास्ते वयं चाच्ये च तादूशा: ॥४२  
 केचनोद्भद्धवैरेण भक्त्या केचन कामतः । न तथा सत्त्वसंरब्धाः सन्निकृष्टाः सुरादयः ॥४३  
 इदमित्थमिति प्रायस्तव योगेश्वे श्वर ! । न विदन्त्यपि योगेशा योगमायां कुतो वयम् ॥४४  
 तत्रः प्रसीद निरपेक्षविमृग्ययुष्मत्पादादरविन्दधिषणान्यगृहान्धकूपात् ।  
 निष्क्रम्य विश्वशरणाङ्गध्युपलब्धवृत्तिः शान्तो यथैक उत सर्वसख्येश्वरामि ॥४५॥  
 शाध्यस्मानीशितव्येश निष्पापान् कुरु नः प्रभो ! । पुमान् यच्छ्रद्धयाऽऽतिष्ठश्वेदनाया विमुच्यते ।

## श्रीभगवानुवाच

आसन् मरीचेः षट् पुत्रा ऊर्णायां प्रथमेऽन्तरे । देवाः कं जहसुरीक्ष्य सुतां यभितुमुद्यतम् ॥४७  
 तेनासुरीमग्न् योनिमधुनावद्यकर्मणा । हिरण्यकशिपोर्जता नीतास्ते योगमायया ॥४८  
 देवक्या उदरे जाता राजन् कंसविहिंसिताः । सा ताज्ञेचत्यात्मजान् स्वांस्त इमेऽध्यासतेऽन्तिके  
 यक्ष, राक्षस, पिशाच, भूत, प्रमथना पतिअो, अमो तथा तेवा ज भीजा पण  
 लोको के जेओ साक्षात् शुद्ध सत्वमय अने वेदरूपी शरीरवाणा आपनी साथे  
 निरंतर वेर राखनारा छे, छतां पण तेओने तमारं दर्शन मणे छे, माटे ऐकलुं  
 दुर्लभ ज छे अेम कही शकातुं नथी.<sup>४९-५०</sup> जेवी रीते केटलाक लोको वेरथी, केटलाक  
 भक्तिथी, केटलाक कामथी तमारा स्वरूपने पाभ्या छे, तेवी रीते सत्यगुणवाणा  
 देवताओ पण पाभ्या नथी.<sup>५१</sup> हे ईश्वर ! धाणुं करीने योगीओ पण तमारी मायाने  
 जाणता नथी, त्यारे अमो तो क्यांथी जाणीअे ?<sup>५२</sup> ऐटला माटे अमारी उपर  
 एवी कृपा करो के जे कृपाथी निष्काम पुरुषोअे पण शोधवा योग्य आपना  
 चरणारविंदरुपी आश्रयथी पापयुक्त घररुपी उंडा खाडामांथी नीकणीने, वृक्षोना  
 भूणमां पोतानी भेणे ज पडेलां फ्लाइकथी आञ्जिका भेणवी, हुं शांत थईने  
 ऐकलो ज अथवा सर्वना भित्ररुप महात्मा पुरुषोनी साथे फ्लूं.<sup>५३</sup> हे सर्वना  
 स्वामी ! अमोने आशा करी निष्पाप करो, के जे आशाने श्रद्धाथी पाणनार पुरुष  
 विधिनिषेधना बंधनमांथी छूटे छे.<sup>५४</sup>

आ सर्व वातनी हा पाडीने भगवान कहे छे स्वायंभुव मन्वंतरमां मरीचि  
 ऋषिने उष्णां नामनी स्त्रीमां छ पुत्रो थया हता. ए छ देवो, पुत्रीमां मैथुन करवा  
 सज्ज थयेला ब्रह्माने ज्ञेईने हस्या हता.<sup>५५</sup> ते पापकर्मथी तरत असुरनी योनिने  
 पामीने हिरण्यकशिपुना पुत्रो थया हता. पट्ठी तेओने त्यांथी योगमाया लई  
 जतां देवकीना उदरथी जन्म्या हता के जेओने कंसे मारी नाभ्या. ए पोताना  
 पुत्रोनो देवकी शोक करे छे. ते आ छ जण तमारी पासे बेठा छे, माटे मातानो

इत एतान् प्रणेष्यामो मातृशोकापनुत्तये । ततः शापाद् विनिर्मुक्ता लोकं यास्यन्ति विज्वराः ५० स्मरोदीथः परिष्वङ्गः पतङ्गः क्षुद्रभृद् घृणी । घडिमे मत्प्रसादेन पुनर्यास्यन्ति सद्गतिम् ॥५१ इत्युक्त्वा तान् समादाय इन्द्रसेनेन पूजितौ । पुनर्द्वारवतीमेत्य मातुः पुत्रानयच्छताम् ॥५२ तान् दृष्ट्वा बालकान् देवी पुत्रस्नेहस्तुतस्तनी । परिष्वज्याङ्गमारोप्य मूर्ध्यजिग्रहभीक्षणाः ५३ अपाययत् स्तनं प्रीता सुतस्पर्शपरिप्लुता । मोहिता मायया विष्णोर्यथा सृष्टिः प्रवर्तते ॥५४ पीत्वामृतं पयस्तस्याः पीतशेषं गदाभृतः । नारायणाङ्गसंस्पर्शप्रतिलब्धात्मदर्शनाः ॥५५ ते नमस्कृत्य गोविन्दं देवकीं पितरं बलम् । मिथतं सर्वभूतानां यथुर्धर्म दिवौकसाम् ॥५६ तं दृष्ट्वा देवकी देवी मृतागमननिर्गमम् । मेने सुविस्मिता मायां कृष्णस्य रचितां नृप ! ॥५७ एवं विधान्यद्वुतानि कृष्णस्य परमात्मनः । वीर्याण्यनन्तवीर्यस्य सन्त्यनन्तानि भारत! ॥५८

## सूत उवाच

य इदमनुश्रुणोति श्रावयेद्वा मुरारे श्रृंगारमृतकीर्तेवर्णितं व्यासपुत्रैः ।  
जगदधिदिलं तद्वक्तसत्कर्णपूरं भगवति कृतचित्तो याति तत्क्षेमधाम ॥५९॥  
इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे उत्तरार्द्धे  
मृताग्रजानयनं नाम पञ्चाशीतितमोऽध्यायः ॥८५॥

शोक मटाडवा सारु तेऽनोने अहींथी लई जईशुं. त्यांथी शापमांथी धूटी संताप  
रहित थईने देवलोकमां जशे. ४४-५० स्मर, उद्गीथ, परिष्वंग, पतंग, क्षुद्रभृत  
अने धृणी ए आ छ जष्ण मारी कृपाथी देवलोक पाभ्या पैठी पाइशा मोक्ष पामशे. ५१

शुक्टेवज्जु कहे छे भणिराजाए पूजेला श्रीकृष्ण अने बण्टेवज्जु आ प्रमाणे  
कही, तेऽनोने लई द्वारकामां आवीने ते पुत्रो पोतानी मा देवकीने पाभ्या. ५२ ए  
बाणकोने जोई पुत्रना स्नेहथी जेने पानो आव्यो, ऐवां देवकी तेऽनोनुं आलिंगन  
करी खोणामां वारंवार तेऽनोनां माथा सूंधवा लाङ्यां. ५३ जगतनी सूष्टिने  
प्रवर्तावनारी विष्णुनी मायाथी मोह पामेलां अने पुत्रोना स्पर्शथी आनंदमां मग्न  
थयेलां देवकीए प्रीतिथी तेऽनोने स्तनपान कराव्युं. ५४ भगवाने पीतां बाकी रहेलुं  
ते देवकीनुं अमृत सरखुं दूध पीवाथी अने नारायणाना अंगना स्पर्शथी जेऽनोने  
आत्मशान मण्युं, ऐवा ए छ जष्ण भगवानने, देवकीने, वसुदेवने, अने  
बण्टेवज्जुने प्रणाम करी, सर्वे लोकोना देखतां देवलोकमां गया. ५५-५६ मृत्यु  
पामेलाओनुं आववुं अने पाइ जवुं जोईने विस्मय पामेलां देवकीए, ऐ सधणी  
भगवाने रयेली माया ज मानी. ५७ हे राजा ! अनंत शक्तिवाणा परमात्मा  
श्रीकृष्णानां आवां अहुत यरित्रो अनंत छे. ५८

अथ पञ्चाशीतितमोऽध्यायः (८६)

॥ राजोवाच ॥

ब्रह्मन्वेदितुमिच्छामः स्वसारं रामकृष्णायोः । यथोपयेमे विजयो या ममासीत् पितामही ॥१  
श्रीशुक उवाच

अर्जुनस्तीर्थयात्रायां पर्यटन्नवनीं प्रभुः । गतः प्रभासमशृणोम्मातुलेयीं स आत्मनः ॥२  
दुर्योधनाय रामस्तां दास्यतीति न चापरे । तल्लिप्पुः स यतिर्भूत्वा त्रिदण्डी द्वारकामगात् ॥३  
तत्र वै वार्षिकान् मासानवात्सीत् स्वार्थसाधकः । पैरैः सभाजितोऽभीक्षणं रामेणाजानता च सः ॥  
एकदा गृहमानीय आतिथ्येन निमन्त्र्य तम् । श्रद्धयोपहृतं भैक्ष्यं बलेन बुभुजे किल ॥५  
सोऽपश्यत्तत्र महतीं कन्यां वीरमनोहराम् । प्रीत्युत्कुलेक्षणस्तस्यां भावक्षुब्धं मनो दधे ॥६

सूत शौनक ऋषिने कहे छे शुक्टेवज्जु अे वर्णवेलां, जगतनां पापोने अत्यंत  
मटाडनारां अने भक्तोना कानने उत्तम आभूषणउपी आ मनोहर शीर्तिवाणा  
श्रीकृष्णानां यरित्रने जे भाणस भगवानमां यित राखीने सांभणे अथवा संभणावे  
ते भाणस भगवानना निर्भय स्थानकने पामे छे. ५६

इति श्रीमद् महापुराण भागवतना दशम रक्ष्यनो पंचाशीमो अद्याय संपूर्ण.

## अद्याय ८६

सुभद्रानुं हराणा करता अर्जुन तथा भिद्यिला नगरीमां जहने  
जनकराज्ञ अने श्रुतेव विप्रने आनंद आपता श्रीकृष्ण भगवान.

परीक्षित राजा पूछे छे हे महाराज ! बण्टेव तथा श्रीकृष्णानां बेन सुभद्रा  
के जे मारी दाढी हतां, तेमने अर्जुन जेवी रीते परेया ते जाणवाने ईच्छुं छुं. १

शुक्टेवज्जु कहे छे समर्थ अर्जुन तीर्थयात्रा करवा सारु पृथ्वीमां फरता  
प्रभासमां गया हता, त्यां तेमणे सांभण्युं के “पोताना मामा वसुदेवनी दीकरी  
सुभद्राने बण्टेव दुर्योधनने आपशे अने ते सगपण करवामां बीजाओनो मत  
नथी.” आ उपरथी ते कन्याने भेणववानी ईच्छाने लीघे, अर्जुन त्रिंदी संन्यासी  
थईने द्वारकामां गया. २-३ स्वार्थ साधवा सारु ते अर्जुन त्यां योमासाना चार  
महिना सुधी रह्या अने गामना लोको तथा अजाण्या बण्टेव पण तेमनो वारंवार  
सत्कार करता हता. ४ ऐक दिवस आतिथ्यनुं नोतरुं आपी घेर तेडी लावीने  
बण्टेवे श्रद्धाथी भिक्षा आपी, ते अर्जुन पाभ्या. ५ त्यां वीरपुरुषोना मनने हरनारी  
मोटी कन्या तेमना जेवामां आवी. जोईने प्रीतिथी जेनां नेत्र प्रकुल्लित थयां,

सापि तं चकमे वीक्ष्य नारीणां हृदयङ्गमम् । हसन्ती व्रीडितापाङ्गी तञ्चस्तहृदयेक्षणा ॥७  
तां परं समनुध्यायन्नन्तरं प्रेप्सुरजुनः । न लेभे शं भ्रमच्चितः कामेनातिबलीयसा ॥८  
महत्यां देवयात्रायां रथस्थां दुर्गनिर्गताम् । जहारानुमतः पित्रोः कृष्णस्य च महारथः ॥९  
रथस्थो धनुरादाय शूरांश्चारुन्धतो भटान् । विद्राव्य क्रोशतां स्वानां स्वभागं मृगराडिव १०  
तच्छुत्वा क्षुभितो रामः प्रवर्णीव महार्णवः । गृहीतपादः कृष्णेन सुहृद्दिश्चान्वशाम्यत ॥११  
प्राहिणोत् पारिबहृणि वरवध्वोर्मुदा बलः । महाधनोपस्करेभरथाश्वनरयोषितः ॥१२

## श्रीशुक उवाच

कृष्णस्यासीद् द्विजश्रेष्ठः श्रुतदेव इति श्रुतः । कृष्णौकभक्त्या पूर्णार्थः शान्तः कविरलम्पटः १३  
स उवास विदेहेषु मिथिलायां गृहाश्रमी । अनीह्याऽगतात्ताहार्यनिर्वितिनिजक्रियः ॥१४  
यात्रामात्रं त्वहरहदैवादुपनमत्युत । नाधिकं तावता तुष्टः क्रियाश्चक्रे यथोचिताः ॥१५

अेवा अर्जुननुं रतिनी ईर्याथी क्षोभ पामेलुं मन तेमां गयुं ॥६ तेमज ते कन्या  
पश्च स्त्रीओना भनने प्रिय लागनार अर्जुननी ईर्याकृती हती, तेथी ते तेनी  
सामुं लक्षित थई हसवा लागी । भनथी तेनो ज विचार करवा लागी, अने  
नेत्रथी तेने ज जोवा लागी ॥७ पछी तेनुं ज ध्यान करता, हरण करवानो लाग जोता  
अने अत्यंत बणवान कामदेवथी जेमनुं चित भमतुं हतुं, अेवा अर्जुनने सुख  
वयुं नहीं ॥८ पछी भोटी देवयात्राना प्रसंगमां रथमां बेसीने गढमांथी बहार  
नीकणेलां सुभद्राने तेमना भावाप अने श्रीकृष्णनी संमतिथी भहारथी अर्जुन  
हरी गया ॥९ रथमां बेठेला अर्जुन धनुष लईने, जे शूरा योद्धाओ पोताने रोकवा  
आव्या तेओने भगाडीने, सिंह जेम पोताना भागने लई जाय तेम संबंधीओनो  
कोलाहल छतां सुभद्राने लई गया ॥१० आ वात सांभणी, पूनमनी रातमां समुद्र  
जेम क्षोभ पामे तेम बणदेवकु खडु ज क्षोभ पाभ्या, पश्च श्रीकृष्ण तथा बीजां  
संबंधीओ पगमां पडतां शांत थया ॥११ पछी बलरामे धशा आनंदथी ते वरवहुने  
धशा भूत्यवान सरसामान, हाथीओ, रथ, घोडा, दास अने दासीओ आठि  
प्रीतिथी आपवाना पदार्थो भोक्तव्या ॥१२

अेक श्रुतदेव नामनो उत्तम ब्राह्मण श्रीकृष्णनो भक्त हतो । ए ब्राह्मण  
केवण भगवाननी ज भक्तिथी पोताने कृतार्थ माननार, शांत, विद्वान अने  
विषयोमां वैराग्यवाणो हतो ॥१३ विदेह देशथी मिथिला नगरीमां ए गृहस्थाश्रमी  
ब्राह्मण रहेतो हतो । उद्यम वगर जे कंट अन्नादिक आवे तेथी पोतानी कियाओ  
करतो हतो ॥१४ दूररोज देवगतिथी तेने निर्वाह जेटलुं मणी रहेतुं हतुं, ए ब्राह्मण

तथा तद्राष्ट्रपालोऽङ्ग बहुलाश्च इति श्रुतः । मैथिलो निरहम्मान उभावच्युतप्रियौ ॥१६  
तयोः प्रसन्नो भगवान् दारुकेणाहृतं रथम् । आरुह्य साकं मुनिभिर्विदेहान् प्रययौ प्रभुः ॥१७  
नारदो वामदेवोऽत्रिः कृष्णो रामोऽसितोऽरुणिः । अहं बृहस्पतिः कण्वो मैत्रेयश्चवनादयः ॥१८  
तत्र तत्र तमायान्तं पौरा जानपदा नृप ! । उपतस्थुः सार्वदहस्ता ग्रहैः सूर्यमिवोदितम् ॥१९  
आनर्तधन्वकुरुजाङ्गलकङ्गमत्स्यपाञ्चालकुन्निमधुकेकयकोसलार्णाः ।

अन्ये च तन्मुखसरोजमुदारहासन्निग्रहेक्षणं नृप ! पपुर्वशिभिर्नृनार्यः ॥२०॥

तेभ्यः स्ववीक्षणविनष्टतमिन्नदृग्भ्यः क्षेमं त्रिलोकगुरुरथैर्दृशं च यच्छन् ।

शृण्वन् दिगन्तधवलं स्वयशोऽशुभ्यं गीतं सुरैर्नृभिरगच्छनकैविदेहान् ॥२१॥

तेऽच्युतं प्रासमाकर्ण्य पौरा जानपदा नृप ! । अभीयुर्मुदितास्तस्मै गृहीतार्हणपाणयः ॥२२  
दृष्ट्वा त उत्तमश्लोकं प्रीत्युत्कुलाननाशयाः । कैर्धृताऽज्जलिभिर्नेमुः श्रुतपूर्वास्तथा मुनीन् ॥२३

तेटलाथी ज संतोष राखीने यथायोग्य कियाओ करतो हतो ॥२४ हे परीक्षित राजा !  
ए देशनो राजा जनकना वंशनो खडुलाश्च पश्च एवी ज रीते अहंकार रहित  
अने भगवाननो भक्त हतो, ए बज्जे श्रीकृष्णने प्रिय हता ॥२५ ते बज्जेनी उपर  
प्रसन्न थयेला श्रीकृष्ण भगवान रथमां बेसीने मुनिओनी साथे विदेह देशमां  
पधार्या ॥२६ नारद, वामदेव, आत्रि, वेदव्यास, परशुराम, असित, अरुणि, खुं,  
(शुकदेवल) खुहस्पति, कृष्ण, मैत्रेय अने अथवानादि मुनिओ तेमनी साथे हता ॥२७  
हे राजा ! विदेह देशमां जतां भगवान ज्यां ज्यां आव्या त्यां नगरना अने  
देशना लोको हाथमां अर्ध्य लईने तेमनी सामा आवता हता । ग्रहोनी साथे उगेला  
सूर्यने जेम मान आपे, तेम सर्वे लोको मुनिओनी साथे आवता श्रीकृष्णने मान  
आपता हता ॥२८ आनर्त, धन्व, कुरु, जंगल, कंक, मत्स्य, पांचाल, कुंति, मधु,  
केक्य, कोसल अने ऋषां देशमां रहेनारां तथा बीजां पश्च पुरुषो अने स्त्रीओ  
उदार हास्य अने स्नेह भरेली दृष्टिवाणा ते भगवानना मुखारविंदने नेत्रोथी  
पीतां हतां ॥२९ पोतानां दर्शनथी जेओनुं अज्ञान नाश पाम्युं हतुं एवा ते लोकोने  
अभय तथा तत्वज्ञान आपता अने दिशाओना छेडा सुधी झेलाएली, अशुभ  
मटाडनारी तथा देव अने मनुष्यो ए गायेली पोतानी उझवण कीर्तिने सांभणता  
श्रीकृष्ण भगवान धीरे धीरे विदेह देशमां पधार्या ॥३० हे राजा ! भगवानने आवेला  
सांभणी, राजा थयेला नगरना तथा देशना लोको हाथमां पूजनना पदार्थो लईने  
तेमनी सामे आव्या ॥३१ ते भोटी कीर्तिवाणा भगवानने तथा पूर्वे सांभणेला  
मुनिओने जेइ, जेओनां मुख अने अंतःकरण प्रीतिथी प्रकृतिवाण थयां हतां,

स्वानुग्रहाय सम्प्रासं मन्वानौ तं जगद्गुरुम् । मैथिलः श्रुतदेवश्च पादयोः पेततुः प्रभोः ॥२४  
 न्यमन्त्रयेतां दाशार्हमातिथ्येन सह द्विजैः । मैथिलः श्रुतदेवश्च युगपत् संहताञ्जली ॥२५  
 भगवांस्तदभिप्रेत्य द्वयोः प्रियचिकीर्षया । उभयोराविशद् गेहुभाभ्यां तदलक्षितः ॥२६  
 श्रोतुमप्यसतां दूरान् जनकः स्वगृहागतान् । आनीतेष्वासनाग्रयेषु सुखासीनान् महामनाः ॥२७  
 प्रवृद्धभक्त्या उद्दर्घहृदयास्त्राविलेक्षणः । नत्वा तदङ्गीन् प्रक्षत्य तदपो लोकपावनीः ॥२८  
 सकुटुम्बो वहन् मूर्धन् पूजयाञ्चक्र ईश्वरान् । गन्धमाल्याङ्गराकल्पधूपदीपार्घ्यगोवृष्टे ॥२९  
 वाचा मधुरया प्रीणन्निदमाहान्तर्पितान् । पादावङ्गतौ विष्णोः संप्यशञ्जनकैर्मदा ॥३०

राजोवाच

भवान् हि सर्वभूतानामात्मा साक्षी स्वदृग् विभो । अथ नस्त्वत्यदाभ्योजं स्मरतां दर्शनं गतः ३१  
स्ववच्चस्तदृतं कर्तुमस्मद्दृग्गोचरो भवान् । यदात्यैकान्तभक्तान्मे नानन्तः श्रीरजः प्रियः ३२

એવા તે લોકો જેઓના ઉપર અંજલિઓ ધરી હતી એવાં માથાઓથી તેઓને પગે લાગ્યા. અર્થાત્ માથા ઉપર હાથ જોડીને પગે લાગ્યા.<sup>23</sup> તે જગતના ગુરુલું ભગવાનને પોતાના ઉપર અનુગ્રહ કરવા સારુ આવેલા માની, બહુલાશ્ય રાજા અને શ્રુતદેવ પ્રાતિષ્ઠાનિક ભગવાનના ચરણમાં પડ્યા.<sup>24</sup> બહુલાશ્યે અને શ્રુતદેવે હાથ જોડી ભગવાનને મુનિઓની સાથે, એક જ સમયમાં મહેમાનીનાં નોતરાં આપ્યાં.<sup>25</sup> એ નોતરાંનો સ્વીકાર કરી, બસ્તેને રાજુ કરવા સારુ ભગવાન પ્રાતિષ્ઠાનોની સાથે બે રૂપ કરીને બસ્તેને ઘેર એક સમયમાં પધાર્યા, અને તે વાત બહુલાશ્ય તથા શ્રુતદેવના જાળવામાં આવી નહિ.<sup>26</sup> વૃદ્ધ પામેલી ભક્તિથી હદ્યમાં બહુ રાજુ થયેલા અને આંસુથી ભીનાં નેત્રવાળા ઉદાર જનક રાજાએ પોતાને ઘેર આવેલા અને નીચપુરુષોના તો સાંભળવામાં પડ્યા ન આવે, એવા એ મહાત્મા પુરુષોને પોતે આણેલાં ઉત્તમ આસનો પર સારી રીતે બેસાડી પ્રણામ કરીને તેઓના પગ ધોયા, અને લોકોને પવિત્ર કરનારા પગ ધોવાના જણને પોતાના કુટુંબ સહિત માથે ચઢાવ્યું. ગંધ, પુષ્પ, વસ્ત્ર, અલંકાર, ધૂપ, દીપ, અર્ધ્ય, ગાય અને બળદોથી તે મહાત્માઓનું પૂજન કર્યું.<sup>27-28</sup> અત્થથી તૃપુ કરેલા એ મહાત્માઓને મધુર વાણીથી રાજુ કરતા અને ખોળામાં લીધેલાં ભગવાનનાં ચરણને પ્રેમથી ધીરે ધીરે સ્પર્શ કરતા જનક રાજા આ પ્રમાણે બોલ્યા.<sup>30</sup>

બહુલાશ્ કહે છે હે પ્રભુ ! આપ સર્વપ્રાણીઓને ચેતના આપનાર સાક્ષી અને સ્વયંપ્રકાશ છો, એટલા માટે અમો કે જેઓ આપના ચરણારવિંદનું સ્મરણ કરનારા છીએ, તેઓને આપે દર્શન દીધું છે.<sup>૩૧</sup> મારા સાચા ભક્ત કરતાં મને

को नुत्त्वचरणाभोजमेवंविद् विसृजेत् पुमान् । निष्कञ्चनानां शान्तानां मुनीनां यस्त्वमात्मदः ॥  
 योऽवतीर्थं यदोर्वशे नृणां संसरतामिह । यज्ञो वितेने तच्छान्त्यै त्रैलोक्यवृजिनापहम् ॥३४  
 नमस्तुभ्यं भगवते कृष्णायाकुण्ठमेधसे । नारायणाय ऋषये सुशान्तं तप ईयुषे ॥३५  
 दिनानि कर्तिचिद् भूमन्! गृहान् नो निवस द्विजैः । समेतः पादरजसा पुनीहीदं निमेः कुलम् ॥३६  
 इत्युपामन्त्रितो राजा भगवांलोकभावनः । उवास कुर्वन् कल्याणं मिथिलानरयोधिताम् ॥३७  
 श्रुतदेवोऽच्युतं प्रासं स्वगृहाज्जनको यथा । नत्वा मुनीन् सुसंहृष्टे धन्वन् वासो नर्त ह ॥३८  
 तृणपीठवृसीष्वेतानानीतेषूपवेश्य सः । स्वागतेनाभिनन्द्याङ्गीन् सभार्योऽवनिजे मुदा ॥३९  
 तदभ्यसा महाभाग आत्मानं सग्रहान्वयम् । स्नापयाञ्चक्र उद्धर्षे लब्ध्यसर्वमनोरथः ॥४०

फलार्हणोशीरशिवामताम्बभिर्मदा सरभ्या तलसीकशाम्बजैः

आराध्यामास यथोपपन्नया सपर्यया सत्त्वविवर्धनान्धसा ॥४१॥

શેખનાગ, લક્ષ્મી કે બ્રહ્મા પણ વધારે ઘારા નથી” એમ જે આપે કહું છે, તે આપના વચનને સત્ય કરવા સારુ આપે અમને દર્શન દીધું.<sup>32</sup> આવાં આપનાં વચનને જાણનારો કયો પુરુષ આપના ચરણારવિંદનો ત્યાગ કરે? કે જે આપ નિર્જિયન અને શાંત મુનિઓને પોતાનું સ્વરૂપ આપો છો.<sup>33</sup> જેણે યદ્વિવંશમાં અવતરી, અહીં જન્મ મરણ પામતાં મનુષ્યોને સંસારમાંથી છોડાવવા સારુ ત્રિલોકના પાપને દૂર કરનારી કીર્તિ વિસ્તારી છે. તે અખંડ જ્ઞાનવાળા, અત્યંત શાંતિ ભરેલું તપ કરનાર, નારાયણ ઋષિરૂપ આપ શ્રીકૃષ્ણ ભગવાનને પ્રણામ કરું છું.<sup>34-35</sup> હે પ્રભુ! મુનિઓની સાથે કેટલાક દિવસ સુધી અમારા ઘરમાં રહો, અને ચરણારજથી આ નિમિરાજાના કુણને પવિત્ર કરો.<sup>36</sup>

શુકૃદેવજી કહે છે આ પ્રમાણે રાજાએ પ્રાર્થના કરતાં, લોકોના રક્ષક ભગવાન મિથિલા નગરીના પુરુષો અને સ્ત્રીઓનું કલ્યાણ કરવા સારુ ત્યાં રહ્યા. <sup>૩૭</sup> પોતાને ઘર આવેલા ભગવાન સહિત મુનિઓને પ્રણામ કરી, જનકરાજાની પેઠે બહુ જ રાજ થયેલો શુતર્દેવ બ્રાહ્મણ પણ પોતાનું વસ્ત્ર હલાવીને નાચવા લાગ્યો. <sup>૩૮</sup> તૃણમય ચટાઈ, બાજોઈ અને દર્ભાસન બિધાતી, તેના ઉપર ભગવાન શ્રીકૃષ્ણ અને મુનિઓને બેસાડી, સ્વાગત વચનથી સત્કાર કરી, પોતાની સ્ત્રી સહિત પ્રેમથી તેઓના પગ ધોયા. <sup>૩૯</sup> ભાગ્યશાળી, બહુજ હર્ષ પામેલ અને જેના સર્વે મનોરથ પૂરા થયા છે, એવા એ શુતર્દેવ બ્રાહ્મણો તેઓના પગધોવાના જળથી પોતાના શરીરને અને ઘરના કુટુંબને નવરાવ્યા. <sup>૪૦</sup> ફળ વાળાથી વાસેલાં શીતળ મીઠાં જળ, સુગંધી માટી, તુલસી, દર્ભ, કમળો એ આહિ અનાયાસે પ્રાપ્ત થયેલી

સ તર્કયામાસ કૃતો મમાન્વભૂદ્ ગૃહાસ્થકૂપે પતિતસ્ય સર્જમઃ ।  
ય: સર્વતીર્થસ્પદપાદરેણુભિ: કૃષ્ણો ચાસ્યાત્મનિકેતભૂસુરૈ: ॥૪૨॥

સૂપવિષન् કૃતાતિથ્યાન્ શ્રુતદેવ ઉપસ્થિત: । સભાર્યસ્વજનાપત્ય ઉવાચાંશ્વયભિમર્શન: ૪૩  
શ્રુતદેવ ઉવાચ

નાદ્ય નો દર્શનં પ્રાસ: પરં પરમપૂરુષ: । યર્હીદં શક્તિભિ: સૃષ્ટા પ્રવિષ્ટો હ્યાત્મસત્ત્વયા ॥૪૪  
યથા શયાન: પુરુષો મનસૈવાત્મમાયયા । સૃષ્ટા લોકં પરં સ્વાજમનુવિશ્યાવભાસતે ॥૪૫  
શૃષ્ટવતાં ગદતાં શશ્વદર્ચતાં ત્વાભિવન્દતામ્ । નૃણાં સંવદતામન્તર્હીદિ ભાસ્યમલાત્મનામ્ ॥૪૬  
હૃદસ્થોઽધ્યતિદૂરસ્થ: કર્મવિક્ષિપચેતસામ્ । આત્મશક્તિભિરગ્રાહોઽધ્યનન્યુપેતગુણાત્મનામ્ ॥૪૭  
નમોઽસ્તુ તેઽધ્યાત્મવિવદાં પરાત્મને સ્વાત્મવિભક્તમૃત્યવે ।

સકારણાકારણલિઙ્ગમીયુષે સ્વમાયયાસંવૃતરુદ્ધદૃષ્ટ્યે ॥૪૮॥

પૂજાની સામન્ની અને સત્વગુણને વધારનાર અન્ન વડે, બની શકી તેવી પૂજાથી તે મહાત્માઓની આરાધના કરી.<sup>૪૧</sup> એ બ્રાહ્મણ વિચાર કરવા લાગ્યો કે “જે હું ધરૂપી ઊંડી ખાઈમાં પડેલો છું, તે મને સર્વતીર્થોના સ્થાનકરૂપ શ્રીકૃષ્ણ અને તેમના પોતાના નિવાસ સ્થાનકરૂપ મુનિઓનો સમાગમ શા પુણ્યથી થયો?”<sup>૪૨</sup> પછી સુખેથી બેઠેલા અને જેઓનું આતિથ્ય કર્યું છે. એવા એ મહાત્માઓની પાસે પોતાની સ્ત્રી, સ્વજન અને સંતાનોની સાથે બેઠેલો અને પગ ચાંપતો શ્રુતદેવ બ્રાહ્મણ આ પ્રમાણે બોલ્યો.<sup>૪૩</sup>

શ્રુતદેવ કહે છે જે આપ પરમપુરુષ છો, તે આપ આજ જ અમને મળ્યા છો એમ નથી, પણ જ્યારે પોતાની શક્તિકરૂપ સત્વાદિગુણથી આ જગતને ઝજ્જને તેમાં પોતાની સત્તાથી પ્રવેશ્યા છો, ત્યારે જ મળ્યા છો, પરંતુ પ્રત્યક્ષ દર્શન આજે જ થયું, છે.<sup>૪૪</sup> જેમ સૂતેલો પુરુષ વાસનાને અનુસરનારા મનના સંકલ્પથી જ સ્વપ્ર અવસ્થાના બીજા દેહને ઝજ્જને તેમાં જાણે પ્રવેશ્યો હોય તેમ લાગે છે. ઇતાં તેનાથી પૃથક્ક છે. તેમ આપ પણ આ જગતને ઝજ્જને જાણે તેમાં પ્રવેશ્યા હો એમ જણાઓ છો.<sup>૪૫</sup> તમારું નિરંતર શ્રવણ કરતા, તમને પૂજતા, પ્રણામ કરતા અને તમારી જ વાતો કરતા નિર્મણ મનવાળા મનુષ્યોને પણ તમે હૃદયમાં જ દર્શન આપો છો, અને મને તો પ્રત્યક્ષ દર્શન દીધું, તેથી હું મારું અહોભાગ્ય સમજું છું.<sup>૪૬</sup> તમે જો કે હૃદયમાં જ રહ્યા છો, તોપણ કર્મથી વિક્ષેપ પામેલી બુદ્ધિવાળાઓને અત્યંત દૂર રહ્યા છો. તેમજ તમે અહંકારાદિકથી વ્યવધાન પામેલા છો, તોપણ જેઓના અંત:કરણમાં શ્રવણ, કીર્તનાદિકનો સંસ્કાર લાગેલો હોય છે તેઓને

સ ત્વં શાધિ સ્વભૂત્યાન્ ન: કિં દેવ! કરવામહે । એતદન્તો નૃણાં કલેશો યદ્ ભવાનક્ષિગોચર: ૪૯

શ્રીશુક ઉવાચ

તદુકમિત્યુપાકર્ણ ભગવાન્ પ્રણતાર્તિહા । ગૃહીત્વા પાણિના પાણિં પ્રહસંસ્તમુવાચ હ ॥૫૦

શ્રીભગવાનુવાચ

બ્રહ્મસ્તેજનુગ્રહાર્થય સમ્પ્રાસાન્ વિક્ષ્યામૂનુનીન । સંચરન્નિ મયા લોકાન્ પુનન્ત: પાદરેણુભિ: ૫૧

દેવા: ક્ષેત્રાણિ તીર્થાનિ દર્શનસ્પર્શનાર્ચનૈ: । શનૈ: પુનન્ત કાલેન તદપ્રહર્તમેક્ષયા ॥૫૨

ગ્રાહણો જમ્નના શ્રેયાન્ સર્વેષાં પ્રાણિનામિહ । તપસા વિવ્યાયા તુષ્ટા કિમુ મલ્કલયા યુત: ૫૩

ન ગ્રાહણાન્મે દયિતં સ્રુપ્મેતચ્ચતુર્ભુજમ્ । સર્વવેદમયો વિપ્ર: સર્વવેવમયો હ્યાહમ્ ॥૫૪

દુષ્પ્રજ્ઞા અવિદિત્વૈવમવજાનન્યસૂયવઃ । ગુરું માં વિપ્રમાત્માનમર્ચાદવિજ્યદૃષ્ટયઃ ॥૫૫

તમે પાસે જ છો. ૫૭ જે તમો દેહાદિકના અભિમાનથી રહિત પુરુષોને મોક્ષ આપનાર છો. અને દેહાદિકના અભિમાન ધરાવનાર, પુરુષને તમારા સંકલ્પથી જ મૃત્યુરૂપી

સંસારને આપનારા છો. ભક્તો ઉપર અનુગ્રહ કરવા માટે કર્મધીનથી રહિત

દિવ્ય શરીરને ધારણ કરનારા છો, અને જે પુરુષો માયાથી મોહિત થયેલા છે, તે

પુરુષોને પોતાના સ્વરૂપનું જ્ઞાન નહિ આપનાર એવા તમોને મારા પ્રણામ હોજો. ૫૮

હે દેવ! તે પરમેશ્વર આપ પોતાના દાસ અમ લોકોને આશા કરો. અમો શું કામ કરીએ? આપનાં પ્રત્યક્ષ દર્શન થાય ત્યારે મનુષ્યોના કલેશનો અંત થાય છે. ૫૯

શુકુદેવજી કહે છે આ પ્રમાણે શ્રુતદેવનાં વચ્ચન સાંભળી; ભક્તોની પીડાને

હરનાર ભગવાને પોતાના હાથથી તેનો હાથ પકડી, હસીને આ પ્રમાણે કહ્યું. ૫૦

ભગવાન કહે છે હે બ્રાહ્મણ! “આ મુનિઓ તમારા ઉપર અનુગ્રહ કરવા

સારુ આવેલા છે એમ જાણો. પોતાની ચરણરજથી લોકોને પવિત્ર કરતા, આ

મુનિઓ મારી સાથે ફરે છે. ૫૧ દેવ, ક્ષેત્રો અને તીર્થો, દર્શન, સ્પર્શ અને પૂજનથી

ઘણે કાળે પવિત્ર કરે છે; અને આ મુનિઓ તો તરત જ પવિત્ર કરે છે. દેવાદિકમાં

પવિત્ર કરવાની જે શક્તિ છે, તે પણ આવા મહાત્માઓની દષ્ટિ પડવાથી જ છે. ૫૨

આ જગતમાં મુનિઓ સર્વે પ્રાણીઓમાં ઉતામ છે. તેમાં પણ જે બ્રાહ્મણ

મુનિઓ તપ, વિદ્યા, સંતોષ અને મારી ઉપાસનાથી યુક્ત હોય તેની તો શી જ વાત

કરવી? ૫૩ આ મારાં ચતુર્ભુજરૂપ કરતાં પણ બ્રાહ્મણ મુનિઓ મને વધારે ઘારા

છે. બ્રાહ્મણ મુનિઓ સર્વે વેદમય છે અને હું સર્વે દેવમય છું, માટે દેવતાઓની

સિદ્ધિ તેના પ્રમાણરૂપ વેદને આધીન હોવાને લીધે બ્રાહ્મણ મુનિઓ મને આ રૂપ

કરતાં પણ વધારે પ્રિય છે. ૫૪ ગુણમાં દોષનો આરોપ કરનારા અને મૂર્તિ આદિકમાં

चराचरमिदं विश्वं भावा ये चास्य हेतवः । मद्रूपाणीति चेतस्याधते विप्रो मदीक्षया ॥५६  
तस्माद् ब्रह्मन्तर्षीनेतान् ब्रह्मन्! मच्छ्रद्धयार्चय । एवं चर्दर्चितोऽस्यद्वा नान्यथा भूरिभूतिभिः ५७

श्रीशुक उवाच

स इत्थं प्रभुणाऽऽदिष्टः सहकृष्णान् द्विजोत्तमान् । आराध्यैकात्मभावेन मैथिलश्वाप सद्गतिम् ५८  
एवं स्वभक्तयो राजन् ! भगवान् भक्तभक्तिमान् । उषित्वाऽदिष्ट्य सन्मार्गं पुनर्द्वावतीमगात् ५९

इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे उत्तरार्थं

श्रुतदेवानुग्रहो नाम षडशीतितमोऽध्यायः ॥८६॥

### अथ सप्तशीतितमोऽध्यायः (८७)

॥ परीक्षिदुवाच ॥

ब्रह्मन् ! ब्रह्मण्यनिर्देश्ये निर्गुणे गुणवृत्तयः । कथं चरन्ति श्रुतयः साक्षात्सदसतः परे ॥१

४ पूजन भुद्धि धरावनारा दुर्भुद्धि लोको आप्रमाणे नहि समज्ञने गुरु, हुं अने आत्मारूप ब्राह्मण मुनिओनुं अपमान करे छे.<sup>५५</sup> आ स्थावर जंगम जगत अने तेना कारणरूप महतात्वादिकं पदार्थो भगवाननां ज रूप छे.” ऐम ब्राह्मण सर्वे ठेकाणे ब्रह्मात्मक दृष्टिथी पोताना चित्तमां जाणे छे.<sup>५६</sup> हे ब्राह्मण ! ऐटला माटे मारा पर विश्वासथी आ मुनिओनी पूजा करो, अने ऐम करशो तो ज साक्षात् मारुं पूजन थशे, आम कर्या विना धणा वैभवोथी पण मारुं पूजन थतुं नथी.<sup>५७</sup>

शुक्टेवज्ञ कहे छे आ प्रमाणे भगवाने आज्ञा करतां ते श्रीकृष्ण सहित ब्राह्मणोनी एक भावनाथी आराधना करी, श्रुतदेव ब्राह्मण शुभगति पाभ्यो, अने मिथिलानो राजा भुलाश्य पण शुभगति पाभ्यो.<sup>५८</sup> हे राजा ! आ प्रमाणे भक्तोपर परम प्रीति राखनार श्रीकृष्ण भगवान त्यां रहीने पोताना भक्त ए ब्राह्मण तथा राजाने सन्मार्गनो उपदेश करी, पाइ द्वारकामां पधार्या.<sup>५९</sup>  
इति श्रीमद् महापुराणा भागवतना दशम स्कन्धनो छाशीमो अद्याय संपूर्णः।

### अद्याय ८७

वेदोऽसे करेली निर्गुणा ब्रह्मनी स्तुति.

परीक्षित राजा पूछे छे हे शुक्टेवज्ञ ! सर्वान्तर्यामी परमात्मा तो अनिर्देश्य छे. येतन तत्त्वनो अने अयेतनतत्त्वनो शब्दोथी जे रीते निर्देश करी शकाय छे, ए रीते तेओना समानपणे सर्वान्तर्यामी परमात्मानो निर्देश करी शकातो नथी.

श्रीशुक उवाच

बुद्धीन्द्रियमनःप्राणान् जनानामसृजत् प्रभुः । मात्रार्थं च भवार्थं च आत्मनेऽकल्पनाय च २  
माटे परमात्माने अनिर्देश्य कहेला छे. अने ए परमात्मा येतन तथा अयेतनथी सर्वप्रकारे विलक्षण छे. तथा शब्दोना जे जे प्रवृत्तिनिमित्तक गुणो छे, ते गुणोना प्रत्यक्ष संबन्धथी रहित होवाने कारणे ए सर्वान्तर्यामी परमेश्वरने निर्गुणा कहेला छे. तो हे मुने ! शब्दोना प्रवृत्तिनिमित्तक गुणोना संबन्धथी रहित, ऐवा निर्गुणा परमात्माने विषे प्रवृत्तिनिमित्तक गुणवाणा शब्दात्मक वेदो प्रत्यक्षपणे केवी रीते प्रवर्ती शके छे. अर्थात् आ शब्दात्मक वेदो परमात्मानुं केवी रीते प्रतिपादन करे छे. ज्ञाति, गुण, किया अने संज्ञा आ शब्दोना प्रवृत्तिनिमित्तक गुणो छे. अर्थात् ज्ञात्यादि गुणो अर्थना नियामक छे. ज्ञात्यादि क्षुणोना आधारे ज शब्दोनी अर्थमां प्रवृत्ति जोयामां आवे छे. जेम के “आ गाय छे” अहीं ईन्द्रियोनी साथे गोत्व ज्ञातिना प्रत्यक्ष संबन्धने आधारे ज अर्थने विषे शब्दनी प्रवृत्ति थयेली छे. अने वणी “आ गाय थेत छे.” अहीं ईन्द्रियोनी साथे थेतत्व गुणना प्रत्यक्ष संबन्धने आधारे ज अर्थने विषे शब्दनी प्रवृत्ति थई छे. अने वणी “आ गाय जाय छे” अहीं ईन्द्रियोनी साथे गमनत्व कियाना कोई पण संबन्धना आधारे ज अर्थने विषे शब्दनी प्रवृत्ति थई छे. अने वणी “आ गाय गंगा छे” अहीं ईन्द्रियोनी साथे संज्ञाना संबन्धना आधारे ज अर्थने विषे शब्दनी प्रवृत्ति थई छे. आ रीते कोई पण शब्दोनी अर्थमां प्रवृत्ति ज्ञात्यादि क्षब्दगुणोना आधारे ज थाय छे. अने परमात्माना विषयमां तो ईन्द्रियोनी साथे ज्ञात्यादि क्षब्दगुणोना प्रत्यक्ष संबन्धनो अभाव होवाथी, शब्दात्मक ऐवा वेदो साक्षात् परमात्माने विषे केवी रीते प्रवृत्ति शके छे ? आवो प्रश्ननो भाव छे.<sup>१</sup> शुक्टेवज्ञ कहे छे हे राजन ! नामरूपना निर्वाहक ऐवा परमात्माए, मायाना उदरमां अनादि काणथी पडेला ऐवा ज्ञवात्माओने, हस्त यरणादिकथी युक्त शरीर आपी करी, तेओनी आ लोकमां उत्कान्तिने माटे, अने आराधना करनार ज्ञवोने धर्म, अर्थ अने कामरूपी पुरुषार्थने आपवा पूर्वक तेओना अभ्युदयने माटे, तथा मुक्तिना साधनभूत उपासनानी सिद्धिने माटे, अने उपासनाना अनुष्ठान द्वारा देव मनुष्यादिक भेदोनी निवृत्ति पूर्वक मुक्तिने माटे, ज्ञवोनां बुद्धि, ईन्द्रियो, मन अने प्राणो सर्जेलां छे. (स्थावर जंगम जगतनी अंदर ज्ञवो द्वारा अनुप्रवेशीने परमात्मा ते ते

सैषा ह्युपनिषद् ब्राह्मी पूर्वेषां पूर्वजैर्धृता । श्रद्धया धारयेद् यस्तां क्षेमं गच्छेदकिञ्चनः ॥३  
अत्र ते वर्णयिष्यामि गाथां नारायणान्विताम् । नारदस्य च संवादमृषेनरायणस्य च ॥४  
एकदा नारदो लोकान् पर्यटन् भगवत्प्रियः । सनातनमृषिं द्रष्टुं यथौ नारायणाश्रमम् ॥५

नामरूपना निर्वाहक थयेला छे. माटे ते ते शब्दो ते ते अर्थनुं प्रतिपादन करवा पूर्वक मुख्यवृत्तिथी परमात्माने विषे ज विराम पामे छे. अर्थात् सर्वे शब्दो मुख्यवृत्तिथी परमात्माना ज वाचक बने छे. जेम के आ आपणुं शरीर छे, अने शरीरनी अंदर जे आत्मा रहेलो छे ए शरीरी छे. तो शरीर वाचक तमाम शब्दो शरीर द्वारा आत्मामां ज विराम पामे छे. “आ मनुष्य छे” अहीं मनुष्य शब्द शरीरनो वाचक छे. छतां ए शरीरवाचक मनुष्य शब्द, मनुष्य शरीरथी विशिष्ट ज्ञात्मामां ज विराम पामे छे. जेम के “मनुष्य एटले मनुष्य शरीरथी विशिष्ट ऐवो ज्ञव” पशु एटले पशुशरीरथी विशिष्ट ऐवो ज्ञव.

ऐ ज रीते सर्वे पदार्थों परमात्मानां शरीरों छे. अने परमात्मा ऐ सर्वे पदार्थोंना शरीरी आत्मा छे. माटे परमात्माना शरीर वाचक सर्वे शब्दो ते ते अर्थोनुं प्रतिपादन करवा पूर्वक, शरीरी ऐवा परमात्माना ज मुख्यवृत्तिथी वाचक बने छे. जेम के “पृथ्वी एटले पृथ्वी शरीरथी विशिष्ट परमात्मा” “ज्ञव एटले ज्ञव शरीरथी विशिष्ट परमात्मा” आ रीते सर्वे शब्दों शरीरी ऐवा परमात्माना वाचक बने छे. माटे परमात्माने वेदनी अंदर सर्वशब्दों कहेला छे. आ रीते शब्दात्मक वेदों ईन्द्रादिक शब्दों द्वारा सर्वान्तर्यामी परमात्माने विषे प्रवर्ते छे. आवो भाव छे.<sup>२</sup> उपर प्रतिपादन करेली सर्वे शब्दोंनी परमात्माने विषे ज मुख्यपाणे प्रवर्तवारूप जे वृत्ति छे. ऐ उपनिषद्द्वाना रहस्यरूप छे. अर्थात् उपनिषद्द्वाना अर्थनो विचार करवाथी ज ज्ञानवा योग्य छे. अने आ वृत्तिने पूर्वना पण पूर्वजो जे वामदेवादि मुनिओं तेमणे धारण करेली छे. अर्थात् वामदेवादि मुनिओं ए सर्वे शब्दोंनुं परमात्मा पर्यन्त वाचकपणुं बतावीने, परमात्माने विषे ज सर्वे शब्दोंनी मुख्यवृत्ति बतावेली छे. माटे जे पुरुष उपनिषद्द्वाना रहस्यरूप आ वृत्तिने श्रद्धाथी धारण करे छे, ते पुरुष निष्क्रियन थईने मोक्षपदने पामे छे.<sup>३</sup> हे परीक्षित ! आ तमारा प्रश्नना उत्तरमां नारायण भगवानना संबन्धवाणी एक गाथा हुं वर्णवुं छुं, के जे गाथानी अंदर नारायण भगवान अने नारद ऋषिनो संवाद रहेलो छे.<sup>४</sup> एक समयने विषे भगवानना प्रिय भक्त नारदज्ञ

यो वै भारतवर्षेऽस्मिन् क्षेमाय स्वस्तये नृणाम् । धर्मज्ञानशमोपेतमाकल्पादास्थितस्तपः द तत्रोपविष्टमृषिभिः कलापग्रामवासिभिः । परीतं प्रणतोऽपृच्छदिदमेव कुरुद्वह ॥७  
तस्मै ह्यवोचद् भगवानृषीणां शृणवतामिदम् । यो ब्रह्मवादः पूर्वेषां जनलोकनिवासिनाम् ॥८  
श्रीभगवानुवाच

स्वायम्भुव ब्रह्मसत्रं जनलोकेऽभवत् पुरा । तत्रस्थानां मानसानां मुनीनामूर्धरैतसाम् ॥९  
श्वेतद्वीपं गतवति त्वयि द्रष्टुं तदीश्वरम् । ब्रह्मवादः सुसंवृत्तः श्रुतयो यत्र शेरते ।

तत्र ह्यमभूत् प्रश्नस्त्वं मां यमनुपृच्छसि ॥१०॥  
तुल्यश्रुततपःशीलास्तुल्यस्वीयारिमध्यमाः । अपि चक्रुः प्रवचनमेकं शुश्रूषवोऽपरे ॥११॥

जुदा जुदा लोकोमां भ्रमण करी, सनातन ऐवा नारायण भगवाननां दर्शन करवा माटे बद्रीकाश्रममां पधारेला हता.<sup>५</sup> जे नारायण भगवान आ भरतभंडने विषे मनुष्योना लौकिक अत्युदयने माटे तथा आत्यंतिक मोक्षने माटे, आ कल्पना प्रारंभथी धर्म, ज्ञान अने संयमनी साथे महान तपश्चर्या करे छे.<sup>६</sup> हे परीक्षित ! एक दिवस बद्रिकाश्रमने विषे कलापग्रामवासी (बद्रिकाश्रमवासी) सिद्ध ऋषिओनी मध्ये नारायण भगवान भिराजेला हता. ते समये नारदज्ञाए भगवानने प्रणाम करी नम्रता पूर्वक ए ज प्रश्न पूछियो हतो के जे प्रश्न तमोमे भने पूछेलो छे.<sup>७</sup> हे राजन् ! नारदज्ञना प्रश्नना उत्तरमां भगवान नारायणे सर्वे ऋषिओना सांभणतां नारदज्ञने ए ज कथा संभणावी के जे कथानी अंदर जनलोकवासी सनकादिकनो परस्पर ब्रह्मसंवाद रहेलो छे.<sup>८</sup> भगवान नारायण कहे छे के हे नारद ! प्राचीन समयनी एक कथा छे के जे कथामां जनलोकने विषे त्यांना रहेवासी अने ब्रह्माना मानसपुत्रो, तथा उिध्वरिता नैष्ठिक ब्रह्मचारी ऐवा सनकादिक ऋषिओनो परस्पर ब्रह्मसंवाद थयेलो हतो.<sup>९</sup> भगवान कहे छे हे नारद ! तमो ज्यारे श्वेतद्वीपना अधिपति वासुदेव भगवाननां दर्शन करवा माटे श्वेतद्वीप गया हता, त्यारे ए ब्रह्मसंवाद प्रवर्तेलो हतो. जे ब्रह्मसंवादने विषे श्रुतिओ पण मौन धारण करीने सुखपूर्वक त्यां विराजेली हती. हे नारद ! तमोमे भने जे प्रश्न पूछेलो छे ए प्रश्न ब्रह्मसंवादमां वर्णवामां आवेलो हतो. माटे तमारा प्रश्नना प्रत्युतरूपे ए सर्वे कथा हुं तमारा प्रत्ये कहुं छुं, तेने तमो ध्यान दृष्टिने सांभणो.<sup>१०</sup> भगवान कहे छे हे नारद ! सनक, सनन्दन, सनातन अने सनतकुमार आ चारे जोके शास्त्रीय ज्ञान, तपश्चर्या अने स्वभावमां समान छे, अने ए चारनी दृष्टिमां शत्रु तथा भित्र पण समान छे. छतां पण एक सनन्दन

સનન્દન ઉવાચ

સ્વસૃષ્ટિમિદમાપીય શયાનં સહ શક્તિભિઃ । તદન્તે બોધયાઞ્ચકુસ્તલિઙ્ગૈः શ્રુતયઃ પરમ् ॥૧૨

યથા શયાનં સપ્તાજં વન્દિનસત્પરાક્રમૈः । પ્રત્યૂષેઽભ્યેત્વ સુશ્લોકैર્બોધ્યન્યનુઝીવિનઃ ॥૧૩

શ્રુતય ઊચુઃ

જય જય જહ્યાજામજિત ! દોષગૃભીતગુણાં ત્વમસિ યદાત્મના સમવરુદ્ધસમસ્તભગઃ ।

અગજગદોકસામખિલશક્ત્યવબોધક ! તે ક્રચિદજયાઽત્મના ચ ચરતોઽનુચરેન્નિગમઃ ॥૧૪

વક્તા બનેલા હતા અને સનકાદિક બીજા મુનિઓ શ્રોતા બન્યા હતા.<sup>૧૧</sup> સનન્દન કહે છે જેવી રીતે પ્રાતઃકાળ થતાં સૂતેલા ચક્કવર્તી રાજાને જગાડવા માટે ભૂત્ય એવા બંદિજનો, રાજાની પાસે આવી રાજાના પરાક્રમ તથા યશનું ગાન કરી રાજાને જગાડે છે. એ જ રીતે પોતે સર્જેલા આ જગતનો સંહાર કરી, સૂક્ષ્મ અવસ્થાને પામેલી પ્રકૃતિપુરુષાદિક શક્તિઓથી વિશિષ્ટપણે જ પોઢેલા, એવા પરમાત્માને, શ્રુતિઓ તેમના અસાધારણ પરાક્રમો તથા માહાત્મ્યનું વર્ણન કરી જગાડે છે.<sup>૧૨-૧૩</sup>

(દેશ્ચતુલિ) શ્રુતિઓ પરમાત્માની સ્તુતિ કરતાં કહે છે કે હે અજિત ! આપનો જય હો !!! જય હો !!! દોષરૂપ અને જીવાત્માઓને દુઃખ આપનારા સત્વગુણા, રજોગુણા અને તમોગુણથી યુક્ત એવી સ્થાવર જંગમ જીવોની જે માયા છે, તેનો તમે નાશ કરો. (પ્રલયકાળને અંતે માયાના ઉદ્રમાં રહેલા જીવોની અવિદ્યા નાશ કરવાને માટે શ્રુતિઓએ “અજાં જહિ” આ રીતે પ્રાર્થના કરેલી છે. તેથી પ્રલયકાળને વિષે પણ જીવો અને ઈશ્વરના બેદનું વાસ્તવિકપણું અને માયાનું સત્યપણું સિદ્ધ થાય છે. અને વેદો પણ પ્રલયકાળને વિષે વિદ્યમાન હોવાથી વેદોનું પણ નિત્યપણું સિદ્ધ થાય છે.) અને વળી કાળ, માયા, મહતત્વાદિક સમગ્ર શક્તિઓના પ્રકાશક એવા, હે પ્રભુ ! જે કારણથી તમો અનંત શક્તિઓથી યુક્ત છો, એ જ કારણથી સ્વભાવસિદ્ધ જ પ્રામ થયેલાં સમગ્ર ઐશ્વર્યોથી યુક્ત છો, પણ જીવો તેવા નથી. કારણ કે જીવોને તમારી ઉપાસનાદિકે કરીને ઐશ્વર્ય પ્રામ થાય છે. માટે સ્વભાવસિદ્ધ જ ઐશ્વર્યવાળા જીવો નથી. આવા હે પ્રભુ ! સર્વાન્તર્યામીપણે પ્રકૃતિપુરુષથી વિશિષ્ટપણે વર્તતા તમોને શબ્દસમૂહાત્મક એવી અમો શ્રુતિઓ, ચિત્ત અધિરત્થી વિશિષ્ટપણે પ્રતિપાદન કરીએ છીએ. (રૂદ્ર, ઈન્દ્ર, અજિન, સૂર્યાદિકના અંતર્યામીરૂપે વર્તતા તમોને વેદો, રૂદ્ર, ઈન્દ્ર, અજિન, સૂર્યાદિકરૂપે જ પ્રતિપાદન કરે છે.) કારણ કે સર્વે શબ્દો મુખ્યવૃત્તિથી પરમાત્મામાં

બૃહુપલબ્ધમેતદવયન્યવશેષતયા યત ઉદ્યાસ્તમયૌ વિકૃતેર્મુદિ વાવિકૃતાત् ।

અત રૂષયો દધુસ્ત્વયિ મનોવચનાચરિતં કથમયથા ભવન્તિ ભુવિ દત્તપદાનિ નૃણામ् ॥૧૫

જ વિરામ પામે છે. માટે શબ્દસમૂહાત્મક વેદો, બ્રહ્માત્મક ભાવથી રૂદ્ર, ઈન્દ્રાદિક શબ્દદ્વારા જ આપને વિષે સાક્ષાત્ પ્રવર્તે છે. આવો ભાવ છે.<sup>૧૪</sup> (તમો તો ક્યારેક જ મારું પ્રતિપાદન કરો છો, મોટે ભાગે ઈન્દ્ર, અજિન તથા વરુણાદિક દેવોનું જ પ્રતિપાદન કરો છો ? આ શંકાના પરિહારમાં વેદો પરમાત્માની સ્તુતિ કરતાં કહે છે.) હે પ્રભુ ! પ્રલયકાળને વિષે જીયારે આ જગત નામરૂપના વિભાગથી રહિત અતિ સૂક્ષ્મપણાને પામે છે, ત્યારે અવશેષપણે રહેલું (અર્થાત્ વ્યતિરેક ભાવથી રહેલું) અને પછી સૂચિ સમયે પોતે જ સર્જેલા બ્રહ્મા, ઈન્દ્ર, વરુણાદિકને વિષે (ઉપલબ્ધમ્) અન્વયભાવને પ્રામ થયેલું જે આ તમારું અંતર્યામી સ્વરૂપ છે, તેને મંત્રદષ્ટા મુનિઓ (બૃહત્) બ્રહ્મ આવા નામથી જાણે છે. અને જેમ અવિકારી મૃત્તિકા ઘટ શરાવાદિકરૂપે વિકારને પામે છે, છતાં એ ઘટ શરાવાદિક વિકારો મૃત્તિકાત્મક જ છે. અર્થાત્ કારણરૂપ મૃત્તિકાથી એ ઘટશરાવાદિક વિકારો પૃથ્કુભૂત નથી. અને એ સર્વે વિકારો તે એ અર્થાનું પ્રતિપાદન કરવા પૂર્વક મૃત્તિકામાં જ વિરામ પામે છે. જેમ કે “ઘટ” આ શબ્દ કુમ્ભગ્રિવાદિવત્ અર્થાનું પ્રતિપાદન કરવા પૂર્વક મૃત્તિકામાં જ વિરામ પામે છે. તેમ અવિકારી એવા જે તમારા થકી વિકારી કાર્યોની ઉત્પત્તિ થાય છે, અને જે તમારે વિષે વિકારી કાર્યોનો લય થાય છે, એ તમારા થકી વિકારી કાર્યો પૃથ્ક નથી. કારણ કે બ્રહ્મ એવા તમો સર્વત્ર અંતર્યામીપણે રહેલા હોવાને કારણો એ સર્વે વિકારી કાર્યો બ્રહ્માત્મક છે. એ જ કારણથી ઈન્દ્ર, વરુણાદિક દેવોનું પ્રતિપાદન કરનારા વેદો પણ મન, વાણી અને કર્મો તમારે વિષે જ ધારણ કરે છે. અર્થાત્ મનથી તમારું જ ધ્યાન કરે છે, વાણીથી તમારી જ સ્તુતિ કરે છે, અને શરીરથી તમારા સંબન્ધવાળી જ ચેષ્ટા કરે છે. (જેમ ઘટશરાવાદિકનું વર્ણન એ મૃત્તિકાનું જ વર્ણન છે, કારણ કે ઘટશરાવાદિક મૃત્તિકાત્મક છે. તેમ ઈન્દ્ર, વરુણાદિક દેવોનું વર્ણન એ પરમાત્માનું જ વર્ણન છે. કારણ કે એ સર્વેમાં પરમાત્મા અંતર્યામીપણે રહેલા હોવાથી એ સર્વે બ્રહ્માત્મક છે.) જેમ મનુષ્ય પોતાનો પગ કાણ, પાષણાદિક કોઈ પણ વસ્તુ ઉપર ધારણ કરે, એ પૃથ્વી ઉપર જ ધારણ કર્યો કહેવાય છે. કારણ કે સર્વે વસ્તુ પૃથ્વીરૂપ જ છે. તેમ તમારા શરીરભૂત ઈન્દ્ર, વરુણાદિક દેવોનું પ્રતિપાદન કરતી એવી અમો

इति तव सूर्यस्त्वधिपतेऽखिललोकमलक्षणकथामृताब्धिमवगाहा तपांसि जहुः ।  
किमुतं पुनः स्वधामविद्युताशयकालगुणाः परम भजन्ति ये पदमजस्त्वसुखानुभवम् ॥१६  
दृतय इव श्वसन्त्यसुभृतो यदि तेजनुविधा महदहमादयोऽण्डमसृजन् यदनुग्रहतः ।  
पुरुषविधोऽन्वयोऽत्र चरमोऽन्नमयादिषु यः सदसतः परं त्वमथ यदेष्ववशेषमृतम् ॥१७

श्रुतिओऽकोई पश्च विभूतिओनुं प्रतिपादन करीए, ए तमारुं ज प्रतिपादन कर्युं  
कहेवाय छे. कारण के तमो सर्वत्र रहेला होवाथी ए सर्वे विभूतिओ ब्रह्मात्मक  
छे.<sup>१४</sup> (पूर्व श्लोकने विषे प्रतिपादन करायेला सर्वान्तर्यामी भगवाननुं ध्यान,  
संसारिक सर्वे तापोनुं निवारण करनार छे. ए विषयनुं प्रतिपादन करतां श्रुतिओ  
परमात्मानी स्तुति करे छे.) हे त्रिलोकीना अधिपति ! जे कारणथी तमो ज्ञव  
द्वारा अनुप्रवेशीने जगतना नामदृपना निर्वाहक छो, ए ज कारणथी प्रवृत्तिधर्मना  
प्रवर्तक ब्रह्मादिक देवो अने तेवा ज प्रकारना बीजा पश्च आधुनिक मुनिओ समग्र  
लोकोना पापोने नाश करनारी ऐवी तमारी कथारुपी अमृतना सागरमां दुबकी  
मारीने जो, अध्यात्मिक, आधिभौतिक अने आधिदैविक आ त्रष्ण प्रकारना तापोने  
दूर करी शकता होय, तो हे सर्वोत्कृष्ट ! निवृत्तिधर्मना प्रवर्तक जे नारदादिक  
ऋषिओ अथवा तेवा ज प्रकारना बीजा पश्च आधुनिक ऋषिओ तमारा स्वरूपना  
माहात्म्यज्ञान वडे रागादिक भननी वृत्तिओनो तथा जरा, मरणादिक काणनी  
वृत्तिओनो नाश करी, नित्य ज्ञानानन्दात्मक तमारा स्वरूपनो समाधि वडे  
साक्षात्कार करीने त्रष्ण प्रकारना तापोने दूर करी शके एमां तो कहेवुं ज शुं ? ए तो  
करी ज शके.<sup>१५</sup> (पूर्व श्लोकने विषे कहेला बत्ते प्रकारना भक्तजनो जो भगवाननी  
भक्ति करे नहि, तो ए निंदाने पात्र बने छे, ए विषयनुं निरूपश करतां श्रुतिओ  
परमात्मानी स्तुति करे छे.) हे अनन्त ! प्राणधारी पुरुषो जोऽकोई पश्च प्रकारे  
तमारो आश्रय करे छे. (अर्थात् जे कोई पश्च भावथी तमोने भजे तो ज ए  
सझण ज्ञवे छे.) पश्च जे प्राणधारी पुरुषो तमारो आश्रय नथी करता, अर्थात्  
कोई पश्च भावथी तमारुं भजन नथी करता. ए तो केवण धमणानी पेठे श्यास ले  
छे. (अने वणी कदाच तमो कहेशो के सकाम भावथी मारो आश्रय करवाथी शुं  
प्राप्त थाय छे ?) आ शंकाना परिहारमां श्रुतिओ कहे छे के हे प्रभु ! महतत्व  
अहंकारादिक तत्वोना अभिमानी देवो सकाम भावथी स्तुतिरूप तमारो आश्रय  
कर्या पठी ज, तमारा अनुग्रहथी वैराज्यपुरुषना शरीररूप ब्रह्मांडने सर्ज शक्या

उदरमुपासते य ऋषिवर्तमसु कूर्पदृशः परिसरपद्धतिं हृदयमारुणयो दहरम् ।  
तत उदगादनन्त तव धाम शिरः परमं पुनरिह यत् समेत्य न पतन्ति कृतान्तमुखे ॥१८  
स्वकृतविचित्रियोनिषु विशन्निव हेतुतया तरतमतश्कास्प्यनलवत् स्वकृतानुकृतिः ।  
अथ वितथास्वमूष्ववितथं तव धाम समं विरजधियोऽन्वयन्त्यभिविपण्यव एकरसम् ॥१९

हता. माटे कोई पश्च भावथी तमोने जे भजे छे. तेनुं ज ज्ञवन सार्थक छे. (कदाच  
तमे कहेशो के भक्तोने भजवा योग्य मारुं स्वरूप साकार छे के निराकार छे ?)  
आ शंकाना परिहारमां श्रुतिओ कहे छे के हे प्रभु ! असमय, प्राणमय, मनोमय,  
विज्ञानमय अने आनन्दमय आ पांचकोशोने मध्ये जे अंतिम आनन्दमय छे, जे  
महदादिक कार्यथी पर छे तथा प्रकृति पुरुषादि कारणथी पश्च पर छे, विलक्षण  
छे. अर्थात् जे कार्यकारणना प्रवर्तक छे. अने चित् अचित् भिश ऐवा ब्रह्मांडने  
विषे जे अन्वय भावने पामेला छे, अने प्रलयकाण प्राप्त थतां नेति नेति द्वारा  
सर्वेनो निषेध करतां जे एक अवशेष रहे छे, अने जे सत्यस्वरूप छे, आवा जे  
परमतत्व परब्रह्म परमात्मा छे, ए साक्षात् पुरुषाकार छे. (अर्थात् हस्त  
चरणादिकथी युक्त ऐवा मनुष्यनी पेठे ज, परमात्मा दिव्य हस्त चरणादिकथी  
युक्त पुरुषाकार छे, आवो भाव छे.)<sup>१०</sup> (पूर्व श्लोकने विषे पुरुषाकार आनन्दमय  
परमात्मानुं जे स्वरूप निरूपश कर्युं, ए स्वरूपनी उपासनाना भेदथी उपासना  
करनारा त्रष्ण प्रकारना उपासकोनुं निरूपश करतां श्रुतिओ परमात्मानी स्तुति  
करे छे.) हे अनन्त ! आपनी प्राप्तिने माटे ऋषिओ ए अनेक उपासनाना मार्गो  
निश्चित करेला छे. ए मार्गोने विषे जे सुक्षमबुद्धिवाणा छे. अने तेमां पश्च जे  
अरुषा ऋषिना मार्गने अनुसरनारा छे. (अर्थात् दहर विद्यामां निष्ठावाणा छे)  
ए पुरुषो हृदयमां रहेला अने दहर शब्दथी वाच्य ऐवा तमारी उपासना करे  
छे. अने जे केटलाक वैश्यानर विद्यामां निष्ठावाणा छे, ए जठराज्ञि स्वरूपे तमारी  
उपासना करे छे. अने वणी केटलाक तो (परिसरपद्धतिं ) सुषुम्णा मार्गनी  
उपासना करे छे. (अर्थात् सुषुम्णा नाडी द्वारा आपनी उपासना करे छे.) के जे  
सुषुम्णा नाडी तमारी उपासनानुं परम स्थण छे. अने हृदयथी आरंभीने ब्रह्मरन्ध्र  
पर्यन्त उपर नीकणेली छे. के जे ब्रह्मरन्ध्रने पामीने पुरुष फ्रीवार आ  
प्रकृतिमंडणने विषे, तेमां पश्च यमराजना मुखनी समान आ संसारमां फ्रीवार  
पडतो नथी.<sup>११</sup> (परमात्मा अपवित्र शरीरने विषे प्रवेश करीने रहेला छे, इतां

સ્વકૃતપુરેષ્વમીષ્વબહિરન્તરસંવરણં તવ પુરુષં વદન્યખિલશક્તિધૂતોઽશકૃતમ् ।  
ઇતિ નૃગર્તિ વિવિચ્ય કવયો નિગમાવપનં ભવત ઉપાસતેઽદ્વિઘ્નમભવં ભુવિ વિશ્વસિતાઃ ॥૨૦

તેના લેપથી રહિત શુદ્ધ સ્વરૂપ છે. આ વિષયનું નિરૂપણ કરતાં શ્રુતિઓ પરમાત્માની સ્તુતિ કરે છે.) હે પ્રભુ! તમો જીવોના કર્મને અનુસારે સર્જેલી એવી ઊંચ નીચ યોનિયોને વિષે કારણપણે જાણો પ્રવેશ કરીને રહેલા છો. “જાણો પ્રવેશ કરીને રહેલા છો” આમ કહ્યું તેણે કરીને હે પ્રભુ! તમારો વ્યતિરેકભાવ પણ સૂચ્યવેલો છે. અર્થાત્ મૂર્તિમાન દિવ્ય સ્વરૂપે તમારા ધામમાં પણ વિરાજો છો. અને વળી હે ભગવન્! જેમ અજિ સ્વભાવસિદ્ધ તારતમ્યભાવથી રહિત છે, છતાં પણ નાના મોટા કાણ અનુસારે નાનો મોટો જણાય છે. તેમ તમો પણ સ્વભાવ સિદ્ધ તારતમ્યતાથી રહિત છો. અર્થાત્ સર્વત્ર સમભાવથી પ્રવેશ કરીને રહેલા છો, છતાં પણ કર્મને અનુસારે સર્જાયેલી ઊંચ નીચ યોનિને અનુસારે તારતમ્યભાવથી પ્રકાશો છો. (કદાચ તમો કહેશો કે પ્રાકૃત એવી ઊંચ અને નીચ યોનિઓનો જ્યારે નાશ થાય છે. ત્યારે તેની અંદર પ્રવેશ કરીને રહેલો એવો જે હું તે મારો પણ થવો જોઈએ?) આ શંકાના પરિહારમાં શ્રુતિઓ કહે છે કે હે પ્રભુ! તમો સર્વત્ર પ્રવેશીને રહેલા છો છતાં સર્વે યોનિઓના નાશની સાથે તમારો નાશ થતો નથી. કારણ કે તમારું સ્વરૂપ સમ છે. અર્થાત્ એક જ રૂપે રહેનારું છે, વિકારથી રહિત છે. તેથી કાર્યોમાં અનુપ્રવેશને લીધે લાગતા દોષના સ્પર્શથી રહિત છે. અને વળી તમારું સ્વરૂપ એકરસ છે. અર્થાત્ અપરિચિન્તા આનંદસ્વરૂપ છે. આવું ધામમાં રહેલું જે તમારું સ્વરૂપ છે તેને માયિક ગુણોથી રહિત નિર્મળબુદ્ધિવાળા પુરુષો આલોક તથા પરલોક સંબંધી કર્મફળથી રહિત થઈને પામે છે. (અર્થાત્ પુરુષ અને પાપથી રહિત થયેલા ગુણાતીત પુરુષો જ ધામમાં રહેલા આ તમારા સ્વરૂપને પ્રામ કરે છે.)<sup>૧૯</sup> (પૂર્વ શ્લોકને વિષે દિવ્ય મૂર્તિમાન અને ધામમાં રહેલા પરમાત્માના સ્વરૂપની ઉપાસના કરનારા પુરુષોને જે સ્વરૂપની પ્રાપ્તિ કહેલી છે, એ જ સ્વરૂપની પ્રાપ્તિ અંતર્યામી સ્વરૂપની ઉપાસના કરનારને પણ થાય છે. એ વિષયનું નિરૂપણ કરતાં શ્રુતિઓ પરમાત્માની સ્તુતિ કરે છે.) હે પ્રભુ! સમગ્ર શક્તિઓને ધારણ કરનારા એવા તમારા સંકલ્પાત્મક જ્ઞાનથી ગ્રહણ કરાયેલું, અને તમોએ સર્જેલા આ દેવ-મનુષ્યાદિક શરીરોમાં રહેલું, એવું જે તમારું અંતર્યામી અંગુષ્ઠમાત્ર પુરુષાકાર સ્વરૂપ છે, તેને વેદાન્તો બહાર

દુરવગમાત્મતત્વનિગમાય તવાજ્ઞતનો શ્રરિતમહામૃતાબ્ધિપરિવર્તપરિશ્રમણાઃ ।  
ન પરિલબ્ધન્તિ કેચિદપવર્ગમપીશ્વર ! તે ચરણસરોજહંસકુલસઙ્ગ્રિવસૃષ્ટ્યગૃહાઃ ॥૨૧

અને અંદરના આવરણથી રહિત કહે છે, અર્થાત્ બહાર અને અંદર વ્યાપવામાં સમર્પ કહે છે. અને જ્ઞાન સંકોચના હેતુરૂપ અજ્ઞાનના આવરણથી રહિત કહે છે. આવા અંતર્યામી અંગુષ્ઠમાત્ર પુરુષાકાર સ્વરૂપનો વિચાર કરીને તથા મનુષ્યોની ગતિનો વિચાર કરીને તમારા સ્વરૂપનું યથાર્થ માહાત્મ્ય જાણનારા કેટલાક વિવેકી પુરુષો શ્રદ્ધાવાળા થઈને, એ અંતર્યામી સ્વરૂપના ચરણની ઉપાસના કરે છે. કે જે ચરણ વેદો દ્વારા પ્રતિપાદ્ય છે, અને સંસારના ભયને નિવારણ કરનારાં છે. (ધામમાં રહેલા દિવ્ય પુરુષાકાર, એવા તમારા ચરણની ઉપાસના કરનારા, તથા સર્વાન્તર્યામિપણે રહેલા અંગુષ્ઠમાત્ર દિવ્ય પુરુષાકાર એવા તમારા ચરણની ઉપાસના કરનારા, બસ્તે પણ તમારી ઉપાસનાએ કરીને સમાન મોક્ષગતિને પામે છે, આવો ભાવ છે.)<sup>૨૦</sup> (કદાચ તમે કહેશો કે માયાના ઉદરમાં રહેલા અને તેથી જ માયાના ત્રણો ગુણોથી બંધાયેલા એવા અલ્પજ્ઞ અજ્ઞાની જીવો, પરથી પણ પર રહેલું એવું જે અક્ષરધામ તેને વિષે રહેલો અને પ્રકૃતિપુરુષથી પર એવો જે હું તે મારી ઉપાસના કેવી રીતે કરી શકે?) આ શંકાના પરિહારમાં શ્રુતિઓ કહે છે કે હે દ્યાળું! ધામમાં વિરાજેલા પરમતત્વ પરમાત્માનું જ્ઞાન પ્રામ કરવું અત્યંત કઠિન છે. છતાં જીવાત્માઓને એ પરમતત્વાનું જ્ઞાન પ્રામ કરાવવા માટે પોતાની મૂર્તિને વિષે રહેલ અપરિમિત દિવ્ય પ્રકાશ, એશ્વર્યાદિકને ઢાંકીને જ્યારે તમો રામકૃષ્ણાદિક મનુષ્યરૂપે સર્વે જનોને દેશરૂપે થાઓ છો, ત્યારે તમારા ચરણિકાને વિષે હંસોની પેઠે કીડા કરતા ભાગવત ભક્તોના સમાગમથી સમગ્ર ધરની અભિલાષાઓ ત્યાગ કરી દે છે. અને હે ઈશ્વર! પછી એ જનો મોક્ષની પણ અભિલાષા રાખતા નથી. કેવળ તમારી સેવાને જ ઈચ્છે છે.<sup>૨૧</sup> (પ્રથમ ધામમાં રહેલા હોય ત્યારે મનુષ્યોને પ્રામ કરવા કઠિન એવા ભગવાન અજ્ઞાની જીવો ઉપર દ્યા કરીને રામકૃષ્ણાદિકરૂપે પ્રાદુર્ભાવને પામેલા હોય, છતાં પણ જે જનો તેને ભજતા નથી, તે જનો નિંદાને પાત્ર બને છે. અને સંસારને વિષે ભ્રમણ કર્યા કરે છે. એ વિષયનું વર્ણન કરતાં શ્રુતિઓ પરમાત્માની સ્તુતિ કરે છે.) હે પ્રભુ! મહાન ખેદની વાત છે કે તમારી

त्वदनुपथं कुलायमिदमात्मसुहृत्यिवच्चरति तथोन्मुखे त्वयि हिते प्रिय आत्मनि च ।  
न बत रमन्त्यहो असदुपासनयाऽऽत्महनो यदनुशया भ्रमन्त्युरुभये कुशरीरभृतः ॥२२  
निभृतमरुमनोऽक्षदृढयोगयुजो हृदि यन्मनय उपासते तदरयोरुपि ययुः स्मरणात् ।  
स्त्रिय उरगेन्द्रभोगभुजदण्डविषक्तधियो वयमपि ते समाः समदृशोऽङ्गिसरोजसुधाः ॥२३

सेवाने अनुकूण वर्ततुं, अने पक्षीना माणानी समान आ शरीर आत्मानी पेठे पोताने अनुकूण वर्ततुं होय, (जेम आत्मा ईष साधननी प्रवृत्तिमां अनुकूण वर्ते, तेम अनुकूण वर्ततुं होय) मित्रनी पेठे पोताने अनुकूण वर्ततुं होय, पोताना प्रियनी पेठे पोताने अनुकूण वर्ततुं होय, (पोतानो प्रिय जेम प्रेरणा कर्या विना पोतानुं हित करवामां अनुकूण वर्ते, तेम) आ रीते सर्वप्रकारे शरीर पोताने अनुकूण होय, शरीरमां कोई प्रकारना रोगो न होय, छतां पाणि जे आत्म हत्यारा ज्ञो असत्पुरुषोना प्रसंगे करीने के पुत्र, स्त्री, देह अने धरादिक्ने विषे आसक्तिए करीने, रामकृष्णादिक्कुपे रहेला होवाथी सर्वप्रकारे आश्रय करवा योग्य, उपटेशादिके करीने सर्वप्रकारे हितकारक अने प्रेमना स्थानरूप ऐवा तमारे विषे ध्यानादिके करीने रमता नथी. अर्थात् तमारुं भजन करता नथी. ए पुरुषो असत्पुरुषोना प्रसंगे करीने के पुत्र, स्त्री, देह धरादिक्ने विषे वासनाए करीने, अति निंदित देहोने पामीने बहु भयथी युक्त ऐवा संसारने विषे भ्रमण कर्या करे छे.<sup>२२</sup> (कल्याणना आश्रयरूप प्रत्यक्ष पुरुषोत्तम भगवानना स्वरूपनुं कोई पाणि भावथी स्मरण करनारा ज्ञो एकांतिक भक्तोनी समान गतिने पामी जाय छे. ए विषयनुं निरुपाणि करतां श्रुतिओ परमात्मानी स्तुति करे छे.) हे कृपाना सागर ! प्राण अंतःकरण अने बाह्येन्द्रियोने संयमित करीने दृष्टपाणे योगमां निष्ठावाणा मुनिओ हृदयने विषे जे तमारा स्वरूपनी उपासना करे छे, ए ज तमारा स्वरूपने कोधना आवेशथी निरंतर स्मरण करनारा शत्रुओ पाणि पामी गया छे. तेवी ज रीते महासर्पना शरीरनी समान जे तमारा भुजदंड तेने विषे आसक्त थयेली अर्थात् आकिंगननी अभिलाषावाणी अने तेथी ज क्रमभावे करीने स्मरण करनारी एवी गोपीओ पाणि ते ज तमारा स्वरूपने पामी गयेली छे. अने तमारा यरण कमणनुं सारी रीते ध्यान करनारी एवी जे अमो श्रुतिओ पाणि, मनुष्यादिक्नी पेठे ज समदृष्टिवाणा ऐवा तमारा एज स्वरूपने शब्दोनी मुख्यवृत्तिथी अने तात्पर्यवृत्तिथी पामीअे छीअे.<sup>२३</sup> (उत्पत्ति अने स्थिति अवस्थाने

क इह नु वेद बतावरजन्मलयोऽग्रसं यत उदगादृष्यमनु देवगणा उभये ।  
तर्हि न सन्न चासदुभयं न च कालजवः किमपि न तत्र शास्त्रमवकृष्य शयीत यदा ॥२४  
जनिमसतः सतो मृतिमुतात्मनि ये च भिदां विषणमृतं स्मरन्त्युपदिशन्ति त आरुपितैः ।  
त्रिगुणमयः पुमानिति भिदा यदबोधकृता त्वयि न ततः परत्र स भवेदवबोधरसे ॥२५

विषे तेमां पाणि भगवानना प्रादुर्भाव समये ज्ञो ध्यान भजनादिक्कुनुं सुख मेणवी शके छे. पाणि प्रलयसमये ज्ञो परमात्मानी सभीपे रहेवा इतां ध्यानभजनादिक्कुनुं सुख मेणवी शक्ता नथी, ए विषयनुं निरुपाणि करतां श्रुतिओ परमात्मानी स्तुति करे छे.) हे भगवन् ! आप अत्रसर छो. अर्थात् सृष्टिथी पूर्वे पाणि (प्रलयकाणने विषे पाणि) सूक्ष्म येतन अयेतनथी विशिष्ट कारणपाणे रहेला छो. अने वणी आप अनन्त छो. तेथी आपनी पाइण ज काणे करीने उत्पत्ति अने लयने पामेलो क्यो पुरुष आपने जाणी शके !!! अर्थात् शास्त्रविना कोई पाणि जाणी शके नहि. जे तमारा थकी ब्रह्मा उत्पत्त थया, जे ब्रह्मा थकी निवृत्ति धर्ममां निष्ठावाणा सनकादिको अने प्रवृत्ति धर्ममां निष्ठावाणा मरीच्यादिको उत्पत्त थया. अने एमना पाणी मनुष्यादिक उत्पत्त थया छे. आ रीते मनुष्यो तो आपथी बहु ज पाइण उत्पत्त थया छे. अने वणी ज्यारे तमो शास्त्रनुं आकर्षण करीने (स्थितिनुं आकर्षण करीने, अथवा तो प्रकृति सहित सर्वे कार्यने अक्षरना तेजने विषे लीन करीने) शयन करो छो. त्यारे प्रलय समये कार्यरूपे रहेली येतन वस्तु अने अयेतन वस्तु पाणि न हती. अने क्षण, मुहूर्त अने संवत्सरादिक काणनी प्रवृत्ति पाणि न हती. बहु शुं कहेवुं, ते समये कार्यपाणि न हतुं. ए ज कारणथी प्रलय समये ज्ञवात्माओने तमारा ध्यान भजनादिक्कुनुं ज्ञान पाणि होतुं नथी. एटला ज माटे मनुष्योने केवण उत्पत्ति तथा स्थिति अवस्थाने विषे तमारा अवतारभूत जे रामकृष्णादिक्नी भक्ति छे, एज परम कल्याणना साधनरूप छे, एम ज्ञाय छे.<sup>२४</sup> (जे शास्त्रने जाणनारा होय, छतां जे भगवानना स्वरूपने यथार्थ जाणनारा ऐवा एकांतिक भक्तोनो समागम न होय, तो प्रत्यक्ष पुरुषोत्तम भगवानना जन्म अने कर्मनुं दिव्यपाणुं जाणी शक्ता नथी. आ विषयनुं निरुपाणि करतां श्रुतिओ परमात्मानी स्तुति करे छे.) हे प्रभु ! असतः - अति सूक्ष्मपाणे धाममां रहेला, अजन्मा अने दिव्यमूर्तिमान ऐवा जे तमो ते तमारा जन्मने जे पुरुषो कर्मधीन ज्ञवनी समान कहे छे. अने सर्वे ज्ञनोना नेत्रोथी ग्रहण कर्यामां आवता ऐवा रामकृष्णादिक्कुपे रहेला, नटनी पेठे कीडा करनारा, सत्यमूर्ति

સદિવ મનસ્ત્રિવૃત્ત્વયિ વિભાત્યસદામનુજાત્ સદભિમૃષાન્ત્યશોષમિદમાત્મતયાડ્જત્મવિદ: ।  
ન હિ વિકૃતિં ત્વજન્તિ કનકસ્ય તદાત્મતયા સ્વકૃતમનુપ્રવિષ્ટમિદમાત્મતયાવસિતમ् ॥૨૬  
એવા જે તમો, તે તમારા અંતર્ધાનલીલાને જે પુરુષો કર્મધીન જીવની સમાન કહે  
છે, તમારા દિવ્ય આકારને વિષે અને મનુષ્ય આકારને વિષે જે પુરુષો ભેદ કહે  
છે, અને મોક્ષને આપનાર હોવાથી સત્ય સ્વરૂપ તથા દિવ્ય એવાં તમારાં ચરિત્રોને  
જે પુરુષો માયિક કહે છે. અર્થાત્ જીવોએ કરેલા વ્યવહારની સમાન જ કહે છે, તે  
પુરુષો માત્ર પોતાની બુદ્ધિથી કલ્પેલા ભ્રમો વડે કરીને જ કહે છે. અને ભ્રમો વડે  
બીજા જનોને ઉપદેશ પણ કરે છે. (આ રીતે એ જીવો જો ભાન્ત જ થયેલા હોય તો  
કેવી રીતે ઉપદેશ કરી શકે?) આ શંકાના પરિહારમાં શુદ્ધિઓ કહે છે કુર્હે પ્રભુ!  
એ ઉપદેશા જીવો ત્રણે ગુણોની પ્રધાનતાથી યુક્ત છે, અને તેથી જ અજ્ઞાનતાથી  
ભરેલા છે. અને તેને કારણે જ પોતપોતાની રૂચિને અનુસારે વર્ણવેલો સર્વે ભેદ  
દિવ્ય મૂર્તિમાન એવા તમારા સ્વરૂપના અજ્ઞાનથી જ વર્ણવેલો છે, કે જે અજ્ઞાન  
સર્વે ભેદોથી પર, જ્ઞાનસ્વરૂપ એવા તમારે વિષે નથી. અર્થાત્ ભેદને ઉત્પન્ન  
કરનારું અજ્ઞાન, જ્ઞાનસ્વરૂપ એવા તમને સ્પર્શી શકૃતું નથી.<sup>૨૫</sup> (અસંખ્ય  
કલ્યાણકારી ગુણોથી યુક્ત, દિવ્યમૂર્તિ એવા પરતત્વ પરમાત્માનો આ વિશ્વને  
વિષે અન્વયભાવનો પ્રકાર વર્ણવતાં શુદ્ધિઓ પરમાત્માની સુત્તિ કરે છે.) હે  
અનાત ! કેવળ મનના વિલાસરૂપ તમારા સંકલ્પથી ઉત્પન્ન થયેલું. ત્રણગુણનું  
વર્તન જેને વિષે રહેલું છે, અર્થાત્ ત્રિગુણાત્મક એવું આ વિશ્વ મનુષ્યથી આરંભીને  
વિરાટપુરુષ પર્યત અસત્ત છે, ઇતાં પણ તમો અંતર્ધાનીપણો રહેતાં  
અજ્ઞાનીપુરુષોને સત્તની સમાન જાણાય છે. તમારા સ્વરૂપને જાણનારા પુરુષો તો  
કર્મફળને આપનારી અંતર્ધાની શકૃતિ દ્વારા આ વિશ્વને સત્ત જાણો છે, પણ જીવો  
દ્વારા આ વિશ્વને સત્ત જાણતા નથી. જેમ સુવર્ણને ઈચ્છનારા પુરુષો ચાંદીથી ભિશ  
એવાં પણ કડાં, કુંડળાદિક વિકારોને સુવર્ણાત્મકપણો ગ્રહણ કરે છે, અર્થાત્ ચાંદીનો  
પણ સુવર્ણની સમાન આકાર જોઈને ચાંદીને પણ સુવર્ણ પણો ગ્રહણ કરે છે. તેમ  
હે પ્રભુ ! તમારા સ્વરૂપને જાણનારા પુરુષો તમારી અંતર્ધાની શકૃતિથી યુક્ત  
ક્ષેત્રક્ષેત્રરૂપ વિકારોને બ્રહ્માત્મકપણો ગ્રહણ કરે છે. અર્થાત્ અસત્ત એવા પણ  
વિકારોને બ્રહ્માત્મકપણો સત્ત માનીને સ્વીકારે છે. (સુવર્ણ જેમ કડાં, કુંડળાદિક  
વિકારોરૂપે પરિણામને પામે છે, માટે એ વિકારો સુવર્ણથી ભિશ નથી. અર્થાત્

તવ પરિ યે ચરન્ત્યખિલસત્ત્વનિકેતતયા ત ઉત પદાડ્જત્રમન્ત્રવિગણાય શિરો નિર્ઝેટે: ।  
પરિવયસે પશ્ચાનિવ ગિરા વિબુધાનિપિ તાંસ્ત્વયિ કૃતસૌહ્રદા: ખલુ પુનનિત ન યે વિમુખા: ॥૨૭  
સુવર્ણમય જ છે. તેમ બ્રહ્મ જ જો ક્ષેત્ર તથા ક્ષેત્રક્ષેત્રરૂપે થયેલા હોય તો ક્ષેત્રક્ષેત્રક્ષેત્રપી  
વિકારો અને બ્રહ્મની અભિનતા હોવી જોઈએ. પણ અહીં સુવર્ણના દસ્તાની અભિનતથી  
અભિનતા શા માટે વર્ણવવામાં આવી નથી?) આ શંકાના પરિહારમાં કહે છે કે  
હે પ્રભુ ! તમો પોતે ક્ષેત્ર તથા ક્ષેત્રક્ષેત્રરૂપે પરિણામને પામતા નથી. પણ ક્ષેત્ર તથા  
ક્ષેત્રક્ષેત્રથી વિશીષ્ટ તમારી અંતર્ધાની શકૃતિ પરિણામને પામે છે. તમો તો નિત્ય  
છો. આદિ અંતથી રહિત નિત્ય એવા તમો, નિત્ય એવા જીવોના કર્મફળ આપવાને  
માટે અંતર્ધાનીરૂપે અનુપ્રવેશ કરો છો. તેથી આ વિશ્વને વિદ્વાન પુરુષો બ્રહ્માત્મક  
તમારા રૂપ કહે છે. પણ વસ્તુતાએ આ વિશ્વ બ્રહ્માત્મક તમારારૂપ નથી. અર્થાત્  
તમારા વિકારરૂપ નથી કારણ કે તમો અને જીવો આ બત્તે નિત્ય છો, અને અજ્ઞન્મા  
છો. તથા માયા જડ છે. આ રીતે ત્રણે પૃથ્ક હોવા છાતાં તમારી અંતર્ધાનીશકૃતિથી  
જીવ અને માયા તમારી સાથે જોડાયેલાં રહે છે.<sup>૨૯</sup> (પરમાત્માના સ્વરૂપને  
જાણનારા જે પુરુષ અંતર્ધાનીશકૃતિ દ્વારા આ જગતને સત્ત જાણવા પૂર્વક ઉપાસના  
કરે છે, તે પુરુષો મૃત્યુને તરી જાય છે, એ બાબતનું વર્ણન કરતાં શુદ્ધિઓ  
પરમાત્માની સુત્તિ કરે છે.) હે અનંત ! સમગ્ર પ્રાણીઓના આધારપણે જે પુરુષો  
તમોને સેવે છે. અર્થાત્ સર્વપ્રાણીઓના અંતર્ધાનીપણો તમારા સ્વરૂપને જાણીને  
જે પુરુષો તમારી ઉપાસના કરે છે, તે પુરુષો મૃત્યુનો અનાદર કરીને મૃત્યુના  
મસ્તક ઉપર પગ મૂકીને ઉલ્લંઘી જાય છે. અર્થાત્ મૃત્યુ ઉપર વિજય મેળવે છે.  
અને જે જનો વિમુખ છે. અર્થાત્ તમારી ઉપાસનાથી રહિત છે, તે પુરુષો ભલે  
શાસ્ત્રોને જાણનાર હોય છાતાં પણ વ્યવહારિક નામરૂપવાળી વાણી વડે પશુની  
પેઠે જ બંધાઈ જાય છે. (અર્થાત્ જીવો તમારી ઉપાસના વિના મૃત્યુ ઉપર વિજય  
મેળવી શકતા નથી, અને વાસ્તવિક રીતે જીવો મનુષ્યો, પશુ, પક્ષી એ આદિ  
નામરૂપથી રહિત છે. છાતાં વારંવાર જન્મ દ્વારા મનુષ્ય, પશુ, પક્ષી એ આદિ  
નામરૂપનો સ્વીકાર કરીને બંધનને પામે છે) અને જે પુરુષો તમારે વિષે સ્નેહ  
કરેલો છે, તમારા પરમ ભક્ત છે, એ પુરુષો તો પોતાને અને બીજાને પણ પવિત્ર  
કરે છે. પણ તમારી ભક્તિથી રહિત વિમુખ પુરુષો તો પોતે જ વિન્ધોથી પરામબ  
પામીને નાશ પામી જાય છે.<sup>૨૭</sup> (પ્રકૃતિ પુરુષાદિકની અંદર શકૃતને ધારણ કરનારા

त्वमकरणः स्वारडखिलकारकशक्तिधरस्तव बलिमद्रुहन्ति समदन्त्यजयानिमिषाः ।  
वर्षभुजोऽखिलक्षितिपतेरिव विश्वसृजो विदधति यत्र ये त्वधिकृता भवतश्चकिताः ॥२८  
स्थिरचरजातयः स्युरजयोत्थनिमित्युजो विहर उदीक्षया यदि परस्य विमुक्त ततः ।  
न हि परमस्य कश्चिदपरो न परश्च भवेद् वियत इवापदस्य तव शून्यतुलां दधतः ॥२९

परमात्मा છે. તેથી પ્રકृતિ પુરુષાદિક દ્વારા થતી જે સૃષ્ટિ તેના કર્તા પણ પરમાત્મા જ છે. અને એજ કારણથી બ્રહ્માદિક દેવો પરમાત્મા થકી ભય પામીને સુષ્ઠ્યાદિક કાર્યાને કરે છે. એ વિષયનું વર્ણન કરતાં શુદ્ધિઓ પરમાત્માની સ્તુતિ કરે છે.) હે ભગવન્! તમો પ્રાકૃત ઈન્દ્રિયો, અંતઃકારણથી રહિત હિવ્ય મૂર્તિમાન છો. અથવા તો હે પ્રભુ! તમો માયા, પુરુષ, કાલ આદિક કારણો વિના પણ સૃષ્ટિ કરવાને માટે સમર્થ છો. એટલા જ માટે તમો સ્વરાટ છો. અર્થાત્ સ્વતંત્ર ઐશ્વર્યથી યુક્ત છો. (કદાચ તમો એમ કહેશો કે પ્રકृતિ પુરુષાદિક જ સૃષ્ટિના કર્તા છે. હું કંઈ સૃષ્ટિનો કર્તા નથી?) આ શંકાના પરિહારમાં શુદ્ધિઓ કહે છે કે હે પ્રભુ! તમો જ પ્રકृતિ પુરુષાદિકની શક્તિના પ્રવર્તક છો, અને ધારણ કરનારા પણ તમેજ છો. વાસ્તવિક સૃષ્ટિના કર્તા તમો જ છો. એટલા જ માટે હે અજ્ય! બ્રહ્માદિક દેવતાઓ અને વિશ્વને જ્ઞાનનારા પ્રકृતિ પુરુષાદિક સર્વે તમોને જ પૂજાના ઉપહારો, એ રીતે નિવેદન કરે છે. અને એ ઉપહારોને તમો એ રીતે ગ્રહણ કરો છો. કે જે રીતે ખંડિયા રાજાઓ ચક્રવર્તી રાજાને કર અર્પણ કરે છે, અને ચક્રવર્તી રાજા ખંડિયા રાજાઓએ અર્પણ કરેલા કરને ગ્રહણ કરે છે. અને વળી બ્રહ્માદિક સર્વેને તમોએ જે જે કાર્યામાં નિયુક્ત કરેલા છે, તે તે કાર્યાને બ્રહ્માદિક દેવતાઓ તમારા થકી ભય પામી કરી, સાવધાન થઈને કરે છે.<sup>૧૯</sup> (પરમાત્મા જે આ વિચિત્ર અને વિષમ જગતની સૃષ્ટિ કરે છે, એ જીવોના કર્મને અનુસારે જ કરે છે. પણ પરમાત્માની અંદર વિષમપણું કે નિર્દ્યપણું નથી. એ વિષયનું વર્ણન કરતાં શુદ્ધિઓ પરમાત્માની સ્તુતિ કરે છે.) હે નિત્યમુક્ત! જ્યારે તમારો પ્રકृતિની સાથે પુરુષરૂપે વિહાર થાય છે. ત્યારે તમો ક્ષેત્રજ્ઞ જીવત્માઓના કર્મને અનુસારે દસ્તિ કરો છો. અને એ તમારી દસ્તિથી સાત્વિક, રાજસ અને તામસ એવાં પ્રાચીન કર્મો જગ્યત થાય છે. અને જગ્યત થયેલાં પ્રાચીન કર્મોને આધારે જ સર્વે સ્થાવર જંગમ પ્રાણીઓના દેહો ઉત્પત્ત થાય છે. અર્થાત્ પ્રકृતિના ઉદરમાં રહેલા જીવોના સ્થાવર, જંગમ જે દેહો ઉત્પત્ત થાય છે, એ પરમ પુરુષ એવા તમારી દસ્તિ જ ઉત્પત્ત થાય છે.

अपरिमिता ध्रुवास्तनुभूतो यदि सર्वगतास्तर्हि न शास्यते ति नियमो ध्रुव नेतरथा ।  
अजनि च यम्यं तदविमुच्य नियन्त् भवेत् सममनुजानतां यदमतं मतदुष्टतया ॥३०

(કદાચ તમે કહેશો કે પુરુષ દ્વારા પ્રકૃતિની સાથે મારો વિહાર કહ્યો પણ સાક્ષાત્ પ્રકૃતિની સારે મારો વિહાર કહેવામાં શું દોષ છે?) આ શંકાના પરિહારમાં શુદ્ધિઓ કહે છે કે હે પ્રભુ! જે કારણથી તમારી આગળ ઊભી રહેવા માટે પણ માયા લજજાને પામે છે. અને ઊભી પણ રહી શકતી નથી. એજ કારણથી તમો સર્વોત્કૃષ્ટ છો. અને સર્વોત્કૃષ્ટ હોવાથી જ આકાશની સામાન આધાર રહિત છતા સર્વાધાર, અને વ્યાપક છો. અને વળી તમો શૂન્યની સમાનપણાને ધારણ કરો છો. અર્થાત્ કોઈ શૂન્ય ઘર હોય, તેને વિષે નિવાસને સૂચ્યવનાર લેપાદિ હોતા નથી, તેમ તમારે વિષે જગતની વિચિત્ર અને વિષમ સૃષ્ટિના નિમિત્ત ઉત્પત્ત થયેલ વિષમપણું અને નિર્દ્યપણું એ આદિ દોષોનો લેપ નથી. આવા વિશેષોથી યુક્ત એવા તમોને કોઈ પોતાનો કે પારકો પણ નથી. તેથી તમારે વિષે જે વિષમપણું જોયામાં આવે છે. એ કેવળ જીવોના કર્મને અનુસારે જ જોયામાં આવે છે, પણ વાસ્તવિક રીતે નથી.<sup>૨૦</sup>  
(જીવાસ્ત્વાઓ નિત્ય છે અને પરમાત્મા દ્વારા શાસ્ય છે. આ વિષયનું નિરૂપણ કરતાં શુદ્ધિઓ પરમાત્માની સ્તુતિ કરે છે.) હે નિત્ય! જીવો નિત્ય છે અને અસંખ્ય છે. નિત્ય તથા અસંખ્યપણાને વિષે તો શુદ્ધિઓ પ્રમાણરૂપ હોવાથી એ સત્ય જ છે. પણ જીવો જો તમારી ઉપાસનાએ કરીને સ્વરૂપથી સર્વવ્યાપક બની જતા હોય અર્થાત્ સ્વરૂપે કરીને વિભુ બની જતા હોય તો તમારી સમાન જ બની જાય. અને તેથી જીવોને વિષે જે શાસ્યતા શાસ્ત્રોએ નિશ્ચિત કરેલી છે એ રહે નહિ. અને એમ થવાથી શાસ્ત્ર પ્રસિદ્ધ શાસ્ય શાસકતારૂપ જે નિયમ છે તેનું ખંડન થઈ જાય. માટે જીવોની સ્વરૂપે કરીને સર્વવ્યાપકતા નથી. સ્વરૂપે કરીને તો જીવ મુક્તિ દશામાં પણ અણુસ્વરૂપ જ છે. કેવળ ધર્મભૂતજ્ઞાનથી જ જીવ વિભુ બની શકે છે. આ રીતે સ્વરૂપે કરીને જીવોના સર્વ વ્યાપકપણાના અભાવને વિષે તો શાસ્ય અને શાસકપણાનો જે નિયમ છે એ ઘટી શકે છે. (સ્વરૂપે કરીને જીવત્માઓના સર્વવ્યાપકપણાના અભાવપક્ષને વિષે મારા દ્વારા જીવોની જે શાસ્યતા છે, એ શાસ્યતા રાજાઓની પેઢે બહારથી છે? કે અંદર પ્રવેશીને છે?) આ શંકાના પરિહારમાં શુદ્ધિઓ કહે છે કે હે પ્રભુ! વ્યાપક એવા જે તમારાથી વિશિષ્ટ આ સંપૂર્ણ જગત ઉત્પત્ત થયેલું છે, એ જ તમો અંદર પ્રવેશીને જ જગતનું નિયંત્રણ

न घटत उद्धवः प्रकृतिपूरुषयोरजयोरभययुजा भवन्त्यसुभृतो जलबुद्धुदवत् ।  
त्वयि त इमे ततो विविधनामगुणैः परमे सरित इवार्णवे मधुनि लिल्युरशेषरसाः ॥३१  
नृषु तव मायथा भ्रमममीष्ववगत्य भृशं त्वयि सुधियोऽभवे दधति भावमनुप्रभवम् ।  
कथमनुवर्ततां भवभयं तव यद्भ्रुकुटिः सृजति मुहुस्त्रिणेमिरभवच्छरणेषु भयम् ॥३२

करो छो, पण राजाओनी पेठे बहारथी नहीं, आ प्रमाणे सारी रीते जाणनारा प्रमाणिक पुरुषोने दुष्टपाणे जे भत अभिमत न होय. (अर्थात् प्रमाणथी विलङ्घ होय) ए भतनो अनादर करी देवो जोईओ.<sup>३०</sup> (प्रकृति पुरुषनुं अजन्मापण्युं, नित्य एवा क्षेत्रश्च ज्ञवोना देहोनी उत्पत्तिनो प्रकार अने प्रलय काणने विषे प्रकृतिना कार्यभूत नाम, रुप अने गुणोनो नाश, आ सर्वेनुं वर्णन करतां श्रुतिओ परमात्मानी स्तुति करे छे.) के हे अनंत! “अजेंकां” “अजें होके” आ प्रमाणे वेदने विषे अजन्मापणे प्रसिद्ध एवा प्रकृतिपुरुषनी उत्पत्ति घटी शक्ती नथी. (तो पछी कोनी उत्पत्ति थाय छे?) आ शंकाना परिष्ठारमां श्रुतिओ कहे छे के हे प्रभु! जो के अजन्मा होवाथी प्रकृतिपुरुषनी उत्पत्ति नथी. छतां पण जेम वायुना योगे करीने जण थडी परपोटा उत्पत्ति थाय छे. तेम पुरुषना योगे करीने प्रकृति थडी क्षेत्रश्च ज्ञवोना मात्र देहो आधारभूत एवा तमारे विषे उत्पत्ति थाय छे. अर्थात् आधारभूत एवा तमारा संकल्पथी प्रकृतिपुरुष द्वारा ज्ञवोना देहो उत्पत्ति थाय छे, पण स्वतंत्रपणे थता नथी. अने त्यार पछी ज्यारे प्राकृति प्रलय थाय छे, त्यारे नाम, रुप अने गुणोथी उपलक्षित एवा विराटथी आरंभीने तृष्ण पर्यंत क्षेत्रश्च ज्ञवोना देहो तमारा शरीरभूत प्रकृतिने विषे लय पामे छे. अर्थात् प्रलय दशामां नाम रुपनो त्याग करीने अति सूक्ष्मपणाने पामे छे. नदीओ जेम पोताना नाम, रुपनो त्याग करीने समुद्रने विषे एवी रीते लय पामे छे के पृथक् पोतानुं अस्तित्व होवा छतां जोई शकातुं नथी. अने वणी अनेक पुरुषना रसो जेम नाम, रुपनो त्याग करीने मधने विषे एवी रीते लयने पामे छे के मधने विषे पुरुषोना रसनुं पृथक् अस्तित्व होवा छतां जोई शकातुं नथी. तेम प्रलयकाणने विषे आ सर्वं जगत नामरुपनो त्याग करीने आपना शरीरभूत प्रकृतिने विषे एवी रीते लयने पामे छे, अर्थात् एवी रीते अति सूक्ष्मपणाने पामे छे के प्रकृतिने विषे सर्वं तत्पोनुं पृथक् अस्तित्व होवा छतां पृथक् जोई शकातुं नथी.<sup>३१</sup> (प्राकृत एवा शरीरना भोगोने विषे आसक्त थयेला जे ज्ञवो छे, अने देहने विषे आत्मभ्रम

विजितहृषिकवायुभिरदान्तमनस्तुरगं य इह यतन्ति यन्तुमतिलोलमुपायखिदः ।  
व्यसनशताच्चिताः समवहाय गुरोश्चरणं वणिज इवाज सन्त्यकृतकर्णधरा जलधौ ॥३३  
स्वजनसुतात्मदारथामधरासुरश्चस्वयि सति किं नृणां श्रयत आत्मनि सर्वरसे ।  
इति सदजानतां मिथुनतो रतये चरतां सुखयति को न्विह स्वविहते स्वनिरस्तभगे ॥३४

तथा स्वतंत्रपणानो भ्रम धारण करनारा जे ज्ञवो छे, ते जे ज्ञवोने उत्पत्ति प्रलयाद्विकने विषे कालकृत भय रहेलो छे, पण तमारा भक्तोने कालकृत भय नथी. ए विषयनुं वर्णन करतां श्रुतिओ परमात्मानी स्तुति करे छे.) के हे भगवन्! प्राकृत देहना विषयोने विषे आसक्त थयेला आ ज्ञवोने विषे तमारी मायाए करीने जन्मोजन्म उत्पत्ति थयेलो जे देहात्मभ्रम तथा स्वतंत्रपणानो जे भ्रम छे, ए जे संसृतिमां कारणरुप छे. अम जाणीने रुडी बुद्धिवाणा पुरुषो मुक्तिने आपनारा एवा तमारे विषे जे अत्यंत प्रेमभावने धारण करे छे, अने तमारे विषे जे प्रेमभावने धारण करीने तमारुं सेवन करता एवा पुरुषोने संसारनो भय क्यांथी होय? न जे होय. कारण के कोधने सूचवनारी तमारी भूकुटिना लंगरुप जे संवत्सरात्मक काण छे, ए तमारा शरणाथी रहित एवा पुरुषोने विषे जे वारंवार संसारनो भय सर्जे छे.<sup>३२</sup> (शास्त्रोक्त लक्षणोथी संपत्त एवा सद्गुरुना सेवन विना तो रुडी बुद्धिवाणा पुरुषोने पण विघ्नोथी पराभव थतो होवाथी कोई पण कल्याणना साधननी सिद्धि थती नथी, आ विषयनुं वर्णन करतां श्रुतिओ परमात्मानी स्तुति करे छे.) के हे अजन्मा! जे मनुष्यो वसुदेवाद्विकने धेर पुरुषपणे प्रादुर्भावने पामेला, अने उपदेष्टा एवा तमारा चरणना सेवननो त्याग करीने अतिशे यंचण अने ईन्द्रियो तथा प्राणवायुने ज्ञत्या विना वश करवा अशक्य एवा, मनरुपी धोडाने वश करवा माटे प्राणायामाद्विक बीजं अनेक साधनो वडे खेद पामता प्रयत्न करे छे. ते मनुष्यो सो ए सो दुःखोथी युक्त थर्हने आ संसारने विषे भ्रमण करता दुःखोने पामे छे. जेम नाविकोनो आश्रय कर्या विना जे वणिको समुद्रने पार पामवा ईच्छे, ते वणिको समुद्रमां ज दूबकां खाता दुःखने पामे छे. तेम सद्गुरुना शरण विना प्राणायामाद्विक अनेक साधनो वडे मनने वश करीने संसार सागरने तरवा ईच्छता पुरुषो संसारने विषे जे दुःखने पामे छे. अर्थात् जन्म मरणाने तरी शक्ता नथी.<sup>३३</sup> (सद्गुरुना सेवनथी भगवानमां भक्तिने पामेला विवेकी पुरुषोने

भुवि पुरुपुण्यतीर्थसदनान्यृष्ययो विमदास्त उत भवत्पदाम्बुजहृदोऽघभिदङ्ग्यिजलाः ।  
दधति सकून्मनस्त्वयि य आत्मनि नित्यसुखे न पुनरुपासते पुरुषसारहरावसथान् ॥३५

ऐक भगवानने विषे सुख होय छे, भगवान विना अन्य पदार्थोंमां सुख होतुं नथी. विषयोंमां आसक्त थयेला अविवेकी पुरुषोंसे प्राकृत मनुष्योंने अने प्राकृत पदार्थोंने सुखकारी मानेलां छे, पश ए सर्वे हुःभद्रायक छे. ऐ विषयनुं वर्णन करतां श्रुतिओं परमात्मानी स्तुति करे छे.) हे प्रभु ! अति सुखरूप, सर्वना अंतर्यामी एवा आप विद्यमान रहेतां ज्ञवोने भध्ये कोई पश ज्ञव तमारा अथवा सद्गुरुना चरणनुं सेवन करे छे. ऐ ज्ञवने पितादिक स्वजनो, पुत्रो, देह, पत्नी, धन, धर, पृथ्वी, प्राणो अने रथ ए आदि पदार्थोंनी साथे शुं प्रयोजन छे ? अर्थात् शुं सुख छे ? कांઈ पश सुख नथी. ए सर्वे पदार्थोंने विषे सुखनो तो ऐक लेश छे, पश हुःभ अपार छे. अने आ रीते ऐक तमारे विषे ज सुख छे, तथा तमारा सिवाय अन्यत्र हुःभ छे. आवा साचा विवेकने नहि जाणनारा, एटला ज माटे परस्पर रतिसुखने माटे दंपती भावथी वर्तता एवा भनुष्योंने स्वभावसिद्ध नाशवंत अने स्वभाव सिद्ध ज सार रहित एवा, आ संसाररूपी नरकने विषे क्युं पदार्थ सुखने आपनार थाय छे ? कोई पश पदार्थ सुखने आपनार थतुं नथी.<sup>३४</sup> (गृहस्थाश्रमने विषे अति अत्प्रसुखमां आसक्त थयेला ज्ञनोने विषे संसार संबन्धी अपार हुःभ रहेलुं छे, तेने ज्ञाणीने अति आनंदस्वरूप परमात्माने पमाडनारा सद्गुरुना समागमने विषे अत्यंत आसक्त थयेला जे विवेकी पुरुषों छे, ते गृहस्थाश्रमने विषे रहेता नथी. ए विषयनुं वर्णन करतां श्रुतिओं परमात्मानी स्तुति करे छे.) हे भगवन् ! तमारा चरण कमणे हृदयमां धारी रहेला, एटला ज माटे जेओनुं चरणतीर्थ पश सर्वपापोने नाश करनार छे. आवा मुनिओं पश आ पृथ्वी उपर आ देहने विषे आत्माभिमानना मदथी तथा आत्माने विषे स्वतंत्रपशाना अभिमानरूपी मदथी रहित थईने गंगादिक जलप्रधान पूज्यक्षेत्रो तथा द्वारिकादि स्थलप्रधान तीर्थक्षेत्रोनुं सेवन करे छे, पश दंपतीभावथी धरमां रहेता नथी. (जो के गंगादिक पूज्यक्षेत्र तथा द्वारिकादिक तीर्थक्षेत्रना सेवन विना पश तमारा तथा तमारा साधुपुरुषोंना समागमे करीने ज पवित्रपशाने पामेला ए महापुरुषोंने तीर्थादिकनुं सेवन करवानो कोई मतलब होतो नथी. छतां पश लोक संग्रहने माटे अने तीर्थमां

सत इदमुत्थितं सदिति चेन्ननु तर्कहतं व्यभिचरति क्रच क्रच मृषा न तथोभययुक् ।  
व्यवहृतये विकल्प इषितोऽन्धपरम्परया भ्रमयति भारती त उरुवृत्तिभिरुक्थजडान् ॥३६

रहेला ज्ञनो तथा स्वयं तीर्थने पश पवित्र करवाने माटे, ए महात्मापुरुषोंनुं तीर्थ सेवन होय छे, आवो भाव छे.) अथवा तो जे कारणाथी नित्य सुखरूप परमात्मा एवा तमारे विषे जे पुरुषो ऐक ज वार पश मन स्थिर करे छे. अर्थात् ऐक ज लेश तमारा सुखनो आस्वाद मेणवे छे, ते ज्ञनो पश पुरुषोना भक्ति, ज्ञानादिकना बणने हरी लेनारां धरोनुं सेवन करी शक्ता नथी. ए ज कारणाथी विरक्त मुनिओं धरनो त्याग करीने तीर्थोनुं सेवन करवुं ए योग्य ज छे. (जो ऐकवार परमात्माना सुखनो आस्वाद मेणवेलो होय, तो ते पुरुषने पश गृहस्थाश्रमना दंपती भावने विषे अनादर थई जाय छे. तो पछी निरंतर परमात्माना सुखनो आस्वाद मेणवनारा पुरुषोंने गृहस्थाश्रमना दंपतीभावमां अनादर थाय तेमां तो कहेवुं ज शुं ? ओ तो थाय ज. तेथी विरक्त मुनिओं भक्ति ज्ञानादिक बणने हरी लेनारां धरोनो (दंपतीभावनो) त्याग करीने तीर्थोनुं सेवन करवुं ए ज योग्य छे, आवो भाव छे.)<sup>३५</sup> (आ विश्व केवुं छे ? अने शा माटे परमात्माए सर्जेलुं छे ? आ विषयनुं वर्णन करतां श्रुतिओं परमात्मानी स्तुति करे छे.) हे प्रभु ! कोई पश जो एवुं विचारता होय के आ विश्व सत् थकी (येतन अयेतनथी विशिष्ट एवा परमात्मा थकी) उत्पन्न थयेलुं छे, माटे सत् छे. अर्थात् अविनाशी छे. तो तेनो ए विचार तर्कथी हुणायेलो ज छे. अर्थात् तर्कसंगत नथी ज, आवो निश्चय छे. कारण के आ विश्व (क्रच मृषा) कोई ऐक भागमां असत् छे. अर्थात् नाशवंत छे. (आ विश्व बे विभागथी युक्त छे, तेमां ऐक जड विभाग छे अने बीजो येतन विभाग छे. तेमां जे जड विभाग छे ए अस्थिर होवाथी नाशवंत छे, तेथी तेने असत् कहेवामां आवे छे. माटे आ विश्व ऐकदेशने विषे (मृषा) नाशवंत छे.) अने वणी आ विश्व (क्रच व्यभिचरति) कोई ऐक भागमां व्यभिचारने पामे छे. अर्थात् येतन विभाग नित्य होवाथी येतन पक्षने विषे आ विश्व स्थिर छे, माटे आ विश्व ऐक देशने विषे अविनाशी अने सत् ठरे छे. (तो पछी आ विश्वने सत् मानवुं ? असत् मानवुं ? के सदसत् मानवुं ?) आ शंकाना परिहारमां श्रुतिओं कहे छे के हे प्रभु ! (उभययुक्) आ विश्व सदसत् छे. अर्थात् येतन अने अयेतनथी मिश्र छे. (तो आवा विचित्रपशाथी युक्त आ

ન યદિદમગ્ર આસ ન ભવિષ્યદતો નિધનાદનુમિતમન્તરા ત્વયિ વિભાતિ મૃષૈકરસે ।  
અત ઉપમીયતે દ્રવિણજાતિવિકલ્પયથૈર્વિતથમનોવિલાસમૃતમિત્યવયન્યબુધા: ॥૩૭

વિશ્વને ઈશ્વરે શા માટે સર્જેલું છે ?) આ શંકાના પરિહારમાં કહે છે કે ( વ્યવહૃતયે  
વિકાલ્પ ઇષિતા: ) આ વિશ્વમાં પામર વિષયી જીવોને તથા મુમુક્ષુ જીવોને ધર્મ,  
અર્થ, કામ, અને મોક્ષ આ ચાર પુરુષાર્થની પ્રાપ્તિ કરવા રૂપ વ્યવહારને માટે,  
ઈન્દ્રિયો શરીરાદૃષ્પ આ વિકલ્પ - બેદ તમોએ સર્જેલો છે. તેમાં અતિ દુઃખરૂપ  
સંસારથકી ઉદ્દેગને પામેલા જે મુમુક્ષુ જીવો છે, એ કેવળ મોક્ષરૂપી વ્યવહારને  
માટે પ્રયત્ન કરે છે. અને બીજા સંસાર સુખમાં આસક્ત પામર વિષયી જીવો છે,  
એ કેવળ ધર્મ, અર્થ અને કામરૂપી વ્યવહારને માટે જ પ્રયત્ન કરે છે. કારણ કે  
અનાદિકાળનાં પાપોથી દૂષિત બનેલા અને કર્મમાં જ જડ એવા પુરુષોને જ,  
સ્વર્ગાદિકને જણાવનારી વેદરૂપી તમારી વાણી ( અરૂવૃત્તિભિ ) સ્વર્ગાદિકને  
જણાવનારાં વચનો દ્વારા ઉપનિષદ્ધજન્ય જ્ઞાન દાખિથી રહિત એવા પુરુષોની  
પરંપરાએ ભ્રમ ઉત્પત્ત કરે છે. પણ મુમુક્ષુ પુરુષોને એ સ્વર્ગાદિકને જણાવનારી  
તમારી વાણી ભ્રમ ઉત્પત્ત કરતી નથી. માટે મુમુક્ષુ જીવો કેવળ મોક્ષને માટે જ  
પ્રયત્ન કરે છે. અને પામર વિષયી જીવો ધર્મ, અર્થ અને કામને માટે પ્રયત્ન કરે  
છે.<sup>૩૬</sup> ( અત્યારે સ્થૂલરૂપે જોયામાં આવતું જગત સૃષ્ટિથી પહેલાં ન હતું, અને  
ફરી પ્રલય પછી પણ નહીં હોય, કેવળ મધ્યે જ જોયામાં આવે છે એ વિષયનું  
વર્ણન કરતાં શ્રુતિઓ પરમાત્માની સ્તુતિ કરે છે.) હે પ્રભુ ! સ્વતઃ ત્રિગુણાત્મક,  
જીવાત્માઓના કર્મના ફળરૂપ અને પ્રત્યક્ષપણે જોયામાં આવતું. એવું આ સ્થૂલ  
જગત સૃષ્ટિથી પહેલાં સ્થૂલરૂપે જોયામાં આવતું ન હતું. તેથી કહેવામાં આવે છે કે  
આ જગત સૃષ્ટિથી પહેલાં ન હતું. અર્થાત્ સૂક્ષ્મરૂપે તો હતું જ. અને વળી પ્રલય  
પછી પણ સ્થૂલરૂપે નહિ હોય. એજ કારણથી કેવળ મધ્યે જ સ્થૂલરૂપે સર્વેને  
જોયામાં આવતું જે આ જગત, તેને અજ્ઞાની પુરુષોએ સત્યપણે ( અનુપ્રિતમ )  
જાણેલું છે. ઇતાંપણ જ્યારે આનંદની પરાકાષ્ટારૂપ તમારા સ્વરૂપનું યથાર્થ જ્ઞાન  
થાય છે ત્યારે, આદિને વિષે અને અંતને વિષે સૂક્ષ્મરૂપે રહેલું. આ જગત ( મૃષા  
વિભાતિ ) દુઃખરૂપ હોવાથી અતિ તુચ્છ અને નહિ વર્ણન કરવા યોગ્ય થાય છે.  
છતાં આ જગત જીવાત્માઓના કર્મફળરૂપ હોવાને કારણે જ અમો શ્રુતિઓ,  
દ્રવ્ય એટલે જીવોના સ્વરૂપનું આવરણ કરનારી પ્રકૃતિ, જ્ઞાતિઓ એટલે સત્ત્વગુણ,

સ યદજયા ત્વજામનુશીયીત ગુણાંશ જુષન् ભજતિ સરૂ પતાં તદનુ મૃત્યુમેતભગ: ।  
ત્વમુત જહાસિ તામહિરિવ ત્વચમાત્તભગો મહસિ મહીયસેઽષ્ટગુણિતે�પરિમેયભગ: ॥૩૮

રજોગુણ અને તમોગુણરૂપ પ્રકૃતિની સ્વરૂપભૂત જ્ઞાતિઓ, તથા જ્ઞાતિઓના  
વિકલ્પો એટલે દેવ, મનુષ્ય, પશુ, પક્ષી એ આદિક ભેદો, તથા તે ભેદોના માર્ગો  
એટલે ઊંચ નીચ રૂપ અવાન્તર ભેદો, તેઓની સમાનપણે આ જગતનું નિરૂપણ  
કરીએ છીએ. આ રીતે અમો શ્રુતિઓ દ્વારા વર્ણન કરાયેલું અને નાશવંત એવા  
મનના વિલાસો જેને વિષે રહેલા છે. ( અર્થાત્ કેવળ મનના વિલાસરૂપ ) એવું આ  
જગત અસત્ય અને દુઃખરૂપ છે, છતાંપણ હે પ્રભુ ! અજ્ઞાની પુરુષો સત્ય અને  
સુખરૂપ એવા તમારો ત્યાગ કરીને જગતને જ સત્ય અને સુખરૂપ જાણે છે.<sup>૩૯</sup>  
( આ જગતને વિષે ત્રણ પ્રકારના પુરુષો છે. તેમાં એક કર્મપરતંત્ર અજ્ઞાની પુરુષો,  
અને બીજા સ્વતંત્ર પરમાત્માના અવતાર પુરુષો તથા ત્રીજા સકામ અને નિષ્કામ  
પરમાત્માના ભક્ત પુરુષો, આ ત્રણે પુરુષોનું વર્ણન અનુકૂમે કરતાં ત્રણ શ્લોકથી  
શ્રુતિઓ પરમાત્માની સ્તુતિ કરે છે.) હે ભગવન્ ! કર્મ પરતંત્ર અજ્ઞાની પુરુષો જે  
કારણથી અનાદિ અવિદ્યારૂપ માયા વડે મોહિત થયેલા છે, એ જ કારણથી પ્રકૃતિના  
પરિણામરૂપ દેવ, મનુષ્યાદિક આકારોમાં શયન કરે છે. અર્થાત્ દેવ મનુષ્યાદિકના  
શરીરોને ધારણ કરે છે. અને ત્યારપણી શષ્ઠાદિક વિષયોને સેવતાં તેના  
સમરૂપપણાને પામે છે. અર્થાત્ દેવ મનુષ્યાદિકના શરીરોને વિષે જ  
આત્માભિમાની થાય છે. અને ત્યાર પછી મૃત્યુને પામે છે. આ રીતે જીવો  
જન્મમરણરૂપી સંસૃતિના ભોક્તા હોવાથી જાણ ઐશ્વર્યાદિકથી રહિત હોય  
તેવા થાય છે, પણ એ બદ્ધ જીવો જ્ઞાન ઐશ્વર્યાદિકથી રહિત થતા નથી, પરંતુ  
કેવળ જ્ઞાન ઐશ્વર્યાદિકની સંકુચિત અવસ્થાવાળા થાય છે. ( આ પ્રમાણે કર્મપરતંત્ર  
અજ્ઞાની પુરુષોનું વર્ણન કરવામાં આવ્યું, હવે સ્વતંત્ર પરમાત્માના  
અવતારપુરુષોનું વર્ણન કરતી શ્રુતિઓ પરમાત્માની સ્તુતિ કરે છે) કે હે પ્રભુ !  
અપહતપામત્વાદિ કલ્યાણકારી ગુણોથી યુક્ત એવા તમો તો પરમ દયાથી  
મનુષ્યોના કલ્યાણને માટે રામકૃષ્ણાદિક દેવ મનુષ્યરૂપે પ્રાદુર્ભાવને પામો છો.  
અને પોતાના સ્વભાવનો અને ઐશ્વર્યનો ત્યાગ કર્યા વિના જ દેવમનુષ્યાદિકને  
અનુકૂળ પોતાનો સ્વભાવ બનાવી કરી, ભક્તજનોએ અર્પણ કરેલા ભોગોને  
ભોગવો છો. અને પછી સર્વ જેમ ઉપરની ત્વચાનો ત્યાગ કરે, તેમ તમો

यदि न समुद्धरन्ति यतयो हृदि कामजटा दुरधिगमोऽसतां हृदि गतोऽस्मृतकण्ठमणिः ।  
असुतृपयोगिनामुभयतोऽप्यसुखं भगवन्ननपगतान्तकादनधिस्तृष्टपदाद् भवतः ॥३९  
त्वद्वगमी न वेत्ति भवदुत्थशुभाशुभयोर्गुणविगुणान्वयांस्तर्हि देहभृतां च गिरः ।  
अनुयुगमन्वहं सगुण गीतपरम्परया श्रवणभृतो यतस्तवमपवर्गगतिर्मनुजैः ॥४०

देवमनुष्यादिकने अनुरूप स्वीकारेल स्वभावरूप प्रकृतिनो त्याग करो छो. अने पछी समस्त महा ऐश्वर्योथी संपत्र अचिन्त्य भृत्यामावाणा थई, अपहतपामत्वादि आठ गुणोथी युक्त स्वयंप्रकाश एवा स्वस्वरूपने विषे विराजो छो.<sup>३९</sup> (भगवानने विषे भक्तिवाणा छतां सवासनिक सकामपुरुषो योगभ्रष्ट थवाथी बे प्रकारना हुःभने पामे छो, ऐ बाबतनुं वर्षन करतां श्रुतिओ परमात्मानी स्तुति करे छो.) हे भगवन् ! तमारा चरित्रोना श्रवण कीर्तनादिक भक्तिमां तत्पर थयेला एवा पाण मुनिओ, जो हृदयमां रहेली वासनाने निर्भूण करे नहि तो ऐ सवासनिक सकामभक्तोना हृदयमां आप सभीपे ज रहेला होवा छतां पाण प्राम करवा अति कठिन छो. अन्यत्र आसक्तिना कारणो सभीपे रहेवा छतांपशा दूर रहेलानी पेठे आप जणाता नथी. जेम कंठने विषे भणी धारण करेलो होय, छतांपशा जो ऐ मणि विस्मृतिने पामेलो होय तो ते मणि कंठमां सभीपे होवा छतां अप्रामनी समान जणाय छो. तेम आप सभीपे हृदयमां ज रहेवा छतां सवासनिक सकामीभक्तोने दूर जणाओ छो. केवण अटलुं ज नहि पोताना प्राणोने ज तृप्त करनारा, अर्थात् कामभोगने विषे तृप्तिथी रहित एवा जे सवासनिक योगीओ छो, तेमने बे प्रकारनुं हुःभ ज प्राम थाय छो. तेमां एक तो सवासनिक होवाथी तमारुं अक्षर नामनुं स्थान तेने प्राम थतुं नथी, पाण योगभ्रष्ट एवा ते योगीओ तमारी भक्तिना प्रतापथी नरकनी समान बहु हुःभथी भरेला स्वर्ग स्थानने पामे छो. अने ऐ स्वर्ग स्थाननुं सुख तमारा धामना सुखनी आगण नरकनी समान छो. माटे ऐ स्वर्गनुं सुख पाण एक हुःभ ज छो. अने ऐ स्वर्गने विषे नहि निवृत्तिने पामेला भृत्यु थकी भय प्राम थाय छो. माटे काणनो भय ऐ बीजुं हुःभ छो. आ प्रमाणे सवासनिक, सकामी भक्तोने बे प्रकारनुं हुःभ प्राम थाय छो.<sup>४०</sup> (हवे निर्वासनिक एवा जे निष्कामी भक्तो छो, ऐ आन्यंतिक सुखने पामे छो. ऐ विषयनुं वर्षन करतां श्रुतिओ परमात्मानी स्तुति करे छो.) हे भगवन् ! हित्य जन्म अने कर्मथी युक्त एवा तमारा स्वरूप, स्वभाव,

द्युपतय एव ते न ययुरन्तमनन्ततया त्वमपि यदन्तराणडनिचया ननु सावरणाः ।  
ख इव रजांसिवान्ति वयसा सह यच्छ्रुतयस्त्वयि हि फलन्त्यतन्त्रिरसनेन भवन्त्रिधनाः ॥४१  
गुण, अने विभूतिने यथार्थ ज्ञाणानारा अने निष्कामी एवा जे एकांतिक ज्ञानी भक्तो छो, ऐ कर्मक्षणप्रदाता एवा तमारी प्रेरणाथी इण आपवा सज्ज थयेलां शुभ अने अशुभ कर्मना इणरूप सुखदुःखना संबन्धनुं अनुसंधान राखता नथी. अर्थात् आत्मा परमात्माना यथार्थ ज्ञानथी सुख अने हुःभने गणकारता नथी, तो पछी देहधारी पुरुषोनां स्तुति अने निंदानां वाक्योने न गणकारे ऐभां कहेवुं ज शुं ? न ज गणकारे. अने वणी दरेक युगमां सच्छास्त्रोनी अंदर कहेला सत्य-शौचादि गुणोनी साथे वर्तती ऐवी जे कथाओ, तेओनी परंपराए प्रतिदिन साधुपुरुषो थकी मुमुक्षु पुरुषो ए कर्ण ईन्द्रियो द्वारा चितने विषे धारण करेला एवा तमो ज, ऐ एकांतिक भक्तोना देहने अंते मोक्षना परम गतिरूप छो. अर्थात् ऐ एकांतिक भक्तोना हृदयमां रहेलां सर्वे अमंगणोने दूर करीने तेओने आप आन्यंतिक सुख आपो छो.<sup>४०</sup> (भगवानना गुण विभूत्यादिक तो अनन्त होवाथी समग्रपशे ऐ गुणविभूत्यादिकुं वर्षन करवुं ऐ अति कठिन छो. तेथी हवे श्रुतिओ परमात्मानी स्तुतिनो उपसंहार करतां कहे छो.) हे अपरिमित-गुणगण ! तमारां स्वरूपो अने गुण विभूत्यादिक अनंत होवाथी स्वर्गादिक लोकोना अधिपतिओ जे ईन्द्र, ब्रह्मादिक देवो पाण तमारा स्वरूप स्वभावादिकना पारने पामता नथी, अक्षरपुरुषादि करोडे करोड मुक्तो पाण तमारा स्वरूप स्वभावादिकना पारने पामता नथी. बहु शुं कहेवुं ? सर्वे देवो तथा मुक्तोना अधिपति तमो पाण तमारा स्वरूप स्वभावादिकना पारने पामता नथी. कारण के तमारा स्वरूप स्वभावादिक अपरिच्छिन्न छो. जेम आकाशने विषे काण सहित अनेक परमाणुओ ऊडतां फेरे छो. तेम आठ आठ आवरणो सहित अनेक ब्रह्मांडो आपना एक रुंवाडांना छिद्रने विषे ऊडतां फेरे छो. हे प्रभु ! जे कारणीथी तमो आवा भृत्यामावाणा छो, ऐ ज कारणीथी अमो श्रुतिओ (अतन्त्रिरसनेन) अतत् क्षर अक्षर शब्दथी कहेवा योऽय बद्धमुक्त क्षेत्रश ज्ञवोना उत्कृष्टपणानो निषेध करीने (तमारी अपेक्षाए बद्धमुक्त सर्वे ज्ञवो उत्कृष्ट नथी.) तमारे विषे प्रवेश पामी करी सङ्कण थई ए छीओ. (शब्दवृत्तिथी के तात्पर्यवृत्तिथी बद्धमुक्त ज्ञवोनी साथे सादृश्यपणानो निषेध करी, ऐ सर्वथी विलक्षण तमारा स्वरूपनुं निरूपण

श्रीभगवानुवाच

इत्येतद्ब्रह्मणः पुत्रा आश्रुत्यात्मानुशासनम् । सन्नदनमथानर्चुः सिद्धा ज्ञात्वाऽऽत्मनो गतिम् ४२  
इत्येषसमान्यायपुराणोपनिषद्ग्रसः । समुद्भूतः पूर्वजातैर्व्येमयानैर्महात्मभिः ॥४३  
त्वं चैतद्ब्रह्मदायाद श्रद्धयाऽऽत्मानुशासनम् । धारयंश्वर गां कामं कामानां भर्जनं नृणाम् ४४

श्रीशुक उवाच

एवं स ऋषिणाऽऽदिष्टं गृहीत्वा श्रद्धयाऽऽत्मवान् । पूर्णः श्रुतधरो राजनाह वीरव्रतो मुनिः ४५  
नारद उवाच

नमस्तस्मै भगवते कृष्णायामलकीर्तये । यो धर्ते सर्वभूतानामभवायोशतीः कलाः ॥४६  
इत्याद्यमृषिमानस्य तच्छ्रियांश्च महात्मनः । ततोऽगादाश्रमं साक्षात् पितुद्वैपायनस्य मे ॥४७

करीने कृतार्थं थर्थिअे धीअे.) पाणि समग्रपणे तमारा स्वरूप स्वभावादिकुनु वर्णन करवा माटे अमो समर्थ नथी, आवो भाव छे.<sup>४१</sup> नारायण भगवान कुहे छे हे नारद ! आ प्रमाणे परमात्माना माहात्म्यने भतावनार उपदेशरूपी आ उत्तरने सांभणी, परमात्मानु यथार्थ माहात्म्य जाणी, ब्रह्माना मानसपुत्रो जे सनकादिको पोते सिद्ध होवा छतां वक्ता ऐवा सनन्दननी पूजा करी.<sup>४२</sup> हे देवर्षि ! आ प्रमाणे सूष्टिना प्रारंभमां सर्वथी पहेलां उत्पत्त थयेला, योगशक्तिथी आकाशमार्गे विचरण करनारा ऐवा बुद्धिमान सनकादिकोअे प्रश्नोत्तरद्वारा भंथन करीने माखणरूपे समग्रवेदो, पुराणो अने उपनिषदोनो सार भहार काढेलो छे.<sup>४३</sup> ब्रह्माना मानसपुत्र ऐवा हे नारद ! तमो पण मनुष्योनी समग्र वासनाओने बाणीने भस्म करी नाखनार आ परमात्माना स्तवनरूप ब्रह्मविद्याने श्रद्धाथी हृदयमां धारण करीने ईश्वानुसार पृथ्वी उपर विचरण करो.<sup>४४</sup> शुकदेवजु कुहे हे परीक्षित ! महान संयमी, जेवुं सांभणेलुं होय तेवुं ज तरत धारण करी लेनार, नैषिकब्रह्मचारी अने पूर्ण ऐवा नारदज्ज, आ प्रमाणे बदरिकाश्रमवासी नारायण भगवाने आपेला उपदेशने श्रद्धा वडे ग्रहण करीने, गुरु ऐवा नारायण भगवानने आगण कुहेवाशे ए प्रमाणे कुहेवा लाग्या.<sup>४५</sup> नारद कुहे छे हे प्रभु ! तमो सर्वने सुख करनारा छो, समग्र ऐश्वर्यथी संपत्त छो. तमारी मूर्ति कर्मधीनथी रहित परम पवित्र छे. जे तमो समग्र प्राणीओना भोक्षने माटे निर्मण विद्याओने धारण करनारा छो. आवा तमोने हुं नमस्कार करुं छुं.<sup>४६</sup> हे राजन् ! आ प्रमाणे सर्वना आदि ऐवा नारायण भगवानने नमस्कार करी, सभामां बिराजेला सर्व ऋषिओने पाणि नमस्कार करी महामनवाणा नारदज्ज त्यांथी

सभाजितो भगवता कृतासनपरिग्रहः । तस्मै तद् वर्णयामास नारायणमुखाच्छुतम् ॥४८  
इत्येतद्वर्णितं राजन् ! यन्नः प्रश्नः कृतस्त्वया । यथा ब्रह्मण्यनिर्देश्ये निर्गुणेऽपि मनश्चरेत् ४९  
योऽस्योत्तेक्षकादिमध्यनिधने योऽव्यक्तजीवेश्वरो ।  
यः सृष्टेदमनुप्रविश्य ऋषिणा चक्रे पुरःशास्ति ताः ॥  
यं संपद्य जहात्यजामनुशयी सुषः कुलायं यथा ।  
तं कैवल्यनिरस्तयोनिमध्यं ध्यायेदजस्तं हरिम् ॥५०॥

इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे उत्तरार्थं नारदनारायणसंवादे वेदस्तुतिर्नाम सप्तशीतितमोऽद्यायः ॥८७॥

मारा पिता ऐवा साक्षात् व्यासज्जना आश्रममां पधार्या.<sup>४७</sup> भगवान व्यासज्जु ऐ नारदज्जनो यथायोग्य सत्कार कर्यो, नारदज्जु ऐ आसननो स्वीकार कर्यो. अने त्यारपछी महात्मा नारदज्जु ऐ नारायण भगवानना मुख्यकी जे सांभणेलुं हतुं, ए सर्वे भारा पिता व्यासज्जु ने संभणाव्युं.<sup>४८</sup> हे परीक्षित ! मनवाणीथी अगोचर, सर्वव्यापक अने निर्गुण ऐवा परमात्माना स्वरूपने विषे जे रीते भन प्रवेशी शके छे, ए सर्वे में तमारी आगण वर्णन कर्यु. के जे तमोअे भने पूर्वे प्रक्षेप करेलो हतो.<sup>४९</sup> जे भगवान आ जगतनी उत्पत्ति, स्थिति अने प्रलयना निमित्ते संकल्प कर्ता छे. (अर्थात् संकल्प कर्ता होवाथी परमात्मा ज आ जगतना निमित्ता कारण छे.) जे भगवान कारण अवस्थाए रहेलां प्रकृतिपुरुषनी अंदर प्रवेशीने तेना नियन्ता छे. तेथी ऐ परमात्मा ज उपादान कारण छे. जे भगवान महात्वथी आरंभीने पृथ्वी पर्यंतना समष्टि तत्त्वोने सर्ज, ज्ञवद्वारा तेनी अंदर अनुप्रवेशीने समग्र शरीरो निर्माण करेलां छे. अने त्यार पाणी ऐ ज परमात्मा ऐ शरीरोनु नियन्त्रण करे छे, अने वली जेम माणाने विषे थोडो समय सूतेलुं पक्षी पाणि समग्र प्राम थतां माणानो त्याग करीने उती जाय छे, तेम कर्मवश अज्ञानी ज्ञव जे परमात्माने पाभी करी प्रकृतिसंबन्धनो त्याग करे छे. (अर्थात् मुक्तिदशाने पामे छे.) अने जे परमात्मा संसारी ज्ञवोने मोक्षानुं प्रदान करीने मनुष्यादिक योनिओना हुःभने हूर करनारा छे. जे परमात्मा निर्भय छे, अने शरणे आवेलाओनी पीडाने हरनारा छे. आवा परमात्मानुं निरंतर ध्यान करवुं जोईअे.<sup>५०</sup>

इति श्रीमद् महापुराणा भागवतना दशमस्कन्धनो सप्तशीतिमो अद्याय संपूर्णः.

अथ अष्टाशीतितमोऽध्यायः (८८)

॥ राजोवाच ॥

देवासुरमनुष्ये ये भजन्त्यशिवं शिवम् । प्रायस्ते धनिनो भोजा न तु लक्ष्म्याः पर्ति हरिम् ॥१  
एतद् वेदितुमिच्छामः संदेहोऽत्र महान् हिनः । विरुद्धशीलयोः प्रभ्वोर्विरुद्धा भजतां गतिः २

श्रीशुक उवाच

शिवः शक्तियुतः शश्वत् त्रिलङ्घो गुणसंवृतः । वैकारिकसैजसश्च तामसश्चेत्यहं त्रिधा ॥३  
ततो विकारा अभवन् षोडशामीषु कञ्चन । उपधावन् विभूतीनां सर्वासामशनुते गतिम् ॥४  
हरिर्हि निर्गुणः साक्षात् पुरुषः प्रकृतेः परः । स सर्वदृगुपद्रष्टा तं भजन् निर्गुणो भवेत् ॥५

अध्याय ८८

विष्णुना भक्तने भोक्ष प्राख्निनुं वर्णन तथा जीजा देवोना  
भक्तने ऐश्वर्य प्राख्निनुं वर्णन.

परीक्षित राजा पूछे छे हे मुने ! દેવ અસુર અને મનુષ્યોમાં જે લોકો શિવ કે  
જેમણે ભોગસુખનો તિરસ્કાર કરેલ છે તેમને ભજે છે; તેઓ ધાંશું કરીને ધનવાન  
અને ભોગ ભોગવનારા થાય છે. અને જેઓ વિષ્ણુ કે જે લક્ષ્મીના પતિ છે તેમને  
ભજે છે તેઓ ધનવાન् તથા ભોગ ભોગવનારા થતા નથી. આ વિષયનું કારણ  
જાણવાને ઈચ્છાએ છીએ. શિવ અને વિષ્ણુ કે જે ઓ નિર્ધનપણા અને  
ધનવાનપણાને લીધે વિરુદ્ધ સ્વભાવવાળા છે તેઓને ભજનારાઓની સ્થિતિ વિરુદ્ધ  
થાય છે. એટલે શિવને ભજનારા ધનવાન થાય છે, એ વિષયમાં અમને મોટો  
સંદેહ છે.<sup>૧-૨</sup>

શુકદેવજી કહે છે પાર્વતી નામની શક્તિથી યુક્ત શિવ સર્વદા સાત્ત્વિક,  
રાજસ અને તામસ આ ત્રણ પ્રકારના અહંકારથી યુક્ત છે. તેમાં શિવને વિષે  
તમોગુણ પ્રધાન છે. એ ત્રણપ્રકારના અહંકાર થકી અગિયાર ઈન્દ્રિયો અને  
તન્માત્રાઓ સહિત પાંચભૂતો, આ સોળ વિકારો ઉત્પત્ત થાય છે. આ વિકારોના  
અધિ દેવતાઓને ભજનારો પુરુષ એ અધિદેવતા દ્વારા પ્રાપ્ત થવાને શક્ય તમામ  
ऐશ્વર્યને પામે છે.<sup>૩-૪</sup> સર્વના કારણપણે પ્રસિદ્ધ વિષ્ણુ તો નિર્ગુણ છે. અર્થાત्  
સત્ત્વાદિમિશ્ર પ્રાકૃત ગુણોથી રહિત સદા શુદ્ધ સત્ત્વમય છે તેથી નિર્ગુણ છે, અને  
જીબન ઐશ્વર્યાદિ છ ભગોથી યુક્ત છે. પરા પ્રકૃતિ અને અપરા નામની પ્રકૃતિથી  
વિલક્ષણ છે, સર્વજ્ઞ છે, માટે વિષ્ણુને ભજનારા પુરુષો નિર્ગુણ થાય છે, અર્થાત्

નિર્વિતેષ્વશ્રમેષ્ઠો રાજા યુષ્પત્તિતામહઃ । શૃષ્ટવન् ભગવતો ધર્માનૃપૃછ્છદિદમચ્યુતમ् ॥૬  
સ આહ ભગવાંસ્તસ્તમૈ પ્રીતઃ શુશ્રૂષવે પ્રભુઃ । નૃણાં નિઃશ્રેયસાર્થાય યોગવતીર્ણો યદોઃ કુલે ॥૭  
શ્રીભગવાનુવાચ

યસ્યાહમનુગૃહામિ હરિષ્યે તદ્ધનં શનૈઃ । તતોऽધનં ત્વજન્ત્યસ્ય સ્વજના દુઃખદુઃખિતમ् ॥૮  
સ યદા વિતથોદ્યોગો નિર્વિષણઃ સ્યાદ् ધનેહ્યા । મત્પરૈઃ કૃતમૈત્રસ્ય કરિષ્યે મદનુગ્રહમ् ॥૯  
તદ્બ્રહ્મ પરમં સૂક્ષ્મં ચિન્માત્રં સદનન્તકમ् । અતો માં સુદુરારાધ્યં હિત્વાન્યાન્ ભજતે જનઃ ॥૧૦  
તત્ત્સત આશુતોષેભ્યો લબ્ધરાજ્યશ્રિયોદ્ધતાઃ । મત્તાઃ પ્રમત્તા વરદાન્ વિસ્મરન્ત્યવજાનતે ॥૧૧

શ્રીશુક ઉવાચ

શાપપ્રસાદયોરીશા બ્રહ્મવિષ્ણુશિવાદયઃ । સદાઃશાપપ્રસાદોऽઙ્ગ શિવો બ્રહ્મા ન ચાચ્યુતઃ ॥૧૨

પ્રાકૃત ગુણોના સંબન્ધથી રહિત થઈને મુક્ત દશાને પામે છે.<sup>૫</sup> તમારા દાદા  
યુધિષ્ઠિર રાજાએ પોતાના અશ્વમેધ યજો પૂરા થયા પછી ભગવાન પાસેથી ધર્મ  
સંબંધી વિષયોનું શ્રવણ કરતાં ભગવાનને આ વાત પૂછી હતી.<sup>૬</sup> શ્રીકૃષ્ણ ભગવાન  
મનુષ્યોનું કલ્યાણ કરવા સારું યદ્દુકુળમાં અવતર્યા હતા, તે શ્રીકૃષ્ણે શ્રવણ કરવાની  
ઈચ્છા રાખનાર યુધિષ્ઠિર રાજાને પ્રસન્ન થઈને આ પ્રમાણે ઉત્તર આપ્યો.<sup>૭</sup>

ભગવાન કહે છે જે મારો ભક્ત વિષયોને છોડી દેવાની ઈચ્છા કરતો હોય  
તોપણ વાસનાની પ્રબળતાથી છોડી શકતો ન હોય અને ભોગવતાં મુંજાતો હોય,  
તેના ઉપર અનુગ્રહ કરવા સારું હું ધીરે ધીરે તેના ધનને હરી લઉં છું. પછી તે  
નિર્ધન અને બધુ જ દુઃખી જેવો જણાતાં તેના સંબંધીઓ તેને છોડી દે છે.<sup>૮</sup> એ  
ભક્ત પાછો બંધુઓના અનુગ્રહથી ધન મેળવવાના ઉદ્ઘોગ કરે, પણ મારા  
અનુગ્રહથી જ્યારે તેના ઉદ્ઘોગ વ્યર્થ જાય અને તેમ થતાં જ્યારે પ્રબળ વૈરાગ્ય  
થાય ત્યારે તે ભક્ત મારા બીજા ભક્તોની સાથે મિત્રતા કરે એટલે પછી તેના  
ઉપર હું પરમ અનુગ્રહ કરું છું.<sup>૯</sup> મારો પરમ અનુગ્રહ એજ હોય છે કે ચૈતન્યમાત્ર,  
સત્ય, અનંત અને સૂક્ષ્મ એવું મારું પરબ્રહ્મ સ્વરૂપ તેમને હું આપું છું. આ પ્રમાણે  
જે મારી આરાધના કરવી બધુ જ કઠણ છે, તેથી મને છોડીને લોકો બીજા  
દેવતાઓને ભજે છે.<sup>૧૦</sup> પછી બીજા દેવતાઓ કે જેઓ તરત પ્રસસ થાય એવા છે,  
તેઓની પાસેથી રાજ્ય લક્ષ્મી પ્રાપ્ત થતાં ઉદ્ઘત અને મદોન્મત થયેલા તે લોકો  
પ્રમાદમાં પરીને પોતાને વરદાન દેનારાઓને ભૂલી જાય છે એટલું જ નહીં પણ  
તેઓનું અપમાન કરે છે.<sup>૧૧</sup>

શુકદેવજી કહે છે હે પરીક્ષિત રાજા ! બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એ ત્રણેદેવ

अत्र चोदाहरन्तीमितिहासं पुरातनम् । वृक्षासुराय गिरिशो वरं दत्त्वाऽप्य सङ्कटम् ॥१३  
 वृक्षो नामासुरः पुत्रः शकुनेः पथि नारदम् । दृष्टाऽशुतोषं पप्रच्छ देवेषु त्रिषु दुर्मतिः ॥१४  
 स आह देवं गिरिशमुपाधावाशु सिद्धयसि । योऽल्पाभ्यां गुणदोषाभ्यामाशु तुष्यति कुप्यति ॥१५  
 दशास्यबाणयोस्तुष्टः स्तुवतोर्वन्दिनेऽरिव । ऐश्वर्यमतुलं दत्त्वा तत आप सुसङ्कटम् ॥१६  
 इत्यादिष्टस्तमसुर उपाधावत् स्वगत्रतः । केदार आत्मऋच्येण जुह्नोऽग्निमुखं हरम् ॥१७  
 देवोपलब्धिमप्राप्य निर्वेदात् सप्तमेऽहनि । शिरोऽवृश्तं स्वधितिना तत्तीर्थकिलन्नमूर्धजम् ॥१८  
 तदा महाकारुणिकः स धूर्जटिर्यथा वयं चाग्निरिवोत्थितेऽनलात् ।  
 निगृह्य दोर्घ्या भुजयोर्यवायत् तत्स्पर्शनाद् भूय उपस्कृताकृतिः ॥१९ ॥  
 तमाह चाङ्गलमलं वृणीष्व मे यथाभिकामं वितरामि ते वरम् ।  
 प्रीयेय तोयेन नृणां प्रपद्यतामहो त्वयाऽत्मा भृशमर्द्यते वृथा ॥२० ॥

शाप तथा अनुग्रह करवामां समर्थ छे. तेओमां शिव अने ब्रह्मा ए बे देव प्रसन्न पश तरत थाय छे अने शाप पश तरत आपे छे, अने विष्णु तो तरत प्रसन्न पश थता नथी अने तरत शाप पश आपता नथी.<sup>१२</sup> सदाशिव वृक्षासुरने वरदान आपीने पोते संकट पाभ्या हता, ए जूनो ईतिहास आ विषयमां उदाहरण रूपे कहुं छुं.<sup>१३</sup> शकुनिना दीकरा दुर्भुद्धिवाणा वृक्षासुरे मार्गमां नारदज्ञने ज्ञोईने तेमने पूछ्युं के त्रश देवमां तरत प्रसन्न थाय एवा कया देव छे?<sup>१४</sup> नारदज्ञभे कहुं के “तुं सदाशिवने शरणे ज्ञ के जे सदाशिव थोडा गुणथी तरत प्रसन्न थाय छे अने थोडा दोषथी तरत रीस करे छे, आम करीश तो तने तरत सिद्धि भण्शे.”<sup>१५</sup> रावण अने भाण्डासुर सदाशिवनी बंदिजननी पेठे स्तुति करता हता, तेमना पर प्रसन्न थईने सदाशिवे भारे ऐश्वर्य आप्युं हतुं, पश तेमांथी पोताने ज भारे संकट प्राप्त थयुं हतुं.”<sup>१६</sup> आ प्रमाणे नारदज्ञना कहेतां ते वृक्षासुर केदारक्षेत्रमां सदाशिव उपर तप करवा लाग्यो. महादेवने प्रसन्न करवा सारु पोताना शरीरमांथी मांस कापी कापीने अग्निमां होमवा लाग्यो.<sup>१७</sup> आम करतां सात दिवस थया तो पश महादेव दर्शन नहि देतां वृक्षासुरे कायर थईने पोतानुं माथुं पोताना हथियारथी कापी नाखवा मांडयुं.<sup>१८</sup> ते समयमां महा दयाणु सदाशिवे अग्निमांथी देहधारी अग्निनी पेठे नीकलीने, वृक्षासुरने पोताना हाथथी तेना बे हाथ पकडीने वायो. महादेवनो स्पर्श थतां वृक्षासुरनो देह पाछो साजो थई गयो.<sup>१९</sup> महादेवे ते वृक्षासुरने कहुं के “हे भक्त! वरदान माग, जे तने ज्ञोईतुं होय ते आपीश. अहो!!! हुं मारा शरणागतो उपर जणना अभिषेकथी पश प्रसन्न

देवं स वक्रे पापीयान् वरं भूतभयावहम् । यस्य यस्य करं शीर्षिं धास्ये स प्रियतामिति ॥२१  
 तच्छुत्वा भगवान् रुद्रो दुर्मना इव भारत ! । ओमिति प्रहसंस्तस्मै ददेऽहरमृतं यथा ॥२२  
 इत्युक्तः सोऽसुरो नूनं गौरीहरणलालसः । स तद्वरपरीक्षार्थं शम्भोर्मूर्धिं किलासुरः ।  
 स्वहस्तं धातुमारेभे सोऽबिभ्यत् स्वकृताच्छिवः ॥२३  
 तेनोपसृष्टः संत्रस्तः पराधावन् सवेपथुः । यावदन्तं दिवो भूमे: काष्ठानामुदगादुदक् ॥२४  
 अजानन्तः प्रतिविधिं तूष्णीमासन् सुरेश्वराः । ततो वैकुण्ठमगमद् भास्वरं तमसः परम् ॥२५  
 यत्र नारायणः साक्षात्त्वासिनां परमा गतिः । शान्तानां न्यस्तदण्डानां यतो नावर्तते गतः २६  
 तं तथाव्यसनं दृष्ट्वा भगवान् वृजिनार्दनः । दूरात् प्रत्युदियाद् भूत्वा वटुको योगमायया ॥२७  
 मेखलाजिनदण्डाक्षेस्तेजसाग्निरिव ज्वलन् । अभिवादयामास च तं कुशपाणिर्विनीतवत् ॥२८  
 श्रीभगवानुवाच

शाकुनेय भवान् व्यक्तं श्रान्तः किं दूरमागतः । क्षणं विश्रम्यतां पुंस आत्मायं सर्वकामधृक् ॥२९

थाउं छुं, भाटे तारा देहने तुं वृथा पीडा करे छे.”<sup>२०</sup> महापापी वृक्षासुरे सदाशिव पासेथी लोकोने त्रास आपे एवुं वरदान मायुं के “हुं जेनी उपर हाथ मूँकुं ते भरी ज्वो ज्ञोईअे.”<sup>२१</sup> हे राजा ! आ वयन सांभणी जाणे उदास थयेला होय एवा शंकरे, सर्पने जेम दूध आपे तेम हसीने ते देत्यने “तथास्तु” एम बोलीने तेवुं वरदान आप्युं.<sup>२२</sup> आवुं वरदान पामीने ते देत्यने पार्वतीनुं हरण करवानी ईर्थ्या थई. पछी ते वरदाननी परीक्षा लेवा सारु ते देत्ये महादेवने माथे ज पोतानो हाथ मूँकवानी ईर्थ्या करी. महादेव पोताना आपेला वरदानथी पोते भय पाभ्या. देत्य शिवनी पछवाडे दोडतां त्रास पामेला महादेव पृथ्वीना अंत सुधी भाग्या अने दिशाओमां उत्तरादिकोर पश गया.<sup>२३-२४</sup> कोई उपाय नहीं जाणवामां आवतां सर्वे मोटा देवताओ चुप थई रह्या. पछी अंधकारथी पर, सुप्रकाशित, शांत, सर्वने अभय आपनारा नारायण ज्यां रह्या छे एवा श्वेतद्वीपमां गया के त्यां गयेलाने पाछो भवनो फेरो होतो नथी.<sup>२५-२६</sup> महादेवनुं ए दुःख ज्ञोई, कष्टने दूर करनार भगवान् पोतानी योगमायाथी बटुक थईने दूरथी ते देत्यनी सामे आव्या.<sup>२७</sup> भेघणा, मृगयर्म, दंड अने माणाने धरनार, तेजथी अग्निनी पेठे प्रकाशता अने जेना हाथमां दर्भ हता एवा ए बटुके नम्रताथी देत्यनुं अभिवादन करी आ प्रमाणे कहुं.<sup>२८</sup>

भगवान् कहे छे हे शकुनिना पुत्र ! तमे अवश्य थाकी रहेला जणाओ छो. आटला दूर प्रदेशमां शा माटे आव्या छो ? थोडीवार विसामो लो, केमके आ देह

यदिनः श्रवणायालं युष्मद्व्यवसितं विभो! । भण्यतां प्रायसः पुम्भिर्धृतैः स्वार्थान् समीहते ३०

श्रीशुक उवाच

एवं भगवता पृष्ठे वचसामृतवर्षिणा । गतकल्मोऽब्राहीत् तस्मै यथापूर्वमनुष्टितम् ॥३१

श्रीभगवानुवाच

एवं चेत्तर्हि तद्वाक्यं न वयं श्रहधीमहि । यो दक्षशापात् पैशाच्यं प्राप्तः प्रेतपिशाचराद् ॥३२

यदि वस्त्र विश्रम्भो दानवेन्द्र ! जगदुरौ । तर्हङ्गाशु स्वशिरसि हस्तं न्यस्य प्रतीयताम् ॥३३

यद्यसत्यं वचः शम्भोः कथंचिद् दानवर्षभ ! । तदैनं जह्यसद्वाचं न यद्वक्तानृतं पुनः ॥३४

इत्थं भगवतश्चित्रैर्वचोभिः स मुपेशलैः । भिन्नधीर्विस्मृतः शीर्षिं स्वहस्तं कुमतिर्व्यथात् ॥३५

अथापतद्भिन्नशिरा वज्राहत इव क्षणात् । जयशब्दे नमः शब्दः साधुशब्दोऽभवद्विवि ॥३६

मुमुक्षुः पुष्पवर्षाणि हते पापे वृकासुरे । देवर्षिपितृगन्धर्वा मोचितः सङ्कटाच्छिवः ॥३७

मुकुं गिरिशमभ्याह भगवान् पुरुषोत्तमः । अहो देव महादेव पापोऽयं स्वेन पाप्ना ॥३८

सर्व मनोरथोने आपनार छे भाटे तेने भडु परिश्रम नहीं देवो जोईये.<sup>२९</sup> हे समर्थ ! तमारुं धारेलुं अमने सांभणवा योऽय होय तो ते कहो. केम्के भीजाओनी संमति अने सहायता लेवाथी पुरुषना स्वार्थ सिद्ध थाय छे.<sup>३०</sup>

शुक्टेवज्जु कहे छे हे राजा ! आ प्रमाणे जाणो अमृत वरसतुं होय अवां वयनथी भगवाने पूछितां जेनो परिश्रम मटी गयो छे, एवा वृकासुरे पोते प्रथम करेली सर्वे वात कही देखाई.<sup>३१</sup>

भगवान कहे छे जो अमे होय तो अमे महादेवना वयनने साचुं मानता नथी; केम्के महादेव तो दक्षना शापने लीढि पिशाचपशुं पामेल छे अने प्रेत तथा पिशाचोनो राजा छे.<sup>३२</sup> हे दानवोना ईंद्र ! ए जगतना गुरु कहेवाता महादेव उपर तमने विश्वास होय तो तमे पोताना माथा उपर हाथ मूकीने वयननी परीक्षा करो.<sup>३३</sup> हे दानवोमां उतम ! जो कोई रीते पश महादेवनुं वयन खोटुं जाणाय तो ए खोटुं बोलनारने मारी नाखजो के जेथी फरीवार खोटुं न बोलो.<sup>३४</sup>

शुक्टेवज्जु कहे छे आ प्रमाणे विचित्र अने सुक्रोमण भगवानां वयनोथी जेनी बुद्धि फरी गई, एवा हुबुद्धि वृकासुरे भूल खाईने पोतानो हाथ पोताना माथा उपर मूक्यो.<sup>३५</sup> मूकतां ज जाणे वज्ज वाग्युं होय तेम माथुं फाटी पडतां ते देत्य पडीने मरी गयो. देवताओ “जय जय, नमो नमः, सारुं थयुं सारुं थयुं” अमे कहेवा लाग्या.<sup>३६</sup> पापी वृकासुर मरण पामतां देव, ऋषि, पितृ अने गंधर्वों पुण्यनी वृष्टि करवा लाग्या. आवी रीते भगवाने सदाशिवने संकटमांथी

हतः को नु महत्वीश जन्मुर्वै कृतकिल्बिषः । क्षेमी स्यात् किमु विश्वेशे कृतागस्को जगदुरौ ॥३९  
य एवमव्याकृतशक्त्युदन्वतः परस्य साक्षात् परमात्मनो हरे: ।

गिरित्रोक्षं कथयेच्छृणोति वा विमुच्यते संसृतिभिस्तथारिभिः ॥४०॥

इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्दे उत्तरार्थं  
रुद्रमोक्षणं नामाष्टाशीतिमोऽध्यायः ॥८८॥

अथ एकोननवतितमोऽध्यायः (८९)

॥ श्री शुक उवाच ॥

सरस्वत्यास्तटे राजन्वृषयः सत्रमासत । वितर्कः समभूतेषां त्रिष्वधीशेषु को महान् ॥१  
तस्य जिज्ञासया ते वै भृगुं ब्रह्मसुतं नृप! । तज्जप्त्यै प्रेषयामासुः सोऽभ्यगाद् ब्रह्मणः सभाम् ॥२  
न तस्मै प्रह्लणं स्तोत्रं चक्रे सत्त्वपरीक्षया । तस्मै चुक्रोथ भगवान् प्रज्वलन् स्वेन तेजसा ॥३

छोडाव्या.<sup>३७</sup> कष्टथी भूकाएला सदाशिवनी पासे आवीने भगवाने कहुं के “अहो ! ! हे महादेव ! ए पापी पोताना पापथी ज मरी गयो. हे ईश्वर ! कोई ज्ञव भीजा महात्माओनो अपराध करे तो तेनुं कल्याण थाय नहीं, त्यारे आप के जे जगतना गुरु अने ईश्वर छो तेना अपराध करनारनुं तो केम ज कल्याण थाय! <sup>३८-३९</sup> आ प्रमाणे वाणी के मनथी न पहोंचाय एवी शक्तिओना समुद्ररूप अने मायाथी पर साक्षात् परमात्मा भगवाने सदाशिवने कष्टथी छोडाव्यानी कथाने जे पुरुष कहे अथवा सांभणे ते पुरुष जन्म मरणाथी तथा शत्रुओथी पश छूटे छे.<sup>४०</sup>

इति श्रीमद् महापुराण भागवतना दशम स्कन्दनो अठ्याशीमो अद्याय संपूर्णः

अद्याय ८८

त्राष्णा देवनी परीक्षा करीने विष्णुनी भहत्ता वार्णवता भृगुऋषि, तथा भूत ख्राण्डाना पुत्रने पाढा लावी आपता श्रीकृष्ण भगवान्.

शुक्टेवज्जु कहे छे हे राजा ! सरस्वतीने कांठे ऋषिओ यज्ञ करवा बेठा हता, तेओने तर्क उत्पत्त थयो के “त्राष्णा देवोमां कोषा मोटो हशे ?” आ वात जाणवानी ईश्वराथी तेनो निश्चय करवा सारु तेओये ख्राण्डाना पुत्र भृगुऋषिने मोकल्या. भृगुऋषि ख्राण्डानी सभामां गया.<sup>१-२</sup> ख्राण्डानी महत्तानी परीक्षा करवा

स आत्मन्युस्थितं मन्युमात्मजायात्मना प्रभुः । अशीशमद्यथा वहिं स्वयोन्या वारिणाऽत्मभूः ॥  
ततः कैलासमगमत् स तं देवो महेश्वरः । परिरब्धुं समारेभे उत्थाय भ्रातरं मुदा ॥५  
नैच्छत्त्वमस्युत्थग इति देवश्चकोप ह । शूलमुद्यम्य तं हन्तुमारेभे तिग्मलोचनः ॥६  
पतित्वा पादयोर्देवी सान्त्वयामास तं गिरा । अथो जगाम वैकुण्ठं यत्र देवो जनार्दनः ॥७  
शयानं श्रिय उत्सङ्गे पदा वक्षस्यताडयत् । तत उत्थाय भगवान् सह लक्ष्म्या सतां गतिः ॥८  
स्वतल्पादवरुहाथ ननाम शिरसा मुनिम् । आह ते स्वागतं ब्रह्मन् निषीदात्रासने क्षणम् ॥९

अजानतामागतान् वः क्षन्तुमर्हथ नः प्रभो ! ॥९

अतीव कोमलौ तात ! चरणौ ते महामुने ! इत्युक्त्वा विप्रवरणौ मर्दयन् स्वेन पणिना ॥१०  
पुनीहि सहलोकं मां लोकपालांश्च मद्गतान् । पादोदकेन भवतस्तीर्थानां तीर्थकारिणा ॥११  
अद्याहं भगवल्लक्ष्म्या आसमेकान्तभाजनम् । वत्स्यत्युरसि मे भूतिर्भवत्यादहतांहसः ॥१२

सारु भृगुऋषि ब्रह्माने नभ्या नहीं अने स्तुति पश्च करी नहीं । पोताना तेजथी  
प्रकाशता ब्रह्माए भृगु उपर क्रोध कर्योः ॥३ पछी ब्रह्माए पोताना मनमां उठेला  
क्रोधने “भृगु मारो पुत्र छे” ऐम करीने शमाव्यो । अग्निने शांत करवामां जेम  
अग्निथी उत्पत्त थयेलुं जण काम आवे तेम ब्रह्मानो क्रोध शांत थवामां भृगुनुं  
पुत्रपशुं काम आव्युः ॥४ पछी ऋषि डेलास पर्वतमां गया । त्यां सदाशिवे प्रेमथी  
उभा थईने ते पोताना भाई भृगुने भणवानो आरंभ कर्योः ॥५ “तुं अवणे मार्गे  
यालनार छे” ऐम कहीने भृगुए सदाशिवने भणवानी ईश्वा न करी, तेथी  
सदाशिवने क्रोध यड्यो । भयंकर नेत्रवाणा शंकरे त्रिशूण उपाईने भृगुने मारी  
नाखवानो आरंभ कर्योः ॥६ पार्वतीए पगमां पडीने वयनथी सदाशिवने शांत कर्योः  
पछी वैकुंठलोक के जेमां विष्णुदेव रहे छे त्यां भृगुऋषि गया ॥७ लक्ष्मीना खोणमां  
विष्णु सूता हता त्यां तेमनी छातीमां भृगुए लात मारी । सत्पुरुषोना शरणरूप  
भगवान्, लक्ष्मीज्ञनी साथे जागी, पोताना शयनमांथी उतरीने, मस्तकथी भृगुने  
पगे लाग्या । भगवाने कह्युं के “हे महाराज ! तमे भले आव्या, थोडीवार आ  
आसन पर बेसो, हे प्रभु ! तमारा पधारवाने अमो जाणता न हता । तेथी अमारा  
उपर आप क्षमा करवाने योग्य छो ॥८ हे बाप ! हे मोटा मुनि ! तमारा पगतो  
बहु ज सुकोमण छे ते मारी छातीमां लागवाथी दुःखता हशे ॥९ ऐम कही पोताना  
हाथथी ऋषिना पगने यांपवा लाग्या ॥१० वणी भगवान बोल्या के “तीर्थोने पश्च  
पवित्रपशुं आपनार आपना यरण धोवाना जणथी लोक सहित मने तथा मारामां  
रहेला लोकपाणोने पवित्र करो ॥११ हे महाराज ! हुं आज लक्ष्मीना अवियण

श्रीशुक उवाच

एवं ब्रुवाणे वैकुण्ठे भृगुस्तमन्द्रया गिरा । निर्वृतस्तर्पितसूष्टिं भक्त्युत्कण्ठोऽश्रुलोचनः ॥३  
पुनश्च सत्रमावज्य मुनीनां ब्रह्मवादिनाम् । स्वानुभूतमसेषेण राजन् ! भृगुरवर्णर्यत् ॥४  
तत्रिशम्याथ मुनयो विस्मिता मुक्तसंशयाः । भूयांसं श्रद्धुर्विष्णुं यतः शान्तिर्यतोऽभयम् ॥५  
धर्म सक्षाद् यतो ज्ञानं वैराग्यं च तदन्वितम् । ऐश्वर्य चाष्टधा यस्माद् यशश्चात्ममलापहम् ॥६  
मुनीनां न्यस्तदण्डानां शान्तानां समचेतसाम् । अकिञ्चनानां साधूनां यमाहुः परमां गतिम् ॥७  
सत्त्वं यस्य प्रिया मूर्तिर्बह्माणास्त्विष्टदेवताः । भजन्त्यनाशिषः शान्ता यं वा निपुणबुद्ध्यः ॥८  
त्रिविधाकृतयस्तस्य राक्षसा असुराः सुराः । गुणिन्या मायवा सृष्टः सत्त्वं तत्तीर्थसाधनम् ॥९

श्रीशुक उवाच

एवं सारस्वता विप्रा नृणां संशयनुत्तये । पुरुषस्य पदाभ्योजसेवया तद्रत्िं गताः ॥२०

स्थानकरूप थयो । तमारुं यरणा छातीमां वागवाथी मारां पाप मटी गयां, तेथी  
हवे मारी छातीमां लक्ष्मी अवियण रहेशे ॥११ विष्णु भगवान आ प्रमाणे बोलता  
हता, त्यारे भृगुऋषि सुभ अने तृष्णि पामीने युप रव्या । भक्तिथी उत्कंठा थवाने  
लीघे भृगुना नेत्रमां आंसु आव्यां ॥१२ हे राजा ! भृगुऋषिए ब्रह्मवादी मुनिओना  
पश्चमां पाण्डा आवीने जे कांट्य पोताना जाणवामां आव्युं ते सर्वे कही संभणाव्युः ॥१३  
आ वात सांभणी विस्मय पामेला मुनिओए संशय छोडी दृष्टे विष्णुने मोटा  
मान्या के जे विष्णुमां शांति अने अभय छे ॥१४ धर्म, शान, वैराग्य, आठ प्रकारनी  
सिद्धिओ अने अंतःकरणाना मेलने मटाइनार यश जेमां रहेल छे, ते विष्णु  
सर्वोत्तम छे ऐम मान्युः ॥१५ सर्वने अभय आपनार, शांत, समचित्तवाणा अने  
आभिमान रहित साधु मुनिओना जे शरणरूप कहेवाय छे ते विष्णुने मोटा  
मान्या ॥१६ शुद्ध सत्वगुण जेना प्रिय शरीररूप छे, ब्राह्मणो जेना ईष्टदेव छे अने  
शांत तथा निपुण बुद्धिवाणा निष्काम लोको जेने भजे छे ते विष्णुने मोटा मान्या ॥१७  
भगवाननी त्रिगुणात्मक मायाथी सर्जाएला राक्षसो, असुरो अने देवताओ आ  
त्रण प्रकारनी विष्णुनी ज आकृतिओ छे, अर्थात् विष्णुनां शरीरो छे । “देवताओ  
सत्वगुण प्रधान छे, असुरो रजोगुण प्रधान छे, अने राक्षसो तमोगुण प्रधान  
छे ॥” आ त्रणे त्रिगुणात्मक अने भगवाननां शरीरो होवाथी सर्वप्रकारे भगवानने  
आधीन छे । माटे सात्विक, राजस अने तामस त्रणे भावो उपासनीय नथी । त्रणे  
गुणोथी पर जे शुद्ध सत्व छे, ए ज विष्णुनी प्राप्तिनुं साधन छे ॥१८

शुकदेवज्ञ कहे छे आ प्रमाणे मनुष्योना संशय टाणवाने माटे निश्चय करी

सूत उवाच

इत्येतन्मुनितनयास्यपद्मगन्धीयूषं भवभयभित् परस्य पुंसः ।  
सुश्लोकं श्रवणपृष्ठैः पिबत्यभीक्षणं पान्थोऽध्वभ्रमणपरिश्रमं जहाति ॥२१॥

श्रीशुक उवाच

एकदा द्वारवत्यां तु विप्रपल्याः कुमारकः । जातमात्रो भुवं स्पृष्टा ममार किल भारत! ।२२  
विप्रो गृहीत्वा मृतकं राजद्वार्युपधाय सः । इदं प्रोबाच विलपन्नातुरो दीनमानसः ॥२३  
ब्रह्मद्विषः शठधियो लुब्धस्य विषयात्मनः । क्षत्रवन्धोः कर्मदोषात् पञ्चलं मे गतोऽर्थकः ॥२४  
हिंसविहारं नृपतिं दुःशीलमपजितेन्द्रियम् । प्रजा भजन्त्यः सीदन्ति दरिद्रा नियदुःखिताः ॥२५  
एवं द्वितीयं विप्रर्षिस्तृतीयं त्वेवमेव च । विमृज्य स नृपद्वारि तां गाथां समग्रायत ॥२६  
तामर्जुन उपश्रुत्य कर्हिचित् केशवान्तिके । परेते नवमे बाले ब्राह्मणं समभाषत ॥२७  
भगवानना यरणारविंहनी सेवा करवाथी सरस्वतीने कांठे रहेनारा ब्राह्मणो  
भगवानना स्वरूपने पाम्या हता ॥२८

सूत शौनकने कहे छे आ प्रमाणे शुकदेवज्ञना मुख कमण्मांथी नीकणेल  
सुगंधी जेमां रहेली छे ऐवो अमृत समान, संसारना भयने टाणनार अने  
वर्णन करवा योग्य आ भगवानना यशने संसारउपी मार्गमां फरनारो जे पुरुष  
कानउपी पडीआथी वारंवार पीओ; तेने संसारउपी मार्गमां भटकवानो परिश्रम  
मटी जाय छे ॥२९

शुकदेवज्ञ कहे छे हे राजा ! एक दिवसे द्वारकामां कोई ब्राह्मणनी स्त्रीनो  
दीकरो जन्मतां ज धरतीने अडीने मरी गयो ॥२२ आतुर अने रांक मननो ब्राह्मण  
ऐ शबने लई राजद्वारमां भूझीने विलाप करतां आ प्रमाणे बोल्यो ॥३०

ब्राह्मण कहे छे ब्राह्मणोनो देख करनार, लोभी, विषयोमां लंपट अने शठ  
भुद्धिवाणा क्षत्रियोनां कुकर्मने लीधे मारो बाणक मरणा पाम्यो छे ॥३४ हिंसाने  
विहारउप माननारा, अजितेन्द्रिय अने दुष्ट स्वभाववाणा राज्ञाने भजनारी  
प्रजा पीडाय छे, दरिद्री रहे छे अने निरंतर दुःखी ज कहेवाय छे ॥३५

शुकदेवज्ञ कहे छे आ बाणकने लावीने ब्राह्मण जेम राजद्वारमां बोल्यो,  
तेमज भीज्ञवारना अने त्रीज्ञवारना बाणकने पण राजद्वारमां भूझीने ते प्रमाणे  
ज बोल्यो. (आवी रीते आठ बाणक मरणा पाम्यां) ॥३६ पछी एक दिवसे  
भगवाननी पासे अर्जुन बेठा हता, त्यां नवभीवारनो बाणक मरणा पामतां ऐ  
ब्राह्मण ऐ प्रमाणे ज बोल्यो, ते सांभणीने अर्जुने ब्राह्मणने आ प्रमाणे कहुं ॥३७

किंस्वद् ब्रह्मस्त्वन्निवासे इह नास्ति धनुर्धरः । राजन्यबन्धुरेते वै ब्राह्मणाः सत्र आसते ॥२८  
धनदारात्मजापृक्ता यत्र शोचन्ति ब्राह्मणाः । ते वै राजन्यवेषेण नटा जीवन्त्यसुभ्रातः ॥२९  
अहं प्रजा वां भगवन्! रक्षिष्य दीनयोरिह । अनिस्तीर्णप्रतिज्ञोऽग्निं प्रवेक्ष्ये हतकल्मषः ॥३०

ब्राह्मण उवाच

सङ्कर्षणो वासुदेवः प्रद्युम्नो धन्विनां वरः । अनिरुद्धोऽप्रतिरथो न त्रातुं शक्वनुवन्ति यत् ॥३१  
तत्कथं नु भवान् कर्म दुष्करं जगदीश्वैः । चिकीर्षसि त्वं बालिश्यात् तत्र श्रहधम्हे हि वयम् ॥३२  
अर्जुन उवाच

नाहं सङ्कर्षणो ब्रह्मन्! न कृष्णः काण्डीरिव च । अहं वा अर्जुनो नाम गाण्डीवं यस्य वै धनुः ॥३३  
मावमंस्था मम ब्रह्मन्! वीर्यं त्र्यम्बकतोषणम् । मृत्युं विजित्य प्रथने अनेष्ये ते प्रजां प्रभोः ॥३४  
एवं विश्रम्भितो विप्रः फाल्युनेन परंतप ! । जगाम स्वगृहं ग्रीतः पार्थवीर्यं निशामयन् ॥३५  
प्रसूतिकाल आसन्ने भार्याया द्विजसत्तमः । पाहि पाहि प्रजां मृत्योरित्याहार्जुनमातुरः ॥३६

अर्जुन कहे छे हे ब्राह्मण ! तारा गाममां कोई धनुषधारी क्षत्रिय नथी शुं ?  
धन, स्त्री अने पुत्रोमां लागी रहेला आ यादवो तो यज्ञमां जमवा भेणा थयेला  
ब्राह्मणो जेवा ज्ञाय छे. जे क्षत्रियोना ज्ञवां ब्राह्मणो शोक करे ते पेटभरा  
क्षत्रियो तो क्षत्रियना वेष्यी नट लोको ज ज्ञवे छे ऐम समज्ञुं ॥३८-३९ हे महाराज !  
दीन ऐवां जे तमो भनेनुं हुं रक्षण करीश, अने जो आ मारी प्रतिज्ञाने साची नहीं  
करी शकुं तो हुं अनिमां प्रवेश करीने पवित्र थईश ॥३०

ब्राह्मण कहे छे बणदेव, कृष्ण, धनुष धरनाराओमां उतम प्रधुम्न अने  
जेनी सामो युद्धमां कोई उभो रही शके नहीं, ऐवा अनिरुद्धथी पण मारा  
बाणकोनुं रक्षण करी शकायुं नथी, तो जे काम जगतना ईश्वरोने पण करवुं कठाण  
लाग्युं छे, ते कामने तुं मूर्खपणाथी केम करवा धारे छे ? तारी वातनो अमे विश्वास  
राखता नथी ॥३१-३२

अर्जुन कहे छे हे ब्राह्मण ! हुं, बणदेव, कृष्ण, प्रधुम्न के अनिरुद्ध नथी  
पण हुं तो अर्जुन छुं के जेनुं गांडीव नामनुं धनुष प्रभ्यात छे ॥३३ जेथी महादेव  
पण प्रसन्न थया हता, ऐवा मारा पराकर्मनुं तारे अपमान करवुं नहीं, युद्धमां  
मृत्युने ज्ञीने पण हुं तारी प्रजाने लावी आपीश ॥३४

शुकदेवज्ञ कहे छे हे राजा ! आ प्रमाणे अर्जुने विश्वास आपतां, अर्जुनना  
पराकर्मोने सांभणीतो ते ब्राह्मण राज थईने पोताने घेर गयो ॥३५ स्त्रीने प्रसवनो  
समय पासे आवतां आतुर थयेला ते उतम ब्राह्मणे “मारी प्रजानी मृत्युथी रक्षा

स उपस्थित्य शुच्याभो नमस्कृत्य महेश्वरम् । दिव्यान्यस्त्राणि संस्मृत्य सज्जं गाण्डीवमाददे ॥३७  
न्यरुणत् सूतिकागारं शनैर्नानास्त्रयोजितैः । तिर्यगूर्ध्वमध्यः पार्थश्चकार शरपञ्जरम् ॥३८  
ततः कुमारः संजातो विप्रपत्न्या रुदन् मुहुः । सद्योऽर्दशनमापेदे सशरीरो विहायसा ॥३९  
तदाऽऽहविप्रोविजयं विनिन्दन् कृष्णसन्निधौ । मौन्यं पश्यत मे योऽहं श्रद्धेवलीबक्त्यनम् ॥४०  
न प्रद्युमो नानिरुद्धो न रामो न च केशवः । यस्य शेकुः परित्रातुं कोऽन्यस्तदवितेश्वरः ॥४१  
धिगर्जुनं मृषावादं धिगात्मश्लाघिनो धनुः । दैवोपसृष्टं यो मौन्यादानिनीषति दुर्मतिः ॥४२  
एवं शपति विप्रबौं विद्यामास्थाय फाल्युनः । यथौ संयमनीमाशु यत्रास्ते भगवान् यमः ॥४३  
विप्रापत्यमचक्षाणस्तत ऐन्नीमगात् पुरीम् । आग्नेयी नैऋतीं सौम्यां वायव्यां वारुणीमथ ।

रसातलं नाकपृष्ठं धिष्ययान्यन्यान्युदायुधः ॥४४

ततोऽलब्धद्विजसुतो हानिस्तीर्णप्रतिश्रुतः । अर्गिन विविक्षुः कृष्णेन प्रत्युक्तः प्रतिषेधता ॥४५

करो” एम अर्जुनने कहुँ।<sup>३६</sup> अर्जुने पवित्र जगन्नुं आयमन लई, श्रीकृष्णने भ्रातृष्णोनी उपेक्षा करनार जाणी, तेमने नमस्कार नहीं करतां भण्डारेवज्ञने नमस्कार करीने, दिव्य अस्त्रोनुं स्मरण करी, दोरी यढावेलुं गांडीव धनुष उपाइयुँ.<sup>३७</sup> अनेक अस्त्रोथी जोडेलां बाणोवते आहुं, ऊंचुं अने नीचुं सूवावीना धरने रोकीने बाणोनुं पांजरुं करी दीधुँ.<sup>३८</sup> पछी विप्रपत्नी थकी उत्पत्त थयेलो बाणक वारंवार रुदन करतां करतां भ्रातृष्णने घेर दीकरो आव्यो के तरत ज तेना शरीर सहित आकाशभार्गं गयो के जे देखवामां पश आव्यो नहीं।<sup>३९</sup> ते समयमां भ्रातृष्ण श्रीकृष्णना सभीपमां अर्जुननी निंदा करतां करतां बोल्यो के “मारी भूर्भता तो जुओ, के में नपुंसकना बकवाद उपर विश्वास राख्यो।<sup>४०</sup> प्रद्युम्न, अनिरुद्ध, बण्डेव अने श्रीकृष्ण जेनुं रक्षण करी शक्या नहीं तेनुं रक्षण करवाने बीजो कोणा समर्थ थाय ?<sup>४१</sup> खोटुं बोलनारा अर्जुनने धिक्कार छे. पोताना वभाषण करनार अर्जुनना धनुषने धिक्कार छे के जे दुर्भुद्धिवाणो अर्जुन देवे नहीं राखवा ठच्छता पदार्थने भूढताथी राखवा धारे छे।<sup>४२</sup> आ प्रमाणे भ्रातृष्ण गाणो देतां, अर्जुन विद्यानो उपयोग करी तरत संयमनीपुरीमां गया, त्यां यमपुरीमां पश भ्रातृष्णनो पुत्र नहीं देखतां, त्यांथी हथियार उपाडीने ढंद, अग्नि, सोम, वायु अने वरुणानी पुरीओमां गया. त्यां पश नहीं देखवामां आवतां पाताणमां स्वर्गमां अने बीजं स्थानकोमां पश गया।<sup>४३-४४</sup> कोई स्थानकमां भ्रातृष्णनो पुत्र नहीं भणतां प्रतिज्ञा पूरी नहीं थवाने लीघे अर्जुने अग्निमां प्रवेश करवाने धार्यु, त्यां तेने श्रीकृष्ण भगवाने ना पाईने कहुँ के “हुं तमने भ्रातृष्णना पुत्रो देखाहुं छु के जेथी निंदा

दर्शये द्विजसूनस्ते मावज्ञात्मानमात्मना । ये ते नः कीर्ति विमलां मनुष्याः स्थापिष्यन्ति ४६  
इति सम्भाष्य भगवानर्जुनेन सहेश्वरः । दिव्यं स्वरथमास्थाय प्रतीर्चीं दिशमाविशत् ॥४७  
सप्त द्वीपान् सप्त सिंधून् सप्तसप्तगिरीनथ । लोकालोकं तथातीत्य विवेश सुमहत्तमः ॥४८  
तत्राश्वाः शैव्यसुगीवमेघपुष्पबलाहकाः । तमसि भ्रष्टगतयो बभूवुर्भरतर्षभ ! ॥४९  
तान् दृष्ट्वा भगवान् कृष्णो महायोगेश्वरेश्वरः । सहस्रादित्यसंकाशं स्वचक्रं प्राहिणोत् पुरः ॥५०

तमः सुधोरं गहनं कृतं महद् विदारयद् भूरितरेण रोचिषा ।

मनोजं निर्विविशे सुदर्शनं गुणच्युतो रामशरो यथा चमूः ॥५१॥

द्वारेण चक्रानुपथेन तत्तमः परं परं ज्योतिरनन्तपारम् ।

समश्नुवानं प्रसमीक्ष्य फाल्युनः प्रताङ्गिताक्षोऽपिदधेऽक्षिणी उभे ॥५२॥

ततः प्रविष्टः सलिलं नभस्वता बलीयसैजद्वृहदूर्मिभूषणम् ।

तत्राद्वृतं वै भवनं द्युमत्तमं भ्राजन्मणिस्तम्भसहस्रशोभितम् ॥५३॥

तस्मिन् महाभीममनन्तमद्वृतं सहस्रमूर्धन्यफणामणिद्युभिः ।

विभ्राजमानं द्विगुणोल्बणेक्षणं सिताचलाभं शितिकण्ठजिह्म् ॥५४॥

करनारा भाषासो ज तमारी कीर्तिने अविच्यण करशे. तमे पोताथी पोतानुं अपमान न करो।<sup>४५-४६</sup> एम कही श्रीकृष्ण अर्जुननी साथे पोताना दिव्य रथमां बेसीने पश्चिम दिशामां चाल्या।<sup>४७</sup> सात द्वीप, सात समुद्र, सात पर्वत अने लोकालोक पर्वतने भूकीने भारे प्रबण अंधारामां प्रवेश्या।<sup>४८</sup> हे राजा ! अंधारामां पेसतां शैव्य, सुगीव, मेघपुष्प अने बालाहक नामना चार भगवानना धोडा चालतां अटक्या।<sup>४९</sup> ए जोईने श्रीकृष्ण भगवाने हजार सूर्य जेवा पोताना यक्ने आगण चलाव्युँ।<sup>५०</sup> बहुभारे तेजथी ओ प्रकृतिना परिणामरूप, ए धाटा अंधाराने कापी नांभतुं ए भगवाननुं यक, जेम दोरीमांथी धूटेलुं रामनुं बाण, रावणानी सेनाओमां जतुं, तेम मन सरभा वेगथी चालवा लाग्युँ।<sup>५१</sup> यके करी आपेला मार्गमां चालतां अंधाराथी धाणुं छेटुं, अंत अने पार वगरनुं तथा व्याम थतुं परम तेज जोवामां आव्युं. तेने जोईने आंभो अंजाई जतां अर्जुने बने आंभो भींची दीधी।<sup>५२</sup> पछी भारे पवनथी उष्णिता मोटा मोटा तरंगोथी शोभी रहेलां जगमां प्रवेश कर्यो. त्यां मोटा प्रकाश वाणुं अने शोभी रहेला हजारो मणिओना थांभलाओथी दीपतुं अहूत धर जोवामां आव्युँ।<sup>५३</sup> ए धरमां भण्डार्यंकर अने माथा उपर फणोमां रहेला मणिओनी कांतिओथी शोभता, भयंकर बेहजार नेत्रवणा, धोणा पर्वत सरभा अने कुंठ तथा ज्ञभो जेनी श्याम छे एवा शेषनाग

दर्दश तद्वोगसुखासनं विभुं महानुभावं पुरुषोत्तमोत्तमम् ।  
सान्द्राम्बुदाभं सुपिशङ्गवाससं प्रसन्नवक्त्रं रुचिरायतेक्षणम् ॥५५॥

महामिन्द्रियातकिरीटकुण्डलप्रभापरिक्षिसहस्रकुन्तलम् ।  
प्रलम्बचार्वष्टभुजं सकौस्तुभं श्रीवत्सलक्ष्मं वनमालया वृतम् ॥५६॥

सुनन्दनन्दप्रमुखैः स्वपर्षदैश्वर्कादिभिर्मूर्तिधरैर्निजायुधैः ।  
पुष्ट्या श्रिया कीर्त्यजयाखिलद्विभिर्निषेव्यमाणं परमेष्ठिनां पतिम् ॥५७॥

ववन्द आत्मानमनन्तमच्युतो जिष्णुश्च तदर्थनजातसाध्वसः ।  
तावाह भूमा परमेष्ठिनां प्रभुर्बद्धाज्जली सस्मितमूर्जया गिरा ॥५८॥

द्विजात्मजा मे युवयोर्दिवृक्षुणा मयोपनीता भुवि धर्मगुप्ते ।  
कलावतीर्णाववनेभरासुरान् हत्वेह भूयस्त्वरयेत्तमन्ति मे ॥५९॥

पूर्णकामावपि युवां नरनारायणावृषी । धर्ममाचरतां स्थितै ऋषभौ लोकसंग्रहम् ॥६०

ज्ञेवामां आव्या.<sup>४४</sup> ते शेषनागना शरीर उपर सुभ्पूर्वक बिराजेला, मोटा प्रभाववाणा, अने मनुष्यो तथा ईंद्रादिक देवो करतां उत्तम ऐवा ब्रह्मा, विष्णु अने शिव करतां पश उत्तम धाटा भेघनी समान श्याम कांतिवाणा, पीणां वस्त्रो धारी रहेला, प्रसन्न मुखकमण्ठी युक्त अने सुंदर तथा लांबा नेत्रोवाणा ऐवा भूमापुरुष भगवान, श्रीकृष्ण अने बण्ठेवज्ञना ज्ञेयामां आव्या.<sup>४५</sup> अनेक मोटा मणिओवाणा किरीट अने कुंडलनी कांतिथी केशनो समूह चण्डकतो हतो. लांबी अने सुंदर आठ भुजाओ हती. क्षौस्तुभमणि धर्यो हतो. श्रीवत्सने शोभा आपनारी वनमाणाथी वींटाया हता.<sup>४६</sup> नंद अने सुनंद आदि पोताना पार्षदो, यक आदि आयुधो, पुष्टि, लक्ष्मी आदि आठ सिद्धिओ सेवती हती. अक्षरधामना अधिपति स्वयं श्रीकृष्ण भगवान पोताना अवतारभूत भूमापुरुषने नमस्कार कर्या. तेवी ज रीते भूमापुरुष भगवाननां दर्शनथी भक्तिपूर्वक, जेने भय उत्पन्न थयेलो छे ऐवा अर्जुने पश वंदन कर्या, ते समये भ्रत्यादिकोना पश ईश्वर भूमा भगवाने बे हाथ जोडी, हसीने गंभीर वाणीथी आ प्रमाणे कहुं.<sup>४७-४८</sup>

भूमा भगवान कहे छे तमारां दर्शननी ईच्छाथी ब्राह्मणाना पुत्रने हुं अहीं लाव्यो छुं. तमो भन्ने आ पृथ्वी उपर धर्मनुं रक्षण करवा माटे शानना पूर्णाशथी अवतरेला छो, एटला ज माटे पृथ्वीना भारतुप दैत्योने मारीने स्वधाम जती वधते अमारा स्थानने विषे फरीवार पश मने दर्शन आपवा माटे मारी सभीपे शीघ्र पधारजो.<sup>४९</sup> जे तमो ऋषि नरनारायणना अवताररूप अने सर्वोत्तम छो,

इत्यादिष्टै भगवता तौ कृष्णो परमेष्ठिना । ओमित्यानम्य भूमानमादाय द्विजदारकान् ॥६१  
न्यवर्ततां स्वकं धाम सम्प्राण्यै यथागतम् । विप्राय ददतुः पुत्रान् यथास्तु पं यथावयः ॥६२  
निशाम्य वैष्णवं धाम पार्थः परमविस्मितः । यत् किंचित् पौरुषं पुंसां मेने कृष्णानुकम्पितम् ॥६३  
इतीदृशान्यनेकानि वीर्याणीह प्रदर्शयन् । बुभुजे विषयान् ग्राम्यानीजे चात्यूर्जितैर्मर्खैः ॥६४  
प्रववर्षाखिलान् कामान् प्रजासु ब्राह्मणादिषु । यथाकालं यथैवेन्द्रो भगवाज्ञैङ्ग्यमास्थितः ॥६५  
हत्वा नृपानर्धमिष्टान् धातयित्वार्जुनादिभिः । अञ्जसा वर्तयामास धर्मं धर्मसुतादिभिः ॥६६

इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे उत्तरार्धे द्विजकुमारानयनं नाम एकोननवतिमोऽध्यायः ॥८९॥

## अथ नवतिमोऽध्यायः (९०)

॥ श्री शुक उवाच ॥

सुखं स्वपुर्या निवसन् द्वारकायां श्रियः पतिः । सर्वसंपत्समद्वायां जुष्टायां वृष्णिपुंगवैः ॥१  
स्त्रीभिश्वेत्तमवेषाभिर्नवयौवनकान्तिभिः । कन्दुकादिभिर्हर्मेषु क्रीडन्तीभिस्तडिद्युभिः ॥२  
नित्यं संकुलमार्गायां मदच्युद्धिर्मतङ्गजैः । स्वलङ्कृतैर्भृतैरश्वै रथैश्च कनकोज्ज्वलैः ॥३  
उद्यानोपवनाढ्यायां पुष्पितद्वुमराजिषु । निर्विशद्भङ्गविहगैर्नादितायां समन्ततः ॥४

ते तमो जगतनी स्थिति अने भर्यादा राखवा सारुं धर्मनुं आयरणे करो छो.<sup>५०</sup>  
शुकदेवज्ञ कहे छे, भूमापुरुषे आ प्रमाणे आशा करतां राज्ञ थयेला श्रीकृष्ण  
अने अर्जुन तेमनी आशाने माथे यढावी ब्राह्मणाना पुत्रोने लई, भूमापुरुषने  
प्रणाम करीने जे मार्गेथी आव्या हता ते ज मार्गेथी पाइ। द्वारकामां आव्या.  
ब्राह्मणने प्रथमना जेवा ज रूप अने अवस्थावाणा तेना पुत्रो आप्या.<sup>५१-५२</sup> विष्णुनुं  
धाम जोईने बहुज विस्मय पामेला अर्जुने मान्युं के “जे कांट पुरुषोमां पुरुषार्थ  
होय ते सर्वे भगवाननी कृपाथी ज होय छे.”<sup>५३</sup> आ लोकमां ऐवां अनेक पराक्रमो  
देखाउता श्रीकृष्ण भगवान संसार संबंधी विषयोने भोगवता हता अने मोटा  
समृद्धिवाणा यज्ञोथी यज्ञन करता हता.<sup>५४</sup> श्रेष्ठपुणाने धारणा करता भगवान  
ईद्रनी पेठे ब्राह्मणादिक प्रजाओना समयसर सर्वे मनोरथो पूरता हता.<sup>५५</sup> अधर्म  
करनारा राजाओने मारीने तथा अर्जुनादिकनी पासे मरावीने युधिष्ठिर आदि  
धार्मिक राजाओद्वारा अनायासथी धर्मनी प्रवृत्ति करावता हता.<sup>५६</sup>

इति श्रीमद्भागवतमाहात्म्यम् भागवतना। दशम स्कन्धनो नेत्याशीमो अद्याय संपूर्णः.

रेमे घोड़साहस्रपलीनामेकवल्लभः । तावद्विचित्रस्त्रोऽसौ तद्गृहेषु महद्विष्टु ॥५  
प्रोत्फुलोत्पलकहारकुमुदाम्भोजरेणुभिः । वासितामलतोयेषु कूजद्विजकुलेषु च ॥६  
विजहार विगाहाम्भो ह्रदिनीषु महोदयः । कुचकुद्धमलिमाङ्गः परिव्यश्च योषिताम् ॥७  
उपगीयमानो गन्धर्वैर्मृदङ्गपणवानकान् । वादयद्विर्मुदा वीणां सूतमागधवन्दिभिः ॥८  
सिद्धमानोऽच्युतस्ताभिर्हसन्तीभिः स्म रेचकैः । प्रतिषिञ्चन् विचित्रीडे यक्षीभिर्यक्षराडिव९  
ताः क्लिन्नवस्त्रविवृतोरुकुचप्रदेशाः सिद्धन्त्य उद्धृतबृहत्कब्रप्रसूनाः ।  
कान्तं स्म रेचकजिहीरषयोपगुह्यं जातस्मरोत्सवलसद्वदना विरेजुः ॥१०॥

अध्याय ६०

## श्रीकृष्णो करेली लीलाओनुं संक्षिप्त वार्तान्.

शुक्लेवज्जु कहे छे हे राजा ! सर्वे संपत्तिओनी समृद्धिवाणी, मोटा याएवोथी  
सेवेली झूल तथा झणनी वारीओथी संपत्ति, यारेकोर झूलजाइनी पंकितओमां विहार  
करता भ्रमर अने पक्षीओना नादवाणी पोतानी पुरी द्वारका के जेना मार्गो भद्र  
झरनारा हाथीओ, शाशगारेला योद्धा तथा धोडा अने सुवर्णथी दीपता रथोथी  
निरंतर भीडवाणा ज रहेता हता, तथा जेमां उत्तम वेषवाणी, नवीन यौवानथी  
शोभती, हवेलीओमां दडा आदिथी कीडा करती अने वीजली सरभी कांतिवाणी  
स्त्रीओ विलास करती हती. तेमां सुखेथी रहेता लक्ष्मीना पति अने सोण हजार  
स्त्रीओना एक ज प्यारा भगवान मोटी समृद्धिवाणां ते स्त्रीओनां धरोमां तेटलांज  
विचित्र रूप धारणा करीने रमता हता.<sup>१-५</sup> ए धरनी अंदर निर्मण जग्नाशयोनां  
जण, प्रकृत्यित थयेलां उत्पल, कल्हार, कुमुद अने पद्मोना सुगंधथी वासित  
थयेलां हतां, अने पक्षीओनां टोणां शब्द करतां हतां.<sup>६</sup> मोटा वैभववाणा भगवान  
तलावडीओना जणमां प्रवेश करीने विहार करता हता. स्त्रीओअे आविंगन  
करवाने लीधे तेओना स्तन उपरना केशरोथी भगवाननुं श्रीअंग लींपातुं हतुं.<sup>७</sup>  
प्रेमथी मृदुंग, पश्चव, आनक अने वीश्वाओने वगाडता गंधवलोको अने सूत,  
मागध तथा बंदिजनो भगवाननुं गायन करता हता.<sup>८</sup> स्त्रीओ हसती हसती  
भगवानने पियकारिओथी पलाणती हती अने भगवान तेओने पलाणता हता.  
यक्षिणीओनी साथे जेम कुबेरज्जु विहार करे, तेम भगवान स्त्रीओनी साथे विहार  
करता हता.<sup>९</sup> भगवानने पलाणती, वस्त्र भींजावाने लीधे जेओनां साथण अने  
स्तनना प्रदेशो देखाई रहेता हता ऐवी, पियकारिथी भयवानी ईरण्याने लीधे

कृष्णस्तु तत्सनविषज्जितकुद्धमस्त्रकक्षीडाभिषङ्गधुतकुन्तलवृन्दबन्धः ।  
सिञ्चन् मुहुर्युवतिभिः प्रतिषिद्ध्यमानो रेमे करेणुभिरिवेभपतिः परीतः ॥११॥  
नटानां नर्तकीनां च गीतवाद्योपजीविनाम् । क्रीडालङ्कारवासांसि कृष्णोऽदात्तस्य च स्त्रियः ॥१२  
कृष्णस्यैवं विहरतो गत्यालापेक्षितस्मितैः । नर्मक्षेलपरिष्वङ्गैः स्त्रीणां किल हृता धियः ॥१३  
ऊर्चुमुकुन्दैकधियोऽगिर उन्मत्तवज्जडम् । चिन्तयन्त्योऽरविन्दाक्षं तानि मे गदतः शृणुः ॥१४

महिष्य ऊचुः

कुररि विलपसि त्वं वीतनिद्रा न शेषे स्वप्निति जगति रात्र्यामीश्वरो गुप्तबोधः ।  
वयमिव सखि कच्चवद् गाढनिर्भिन्नचेता नलिननयनहासोदारलीलेक्षितेन ॥१५॥  
नेत्रे निमीलयसि नक्तमदृष्ट्यन्धुस्त्वं रोरवीषि करुणं बत चक्रवाकि ।  
दास्यं गता वयमिवाच्युतपादजुष्टां किं वा स्त्रजं स्पृहयसे कबरेण वोहुम् ॥१६॥  
भो भोः सदा निष्ठनसे ! उदन्वन्नलब्धनिन्द्रोऽधिगतप्रजागरः ।  
किं वा मुकुन्दापहृतात्मलाज्ज्ञः प्रासां दशां त्वं च गतो दुरत्ययाम् ॥१७॥

भगवाननुं आविंगन करतां उत्पन्न थयेला कामदेवना उत्सवथी शोभतां  
मुखवाणी, अने जेओना मोटा योटलाओमांथी झूल भरतां हतां ऐवी ते स्त्रीओ  
भुज्ज दीपती हती.<sup>१०</sup> भगवाने पहेरेली भाणाओमां स्त्रीओना स्तननुं केसर  
लाणी रह्युं हतुं अने पोते कीडाना अभिनिवेशथी केशना बंधनोने हलावता हता.  
स्त्रीओने पलाणता अने स्त्रीओअे वारंवार पलाणाता भगवान हाथशीओथी  
वीटाएला मोटा हाथीनी पेठे विहार करता हता.<sup>११</sup> नट, नायनारी अने गीत  
तथा वाजनी ज्वनाराओने श्रीकृष्ण भगवान कीडाना अलंकार अने वस्त्रो हेता  
हता. अने भगवाननी स्त्रीओ पाण हेती हती.<sup>१२</sup> आ प्रमाणे विहार करता श्रीकृष्ण  
भगवाननी गति, भाषण, दृष्टि, हसवुं, हास्यनुं वयन अने आविंगनथी  
स्त्रीओनी बुद्धि हराई हती.<sup>१३</sup> भगवाननुं चित्तवन करती अने भगवानमां ज  
जेओनी बुद्धि लाणी रही हती, ऐवी ते स्त्रीओ उन्मत्त अने जडनी पेठे जे वयनो  
बोलती हती ते वयनो हुं तमने कहुं छुं, सांभणो.<sup>१४</sup>

स्त्रीओ बोले छे हे टीटोडी ! जगतमां गुम बोधवाणा श्रीकृष्ण रात्रिमां  
पोढ़ाया छे अने तुं विलाप करी करीने निद्रानो भंग करे छे पश शूती नथी ऐ  
योग्य नथी. हे सभा ! अमारी पेठे तारुं चित्त पश भगवाननां उदार हास्य अने  
लीलापूर्वक ज्ञेवाथी अत्यंत भेदाई गयुं छे के शुं ?<sup>१५</sup> हे यकवी ! तुं नेत्र केम भींयी  
गाई छे ? रात्रिमां पतिने नहीं देखवाथी तुं दयामाणी रीते रुवे छे के शुं ? जेम

ત્વं યક્ષમણા બલવતાસિ ગૃહીત ઇન્દો ! ક્ષીણસ્તમો ન નિજદીધિતિભિ: ક્ષિણોષિ ।  
 કચ્ચિનુકુન્દગદિતાનિ યથા વયં ત્વં વિસ્મૃત્ય ભો: સ્થાગિતગીરુપલક્ષ્યસે ન: ॥૧૮॥  
 કિં ત્વાચરિતમસ્માભિર્મલયાનિલ ! તેડપ્રિયમ् । ગોવિન્દપાઙ્ગનિર્ભિન્ને હૃદીરયસિ ન: સ્મરમ् ૧૯  
 મેઘ શ્રીમંસ્ત્વમસિ દયિતો યાદવેન્દ્રસ્ય નૂં શ્રીવત્સાઙ્કં વયમિવ ભવાન્ ધ્યાયતિ પ્રેમબદ્ધ: ।  
 અત્યુક્તણઠ: શબલહૃદ્યોઽસ્મદ્ધિદો બાષ્પધારા: સ્મૃત્વા સ્મૃત્વા વિસૃજસિ મુહુર્દુઃખવદસ્તલસઙ્ગ: ।  
 પ્રિયરાવપદાનિ ભાષસે મૃતસઞ્જીવિકયાનયા ગિરા ।  
 કરવાણિ કિમદ્ય તે પ્રિયં વદ મે બળિતકણ ! કોકિલ ! ॥૨૧॥  
 ન ચલસિ ન વદસ્યુદારબુદ્ધે ક્ષિતિધર ચિત્તયસે મહાન્તમર્થમ् ।  
 અપિ બત વસુદેવનન્દનાઙ્ગિં વયમિવ કામયસે સ્તનૈર્વિર્થર્તુમ् ॥૨૨॥

દાસીપણું પામેલી અમો ભગવાનના ચરણમાં રહેલી માળાને ચોટલામાં ધારણ  
 કરવા ઈચ્છિએ છીએ, તેમ તું પણ ઈચ્છે છે કે શું ?<sup>૧૬</sup> હે સમુદ્ર ! ઊંઘ નહીં  
 આવતાં ઉજાગરો થવાથી તું નિરંતર ચીસો પાડ્યા કરે છે કે શું ? અથવા અમને  
 જે ન મટે તેવી દશા પ્રામ થઈ છે તે દશાને તું પણ પાભ્યો છે કે શું ? જેમ અમારાં  
 સ્તન કુંકુમાદિક લાંઘણ ભગવાને હર્યાછે, તેમ તારાં પણ લક્ષ્મી અને કૌસ્તુભાદિક  
 લાંઘણ ભગવાને હરી લીધાં છે કે શું ?<sup>૧૭</sup> હે ચંદ્ર ! તું ભારે કશ્યરોગથી પકડાઈને  
 ક્ષીણ થવાથી કે ભગવાનની રહસ્ય વાતો સંભારીને તેની જ ચિંતામાં મળન થવાથી  
 પોતાનાં કિરણોવડે અંધારાને દૂર કરતો નથી ? અમારી પેઠે તારું બોલવું પણ  
 બંધ થઈ ગયું છે એમ જણાય છે.<sup>૧૮</sup> હે મલયાચણના પવન ! અમોએ તારું શું ભૂંદું  
 કર્યું છે ? કે જેથી તું ભગવાનના નેત્રની અણીઓથી ભેદાઈ ગયેલા અમારા હદ્યમાં  
 કામદેવને મોકલે છે.<sup>૧૯</sup> હે રૂપાળા મેધ ! તારામાં પણ તાપ હરવાનો ગુણ હોવાને  
 લીધે તું અવશ્ય ભગવાનનો સખા છે અને તેથી જ પ્રેમથી બંધાઈને તું અમારી  
 પેઠે ભગવાનનું ધ્યાન કરતો જણાય છે. કેમકે બહુ ઉત્કંઠાથી હદ્ય ઘેરાઈ જતાં તું  
 ભગવાનને સંભારી સંભારી અમારી પેઠે જ આંસુની ધારાને વરસાવે છે. અરે !  
 તેની સાથે તારે ભિત્રતા શા માટે કરવી પડે ? કેમકે ભગવાનનો પ્રસંગ તો વારંવાર  
 દુઃખદાયી જ થાય છે.<sup>૨૦</sup> હે સુંદર કંઠવાળી ! હે કોયલ ! તું મુવાને પણ જીવાડે  
 એવી આ કોમળ વાઙ્મીથી ભગવાનના શબ્દો બોલે છે, માટે આજ હું તારું શું પ્રિય  
 કરી આપું ?<sup>૨૧</sup> હે ઉદાર બુદ્ધિવાળા પર્વત ! તું હાલતો નથી અને બોલતો પણ  
 નથી, તેથી કોઈ મોટા વિષયનો વિચાર કરે છે એમ જણાય છે. અમારી પેઠે તું  
 પણ ભગવાનના ચરણને સ્તન ઉપર ધારવાને ઈચ્છે છે કે શું ? જો એમ હશે તો

શુદ્ધદ્રથદા: કર્શિતા બત સિસ્થુપલ્ય: સમ્પત્યપાસ્તકમલશ્રિ ઇષ્ટભર્તુ: ।  
 યદ્વદ્વ વયં મધુપતે: પ્રણયાવલોકમપ્રાપ્ય મુષ્ટુદ્વયા: પુરુકર્શિતા: સ્મ ॥૨૩॥  
 હંસ ! સ્વાગતમાસ્યતાં પિબ પયો બ્રૂહઙ્ગ શૌરે: કથાં  
 દૂતં ત્વાં નુ વિવામ કચ્ચિદજિતઃસ્વસ્ત્યાસ્ત ઉત્તં પુરા ॥  
 કિં વા ન શ્રલસ્તુહદઃ સ્મરતિ તં કસ્માદ્ ભજામો વયં  
 ક્ષૌદ્રાલાપય કામદં શ્રિયમૃતે સૈવૈકનિષ્ઠા સ્ત્ર્યામ् ॥૨૪॥  
 ઇતીદૃશેન ભાવેન કૃષ્ણ યોગેશ્વરેશ્વરે । ક્રિયમાણેન માધવો લેભિરે પરમાં ગતિમ् ॥૨૫  
 શ્રુતમાત્રોઽપિ ય: સ્ત્રીણા પ્રસહ્યાકર્ષતે મન: । ઉરુગાયોરુગીતો વા પશ્યનીનાં કુત: પુન: ॥૨૬  
 યા: સમ્પર્યચરન્પ્રેમણા પાદસંવાહાનાદિભિ: । જગદ્વું ભર્તુબુદ્ધા તાસાં કિં વણર્યતે તપ: ॥૨૭  
 એવં વેદોદિતં ધર્મમનુતિષ્ઠન્ સતાં ગતિ: । ગૃહં ધર્માર્થકામાનાં મુહુશાદર્શયત્ પદમ् ॥૨૮  
 તારી પણ અમારા જેવી સ્થિતિ થશે.<sup>૨૨</sup> હે સમુદ્રની સ્ત્રીઓ નદીઓ ! જેમ અમો  
 ભગવાનનો કૃપાકટાક્ષ નહીં મળતાં હદ્ય ચોરાઈ જવાથી બહુ દુર્બળ થયેલી  
 છીએ, તેમ તમો પણ હમણાં મેઘદ્વારા સમુદ્રનું જળ નહીં મળવાથી, દુર્બળ સુકાઈ  
 ગયેલા ધરાવાળી અને કમળની શોભા વગરની થયેલી છો.<sup>૨૩</sup> અરે રે ! ! !  
 (દેવગતિથી આવેલા હંસને ભગવાનનો દૂત કલ્પીને કહે છે.) હે હંસ ! તું ભલે  
 આવ્યો બેસી જા. દૂધ પી, અને ભગવાનની વાત કર. તું દૂત થઈને આવ્યો છે તે  
 અમે જાણીએ છીએ. કોઈના વશમાં ન થનારા ભગવાન સંકુશણ તો છે ને ?  
 કણિક સ્નેહ રાખનારા ભગવાન, પોતે અમારી પાસે જે આગળ કહું હતું તેને  
 સંભારે છે ? હે ક્ષુદ્રના દૂત ! અમારે ભગવાનનું શું કામ છે ? ભગવાન અમને  
 સંભોગને માટે બોલાવતા હોય તો તેમને જ અહીં બોલાવી લાવ. પણ લક્ષ્મી  
 અમોને ઠગીને એકલી જ ભગવાનને સેવે છે, માટે લક્ષ્મી વિના એકલા ભગવાનને  
 બોલાવી લાવજે. લક્ષ્મી એક નિષ્ઠાવાળી છે માટે તેને શી રીતે મૂકી દેવાય ? એમ  
 તારા મનમાં હોય, તો સ્ત્રીઓમાં લક્ષ્મી જ એકનિષ્ઠાવાળી છે અને શું અમો તેવી  
 નથી.<sup>૨૪</sup> શુકુદેવજી કહે છે શ્રીકૃષ્ણ ભગવાનમાં આવો પ્રેમ કરવાથી ભગવાનની  
 સ્ત્રીઓ પરમગતિને પામી.<sup>૨૫</sup> ઘણાં ગીતોથી ગાતાં અને શ્રવણ કરતાં પણ જે  
 ભગવાન સ્ત્રીઓના મનને બળાત્કારથી ખેંચી લે છે, તે ભગવાનને જોનારી  
 સ્ત્રીઓનાં મન ખેંચાઈ જાય તેમાં શું કહેવું ?<sup>૨૬</sup> જે સ્ત્રી જગતના ગુરુ ભગવાનને  
 પતિ સમજીને પ્રેમપૂર્વક પગ ચાંપવા આદિથી સેવતી હતી, તેઓના તપનું કેટલુંક  
 વર્ણન કરી શકાય ?<sup>૨૭</sup> આ પ્રમાણે વેદોક્ત ધર્મ પાળતા અને સત્પુરુષોના શારણરૂપ

आस्थितस्य परं धर्मं कृष्णस्य गृहमेधिनाम् । आसन् षोडशसाहस्रं महिष्यश्च शताधिकम् ॥२९  
तासां स्त्रीरत्नभूतानामष्टौ याः प्रागुदाहृताः । रुक्मिणीप्रमुखा राजंस्तपुत्राश्चानुपूर्वशः ॥३०  
एकैकस्यां दश दश कृष्णोऽजीजनदात्मजान् । यावत्य आत्मने भार्या अमोघगतिरीश्वरः ३१  
तेषामुद्भामवीर्याणामष्टादश महारथाः । आसन्नुदारयशसस्तेषां नामानि मे शृणु ॥३२  
प्रद्युम्नश्चानिरुद्धश्च दीमिमान् भानुरेव च । साम्बो मधुर्भृहद्वानुश्चित्रभानुरुक्तोऽरुणः ॥३३  
पुष्करो वेदबाहुश्च श्रुतदेवः सुनन्दनः । चित्रबाहुर्विरूपश्च कविर्न्यग्रोध एव च ॥३४  
एतेषामपि राजेन्द्र! तनुजानां मधुद्विषः । प्रद्युम्न आसीत् प्रथमः पितृवद् रुक्मिणीसुतः ॥३५  
स रुक्मिणो दुहितरमुपयेमे महारथः । तस्मात् सुतोऽनिरुद्धोऽभूत्रागायुतबलान्वितः ॥३६  
स चापि रुक्मिणः पौत्री दौहित्रो जगृहे ततः । वज्रस्तस्याभवद् यस्तु मौसलादवशेषितः ॥३७  
प्रतिबाहुरभूतस्मात् सुबाहुस्तस्य चात्मजः । सुबाहोः शान्तसेनोऽभूच्छतसेनस्तु तत्सुतः ॥३८  
न होतस्मिन् कुले जाता अथना अबहृप्रजाः । अल्पायुषोऽल्पवीर्याश्च अब्रह्यण्याश्च जिज्ञेरे ॥३९  
यदुवंशप्रसूतानां पुंसां विख्यातकर्मणाम् । संख्या न शक्यते कर्तुमपि वर्षायुतैर्नृप ! ॥४०

भगवाने घर ज धर्म, अर्थ अने कामनुं स्थानक छे ऐम वारंवार देखाइयुं.<sup>२८</sup>  
गृहस्थाश्रम-वाणाओना उत्तम धर्मने पाणता श्रीकृष्ण भगवानने सोण हजार,  
ऐकसो अने आठ स्त्रीओ हती.<sup>२९</sup> स्त्रीओमां रत्न जेवी रुक्मिणी आहिं जे आठ  
स्त्रीओ प्रथम कुलेली छे तेअोना पुत्रोनां नाम पाण प्रथम आपेलां छे.<sup>३०</sup>  
सत्यसंकल्पवाणा भगवान श्रीकृष्णो जेटली पोतानी स्त्रीओ हती. ते दरेकमां  
दश दश पुत्रो उत्पत्त कर्या हता.<sup>३१</sup> महापराक्तमी ऐ पुत्रोमां अढार तो मोटा  
यशवाणा महारथी हता. तेअोनां नाम मारी पासेथी सांभणो.<sup>३२</sup> प्रद्युम्न,  
दिमिमान, भानु, सांभ, मधु, बृहद्भानु, चित्रभानु, वृक्ष, अरुण, पुष्कर,  
वेदभाषु, श्रुतदेव, सुनंदन, चित्रभाषु, विरुप, कवि अने न्यग्रोध ऐ सतार अने  
अढारमा पद्युम्नना पुत्र अनिरुद्ध ऐ महारथी हता.<sup>३३-३४</sup> हे परीक्षित !  
भगवानना ऐ सर्वे पुत्रोमां पाण रुक्मिणीना पुत्र प्रद्युम्न पोताना पितानी पेठे  
सर्वोत्तम महारथी हता.<sup>३५</sup> ऐ महारथी प्रद्युम्न रुक्मीनी पुत्रीने परश्या हता,  
तेमां तेमने दशहजार हाथीना भगवाणा अनिरुद्ध नामना पुत्र थया हता.<sup>३६</sup> ऐ  
अनिरुद्ध रुक्मीनी पौत्रीने परश्या हता, तेमनो वज्जनाभ नामे पुत्र थयो के जे  
मुश्लेषी थयेला नाशमांथी अवशेष रहेल छे.<sup>३७</sup> वज्जनाभनो प्रतिबाषु, तेनो सुबाषु,  
तेनो शांतसेन, अने तेनो शतसेन नामे पुत्र थयो.<sup>३८</sup> ऐ कुणमां जे ओ जन्म्या हता ते  
कोई निर्धन, थोडी प्रजावाणा, थोडां आयुष्यवाणा के भ्रातृष्णोने न माने ऐवा थया न

तिस्रः कोट्यः सहस्राणामष्टशीतिशतानि च । आसन् यदुकुलाचार्याः कुमाराणामिति श्रुतम् ४१  
संख्यानं यादवानां कः करिष्यति महात्मनाम् । यत्रायुतानामयुतलक्षेणास्ते स आहुकः ॥४२  
देवासुराहवहता दैतेया ये सुदारुणाः । ते चोत्पन्ना मनुष्येषु प्रजा दृमा बबाधिरे ॥४३  
तत्रिग्रहाय हरिणा प्रोक्ता देवा यदोः कुले । अवतीर्णाः कुलशतं तेषामेकाधिकं नृप ! ॥४४  
तेषां प्रमाणं भगवान् प्रभुत्वेनाभवद्धरिः । ये चानुवर्तिनस्तस्य वृवृद्धुः सर्वयादवाः ॥४५  
शश्यासनाटनालापक्रीडास्नानादिकर्मसु । न विदुः सन्तमात्मानं वृष्णायः कृष्णचेतसः ॥४६  
तीर्थं चक्रे नृपोनं यदजनि यदुषु स्वःसरित्यादशौचं ।

विद्विद्वित्स्त्रिधाः स्वरूपं ययुरजितपरा श्रीर्वदथेऽन्यव्यतः ॥  
यन्नामामङ्गलञ्च श्रुतमथ गदितं यत्कृतो गोत्रधर्मः ।  
कृष्णस्यैतत्र चित्रं क्षितिभरहरणं कालचक्रायुधस्य ॥४७॥

हता.<sup>३८</sup> हे राजा ! प्रभ्यात कर्मवाणा यदुवंशमां जन्मेला पुरुषोनी संख्या लाखो वर्षे  
पाण गङ्गी शकाय ऐम नथी.<sup>३९</sup> यदुकुणना असंख्यात कुमारोने भशावनारा अध्यापको  
त्राण करोड अने अठ्याशी सो हता, ऐवुं अमे सांभण्युं छे.<sup>४०</sup> जे द्वारिकाने विषे  
अनेक लाख यादवोनी साथे उत्प्रसेन रहेता हता, ते यादवोनी संख्याने कोश कही  
शक्षे ?<sup>४१</sup> देव अने असुरोना वय्येना संत्राममां जे भयंकर देत्यो भरण पाभ्या  
हता तेओ मनुष्योमां उत्पत्त थैर्गर्वधरीने प्रजाओने पीडता हता.<sup>४२</sup> तेओनो नाश  
करवाने माटे भगवाननी आशाथी यदुकुणमां देवताओ अवतर्या हता. तेओनां  
ऐकसो अने ऐक कुण हतां.<sup>४३</sup> ऐ सर्वे यादवोने श्रीकृष्ण भगवान प्रभुताने लीषे  
प्रमाणरूप हता. भगवानने अनुसरनारा जे यादवो हता तेओ सर्वे वृद्धि पाभ्या  
हता.<sup>४४</sup> जे ओनुं चित भगवानमां ज लागी रह्युं हतुं ऐवा यादवोने सूतां, बेसतां,  
झरतां, बोलतां, रमतां, नहातां अने ऐवां बीजां कर्मो करतां पाण पोताना शरीरनुं  
भान ज रहेतुं न हतुं.<sup>४५</sup> हे राजा ! प्रथम भगवानना यरण धोवाना जणरूप गंगाज्ञ  
ज सर्वोत्तम तीर्थरूप हतां, पाण भगवाननी कीर्तिरूप जे तीर्थ पाइणथी यादवोमां  
उत्पत्त थयुं तेषो ऐ गंगाज्ञने पाण न्यून करी नाभ्यां. श्रीकृष्णना स्नेहीओ अने  
शत्रुओ पाण स्वरूपने पाभी गया, ऐ कांઈ आश्र्य समजवुं नहिं; केमके ऐ महा  
दयाणु हता. कोईने प्राम न थयेल ऐवा परिपूर्ण लक्ष्मी के जेने माटे मोटा मोटा  
देवताओ पाण प्रयत्न करे छे, ते लक्ष्मीज्ञ भगवाननी ज पासे हती, ऐ कांઈ  
आश्र्यरूप नथी; केमके सांभणेलुं अथवा उच्चारण करेलुं भगवाननुं केवण नाम  
पाण अमंगणे मटाइनार छे अने ऋषिओना वंशमां धर्म पाण भगवाने ज यतावेलो  
छे. कणरूपी अने यक्करूप आयुधवाणा ऐ भगवाने पृथ्वीनो भार उतार्यो, ऐ

જયતિ જનનિવાસો દેવકીજન્મવાદો યદુવરપર્ષત્વદોભિરસ્યન્નથર્મમ् ।  
સ્થિરચરવૃજિનિધાઃ સુસ્મિતશ્રીમુહેન વ્રજપુરવનિતાનાં વર્ધયન્ કામદેવમ् ॥૪૮॥

ઇથ્યં પરસ્ય નિજવર્ત્તરિરક્ષયાઽત્તલીલાતનોસ્તદનુરૂપવિડ્ભનાનિ ।  
કર્માણિ કર્મકષણાનિ યદૂતમસ્ય શ્રૂયાદમુષ્ટ પદયોરનૃવૃત્તિમિચ્છન્ ॥૪૯॥

મત્રવસ્તયાઽનુસવમેધિતયા મુંકુંદશ્રીમતકથાશ્રવણકીર્તનચિન્તયૈતિ ।  
તન્દ્રામ દુસ્તરકૃતાન્તજવાપવર્ગ ગ્રામાદ્વાનં ક્ષિતિભુજોપિ યયુર્યદર્થા: ॥૫૦॥

ઇતિ શ્રીમહાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં દશમસ્કન્દ્યે ઉત્તરાર્થ  
શ્રીકૃષ્ણાચરિતાનુવર્ણનં નામ નવતિતમોઽદ્યાય: ॥૫૦॥

ઇતિ દશમસ્કન્દ્યોત્તરાર્થ: સમ્પૂર્ણ:

શ્રીકૃષ્ણાર્થણમસ્તુ

આશ્રયરૂપ કહેવાય જ નહીં.<sup>૪૭</sup> ભગવાન શ્રીકૃષ્ણ સર્વજીવોના આશ્રયરૂપ છે. જો કે એ શ્રીકૃષ્ણ સર્વદા સર્વત્ર રહેલા જ છે, છતાં કહેવા માત્ર દેવકીના ગર્ભ થકી જન્મ ધારણ કર્યો છે. યાદવો વીર પાર્ષદોના રૂપમાં એ શ્રીકૃષ્ણની સેવા કરી રહ્યા છે. જે શ્રીકૃષ્ણો પોતાના ભુજબળથી અધર્મનો નાશ કર્યો છે. જે શ્રીકૃષ્ણ સ્વભાવ સિદ્ધ સ્થાવર જંગમ જીવોના સંસારરૂપી દુઃખને નાશ કરનારા છે, અને જે શ્રીકૃષ્ણ ભગવાનનું મંદ મંદ હાસ્યથી યુક્ત સુંદર મુખકમળ વ્રજની અને પુરની સ્ત્રીઓના હંદયમાં પ્રેમ ભાવનો સંચાર કરી રહ્યું છે. આવા શ્રીકૃષ્ણ આ પૃથ્વી ઉપર જયકારી પ્રવત્તો.<sup>૪૮</sup> પોતાના વેદ માર્ગની રક્ષા કરવા સારુ લીલાથી અનેક અવતાર ધરનાર અને યાદવોમાં ઉત્તમ પરમાત્મા શ્રીકૃષ્ણનાં જે સર્વ ચરિત્રો કર્મબંધનને મટાડનાર છે, તે સર્વ ચરિત્રોને ભગવાનના ચરણની સેવા ઈચ્છનારા પુરષે અવશ્ય સાંભળવાં જોઈએ.<sup>૪૯</sup> દરેક સમયમાં શ્રીકૃષ્ણની સુંદર કથાનું શ્રવણ અને કીર્તન સહિત ચિંતન કરવાને લીધે વૃદ્ધિ પામેલી ભક્તિથી માણસ, ભગવાનનું જે ધામ, કાળના દુસ્તર વેગથી રહિત છે. એવા એ ધામને પામે છે. મોટા મોટા રાજાઓ પણ એવી ભક્તિ કરવાની ઈચ્છાથી જ પોતાના નગર છોડીને વનમાં ગયા હતા.<sup>૫૦</sup>

ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કન્દ્યનો શ્રીકૃષ્ણ ચરિત્ર વર્ણન  
નામનો નેવુંમાં અદ્યાય સંપૂર્ણ.

-: શ્રીમહાગવત દશમ સ્કન્દ્ય સમાપ્ત: :-

ॐ નમો ભગવતે વાસુદેવાય

શ્રીમહાગવત માહાત્મ્ય સંક્ષિપ્ત

અધ્યાય :- ૧

અકે સમયે કથારસના રસીયા શૌનકમુનિએ નેમિધારણ્યમાં બેઠેલા સૂતજીને પૂછ્યું, અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરનાર હે સૂત ! ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યથી મળતો વિવેક કઈ રીતે વધે, મોહમાયાનો ત્યાગ શી રીતે થાય, કળિયુગમાં દુઃખી જીવને શુદ્ધ કરવા ઉત્તમ ઉપાય, શ્રીકૃષ્ણની પ્રાપ્તિ કરાવનાર પવિત્ર સાધન કર્યું છે તે અમોને કહો.

સૂત કહે છે હે શૌનક ! ભવભય હરનાર શ્રીકૃષ્ણને પ્રસંગ કરનાર એવું કળિયુગમાં કાળરૂપી સર્પથી બચાવનાર શાસ્ત્ર તે શુક્દેવજીએ ‘ભાગવત શાસ્ત્ર’ કહ્યું છે. દેવોએ અમૃતના કુંભના બદલામાં મનની શુદ્ધિ કરનાર ભાગવતની કથારૂપ અમૃતની માગણી પરીક્ષિત રાજને કથા સંભળાવવા સભામાં બેઠેલ શુક્દેવજી પાસે કરી, પરંતુ અમભક્ત દેવોને શુક્દેવજીએ કથારૂપી અમૃત આપ્યું નહીં. બ્રહ્માએ સત્યલોકમાં બીજાં સાધનો કરતાં ભાગવત પ્રમાણમાં વધી ગયું હતું. આ ભાગવત બ્રહ્માએ નારદજીને અને નારદજીએ સનત્કુમારોને વિધિના જ્ઞાન સાથે આપ્યું.

સત્તંગમાટે બદરિકાશ્રમમાં આવેલા ચાર સનત્કુમારોએ ત્યાં આવેલા નારદજીને ઉદાસ જોઈ તેમને ચિંતાનું કારણ પૂછ્યું. ત્યારે નારદજીએ જણાવ્યું કે પૃથ્વીપર અનેક તીર્થોમાં ફરતાં ક્યાંય સુખ ન જોયું અને સર્વત્ર અધર્મના મિત્ર કળિયુગની પીડા વ્યાપી ગઈ છે. લોકો અધર્મી બની રોગાદિક ઉપદ્રવોથી પીડાય છે, સંતો વૈરાગીઓ પાંચિ અને ઘરભારી થઈ ગયા છે, પરિવારમાં સ્ત્રીઓ ધડી થઈ ગઈ છે. સાણાઓની બુદ્ધિ સલાહનું ચલણ થયું છે. કન્યાઓ વેચાય છે. પવિત્ર સ્થળોમાં યવનો જામી ગયા છે. જ્ઞાની સત્પુરૂષો રહ્યા નથી. બ્રાહ્મણો વેદ વેચે છે, સ્ત્રીઓ દેહ વેચે છે. ફરતાં ફરતાં જમનાજીને કંઠે ગયો ત્યાં એક યુવાન સ્ત્રી પાસે બે વૃદ્ધ પુરુષો બે ભાન જેવા પડ્યા હતા. સ્ત્રી તે પુરુષોની સેવા કરતી હતી. અને રડતી હતી. સેંકડો સ્ત્રીઓ તેને પવન નાખી હતી. યુવાન સ્ત્રીએ મને કહ્યું સાધુ પુરુષનું દર્શન દુઃખહરનાર, ચિંતાનો નાશ કરનાર છે. આપ મારી ચિંતાનો નાશ કરો. મેં તેની વિગત પૂછી. તો તેણે કહ્યું હું ભક્તિ છું. આ બે વૃદ્ધ તે મારા જ્ઞાન અને વૈરાગ્ય પુત્રો છે. દ્રવિદ દેશમાં જન્મેલી, કણ્ઠાટક-મહારાષ્ટ્રમાં વૃદ્ધ પામેલી, ગુજરાતમાં પાંદડોએ મારાં અંગો ભાંગી નાખતાં પુત્રો સાથે અશક્ત થઈ ગઈ છું. વૃદ્ધાવનમાં આવવાથી જીવાન રૂપાળી થઈ ગઈ છું. હું વૃદ્ધ થવાને બદલે જીવાન થઈ છું. મારા પુત્રો જીવાન

હોવાને બદલે વૃદ્ધ છે. યોગના ભંડારરૂપ હે નારદ ! આમાં જે કારણ હોય તે મને કહો.

ક્ષણવાર વિચારી નારદજીએ કહ્યું હે સુંદરી ! દાસણ કળિયુગથી લોકો અધાસુર જેવા થઈ સદાચાર યોગ તપને તજી શઠતા અને નિય કર્મને વર્યા છે. વિષયોથી અંધ દુષ્ટજો સત્પુરુષોને પીડાતા જોઈ રાજી થાય છે. આવા લોકોએ તારી ઉપેક્ષા કરવાથી તું વૃદ્ધ થઈ ગઈ હતી. જ્યાં ભક્તિ નાચે છે એવા વૃન્દાવનનો યોગ થતાં તું જીવાન રૂપાડી બની ગઈ. તારા પુત્રોને અહીં કંઈક સુખ થવાથી તેમને નિદ્રા આવી ગઈ છે.

ભક્તિએ પૂછ્યું, પરીક્ષિત રાજા અને દયાળું ભગવાને કળિયુગ તેમજ અધર્મને શા વાસ્તે રહેવા હે છે ? હે નારદજી ! તે તમારી સુખદાયક વાણીમાં મને કહો.

નરદજી કહે હે સુંદરી ! પરીક્ષિત રાજાએ કળિયુગમાં રહેલો એક ગુણ જોયો. કે જે ફળ સમાધિથી ન મળે તે કળિયુગમાં ભગવાનના કીર્તનમાત્રથી મળે છે. તેમણે અમરની માફિક આ સાર સ્વીકારી સત્પુરુષોના કલ્યાણને માટે કળિયુગને રહેવા દીધો. જેથી ભગવાનની કીર્તનભક્તિ કરીને લોકો સુખ મેળવે. કળિયુગના પ્રભાવથી હાલમાં ભાગવત કથાનો, તીર્થોનો, તપનો, ધ્યાન અને યોગનો સાર જતો રહ્યો છે. કારણકે લોલી, નાસ્તિક, કોધી, વ્યાકુળ, ઢોંગી, પાખંડી, તૃષ્ણાથી વ્યાકુળ અને પાડાની જેમ પોતાની સ્ત્રી સાથે વિહાર કરનારા પંડિતજીનો સમાજમાં વધી ગયા છે. અને તેમનું વર્ચસ્વ છે.

નારદજીનાં વચ્ચનથી વિસ્મય પામેલ ભક્તિએ નારદજીને કહ્યું, સંત દર્શન ઉત્તમ અને સિદ્ધિ આપનાર છે. મારું અહીં ભાગ્ય કે હું આપનાં દર્શન પામી, દરેક કલ્યાણના પાત્ર આપને હું પ્રણામ કરું છું. ||૧||

નારદજી કહે છે હે સુંદરી ! તું જેમને વહાલી છે, એવા શ્રીકૃષ્ણનું સ્મરણ કર, એથી તારું હુઃખ દૂર થશે. ચૈતન્યમૂર્તિ ભગવાને તને આશા કરેલી છે કે ‘તારે મારા ભક્તોનું પોષણ કરવું.’ તને મુક્તિરૂપ દાસી અને જ્ઞાન તથા ભક્તિરૂપ સાથી આપ્યા. એમને લઈ તું પૃથ્વી પર આવી. કળિયુગમાં તારી ઉપેક્ષાને લિધે તારા બસે પુત્રો નિર્બળ વૃદ્ધ થઈ ગયા છે. હું તેનો ઉપાય કરી ઘેર ઘેર દરેક માણસમાં તારું સ્થાપન કરીશ. ભક્તિવાળા જીવ પાપી હશે તો પણ વૈકુંઠમાં જશે. ચિત્તમાં ભક્તિવાળાને પ્રેત આદિ તત્ત્વો સ્પર્શ કરી શકતા નથી. પ્રેમ ભક્તિથી ભગવાન વશ થાય છે. ભક્તિનો દ્રોહ કરનાર હુઃખી થાય છે. ભક્તિથી જ મુક્તિ મળે છે.

પોતાનું માહાત્મ્ય સાંભળી ભક્તિએ નારદજીને કહ્યું, હે નારદ ! હું સર્વદા તારા ચિત્તમાં રહીશ પછી તેણે પોતાના બેભાન પડેલા પુત્રોને જગાડવા કહ્યું.

નારદજીએ જ્ઞાન, વૈરાગ્ય બસે જગાડવા કાનમાં વેદવેદાંતના શબ્દોથી, ગીતાના શ્લોકથી, મોટા અવાજે જગાડતાં તેઓ માંડ ઉઠ્યા અને આળશાને લીધે ભગવાની પેઠે પાછા પડી ગયા. નારદજી ચિંતામાં પડ્યા, ત્યાં આકાશવાણી થઈ, હે નારદજી શીલવાન સાધુપુરુષો તમને સત્કર્મનો ઉપદેશ કરશે, એ પ્રમાણે સત્કર્મ કરો. એથી આ બસે જાગૃત થશે અને તેનું વૃદ્ધત્વ જતું રહેશે, આકાશવાણી સાંભળ્યા પછી નારદજી ત્યાંથી ચાલી નીકળ્યા. તીર્થ સ્થળોમાં ફરતા ફરતા મુનીશ્વરોને સત્કર્મ અંગે પુછવા લાગ્યા પણ કોઈ પાસેથી ઉપાય મળ્યો નહિ.

ચિંતાતુર નારદજી બદ્રીકાશ્રમમાં ગયા ત્યાં ભાગ્યવશ મુનીશ્વર સનકાદિકનો મેળાપ થયો. નારદજી કહે હે દયાવાન સનકાદિક ! જેનાથી ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યને સુખ થાય અને સર્વવર્ણોમાં તેઓનું સ્થાન થાય તેવું આકાશવાણીએ કહ્યું તે સાધન કર્યું ? અને તે કેવી રીતે કરવું તે દયા કરીને કહો.

સનત્કુમારે નારદજીને કહ્યું હે નારદજી ! ચિંતા કરો નહિ, સત્કર્મ સૂચ્યવનાર સાધન કહું તે સાંભળો, શુકાદિક મુનિઓએ ગાયેલ શ્રીમદ્ભાગવતના આલાપરૂપ એક જ્ઞાનરૂપી વજ્ઞ જ સત્કર્મ સૂચ્યવનારો છે. વેદ, ઉપનિષદ, ગીતાના સારમાંથી થયેલ શ્રીમદ્ભાગવત કથારૂપ ફળ અતિ ઉત્તમ છે. ભાગવતનું પ્રકાશન ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યના સ્થાપન માટે જ કહેલું છે, તેનું શ્રવણ શોક તથા દુઃખનો નાશ કરનારું છે. નારદજી કહે છે હે સનકાદિક ! તમારું દર્શન પાપનો નાશ કરનારું તેમજ ભવદુઃખના દાવાનથી પીડાએલાઓને કલ્યાણ કરનાર છે, તેથી હું આપને શરણે છું. ||૨||

સનકાદિકે કહ્યું, હે નારદ ! હરિદ્વારની પાસે આનંદ નામે તટ છે એ સ્થળે તમારે જ્ઞાનયોગ કરો, ભાગવતની કથા થતી હોય ત્યાં ભક્તિ પોતે જ્ઞાન તથા વૈરાગ્યને લઈને આવે એવો નિયમ છે. એટલે એ ત્રણે કથા પ્રસંગે આવશે. આ સાંભળી સનકાદિક ભાગવતનો મહિમા સંભળાવે તે માટે તેમને લઈ આનંદ તટે આવ્યા.

સનકાદિકો મહાત્મા નારદજીને ભાગવત કથાનું મહાત્મ્ય કહેવા લાગ્યા, ભાગવત કથા ઘટને તીર્થરૂપ બનાવે છે હજારો યજ્ઞો તેના સોણમા ભાગ જેટલા પણ નથી. ભાગવત કથાનો સાર્થ પાદ કરનારાં અનેક જનમાં પાપ નાશ પામે છે. મૃત્યુ સમયે ભાગવત સાંભળનાર વૈકુંઠમાં જાય છે. અને જેને ભાગવતની કથા સાંભળી નથી તેનો જન્મ વૃથા છે.

સનકાદિકોએ આ રીતે સભામાં ધર્મનો પ્રકાશિત કરવા માંડ્યો તે સમયમાં ભગવાનના નામનો ઉચ્ચસ્વરે આલાપ કરતી ભક્તિ પોતાના બે યુવાન પુત્રો સાથે પ્રગટ થઈ, અને નમ્રભાવે સનત્કુમારને કહ્યું, કથારસનું પાન કરાવી તમોએ મને

હમણાંજ પૃષ્ઠ કરી છે હવે મારે ક્યાં રહેવું તે આજા કરો. સનકાદિકે તેને કહ્યું, વૈર્યશાળી વૈષ્ણવોના ચિત્તમાં રહો એટલે કળિયુગના પ્રબળ દોષ તારી સામે પણ જોઈ શકશે નહીં. આ સાંભળીને ભક્તિ ભગવાનના દાસોના ચિત્તમાં જઈ નિવાસ કર્યો, જેના ચિત્તમાં શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ વસે છે તેના ચિત્તમાં ભગવાન પણ પ્રવેશ કરે છે. અને ભાગવત સાંભળનારને પણ ભગવત્સમાનપણું પ્રામ થાય છે. ॥૩॥

વैષ્ણવોના ચિત્તમાં ભક્તિને જોઈને ભગવાને તેઓના ચિત્તમાં પ્રવેશ કર્યો, સર્વે શ્રોતાઓને કથા શ્રવણથી દેહ, ધર, સ્વભાવનું વિસ્મરણ થઈ ગયું, નારદજીએ પૂછ્યું, હે મુનીશ્વરો ! ભાગવત કથાનું શ્રવણ કરવાથી કોણ કોણ શુદ્ધ થાય છે તે મને કહો. સનકાદિકે કહ્યું, કોઈ પણ પ્રકારનું પાપ કરનાર કોધી, કુટીલ, કામી, પંચમહાપાપ કરનાર, નિર્દ્ય, મન-વાણી કાયાથી પાપ કરનાર તમામ કળિયુગમાં ભગવાનની કથા યજથી પવિત્ર થાય છે.

ત્યારપછી શનકાદિકે આ વિષયમાં જુના વખતની એક ઘટના કહી. આત્મદેવ નામે બ્રાહ્મણની મનયલી પણી ધુંધલી હતી. આત્મદેવે સન્તાન પ્રાપ્તિ માટે સન્યાસીએ આપેલું ફળ ધુંધલીને ખાવા માટે આપ્યું પણ તેણે તે ફળ ગાયને ખવડાવી દીધું. સમય જતાં પોતાની બહેનને જન્મેલ પુત્ર પોતાને ઘેર લાવી પોતાને પુત્ર થયાની વધામણી આત્મદેવને આપી, વળી કહ્યું કે મારી બહેનનો પુત્ર જન્મીને મરી ગયો છે તેથી તે આ પુત્રનું પોષણ કરશે, બીજી બાજું બાજું ગાયને ફળ આપ્યું હોવાથી ગાયના પેટે બાળકનો જન્મ થયો. એ બાળક રૂપાળો, દિવ્ય, સોનેરી કાન્તિવાળો હતો, આ ઘટનાનું રહેસ્ય કોઈના જ્ઞાણવામાં આવ્યું નહિ. તેના કાન ગાયના સરખા હોવાથી તેનું નામ ગોકર્ણ રાખ્યું, ધુંધલીના પુત્રનું નામ ધુંધુકારી રાખ્યું, ગોકર્ણ પંડિત અને જ્ઞાની થયો. જ્યારે ધુંધુકારી મહા ખડ દુરાયારી થયો, અને પિતાના ધનનો નાશ કર્યો.

ભીખારી હાલતમાં આવેલો આત્મદેવ દુઃખી થઈ રડતો હતો. ત્યારે ગોકર્ણ આવી પિતાને બોધ આપ્યો કે, સંસારમાં કયાંય સુખ નથી, દિકરા, ધન અને ચક્કવર્તી રાજ્યમાં પણ સુખ નથી પરંતુ વૈરાગ્યવાળા એકાંતવાસી મુનિને સુખ છે. માટે તમે આ દેહ પણી જ્યાં તે પહેલાં વનમાં જાઓ. દેહમાં અભિમાન છોડી સ્ત્રી, પુત્રની મમતા મુક્તી દઈ જગત ક્ષણાભંગુર છે એવો નિરંતર વિચાર કરવો. વૈરાગ્યમાં વૃત્તિ રાખી ભક્તિમાં નિષ્ઠા રાખવી, ધર્મ તથા સાધુ પુરુષોનું સેવન કરવું અને વિષય તુલ્ણાનો ત્યાગ કરી ભગવત્કથારસનું પાન કરવું.

વૃદ્ધ આત્મદેવ પુત્ર ગોકર્ણ આપેલ બોધથી વનમાં ગયા. સ્થિરચિત્તવાળા થઈ ભગવત્સેવા પરાયણ રહ્યા. ભાગવત દશમક્ષણના પાઠનો નિત્ય નિયમ ધારી શ્રીકૃષ્ણ

પરમાત્માને પાભ્યા. ॥૪॥

પિતાના મૃત્યુ પછી ધુંધુકારી પૈસા માટે માતાને ત્રાસ દેતો તેથી ધુંધલી કુવામાં પડી મરી ગઈ. ગોકર્ણ તીર્થયાત્રામાં નીકળી ગયા, ધરમાં એકલા પડેલ ધુંધાકારીએ પાંચ વેશયાઓ રાખી. તેમને રાજી કરવા ચોરી કરી ધન, ધરેણાં આદિ લઈ આવતો. વેશયાઓએ વિચાર્યુ કે આ ચોરી કરે છે તેથી રાજા એને કોઈકવાર પકડશે. અને ધન પણ લઈ જશે. તેમણે ધુંધુકારીને મારી નાખ્યો અને બધું ધન ધરેણાં લઈને ચાલી ગઈ. કર્મનો મહેલો ધુંધુકારી મોટો પ્રેત થયો. ટાઢ, તડકો, ભૂખ, તરસ વગેરેથી પીડાતો વંટોળિયા રૂપે દર્શામાં દોડતો રક્ષણ કે શાન્તિ વગર તે હાય દૈવ કરતો હતો.

સમય જતાં ગોકર્ણો તેનું મૃત્યુ થયાનું જાણી તીર્થોમાં તેનું શાદ્ધ કરતા કરતા પોતાના ગામમાં આવ્યા. ધુંધુકારીએ મધરાતે ગોકર્ણને વિકરાળ રૂપ બતાવા માંડયું. પાડો, અન્ન, પુરુષ એવાં રૂપ બતાવ્યાં. અલ્યા તું પ્રેત, પિશાચ, રાક્ષસ છે કે કોણ છે ? ગોકર્ણ એમ પુછતાં તે બોલ્યો હું તમારો ભાઈ ધુંધુકારી છું. મારા કુકર્માથી પ્રેત થયો છું, હે દયાળુ ભાઈ ! મને આ યોનિમાંથી મુક્ત કરો, ગયાજીમાં પિંડદાન કરવા છિતાં ધુંધુકારીની મુક્તિ થઈ નહિ તેથી ગોકર્ણને વિસ્મય થયો, સવારે મળવા આવેલા વિદ્વાનો સાધુપુરુષો આદિ લોકો સાથે વાત કરી અને શાર્દ્રો પણ જોયાં, પરંતુ ધુંધુકારીને પ્રેતમાંથી છુટકારો આપવાનો ઉપાય ન મળવાથી સૂર્યનારાયણને પ્રેત મુક્તિનો ઉપાય પૂછ્યો. એટલે સૂર્યનારાયણે કહ્યું કે શ્રીમહભાગવતથી પ્રેતની મુક્તિ થશે, માટે ભાગવતની સમાહ પારાયણ કરો.

ગોકર્ણ કથાનું આયોજન કર્યું, કથા સાંભળવા અનેક લોકો પોતાના પાપનું નિવારણ થાય તે માટે આવ્યા. ધુંધુકારી પણ આવ્યો, ત્યાં સાત ગાંઠવાળા એક પોલા વાંસને જોઈ પોતે તેના મૂળના ધીક્રમાં પ્રવેશ કરી કથા સાંભળવા બેઠો, પ્રથમ દિવસે સાંજે કથા પૂર્ણ થઈ ત્યારે વાંસની એક ગાંઠ ભારે અવાજ સાથે તૂટી, એ રીતે દરરોજ એક એક ગાંઠ તૂટે અને સાતમા દિવસે સાંજે સાતમી ગાંઠ તૂટી અને ધુંધુકારીનું પ્રેતપણું ટળી ગયું. અને તે દિવ્ય રૂપવાળો પુરુષ બની ગયો. તે પોતાના ભાઈ ગોકર્ણને પગે લાગ્યો અને કહ્યું, ભાગવતને ધન્ય છે અને તમને પણ ધન્ય છે, કે જે કથા સાંભળવાથી મારી મુક્તિ થઈ. એટલામાં તો ભગવાનના પાર્ષદો ધુંધુકારીને વેકુંઠમાં તેડી ગયા. આ રીતે ધુંધુકારી પરમ મોક્ષને પાભ્યો. ॥૫॥

આ રીતે જે મનુષ્યો સાત દિવસ ઉપવાસ કરી સ્થિર ચિત્તે ભાગવતકથા સાંભળે છે તેનો પણ અવશ્ય મોક્ષ થાય છે.